

# સાંદુરંજિન દ્વારા પ્રયોગો


લેખક : સંઘવી બાબુલાઈ ગીરધરલાલ કડીવાળા

આંગં

અનુભ

શ્રીસત્કાળિં

શાન્તિ



•પ્રકાશક•

બાબુલાઈ કડીવાળા એરીટેબલ ડ્રસ્ટ સંચાલિત



દાઈલ પેજના ચિત્રની સમજ  
પ્રયોગ નં. ૫

સાધકના હૃદયમાં બીરાજમાન  
પરમાત્મામાંથી હિંય શુણો અને  
શક્તિએનો વિસ્ક્રોટ થાય છે. (૧)  
ગ્રેમ-કર્દણા (૨) આનંદ (૩) સુખ  
(૪) શક્તિ (વીર્યશુણ) (૫) શુણ  
સમૃદ્ધિનો વિસ્ક્રોટ થએ સાધકમાં  
હેલાય છે. સાધકના અણુએ અણુમાં  
તે હિંય શક્તિએ કાર્યશીલ થાય  
છે. તેથી સાધક સ્વયં ગ્રેમ-કર્દણા  
આનંદ, સુખ, શક્તિ, શુણ સમૃદ્ધિ  
દ્વારા બને છે. જીવનને પરીપૂર્વ સર્જાતા  
પરાકાણાએ પહેંચી જવાશે.



# સાલંખન ધ્યાનના પ્રચોરો

Practice of Jain Meditation  
By Bbubhaai Kadiwala

પ્રેરક : પ. પુ. અધ્યાત્મયોગી, નમસ્કાર મંત્ર સંનિષ્ઠ,  
યોગાત્મા, પૂ. પં. શ્રી લદુંકરવિજયજી મહારાજ સાહેબ

લેખક : સંઘવી બાળુભાઈ ગિરધરલાલ કડીવાળા

## : પ્રસ્તાવના :

પરમ પૂજ્ય બાપજી મહારાજના સમૃદ્ધાયના  
પરમ પૂજ્ય, પરમાત્મલાલ સનિષ્ઠ, આગમ વિશારદ  
શ્રી જંખૂવિજયજી મહારાજ સાહેબ

## : પ્રકાશક :

બાળુભાઈ કડીવાળા ચેરીટેબલ ફસ્ટ

૨૨, મહાવીરનગર, નરસારી.

પ્રથમ આવૃત્તિ સંવત ૨૦૪૩

મૂલ્ય : રૂ. ૨૫-૦૦



**ગુપ્તાનામ :**

(૧) શ્રી જૈન પ્રકાશન મંદિર  
શ્રી જશવંતલાલ ગીરખરલાલ  
૩૦૬/૪ ખત્રોની ખડકી,  
દોશીવાડાની પેણ,  
અમદાવાદ. ૩૮૦૦૦૧

(૩) શ્રી સેવાંતીલાલ વી. જૈન  
૨૦, મહાજન ગલી,  
ભીજે માળે, અવેરી બંજર,  
મુંબઈ નં. ૩. ૪૦૦૦૨

(૨) સોમયંદ ડી. શાહ  
જીવન નિવાસ સામે,  
પાલીતાણા. ૩૬૪૨૭૦

(૪) શ્રી અમરસીલાઈ  
એસ. ટી. લુક સ્ટોલ,  
શાંખેશ્વર તીર્થ. ૩૮૪૨૪૫

(૫) આધ્યાત્મિક સંશોધન અને ધ્યાન કેન્દ્ર  
C/O બાબુભાઈ કરીવાળા  
૨૨, મહાવીર નગર,  
નવસારી. ૩૬૬૪૪૫  
ટે. નં. ૩૧૩૬ (૨હેઠાણ)  
૧૨૦૭ (ઓફિસ).

આ પુસ્તક વાચ્યા પછી આપના હૃદયમાં જે ભાવ  
ઉત્પન્ન થાય તે સંબંધમાં પત્ર લેખકના સરનામે લખવા  
વિનંતી છે. બીજુ આવૃત્તિમાં આપના હૃદયની ભાવના  
છાપવા પ્રયત્ન કરીશું.

## ગુરુચરણારવિદે

યેન જ્ઞાનપ્રદીપેન, નિરસ્યાલ્યંતરં તમઃ ।

મમાત્મા નિર્મલીયઙે, તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥

પરમપૂજય અધ્યાત્મયોગી નમસ્કાર મહામંત્ર સનિનષ્ટ, પંન્યાસળ  
ભાગવંત શ્રી લદંકરવિજયાલ મહારાજ સાહેખને કોટિ કોટિ  
વ'હુના !

આજથી ૩૦ વર્ષ પહેલાં લીલાડીયાલુ તીર્થમાં વિ. સં.  
૨૦૧૩ના ચૈત્રી ઓળણીની આરાધના પ્રસંગે આપનો પરિચય થયો.  
ન્યૂરથી આપે વારંવાર ભક્તિરસના અંકુર પ્રગટ્યાંબા. પાંચ વર્ષ  
સુધી આરંભ-સમારંભના વેપારના ત્યાગનો નિયમ કરાવ્યો.

વિ. સં. ૨૦૧૪ના પાનસર તીર્થ ચૈત્રી ઓળણીના પ્રસંગે આપ  
કૃપાળુંથે શ્રી વર્ધમાન તપનો પાયો નંભાવી, તપધર્મનો સંઘેગ  
સુસૂચના તથા ધ્યાનનો વિધિ બતાવી સાધનામાર્ગમાં પ્રવેશ કરાવ્યો.

વિ. સં. ૨૦૧૪ના ડીસાના ચાતુર્મસ દરમિયાન આસોની  
ઓળણીના પ્રસંગે આપશ્રીએ અનુષ્ઠાન કરીને વિધિપૂર્વક એક લાખ  
નવકારની આરાધના કરાવી, જપયોગ, ધ્યાનયોગ અને પ્રતિદિન  
સિદ્ધ્યકુનું આરાધન કરવાની પ્રેરણા આપી તથા પ્રસંગે પ્રસંગે પૂજન  
મંત્ર, યંત્રનો સમન્વય કરાવી મહાન ઉપકાર કર્યો.

ત્યારથાદ આપશ્રીની વાત્સલ્યમાં પાવન નિશ્ચામાં બેડા,  
શાખેશ્વર અને જમનગર એમ ત્રણે સ્થળે ખીરનાં એકાસખાપૂર્વક  
વિધિ સહિત એક એક લાખ નવકારના જપનું અનુષ્ઠાન કરતાં  
આપની કૃપાથી અપૂર્વ આનંદ અનુભંગો.

વળી નિત્યની આરાધના તથા સિદ્ધ્યક પૂજન ન થાય ત્યાં  
સુંધી પરચ્છભાણ ન પારવું તેનો સંકલ્પ કરાવી, પરમાત્માની નિર્ણા-  
ભૂર્ભૂતી આરાધનાનો માર્ગ બતાવી સેનકને કૃતાર્થ કર્યો.

વિ. સં. ૨૦૩૧-૩૨માં ભૂળ વિધિથી ઉપધાન તપતું વહનનું  
કરાવી આપશીએ મોક્ષની માળા પહેરાની સાધના માટે અપૂર્વ  
આવોલ્લાસ પ્રગટાયો.

વિ. સં. ૨૦૧૪થી ૨૦૩૩ સુધી એટલે કે ૧૬ વર્ષ સુધીની  
અવારનવાર આપશીના સંપર્કનો સતત લાલ મળતો જ રહ્યો. જ્યારે  
જ્યારે 'આપશી પાસે વસવાતું થયું', ત્યારે ત્યારે આપશીએ કરુણાપૂર્વ  
હૃદયથી ઢીક ઢીક સમય આપને મોહંધકારથી વ્યાપ્ત મારા હૃદયરૂપી  
નયનને જિનપ્રવચનદ્વય અમૃતનું અંજન કરાયું. અનેક એકાન્ત  
આગ્રહની પકડમાંથી મને છોડાયો. આત્માનું અને પરમાત્માનું  
પરમ સૌદર્ય સમજાયું. "આત્મસવરૂપનો અનુભવ પ્રાપ્ત કરવો એ  
આ જીવનનું ધ્યેય છે." એમ નક્કી કરાયું. જિનશાસનનું વ્યવહાર  
અને નિશ્ચય ઉભયાંમાં સ્વરૂપ સમજાયું. પરમાત્મપદ્ધતિ પ્રાપ્તિના  
ઉપાયો બતાવી, પરમાત્માના દર્શન, મિલન, પૂજન અને સ્પર્શનનો  
દિવ્યમાર્ગ બતાવી આત્મામાં પરમાત્મલાવનો અનુભવ પ્રાપ્ત કરવાનું  
તત્ત્વામૃત પાયું, અને મોક્ષમાર્ગ સંચરવાની દિવ્ય કળા શીખવાડીને  
આ દાસ ઉપર મહાન ઉપકાર કર્યો.

માતા જેમ પોતાના બાળકની સારસંભાળ રાખે, પિતા જેમ  
પુત્રને ડેળવવા માટેની કાળજી રાખે, શુરુ જેમ શિષ્યોમાં સહવિદ્યાનો  
વિનિમય કરે અને પરમાત્મા ને રીતે પોતાની કરુણાને પાત્ર-અપાત્રનો  
વિચાર કર્યા સિવાય વરસાવે તે રીતે આપે મારા જેવા તુચ્છ, સંસારમાં  
ક્ષાયકાળ, અવિનયી, અપરાધી અને અજ્ઞાની જીવની માતાની જેમ  
સંભાળ રાખ્યી, પિતાની જેમ ધાર્મિક વ્યવહારનો બોધ આપ્યો,  
શુરુની જેમ મારા જીવનમાં આત્મસાધનાનો માર્ગ બતાવી મારા જીવનમાં  
સાધનાનું સંપ્રદાન કર્યું અને પરમાત્માની જેમ પ્રેમ, કરુણા અને  
વાતસલ્ય આપ્યાં. આ રીતે મારા ઉપરના આપશીના અનંત ઉપકારને  
અનંત અનંત વાર પ્રણામ કર્દાં છું, સમયે સમયે યાદ કર્દાં છું.

મારા જેવા સંસારના ક્ષાયકાળ ક્ષાયકાળ એક પામર આત્માથી

નમસ્કાર મહામંત્રના વિષયમાં “જીવનની સર્વાંગે કળા શ્રી નવકાર” પુસ્તક તૈયાર થયું અને નવપદ-સિદ્ધચક્ષુના વિષયમાં “શ્રીપાલ અને ભક્તશ્રદ્ધાના આધ્યાત્મિક જીવન રહસ્યો” પુસ્તક તૈયાર થયું છે. તેમાં ડેવણ આપશીની દૃપાનો જ પરમ પ્રલાવ છે.

જૈન શાસ્ત્રો અને આપના દિવ્ય અનુભવોના આધારે આપે સં. ૨૦૨૪ થી અનેક ધ્યાન પ્રયોગો શીખવવાનું શરૂ કર્યું. અને તે મુજબ આપની નિશ્ચાયે સાધના કરાવતા. સાધનામાં થતી અનુભવો ઉપરથી સાધનાના વિકાસ માટે આપ નવા નવા ધ્યાન પ્રયોગો શીખવવાની દૃપા કરતા જ રહ્યા. તે રીતે ૧૬ વર્ષ સુધી એટલે ૨૦૩૩ સુધી આપે ધ્યાન સંબંધી માર્ગદર્શન આપી મારા ઉપર દિવ્ય ઉપકાર કર્યો.

આપની પાસેથી પ્રાપ્ત થયેલ દિવ્ય ધ્યાન પ્રક્રિયાનો લાલ ચોઝ્ય આત્માઓને પ્રાપ્ત થાય તે હેતુથી આ પુસ્તક તૈયાર થયું છે, તેમાં આપની મહાન પ્રેરણા જ કામ કરી રહી છે.

આપના લોહીના આણુંચે આણુમાં નમસ્કાર મહામંત્રનું ગીત ગૂંજ રહ્યું હતું. આપના આત્માના પ્રદેશો પ્રદેશો વિશ્વ કલ્યાણની ભાવનાનું સંગીત શુંભરવ કરતું હતું. આપના હૃદ્યના ધર્મકારે ધર્મકારે “અહુ”ના નાદનો ધ્વનિ ચાલતો હતો.

મારા આત્મકલ્યાણને માટે, મને સંન્માર્ગ વાળવા માટે આપશીએ અંથાગ પ્રયત્ન કર્યો છે, મને ધર્મ માર્ગદર્શન આપ્યું છે અને તે માર્ગ ચાલવાનું બળ કરણાના સાગર, દૃપાના અવતાર, વાત્સલ્યના પરમ ભંડાર હેવાધિહેવ પરમાત્મા નિરંતર મને આપતા રહે અને મારા માટેની આપશીની બધી અલિકાષાઓ પાર પડે તેવી પ્રલુને હાર્દિક પ્રાર્થના કરું છું.

૨૦૪૩, દ્રાગણુ સુદ ૬

જિરનાર તીર્થ

આપનો ચરણકિંડર

બાળુ કડીવણાના

આપના ચરણકમળમાં ડેટિ ડેટિ  
ભાવભર્યા નમસ્કાર ॥ ॥

## પ્રકાશકીય નિવેદન

પરમ શાસ્ત્રન પ્રભાવક, ગવચાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદ્વારા શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યરતન, નમસ્કાર મહામંત્ર અને નવપદના પરમ આરાધક, અધ્યાત્મયોગી, પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રી લદ્રંકરવિજયજી મહારાજની કરણાદિષ્ટના મહાન અભાવથી ‘સાલાંખન ધ્યાનના પ્રયોગો’—આ પુસ્તક પ્રગટ કરતાં અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ.

પરમ પૂજ્ય સંઘસ્થદ્વિર પૂજ્ય બાપજી મહારાજના સમૃદ્ધાયના પરમાત્મભાવ સંનિષ્ઠ, આગમ વિશારદ પૂ. જાંખૂવિજયજી મહારાજ સાહેબે આ પુસ્તકની પ્રતીવાના લખી આપી અમારા ઉપર મહાન ઝ્યાં કરી છે. શ્રી જિન આગમના સંશોધન અને પ્રકાશનમાં સદા રક્ત શ્રી જાંખૂવિજયજી મહારાજે પોતાના હૃદયમાં રહેલ ધ્યાન શક્તિનો પ્રભાવ આ પ્રસ્તાવનામાં ખતાવી અમારું ઉપર મહાન ઉપકાર કર્યો છે.

વર્તમાન જગતમાં ઉપલબ્ધ લૌટિકતાની પરાકાઢાએ પહેંચ્યા પછી, શરીરની સગવડો ધાર્થી મળવા છતાં માણસ આને માનસિક રીતે પીડાઈ રહ્યો છે. સૌ ડાઈ આમાંથી છુટકારો રોધે છે. સૌ ડાઈ મનની પ્રસન્નતા, શાંતિ, આનંદ, સુખ, નિર્ભયતા ઈચ્છે છે. આ બધું ડેવી રીતે મળે તે જ આપણી સમક્ષ સૌથી મોટા પ્રશ્ન છે, તે માટે મનની સ્થિતિ બદલવી જરૂરી છે.

મનની સ્થિતિ બદલવા આપણી પાસે “સાલાંખન ધ્યાન” એક અદ્ભુત ઉપાય છે. આ પ્રયોગો દ્વારા ધ્યાનમાં આપણે પરમાત્માનું સાનિધ્ય અનુભવી શકીએ છીએ. પરમાત્મા અચિંત્ય, અનંત શક્તિ, પરમ આનંદ અને અન્યાન્યાધ સુખના દિવ્ય લંડાર છે. તેમનું

સાનિધ્ય અનુભવવાની, પરમાત્માનું દિવ્ય મિલન કરવાની પ્રક્રિયાઓ આ પુસ્તકમાં બતાવવામાં આવી છે.

નેવી રીતે લોખંડના જોગાને અભિનમાં રાખવામાં આવે તો તે અભિના બાળવાના ગુણુને ધારણું કરે છે, તેવી રીતે પરમાત્માના ધ્યાનથી પરમાત્મા સાથે તન્મયતા, તદ્દુપતા, અને એકતા સધારણ છે. તે વખતે સાધકમાં પરમાત્માની શક્તિઓ કાર્યશીલ થાય છે. સાધકમાં પરમાત્માના ગુણોને આવિલાવ થાય છે. વળી, આને લીધે અનુષ્ણની જૂની ટેવોમાં પરિવર્તન થતાં તેને નવું મન, નવું જીવન, — દિવ્ય જીવન મળે છે. શોક, ચિંતા, અશાંતિ, અને લથના સ્થાને આનંદ, સુખ, શાંતિ અને નિર્બિદ્ધતાથી પરિપૂર્ણ જીવન અનુભવાય છે.

આ પુસ્તકમાં બાળકથી માંડાને આત્મરમણલા સુધીની સ્થિતિ ઉત્પન્ન થાય તેવા અનેક પ્રયોગો બતાવવામાં આવ્યા છે. આપણે આપણી પ્રાકૃત સ્થિતિમાંથી ઉત્તરોત્તર આગળ પ્રગતિ કરવાની છે. દરેક ચોતાની ભૂમિકા પ્રમાણે આગળ વધવાનું છે. વર્તમાન કાળમાં જગતમાં અનેક પ્રકારનાં ધ્યાન કરવામાં આવે છે. જૈન પૂર્વાચાર્યોની ધ્યાનયોગના વિષયમાં અનેક અંદ્રોમાં અનેક સ્થળે કહ્યું છે. પૂ. પ. લદ્રંકરવિજયજી મહારાજ સાહેબ આપણા સમયના એક પરમ ધ્યાનયોગી પુરુષ થઈ ગયા છે. આ પુસ્તકના લેખકને તેમની પાસે ૨૩ વરસ સુધી રહેવાનો સુયોગ પ્રાપ્ત થયો હતો. આપણા પૂર્વાચાર્યો રેચિત અંદ્રો અને અનુભવના આધારે પૂજ્ય ગુરુમહારાજ પાસેથી પ્રસારારપે અનેક અનુભવસિદ્ધ ધ્યાન પ્રક્રિયા આ પુસ્તકના લેખકને મળી હતી. વધેરે સુધી તે ધ્યાન પ્રક્રિયાનો પ્રયોગાત્મક અભ્યાસ કર્યો પણી, તેમાંથી પ્રાપ્ત થયેલ અનુષ્ણલનું અવલંખન લઈને આ અંધળાં લેખકે અનેક ધ્યાન પ્રયોગો બતાવ્યા છે. જૈન શાસનમાં ધ્યાનયોગ માટે કે પ્રક્રિયા બતાવવામાં આવી છે તે જાણ્ણીને હરડાઈને આનંદ

થશે. ને કોઈ આ પ્રયોગોની સાધના કરશે તે જ તેના ફળ સુધી પહોંચી શકશે. ધ્યાનના ફળ સુધી પહોંચવા માટે માત્ર તેનું વાંચ્યત કે વિચારણા પર્યાપ્ત નથી, પરંતુ ધ્યાનના પ્રયોગનું જીવનમાં નિષ્ઠા-પૂર્વક આરાધન કરવાથી જ અનુભવ સુધી પહોંચી શકાય છે.

સાલંબન ધ્યાનના પ્રયોગો દ્વારા મન અદ્વાતી શકાય છે. જૂની ટ્રેનેનું પરિવર્તન કરી શકાય છે. આ પુસ્તકમાં અનુભવસિદ્ધ પ્રયોગો છે. આ પ્રયોગો દ્વારા જીવન પરિવર્તન થાય છે. આર્તી-રૌદ્ર ધ્યાનના સ્થાને ધર્મધ્યાન; દુઃખ, લય, શોક, ચિંતાને બદલે સુખ, શાંતિ, અનંદ, નિર્ભયતા; જગતના પદ્ધતીઓ તરફની આસક્તિને લીધે થતી તાણ (temptation) ને સ્થાને પરમાત્મા પ્રત્યેની અભિમુખતા અને તેથી દિવ્ય આનંદ અને સુખની અનુભૂતિ; કોષ, માન, માયા, દોષથી થતા વ્રાસમાંથી છુટકારો મેળવી જીવ ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષનો આનંદ મેળવે છે. ઈર્ષા, અનુયા, સ્વાર્થવૃત્તિ, વૈર, વિરોધના સ્થાને મૈત્રી, પ્રેમ, વાત્સલ્ય, પ્રમેદ, કરુણાથી સાંદર્ભનું હૃદય ભિષરાય છે. ભૌતિકતાને સ્થાને આધ્યાત્મિકતાના દ્વાર ખૂલે છે. અને દિવ્ય આનંદ, અવ્યાધાધ સુખ, અચિંત્ય શક્તિના લંડાર આત્મતત્વનાં દ્વાર ખુલ્લાં થઈ જય છે. વ્યક્તિત્વનું ડોચ્ચલું તુરીને અમર્યાદ અમરત્વ તરફ પ્રયાણ શરૂ થાય છે. જન્મારે આપણું મન પરમાત્માના ચિંતન તરફ વળે છે, ત્યારે બંધું જ સુલભ થવા લગે છે. પરમાત્માની અનંત કરુણાશક્તિ સાધકને અમર્યાદ આનંદ અને સુખના લંડાર આત્મામાં ડૂની રીતે લઈ જય છે તેનો પ્રત્યક્ષ અનુભવ આ પુસ્તકના પ્રયોગો દ્વારા થાય છે. વળી, મિથ્યા દર્શનું સ્થાને સમ્યગુદ્ધર્થન જાગે છે, અને આપણું ને વાસ્તવિક દિવ્ય જીવન લાદે છે. સાલંબન ધ્યાનના પ્રયોગો તો ચેતના જીર્ણગમનની દિવ્ય પ્રક્રિયા છે.....

દુટાલીક જગ્યાએ ધ્યાનમાં ભાવિત બની નિસ્થર થવા માટે વર્ચે

વચ્ચે પ્રાર્થનાએ મૂળેલી જગ્યાશે. ધ્યાનમય પ્રાર્થના એટલે ફરી ફરી શર્જદો ઉત્ત્યારવા એમ નથી. ધ્યાનમય પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગુણ વાતાવાપ, પરમાત્માના ગુણ અને સ્વરૂપનું ચિંતન અને તે દારા અનુભવ. પ્રાર્થના દારા અંતે આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન થાય છે.

ભાવના ભવનાશની છે. આ પુસ્તકના પ્રયોગોમાં ને ભાવના અતાવી છે, તેમાં ડેટલાક પ્રયોગોમાં auto suggestion સવયંસૂચનની પ્રક્રિયા પણ છે. આજની ભાષામાં તેને ખેન વેશીંગ Brain washing કહી શકાય. ને કે ભાવના તો તેના કરતાં પણ જીંચી વસ્તુ છે. ભાવના દારા મનુષ્યના જૂના સંસ્કારો ધોવાઈ જાય છે અને નવા સંસ્કારો જાગે છે.

પાણી પણ અમૃત છે. એ અમૃત છે એવું ભાવના કરવાથી પાણી પણ અમૃતરષે ક્રોણ તેવું ભી કલ્યાણમંહિર સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દીવાકર સૂરીશ્વરજી મહારાજ કહે છે. ભાવના દારા એક બિન્દુ એવું આવે છે કે જેનાથી જીવનની દિશા પરિવર્તન થાય છે. આ પુસ્તકમાંના પ્રયોગોમાં ઘણા સ્થળે આ સિદ્ધાંતની પ્રતીતિ થશે. પ્રથમ 'આમુખ' વાંચ્યા પછી જ આગળ પુસ્તક વાંચ્યા.

શ્રી બાળુલાઈ કડીવાળાને ગુરુકૃપા દારા મળેલ ધ્યાન સાધનનાં અદ્ભુત રહસ્યોના આપ સર્વને ભાગીદાર બનાવવા માટે આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. સાધના દારા પ્રાપ્ત થયેલ અણુમેલ રત્નોનો લાલ આપ - વાયક મિત્રોને મળે તે હેતુથી જ આ પ્રકાશન કરતાં અમે દિવ્યાનંદ અનુભવીએ છાએ. આ પુસ્તકમાં લખેલ ડેટલીક હક્કાક્રતો સાધના દારા જ સમજય તેવી છે. ડેટલીક વસ્તુ ધ્યાન શિખિતનું આયોજન આ પુસ્તકના લેખક દારા કરવામાં આવે ર્યારે અત્યક્ષ પણ સમજ શકાશે.

પૂ. ૫. લાંકરવિજયળના સ્વહસ્તે લખાયેલ ‘ચિંતનધારા’ બોડા વખત પહેલાં જ અમારા આ ટ્રસ્ટ તરફથી પ્રકાશન કરાયામાં આવેલું.

શ્રી જિનશાસનની કૃતજ્ઞભાવે સેવા કરવા માટે આ પુસ્તકના પ્રકાશન માટે અમને જે તક મળી છે તે માટે દેવભૂતના ચરણમાં ડોટી ડોટી પ્રણામ કરીએ છીએ.

સૌ ડોઈ આ પુસ્તકના વાંચન, મનન નિર્દિધ્યાસન અને ધ્યાન દારા આત્મકલ્યાણના પંથે આગળ વધે એ જ શુલેષણ.

‘મહાવિદ્ઘ’

૨૨, મહાવીર નગર, નવસારી

૨. ન. ૩૧૩૬ (R)

૧૨૦૭ (O)

લિ. અશોક બાળુલાઈ કડીવાળા

મેનેજંગ ટ્રસ્ટી.

બાળુલાઈ કડીવાળા ચેરીટેબલ ટ્રસ્ટ.



## આ મુખ

### સાલંખુન દ્વયાનના પ્રયોગો

સમતાભાવનિષ્ઠ, પૂજયપાદ, પંન્યાસજી લગવંત શ્રી-  
લદંકર વિજયજી મહારાજ

જેમણે જગતને મૈત્રીનું અમૃત પાયું,  
જેમણે જગતને યોગ-સામ્રાજ્યનો મહિમા સમજાવ્યો,  
જેમણે જગતને ખમવાની કળા શીખવાડી,  
જેમણે જગતને શ્રી નવકારની માયા લગાડી,  
જેમણે જગતને સ્થાદ્વાદનો બોધ પીરસ્યો,  
જેમણે જગતને 'નમન'નું રહસ્ય સમજાવ્યું,  
જેમણે જગતને ચિંતામુક્તિનો ઉપાય સમજાવ્યો,  
જેમણે જગતને આત્મતત્ત્વનો મહિમા સમજાવ્યો,  
જેમણે જગતને 'આભાર'નું મૂર્ખ સમજાવ્યું,  
જેમણે જગતને આત્મ સમજાવનું દાન કર્યું,  
જેમણે જગતને અહિંસા, સંયમ અને તપનો સમતામય  
માર્ગ સ્વ-જીવન દારા ઉપદેશ્યો,  
જેમણે જગતને લદંકર આત્મસ્નેહ વડે લીંજાવ્યું,  
જેમણે 'શિવમસ્તુ સર્વ' જગત ની લાવના વડે વાયુ મંદળને  
સુવાસિત કર્યું;  
જેમણે જૈનશાસ્કો મુજબની અનેક દ્વયાન પ્રક્રિયા યોગ્ય  
આત્માઓને શીખવાડી.  
જેમણે યોગ્ય આત્માઓને આત્મ અનુભવનો જિનકથિત દિવ્ય  
માર્ગ વ્યતાવ્યો,

તे.....

પરમ પૂજ્ય, પ્રાતઃસમરણીય, ગુરુહેવ, પંત્યાસળ લગ્બંત, શ્રી અરિહંત કદંકરવિજ્યજી ગણિતરશ્રીના સમભાવ લાવિત શ્રી અરિહંત ધ્યાનમળ આત્માને ડાટિ ડાટિ નમસ્કાર સાથે આ અંથ શરૂ કરવામાં આવે છે.

સાલંખન એટલે આલંખન સહિતનું ધ્યાન. શુદ્ધ આલંખનોમાં સર્વાશ્રેષ્ઠ આલંખન પરમાત્માનું જ છે.

અરિહંત પરમાત્મા ને ધ્યાનના કેન્દ્રમાં હોય તે સાલંખન ધ્યાન છે.

“પ્રયોગ” ધ્યાન પ્રક્રિયા જાણુવી એ જરૂરી છે. પણ એ જાણવા માત્રથી આપણે કાર્યસિદ્ધ સુધી પહોંચી શકતા નથી. કળાદેશ સુંધરી પહોંચવા માટે આપણે પ્રયોગ કરવો જોઈએ. શાસ્ત્રીય પરિલાષામાં પ્રયોગ એટલે કિયા. તત્ત્વાર્થસૂત્રમાં કહું પણ છે કે જ્ઞાન-ક્રિયાભ્યાં મોક્ષઃ। આપણે સૌથી પ્રથમ ધ્યાનપ્રક્રિયા જાણુવી જોઈએ. અનેક દસ્તિબિન્હાયોથી જાણુવી તે જ્ઞાન કહેવાય. અને તે મુજબનો પ્રયોગ (કિયા) કરવો જોઈએ. આ રીતે જ્ઞાન + કિયા = કાર્યસિદ્ધિ.

આપણે કિયા પણ ધ્યેય શુદ્ધિપૂર્વક કરવી જોઈએ. આપણું ધ્યેય શું હોવું જોઈએ? આ અંગે આ પુસ્તકના લેખકને વર્તમાન સમયના મહાન ધ્યાનયોગી શ્રી પં. લદંકરવિજ્યજી સાથે વિ. સ. ૨૦૩૩ ના ચૈત્ર સુદ ૧૩ ના દિવસે ને વાર્તાલાપ થયો હતો તે આ પુસ્તકના પાંચમાં નોંધેલો છે.

‘પ્રભુ નામે આનંદ કંદ’ ના વાક્યમાં પ્રભુ નામે એ સિદ્ધાંત (principle) છે, આનંદનો કંદ ફળ (result) છે. પણ આ વસ્તુ જાણવા માત્રથી કાર્યની સિદ્ધિ થતી નથી. સિદ્ધિનું સમીકરણ - ફોર્મુલા છે :—

Principle + Application = Result.

સિક્ષાંત + પ્રયોગ = ધ્યાનો અનુભવ.

‘ધ્યાન’ એટલે ધ્યેયાકાર ઉપરોગ. ધ્યાનં ચૈકાગ્રય સંવિતિ ॥  
(જ્ઞાનસાર ધ્યાનાષ્ટક) ધ્યાન એટલે એકાશ જુહી અર્થત્ વિજ્ઞતીય  
જ્ઞાનના અંતર રહિત સજ્ઞતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે.  
ધ્યાનની અનેક પ્રક્રિયા અને વ્યાખ્યા આ પુસ્તકમાં આપવામાં આવી છે.  
ધ્યાન પ્રક્રિયા અનેક પ્રકારની એટલા માટે બતાવી છે કે એ લિન્ન લિન્ન  
રુચિવાળા અને લિન્ન લિન્ન પ્રકારના ક્ષીયોપશમવાળા આત્માઓને  
લાગુ દરેક સાધક પોતાની યોગ્યતા મુજબ સાધનામાં  
વિકાસ સાધી શકે છે.

જ્યારે આપણું મન ચિંતા, ભય, શોક, અશાંતિ, ટેન્શન (તાણ)  
આદિયા પીડાતું બંધ થાય ત્યારે તે ધ્યાનને યોગ્ય બને છે. આજકાલ  
જેને સોંગ ટેન્શન કહે છે તેને મહાપુરુષો આર્તધ્યાન-રૌદ્રધ્યાનની  
પીડા કહે છે. સૌથી પ્રથમ પીડા શાંત કરવી જોઈએ. આ પીડા  
શાંત કરવા માટે પરમાત્માની અનંત કરુણા શક્તિની સહાયથી હુંઘ,  
ભય, ચિંતા, અશાંતિ આદિમાંથી છુટકારો મેળવી સુખ, શાંતિ,  
આનંદ અને નિર્બધતાનો અનુભવ કરવાની દિવ્ય અનુભવસિક્ષ  
પ્રક્રિયા પ્રયોગ નં. ૧ માં બતાવી છે.

પરમાત્માની કરુણા શક્તિની સહાય લઈને મહિન  
વાસનાંયો, દુષ્ટ લાંબો અને પાપ વૃત્તિઓમાંથી ડેવી રીતે છુટકારો  
મેળવવે તેની પ્રક્રિયા ધ્યાનપ્રયોગ નં. ૨ માં બતાવવામાં આવી છે.

દુષ્ટ ગુણોનો સુવાસથી ભરપૂર આપણું જીવન ડેવી રીતે  
બનાવી શકાય તે અંગેની ધ્યાન પ્રક્રિયા પ્રયોગ નં. ૩ માં બતાવવામાં  
આવી છે.

પરમાત્માના દિવ્ય પ્રકાશના આદાંભન દ્વારા આનંદના મંજુ-

સાગર આત્મામાં સ્થિર બની આનંદનો અનુભવ કરવાની ધ્યાન પ્રક્રિયા પ્રયોગ નાં ૪ માં બતાવવામાં આવી છે.

જગતના સર્વ જીવો સાથે મૈત્રી ભાવનું અનુસોધાન કરવાની દિવ્ય પ્રક્રિયા ધ્યાન પ્રયોગ નાં ૭ માં બતાવવામાં આવી છે.

અનેક દિવ્ય અનુભવ સિદ્ધ ધ્યાન પ્રક્રિયા આ પુસ્તકમાં બતાવવામાં આવી છે.

દરેક સાધક પોતપોતાની ભૂમિકા અને યોગ્યતા મુજબ આગળ વધાયું.

“શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક જીવન રહસ્યો” નામનું પુસ્તક કે જેમાં જીવનની જ્વલંત સંક્ષણતા પ્રાપ્ત કરવાની ચાવી છે, તેનું આપે અધ્યયન કર્યું હશે.

શ્રીપાલ અને મયણા તો પોતાનું જીવન પરિપૂર્ણ રીતે સંક્ષળ કરી ગયાં. તેઓ કર્મકૃત વિચિત્ર સંલેખામાં પણ પરમાત્માનું સતત સાનિધ્ય અનુભવતાં હતાં. તેમનું એ જીવન A Key to Radiant Success — જ્વલંત સંક્ષણતાની ચાવી રૂપ આપણા માટે પણ જની શકે છે.

જેના શરીરમાંથી ડેઢને લીધે રક્તપીત વહેતું હતું તેવો પતિ મળ્યો છતાં મયણાના મુખ ઉપરની એક રેખા વિષાદમાં અદ્વલાઈ ન હતી. જ્વલંત પરમાત્માની અચિંત્ય શક્તિના પ્રતાપે તેઓનાં કાર્યની સિદ્ધ થતી રહી. શ્રીપાલને જ્યારે દરિયામાં ફેંકી દેવામાં આવ્યો ત્યારે પણ તેના હૃદયમાં તો પરમાત્માનું ધ્યાન ચાલુ રહ્યું હતું. એક વખત દુઃમન રાન્ને ઉજ્જવલિની નગરીને ઘેરો ઘાલ્યો અને આખું નગર બયાસ્ત થયું, પણ તે વખતે ડેવળ મયણા જ નિર્બિય રહી હતી. નગરજનો દુઃમનની શક્તિનો વિચાર કરતા હતા, ત્યારે મયણા

પરમात्मानी શક्तिनો વિચાર કરતી હતી. નગરનો રાજુ, સરસેનાપતિ, લક્ષ્મિર, પ્રધાનો અને નગરજનો દુઃમનની એ શક્તિને લાઘે ભયગ્રસ્ત થઈ ગયાં હતાં, તે વખતે પરમાત્માની અચિંત્ય શક્તિઓથી મયણુંછું મન અને હૃદય ભર્યું ભર્યું રહેતું હોવાથી મયણ્ણા સારા નગરમાં એક જ નિર્બિંદુ હતી.

આ વિચારોમાંથી સાલંખન ધ્યાનના પુસ્તકનું સર્જન થઈ શક્યું છે. સાલંખન ધ્યાનના આ પુસ્તકના પ્રયોગો દ્વારા પરમાત્માની અચિંત્ય શક્તિના પ્રભાવે આપણે પણ પૂર્ણ સફળતાભર્યું જીવન બનાવી શકીએ એમ છીએ. મોક્ષ પર્યાતની યત્તા નિર્વિદ્ધ રીતે પૂરી કરી શકીએ છીએ અને આપણે સુખ, શાંતિ, આનંદ અને નિર્બિંદુથાથી પરિપૂર્ણ જીવન જીવી શકીએ છીએ.

પ્રિય વાયક મિત્રો ! તમે તમારા જીવનનું લક્ષ્યબિન્દુ નક્કી કરો. તમારા અંતિમ લક્ષ્યનું સ્પષ્ટ ચિત્ર તમારી સમક્ષા ઉપસ્થિત કરો. પરમાત્માની દિવ્ય શક્તિનો અચિંત્ય પ્રભાવ તમારી અંદર કાર્ય કરી રહ્યો છે, તેવું સતત સમરણ રાખો અને તમારું જીવન સુખ, આનંદ, શાંતિ, નિર્બિંદુતા, સર્વ પ્રત્યે પ્રેમ અને મૈત્રી, સમૃદ્ધિ અને આરોગ્યથી ભર્યું ભર્યું બની જશો. આ પુસ્તકમાં તે માટેના પ્રયોગો બતાવ્યા છે. તેની તમારા જીવનમાં નિયમિત સાધના કરો. પ્રયોગમાં યતાવેલ રીતે અથવા તો તમારી અંતરપ્રેરણા સુજ્ઞય ધ્યાનમાં આગળ વધો. તમને જે જોઈએ છે, તમારે જેવા બનવું છે તેવું સ્પષ્ટ ચિત્ર તમારી સમક્ષા રાખો. સફળતા તમારા હાથમાં જ છે. દા. ત., સૌથી મેટો સંકલ્પ કે “આવતા જનમાંદુંવિહરમાન તીર્થાંકર દેવાધિદેવ ભગવાન સીમાંધર સ્વામી જ્યાં વિચરી રહ્યા છે ત્યાં તમારો જનમ થાય. આઠ વરસની ઉંમરે તમે ભગવાનના હસ્તક દીક્ષા અંગીકાર કરો; પ્રલુબ આજા સુજ્ઞય જીવન જીવી આત્માનુભવયુક્ત ચારિત્ર પાણો. અને શુદ્ધ આનંદ સ્વરૂપ પ્રગટ કરો.” તમારો આવો

મહાન અને દિવ્ય મનોરથ જરૂર પૂર્ણ થનાર છે. (તે માટે જુઓ  
પ્રયોગ નં. ૩૪). આ જીવનની સામાન્ય ઘટનાથી માંડીને સેક્ષણ  
પર્યાંતની સર્વ સુખસંપદાની પ્રાપ્તિ માટે તમારે શું કરવું તે પ્રયો-  
ગતમંડ રીતે આ પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે. તમારી પ્રકૃતિને  
અનુદ્રગ હોય તે પ્રયોગ તમે કરી શકો છો. આ માટે તમારી ચોચ્યતા  
કેળવવા તમારે શું કરવું જોઈએ તે પણ આ પુસ્તકમાં ચોચ્ય સ્થળે  
અવસરે અવસરે બતાવવામાં આવ્યું છે. જિનેશ્વરની આજાતું પાલન  
તેજ ચોચ્યતા છે. તમારું જીવન પ્રેમ, કરુણા, આનંદ, સુખ,  
શક્તિએ અને સમૃદ્ધિએ પૂર્ણ બનાવવા માટે પરમાત્મા તમને સહાય-  
ભૂત થવા તત્પર છે. પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરો. અને પરમા-  
ત્મામાંથી આ બધી દિવ્ય શક્તિએ વિસ્તૃત થઈ તમારામાં ફેલાય  
છે. તમે આ દિવ્ય વસ્તુએથી પરિપૂર્ણ બની તે સ્વરૂપ બનો છો.  
તેવી સાધના નિયમિત કરો. તમારું જીવન પ્રેમ, કરુણા, આનંદ,  
સુખ, શક્તિ, સમૃદ્ધિ ભરેલું તમે અનુભવશો. (જુઓ પ્રયોગ નં. ૫).

જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ગલબારશો નહિ, નાસીપાસ  
થાએં નહિ; પરમાત્માની અચિંત્ય શક્તિ સમક્ષ, તમારી મુશ્કેલી તો  
મામૂલી વસ્તુ છે. તમને જીવનમાં અસુક સંભેગોમાં extra-  
protection વિશેષ રક્ષણાની જરૂર પડે ત્યારે તમારા હૃદયમાં રહેલું  
પરમાત્માની દિવ્ય શક્તિનો પ્રકાશ પ્રસરી તમારી ચારે બાજુ આલા-  
મંડળ રચે છે તેવી ડલ્ફના કરો. અને પરમાત્માની દિવ્ય શક્તિએનું  
આલામંડળ તમારી ચારે તરફ છે તેવું ધ્યાન કરો. (જુઓ પ્રયોગ  
નં. ૬ અને તેની સંમીક્ષા.) તમને વિશેષ રક્ષણાત્મક બળ મળશે.  
વળી, તમારી ચારે બાજુ રચાયેલ આલામંડળના પ્રલાવે તમારી  
પાસે આવનાર અશાંત મનુષ્ય શાંત બનશે. અધ્યમી હશે તે તમારી  
પાસે આવતાં ધર્મી બનશે. દુઃખીને સુખનો અનુભવ થશે. અશક્ષાળુ  
હશે તો અશક્ષાળુ બનશે. તમે જગતના લેડિની સાચી સેવા કરી તેમને  
પરમાત્માનો માર્ગ બતાવી શકશો.

તમારી અંદર રહેલ આત્મશક્તિને ડેવી રીતે પરમાત્માના ધ્યાન દારા જગૃત કરવી, જગૃત થયેલ આત્મશક્તિને ડેવી રીતે સૌચ્ય બનાવવી અને પરમાત્માના અસેદ ધ્યાન દારા આત્માના આનંદનો અનુભવ ડેવી રીતે માણુદે અને જગૃત શક્તિને જગતના જીવોના કલ્યાણ માટે ડેવી રીતે ઉપયોગમાં દેવી તે માટે જુઓ પ્રયોગ નં. ૩૦\*

વડેતૃત્વની અખંડ ધારા અને ધર્મના સિદ્ધાંતોના રહસ્યનું ગાન ડેવી રીતે મેળવવું-તે માટે જુઓ પ્રયોગ નં. ૨૭.

આજના કરેલા ધર્મનું ફળ આજે જ ડેવી રીતે પ્રાપ્ત કરવું તે માટે જુઓ પ્રયોગ નં. ૧૭.

પરમાત્માની ભક્તિ એ વિશ્વ પરનું અમૃત છે. તે ભક્તિ પરાકાપા સુધી પહોંચાડી આત્મસાક્ષાત્કાર ડેવી રીતે કરવે તે માટે જુઓ પ્રયોગ નં. ૧૮.

સિદ્ધચક્ર એ Cosmic Dynamo છે. તેને ધ્યાન પ્રક્રિયા દારા ડેવી રીતે કાર્યશીલ operate કરવે અને શ્રીપાલ અને મધુણા જેવું સમૃદ્ધ, ભક્તિમય, પ્રલુભમય જીવન ડેવી રીતે બનાવવું તે માટે જુઓ પ્રયોગ નં. ૨૨, ૨૩, ૨૪.

સાડણી માઠાશનું વર્ણન કરવામાં આવે એટલે તે ખાવાનું મન થાય. પણ સાકરનો સ્વાદ તો તેનો દુક્કડો મેંમાં મૂકવાથી જ આવે છે. તેમ આ ધ્યાનપ્રયોગો જીવનમાં પ્રેક્ટીકલ રૂપે કરવાથી જ તેના અમૃતમય આસ્વાદનો અનુભવ થાય છે.

\* આત્મશક્તિ જગરણ (કુંડલિનીનું ઉત્થાન) સમયે અનેક પ્રકારની શારીરિક, માનસિક વિકૃતિઓ ઉત્પન્ન થાય, તેમાંથી બયવા પરમ પૂજય હેમચંદ્રસૂરિજી મહારાજે બતાવેલ આ પ્રયોગ જગતના શક્તિ જગરણના પ્રયોગમાં સર્વ અછ છે.

સૌ કેદી મહાન બનવા ઈચ્�ે છે; સૌ ડેર્ચ શક્તિસંપન્ન બનવા ઈચ્છે છે. બધા જ તૃપ્તિ અને સમતાનો આનંદ ઈચ્છી રહ્યા છે. આ માટે નીચેના નિયમો યાદ રાખો :—

(૧) મહાન બનવા માટે પરમાત્માની મહાનતાને હૃદયમંદિરમાં ધારણું કરો.

(૨) શક્તિ સંપન્ન બનવા માટે પરમાત્માની અચિંત્ય શક્તિને મતમંદિરમાં ધારણું કરો.

(૩) જેટલી ભક્તિ ભગવાન પ્રત્યે હોય તેટલી જ તૃપ્તિનો અનુભવ જીવનમાં થાય છે.

(૪) જેટલી ભમતા ભગવાન પ્રત્યે હોય તેટલી જ સમતાનો જીવનમાં અનુભવ થાય છે.

(૫) પરમાત્માના નામને ચૈતન્યનો મહાલંડાર સમજ ને મતુધ્ય નિરંતર પરમાત્માનું સમરણું કરે છે, તેને પરમાત્મા કલ્પવૃક્ષની નેમ ફળદારી બને છે.

આ પાંચ નિયમોનું પાલન તમારા જીવનને જીવલંત સફળતા Radient Successમાં પરીણમાવશે.

## સફળતાનું મૂળ કચાં છે ?

ધ્યાન દ્વારા પરમાત્મા સાથે એકતા સાધવી.

પરમાત્માની સાથે ધ્યાનમાં એકતા થતાં, આપણો શુદ્ધ આત્મા ને અનર્ગીણ આનંદ અને અનંત સુખનો મહાન લંડાર છે, તેની સાથે આપણી એકતા થાય છે, અને આત્માના અનંત સમૃદ્ધિ, આનંદ, સુખ અને શક્તિના લંડારમાં થોડી ક્ષણ માટે સ્થિરતા થતાં જ આપણું જીવન સમૃદ્ધ બની જશો, જીવલંત સફળતાનાં સોધાન આપણે સર કરી શકીશું. આપણું જીવન આનંદ અને સુખમય થઈ

જ્ઞાતે પરમાત્માની સાથે ધ્યાન દ્વારા એકતા ડેવી રીતે સાધવી અને વે દ્વારા અનંત સુખની ખાળું સમાન આપણું શુદ્ધ આત્મચૈતન્ય જ્ઞાને એકતા ડેવી રીતે સાધવી તે આ પુસ્તકના ધ્યાન જ ધ્યાન-અભેગાનું લક્ષ્ય છે. ધીરજપૂર્વક દીર્ઘકાળ સુધી, અંતપૂર્વક સાધના આદુ રાખો. મહાનતા, સમૃદ્ધિ અને સંપત્તિ તમારી તરફ આકર્ષાઈને આવશે અને તેમાં પણ અનાસક્ત યોગ દ્વારા તમે આત્મ સમૃદ્ધિના અનંત લંડારને આપ્ત કરશો. આત્મઅનુભવ યાને આત્મશર્ણાંતિ યાને અરમાત્માનો સાક્ષાત્કાર આ પુસ્તકનો મુખ્ય હેતુ છે. તે લક્ષને અજખૂત પકડી રાખો.

આખ સંપત્તિઓ વચ્ચેગાળાની પેદાશ છે. તે તો તમારી પાસે આકર્ષાઈને આવવાની જ છે. પણ તમે લક્ષને ભરાયર વળગી રહેણને. જીવનની સર્વેતૃષ્ટ કક્ષાએ પહેંચયાં તે જ આપણું લક્ષ છે. આત્મઅનુભવની અવસ્થા જીવનની સર્વેતૃષ્ટ અવસ્થા છે. આ પુસ્તકના ધ્યાનપ્રયોગો તમને આત્મઅનુભવના આનંદમાં તુલ્પણ કરી દેશે. આપૂર્વક આગળ વધો. સફળતા તમારા હાથમાં જ છે.

તમે સ્વયં અનંત આનંદ અને શુણુના લંડાર આત્મા છો. શક્તિનો દિવ્ય અન્નનો તમારામાં ભરપૂર લર્યો છે. તેમાં પ્રવેશ કરવાની કળા તે જ સાલંખન ધ્યાનના પ્રયોગો છે. તેમાં રમણુતા જીવિ અમૃતનો આસ્વાદ કરવા માટે જ આ પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ બધો અન્નનો અધ્યાત્મયોગી પુ. પંન્યાસ સદરંકરવિજયજ્ઞ મંડુરાજના સાનિધ્યમાં ૨૩ વરસ સુધીં આ પુસ્તકના લેખક (શ્રી. ખાળુંશાઈ કરીબાળા)ને રહેવાનું અધ્યું તે પ્રસંગે શુદ્ધપ્રસાદી રૂપે મળ્યો છે. સૌ મુસુકુઓને તેનો લાલ મળે તે માટે સાધના પ્રયોગોને અણી અક્ષરરહેઠ આપવામાં આવ્યો છે અને જૈન યોગ અધ્યાત્મ અંશોના અધ્યાસ અને ધ્યાન દ્વારા અનુભવેલાં તરવો, પૂજય શુરૂ ભગવતં

પાસેથી આ પુસ્તકના લેખકને મળેલાં, અને આ પુસ્તકના લેખકેને  
રૂટ વર્ષની સાધના દારા જીવનમાં ને અનુભવ અમૃત આપેન  
કર્યું તેનો દિવ્ય ભધુર આસ્વાદ સુસુષુ આત્માઓને મળે અને  
પરમાત્માની દિવ્ય લક્ષ્ણ અને ધ્યાન દારા સૌ ડાઈ કિનેશ્વર  
પ્રલુના અનુગ્રહને પાત્ર બની સાધનાની સિદ્ધિ મેળવે છે જ  
અંતરની અલિલાષા છે.\*

પૂ. ૫. લદંકરવિજયજી મહારાજના સાનિધ્યમાં દિવ્ય રત્ને  
આપું થયાં તેનો લાલ સૌ ડાઈને મળે અને ધર્મ દારા પ્રાપ્ત થતું  
દિવ્ય સુખ, પરમ આનંદ, અલૌકિક શાંતિ સૌને મળે તે હેતુથી  
આ પુસ્તક લખવામાં આવ્યું છે. આપ આ પુસ્તકમાં લખેલા પ્રયો-  
ગોની જીવનમાં સાધના કરવો ત્યારે આપ ડાઈ દિવ્ય આનંદમાં  
જૂલતા હોય તેવું આપને લાગશે. આ પુસ્તક ધારે-ધારે વાચવું.  
પ્રયોગ કરવા મારો અને આગળ વધો, અગર આખું પુસ્તક એક  
વખત સણંગ વાંચી જાઓ. પછી, બીજી વખત ધીમે-ધીમે ફરીથી  
વાંચીને પ્રયોગ કરો જાઓ.

આ પુસ્તક વાચકોના કરકમળમાં પૂ. પંન્યાસ લદંકરવિજયજીની  
દિવ્ય લેટ રૂપે અર્પણું કરવામાં આવે છે અને પૂજ્ય પંન્યાસજી  
મહારાજ તરફથી મળેલ આશીર્વાદ અને દિવ્ય રત્નોના આપ સૌ  
આ પુસ્તક દારા ભાગીદાર બનો. તેવી શુલ ઈચ્છા છે. આ પુસ્તકના  
પ્રયોગોની સાધના આપના જીવનમાં શુલ આશીર્વાદ, મંગળમય  
આનંદ અને દિવ્ય સુખની લહેરો લાવશે અને આપને પરમાત્માના  
રક્ષણ નીચે મૂડી નિર્બિય બનાવશે.

આપણે જેવા વિચારો નિરંતર કરીએ છીએ, તેવી ચીજેનું

---

\* પૂ. પંન્યાસજી લદંકરવિજયજી પાસે પાત્ર થયેલા ડેટલાક  
અદ્ભુત ધ્યાન પ્રયોગો અને અનુભવો માત્ર વિશિષ્ટ ડાઈનાં  
સાધકોને જ બતાવી શકાય તેવા હોવાથી આ પુસ્તકમાં રજુ કર્યા નથી.

આકર્ષણું આપણી તરફ થાય છે. ને આપણે પરમાત્માની અચિંત્ય શક્તિનો નિરંતર વિચાર કરીશું, પરમાત્માના શુષ્ણાનું ચિંતન કરીશું, પરમાત્માનું ધ્યાન કરીશું, તો પરમાત્માની અચિંત્ય, અનંત શક્તિ આપણી અંદર કાર્યશીલ થશે અને તેથી આપણે એક સામાન્ય મનુષ્યમાંથી મહામાનવ બની શકીશું. આપણા મનમાં જે વિચારો ઘૂંટય છે તે છેવટે ભૌતિક સ્વરૂપે પ્રગટ થાય છે. આ પુસ્તકના પ્રેરોજા જેમ જેમ કરતા જરૂરો તેમ તેમ પરમાત્માનો જ નિરંતર વિચાર કરવાની ટેવ પડી જરૂરો. તમારા જીવનમાં થતું નવસર્જન ઝાઈ દિવ્ય અને અદૌરીકિ હરો. તમારું જીવન શાંતિ, આનંદ અને નિર્ભયતાથી પૂર્ણ બની જરૂરો. આ પુસ્તકના શરૂઆતના ૧ થી ૭ પ્રેરોજા તથા પ્રેરોજ નં. ૩૪ માં લખેલ વસ્તુ વર્તમાન ડાળમાં બનતી તમે કદ્યપના કરનો. (આ બધું લખિયમાં બનશે તેવી કદ્યપના નથી કરવાની.) એ અત્યારે જ બની રહ્યું છે તેવું વર્તમાન ડાળમાં ચિંતવવું. ઉદ્દાહ તરીકે “પરમાત્માની અચિંત્ય શક્તિ મારામાં કાર્યશીલ બનશે” તેવું વિચારવાનું નથી, પરંતુ અત્યારે જ પરમાત્માની દિવ્ય શક્તિ મારી અંદર કાર્યશીલ બની છે. તેના પ્રલાવથી હું આનંદમય, સુખમય, શક્તિમય બન્યો છું તેવું અનુભવવું. વસ્તુ ભૌતિક રૂપે પ્રગટ થાય તે પહેલાં મનોમય ભૂમિકા ઉપર પ્રગટથી તમે જુઓ. પછી પરિણામ ભૌતિકરૂપે પણ તેવું જ આવશે. મોઝીટીવ માતસ તમારી નજર સમક્ષ ઉપસ્થિત કરો’, નકારાત્મક વિચાર છોડી દો.

પરમાત્મા અને આત્માના શુદ્ધ ચૈતન્ય તરફ મન ડેન્યિટ કરો. પરમાત્માની અચિંત્ય શક્તિ તમારામાં કાર્યશીલ બનશે. આપણી વર્તમાન પરિસ્થિતિ અને પરમાત્માનું આનંદમય ધાર— એ એ વચ્ચેનું અનુસંધાન આ પુસ્તકના ધ્યાનપ્રેરોજા દ્વારા થશે. આ પ્રેરોજા તમારા અને પરમાત્મા વચ્ચે એક ચેનલ-ઓપ બની જરૂરો. તમે ધ્યાન કરવા બેસો ત્યારે આગળ પાછળની

સ્વુતદ્ગાળ અને અભિષ્યની ચિંતા છોડી હો. ભથ, શોક, દુઃખ, અરૂપાની આદિ ઓડીને શાંત અનીને ધ્યાન કરજો. આ કાર્યમાં પરમાત્માની કરુણા શક્તિ તમને મદ્દ કરશે. તે માટે ડોઈ પણ ધ્યાનપ્રયોગ કરતા પહેલાં પ્રયોગ ન. ૧ પ્રથમ કરવો. દરેક પ્રયોગમાં દર્શન પ્રથમ કરવાનું બતાવવામાં આવ્યું છે. તે દર્શનિમાંથી સર્જન થશો, અને સર્જન તમને તે સુજાપના સંવેહનમાં લઈ જઈ કાર્યસંક્રિ કરાવશે.

તમે ધ્યાન એટલું જોડાણુમાં લઈ જાઓ કે જેથી તમારા આત્મામાં રહેલ અનંત આનંદ અને સુખના મહાસાગર સુધી તમે પહેંચી શકો. તે માટે પ્રયોગમાં ટપકાં ..... મૂકેલાં છે. ત્યાં સ્થિર બનો અને જોડાણુમાં જાઓ.

આ પ્રયોગા સામુદ્દરિયિક રીતે પણ થઈ શકે છે. જ્યારે ડોઈ એકજ વિચાર એ કે તેથી વધુ મનુષ્યને સ્પર્શ છે, ત્યારે એક માસ્ટર માઈન્ડ બને છે. તે હેતુથી ધ્યાન શિબિરોનું પણ આયોજન ચાલી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં ૩૦ જેટલા ધ્યાન શિબિરો ઉપરાંત ૧૫૦ જેટલા ધ્યાનપ્રયોગા કરવામાં આવ્યા છે. તેમાં ૪૦ જેટલા આચાર્ય ભગવંતો, ૮૦૦ જેટલા સાધુ સાધી મહારાજો અને ડૉ. ૪૦ થી ૪૦ હજર જેટલા આરાધકોએ ધ્યાન શિબિરોમાં લાગ લીધો છે. આ પ્રયોગ અને પ્રક્રિયા પ્રેક્ટીકલ કરવાના વિષયમાં શિબિરનું આયોજન થાય ત્યારે ત્યાં આપ વધુ લાલ લઈ શકા છો. જૈન શાસનમાં સામુદ્દરિયિક આરાધના, સામુદ્દરિયિક પૂજન વગેરેનું આયોજન ચાલતું આવ્યું છે, તેની પાછળ ગંભીર રહસ્ય છે. તે આ પુસ્તકના પાન ન. ૧૧૭ માં પ્રતિમા શતક અંથના આધારે બતાવ્યું છે.

ધ્યાનપ્રયોગ દ્વારા તમારું જીવન એક નવસર્જનદ્વારા બની જશે. પરમાત્માની દિવ્ય શક્તિ તમારા જીવનમાં કાર્યશીલ બનશે. શાંતિ,

આનંદ, પ્રેમ, કરુણા, શક્તિ, જ્ઞાન અને સુખમય તમારું જીવન બની જરો.

દ્વારાકમાં તમારા જીવનના તમે અદ્ભુત કલાકાર છો. હિન્દુયા -કલાત્મક જીવન બનાવો. પરમાત્માને જીવનના ડેન્દ્ર સ્થાનમાં લાવો. તમારું જીવન પરમાત્માના સાનિધ્યથી લથું લથું બની જરો.

દર્શનાત્ર દુરિત ધ્વાંસી, વંદનાત્ર વાંચિત પ્રદઃ ।  
પૂજનાત્ર પૂરકઃ શ્રીખુંા, જિનો સાક્ષાત્ સુરુમઃ ॥

God is my Instant, Constant, Abudent supply  
of every potent Good :

આ પુસ્તકમાં લખેલ ડેટલીડ વાતો એવી છે કે, જે સાધનાથી જ સમજ શકાય તેવી છે. “પૂજય ગુરુ અગવંત ધ્યાન સિદ્ધ પુરુષ હતા.” તેમના અનુભવોમાંથી પ્રાપ્ત થયેલ ડેટલીડ મૌલિકઅને તાત્ત્વિક વિચારણા આ પુસ્તકમાં છે, જે ઈસ્થર ચિત્તે વિચારવા સાધનાપ્રેમા વાયકોને વિનંતી છે.

આત્માની અધ્યૂટ સંપત્તિના અજ્ઞાનાને ઓલવાની હિન્દુય ચાવીડિપ આ પુસ્તક વાયકોનાં કરકમલમાં મૂકૃતાં હિન્દુય આનંદ અનુભવાય છે. જીવનમાં પરમ સુખ, હિન્દુય આનંદ અને શાંતિના અનુભવ કરવાની અહીન કળાથી ભર-પૂર આ પુસ્તક આપણા જીવનની અણુમોદ સંપત્તિદિપ છે.

આ પુસ્તક પ. પૂ. ભદ્રકરવિજયજીની પ્રેરણાનું ઇણ છે. આમાં જે કંઈ સાર્દ છે તે તેઓશ્રી પાસેથી મળેલું છે. તેઓશ્રીની ઇપાનું ઇણ છે. આમાં જે ડાઈ ક્રુટિ છે તે મારી પોતાની છે.

આ પુસ્તકના લખાણમાં કચાંય પણ શ્રી જિનાજી વિરુદ્ધ લખાણું હોય તેનો નિવિધે ક્ષમા યાચું છું.

ગિરનારળ મહાતીર્થમાં કરણુસાગર નેમનાથ ભગવાનની પરમ  
પાવનકારી, પવિત્ર છતછાયામાં સાધના માટે ગિરનાર ઊપર રોકાબાળો  
આણુમોલ અવસર પ્રાપ્ત થયો, તે વખતે દૈવગુરુની કૃપાથી આ પુસ્તક  
શ્રી નેમનાથ ભગવાનના કરણુમય પ્રકાશમાં લખાયું છે. કૃપાનિધિ  
પરમાત્માનો દિવ્ય પ્રકાશ આપળું સૌના હુદયમાં નિરંતર પથરતો  
રહે એ જ અભ્યર્થના.

લિ. બાળુલાઈ કડીવાળા  
ના પ્રણામ વંદન.

# અનુક્રમણિકા

‘અથમ આમુખ અને પ્રસ્તાવના વાંચ્યા પછી જ આગળ વાંચ્યા.

પોઠ પહેલો।

૫૪

- |   |
|---|
| (૧) અનંત લગ્નિધિનિધાન શ્રી ગૌતમસ્વામીજીની<br>દેશનામાં સાલંઘન ધ્યાનનો ઉપદેશ. ૧   |
| (૨) ધર્મ કિયામાં પ્રાણુપૂર્તિ કરવા માટે સાલંઘન<br>ધ્યાનની આવશ્યકતા. ૫           |
| (૩) પરમાત્માની કરુણાને જીવનાની દિવ્ય કળા. ૧૧                                    |
| (૪) પરમાત્માની કરુણાના દિવ્ય પ્રભાવે પીડાકારક<br>ટેવાના પરિવર્તનની પ્રક્રિયા ૧૩ |
| (૫) Ideal Reality મનોમય ભૂમિકા ઉપરનું સત્ય. ૧૬                                  |
| (૬) ધ્યાનની પૂર્વ તૈયારી. ૨૦  |

પ્રયોગ નં. ૧

પરમાત્માની કરુણાના પ્રભાવે દુઃખ, ભય, શોક, ચિંતા,  
અશાંતિ, ટેન્શનમાંથી છુટકારો મેળવી સુખ, શાંતિ,  
આનંદ અને નિર્ભયતાની પ્રાપ્તિનો પ્રયોગ. ૨૪

પ્રયોગ નં. ૨

પાપ વૃત્તિઓ, મલિન વાસનાઓ અને દુષ્ટ ભાવો નાશ  
કરવાનો પ્રયોગ. ૨૮

પ્રયોગ નં. ૩

પરમાત્માના શુણુ ગંગાજળમાં સ્નાન કરી ઉત્તમ શુણુથી  
પૂર્ણ ભરાઈ જવાનો પ્રયોગ. ૩૧

## પ્રયોગ નં. ૪

પરમાત્માના આલંખને આત્મદર્શિન અને પરમ આનંદની અનુભૂતિની પ્રક્રિયા.

૩૨

## પ્રયોગ નં. ૫

હૃદયમાં બિરાજમાન પરમાત્મામાંથી શક્તિએ અને ગુણોનો વિસ્તેટ થવાથી પ્રેમ, કરુણા, આનંદ, સુખ, શક્તિ અને ગુણું સમૃદ્ધિપૂર્ણ અવસ્થાનો અનુભવ કરવાની પ્રક્રિયા.

૪૧

## પ્રયોગ નં. ૬

(૧) પરમાત્માના અભેદ મિલનના પૂર્ણાનંદનો અનુભવ કરવાની પ્રક્રિયા.

૪૪

(૨) પહેલા છ પ્રેમગોની સમીક્ષા.

૪૮

(૩) ઉપમિતિ મહાચંથના આધારે સમર્સ્ત દાદશાંગ રૂપ જિન પ્રવચનના સાર રૂપ પરમ વિશુદ્ધ એવો ધ્યાનયોગ.

૫૦

સાલંખન ધ્યાનથી ચૈતન્યની મહાશક્તિએ કાર્યશીલ અનવાથી સામાન્ય મનુષ્ય મહાત્માનવ બને છે.

૫૪

## પ્રયોગ નં. ૭

મેત્રી ભાવનાનું ધ્યાન.

પરમાત્માના મહાકરુણા ભાવમાં આપણા ભાવને લેળવી દેવાના દિવ્ય પ્રયોગ (in tune with the infinite).

૫૬

## પાઠ ષીઞે

(૧) નમસ્કાર મંત્રનું ધ્યાન. પદ્મસ્થ ધ્યાન.

૬૩

(૨) ધ્યાન માટે આસન, સુદ્રા, દિશા, માળા સંખા, સમય.

૬૫

પ્રયોગ નં. ૮

નવકારના અક્ષરોનું ધ્યાન કરવાની વિવિધ રીતા. ૭૦

પ્રયોગ નં. ૯

નવકાર મંત્રનું કમળખદ ધ્યાન તથા વિવિધ રીતા. ૭૪

પ્રયોગ નં. ૧૦

નમસ્કાર મંત્રના ધ્યાન દ્વારા આત્મ સાક્ષાત્કાર સુધી પહેંચવાની દિવ્ય પ્રક્રિયાની ઉત્સેતર પ્રગતિકારક બાર રીતા. ૮૬

પ્રયોગ નં. ૧૧

(૧) સાધનામાં આવતાં વિદ્ધો શાંત કરવા માટેના પ્રયોગ. ૧૦૦

(૨) નમસ્કાર મંત્રની અચિંત્ય શક્તિએ. ૧૦૦

પાઠ ગ્રીંલે

ઇપસ્થ ધ્યાન—પરમાત્માની મૂર્તિના આલંબને ધ્યાન ૧૦૫

પ્રયોગ નં. ૧૨

પરમાત્માના દર્શનમાં ધ્યાન. ૧૦૮

પ્રયોગ નં. ૧૩

ધ્યાનમાં દર્શન. ૧૦૯

પ્રયોગ નં. ૧૪

પૂજનમાં ધ્યાન. ૧૧૧

પ્રયોગ નં. ૧૫

ધ્યાનમાં પૂજન. ૧૧૨

‘પ્રતિમાશતક’ અંથના આધારે પરમાત્માના મહાપૂજનમાં સામુદ્દરિક ધ્યાન પ્રક્રિયા અને તેની ઇલાજુતિ. ૧૧૯

**પ્રયોગ નં. ૧૬**

સ્તવનમાં ધ્યાન, પ્રાર્થના અને સુદૂર દ્વારા ધ્યાન, ૧૨૦

**પ્રયોગ નં. ૧૭**

(૧) ‘અમૃત કિયા’—આજના કરેલા ધર્મનું કળ આજે જ  
પ્રાપ્ત કરી શકાય તેવી દિવ્ય પ્રક્રિયા. ૧૩૩

**પ્રયોગ નં. ૧૮**

વિશિષ્ટ આરાધકો માટે જિન ભક્તિની સર્વેચ્છા ભૂમિકા. ૧૪૮

પરમાત્મ ભક્તિના આઠ સ્ટેજ દ્વારા આત્મઅનુભૂતિનો પ્રયોગ. ૧૫૪

**પાડ ચોથો**

**પ્રયોગ નં. ૧૯**

ખાળકો માટે સાધનાના ખાસ પ્રયોગો. ૧૬૩

**પાડ પાંચમો**

ધ્યેય લક્ષ.

આ પુસ્તકના લેખકને દિવ્ય ગુરુનો મેળાપ થયો ત્યારે  
થયેલ ધ્યેયલક્ષ સંબંધનો વાર્તાલાપ. ૧૬૭

પૂજ્ય પંન્યાસજુ લદંકરવિજયજુ સાથે “આત્મ  
સાક્ષાત્કાર અને ઉપયોગ” વિષયનો વાર્તાલાપ. ૧૭૪

**પાડ છુટો**

નવપદ્ધું ધ્યાન. ૧૭૭

**પ્રયોગ નં. ૨૦**

નવપદ્ધની આરાધનાની પ્રથમ ભૂમિકા. ૧૮૧

**પ્રયોગ નં. ૨૧**

(૧) નવપદ્ધના ધ્યાનની ખીજુ ભૂમિકા. ૧૮૪

(૨) નવપદની સાધના દારા વિકાસકરણની ભૂમિકાઓ.	૨૦૬
(૩) નવપદના ધ્યાનની સર્વેચ્છા ભૂમિકા.	૨૨૦
(૪) વિશ્વની સર્વત્રેષ્ઠ ધ્યાન અર્થીયા.	૨૩૨
<b>પાઠ સાતમો</b>	
સિદ્ધયકૃતું ધ્યાન.	૨૩૬
<b>પ્રયોગ નં. ૨૨</b>	
કળશની આદૃતિથી સિદ્ધયકૃતું ધ્યાન.	૨૩૭
<b>પ્રયોગ નં. ૨૩</b>	
કૃત્યવૃક્ષની આદૃતિથી સિદ્ધયકૃતું ધ્યાન.	૨૩૭
<b>પ્રયોગ નં. ૨૪</b>	
(૧) ચક્રાકાર આદૃતિથી સિદ્ધયકૃતું ધ્યાન.	૨૩૮
<b>પાઠ આठમો</b>	
અનુપ્રેક્ષા સ્વાધ્યાય દારા ધ્યાન.	૨૪૫
<b>પ્રયોગ નં. ૨૫</b>	
સંસાર દાવાની સ્તુતિ દારા ધ્યાન.	૨૪૭
<b>પ્રયોગ નં. ૨૬</b>	
(૧) લક્ષ્માર સ્તોત્રની ૧૪ મી ગ્રાથાનું ધ્યાન.	૨૪૮
(૨) વામન અને વિરાટનો મેળાપ.	
(૩) ભનની અગાધ શક્તિ.	૨૫૨
(૪) અનુયોગ દાર સ્ક્રનના આધારે ઉપયોગની પ્રવર્ધિત વિશુદ્ધિ.	૨૫૬
<b>પાઠ નવમો</b>	
વણું માતૃકાનું ધ્યાન.	૨૬૦
<b>પ્રયોગ નં. ૨૭</b>	
(૧) ભારાક્ષરીના અક્ષરોનું ધ્યાન.	૨૬૦
(૨) લક્ષ્મીનું અદ્ભુત સ્વરૂપ.	૨૬૩

**પ્રયોગ નં. ૨૮**

વર્ણુક્ષરોનું વિશિષ્ટ ધ્યાન.

૨૬૬

**પ્રયોગ નં. ૨૯**

યુદ્ધતત્ત્વનું ધ્યાન.

૨૭૩

**પાઠ ઇસમે**

અર્ડ્ડનું ધ્યાન.

૨૭૭

**પ્રયોગ નં. ૩૦**

(૧) યોગશાસ્ત્રના આધારે અર્ડનું ધ્યાન થાને શક્તિ જાગરણનું ધ્યાન.

૨૮૦

(૨) શક્તિ જાગરણ અને કુંડલિની ઉત્થાન વખતે આવતી પ્રતિક્રિયાના નિવારણની પ્રક્રિયા.

૨૮૬

(૩) પરિશિષ્ટ ત્રણુઃ : કુંડલિનીના વિષયમાં જૈન અંથેના આધારે.

૩૦૨

**પાઠ અગિયારમે**

નામ સમરણ દ્વારા ધ્યાન.

૩૦૩

**પ્રયોગ નં. ૩૧**

નામ સમરણ દ્વારા ધ્યાન.

૩૦૪

**પાઠ બારમે**

પિંડસ્થ ધ્યાન—યોગશાસ્ત્રના સાતમા પ્રકાશના આધારે.

૩૧૪

**પ્રયોગ નં. ૩૨**

પાંચ ધારણાનું ધ્યાન.

૩૧૪

**પાઠ તેરમે**

સિદ્ધગિરિનું ધ્યાન.

૩૨૪

## ગ્રયોગ નં. ૩૩

સિદ્ધગિરિતું ધ્યાનની દિવ્ય પ્રક્રિયા. ૩૨૪

## પાઠ ચૌદશો

મહાવિદેહનું ધ્યાન. ૩૩૦

## ગ્રયોગ નં. ૩૪

આવતા જન્મમાં વિહરમાન તીર્થીકર ભગવાન પાસે ૩૩૧

પહોંચવા શું કરવું ? ૩૩૨

ધ્યાનમાં મહાવિદેહ તરફ પ્રયાણુ. ૩૩૩

ધ્યાનમાં સમવસરણુમાં બિરાજમાન સાક્ષાત્ ભાવ-  
જિનેશ્વર સિમંધર સ્વામીનું દર્શન. ૩૪૪

પરમાત્માની સમ્યગું દર્શનની દેશના. ૩૪૫

સમ્યગું દર્શનની ધ્યાનમાં પ્રાપ્તિ. ૩૪૨

પરમાત્માના ચારિત ધર્મની દેશના. ૩૪૩

પરમાત્મા પાસે ચારિત પ્રાપ્ત કરવું. ૩૪૭

પરમાત્માની ક્ષપક ઓણીની દેશના. ૩૪૬

ક્ષપકોણી અને ડેવળજાનની ભાવના. ૩૬૧

પરમાત્મા સિમંધરસ્વામીની છેલ્લી દેશના. ૩૬૫

બિશિષ્ટ ભાવોથી ભાવિત બની મૂળ સ્થળ ઉપર આવવું. ૩૬૭

સમાધિ વિચાર અંથમાંથી બારમા દેવલોકના

દેવનું દષ્ટાંત. ૩૬૯

આપણી કલ્પના શક્તિ વડે રચાતું ચિત્ર ભવિષ્યમાં

થનાર આપણી સ્થિતિનો નમુનો છે. ૩૭૨

ગ્રેમનું અમૃત અને જીનનો પ્રકાશ. ૩૭૪

સમાપ્તિ એટલે સમ્યગું પ્રકારે પ્રાપ્તિ. ૩૭૭

સર્વે કર્મ પ્રણાશક ધ્યાન વિધિ. ૩૭૯

વાંચકાને ઉદ્દેશીને લેખકનો ગ્રેમલયેર્સ પત્ર. ૩૮૬

श्री ऋषभदेवस्वामिने नमः ।  
 श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।  
 श्री महावीरस्वामिने नमः ।  
 श्री गौतमस्वामिने नमः ।

पूज्यपादाचार्यमहाराजश्रीमहिजयसिद्धिसूरीश्वरजी  
 पादपद्मेभ्यो नमः ।  
 पूज्यपादाचार्यमहाराजश्रीमहिजयमेघसूरीश्वरजी  
 पादपद्मेभ्यो नमः ।  
 सद्गुरुरुदेवपूज्यपादमुनिराजश्रीभुवनविजयजी  
 पादपद्मेभ्यो नमः ।

## એક પોલ

પરમात्मानी કૃપाथી માનવ જગતમાં પ્રાપ્ત થયેલી અત્યંતમાં અત્યંત મહત્વની શક્તિ હોય તો તે ધ્યાન છે.

ધ્યાન શર્ણથી અત્યંત સ્થિર અધ્યવસાયને જ ન લેતાં, અનુપ્રેક્ષા, વિચારના દીર્ઘકાળીન પ્રવાહ તથા સ્થિર અધ્યવસાયને પણ ધ્યાન શર્ણથી લઈશું તો સમજશે કે જીવનના સર્વાંગીણું એક ઘડતરમાં ધ્યાન જ અત્યંત ઉપયોગી થઈ શકે તેમ છે.

ધ્યાન વિષે ધણ્ણા આમક ખ્યાલો જગતમાં પ્રવર્તે છે. તેમજ ધ્યાન વિષે ધણ્ણા ઉપેક્ષાભાવ પણ પ્રવર્તે છે. ધ્યાન એ આપણું કામ નહિ, આ સમયમાં સાચું ધ્યાન હોઈ શકે નહિ, ધ્યાન અને કિયાને મેળ ખાય નહિ, ધ્યાન આવે એટલે કિયા છૂટી જય, ધ્યાન આવે એટલે આચારમાં શૈથિત્ય આવે, ધ્યાન આવે એટલે ઉન્માર્ગ ચડી જવાય ઈત્યાદિ અનેક પ્રકારના ખ્યાલો આ જગતમાં તથા શ્રી સંધમાં પ્રવર્તે છે. પરંતુ સાચા અર્થમાં ધ્યાન આવે તો હકીકતમાં આવું

\*કંઈ છે જ નહિ. સાચા અર્થમાં ધ્યાન આવે તો કિયા છુટી જતી નથી, પણ સમજપૂર્વકની કિયા થતી હોવાથી કિયા બણી પ્રાણુવાન બની જય છે, માટે જ આપણું પૂર્વના મહાપુરષોએ જ્ઞાનસહિત કિયા માટે —

જ્ઞાની શાસોચ્છવાસમે કરે કર્મનો ઘેણ,  
પૂર્વ ડેડિ વરસાં લગે અજ્ઞાની કરે તહે."

આ રીતે અત્યંત આદરપૂર્વક ગુણુગાન ગાયાં છે.

વળો, કિયા એટલે શું ? એ પણ આપણે સમજવું જોઈશે, કિયાકંડ તો કિયાનું સથૂલ સ્વરૂપ છે. વિષય-કથાયના ત્યાગ દ્વારા આત્મ-રમણુતામાં જ્યારે એ કિયાકંડ પરિણુમે છે ત્યારે એ કિયાયેાગ બની જય છે. પુદ્ગલરમણુતા, વિષયરમણુતા, કથાયરમણુતા તથા આસ્લવરમણુતાનો ત્યાગ કરીને આત્મરમણુતામાં-પરમાત્મરમણુતામાં તન્મય થનું એ પણ ઉત્તમ ભૂમિકાની ખરેખર એક કિયા જ છે. અસુક ઉત્તમ ભૂમિકાએ પહેંચ્યા પછી વિભાવદશા ઘટી જય અને સ્વભાવદશામાં રમણુતા વધારે પ્રગટ તેથી કંઈ કિયા છુટી ગઈ ન કહેનાય. કિયાને પ્રાણુવાન બનાવવા માટે પણ સ્થાન અને ધ્યાન ધણું જરૂરી છે.

વિષય અને કથાયેના ધ્યાનથી આ જીવ અનાદિ કાળથી સંસારમાં જકડાયો છે, અનેક દુર્ગણ્યાથી ખરડાયો છે, અનંત વાસનાઓથી ધેરાયો છે અને અનંત યાતનાઓ ચાર ગતિઓમાં પામ્યો છે. તેની સામે જે પરમાત્માનું પવિત્ર ધ્યાન આવે તો બધા જ કલેશાનો ફરે કરે અંત આવી જય.

એ માટે જિનેશ્વર પરમાત્માના શાસનમાં શુલ્ષ ધ્યાનના લિન્ન લિન્ન અનેક માર્ગો સુયવેલા છે. યોગશાસ્ત્રના ૬ થી ૧૨ પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાનશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે ધ્યાનના અનેક અનેક પ્રકારો વર્ણિવેલા છે.

ધ્યા. પ્ર 3

\* પ્રસ્તાવના લેખક પ. પુ. શ્રી જ ભૂવિજયજી મહારાજ.

જીવનને સાર્થક કરવા માટે તથા સુખી થવા માટે, જીવનમાં ડગલે અને પગલે વિવિધ સહયોગીની, સામર્થ્યની, તથા પવિત્રતાની જરૂર પડે છે. ખરેખર કહીએ તો, સહયોગ, પવિત્રતા તથા પરમાત્માની પ્રાપ્તિ માટે જ આપણો આ જન્મ છે અને આપણું આ જીવન છે.

વિવિધ પ્રકારની વાસનાઓ તથા વિવિધ પ્રકારના દુર્ગણામાંથી શુદ્ધીને સહયોગ તથા પવિત્રતા પ્રગટાવવા માટે, પ્રસંગે પ્રસંગે આવશ્યક સામર્થ્ય માટે, જીવનના ચોગ ક્ષેમ માટે તથા પરમાત્માને અંદર-બહાર સર્વત્ર પ્રાપ્ત કરવા માટે શાખમાં વર્ણવેલી ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓને નજર સમક્ષ રાખીને ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓને શ્રી આધુનભાઈ કઠીવાળાએ સાલાંખન ધ્યાનના પ્રયોગો આ પુસ્તકમાં શાખાધારે ગુરુકૃપાથી તેમજ સ્વાનુભવના આધારે સુંદર રીતે વર્ણવી છે.

સુશ્રાવક બાધુભાઈ કઠીવાળા વધેથી ધ્યાનમાર્ગના ખૂબ સુંદર ઉપાસક છે. આ પુસ્તકમાં બહુ સરળ શૈલીથી તેમણે ધ્યાનના અનેક અનેક માર્ગો વર્ણવેલા છે કે નેથી સામાન્ય માનવી પણ સહેલાઈથી સમજ શકે. આ વિવિધ પ્રયુલિકાઓમાં, તફન પ્રાથમિક કક્ષાથી પ્રારંભી ચરમ ડક્ષા સુધીના અનેક માર્ગો વર્ણવેલા છે. મને લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં આ વિષયનું આવું વિશાળ અને સર્વ-ગ્રાહી આ પ્રથમ જ પ્રકાશન હશે.

પહેલાં તો, વાચક આ ધ્યાનના પ્રયોગોને ખરાખર સમજ લે, પછી પોતાના ક્ષયોપશમ પ્રમાણે પોતાને ઇચ્ચે તેવા ડોઈ પણ પ્રયોગને પસંદ કરીને અતિ આદરથી પરમાત્માનું શરણ અને સમરણ કરવા પૂર્વક નિયમિત રીતે અમલમાં મૂકે. તો આદરપૂર્વક નિરંતર અભ્યાસથી તેને અવશ્યમેવ આધ્યાત્મિક તથા વ્યાવહારિક લાભ મળશે.

વિચારમાં મહાન શક્તિ રહેલી છે, આ વાત સર્વત્ર સ્વીકાર પામેલી છે. છેલ્ખાં સો-હોદ્દોસો વર્ષથી New Thought movement પશ્ચિમના દેશોમાં શર થયેલી છે. અને વિચારશક્તિ વિષે ધણું જ પુસ્તકો ત્યાં લખાયેલાં છે. ગુજરાતી સાહિત્યમાં વિશ્વવંદનાં ( છાટાલાલ માસ્તરના ) વિચારરત્નરાશિ વગેરે પુસ્તકોમાં પણ વિચારોની શક્તિ વિષે ધણું લખાયેલું છે. આપણું પૂર્વાચાર્યોએ ધ્યાનના સામર્થ્ય વિષે જે વર્ણિયું છે તેનું જ આ વિસ્તરણ છે.

ધ્યાનની વાતો ડેટલીક વાર માણુસને ભ્રમણાર્થ અથવા તો મિથ્યા કલ્પનાર્થ લાગે છે. પરંતુ હકીકત જુદ્દી છે. ધ્યાનમાર્ગની એ પ્રણાલિકા જ છે. માણુસને જેવા થવાની ઈચ્છા હોય તેવા તરફનું ધ્યાન તેણું કરવું જ જોઈએ. જે પ્રાપ્ત કરવાની તેની ઈચ્છા હોય તેનું ચિત્ર તેણું સુરેખ રીતે ચિત્તમાં-ચૈતન્યમાં રાખવું જ જોઈએ. ચૈતન્ય અનંત શક્તિઓનો લંડાર છે.

ભારતીય દર્શનશાસ્કોમાં વિજ્ઞાનવાદનું એક દર્શન છે. વિજ્ઞાનવાદના મત પ્રમાણે વિજ્ઞાન જ ( ચૈતન્ય જ ) અર્થનું રૂપ ધારણું કરે છે. નથયકમાં કહ્યું છે કે વિજ્ઞાનવાદ એ ઉપયોગ-એવાંભૂતનયનો પ્રકાર છે. દર્શનશાસ્કોના વિજ્ઞાનવાદને અહીં સહેલાઈથી સમજવી શકાય તેમ નથી, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાત્મા, પરમાત્માના શુણો તથા પરમાત્માની મંગળકારી પાવનશક્તિઓને જે આપણે આપણું વિજ્ઞાનનો ( ચૈતન્યનો ) વિષય બનાવીએ અને એમાં સતત રમણુતા ડેળવીએ તો આપણું વિજ્ઞાન (આપણું ચૈતન્ય) જ તે રૂપે પરિણ્યામ પામવાની અદ્ભુત પ્રયંક શક્તિ ધરાવે છે. આપણું વિજ્ઞાનનો ( આપણું ચૈતન્યનો ) તે તે રૂપે ડેળવવું એ જ ધ્યાનનો વિષય છે. રહેલાં જે Ideal Reality ભાવના સત્ત્વરૂપે સૂક્ષ્મ અવસ્થામાં હતું તે સતત ભાવનાથી સ્થૂલરૂપે પરિણ્યામ પામે છે.

આ જ વાત વાયક અવર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી  
મહારાજે આ શર્દોમાં કહી છે —

અરિહંતપદ ધ્યાતો થકા, દ્વિહ ગુણ પજનય રે,  
ભેદ છેદ કરો આતમા, અરિહંત રૂપી થાય રે.

### વીર જિષેસર ઉપદિશે.

તત્ત્વાનુશાસન અંથના રચિતાએ આ વાત સ્પષ્ટ કહી છે કે  
આ કાળે પણ ધ્યાન છે, ધ્યાન એ ભાંતિ નથી. પણ વિશિષ્ટ  
પ્રકારનું સત્ય છે.

વાયકા ! અનેક વર્ષોના અનુભવી અને સાધક સુશ્રાવક  
ખાલુલાઈ કરીવાળાના હાથે લખાયેલા આ ધ્યાનવિપયક પુસ્તકનું  
હાઈક સ્વાગત કરશો તેમ જ તેનો યથાયોગ્ય અમલ કરીને વાયકા !  
પરમાત્માની પરમ ફૂપાથી સદ્ગુણી, પવિત્ર, આધ્યાત્મિક શક્તિએથી  
સમર્થ તથા અભ્યંતર સમૃદ્ધિએથી સમૃદ્ધ જનીને સચ્ચિદાનંદભ્ય  
પરમાત્માને પ્રાપ્ત કરીને શીଘ્રમેવ સિક્ષપરમાત્મા ઇપે વિરાજમાન  
થશો, એ શુભેચ્છા.

શ્રી સિક્ષક્ષેત્ર-પાલિતાણા  
વીશાનીમા જૈન ઉપાશ્રય.

ગૈત્રી પૂર્ણિમા,  
વિક્રમ સંવત ૨૦૪૩  
વીર સંવત ૨૫૧૩

પૂ. આ. હે. શ્રી વિજયસિક્ષિસૂરીશ્રી

પઢાલ કાર-

પૂ. આ. હેવશ્રી વિજયમેઘસૂરીશ્રી

શિષ્ય-

પૂ. શુ. શ્રી લુલનવિજયાન્તેવાસી  
સુનિ જાયુવિજય

# આ પુસ્તકમાં ઉપયોગમાં લેવાયેલા આધારભૂત ગ્રંથોની સૂચિ

## ગ્રંથનું નામ

- (૧) સિરિ સિરિવાલ કહા
- (૨) કદ્યાણ મંદિર સ્તોત્ર
- (૩) નિશિથસૂત્ર
- (૪) વંદિતા સ્તુતિ
- (૫) મોટી શાંતિ
- (૬) અજિતનાથ લગવાનવું સ્તવન
- (૭) શાંતિનાથ લગવાનવું સ્તવન
- (૮) ચોવિસી
- (૯) ચોવિસી
- (૧૦) સાડા ત્રણુસો ગાથાનું સ્તવન
- (૧૧) ઉપમિતિ લવપ્રપંચા કથા
- (૧૨) ચોવિસી
- (૧૩) આઠ દષ્ટિની સજાય
- (૧૪) અધ્યાત્મ કલ્પદ્રુમ
- (૧૫) પંચસૂત્ર
- (૧૬) યોગદષ્ટિ સમુચ્ચય
- (૧૭) અધ્યાત્મ યોગી પં. ભરંકરવિજયજી રચિત
- (૧૮) યોગશાસ્ત્ર
- (૧૯) સિદ્ધહેમશળદાનું શાસન
- (૨૦) શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
- (૨૧) શ્રીપાલ રાસ
- (૨૨) પરમેષ્ઠિ વિદ્યા યંત્ર કલ્પ

## રચિતા

- આ. લગવંતશ્રી રત્નશેખરસૂરીશ્વરજી
- આ. લગવંત સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી
- પૂર્વચાર્યાઈત
- સ્થવીર કૃત
- ,,
- શ્રી મોહનવિજયજી
- શ્રી ઉદ્યરત્નસૂરીશ્વરજી
- મહોપાઠ્યાય શ્રી યશોવિજયજી મ.
- ઉ. શ્રી માનવિજયજી મહારાજ
- મહો. શ્રી યશોવિજયજી મહારાજ
- શ્રી સિદ્ધર્ષિ ગણિ
- શ્રી દૈવચંપજી મહારાજ
- મહોપાઠ્યાય શ્રી યશોવિજયજી
- મુનીશ્રી સુંદરસૂરીશ્વરજી
- શ્રી ચિરંજનાચાર્ય
- આ. લગવંત શ્રી હરિલઙ્ગસૂરીશ્વરજી
- સાહિત્ય તથા હસ્તલિખિત ડાયરીઓ
- કલિકાલ સર્વીસ શ્રી હેમચંદ્રાચાર્ય મ.
- „
- ઉ. યશોવિજયજી કૃત
- ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી તથા
- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ
- શ્રી સિંહતિલકસૂરીશ્વરજી

(૨૩) સકલાર્હિત સૂત્ર	આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી
(ત્રિશિથલાકા ચરિત્ર)	
(૨૪) ભગવતીસૂત્ર	
(૨૫) સારમે...લખધા	મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી
(૨૬) શુણુસ્થાનક કુમારીષ	
(૨૭) પ્રતિમા શતક	મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી
(૨૮) સ્તવનો, પહૌ વગેરે	"
(૨૯) શ્રી શત્રુંજ્ય સ્તોત્ર	"
(૩૦) વીરવિજ્યજી કૃત પૂજનએ	શ્રી વીરવિજ્યજી મહારાજ
(૩૧) સ્તોત્ર પૂજન	
(૩૨) સ્તવનો	શ્રી જાનવિમલસૂરીશ્વરજી
(૩૩) ત્રિશિથ શલાકા પુરુષ ચરિત્ર	શ્રી હેમચંદ્રાચાર્યજી
(૩૪) અતીત અનાગત ચોવીસી	શ્રી હેવચંદ્રજી મહારાજ
(૩૫) તત્ત્વાનુશાસન	શ્રી નાગસેતાચાર્યજી
(૩૬) ષોડશક પ્રકરણુ	શ્રી હરિલદ્રસૂરીશ્વરજી મહારાજ
(૩૭) સવાસો ગાથાનું સ્તવન	મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી
(૩૮) સિદ્ધયક પૂજન વિધિ	અજ્ઞાત
(૩૯) શઠસ્તવ	શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી
(૪૦) નવપદની પૂજન	મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી
(૪૧) નવપદની પૂજન	શ્રી હેવચંદ્રજી મહારાજ
(૪૨) નવપદની પૂજન	શ્રી જાનવિમલસૂરીશ્વરજી
(૪૩) નવપદની પૂજન	શ્રી પદ્મવિજ્યજી મહારાજ
(૪૪) શ્રી લલિત વિસ્તરા	શ્રી હરિલદ્રસૂરીશ્વરજી મહારાજ
(૪૫) શ્રી ભગવતી સૂત્ર	શ્રી અભયહેવસૂરીશ્વરજી ટીકા
(૪૬) સંસાર દાવાનલ સ્તુતિ	શ્રી હરિલદ્રસૂરીશ્વરજી મહારાજ
(૪૭) ભક્તામર સ્તોત્ર	શ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજ
(૪૮) શ્રી અનુયોગ દાર સૂત્ર	શ્રી મહલધારી હેમચંદ્રસૂરીશ્વરજી

(૪૬) સિદ્ધ માતૃકાભિધ ધર્મ પ્રકરણુ	શ્રી સિદ્ધસેનહિવાકરસૂરીશ્વરજી
(૫૦) તરવસાર દીપકા	લદ્ધારક સકલકીર્તિ મહારાજ
(૫૧) શ્રી મંત્રરાજ રહસ્ય	શ્રી સિંહતિલકસૂરીશ્વરજી
(૫૨) પાતંજલ યોગસૂત્ર	મહારિં પતંજલિ
(૫૩) ચોવિરસી	શ્રી આનંદધનજી
(૫૪) શ્રી સર્વજ્ઞાષ્ટક	શ્રી મુનિ સુંદરસૂરીશ્વરજી
(૫૫) શ્રી કાવ્ય શિક્ષા	શ્રી વિનયચંપસૂરીશ્વરજી
(૫૬) શ્રી ધ્યાન દંડક સ્તુતિ	( ગુણસ્થાનક કુમારોહ ટીકા )
(૫૭) અધ્યાત્મ માતૃકા	અજ્ઞાત
(૫૮) શારદા સ્તવાષ્ટક	મુનિ શ્રી સુંદરસૂરીશ્વરજી
(૫૯) પરમેષ્ઠ ધ્યાનમાળા	૫. મહાશ્રાવક શ્રી નેમિદાસજી
(૬૦) જ્ઞન સહસ્રનામ સ્તોત્ર	પંડીત આશાધરજી
(૬૧) દ્વાયાશ્રય	શ્રી હેમચંદ્રાચાર્યમૂર્તીશ્વરજી
(૬૨) દ્વાત્રિશદ્દ દ્વાત્રિશિકા	મહોપાધ્યાય શ્રી યશોવિજયજી
(૬૩) પ્રતિમાશતક સ્વેપન વૃત્તિ	„ „
(૬૩) શાનસાર	„ „
(૬૪) શુદ્ધીપથોગ અંથ	શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી
(૬૫) સમવસરણુ સ્તવ	શ્રી ધર્મ કીર્તિસૂરીશ્વરજી મહારાજ
(૬૬) સિદ્ધપ્રાલૂત ટીકા	અજ્ઞાત
(૬૭) અધ્યાત્મ ગીતા	શ્રી હેવચંદ્રજી મહારાજ
(૬૮) રૂર્પ ગાથાનું સ્તવન	મહોપાધ્યાય શ્રી યશોવિજયજી.
(૬૯) પદ સંગ્રહ	શ્રી આનંદધનજી મહારાજ
(૭૦) ભજન સંગ્રહ	શ્રી મીરાંખાઈ
(૭૧) ક્ષેત્ર સમાસ	શ્રી હેવચંદ્રજી મહારાજ
(૭૨) આગમસાર અંથ	૭. યશોવિજયજી કૃત
(૭૩) અમૃતવેલીની સજીવાય	૮. પદ્મવિજયજી કૃત
(૭૪) હેવચંદ્રન માળા	અજ્ઞાત
(૭૫) સમાધિ વિચાર	શ્રી હેવચંદ્રજી મહારાજ
(૭૬) સમવસરણુ સ્તવન	શ્રી હેવચંદ્રજી વિરચિત
(૭૭) પાર્વિનાથ ચરિત્ર	

## શુદ્ધિપત્રક

			અશુદ્ધ	શુદ્ધ
પાઠુ	૫૮	લીટી	૨૭	Imfinite
પાઠુ	૬૭	લીટી	૩-૪	એપાઈન્ટમેન્ટ
પાઠુ	૮૬	લીટી	૨૦	— અહીંથી અનુસંધાન પાઠા ૧૦૦ ઉપર લીટી પાંચમી.
પાઠુ	૧૧૧	લીટી	૭	પછી પાઠું ૧૧૮ નો છેલ્લી ૭ લીટી અને પાઠું ૧૧૯ વાંચ્યા પછી અહીંથી આગળ વાંચવું.
પાઠુ	૧૧૬	લીટી	૧૮	ધ્યાનાવધાન
પાઠુ	૧૬૦	લીટી	૧૪-૧૫-૧૬	ધ્યાનેવધ્યાન આ પ્રમાણે વાંચો જ્યાં સુધી મનને સાચી જગ્યા મળતી નથી ત્યાં સુધી ઠરીને ઠામ બેસતું નથી, તેના માટે સાચી જગ્યા અરિહંતના ચરણુકમળ છે.
પાઠુ	૧૬૦	લીટી	૧૦	ચૈતન્ય
પાઠુ	૧૭૫	લીટી	૧૨	ભને
પાઠુ	૧૭૫	લીટી	૧૩	ઉપયોગને
પાઠુ	૧૮૬	લીટી	૧૫	આ જીવ
પાઠુ	૨૫૮	લીટી	૩	મહતરાસ્કૃતુ
પાઠુ	૨૭૦	લીટી	૧૨	લ
પાઠુ	૨૭૧	લીટી	૭	ય
પાઠુ	૨૮૬	લીટી	૪	મ
પાઠુ	૩૨૩	લીટી	૧૩	આત્મા
પાઠુ	૩૨૭	લીટી	૧૪	પરમાત્મા
પાઠુ	૩૪૩	લીટી	૧૦	૧૦૦૦
પાઠુ	૩૪૩	લીટી	૧૨	દસ હજર
પાઠુ	૩૪૨	લીટી	૨૦	સિત
પાઠુ	૩૪૭	લીટી	૬	વિભાર
પાઠુ	૩૬૦	લીટી	૭	અનુભવલું



ॐ हौँ अहं नमः

## सालं धनं ध्यानना प्रयोगो

पाठ पठेते।

अनंत लिखिना निधान श्री गौतम गणुधर लगवंत  
राजगुही नगरीએ पधार्या છે. શ્રेष્ઠિક મહારાજ વગેરે ઉત્તમ  
જનો દેશના સંભળવા માટે આવ્યા છે. પર્વાને ઉદ્દેશીને  
ગौતમ મહારાજ અનંત કલ્યાણુકારિણી, સર્વ પાપ પ્રણાશિની,  
મોહતિમિર વિનાશિની, પરમ આનંદ પ્રદાચિની, કલ્યાણ  
પરંપરા વર્ધિની, કર્મકાષ દાહિની, લવ સંતાપહારિણી, સકલ  
જીવ સંજીવની, જીવનજ્યોત પ્રકાશિની, સુમધુર એવી હિંય  
વાણીમાં ઉપદેશ આપી રહ્યા છે-

દશ દ્યાંતે હુલ્લાલ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો  
પછી પાંચ પ્રકારના પ્રમાણે ત્યાગ કરીને નિરંતર સહ્યધર્મ-  
કાર્યમાં રત રહેવું.

ધર્મના ચાર પ્રકાર છે. ધર્મનું વર્ણન કરતાં ગौતમ  
ગણુધર લગવંત કહે છે-

સ્તો ધર્મો ચરુભેઽો ઉબહણો સયલજિણવરિદેહિ ।  
દાણ સીળં ચ તથો, ભાવોઽષિ અ તસ્સમે ભેયા ॥ ૧૮ ॥

તत्थ વિ ભાવેણ વિણા દાણ ન હુ સિદ્ધિસાહણ હોઈ ।  
 સીલ વિ ભાવવિયલ, વિહલ ચિય હોઈ લોગંમિ ॥ ૧૯ ॥  
 ભાવં વિણા તવો વિ હુ, ભવોહવિત્થારકારણ ચેવ ।  
 તમ્હા નિયમાવુચ્ચિય, સુવિસુદ્ધો હોઈ કાયવ્વો ॥ ૨૦ ॥  
 ભાવો વિ મળો વિસથો, મળ ચ અદુજ્જયં નિરાલંબ ।  
 તો તસ્સ નિયમણત્થં, કહિયં સાલંબણ જ્ઞાણં ॥ ૨૧ ॥  
 આલંબણાળિ જઇવિ હુ, બહુપ્યયારાળિ સંતિ સત્યેસુ ।  
 તહવિ હુ નવપયજ્ઞાણં, સુપહાણ બિંતિ જગગુરુણો ॥ ૨૨ ॥  
 અરિહંતસિદ્ધાયરિયા, ઉજ્જાયા સાહુણો અ સમ્મતં ।  
 નાણ ચરણ ચ તવો, ઇય પયનવગ મુણેયવ્વં ॥ ૨૩ ॥

—શ્રી રત્નશેખરસૂરી વિરચિત સિરિ સિરિવાલ કડા.

(સિરિ સિરિવાલ કડા શ્લોક ૧૮ થી ૨૨ નો અર્થ) :-

૧. સર્વ તીર્થીંકર લગવંતોએ ચાર પ્રકારનો ધર્મ ઉપ-  
દેશોલો છે : હાન, શીલ, તપ અને ભાવ. ધર્મના આ  
ચાર પ્રકાર છે. ॥ ૧૮ ॥
૨. એમાં પણ ભાવ વિનાનો ધર્મ સિદ્ધિને સાધી આપ-  
નાર થતો નથી. એ જ રીતે ભાવ વિહોણું શીલ પણ  
લોકમાં નિર્ણણ જાય છે. ॥ ૧૯ ॥
૩. સુવિશુદ્ધ ભાવ વિનાનો તપ પણ લવવૃષ્ટિનું કારણ  
અને છે. તેથી પોતાના ભાવને સુવિશુદ્ધ કરવો  
નોઈએ. ॥ ૨૦ ॥
૪. ભાવ પણ મનનો વિષય છે અને આદાંખન રહિત  
મનને અતવું ધણું મુશ્કેલ છે. તેથી મનને વશ

કરવા આલંખનવાળું સાલંખન ધ્યાન કહેલાં છે.  
( બતાવેલું છે ). ॥ ૨૧ ॥

૫. જે કે શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં આલંખનો કહેલાં છે. તો પણ નવપદના ધ્યાનને પ્રધાન આલંખન તરીકે જિનેશ્વર લગવાતોએ ગણ્યું છે. ॥ ૨૨ ॥

૬. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, શાન, ચારિત્ર અને તપ આ નવપદો એ સાલંખન ધ્યાન માટેનું પ્રધાન આલંખન છે.

“સિરિ સિરિવાલ કહા” નામના વ્યથમાં લગવાન શ્રી ગૌતમ સ્વામીજી મહારાજ ઉપરેશ આપે છે કે, દર્શાંતે ફુર્લંબ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી પાંચ પ્રકારના પ્રમાણનો ત્યાગ કરીને નિરંતર સફ્ફધમ્ભ-કર્મમાં રક્ત રહેવું. પછી ચાર પ્રકારના ધર્મનું વણ્ણન કરતાં કહે છે કે, હાન, શીલ, તપ અને લાવ નામના ચાર પ્રકારના ધર્મમાં લાવ ધર્મ સુખ્ય છે. લાવ વગરનું કરેલું હાન, શીલ કે તપ નિષ્ઠળ જાય છે અને લવવૃદ્ધિનું કારણ અને છે. માટે હાન, શીલ, તપ આહી ધર્મના અનુષ્ઠાનો લાવપૂર્વક કરવાં જોઈએ લાવ એ મનનો વિષય છે. આલંખન વગરનું મન અતિ હુજ્ઞ્ય છે. તે મનનું નિયમન કરવા માટે સાલંખન ધ્યાન બતાવ્યું છે.

મનના એ પ્રકારના દોષ છે. એક ચંચળતા અને બીજું મહિનતા. મન ચંચળ હોવા છતાં જે મનને અનુકૂળ કે ગમતું આલંખન મળે તો તે સ્થિર થધ શકે છે, પણ

ને આલંબન અશુદ્ધ હોય તો મન ભવિન થાય છે. ધન, જી આદિ જગતના આલંબનો મનની ભવિનતામાં વૃદ્ધિ કરે છે. માટે ભવિનતા હૂર કરવા અને ચંચળતાને બદલે સ્થિરતા લાવવા મનને શુદ્ધ આલંબનને વિષે બાંધવું જોઈએ.

એવાં શુદ્ધ આલંબનો જિનશાસનમાં અનેક પ્રકારનાં છે, તેમાં અરિહંત આદિ નવપહ એ સર્વ શ્રેષ્ઠ આલંબન છે, માટે આપણે નિરંતર નવપદનું ધ્યાન કરવું જોઈએ. નવપદના ધ્યાનથી આત્મામાં લાવધર્મ ઉત્પત્ત થાય છે. લાવ સહિત કરેલ સર્વ ધર્માનુષ્ઠાનો મોક્ષના હેતુ બને છે. દૂર્કમાં શ્રી ગૌતમ ગણુધર ભાગવાનનો આશય એ છે કે ધર્માનુષ્ઠાનો તથા ધર્મની કિયાએને લાવપૂર્વકની બનાવવા માટે અરિહંત આદિ પહોનું સાલંબન ધ્યાન કરવું જોઈએ.



॥ ઇલિકા ભ્રમરોધ્યાનાત, ભ્રમરોત્વં યથાશ્નુતે ।  
તથા ધ્યાયન् પરામાત્મન, પરમાત્મત્વમાન્યાત ॥૧૪૩॥

ભ્રમરીના ધ્યાનથી ઈલિકા જેમ ભ્રમરીપણાને  
પામે છે તેમ પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા  
પરમાત્મપણાને પામે છે.

( નમસ્કાર ચિંતામણિ )

## ધ્યાન પ્રયોગ અંગે પ્રાસંગિક

અરિહંત આહિ પહોના ધ્યાનથી સામાયિક, પ્રતિકમણ, શૂળ આહિ સર્વ ધર્મ કિયામાં પ્રાણપૂર્તિ થાય છે. કહું છે કે અસ્માત् ક્રિયા પ્રતિકલન્તિ ન ભાવશૂન્યા । ( કલ્યાણ મંદિર સ્તોત્ર. ) લાવ વગર કરેલી કિયા ઇળાદાયી બની શકતી નથી. એટલે કે લાવ વગરની કિયા નિષ્ઠળ જાય છે અને ભાવ તો ભગવાન ગૌતમ સ્વામીના કહેવા મુજબ મનનો વિષય છે અને આલંબન વગરનું મન અતિ ફુજ્ઝય છે. તે અનનું નિયમન ડરવા માટે ભગવંત ગૌતમસ્વામીનું અરિહંત આહિ પહોનું સાલંબન ધ્યાન બતાવે છે. એટલે કે ધર્મકિયાને ભાવસહિતની બનાવવા માટે, ધર્મકિયામાં પ્રાણપૂર્તિ કરવા માટે, ધર્મકિયાને મોક્ષ હેતુક બનાવવા માટે, અરિહંત આહિ પહોનું ધ્યાન અતિ જરૂરી છે. ઉપયોગ શૂન્યપણે, ભાવશૂન્યપણે થતી કિયામાં ભાવપ્રાણ પૂરવા માટે અરિહંત આહિ પહોનું ધ્યાન આપણી આરાધનાનું મુખ્ય અંગ બની જાય છે.

જગતના પદાર્થીને સ્થાને પરમાત્માને ધ્યાનનો વિષય બનાવવો એ જગતની સર્વોત્તમ કળા છે.

અરિહંત પરમાત્મા આપણા પ્રાણથી પણ અધિક છે. તેમના અનંત ઉપકારો, તેમનામાં રહેલી અચિંત્ય તારક શક્તિ,

આપણા જેવા અનાથ દ્વારામાં સંસારમાં અથડાતા જીવોને  
એક માત્ર શરણ આપવાનું તેમનું સામર્થ્ય આહિ જેતાં  
એક ક્ષણું તેમને ભૂલવા ન જોઈએ. ક્ષણે ક્ષણે તેમનું દર્શન,  
પૂજન, વંદન, રત્નન, સમરણ, ધ્યાન અને આજાપાદન  
આપણું પરમ કર્તાબ્ય છે. અરિહંત પદનું ધ્યાન માતાના  
દ્વિધની જેમ પરમ હિતકારક છે. અરિહંત પદનું ધ્યાન કરવું  
તે આપણી પવિત્ર ઝરણ છે. નવપદમાં કેન્દ્રસ્થાને અરિહંત  
પરમાત્મા છે. ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ, સર્વાશ્રોષ, સર્વોત્તમ આલા-  
ખન અરિહંત પરમાત્મા છે અને આવા કરણુંના સાગર,  
કૃપાના અવતાર, ધ્યાના સમુર્દ અરિહંત પરમાત્મા જેમાં  
આલાખન રૂપ છે તેવું ધ્યાન તેને સાલાખન ધ્યાન કહેવાય છે.

દ્વેક મનુષ્ય ધ્યાન કરી રહ્યો છે, માત્ર સાધના કર-  
નાર જ ધ્યાન કરે છે તેવું નથી પ્રત્યેક જીવ ધ્યાન કરે  
છે. આપણે જ્યારે ધ્યાન કરવા એસીએ છીએ ત્યારે જ  
ધ્યાન થાય છે તેવું નથી. રાત અને દિવસ આપણું ધ્યાન  
ચાલુ જ છે. જગતના પદાર્થોનું ધ્યાન આપણે નિરંતર કરીએ જ  
છીએ. વિષયોને-પદાર્થોને પ્રાપ્ત કરવાનું અને તેની સુરક્ષા  
કરવાનું ધ્યાન ચાલુ છે. જ્ઞાની પુરુષો તેને આર્તધ્યાન,  
સૌદ્રધ્યાન કહે છે. આપણે આવા ધ્યાનથી ટેવાઈ ગયા છીએ.  
તેના કારણે નિરંતર આપણું મન લય, શોક, ચિંતા અને  
દેનશનથી બ્યાબ રહે છે. આવા પ્રકારનો લાગણીથી  
આપણે નિરંતર પીડાઈ રહ્યા છીએ. આવા પ્રકારનું દેનશન  
-તાણું, તેનું કારણ પણ ધ્યાન છે. તેમાંથી દ્વી-

વાનો ઉપાય પણું ધ્યાન છે. આપણું આકર્ષણું જગતના પહોંચોને બદલે પરમાત્મા તરફ થાય ત્યારે ધર્મધ્યાન શરૂ થાય છે. હડીકરતમાં આવા પુસ્તકો કે ધ્યાનના પ્રયોગો હિશા પરિવર્તન માટે જ છે. જે હિશામાં અત્યારે ધ્યાનની ધારા વહી રહી છે તે બદલીને પરમાત્મા અને આત્મચૈતન્ય તરફ ધ્યાનની ધારાને લઈ જવા માટેના પ્રયોગો આપણે કરવાના છે. આપણું મન એકાચ જરૂર થાય છે. જે વસ્તુ ઉપર એકાચ થતું હતું તે વસ્તુનો Object બદલવાનો છે. જગતના પહોંચોના બદલે ધ્યાનનો વિષય પરમાત્મા અને આત્મચૈતન્ય આવા પ્રયોગોથી અને છે. સાકર મીડી છે તેથું ૧૦૦ પાનાનું પુસ્તક વાંચવું જુદો વિષય છે અને સાકરનો કુકડો મોઢામાં નાખીને સ્વાદનો અનુભવ કરવો તે જુદો વિષય છે. અહીં સ્વાદનો અનુભવ કરવાની પ્રક્રિયા બતાવી છે.

આત્મધ્યાન, રૌદ્રધ્યાન, લય, શોાર્ક, ચિંતા આહિમાંથી છૂટવા માટેની ધ્યાન પ્રક્રિયા પ્રયોગ નં. ૧ માં છે. તેમાં જ્યારે આપણે ધ્યાનમાં એસીએ, પરમાત્માની કૃપાથી પૂણ્ય લરાઇ જઈએ, પરમાત્માની કર્માની દિંય શક્તિથી લાવિત અનીએ....પ્રલુની કર્માની સ્નાન કરતાં કરતાં સ્થિરતાપૂર્વક ધ્યાન કરીએ....ત્યારે પરમાત્માની અરિહંત શક્તિ આપણા અંદર કાર્યર્થીલ થાય છે અને આપણા આંતરમન સુધી પહોંચી આપણા વિચારો અને ટેવેનું પરિવર્તન કરે છે. તે વખતે સેલ્ફ એટો સાન્સેસન ( Self Auto suggestion)

ધ્રારા આપણી જાતને આપણે સ્વયં સૂચના આપીએ છોંએ.  
મને કોઈ ચિંતા નથી, હુંઅ નથી, લય નથી, ટેન્શન નથી.  
હું સુખમાં છું, આનંદમાં છું, શાન્તિમાં છું.....  
.....આ સ્વયં સૂચના જેટલા જિંડાણુમાં આપણા  
આંતરમનને સ્પર્શો છે; તેટલી આપણી જૂની ટેવો જઈએ  
પરિવર્તન પામે છે. આ પ્રયોગથી કોઈ પણ કારણ વગર  
લય અને ચિંતા કરવાની જૂની ટેવ બદલાય છે. આપણા  
આંતરમનને ઉપરના ભાવો સ્પર્શવાથી ગમે તેવા સંજો-  
ગોમાં પણ આપણે સુખ, શાન્તિ અને આનંદમાં રહેવા  
ટેવાઈ જઈશું. આ પ્રયોગમાં જેટલું વધારે ભાવિત બનાય  
તેટલું શીધ પરિવર્તન થાય છે. કોઈ પણ વસ્તુને ભાવિત  
કરવાથી તેના શુષ્ણુધર્મ બદલાઈ જાય છે. અનાજને આગ  
ઉપર રાંધવાથી ભાવિત થાય છે. પાણી, હૃદ વળેરને ગરમ  
કરવાથી ભાવિત થાય છે.

કલ્યાણ મંહિર સ્તોત્રની ૧૭ મી ગાથામાં સિદ્ધસેત  
દિવાકરસ્કુરીઝ મહારાજ કહે છે કે પાણીને અમૃત ઇંપે ભાવિત  
કરવાથી તે અમૃત તુલ્ય કાર્ય કરે છે. આ રીતે આપણા  
મનને ભાવિત કરવાનું છે. હું નિરંતર પરમાત્માની કર-  
ણામાં સ્નાન કરું છું. હવે મને લય, શોક, ચિંતા, આર્થિ-  
ધ્યાન, રૌદ્રધ્યાન સ્પર્શી પણ નહીં શકે. હું સહા-સર્વદા  
સુખ, શાન્તિ, આનંદમાં રહીશ. આ ભાવથી ભાવિત થવાથી  
સ્વભાવ પરિવર્તન થાય છે. ચિંતા અને લયઅસ્ત બન-  
વાની જૂની ટેવો બદલાય છે અને તેને બદલે શાન્તિ અને

આનંદમાં રહેવાની ટેવ પડે છે. પરમાત્માની કરુણા શક્તિની સહાય લઈને આપણે ટેવોને બહદ્રી શકીએ છીએ. અત્યારે જીસ્સામાંથી ઝૂમાલ પડી જાય તેવી નાની ખાખતમાં પણ આપણે લયગ્રસ્ત બનીએ છીએ. હવે આવા પ્રયોગો વાર-વાર નિયમિત કરવાથી આલ તૂટી પડે તો પણ આપણે સ્વસ્થ રહી શકીએ તેવું પરિવર્તન આપણામાં આવે છે. તે માટે નિયમિત સાધનાની જરૂર છે.

આ પ્રયોગોનો અલ્યાસક્રમ આપણી વૃત્તિઓનું મૂળમાંથી રૂપાંતર કરે છે. જગતના પદાર્થોમાં સુખ અને આનંદ શોધવા સૌ પ્રયત્ન કરે છે અને તેમાંથી સુખ, આનંદ મળતાં નથી તેથી પીડાય છે. હવે આ વૃત્તિનું મૂળમાંથી પરિવર્તન પ્રયોગ નં. ચાર, પાંચ અને છથી થાય છે. અરી રીતે આપણું જરૂર છે સુખ અને આનંદની. તે ક્યાં છે તે અભર નહીં હોવાથી આપણે પીડાઈ એ છીએ. આનંદ અને સુખનો ભંડાર આત્મામાં છે. આનંદ અને સુખનો પૂર્ણ પ્રગટ ભંડાર પરમાત્મામાં પ્રત્યક્ષ છે. તેથી આનંદની, સુખની, ઈચ્છાવાળા સાધકનો ગ્રેમ પરમાત્મા તરફ વળે છે. કારણું કે પરમાત્મા પ્રગટ આનંદના ભંડાર છે અને તેમના આલંબને આપણા આત્મામાં રહેલાં સુખ અને આનંદનો અનુભવ થાય છે. તેથી સાધકનો ગ્રેમ પરમાત્મા તરફ વહેતો રહે છે. અને તે પરમાત્મા પ્રત્યેનો ગ્રેમ જ પરમાનંદ સ્વરૂપ બની અનુભૂતિમાં આવે છે.

આવી રીતે પ્રયોગ નં. ચાર અને પાંચમાં

અતાવેલ ધ્યાન વારવાર, નિયમિત, શુદ્ધ ભાવથી કરવામાં આવે છે ત્યારે મનની ગતિ પણ આનંદના લંડાર આત્મા તરફ થતાં હિંય આનંદની અનુભૂતિ થાય છે. આ રીતે ધ્યાન દ્વારા હિંય આનંદની અનુભૂતિ કરીને બહાર આવેલું મન તે આનંદને કરી કરીને જાએ છે. તેથી પ્રગટ પરમાનંદના પૂર્ણ લંડાર અને આપણા પોતાના પરમ આનંદ અને હિંય સુખના એક ભાગ હેતુ રૂપ પરમાત્માનું સમરણ - ધ્યાન સહજ અની જાય છે. જે રીતે અત્યારે જગતના વિષયો અને પદાર્થોનું ધ્યાન સહજ રીતે વિના પ્રયત્ને થાય છે, તે રીતે આવા ધ્યાનના પ્રયોગોનું નિયમિત આરાધન કરવાથી પરમાત્માનું સમરણ અને ધ્યાન સહજ અની જશે.



આત્માઽયમહૃતો ધ્યાનાત્ પરમાત્મત્વમશ્રનુતે ।  
રસં વિદ્ધિ યથા તાત્, સ્વર્ણત્વમધિગચ્છતિ ॥૧૪૭॥

જેમ રસથી વિંધાયેલું તાંબું સુવર્ણપણાને પામે છે, તેમ આ આત્મા શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનથી પરમાત્મપણાને પામે છે.

(નમસ્કાર ચિંતામણિ)

Receptive attitude towards Paramatma.

## પરમાત્માની કરુણાને જીવિવાની દિવ્ય કળા।

અન્યથા શરણ નાસ્તિ, ત્વમેવ શરણ મમ;

તસ્માત् કારૂણ્યભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર.

અરિહંત પરમાત્માનો અને આપણો સંબંધ અનંત-  
કાળથી ચાલ્યો આવે છે. પરમાત્મા કરુણાના કરનાર છે.  
આપણે તેમની કરુણાના પાત્ર છીએ. પરમાત્મા કરુણાના  
નિધાન છે, કૃપાના અવતાર છે, હ્યાના સમુદ્ર છે, વાત્સલ્ય-  
ના લંડાર છે. જગતના સર્વ જીવ ઉપર એક ધારી  
કરુણા તે વરસાવી રહ્યા છે. “સ્વયંભૂરમણુ સ્પર્ધિ કરુણારસ  
વારિણુ” સ્વયંભૂરમણુ સમુદ્રની સ્પર્ધા કરે તેવા અનંત  
કરુણાના નિધાન અરિહંત પરમાત્મા છે. જે સમયે આપણે  
નિજોદમાં હતા, આપણી જાતનું આપણુને ભાન પણ ન  
હતું; તે સમયે આપણો એ હુઃખમાંથી છૂટકારો કેમ થાય ?  
તેવો આપણા માટે વિચાર કરનાર કોઈ હોય તો અરિ-  
હંત પરમાત્મા છે. નરક, તર્યાંચ આહિ ગતિમાં આપણે  
પીડાઈ રહ્યા હતા તેવા સમયે આપણી એ પીડા કેમ નાશ  
પામે અને આપણુને પરિપૂર્ણ સુખ કેમ પ્રાપ્ત થાય તેવો  
આપણા માટે ભાવ કરનાર કોઈ હોય તો અરિહંત પર-  
માત્મા છે. આડના પાંડા જેવી તુચ્છ હાલતમાં જ્યારે  
આપણે હતા તે સમયે આપણી એવી તુચ્છ અવસ્થામાં

પણ સિદ્ધ લગવંતના જેવું ચૈતન્ય છુપાયેલું છે તેનું મૂલ્યાંકન કરનાર અને આપણું એ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય તે માટેનો માર્ગ બતાવનાર કોઈ હોય તો તીર્થાંકર પરમાત્મા છે. આ રીતે અનંત કાળથી અરિહંત પરમાત્માનો અને આપણો સંખ્યાંધ ચાલતો આવે છે. તે સંખ્યાંધનું અજ્ઞાન હોવાને કારણે આપણે હજુ લવભ્રમણુથી પીડાઈ રહ્યા છીએ. વરસાઈ પડતો હોય ત્યારે જેનું પાત્ર જીંધું હોય તેનું પાત્ર આલી રહે છે, અને જેનું પાત્ર સીધું હોય તેનું પાત્ર-પછી તે પાત્ર થાળી જેવડું હોય, વાટકી જેવડું હોય કે સરોવર જેવડું હોય-ખદું જ લરાઈ જાય છે. પ્રભુની કર્ણાંદ્રાનો સર્વત્ર એક ધારી, એક સરળી નિરંતર વરસી રહી છે. તે કર્ણાંદ્રાને જે મનુષ્ય પોતાના હૃદયમાં જીવે છે તેને પ્રભુની આ મહા કર્ણાંદ્રાનો સક્રિય લાલ મળે છે. આજ સુધી આપણે Non-Receptive Attitude અથહણુશીલ-વૃત્તિવાળા હતા તેવા આપણા હૃદયને અહણુશીલ વૃત્તિવાળું (Receptive Attitude) કેવી રીતે બનાવવું, તે માટે પરમાત્માની કર્ણાંદ્રાને જીવાતાની હિંય પ્રક્રિયા પ્રયોગ ન'. ૧ માં બતાવી છે.



# પરમાત્માની કરુણાના હિંય પ્રભાવે પીડાકારક ટેવોના પરિવર્તનની પ્રક્રિયા

From Tention to Peace

જેવી રીતે હિંયનોટીઝમના ડેફિનેશન દરહીને ટેખલ ઉપર સુવાડી તેને સૂચન (suggestion) આપે છે : “તું સાંલે થઈ ગયો છે. તારી તબિયત એકદમ સારી થઈ ગઈ છે. તું હોડતો થઈ ગયો છે વગેરે વગેરે.” આની સૂચના દરહીને તેના આંતરમન સુધી સ્પર્શે છે ત્યારે તે અશક્તા માણુસ પણ હોડવા માંડે છે. તે રીતે આપણુંને પણ વિના કારણું લયચુસ્ત બની જવાની, ચિંતા કરવાની, શોંક કરવાની, હીનહુઃખી બની જવાની, અશાન્ત થઈ જવાની, આત્મ-રૌદ્ર ધ્યાન કરવાની પીડાકારક ટેવો પડી ગયેલ છે. તે ટેવોમાંથી છૂટવા માટે આપણે આજ સુધી ઘણ્ણા પ્રયત્ન કર્યો છે. પરંતુ તેમાં આપણુંને સર્કણતા મળી નથી. હવે આપણે પરમાત્માની કરુણાની સહાય લઈને સ્વયં સૂચનાના પ્રયોગ કરારા તે જૂની ટેવોનું પરિવર્તન કરીશું. પરમાત્માની કરુણા જ્યારે આપણા આંતરમનને સ્પર્શે છે ત્યારે સ્વયં સૂચના (auto suggestion) કરારા શોંક, હુઃખ, લય, ચિંતા, અશાન્તિમાંથી છૂટકારો થાય છે. (ટેવોનું પરિવર્તન થાય છે.) અને સુખ, શાન્તિ, આનંદ અને નિઃયતાનો અનુભવ લગવાનની કરુણાના હિંય પ્રભાવે થાય છે.

## ભાવની અસરકારકતા

આપણે ધ્યાન સમયે આંખ બંધ કરીને જે કાંઈ દશ્ય જોઈએ છીએ, જે કાંઈ ભાવથી લાવિત બનીએ છીએ, જે કાંઈ સંકલ્પ કરીએ છીએ તેની આપણા ઉપર શું અસર થાય છે ?

એક ચોણી પુરુષ હિમાલયની ગુર્જામાં બેઠા છે. ઠંડીમાં થરથરતો એક માણુસ ચોણી પુરુષ પાસે આવી પ્રાર્થના કરે છે, “હું ઠંડીમાં ધૂજુ રહ્યો છું. કાંઈ ઉપાય કરો નહીં તો ઠંડીમાં થીજુ જઈશ.” તે વખતે ચોણી પુરુષ રં રં રં બીજથી પોતાની જતનું અગિન સ્વરૂપે ધ્યાન કરે છે, અને ઠંડીથી ધૂજતા માણુસને પોતાના કિરણો આપે છે. તેનાથી ધૂજતા માણુસની ઠંડી હુર થાય છે. આ દ્ઘણાત શું બતાવે છે ? દિવાસળી ચાંપીને અગિન સળગેલો કોઈએ જોયો નથી; પરંતુ ઠંડી હુર થવાનું કાર્ય (Result) થવાથી અગિન પ્રગટ થયો હતો તે પણ કબૂલ કરવું પડે છે. તે રીતે પ્રલુની કરુણારૂપી અગિનમાં આપણી પાપવૃત્તિએ, હુણ લાવો અને મહિન વાસનાએને આપણે નિત્ય બળતી જોઈશું અને પ્રનવલિત અગિન જવાળામાં પાપ વૃત્તિએને બળીને લસ્ભીભૂત થતી જોઈશું, તો જરૂર આપણી વાસના અને પાપવૃત્તિએ શાન્ત થઈ જતી આપણે જીવનમાં અનુભવીશું. નિશીથ સૂત્રમાં સમ્યકૃતવના અતિચાર ‘શાંકા’ ઉપર એક ઉદ્ઘાંરણ આવે છે. એક માતાના એ પુત્રો હતા. એક પૂર્વની ઓને અને એક પોતાનો હતો. મા બન્નેને રાખ

આપતી; જેમાં મગના કે થીજા કોઈ ધાન્યના ફોતરાં આવતાં હતાં. ઔરસ પુત્ર સમજતો હતો કે મારી મા મને સારી જ વસ્તુ આપે છે. એરમાન પુત્ર માનતો હતો કે મરેલી માખીવાળી વસ્તુ મારી મા આપે છે. સતત આ ચિંતનથી એ રોગી થયો. એની ચેતના રોગીષ થઈ. છેવટે એ મૃત્યુ પાણ્યો. મગના ફોતરાં પણ મરેલી માખી રૂપ ચિંતન કરવાથી તે મૃત્યુને આપનાર બન્યા. જે વસ્તુને જે ભાવથી ભાવિત કરવામાં આવે છે તે રૂપ ઝણને તે આપે છે.

કલ્યાણ મંહિર સ્તોત્રમાં સિદ્ધસેનહિવાકરસ્થરીશ્વરજી  
કહે છે—

આત્મામનીષિભિરયં ત્વદ્ભેદબુધ્યા,  
ધ્યાતો જિનેન્દ્ર ! ભવતીહ ભવત્પ્રભાવ : ।  
પાનીયમણ્યમૃતમિત્યનુચિન્ત્યમાનં;  
કિં નામ નો વિષવિકારમપાકરોતि ॥

(કલ્યાણ મંહિર ગાથા-૧૭)

હે જિનેશ્વર લગવાંત ! પાણ્યી પણ અમૃત છે-અમૃત છે-તે રીતે ચિંતન કરવાથી એટલે કે અમૃત ઝુદ્ધિએ ચિંતવેદું પાણ્યી પણ જેમ જેર ઉતારે છે; તે રીતે હે પ્રભુ ! તમારી સાથે અસેદ લાવે ધ્યાન કરવાથી કર્મમળ રૂપ જેર ઉતરોને આ આત્મા પરમાત્મા થાય છે.

જે ભાવથી પરમાત્માનું ધ્યાન કરવામાં આવે છે તે રીતે પરમાત્મા અવશ્ય ઝણદાયી થાય છે.

હવે આપણે ધ્યાન પ્રયોગમાં પ્રવેશીએ. સાકરની

મીઠાશનું ઘણું વણું કણું. હવે સાકરનો દુકડો માટામાં નાખી મીઠાશનો સ્વાદ માણીએ.

**Ideal Reality :-( મનોમય ભૂમિકા ઉપરનું સત્ય )**  
 લગવાન મહાવીરસ્વામી ૨૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. નિર્બાણું પામી મોક્ષ ગયા. તે Historical Reality -ઐતિહાસિક સત્ય છે. તે જાણવા માટે ઘણું ઉપયોગી છે; જ્યારે પરમાત્માની અઙ્ગિતા, ઉપાસના, ધ્યાન સમયે Ideal Reality મનોમય ભૂમિકા ઉપરનું સત્ય કામ આવે છે.  
 હા. ત., મહેસાણુમાં સીમાંધરસ્વામીનું મંહિર છે. ત્યાં અત્યારે આપણે જઈને પૂજા-સેવા કરી શકીએ છીએ, તે લૌટિક રૂપે પ્રગટ થયેલું સત્ય ( Objective Reality ) હુંદેવાય. આજથી ૨૦ વર્ષ પહેલાં તે સ્થળે જંગલ હતું. તે વખતે એક સંત પુરુષના મનમાં વિચાર ઉત્પન્ન થયો કે એક માદું મંહિર હોય જોઈએ, તેમાં માટા સીમાંધરસ્વામી લગવાન બિરાજમાન હોવા જોઈએ વગેરે. ૨૦ વર્ષ પહેલાં સંત પુરુષના મનમાં ઉત્પન્ન થયેલું મંહિર તે મનોમય ભૂમિકા ઉપરનું સત્ય ( Ideal Reality ) છે. જો સંત પુરુષના મનમાં ૨૦ વર્ષ પહેલાં તે મંહિર ન આવ્યું હોત, તો અત્યારે ત્યાં જંગલ હોત અગર ખીજું કાંઈ હોત. સંત પુરુષના મનમાં ઉત્પન્ન થયેલું મંહિર તે Ideal Reality-મનોમય ભૂમિકા ઉપરનું સત્ય છે.

જગતમાં જેટલાં ચુદ્ધ થયાં તેમાં સૌથી પહેલાં મનુષ્યનાં મનમાં ચુદ્ધ થાય છે. તે પછી ધર્મા વખત પછી રહ્ય-

મેદાનમાં ચુદ્ધ થાય છે. મનમાં ઉત્પન્ન થયેલું ચુદ્ધ Ideal Reality નું ચુદ્ધ છે. રણમેદાનમાં ઐલાતું ચુદ્ધ Objective Reality નું ચુદ્ધ છે. (લૌટિકિક્સે પ્રગટ થયેલું સત્ત્વ.)

આપણે ફુકાન કે કારખાનું કરવું હોય ત્યારે ફુકાન કે કારખાનું સૌથી ગ્રથમ આપણા મનમાં ઉપસ્થિત થાય છે. તે પછી આપણે જગ્યા અરીદીએ છોએ. તેમાં વેપાર, નક્કી વગેરે થાય છે. નક્કી કરતી ફુકાન કે કારખાનું તે (Objective Reality) લૌટિકિક્સે પ્રગટ થયેલું સત્ત્વ છે. અને મનમાં ઉપસ્થિત થયેલ ફુકાન કે કારખાનું તે Ideal Reality) મનોમય ભૂમિકા ઉપરનું સત્ત્વ છે. જે આપણા મનમાં તે ફુકાન કે કારખાનું ન આવ્યું હોત તો આપણે કહી ફુકાન કે કારખાનાના માલિક બની શકત નહીં.

પ્રસન્નચંડ રાજ્યિક ધ્યાનમાં જિલેલા હતા. બહાર કોઈ ફુથમન સાથે ચુદ્ધ ઐલાતું ન હતું. કોઈ શરૂ પણ ન હતાં, છતાં પ્રસન્નચંડ રાજ્યિકના મનમાં ઐલાતું ચુદ્ધ તે (Ideal Reality) મનોમય ભૂમિકા ઉપરનું સત્ત્વ છે. શ્રાણ તે મનનું ચુદ્ધ સાતમી નરક સુધી પહોંચાડવાને સમર્થ હતું. તે ચુદ્ધના ભાવમાં પલટો આવતાં, આત્મધ્યાનમાં ચઢતાં તે કેવળજ્ઞાન સુધી પહોંચી શકચા. ચૌદ રાજલોકના બન્ને છેડા સુધી પહોંચાડવાનું સામર્થ્ય પ્રસન્નચંડ રાજ્યિકના મનની અંદર ચાલી રહેલ કાવોમાં હતું.

ધા. પ્ર. ૨

આ દ્વારાંતો ઉપરથી એક વસ્તુ સમજાય છે કે, લૌટિક રૂપે પ્રશાટ થયેલું સત્ય, પહેલાં તો મનુષ્યના મનમાં ઉત્પન્ન થાય છે. આવી રીતે પરમાત્મા પણ પહેલાં આપણા મનમાં ઉપસ્થિત થાય છે, મોક્ષ પણ પહેલાં આપણા મનમાં ઉત્પન્ન થાય છે, પછી સાચો મોક્ષ પ્રગટ થાય છે. કોઈ મનુષ્ય સંકલ્પ કરે કે, “આવતા જન્મમાં મારે મહાવિદેહ ક્ષેત્રમાં-સીમાંધરરસ્વામી લગ્વાન વિચરે છે, તે ક્ષેત્રમાં મનુષ્ય તરીકે જન્મ લેવો છે. આઠ વર્ષની ઉંમરે હું લગ્વાન પાસે દીક્ષા લઈશ અને પરમાત્મા સીમાંધરરસ્વામીની આજા મુજબ સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીશ.” આવો મહાન સંકલ્પ સિદ્ધ કરવા માટે અત્યારે આ જન્મમાં શું કરવું જોઈએ? અત્યારે જ કલ્પનાથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ લગ્વાન સીમાંધરરસ્વામીના સમવસરણુમાં આપણે એડેલા છીએ તેવું ચિત્ર સ્પષ્ટ આપણી સામે ઉપસ્થિત કરી, તેમાં સ્થિર બનવું. “લગ્વાનની દેશના આપણે સાંલળીએ છીએ. તે દેશના આપણા આણુમાં પરિણામ પામે છે. આપણે પરમાત્મા પાસે દીક્ષા લઈએ છીએ. પ્રભુના કહેવા મુજબ સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ.” આવું સ્પષ્ટ ચિત્ર નિત્ય આપણે નજર સામે રાખીએ અને તેવા ભાવથી ભાવિત બની ઢ્યાન કરીએ, તો આપણા ઉપરનો સંકલ્પ સિદ્ધ થઈ શકે.

આ રીતે લગ્વાન સૌથી પ્રથમ આપણા મનમાં મનોમય સત્યરૂપે, ઉપસ્થિત થાય છે. (Ideal Reality)

મોક્ષ પણ આપણા મનમાં મનોમય સત્યરૂપે ઉત્પજ્ઞ થાય છે, ( Ideal Reality )

ને વિચાર આપણા મનમાં વારંવાર ધૂંટાય છે, તે છેવટે લૌતિકરૂપ ધારણું કરે છે અને કાર્ય સિદ્ધ થાય છે.



દાણા ધુળમાં મળી જાય ત્યારે છોડ થાય છે. કીડો મરીને ભ્રમર થાય છે. નઢી પોતાનું રૂપ છોડીને સાગર થાય છે. તેમ ઈષ્ટનો નમસ્કાર પોતાને ભૂલી ઈષ્ટ સ્વરૂપ થવા માટે છે. પોતાને ભૂલવાથી જોઈ જતી નથી, પણ નવું ઉચ્ચ સ્વરૂપ પ્રાપ્ત થાય છે.

## ધ્યાનની પૂર્વ તૈયારી

(પ્રચોગ ૧ થી ૭ માટે)

(૧) બને ત્યાં સુધી સામાયિક લઈ ને એસવું અગર જીનમંહિર, ઉપાશ્રય કે ઘરમાં શાન્ત સ્થળે એસવું: સામાયિકમાં એસવાથી વધુ લાલ થાય છે. કારણું કે સામાયિકમાં વચ્ચે ઉઠવાતું કે વિશ્વેષ થવાતું નિમિત્ત આવતું નથી.

(૨) પુખાસને એસી શક્યાય તો વધુ સાર્દું અગર સુખાસને એસવું.

(૩) પૂર્વ અગર ઉત્તર દિશા સન્મુખ એસવું. જિનમંહિરમાં પરમાત્માની સામે એસીએ તો દિશાતું મહત્વ રહેતું નથી.

(૪) ઉનના આસન (કટાસણું) ઉપર એસવાથી વધુ અનુકૂળ પડે છે, બને ત્યાં સુધી આસન પણ સફેદ રાખવું.

(૫) જિન આજા મુજબ પોતાના શુણુસ્થાનકને અતુર્દ્ધ્ર અનુષ્ઠાનોમાં રક્ત રહેનારને ધ્યાન જલ્દી લાગુ પડે છે.

(૬) શુદ્ધ જ્યવહારતું પાલન કરતારને ધ્યાન શિક્ષ સિદ્ધિ આપે છે.

(૭) ધ્યાન કરતાં પહેલાં જગતના સર્વ જીવો સાથે મૈત્રીભાવથી ભાવિત બનવું. જીવમાત્રતું કલ્યાણ ધરાવું.

શુવમાત્રને આત્મ સમાન જાહી તેમની સાથે મૈત્રી પૂછું  
વ્યવહાર કરનારને ધ્યાન જહી લાગુ પડે છે.

### મૈત્રી ભાવનાના શિલોક્ષેપ

ખામેભિ સંવ જીવે, સંવે જીવા ખમંતુ મે;  
મિત્તો મે સંવ ભૂઅેસુ, વેરં મજાં ન કેણુઈ.  
શિવમસ્તુ સર્વ જગતઃ, પરહિતનિરતા ભવન્તુ ભૂતગણ્યા:  
દોષા: પ્રયાન્તુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લોકઃ

(C) હોડ સહજ રીતે બંધ રાખવા, દાંત એક બીજાને  
અડે નહિ તે રીતે રાખવા.

(D) આંખ બંધ રાખવી, સામેથી પ્રકાશ આવતો  
હોય તેવા સ્થળે બેસવું નહિ.



મંત્રનું અલેદ ચિન્તન તે મંત્રાર્થની પ્રાપ્તિ છે  
તેને સંલેદ પ્રણિધાન અને મંત્રાર્થનું અલેદ ચિન્તન  
તે મંત્ર ચૈતન્યની પ્રાપ્તિ છે, તેને અલેદ પ્રણિધાન  
કરું છે.

## સાલંખન ધ્યાનના પ્રયોગો

**ધ્યાન શરૂ કર્યા પહેલાની આર્થિક મંદ સ્વરે ગાંઠ**

- (૧) ધ્યાસિન્ધુ, ધ્યાસિન્ધુ, ધ્યા કરજે, ધ્યા કરજે,  
હવે આ જાળરોમાંથી, મને જલદી છૂટો કરજે;  
તથી આ તાપ સહેવાતો, ભલ્લકી કર્મની જવાળા,  
વરસાવી ગ્રેમની ધારા, હૃદયની આગ બુઝવજે.
- (૨) જેની અંખો પ્રશામ જરતી, સૌખ્ય આનંદ આપે,  
જેની વાણી અમૃત અરતી, દર્દ સંતાપ કાપે;  
જેની કાયા પ્રશામ અરતી, શાન્તિનો એધ આપે,  
એવું મીહું સમરણું પ્રભુનું, પંથનો થાક કાપે.
- (૩) તારકતા તુજ માંહે રે, શ્રવણે સાંલળી,  
તે જાણી હું આંદો છું, દીન ધ્યાળ જે;  
તુજ કરુણાની લહેરે રે, સુજ કારજ સરે,  
શું ઘણું કહીએ જાણુ, આગળ કૃપાળ જે.

**દર્શનદ્વારા મનશાનિતનો પ્રયોગ**

**(પ્રયોગ નં. ૧ થી ૭ ની પૂર્વ ભૂમિકાના પ્રયોગો)**

જીવની એ શક્તિ છે. એક દર્શન શક્તિ, બીજી જીબન  
શક્તિ. તે બંને પ્રયોગોમાં હોય ત્યારે તેને દર્શન ઉપયોગ  
અને જીબન ઉપયોગ કહેવામાં આવે છે. દર્શન સામાન્યને  
અહણું કરે છે તેથી વિકલ્પ રહિત હોય છે. જીબન વિશેષને  
અહણું કરે છે તેથી વિકલ્પ સહિત હોય છે.

મનમાં ચાલતી વિચારોની હોડ શાન્ત કરવા સૌથી પ્રથમ આપણે દર્શાનને પ્રયોગ કરીશું. આપણી સામે ભગવાનની મૂર્તિ અગર ચિત્રપટ છે. ખૂલ્લાં નેત્રથી આપણે ભગવાનના દર્શાન કરીશું. માત્ર દર્શાન કરવાનું છે. મનને પણ દર્શાનમાં જોડવાનું છે. જે વિચાર કરીશું તો દર્શાન બંધ થઈ જશે, અને દર્શાન કરીશું તો વિચાર શાંત થઈ જશે. ત્રણ મિનિટ ખૂલ્લાં નેત્રથી આપણે ભગવાનનું દર્શાન કરવાનું છે. ત્રણ મિનિટના દર્શાનમાં વિચારોની હોડ આપણા મનમાં શાન્ત થશે.

### પ્રાણુશુદ્ધિનો પ્રયોગ :—

#### પ્રાણુનું પ્રતિક છે શાસોશાસ.

આંખ બંધ કરીને શાસોશાસ ચાલે છે તેનું નિરી-ક્ષણું કરવું. શાસ લેતાં ‘અરિ’ અને શાસ મૂકતાં ‘હંત’ આ રીતે પ્રત્યેક શાસોશાસમાં ‘અરિહંત’ પહુંચ સમરણ ત્રણ મિનિટ સુધી કરવું, તેનાથી પ્રાણ શુદ્ધ થાય છે. જરા પ્રયોગપૂર્વક શાસ ધીમે ધીમે લેવા અને ધીમે ધીમે મૂકવા.

### લોહીની શુદ્ધિ-હૃદય શુદ્ધિનો પ્રયોગ

સામાન્ય રીતે તંડુરસ્ત મનુષ્યના અંદાજે ૭૦ જેટલા હૃદયના ધખકારા એક મિનિટમાં થાય છે. પ્રત્યેક ધખકારે અંદાજે ૮૦ C. C. જેટલું લોહી હૃદયમાંથી પસાર થાય છે. સામાન્ય રીતે આપણા શરીરમાં પાંચ ક્રીલો જેટલું લોહી

હોય છે તે બધા જ લોહીને હૃદયમાંથી પસાર થતાં એક મિનિટ કરતાં પણ થાડો ઓછો સમય લાગે છે. પ્રત્યેક ધખકારે અરિહંત પહું સમરણ કરીને આપણા હૃદયમાંથી પસાર થતા લોહીને અરિહંત ભાવથી વાસિત કરવાનું છે. કે રીતે વૈધરાજે નાડી પડીને ધખકારા ગણે છે; તે રીતે આપણે આપણી નાડી ઉપર આંગળી મૂકીને હૃદયમાં થતા ધખકારા સાંલળી શકીએ છીએ. હૃદયના પ્રત્યેક ધખકારે ‘અરિહંત’ ‘અરિહંત’ તે રીતે આપણે સમરણ કરવાનું છે. હૃદયમાંથી પસાર થતું લોહી (પ્રત્યેક ધખકારે ‘અરિહંત’ પદના સમરણથી) અરિહંત ભાવથી વાસિત બની જશે. ત્રણ મિનિટ સુધી આપણે હૃદયના પ્રત્યેક ધખકારે ‘અરિહંત’ પહું સમરણ કરવાનું છે, જેથી આપણી નાડીઓમાં અરિહંત ભાવ વાસિત લોહી વહેતું થઈ જશે.

**ધ્યાનમાં પ્રવેશ :—(પ્રચોગ નં. ૧) :—**

હવે આપણે આંખો બંધ કરી દઈએ છીએ, આપણી સામે આપણુને પરમાત્મા દેખાય છે.\* આપણી સામે કર્ણા-મય પ્રલુબુનું આપણે દર્શિન કરી રહ્યા છીએ.

પરમાત્મા કર્ણા સ્વરૂપ છે. .... ....

તેમના નેત્રમાંથી સક્રેચ રૂધ જેવી કર્ણાની ધારા વહી રહી છે. .... .... .... ....<sup>9</sup>

\* કદાચ સામે પરમાત્મા ન દેખાય કે જાંખા દેખાય તો પણ દેખાય છે તેવો આવ રહેવો.

૧. ટપકાં મુક્યાં છે તે દશ્ય જેવામાં થાડી ક્ષણ સ્થિર રહેતું તે બતાવવા માટે છે.

પ્રભુના નેત્રમાંથી વરસ્કતી કર્ણથુણાની ધારા આપણા  
ઉપર પડી રહી છે, તેમાં આપણે સ્નાન કરીએ છીએ ....  
.... .... .... .... (આવું દશ્ય જોવું.)

સક્રૈદ હૃદ જેવી ધારા વહી રહી છે.... ....

આપણા મસ્તકના મધ્ય લાગમાંથી કર્ણથુણાની ધારા  
આપણા શરીરમાં પડી રહી છે.... .... ....

આપણું હૃદય (આજ સુધી ઉંઘું Non Receptive)  
હતું તે સીધું કમળ જોવું બન્ધું છે. (Receptive  
Altitude). ... ... ... ...

પરમાત્માની દિંદ્ય કર્ણથુણાની ધારા આપણા કમળ  
જેવા હૃદયમાં પડે છે અને હૃદય ભરાઈ રહ્યું છે.... ....  
....(આવું અનુભવવું)

હૃદય ભરાઈ અને ઉભરાઈ રહ્યું છે.... .... (A)

પ્રભુની કર્ણથુણા હૃદયમાં ભરાઈ અને ઉભરાય છે.  
અને આપણા શરીરમાં ઝેલાય છે.... .... ....

આપણું શરીર પ્રભુની મહા કર્ણથી ભરાઈ ગયું....

આપણા લોહીના આણુએ આણુમાં પરમાત્માની કર્ણથુણા  
વ્યાપ્ત બની ગઈ.... .... .... ....

A. આવું દશ્ય થાડી ક્ષણુ જોવું. ધીમે ધીમે આવો અનુ-  
ભવ થવાનો શરૂ થશે. જ્યાં ... ...આવાં ટપકાં મુક્કાં છે ત્યાં  
દશ્ય જોવું. ધ્યાનમાં દર્શન, સંકલ્પ અને સંવેદન (અનુભવ)  
મુખ્યત્વયા આપશે.

આપણા આત્માના પ્રદેશો પ્રદેશો પ્રભુની કરુણા  
વ્યાપક બની ગઈ.... .... (આવો ભાવ કરવો).

પરમાત્માની કરુણામાં અચિત્ય શક્તિ છે, સર્વ હુઃખ  
નિવારણ કરવાની, સર્વ શોક, લય, ચિંતાથી મુક્તા કરવાની  
શક્તિ પરમાત્માની આ મહા કરુણામાં છે. સર્વ સુખ,  
શાન્તિ, આનંદ અને નિષ્ઠાયતાનો અનુસવ કરાવવાની શક્તિ  
પરમાત્માની કરુણામાં છે. (આવો સંકલ્પ કરવો.)  
પરમાત્માની કરુણા શક્તિને આપણે સંપૂર્ણ આધીન બતો  
જઈએ છીએ. પરમાત્માની સંપૂર્ણ અને બિનશરતી શરુ-  
ણાગતિ (Complete uncomditional surrender)  
સ્વીકારીએ છીએ.

નેરથી વરસે છે લગવાનની કરુણા.... ....

આપણે તેમાં સ્નાન કરીએ છીએ.... ....

પરમાત્માની કરુણા આપણા આંતરમન સુધી સ્પશે છે.

પરમાત્માની કરુણા આપણા હૃદયના ઉંડાણુ સુધી  
સ્પશે છે.

તેના પ્રલાવથી આપણી જૂની ટેવોમાં પરીવર્તન  
થવું શરૂ થાય છે.

પરમાત્માની કરુણાના હીંદ્ય પ્રલાવે :—

મને કોઈ હુઃખ નથી. મારાં સર્વ હુઃખ નાશ પામી  
ગયાં × × × × (B)

B. × × × આવી નિશાની સ્વખસુયના (Auto Sugges-

મને કોઈ લય નથી. × × ×

મને કોઈ રોગ નથી. × × × (આવું સંવેહન કરવું)-

પરમાત્માની કરુણામાં સ્નાન કરવાથી મારા સધળા  
રોગ, શોક, હૃદય, લય, ચિંતા નાશ પામી ગયા છે × ×  
(આવું સંવેહન કરવું.)

જેરથી વરસે છે લગવાનની કરુણા.... ....

તેમાં હું સ્નાન કરી રહ્યો છું.... .... તેના પ્રલાવે:-

હું સુખથી ભરાઈ રહ્યો છું. મને સુખનો અનુભવ  
થઈ રહ્યો છે × × × (આવું અનુભવવું).

આનંદ-આનંદ-આનંદથી પૂર્ણ ભરાઈ રહ્યો છું મને  
આનંદનો અનુભવ થાય છે × × ×

હું નિર્બદ્ધ અની ગયો છું × × ×

શાંતિ-શાંતિ-શાંતિનો અનુભવ થાય છે × ×

હું સુખ, શાંતિ, આનંદ અને નિર્બદ્ધતાથી પૂર્ણ  
ભરાઈ ગયો છું × × × (આવું અનુભવવું).

પરમાત્માની કરુણાના પ્રલાવે મારાં સર્વ રોગ, શોક,  
હૃદય, લય, ચિંતા નાશ પામી ગયા છે. હું સુખ, શાંતિ  
આનંદ અને નિર્બદ્ધતામાં એઠો છું × ×

stion) દરેક વિચાર આંતરમન સુધી સ્પર્શ થાય તે રીતે ભાવિત  
ઘનવું. ચોતાની જતને સૂચના આપવી તે સવયસૂચના છે. ૧૦ થી  
૩૦ સેકંડ સુધી દરેક ભાવ ધારી રાખવો. તે રીતે કરવાથી અંત-  
રોગ ભાવનું પરીવર્તન થાય છે.

હું જ્યાં પણ હોઈશ, જ્યારે પણ હોઈશ સર્વત્ર  
જગવાનની કરુણા વરસી રહી છે. તેમાં હું નિરંતર સ્નાન  
કરતો રહીશ. તેના પ્રલાવે હુઃખ, લથ, ચિંતા, અશાંતિ  
મને સ્પર્શી પણ નહીં શકે.

હું સહા સર્વદા સુખ, શાંતિ, આનંદ અને નિઃબંધ-  
તામાં જ રહીશ ..... .... .... ....

નેરથી વરસે છે જગવાનની કરુણા, તેમાં સ્નાન  
કરીએ છીએ ..... .... .... .... ....  
.... .... .... .... .... .... ....

( નીચેની પ્રાર્થના, ધ્યાનમાંથી બહાર આવવું હોય  
તો મોટેથી ગાવાની છે આગળ ધ્યાન ચાલુ રાખવું હોય  
તો મનમાં પ્રાર્થનાના ભાવને ભાવિત કરવો. )

કરુણા દષ્ટિ ઝીધી રે સેવક ઉપરે,  
ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો.  
મનવાંછિત ફળીયા રે તુજ આલાંખને,  
કર નેડીને સેવક કહે મન રંગ જો.

કરુણાસાગર પ્રભુ ! આજે હું ધન્ય બન્યો. કૃતપુષ્ટય  
મન્યો. આજ આપની કરુણાનો પાત્ર બન્યો. પ્રભુનું દર્શન  
કરી આનંદથી આપણું હુંયું નાચી રહ્યું છે .... ....

પ્રથોગ નં. ૨ :—

આંખો બંધ રાખેલી છે તે બંધ જ રાખવી.  
સામે પરમાત્મા દેખાય છે....(આપણે દર્શન કરીએ

છીએ ત્યારે વિકદ્પો શાન્ત થાય છે. માત્ર દર્શન કરું:  
દર્શન કરતાં કાંઈ વચ્ચારવું નહીં ).

કરુણામય પરમાત્માનું આપણે દર્શન કરીએ છીએ.

હે હિંદુ કરુણાશક્તિ ઇપ પરમાત્મા ! આપ તો  
સર્વ દોષ, પાપ અને વાસનાથી મુક્ત છો. હું તો પાપ-  
વૃત્તિથી ભરેલો છું, મલીન વાસનાઓ હજુ પણ મને  
સત્તાવી રહી છે. હુષ્ટ ભાવો હજુ પણ મને પીડા આપી  
રહ્યા છે.

હું તો કોધ કખાયનો ભરીયો, તું તો ઉપશમ રસનો દરિયો,  
હું મનથી ન મુકું માન, તું તો માન રહીત લગવાન;  
હું તો મોહ તણે વશ પડીયો, તેં તો સધળા મોહને હણીયો,  
મને માયાએ મુક્ત્યો પાર્શી, તું તો નિર્ઝાધન અવિનાર્થી.

( આ પ્રાર્થનાના ભાવો મનમાં ભાવિત કરવા )

હે હિંદુમય પ્રભુ ! આપ કાંઈ ઉપાય કરો જેનાથી  
મારી પાપવૃત્તિએ નાશ પામે, મારી મલીન વાસનાએ  
અને હુષ્ટ ભાવો નાશ પામે.

પરમાત્માની કરુણા-અગિનજવાળાનું સ્વરૂપ ધારણ કરે  
છે.... .... .... તે અગિનજવાળા આપણી તરફ આવી  
રહી છે.... .... .... .... .... (આવું દશ્ય જેવું ).

અગિનજવાળા આપણી ચારે તરફ વીંટળાઈ વળી છે....

તે પ્રભુની કરુણા અગિનમાં આપણી પાપ-

વृत्तिच्यो, મલીન વાસનાચ્યો અને હુણ લાવો બળી  
રહ્યા છે.... .... .... .... (આવું દશ્ય જોવું).

અગિનજવાળા પ્રજ્ઞવિત બળી છે....(આવું દશ્ય જોવું).

પ્રચંડ અગિન જવાળામાં બધાં પાપો ખતમ થઈ  
રહ્યા છે. બળીને ભસ્તમ થઈ રહ્યા છે. તે આપણે જોધું  
છીએ.... .... .... .... (આવું સંવેદન કરવું).

કોધ, માન, માયા, લોલ, રાગ, દ્રેષ, ધર્મ, અસ્ત્રયા,  
સ્વાર્થવૃત્તિ, દોષદાષ્ટિ, હિંસા, ચોરી, અસત્ય, મૈથુન, પરિ-  
અહવૃત્તિ, આર્થધ્યાન, રૌદ્રધ્યાન, વિષયવાસના બધું જ  
બળીને ભસ્તમ થઈ રહ્યું છે.... .... .... ....  
.... .... .... .... .... (સંકલણ કરવો)\*

પ્રચંડ અગિન જવાળામાં બધું જ બળી રહ્યું છે  
(અગિનજની ધારણા બધું જ બળીને ભસ્તમ થાય ત્યાં સુધી  
થોડી મિનિટો પઠડી રાખવી.)

બળીને ભસ્તમ થઈ ગઈ પાપવૃત્તિચ્યો, મલીન વાસ-  
નાચ્યો અને હુણ લાવો.... .... .... ....

બળવાની વસ્તુ ખતમ થવાથી અગિન શાંત થઈ રહ્યો છે.

૧. .... .... આવાં ટપકાં જ્યાં છે ત્યાં થોડી ક્ષણું તે દશ્ય  
જેવામાં સ્થિર બનવું. ધીમે ધીમે એવો અનુભવ થશે.

\* જે હોથ આપણું વધુ ડેરાન કરતો હોય તેને ખતમ થતો  
જેવો. હંમેશાં આ પ્રક્રિયા કરવાથી પાપવૃત્તિચ્યો ઓછી થઈ જતી  
અનુભવાશે.

ધીમે ધીમે અજિન શાંત થઈ ગયો.... ....  
 અજિન શાંત થઈ ગયો છે.... ....  
 પાપથી આપણે એકહમ હળવા થઈ ગયા છીએ.  
 મલીન વાસનાઓ અને હૃદ લાવો ચાલ્યા ગયા છે.... ....  
 પ્રયોગ નં. ૩ :—

સામે પરમાત્મા ભીરાજમાન છે.... ....  
 આપણે અનંત શુણુના લંડાર પરમાત્માનું દર્શાન  
 કરીએ છીએ.... .... .... .... ....  
 હે કરુણામય પ્રભુ ! આપ તો અનંત શુણુના પરમ  
 નિધાન છો. હું તો શુણુણીન છું. મારામાં એક પણ ઉત્તમ  
 સફળતા નથી. તો મને ઉત્તમ શુણોથી પૂર્ણ લરવા કૃપા  
 કરો.... .... .... .... .... ....

પરમાત્માના સર્વ અંગોમાંથી શુણોનો વરસાદ પડવો  
 શરૂ થયો.... .... .... .... .... IV

પ્રભુના શુણુ ગંગાજળનો ઘોધ આપણુ ઉપર પડી  
 રહ્યો છે તેમાં આપણે સ્નાન કરીએ છીએ.... ....  
 તુમ શુણુ ગણુ ગંગાજળો, હું જીવીને નિર્મણ થાઉં રે;  
 અખર ન ધંધો આદર્દં, નિશાદિન તોરા શુણુ ગાઉં રે....  
 ગીર્દાંથા રે શુણુ તુમ તણ્ણા.

પ્રભુના શુણુ ગંગાજળમાં આપણે સ્નાન કરીને નિર્મણ

IV. આવું દશ્ય જોવું અને અનુભવવું.... ....આવી નિશાની  
 લાય ત્યાં આ રીતે દશ્ય જોવં અને અનુભવવં.

અનીએ છીએ.... .... .... (આવું સંવેદન કરવું).

પ્રભુનું શુણુ ગંગાજળ આપણા મસ્તકમાંથી આપણા  
અંદર પ્રવેશ કરે છે.... .... .... ....

પ્રભુના શુણુ ગંગાજળથી આપણે લરાઈએ છીએ....  
.... .... .... .... (આવું દશ્ય જોવું).

આપણે ઉત્તમ શુણોથી લરાઈ રહ્યા છીએ....  
.... .... .... .... .... (આવું દશ્ય જોવું).

ક્ષમા, નઅતા, સરળતા, સંતોષ, દ્વયા, દાન, પરો-  
પકાર, કૃતજ્ઞતા, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યરથ, દાન, દ્વયા  
પરોપકાર આહી ઉત્તમ શુણોથી આપણે લરાઈ રહ્યા છીએ.

આપણે અનંત શુણોથી પૂર્ણ લરાઈ ગયા છીએ...  
.... .... .... .... .... .... .... ....  
.... .... .... (સંકલપપૂર્વક આવું અનુભવવું).

#### ગ્રંથાગ નં. ૪ :—

અનંત તેણેમય પરમાત્મા આપણું સામે બીરાજમાન છે.

આપણે પરમાત્માનું દર્શાન કરીએ છીએ.... ....

હે કરુણામય આત્મસ્વરૂપના દાતા પ્રભુ ! આપણા-  
માંથી વરસતી સહેદ દ્વારા જેવી કરુણાની ધારામાં સ્નાન  
કરવાથી મારાં રોગ, શોક, ફુલ, લય, ચિંતા નાશ પામી  
ગયા. સુખ, શાંતિ, આનંદ, નિર્બિદ્યતાને અનુભવ થયો.  
આપણી કરુણારૂપ અજિન જવાળામાં મારાં બધા પાપો અને  
વાસ્તવાઓ બળીને લક્ષ્મ થર્ફ ગયા.

આપના સર્વીંગોમાંથી વરસતા શુણોના વરસાદમાં  
સનાન કરવાથી હું અનંત શુણોથી પૂર્ણ લરાઈ ગયો.

હુબે તીવ્ર ઈરછા છે-આતમહર્ષિનની. આપ આતમ-  
હર્ષિન કરાવો, જેથો તૃપ્તિનો પરમ આનંદ અનુભવી શકું.

અસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઈ જ,  
ઉંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જ;  
મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જ,  
તું હીણો હું છું તો, તુજ હરશના દાન હઈ જ.

હે કરુણામય પરમાત્મા !

અનંતકાળથી મિથ્યાત્વના-'અસત્યના' પંથ ઉપર  
વિચરી રહ્યો છું. પ્રભુ ! તો સમ્યગ્દર્શિનતું દાન આપીને  
સત્યનો પંથ બતાવો. અજ્ઞાન ઇપી લયંકર અંધકારમાં  
અટવાઈ રહ્યો છું પ્રભુ ! તો સમ્યગ્જ્ઞાનતું દાન આપીને  
આત્માને પરમ પ્રકાશનો માર્ગ બતાવો. અવિરતિના પાપથી  
ક્ષણે ક્ષણે મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યો છું; તો હે પર-  
માત્મા ! સમ્યગ્ર ચારિત્ર પહુંદાન આપી આત્માના અનુ-  
ભવનો પરમ અમૃતમય પંથ બતાવો. આપના શુદ્ધ ચૈતન્ય  
સ્વરૂપનું હર્ષિન આપીતૃપ્તિના પરમાનંદમાં લઈ જાઓ....

પ્રભુએ આપણો પ્રાર્થના સાંલળી.

A ... ...આવી નિશાની હોથ ત્યાં આવું દસ્ય થોડી ક્ષણો  
નેઈ રહેવું.

ધ્યા. પ્ર. 3

પરમાત્મામાંથી ( સૂર્યના બિંખમાંથી નિકળતા પ્રકાશની જેમ ) હિંય તેજપુંજ નીકળી આપણી તરફ આવી રહ્યો છે.....

પરમાત્મામાંથી નીકળેલો પ્રકાશ આપણી ચારે તરફ વીટળાઈ વળ્યો છે.....

પરમાત્માના હિંય પ્રકાશમાં આપણે એહેલા છીએ....  
.....( આવું અનુસવવું )

પરમાત્મામાંથી નીકળેલો હિંય પ્રકાશ આપણુને લેદીને પસાર થાય છે.....

આપણી આરપાર તે પ્રકાશ પસાર થઈ રહ્યો છે....  
.....( આવું દશ્ય જેવું )

તે પ્રકાશમાં આપણા આત્માનો ‘એકસ રે’ લેવાય છે....(B)

તેમાં શરીરનો ઝોટો નથી આવતો.

આત્માને લાગેલાં કર્મનો ઝોટો નથી આવતો.

રાગદ્રોષ આહિ ભાવ કર્મનો ઝોટો નથી આવતો.

પરમાત્માના હિંય પ્રકાશમાં શુદ્ધ આત્માનો ‘એકસ રે’ લેવાય છે.

(B) જે રીતે ડોક્ટરો ‘એકસ રે’ લે છે તેમાં કપડાનો ઝોટો નથી આવતો, ચામડીને નથી આવતો, માંસ, લોહીનો ઝોટો નથી આવતો, ફૂલ હાઉકાનો જ ઝોટો આવે છે. તે રીતે અહીં આત્માનો ‘એકસ રે’ લેવાય છે.

તેમાં આપણું આત્માના સ્વરૂપનું આપણે દર્શાન  
કીએ છીએ.....

પરમાત્માના જેવું જ વિશુદ્ધ આત્મચૈતન્ય આપણું  
દર્શાવે રહેલું છે તેના દર્શાનમાં આપણે સ્થિર બનીએ  
જીએ (C).....

પરમાત્માની હિંય વાણી સંભળાય છે.....

હુ વત્સ ! હેઠ (શરીર) તારું સ્વરૂપ નથો, તું તો  
હુથી લિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્મા છે.....

જગતમાં દર્શયમાન પુદ્ગલ-પદાર્થો તારું રૂપ નથી,  
તોનાથી લિન્ન તું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે.....

પુદ્ગલ (જડ)નું લક્ષણ શાખા, રસ, ગંધ અને  
પણ છે.....

તારું-ચૈતન્યનું લક્ષણ જાન, દર્શાન, ચારિત્ર, વીર્ય  
અને ઉપરોક્ત છે.....

જાનાવરણી આદિ કર્મ-પુદ્ગલ છે, તેનાથી લિન્ન  
તું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે.....

તું જે ભાષા ઓલે છે તે પણ ભાષાવર્ગણાના પુદ્ગલ  
ગદ્દા છે, તેનાથી લિન્ન તું આત્મરૂપ છે.....

---

(C) થોડી ક્ષાળું આત્મદર્શાનમાં સ્થિર બની અતુલવ કરવો.

મનથી કે તું વિચાર કરે છે તે મનોવર્ગાખાના  
પુછગલ છે, તેનાથી કિનત તું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે....

તું બહાર જેઈ રહ્યો છે, જરા અંદર જો, અનાત  
આનંદ અને સુખનો મહાસાગર તારી અંદર (તારા  
આત્મામાં) પૂર્ણ લરેલો છે.....

જીવું મારું સ્વરૂપ છે તેવું જ તારું સ્વરૂપ છે.....

તારા અંદરના આનંદના મહાસાગરમાં હુબકી માર !  
પરમાનંદનો અનુભવ થશે.....

આપણે આત્માના આનંદના મહાસાગરમાં લીન  
અનીએ છીએ.....

.....

.....

.....

.....

\*

દિવ્ય આનંદનો આપણે અનુભવ કરીએ છીએ....  
.....(સ્થિરતાપૂર્વક ધ્યાન કરવું.)

સાકર હૃદયમાં ઓગળી જય તેમ મન આત્માના  
પરમાનંદમાં ઓગળી ગયું છે.....

આનંદના મહાસાગરમાં આપણે વિકીન થઈ ગયા  
છીએ.....(સ્થિરતા પૂર્વક ધ્યાન કરવું.)

\* વિચારો શાંત કરી આત્મિક આનંદના મહાસાગરમાં વિકીન  
અનવું, અનુભવ કરવો. અને તેથ્લો વધુ સમય સ્થિર રહેવું.

આત્માના પરમ આનંદરસનો આજે અનુભવ કરી  
જા છીએ.....

પરમાત્માના આલંબને અનંત સુખ, પરમ આનંદ,  
નંત શક્તિ, કેવળજ્ઞાન આહિ અનંત ગુણ સમૃદ્ધિથી  
જી આપણા આત્માનો અનુભવ થઈ રહ્યો છે.... ....

પ્રભુ મિરે તું સબ આતે પુરા, પરકી આશ કહાં કરે પ્રીતમ,  
એ કીન આતે અધુરા.... . . .

આપણે આત્મા સાથે વિચાર કરીએ છીએ. પ્રભુ !  
તું સર્વ વાતે પૂર્ણ છે.

પર વસ્તુની આશા તું શા માટે કરે છે? તારા  
આંદર શું ઓછું છે?

આનંદ અને સુખ માટે આજ સુધી આપણે બહાર શોધતા હતા. જગતના પહાર્યોમાં સુખ છે તેમ સમજ હોડતા હતા. આજે પ્રભુની કૃપા થઈ. સુખ અને આનંદનો મહાસાગર, પરમાત્માએ આપણા આત્માના અંદર બતાવ્યો, અનુભવ કરાવ્યો.

परसंग त्याग, लाग निजरंगशुः;

આનંદ વેલી અંકુરા.

હે જીવાતમા ! પરનો સંગ છોડીને, આત્માના રંગમાં  
લાગી જા, આનંદથી પૂર્ણ લરાઈ જઈશ.... ....

આને પાર્થીએ પરમ પદનો, પંથ તારી કૃપાથી,

મીટચા આજે અમણું લવના, (દંય તારી કૃપાથી);

કુઃપો સવેં ક્ષય થઈ ગયાં, હેવ તારી કૃપાથો,

ખુલ્યાં ખુલ્યાં સકલ સુખના, દ્વાર તારી કૃપાથી.

( प्रथम नं. ४ पृष्ठ.)

## પ્રયોગ નં. ૧ વિશેષ નોંધ :—

આપણુને વિતા કારણું લભયાસ્ત બની જવાની ચિંતા (ટેન્શન) કરવાની, શોક કરવાની ટેવ પડી ગઈ છે, જેને જાની પુરુષો આર્તિધ્યાન, રૌદ્રધ્યાનની પીડા કહે છે.

આ પ્રયોગથી પરમાત્માની કરુણાની સહાયથી સ્વયં સૂચના કરાર આપણી ટેવમાં પરિવર્તિત આવે છે. દરેક સંઝેગમાં સમતા કેળવવાની ટેવ કેળવાય છે. ગમે તે સંઝેગમાં સુખ, શાંતિ, આનંદ, નિલંઘિતાનો અનુભવ કરી શકાય છે. આજો દિવસ આપણે પરમાત્માની કરુણામાં જ વસ્તીએ છીએ તેવી સલ્લાનતા રહે છે. આ પ્રયોગ દરરોજ કરવાથી જીવન શાંત અને આનંદમય બને છે અને આર્તિ-રૌદ્રધ્યાનની પીડા (ટેન્શન) શાંત થઈ જાય છે. ઉપરાંત આર્તિ-રૌદ્ર ધ્યાનના પ્રસંગોમાં પણ પરમાત્માના સ્મરણ રૂપ ધર્મધ્યાન થઈ શકે છે.

અહીં કરુણાથી પૂર્ણ લરાયા પછી મૈત્રી લાવનાનું ધ્યાન આસ કરવું, જેથી દિવંગ આનંદ અનુભવાશે. મૈત્રી લાવનાનું ધ્યાન પ્રયોગ નં. ૭ મુજબ કરવું.

## પ્રયોગ નં. ૨ વિશેષ નોંધ :—

આ પ્રયોગ દરરોજ બ્યવસ્થિત કરવાથી પાપવૃત્તિઓ, મહીન વાસનાઓ અને દુષ્ટ લાવનાઓ ધીમે ધીમે ઓછી થવા માંડે છે. કોઈ દોષ દા. ત. ‘કોધ’ આપણુને વધુ હેરાન કરતો હોય તો કોધને બળતો બરાખર જોવો. અણીને

ભરમ થાય ત્યાં સુધી જેવો. તેનાથી કોધના નિભત્તોમાં  
પણ શાંત રહેવાની ટેવ પડી જશે.

### પ્રયોગ નં. ૩ વિશેષ નોંધ :—

આ પ્રયોગ દરરોજ કરવાથી પ્રલુના પ્રલાવે સફળ થશે.  
આપણામાં ખીલવા માંડે છે. જે ગુણની આપણને જરૂર  
હોય હા. ત. ‘ઉદ્ધારતા’. તો ઉદ્ધારતાથી આપણે પૂર્ણ  
ભરાઈએ છીએ તેવો ખાસ સંકલ્પ કરવો.

### પ્રયોગ નં. ૪ વિશેષ નોંધ :—

આ પ્રયોગથી સંવેગ અને નિર્વેદ ગુણનો  
વિકાસ થાય છે. ‘હું પુછુગત દ્રોધથી લિન્ન છુ’ તે લક્ષણ  
બેદથી પુછુગતની લિન્નતા ભાવિત થવાથી પાંચે ઈદ્રિયોના  
વિષયોનો અને સંસારના સુખનો રસ ‘હેય’-છોડવા જેવો  
લાગે છે. તે રસ ઘટવા માંડે છે અને આત્માના શુદ્ધ  
આનંદ સ્વરૂપનો અનુભવ કરવાની લગની લાગે છે જેથી  
સંવેગ ગુણ વૃદ્ધિ પામે છે. મોક્ષની તીવ્ર ઈચ્છા એટલે  
મોક્ષમાં જ ઉપાદેય બુદ્ધિ થાય છે. સંસારના સુખ ઉપરનો  
રાગ ઘટતો જય છે. મોક્ષનો એટલે આત્માના પરમાનંદની  
પ્રાપ્તિનો રસ વધતો જય છે. આત્માની અંદર આનંદ  
અને સુખનો મહાસાગર ભરેલો પડ્યો છે તેનું ભાન  
થતાં, તે આનંદની પ્રાપ્તિ માટે તાલાવેલી જાગે છે.

જગતના પદાર્થોમાં સુખ માનીને આપણું મન હોડે  
છે; પરંતુ આ પ્રયોગથી આત્મામાં રહેલ પૂર્ણ સુખ અને  
આનંદના મહાસાગરનો અનુભવ થાય છે. તેમાં મનની ગતિ

(ઉપયોગ) આનંદના મહાસાગર ચેવા આત્મા તરફ થાય છે, અને હિંય આનંદ અનુભવીને બહાર આવેલું આપણું મન કરી કરીને તે હિંય આનંદને જાંખે છે. મનનું આકર્ષણું જગતના પદાર્થોને બહલે પરમાત્મા અને આત્મા તરફ થાય છે.

જુસ પણું ધ્યાયો, મહારસ પાયો, અવર રસે નહિ રાચું; અંતરંગ ઇરસ્યો દરિશન તેરો, તુજ શુણુ રસ સંગ માચું.

પરમાત્માના ધ્યાનથી પરમ સુખનો રસ અનુભવાય છે, ત્યારે જગતના પદાર્થોનાં સુખનો રસ ઘટી જાય છે અને છેવટે એ નાશ પામી છે. પરમાત્માના આલાંખને હિંય રસ અનુભવવા માટેની જાંખના ચાલુ જ રહે છે. તેથી પરમાત્માનું સમરણુ-ક્યાન સાહજ બની જાય છે.

#### અયોગ નં. ૫ :—

વાલેશ્વર સુણો વિનતી, તું સુજ પ્રાણ આધાર;  
તુજ વિષુ હું ન રહી શકું, જેમ બાળક વિષુ માત રે.

(પુ. ૬. યશોવિજયજી કૃત વીર પ્રભુનું સ્તવ)

હે કરુણાનિધાન પ્રભુ ! હૃદય મંહિરીયે પધારો. તમે મારા પ્રાણ, ત્રાણ, શરણ આધાર છો. જેમ બાળક મા વગર રહી ન શકે તેમ પ્રભુ ! એક ક્ષણુ પણ તમારા વગર રહી ન શકું તેવી મારી સ્થિતિ છે.

હવે સુજ મંહિરમાં પ્રભુ આવી વસો રે, પાસું પાસું પરમાનંદરે,  
પ્રભુ ! પધારો પધારો અને સેવકને પરમાનંથી ભરી હો.

અરજુ સુણી મન આવીયા રે, વીર લુણુંદ હ્યાળ રે,  
રમજે મુજ મન મંહિરે રે, પ્રભુ ગ્રેમ ધરી નિશાહિન રે.

પરમાત્મા હૃદય-મંહિરમાં પથારે છે.....(આવું  
દશ્ય આપણે જોઈ રહ્યાં છીએ.)

હૃદય-મંહિરમાં પરમાત્મા બિજાજમાન થાય છે....  
જે દિશામાં આપણું મુખ છે તે દિશામાં પરમા-  
ત્માનું મુખ છે.....

હૃદયમાં બિજાજમાન પરમાત્માનું આપણે ધ્યાન  
કરીએ છીએ.....

૧. પરમાત્મા ગ્રેમ અને કરુણાના લંડાર છે. તેમના-  
માંથી ગ્રેમ અને કરુણાના કુવારા જોડી આપણી અંદર  
ફેલાય છે.....

આપણે ગ્રેમથી ભરાઈ એ છીએ.....  
આપણે ગ્રેમ સ્વરૂપ બનીએ છીએ.....(આવું સંબે-  
દન અને અનુભવ આપણને થઈ રહ્યો છે.)

૨. પરમાત્મા આનંદના લંડાર છે.....  
પરમાત્મામાંથી આનંદના કુવારા જોડે છે....  
આપણી અંદર ફેલાય છે.....  
આપણે આનંદથી ભરાઈ જઈ એ છીએ.....  
આપણે આનંદ સ્વરૂપ બનીએ છીએ.....(આવું  
આપણે અનુભવી રહ્યાં છીએ.)

૩. પરમાત્મા અનંત સુખના નિધાન છે.....  
 પરમાત્મામાંથી સુખનાં લાવો નીકળી આપણી  
 અંદર ફેલાય છે.....  
 આપણે સુખથી પૂર્ણ લરાઈએ છીએ.....  
 આપણે સુખ સ્વરૂપ બનીએ છીએ.....  
 (આવો અનુભવ આપણને થઈ રહ્યો છે.)
૪. પરમાત્મા શક્તિના લંડાર છે. ( અનંત વીય તે  
 શક્તિ છે.).....  
 પરમાત્મામાંથી શક્તિનો પ્રકાશ નીકળી આપણી અંદર  
 ફેલાય છે.....  
 આપણે શક્તિ સ્વરૂપ બનીએ છીએ.....  
 (આવું સંવેહન આપણને થાય છે.)
૫. પરમાત્મા કેવળજ્ઞાન આહિ ગુણ સમૃદ્ધિના લંડાર છે.  
 પરમાત્મામાંથી ગુણ સમૃદ્ધિના કુવારા ભૂટ છે અને  
 આપણી અંદર ફેલાય છે.....  
 આપણે સમૃદ્ધિથી લરાઈએ છીએ.....  
 આપણે સમૃદ્ધિવાન બનીએ છીએ.....  
 હૃદયમાં બિરાજમાન પ્રલુના અનુચ્છથી આપણે ગ્રેમ  
 આનંદ, સુખ, શક્તિ અને ગુણ સમૃદ્ધિથી પૂર્ણ લરાઈ  
 ગયા તેવા સંકલ્પપૂર્વક અનુભવ થઈ રહ્યો છે.....  
 .....

## ગ્રંથાંગ નં. ૬ :—

હૃદયમાં બિરાજમાન પરમાત્માનું આપણે ધ્યાન ધરીએ  
છીએ.... ....પછી આપણે પ્રલુને વિનંતિ કરીએ છીએ-  
પ્રલુન ! મારી સાથે એક રૂપ થઈ પ્રસન્ન થાઓ. હૃદયમાં  
બિરાજમાન પરમાત્મા ધીમે ધીમે મોટું રૂપ ધારણ કરે  
છે.....

આપણા દેહ પ્રમાણ બની જાય છે.....

પરમાત્માના અસંખ્ય આત્મપ્રદેશો આપણા આત્માના  
અસંખ્ય પ્રદેશો સાથે એક રૂપ થાય છે.....

પરમાત્માનો ગ્રત્યેક આત્મપ્રદેશ અનંત સુખ અને  
અનંત ગુણથી પૂર્ણ છે.....

આવો એક એક અનંત ગુણ અને સુખથી પૂર્ણ  
પરમાત્માનો આત્મપ્રદેશ આપણા એક એક આત્મપ્રદેશ  
સાથે ભળતાં આપણે દિવ્ય સ્વરૂપ બની જઈએ છીએ....

આપણે પૂર્ણતાનો અનુભવ કરીએ છીએ.....

આપણે પૂર્ણ સ્વરૂપમાં સ્થિર બનીએ છીએ.... ....

( જેટલો સમય સ્થિર રહી શકાય ત્યાં સુધી સ્થિર  
રહી આનંદ અનુભવીએ છીએ.)

પરમાત્માની હિંયશક્તિ મારા લોહીના આણુએ—આણુમાં  
કાર્યશીલ બની ગઈ છે.....

મારી ચારે તરફ હીંય શક્તિઓનું આલા મંડવ  
અન્યું છે.....

અંતમાં પરમાત્મા હૃદયમાં બિરાજેલા છે તેનું દર્શાન  
કરીએ છીએ.....

હૃદયમાં બિરાજેલા પરમાત્માને નિરંતર હૃદયમાં  
ધારણું કરીશ.....

ધ્યાન પૂરું થાય તે સમયની પ્રાર્થના—

દાઢા તારી સુખસુદ્રાને, અમીય નજરે નિહાળી રહ્યો,  
તારા નયનોમાંથી અરતું, હિંય તેજ હું જીવી રહ્યો;  
ક્ષણુભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો,  
તુજ મૂર્તિમાં મર્સ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો.

સુજ નેત્ર રૂપ ચકોરને તું, ચંદ્ર રૂપે સાંપડચો,  
તેથી જિનેશ્વર આજ હું, આનંદ ઉદ્ઘિમાં પડચો.

જે લાગ્યશાળી હાથમાં, ચિંતામણિ આવી પડે,  
કઈ વસ્તુ એવી વિશ્વમાં, જે તેહને નવ સાંપડે?  
કદ્વપૃષ્ઠ અને ચિંતામણિ સમા પ્રલુ આજે મળ્યા,  
હૃદય મંહિરીએ પ્રલુ પદ્ધાર્યો.  
રમણે સુજ મનમંહિરે રે, પ્રલુ પ્રેમ ધરી નિશદ્ધિન રે.

હૃદયમંહિરમાં પદ્ધારી પ્રલુએ પ્રેમપૂર્વક આપણું  
અંદર તેમની શક્તિઓનું આપણુને દાન આપ્યું.

## ગ્રયોગ નં. ૫ વિશેષ નોંધ :—

પરમાત્મા હૃદયમાં પદ્મારતાં પરમાત્માની હિંય શક્તિએનો આપણામાં વિસ્ક્રેટ થાય છે. આપણા લોહીના આણુએ આણુમાં પરમાત્માની હિંય શક્તિએ કાર્યરીત હોય તેવું અનુભવાય છે. હૃદયમાં બિરાજમાન પરમાત્માની હિંય શક્તિએ-પ્રેમ, આનંદ, સુખ, શક્તિ, (વીર ગુણ) સમૃદ્ધિના પ્રકાશનું આસામંડળ આપણી ચારે બાજુ રચાય છે. જેનાથી જગતના જીવાને આપણું જીવન ઉપકારક બને છે. આપણી નાનુકમાં આવનાર હુઃખીના હુઃખ ઘટે છે. અશાન્ત મનુષ્ય શાન્ત થાય છે. શ્રદ્ધાવિહીન મનુષ્યને શ્રદ્ધા ઉત્પન્ત થાય છે અને ધર્મના પરિણામ થાય છે. આ ગ્રયોગ નિયમિત કરવાથી સામાન્ય મનુષ્યમાંથી આપણે મહામાનવ બની શકીએ છીએ. Self centered આપણી ચેતના God-Centered બને છે.

## ગ્રયોગ નં. ૬ વિશેષ નોંધ :—

અહીં પરમાત્માનું અલેદ ભીલન છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ અલેદ પ્રણિધાનને તાત્ત્વિક નમસ્કાર કરે છે. આ તાત્ત્વિક નમસ્કાર એટલે નમબું, નમબું એટલે પરિણમબું, પરિણમબું એટલે તત્ત્વ સ્વર્દ્ધ બનબું, તદ્વાકાર ઉપગ્રેગે પરિણમબું, તન્મય થબું, તદ્વૃપ થબું. તત્ત્વ સ્વર્દ્ધ બનબું એટલે તે ઇપ હોવાનો અનુભવ કરવો. તદ્વૃપ બનબું એટલે તે ઇપ થઈને સ્થિર બનબું.

આવો અનુભવ કરવાની આ હિંય પ્રક્રિયા છે.

ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણું એકે, લેદ છેદ કરશું હવે ટૈકે,  
ખીર નીર પરે તુમશું મીલશું, વાચક ચશ કહે હેઠે હળશું.

(૬. યશોવિજયળકૃત વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન.)

અહીં મહાપુરુષનું કહેવું છે “જેવી રીતે હૃથમાં  
સાકર નાખીએ અને તે હૃથમાં એકમેક થઈ જાય છે, તે  
રીતે ખીર નીર પરે તુમશું મીલશું એટલે હે વિશુદ્ધ  
ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ! આપના આવા અલેદ મીલન  
કારા એમે પણ હેઠે હળશું એટલે પરમાનંદનો-અનુભવ  
કરીશું અર્થાતું આપનું અલેદ મીલન તેજ આત્મ સાક્ષા-  
તકાર એટલે આત્મ અનુભવની પ્રક્રિયા છે. આવા અનુભવ  
કરવાના લક્ષ્યી આ પ્રયોગ નં. ૫ અને ૬ દરરોજ કરવા  
માટે સુસુક્ષુ આત્માઓને આસ વિનંતિ છે.

જેમ જેમ સ્થિરતાપૂર્વક પરમાત્માનું ધ્યાન થશે તેમ તેમ  
આત્માના અનુભવની હિશામાં આપણે આગળ વધી શકીશું.

તુજ ગુણું જાન ધ્યાનમાં રહીએ,

ધીમ મીલવું પણ સુલભ જ કહીએ.

માનવિજય વાચક પ્રલુબ ધ્યાને,

અનુભવ રસમાં હળીએ એક તાને.

( અલિનંદન જીન સ્તવન.)

પૂર્વીચારોએ અનુભવ-રસ ચાખ્યો છે અને તે આત્મા-  
નુભવ રસ ચખાડવા માટે આપણુંને પરમાત્મ લક્ષ્ણ-ધ્યાન  
આદિનો હિંય માર્ગ અતાવ્યો છે. શ્રદ્ધા પૂર્વક તે જીન-  
કથિત માર્ગ આપણે નિષ્ઠાપૂર્વક પુરુષાર્થ કરવો.

## સમીક્ષા :—

મહેાપાદ્યાય શ્રીબ્રોવિજયજી મહારાજ સાડાગ્રણુંસો ગાથાના સીમાંધર સ્વામીના સ્તવનમાં નથ, નિષ્ઠેપ, સપ્ત-લંગી, વ્યવહાર, નિશ્ચય, ઉત્સર્ગ, અપવાદ વગેરે સર્વ રીતે લક્ષ્ણ કથો પછી ઉપસંહાર કરતાં છેવટે કુણે છે કે :—

તું પ્રભુ જે વસે હર્ષલર હીયલડે,  
તો સકલ પાપના બંધ તૂટે;  
જીગતે ગગન સૂરજ તેણે મંદલે,  
દહ દિશિ જિમ તિમિર પડલ કૂટે.

હે કરુણાસાગર પરમાત્મા ! તું જે મારા હૃદયમાંહિરમાં આનંદપૂર્વક વસે તો મારા સકલ પાપના બંધ તૂટી જાય, કારણ કે પાપદ્રષી અંધકાર ત્યાં સુધી જ રહી શકે છે કે જ્યાં સુધી પરમાત્માદ્વિપ સૂર્યનો ઉદ્ઘય થતો નથી. અર્થાત્ જેમ સૂર્યનો ઉદ્ઘય થતાં દરો દિશામાં અંધકારના પડલ કૂટી જાય છે, તે રીતે પરમાત્મા દ્વિપ સૂર્યનો ઉદ્ઘય જ્યારે જીવાત્માના હૃદયમાં થાય છે, ત્યારે સકલ પાપો પલાયન થઈ જાય છે.

કહેવાનો લાવાર્થ એ છે કે પરમાત્માની લક્ષ્ણ, નમસ્કાર, ઉપાસના, દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, સ્મરણુદ્ધિ દ્વારા પરમ રસનો અનુભવ થાય છે. ઈન્દ્રિયોના અને કષાયના રસો કરતાં અનેકગણો ચાડિયાતો પરમાત્મ-સ્વરૂપનો રસાનુભવ થાય ત્યારે, જગતના સર્વ રસ, નીરસ અની જાય છે.

ખરી રીતે તો પાંચ ઈન્દ્રિયોના અને કથાચોના રસો તે રસ નથી, પેણું આલોંસ માત્ર છે. છતાં અનાદિ ભિષ્યા મોહના કારણે લુધને વિષયકથાયમાં રસ પડે છે અને તે રસ કરતાં અતિ ઉંચા કોટીનો પરમાત્મ-ધ્યાનનો રસ પ્રાપ્ત થાય છે ત્યારે તુરછ રસો નાશ પામી જાય છે.

જશ પ્રભુ ધ્યાયો મહારસ પાયો, અવર રસે નવિ રાયું; અંતરંગ ઝેરસ્યો હરિશન તેરો, તુજ ગુણ રસ સંગ માયું.

ઉપાધ્યાયળું શ્રી યશોવિજ્યાયળું મહારાજ ઉપર્યુક્તા પંક્તિમાં કહે છે કે પ્રભુ, તારા ધ્યાનનો મહારસ આજે પીધો, તેથી બીજી રસ દ્વિક્કા પડી ગયા. અંતરંગમાં તારા સ્વરૂપનું દર્શાન મળ્યું, હવે તારા સિવાય મારે બીજું કંઈ ન જેઈએ, તું જ મારું સર્વસ્વ છે, તું જ મારું સ્વરૂપ છે.

આ પ્રમાણે પરમાત્મ-સ્વરૂપનો ઉપલક્ષણથી આત્મ-સ્વરૂપના-પરમાનંદનો રસાસ્વાદ ચાખ્યા પછી જ જગતના બધા રસોમાંથી સાધકનું મન જીડી જાય છે.

તે જ વાત ૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવતાં છેલ્લે કહે છે કે—

વેગળો મત હુંજે દેવ સુજ મન થકી,  
કમળના વન થકી જેમ પરાગો;  
ચમક પાખાણું જેમ લોહને બીંચો,  
મુક્તિને સહજ તુજ લક્ષ્મિ રાગો.

ધા. પ્ર. ૪

હે હીન દ્વારા, શરણુગતવત્તસલ, કૃપાસિંહુ પરમાત્મા !  
 તું મારા મનમાંથી જરા પણ ખસતો નહિ, તું નિરંતર  
 મારા મનમાંદિરમાં વસક્રે. જેમ કમળના વનથી પરાગ  
 અલગ ન રહી શકે તેમ તારા સ્વરૂપની મહેક નિત્ય મારા  
 મનમાંદિરમાં હોજો. તારું નિરંતર સમરણ કરવા માટે  
 સમય આગમનો સાર “નમો અરિહંતાણું” મંત્ર નિત્ય  
 મારા મનમાંદિરમાં વસો તેવી હું તને વિનંતી કરું છું.

પરમ પૂજય શ્રી સિદ્ધબિ ગણિ મહારાજ ઉપમિતિ  
 લવપ્રપત્યા કથામાં સમય દ્વાદશાંગનો સાર શું છે તે  
 જણાવતાં કહે છે કે—

તસ્માત् સર્વસ્ય સારોસ્ય દ્વાદશાંગસ્ય સુંદર ! ।  
 ધ્યાનયોગ પરં શુદ્ધ : સ હિ સાધ્યો સુભુક્ષુણા ॥

હે સૌભ્ય ! આ સમસ્ત દ્વાદશાંગ ઇપ જિન પ્રવચનનો  
 સાર પરમ વિશુદ્ધ એવો ધ્યાનયોગ છે. સુભુક્ષુચોએ તે  
 ધ્યાનયોગને સાધવો જોઈએ.

મૂલોત્તરગુણાઃ સર્વે, સર્વી ચૈવં બહિપ્રિકયાઃ ।  
 મુનીનાં શ્રાવકાણાં ચ ધ્યાનયોગાર્થમીરિતા ॥

સર્વે મૂલ શુણો અને સર્વે ઉત્તર શુણો તથા સર્વ  
 આદ્ય કિયા કે જે મુનિઓ અને શ્રાવકો માટે વિહિત  
 છે, તે ખાંડી ધ્યાનયોગ માટે પ્રરૂપિત કરવામાં આવી છે.

વિશુદ્ધ ધ્યેય-પરમાત્મા અરિહંત દેવતું ધ્યાન અને  
 તે દ્વારા આત્મ સ્વરૂપનો અનુસ્વર અને છેવડે આત્મ

સ્વરૂપની પ્રાપ્તિ કરવી તે લક્ષણક સુધી પહોંચવાનું છે, તે માટે પોતાના ગુણુસ્થાનકને અનુરૂપ જિન આજા પ્રમાણે ધર્મદિયા-અનુષ્ઠાનો લાવપૂર્વક-ઉપયોગ જોડવા પૂર્વક કરીને એટલે કે ધ્યાન પૂર્વક કરીને પરમાત્માને હૃદયમંહિરમાં અધરાવી પરમાત્માનું ધ્યાન કરવાથી કાયં સિદ્ધિ થાયં છે.

આજે પાણ્યો પરમ પદનો, પંથ તારી કૃપાથી,  
મીટચા આજે ભ્રમણુ લવનાં, દિવ્ય તારી કૃપાથી;  
હુઃઝો સર્વે ક્ષય થઈ ગયા, દેવ તારી કૃપાથી,  
ખુલ્યાં ખુલ્યાં સકલ સુખનાં, દ્વાર તારી કૃપાથી.

આજ સુધી સુખ જગતના પદાર્થોમાં લડેલું છે તેવી સમજ હતી અને તેના કારણે સુખ માટે આપણે જગતના પદાર્થોની પાછળ દોડતા હતા, પરંતુ આજે પરમાત્માની કરુણા આપણા ઉપર વરસી. પરમાત્માની કરુણાને આપણા હૃદયમા આપણે જીવી તેના કારણે આપણી ખુદ્ધિ શુદ્ધ થઈ. સિંયને તુ સદા વિપુલ કરુણા રસે, મુજ મને શુદ્ધ મતિ કલ્પવેદી, શાન દર્શન કુસુમ ચરણુંબર મંજરી, મુક્તિ ક્રણ આપશે તે અકેલી.

(૩. યશોવિજયળુકૃત ૩૫૦ ગાથાનું સ્તવન.)

પ્રભુના કરુણા રસના સિંયનથી આપણી ખુદ્ધિ શુદ્ધ થવાથી અને પરમાત્માના ધ્યાન દ્વારા સુખ આનંદનો મહાસાગર આપણા આત્મામાં પૂર્ણ ભરેલો છે તેની સલાનતા, સફરણા, પ્રતીતિ અને બતુકિચિત્ત અનુભવ થતાં આત્મિક સુખનાં દ્વાર ખુલ્યાં થઈ ગયાં. (ખુલ્યાં ખુલ્યાં સકલ સુખનાં દ્વાર તારી કૃપાથી.) જગતના પદાર્થોમાં સુખ

શુદ્ધ હતી તેના ખફે પરમાત્મા અને આત્મામાં સુખ  
શુદ્ધ ઉત્પન્ન થઈ.

મનનો એક સ્વલ્પાવ છે કે જ્યાં પોતે અધિક સુખ  
આનંદું છે તે તરફ હોડયા જ કરે છે. નાનું ઘર હોય તે  
'માહુ' મેળવવા, થાડા પૈસા હોય તો વધુ મેળવવા, પોતાની  
માનેલી સુખની વધુ સામચ્ચી મેળવવા મનની હોટ નિરંતર  
ચાલુ છે. પરંતુ સાલંખન ધ્યાનના પ્રયોગ કરા પરમા  
ત્માના હિંય પ્રકાશના આલંખને મનની ગતિ (ઉપર્યોગ)  
પરમ આનંદના લંડાર આત્મા તરફ થતાં હિંય આનંદની  
અનુભૂતિ થાય છે. આ રીતે હિંય આનંદની અનુભૂતિ કરીને  
ખફાર આવેલું મન તે આનંદને ફરી ફરી અંખે છે કારણ  
કે ધ્યાન કરા મળેલો પરમ આનંદ અને સુખ એટલ  
કૃચ્ય કક્ષાના હોય છે કે પાંચે ઈદ્રિયો અને કષાય જનિ  
સુખ ને માત્ર સુખાલાસ છે તે આત્મિક સુખની પાં  
અતિ તુચ્છ લાસે છે. તેથી આપણું મન આત્મિક સુખ  
અને આનંદને વારંવાર અંખે છે. તે આત્મિક સુખ અંન  
આનંદ માટેના પરમ આલંખન રૂપ પરમાત્માનું સમરદ્ધ  
ધ્યાન, પૂજન, નમસ્કાર, મંત્ર જપ-આહિ સહજ લાં  
સ્થિરતાથી થાય છે. પરમાત્માની આજા મુજબની સર્વ ધર્મ  
કુચ્છિયામાં રસ અને લાવ ઉત્પન્ન થાય છે. સર્વ ધર્મકુચ્છિયામ  
આણુષ્પૂર્તિ થાય છે.

માહરો આત્મા તુજ થકી નીપને,

માહરી સંપદા સયલ મુજ સંપને,

સેણે મનમંહિરે ધર્મ પ્રભુ ધ્યાઈએ,  
પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ.  
( ધર્મનાથ લગ્વાનતું સ્તવન.)

માહર્દી પૂણોનંદ પ્રગટ કરવા લાણી રે,  
પુષ્ટાલંબન ઇપ, સેવા પ્રભુજી તણી રે,  
દેવચંદ્ર જિનચંદ્ર લક્ષ્મિ મનમેં ધરો રે,  
આધ્યાત્માધ અનંત અક્ષય પહ આદરો રે.

( મહેનાથ લગ્વાનતું સ્તવન.)

આ રીતે સાલંબન ધ્યાન દ્વારા આત્મિક સુખ અને  
આત્માનંદ સૌને પ્રાપ્ત થાય છે તે હેતુથી આ પુસ્તકમાં અનેક  
આધ્યાત્મિક આધારો સહિત તર્વ દર્શાવ્યું છે. સાકર મીડી  
ઉત્તેવું ૧૦૦ પાનાનું પુસ્તક વાંચ્યાથી સાકરની મીહાશનું  
બેઠું જીન થાય છે તેના કરતાં સાકરની એક કાંકરી  
શાલમાં નાંખવાથી પ્રત્યક્ષ મીહાશનો અનુભવ થાય છે.  
ત્યાર આ પુસ્તક વાંચ્યાથી કે વાંચીને સાડું લાગ્વાથી  
જાલ જરૂર છે, પરંતુ કાર્ય સિદ્ધિ તો આપણે ધ્યાન-  
આરાધના કરીએ અને અનુભવ સુધી પહોંચીએ ત્યારે જ  
થાય અને તેનો સાચો આસ્વાદ આવે. માટે ઉ. યશો-  
વિજયજી મહારાજ કહે છે :-

લાગર સુખ પામર નવિ જાણે, વલ્લલસ સુખ કુમારી;  
જી અનુભવ વિજુ ધ્યાન તણું સુખ, કેમ કહીએ નરનારી રે;  
લવિકા વીર વચન એમ જાણે.

( ઉ. યશોવિજયજીકૃત આઠ દશિની સજગાયમાંથી.)

સાલં બન ધ્યાનના આપણે પ્રયોગ કરીએ છીએ તે શું છે?

સૌથી પ્રથમ આપણે સ્થિર આસને બેઠા એટલે કાયાને પરમાત્મ ધ્યાન માટે સ્થિર કરી, વાણીથી પરમાત્માની સ્તુતિ કરી તેથી વાણી પવિત્ર અની, મનથી પરમાત્માનું ચિત્તન કર્યું તેથી મન પવિત્ર-નિર્મળ અન્યાં, મન, વચન, કાયા પવિત્ર થવાથી ચિત્તની વિશુદ્ધ થઈ, ચિત્ત વિશુદ્ધ થવાથી ભાવ અને લેશ્યા વિશુદ્ધ થયાં.

લેશ્યા કૃષણ, નીલ, કપોત, અશુક હતી તે ધ્યાન દ્વારા ભાવ વિશુદ્ધ થવાથી લેશ્યા વિશુદ્ધ થઈ એટલે તેને, પદ્મ અને શુક્લ લેશ્યા થઈ. લેશ્યા અને ભાવ વિશુદ્ધ થંવાથી અધ્યવસાય નિર્મળ થયા. અને અધ્યવસાય નિર્મળ થવાથી કષાય પાતળા પડ્યા અને કષાયે પાતળા પડવાથી આત્માના હિંય પ્રકાશનો આંશિક અનુભવ થયો.

આવી રીતે આપણે બહારથી અંદર ગયા અને આત્મિક આનંદ અનુભવ્યો. હવે અંદરથી બહાર જવાના પ્રસંગે ધ્યાનમાં છેલ્લું દશ્ય પરમાત્મા હૃદયમાં બિરાજમાન છે તેવું તેનું દર્શન અને ધ્યાન કરવાનું છે. હૃદયમાં બિરાજમાન પરમાત્મા ચોવીસે કલાક આપણા હૃદયમાં બિરાજમાન છે, તેનું સ્મરણ રાખવાનું છે. તે સ્મરણ માટે “નમો અરિ-હુંતાણું” નું નિરંતર સ્મરણ કરવાનું છે.

પરમાત્મા હૃદયમાં બિરાજમાન છે તેવા સ્મરણથી તેમનો હિંય પ્રકાશ ચોવીસે કલાક આપણામાં પ્રકાશનો રહેશે. પરમાત્માના પ્રકાશથી કષાયેનું મંઢળ ચોવીસે

કલાક પાતળું રહેશે. (તીવ્ર કષાય કે આસક્તિ આપણે કરી શકીશું નહીં) તેનાથી અધ્યવસાય નિર્મણ રહેશે. અધ્યવસાય નિર્મણ રહેવાથી દેશ્યા અને લાવ વિશુદ્ધ રહેશે અને દેશ્યા-લાવ વિશુદ્ધ રહેવાથી ચિત્ત વિશુદ્ધ રહેશે. ચિત્તની વિશુદ્ધિથી મત-વચન-કાચાના ચોગણનું પ્રવર્તન જુન આજાને અનુરૂપ રહેશે અને તેનાથી આપણું આપું જીવન વિશુદ્ધ થશે.

આ રીતે મોક્ષ ભાગની એક હિંય પ્રક્રિયા આપણે કરીએ છીએ. આપણા સમય જીવનનું પરિવર્તન કરી આપણું જીવન હિંય અનાવવાની અદ્ભુત કિયા જે આ પુસ્તકના દેખફને અદ્યાત્મ ચોગી અનુસવસિદ્ધ મહાયુર્ધ પુ. પ. શ્રી ભરતરવિજ્યજી મહારાજ સાહેબના રૂપ વર્ણના સાનિધ્ય દરમ્યાન પ્રાપ્ત થયેલી તે અહીં રણુ કરી છે.

આ રીતે દરરોજ અનુકૂળતા મુજબ સાલાંબન ધ્યાન ધાને પરમાત્મ ઉપાસના-ભક્તિ કરવા માટે જીવાસુ આત્મા-ઓને ખાસ વિનંતિ છે:—આ પ્રચોગનું મૂળ છે પરમાત્માનું સાનિધ્ય અનુસવવું. પરમાત્માના સાનિધ્યથી આપણું જીવન હિંય ધને છે. દા. ત. લોઢામાં બાળવાનો કોઈ શુણ નથી, પરંતુ લોઢાને અગ્નિના સંચોગમાં રાખવામાં આવે તો લોઢામાં અગ્નિનો બાળવાનો શુણ પ્રગટ થાય છે. તે રીતે પરમાત્માના ધ્યાનથી પરમાત્માના શુણો સાધકમાં આવિલોચ પામે છે. “ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, પામે ક્ષવનો પારોઝ” પરમાત્માનું સાનિધ્ય અનુસવવાથી પરમાત્માની હિંય શક્તિએ આપણાં જીવનમાં કાર્યશીલ ધને

છે. અને સામાન્ય મતુજ્ય મહામાનવ અને છે. સૌ કોઈ પરમાત્મ-ઉપાસના લક્ષ્ણ-ધ્યાનની આરાધના કરી સ્વ-પર કદ્વાણુનો માર્ગ સાધે તે જ અભ્યર્થના.

“હૃદય કુમલમેં ધ્યાન ધરત હું, શિર તુજ આણ વહું”

ધ્યાન-આરાધના સાથે જીન આજાપૂર્વક કિયાને પણ જીજાસુ આત્માઓ જીવનમાં ધારણ કરી મોક્ષ માગના સાચા સાધક અને તે જ અંતરની અલિલાખા.

પ્રચોગ નં. ૭ :—

કરુણારસમાં સ્નાન કર્યો પછી આપણા લાવને પરમાત્માના આ મહાકરુણા લાવમાં લેળવી હેવાનો દિવ્ય પ્રચોગ નીચે મુજબ :—

પરમાત્માના કરુણા રસમાં સ્નાન કરવાના પરિણામે અને પરમાત્માની કરુણા સંકિય રૂપે (પ્રચોગ નં. ૧ ની સાધનાથી) કાર્યશીલ ભનવાથી આપણા રોગ, શોક, દુઃખ, લય, ચિંતા, અશાંતિ નાશ પામી ગયાં. આપણે સુખ, શાંતિ, આનંદ અને નિલંયતાથી લરાઈ ગયા છીએ. હવે આગળ પ્રચોગ :—

પરમાત્માની કરુણાનો સફેદ દ્રોઘ જેવો ધોધ જોરથી પડે છે. આપણા અંદર કરુણા પૂર્ણ લરાઈ ગયી છે. હવે અંદર જગ્યા નથી અને ભહારથી ધોધ પડે છે.....  
.....(આવું દશ્ય જોવું, સંવેદન કરવું)  
.....(થોડો સમય જોયા કરવું.)

કરણા ભાવનો એક કુવારો આપણા અક્ષરંગ  
(મસ્તકના મધ્ય ભાગ)માંથી ઉતે છે. તે ઉપર ઉચ્ચ ને  
ઉચ્ચ જાય છે.....(આવું દશ્ય જેવું.)

તે કુવારો છેક લોકના અંત ભાગ સુધી પહોંચે છે....

૪૫ લાખ ચોજન પહોંચે થઈ સમગ્ર વિશ્વ ઉપર  
વરસે છે.....

### પ્રયોગ :—

આવા મહાકરણાના નિધાન, કૃપાના અવતાર, હ્યાના  
સમુર્દ, વાત્સલ્યના લંડાર પરમાત્માની કરણા જગતના  
જીવ માત્ર ઉપર સિદ્ધશિલાથી છેક નીચે સાતમી નારકી  
સુધી વરસી રહી છે. ચૌદ રાજલોક પરમાત્માની કરણાથી  
પરિપ્રાવિત થઈ રહ્યું છે.....

(આવું દશ્ય આપણે જેઠાં છીએ.)

અતિ અફ્બુત અને આતંકમય દશ્ય આપણે જેઠાં  
છીએ.....તેનાથી આપણા હૃદયમાં ભાવોદ્ધાસ ઉત્પત્ત  
થાય છે. આપણા હૃદયમાં પણ સર્વ જીવ સાથે મૈત્રીભાવ  
ઉદ્ઘસ્ત થાય છે. આપણી જગતના જીવમાત્રના કલ્યાણની  
ભાવના પણ પરમાત્માની કરણા સાથે મળે છે.....

અફ્બુત ભાવોદ્ધાસ આપણામાં પ્રગતે છે.....

“સર્વ જીવોનું કલ્યાણ થાએ.....

સર્વ જીવો હુઃખ મુક્ત બનો.....

સર્વ જીવોનાં પાપ નાશ પામા.....

સર્વ જીવોને પરમાત્માનું શાસન મળો.....  
 અધા જુ બોધિથીજને પામો.....  
 સર્વને મોક્ષ મળો.....  
 સર્વ જીવ મારા આત્માની સમાન છે.....  
 મને સર્વ પ્રત્યે મૈત્રી છે.....  
 મને સર્વ પ્રત્યે સ્નેહભાવ છે.....  
 સર્વ જીવો સત્તાએ પરમાત્મતુલ્ય છે.....  
 પરમાનંદના કંદ છે અને અનંત ગુણુના વૃંદ છે....  
 સર્વ જીવ પ્રત્યે મને પૂર્ણ પ્રેમ છે.....  
 સર્વનું કલ્યાણ-મંગળ થાઓ. સૌને આનંદ થાઓ....  
 સર્વ જીવો પ્રભુની કરુણાના પાત્ર છે, તેથી મારા  
 પરમ ખાંધવ છે.

સર્વ જીવ ઉપર કરુણાને વરસતી જેવી.....પ્રભુની  
 કરુણામાં આપણો કરુણાભાવ લેગો ભજ્યો છે. પ્રભુની  
 કરુણાના મહાસાગરમાં આપણો બિન્હરૂપ લાવ લળી જય છે.

“ઉદ્ક બિન્હ સાયર લયો.” (In tune with  
 Intinite) આવી અવસ્થા છે.....(આવું સંવેદન કરવું.)  
 આપણું અદગ વ્યક્તિત્વ ઓગળી ગયું છે.....  
 સમાધિમાં આપણે લળી ગયા છીએ.....  
 વિશ્વમય પરમાત્મા એ આપણું સર્વર્ષ છે.....  
 મૈત્રીભાવને પરમ આનંદ આપણે અનુભવીએ છીએ.....

## પ્રચોગ ૭ ની વિશેષ નોંધ :—

આ આરાધના કરવાથી સર્વ જીવો પ્રત્યે-પ્રેમ, કરણું, મૈત્રી વિકસિત થાય છે. કોધ, માન, માચા, લોલ આદિ કષાયો પાતળા પડે છે, અને સાધના સમયે દિવ્ય આનંદ થાય છે. કોઈ સાથે વૈર, અમૈત્રી થઈ હોય તો તેના પ્રતિ કરણું ખાસ વરસાવવી. તેથી આપણા વિરોધના ભાવો બદ્લાઈ જશે. પરસ્પર મૈત્રી ઉત્પત્ત થશે.

અધ્યાત્મ કદ્વપદ્મમાં કહ્યું છે :— ( મૂળ શ્વેષ નમ-સ્કાર ચિત્તામણી પાનું ૧૬. )

વિશ્વ જંતુષુ યદિ ક્ષણમેક, સામ્યતો ભજસ્તિ માનસ મૈત્રીં ।  
તત્સુખ પરમ મત્ર પરત્રા, પ્રયાણુષે ન યદભૂતવ જાતુ ॥

હે મન ! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણુવાર પણ પરહિતચિંતા રૂપ મૈત્રીભાવ ભાવીશ તો તને આ ભવ અને પરલવમાં એવું સુખ મળશે કે જે તેં કઢી અનુભવ્યું નહિ હોય.

ધ્યાનમાં વિશેપ આવે ત્યારે આ મૈત્રી ભાવનાનું ધ્યાન કરવું. કારણું કે મૈત્રી આદિ ભાવો ધ્યાનને રસાયણુંની માર્કે પુષ્ટ કરે છે.

ધ્યાન તૂટી જાય ત્યારે આ રીતે મૈત્રી ભાવનાનું ધ્યાન ખાસ કરવું.

## ભાવના

આખુંડ આનંદને વરસાવનાર હે પ્રભુ ! મારા જીવનમાં  
તારું આગમન થયા પછી હવે સંતાપ મને તપાવી નહિ શકે.

હવે શોક મને પ્રજાળી નહિ શકે.

હે કરુણામય ! તારામાંથી વરસતી અતંત સુખની  
વર્ષામાં સ્તાન કયો પછી હવે હુઃખ મને હીન નહિ બનાવી શકે.

આપત્તિ મને હુઃખી નહિ કરી શકે.

હે વાત્સલ્ય મૂર્તિ પરમાત્મા ! પ્રશમરસ પૂર્ણ તારા  
સ્વરૂપમાં સમાઈ જવાધી હવે અશાનિત-અજાગ્રો મને  
સતાવી નહિ શકે.

ચિંતા મને સ્પર્શી પણ નહિ શકે.

હે અલયદ્વયાણું ગુણુના સ્વામી પરમાત્મા !

તારામાં શ્રદ્ધાનો અલાવ એ જ ભયનું સ્વરૂપ છે  
તેવું જાણયા પછી અને તારું શરણ લીધા પછી ભય જેવો  
કોઈ ચીજનું અસ્તિત્વ મારે માટે નથી.

હે કૃપામય પ્રભુ ! તારી કરુણાનું પાત્ર બનેલા મને  
સદા સુખ, શાન્તિ, અને આનંદ નિર્ઝયતા જ છે.

Open your self in an aspiration towards the  
gives of delight with in the divin element.



ॐ હ્રિં અહો નમઃ

## સાલાંખન ધ્યાનના પ્રચોરો॥

પાઠ બીજે

### નમસ્કાર મહામંત્રનું ધ્યાન

નમસ્કાર મંત્રની આરાધના એ મહાન આધ્યાત્મિક સાધના છે. તેની વિશેષતા એ છે કે તે સાધના આભાલ-વૃદ્ધ, રાજ અને રંક, ચોગી અને લોગી, સર્વ કોઈ કરીશકે છે. ખાતાં-પીતાં, બેસ્તાં-જિડતાં, સુખમાં કે દુઃખમાં સર્વ સમયે, નવકારનું સમરણ કરી શકાય છે. જન્મતાં પણ નવકાર સંલગ્નાવવામાં આવે છે, જીવનસર પણ નવકાર ગણુવામાં આવે છે, ભરતાં પણ નવકાર સંલગ્નાવવામાં આવે છે. માતાના હૃદધની જેમ નવકાર સૌને લાલ કરે છે. સર્વ પાપનું મૂળ અહંકાર છે. નમસ્કાર ભાવથી અહંકારનો અંત End of egoism આવે છે.

ધર્મનું મૂળ વિનય છે. વિનય નમસ્કારથી આવે છે. તેથી નમસ્કાર મહાન છે.

નમસ્કાર સર્વ પાપનો નાશ કરી, શુદ્ધ આત્મસ્વરૂપની

પ્રાપ્તિ કરાવે છે કે જે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ મંગલ છે. જગતમાં અનેક મંગલો છે. કોઈ ગાયને મંગલ માને છે. કોઈ કુંકુમને મંગલ માને છે. કોઈ કન્યાને મંગલ માને છે. કોઈ કુંભને મંગળ માને છે. પણ શ્રેષ્ઠ મંગળ કયું ?

આત્માનું શુદ્ધ સ્વરૂપ તે શ્રેષ્ઠ મંગલ (Essence of extremity) છે, જે નવકારની આરાધનાથી મળે છે. નવકારની આરાધનાથી પાપનો પ્રણાશ અને પુષ્ટયનો પ્રકૃત્યા થાય છે. સુખનું સર્જન અને હૃદાનું વિસર્જન થાય છે. વિદ્ધોનો વિચછેદ Dissolution of disorder અને મંગલનું મંડાણું થાય છે. સુનિધિએનું સંવર્ધન અને હુલ્લોણ્યનું ફરીકરણું શ્રી નવકારથી થાય છે. ધર્યાએનું ઉદ્ઘર્વગમન થાય છે, સત્યનું સંશોધન થાય છે. શ્રી નવકાર એ વિશ્વેશ્વરને વિનંતી છે, જેનાથી અનંતતા આશીર્વાદ મળે છે. શ્રી નવકાર એ સર્વેશ્વરની શરણાંગતિનો મંત્ર છે, જેનાથી પૂર્ણતાનો પરમાનંદ (Delight of Divinity) પ્રગટે છે.

શ્રી નવકાર ધર્મધ્યાનનો ધોધ છે, જેનાથી ચિંતાનું ચૂરણ, આપત્તિએનું અવમૂલ્યન, સૌભાગ્યની સંપ્રાપ્તિ, આત્મસિદ્ધિનું આયોજન, અવિનારણીપણાનો આદર્શ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર એ પરમાત્મા સાથેનો દ્વિત્ય પ્રણય છે. જેનાથી પૂર્ણતાનો પરમાનંદ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર શોકનો સંહારક, લવનો લંજનહાર અને ચિંતાનો ચૂરનાર છે, જેના વડે જીવનમાં શાશ્વતપણાનો

સંદેશો સમજાય છે, અને પરમેણિઓ સાથેના તન્મય, તદ્રૂપ ભાવથી (In tune with Infinite) આપણા આત્માને પરમેણિ સંવર્ગ બનાવી શકાય છે. સર્વ સિદ્ધિ-એનું સોપાન શ્રી નવકાર છે. જગતનું સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ, સર્વોત્તમ, આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર શ્રી નવકાર છે.

આવા સર્વોત્કૃષ્ટ મહામંત્રનું સ્મરણુ, જાપ કે ધ્યાન કરતી વખતે આપણું મન ઇરે છે તેવી સર્વ સામાન્ય ઇરિચાઈ સર્વત્ર છે. આપણા પરમ ઈષ્ટ મંત્રના સ્મરણ વખતે આપણું મન ઇરે-ઝીને જાય તે આપણા મનની ખુલ્લ જ હુઃખ ભરી-દર્દ ભરી હાલત છે. જ્ઞાની પુરુષો પણ કહે છે- મનુષ્યનું મન મોટા ભાગે આત્મધ્યાન, રૌદ્રધ્યાનથી પીડાઈ રહ્યું છે. જાય, શોક અને ચિંતાની લાગણ્યીથી વ્યાચ રહેવાના સ્વભાવવાળું અની ગયું છે પરંતુ તે કિલિષ સ્વભાવવાળા મનુષ્યના મનમાં પણ જ્યારે લગવાનનો પ્રદેશ થાય છે ત્યારે તે મન શાંત, આનંદી અને નિર્બાધ અની જાય છે. મનમાં પરમાત્માને લાવવા માટે અનેકવિધ ઉપાયો મહાપુરુષોએ બતાવ્યા છે.

નામ અહે આવી મળે, મન ભીતર લગવાન,  
મંત્રઅળે જેમ દેવતા, જ્હારો કીધો આહાન.

શ્રી માનવિજ્યાળુકૃત પદ્મપ્રભુનું રત્વન.

જેમ ડોષ મંત્ર-દેવતાનું આહાન કરવાથી મંત્ર-  
દેવતાને હાજર થવું પડે છે, તેમ પ્રભના નામદ્રૂપ મંત્રનં

સમરણું કરવાથી પરમાત્મા આપણું મનમહિરમાં મળવા માટે આવે છે.

નામ અને નામીનો કથાચિતું અલેહ સંખંધ છે. ‘લાડુ’ શાખ ઓલવાથી તેનો દેખાવ, સ્વાદ, ખંદું નજર અમક્ષ આવે છે. ‘રસગુણાં’ શાખ ઓલીએ છીએ ત્યારે કેટલાક રસલોહુપી માણસોને મોઢામાં પાણી આવે છે, તે બતાવે છે કે વસ્તુના નામને વસ્તુ સાથે સીધે સંખંધ છે. તેવી રીતે ‘અરિહંત’ એવા નામને સાક્ષાત અરિહંત પરમાત્મા સાથે સીધે સંખંધ છે. માટે કહ્યું છે કે :—

‘નામ અહે આવી ભળે, મન લીતર લગવાન’

માટે પરમાત્માને મેળવવાની તીવ્ર જંખના Dynamic Desire આપણુંમાં ઉત્પન્ન કરવી અને તે જંખના પૂર્ણ કરવા માટે ચારે નિક્ષેપે ત્રિવિદ્યે ત્રિવિદ્યે પ્રભુભક્તિ કરવી ( Devotion to Divinity ).

જૈનશાસનમાં ચાર નિક્ષેપાનું અફ્લસત તત્ત્વજ્ઞાન છે. લાવ નિક્ષેપે તો અતિ ઉપકારી છે જ, પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ પણ એટલા જ ઉપકારી છે.

### પ્રથમ ભૂમિકા

નમસ્કાર મંત્રની આરાધના તે નામ નિક્ષેપની આરાધના છે. જેને કલિકાલ સર્વેશ લગવાન શ્રી હેમચંત્રસ્તુરીશ્વરજી મહારાજ ચોગશાખમાં પદસ્થ દ્યાન કહે છે.

પ્રથમ નમસ્કાર મંત્રના જાપ વિષયક કેટલીક મહત્વની

વિચારણા કર્યો પછી નમસ્કાર મંત્રના ધ્યાન વિષયમાં વિચારીશું.

આરાધના શરૂ કરતાં નીચેની બાબતોનું લક્ષ આપવું.

**આસન અને સુદ્રા :**—આસન જેનનું સફેદ રંગનું એસવા માટે રાખવું. એક જ સ્થાન ઉપર એસી આરાધના કરવી. બહારળામ જવાનું થાય ત્યારે એસવાનું આસન સાથે રાખવું. પજ્ઞાસને એસી શકાય તે વધારે સારું છે, અગર અર્ધ્ય પજ્ઞાસને એસવું; અગર સુખાસને પણ એસી શકાય. હોડ બંધ રાખવા. હાંત એકખીલને અડાડવા નહિ. જુલ્દ હાંતને અડે નહિ તે રીતે સુખમાં ઉપરના લાગમાં ચીટકેલી રાખવી. દરેક ધ્યાન પ્રયોગમાં આ સુદ્રા રાખવાથી વિરોષ પ્રગતિ થશે.

**હિશા :**—પૂર્વ અગર ઉત્તર સન્મુખ સુખ રાખીને આરાધના કરવી. જ્યારે જિનમંહિરમાં આરાધના કરતા હોઈએ ત્યારે ભગવાનની સન્મુખ એસીને કરવી. ત્યાં હિશાની ગૌખુતા છે.

**માલા :**—સફેદ સુતર અગર સફટિકની રાખવી. જે માળા નવકાર ગણુવા માટે રાખી હોય તેનાથી બીજે મંત્ર જપવો નહીં.

માળા વડે થોડા હિવસો જપ કર્યો પછી નંદાવર્ત્ત શાંખાવર્તાથી મંત્ર ગણુવાનો અજ્ઞાસ પાડવો. નંદાવર્તાથી ૧૨ ની સંઘ્યા જમણા હાથ ઉપર ગણુવી. અને શાંખાવર્તાથી ધ્યા. પ્ર. ૫

ડાયે હાયે નવની સંખ્યા ગણુવી. આ રીતે ૧૨ ની સંખ્યા નવ વર્ષની ગણુવાથી ૧૦૮ થશે.

ડાયા હાયે શાંખાવર્તી				જમણા હાયે નંદાવર્તી			
૩	૪	૫	૦	૩	૪	૫	૧૨
૨	૮	૬	૦	૨	૭	૬	૧૧
૧	૮	૭	૦	૧	૮	૮	૧૦

સંખ્યા :—ઓછામાં ઓછી ૧૦૮ ની સંખ્યા નવકારના જાપ માટે નિયમિત રાખવી. અનુકૂળતા હોય તો વધુ સંખ્યાનો સંકલ્પ રાખવો.

સમય :—નિશ્ચિત સમયે આરાધના કરવી. અને ત્યાં સુધી દરરોજની આરાધનાનો સમય એક જ રાખવો. સૂર્યોદય પહેલાંની છ ઘડી અને ત્રણું સંખ્યા શ્રેષ્ઠ સમય ગણુાય.

ત્રિસંધ્યા આ પ્રમાણે (૧) સૂર્યનાં ઉદ્દ્ય પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૨) મધ્યાહ્ન પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૩) સૂર્યોસ્ત પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (એક ઘડી એટલે ૨૪ મિનિટ સમજવી.) અગર સૂર્યોદય પહેલાંની ૪૮ મિનિટ અને સૂર્યોસ્ત પછીની ૪૮ મિનિટ મધ્યાહ્ન ઉપર મુજબ પણ લઈ શકાય. સવારનો સમય વધુ અનુકૂળ છે. નવકાર તો સર્વ સમયે ગણુવાનો હોય છે. વિશેષ આરાધના માટે ઉપર મુજબ સમજવું.

જે નિશ્ચિત સમય આરાધના માટે નક્કી કર્યો હોય તે સમયે ખીજુ ડોઈને એપાઈન્ટમેન્ટ આપવી નહીં. કારણું કે તે સમયે પરમાત્માની સાથે એપાઈન્ટમેન્ટ અપાઈગયેલી હોય છે. Appointment with Most High.

આ રીતે અમુક ચોક્કસ આસને અને મુદ્રાએ, ચોક્કસ જગ્યાએ, ચોક્કસ સંઘયામાં, ચોક્કસ સમયે ધારાખદ રીતે આપ કરવાથી અમુક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ બંધાય છે. જાપમાં સારી રીતે લીનતા ઉત્પન્ન થાય છે. આ નિશ્ચિત આરાધનાના સ્થાને ખીજુ ડોઈ વ્યક્તિ આરાધના કરવા બેસે તો તેનું ધ્યાન પણ તે વાતાવરણના કારણે સ્થિર બની જય છે. મુજ્જો મુજ્જો સંકિલેશો, તિકાલ-સંકિલેશો (પંચસૂત્ર) સંકલેશ હોય ત્યારે નવકાર વાર-પાર જપવો, સંકલેશ ન હોય ત્યારે પણ પણ સંધ્યાએ વાવશ્ય જપવો.

### નવકારના ધ્યાનની ખીજુ ભૂમિકા

આ રીતે નવકાર મંત્રની આરાધના શરૂ કર્યા પછી ધીમે ધીમે આંખ બંધ કરીને મંત્રના અક્ષરો નજરની સામે આવે શાવવા પ્રયત્ન કરવો.

આંખ બંધ કરીને આપણું ઈષ્ટ મંત્રના અક્ષરો કે આપણું ઈષ્ટહેવની મૂર્તિ નજરની સામે આવે આંથી ધ્યાનની શરૂઆત થાય છે. ઉપયોગ જેડાય ત્યારે મંત્રાક્ષરો કે મૂર્તિ હેખાય છે.

जिनेषु कुशलं चित्तं तन्नमस्कारं पवच ।

प्रणामादि च संशुद्धं; योग वीजमनुत्तमम् ॥

( योगदृष्टि समुच्चयः )

प्रथम गुणु स्थानके मार्ग सन्मुख अनेका साधक  
कने सम्यग्दर्शननी प्राप्तिना कममां सूरीपुराहर हरिलिङ्ग-  
सूरीश्वरलु महाराज जिनेश्वर लगवांत प्रत्ये कुशल चित्त  
अने परमात्माना नमस्कारने योगनुं अनुपम वीज  
कुछे छे. अपुनर्भूधक अवस्थामां आवेद आराधक  
नमस्कार अने जिनकिं द्वारा योगमां प्रवेशे छे.  
योगनुं अनुपम वीज प्रथम गुणुस्थानके शास्त्र  
थाय छे.

३. यशोविजयलु महाराज आठ दृष्टिमां वीज तारा  
दृष्टिमां आवेद लुवने ईश्वरनुं ध्यान छोय छे तेवुं भतावे  
छे. सम्यक्तत्व पामवा माटेनी ग्रुडियामां ईश्वर ध्यान  
महत्वनुं अंग छे.

दर्शन तारा दृष्टिमां मनमोहन मेरे,

जोभय अजिन समान रे मनमोहन मेरे;

शौच संतोष ने तप ललुं, मनमोहन मेरे,

सञ्जय ईश्वर ध्यान रे मनमोहन मेरे.

अध्यात्मयोगी पू. पं. श्री लक्ष्मणविजयलु महाराजना हरताक्षरमां अंत्र जप अने भूर्तिना ध्याननुं  
स्वदृप :—

## મંત્ર અને મૂર્તિનું મહત્વ :—

જ્ઞાનજ્યોતિથી પ્રભુ મૂર્તિનાં દર્શન થાય છે અને અનાહત નાદથી પ્રભુનામના મંત્રનો જાપ થાય છે.

જ્યોતિ દર્શનનું આલંખન જિનમૂર્તિ છે અને નાદનું સંધાનનું આલંખન નામ મંત્ર છે.

“ નાદબિન્ડુ કલાડભ્યાસાત्

જ્યોતિરુત્પચતે પુનઃ ।

તત્પ્રાપ્તૌ ચ મનુષ્યાણાં

જાયતે પરમ પદમ् ॥ ૧ ॥ ”

મંત્રવડે નાદ, બિન્દુ, કલાનો પુનઃ પુનઃ અલ્યાસ થાય છે. નાદ અને કલાના અલ્યાસથી જ્યોતિ ઉત્પન્ન થાય છે, તે ચિન્મય જ્ઞાન જ્યોતિ આત્માનું સ્વરૂપ છે, તેની ઉપલબ્ધિ થવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે.

મંત્રજાપ સ્વાધ્યાય સ્વરૂપ છે અને મૂર્તિનું દર્શન ધ્યાન સ્વરૂપ છે, સ્વાધ્યાયથી ધ્યાન અને ધ્યાનથી સ્વાધ્યાયનો પુનઃ પુનઃ અલ્યાસ કરવાથી આત્મતત્ત્વ પ્રકાશિત થાય છે. આત્મા નાદ અને જ્યોતિ સ્વરૂપ છે, તેનું પ્રકૃટીકરણું મંત્ર અને મૂર્તિના અનુકૂળે જાપ અને ધ્યાન વડે સુલભ બને છે. નાદનું આલંખન મંત્ર છે અને જ્યોતિનું આલંખન મૂર્તિ છે,

તત્ત્વદૃષ્ટા પૂજય પન્થાસપ્રવર શ્રી લદ્રંકરવિજયજી મહારાજ  
—સ્વરૂપસ્તાદ્વિભિત ડાયરીમાંથી.

ઉપયોગ જેડવા પૂર્વિકની પ્રત્યેક કિયા ધ્યાન રૂપ અને છે. નવકારના અક્ષરોને આંખ બંધ કરીને નજરની સામે લાવવા માટે નીચે મુજબ પ્રયોગ કરવા.

### પ્રયોગ નં. ૮ :—

જાપ-પ્રથમ નવકારવાળી આહિના આલંખનથી, શાંખા-વર્તા, નંધાવર્તા આહિથી, અને પછી હૃદયકમળમાં નવકારના અક્ષરોની ધારણાથી કરવો. અક્ષરોની ધારણાનો અસ્થાસ કરવાની રીત આ પ્રમાણે છે.

### અક્ષરો જેવાની પ્રથમ રીત

મહામંત્રોના અક્ષરો સાથે આપણું ચિત્તનું જોડાણું થાય તે માટે શરૂઆતમાં કાળા રંગ ઉપર સફેદ અક્ષરોવાળું છાપેલું કાર્ડ સામે રાખી વાંચવું. એક વખત અડસડ અક્ષરો વાંચાય ત્યારે એક જાપ થયો ગણાય. અક્ષરો વાંચતી વખતે ને અક્ષરો વાંચાતા હોય તે અક્ષર ઉપર જ દિનો ઉપયોગ પણ રાખવો, કારણું કે આપણુંને આ મહામંત્ર ભાવ્યાવસ્થાથી સામાન્ય રીતે આપ્ત થયેલો હોવાથી અતિપરિચિત બનેલો હોય છે. તેથી દિનો ઉપયોગ ‘ન’ વાંચતી વખતે ‘મો’ ઉપર ‘મો’ વાંચતી વખતે ‘અ’ ઉપર, અને ‘અ’ વાંચતી વખતે ‘રિ’ ઉપર (‘રિ’ વાંચતી વખતે ‘તા’ ઉપર અને ‘તા’ વાંચતી વખતે ‘ણ’ ઉપર) એમ ઉપયોગ અને જપનું ઉચ્ચારણ આગળ પાછળ થઈ જવા સંભવ છે. એવું ન

થઈ જાય તે માટે નાતું બાળક માત્ર બારાખડી જ આવડતી  
હોય અને વાંચતું હોય તે રીતે,

ન.....મો.....અ.....રિ.....હં.....તા.....ં ।

એમ છુકું છુકું વાંચતું. ધીમે ધીમે અલ્યાસ  
વધતાં શીંગ વાંચતી વેળા પણ ઉચ્ચારણ અને  
દબિઠનો ઉપયોગ સાથે રહેશે. આ રીતે વાંચીને  
જાપનો અલ્યાસ ચાલુ રહેતા થોડા સમય પછી  
આંખો બંધ કર્યો પછી પણ અક્ષરો હેખાવા  
માંડશે. તે પછી હૃદયરૂપી કેારા કાગળ ઉપર  
ધ્યાનરૂપી કલમ વડે પોતાના નામની જેમ પંચ-  
પરમેણિના નામને લખતા હોઇએ તેવી રીતે એકા-  
ચ્રતાથી જાપ કરવો. શરૂઆતમાં આની એકાચ્રતા  
ન આવે તો પણ ધ્યેય તો તે જ રાખતું જેથી  
હિન-પ્રતિહિન સ્થિરતા વધતી જશે.

અક્ષરો જેવા માટેની બીજી રીત

ઉપરની રીત મુજબ જાપ નિયમિત કરવા  
ઉપરાંત નેત્રો બંધ કરીને અક્ષરો નજર સમક્ષ  
લાવવા માટે બીજા પણ પ્રયોગો છે. જેમ કે-નેત્રો  
બંધ કરીને સામે એક કાળું પાઠીયું ધારતું, પછી  
ધારણાથી જ હાથમાં ચાડનો કકડો લઈને તેના  
ઉપર 'નમો' એમ ધારણાથી લખતું એટલે લખેલું  
હેખાશે. ન હેખાય ત્યાં સુધી ફરી ફરીને એ

રીતે પ્રયત્ન કરવો. પછી અરિહંતાળ લખવું. ઇની ફરી પ્રયત્ન કરવાથી તે દેખાશે. આ રીતે નવે પહોં માટે પ્રયત્ન કરવો. અક્ષરો જેવા માટે આવો પ્રયત્ન દરરોજ થોડો વખત કરવો અને પ્રયત્નની સાથે પ્રથમની રીત પ્રમાણેનો જપ પણ ચાલુ જ રાખવો.

### અક્ષરો જેવાની ત્રીજ રીત

હીરાના દાળીના બનાવવાવાળા પહેલાં ચાંદીના ઝોખાં બનાવે છે તેથું નમો અરિહંતાણુંનું ચાંદીનું ઝોખું બનાવવું. તેમાં હીરા સેટ કરવાના બાકી છે.

પછી સફેદ હીરાનો એક ટગલો ધારવો, પછી આંખો મીંચીને ધારણાથી તેમાંથી હીરા લઈ એક એક હીરા કુમશઃ ચાંદીના ઝોખામાં મૂકૃતા નવકારતા ‘ન’નો આકાર બનાવવો. એ રીતે ‘મો’ આહિ બધા અક્ષરો ધારણાથી બનાવવા. તે અક્ષરો સફેદ હીરા જેવા ચળકતા દેખાશે. પછી ‘નમો સિદ્ધાણું’ના ચાંદીના ઝોખામાં માણેક, તીજા પદમાં ચોખરાજ, ચોથા પદમાં નીલમ, પાંચમાં પદમાં શનીના રતનો જડવાં. આ રીતે કલર જેવાનો અલયાસ પડશે. એ રીતે દરેક પદના અક્ષરો સ્પષ્ટ દેખાવા શરૂ થયા પછી અંગળી રીતો વધુ અનુકૂળ પડે છે અને સાધનામાં અડપી વિકાસ શરૂ થાય છે. અક્ષરો ન દેખાય તો પણ ઉપરની રીતે જપ ઉપયોગી છે, તેથી એકાગ્રતા તો કેળ-

श्री नमस्कार महामंत्र  
नमो श्रिरिहंताएं  
नमो सिद्धाएं  
नमो श्रायरियाएं  
नमो उवज्ज्ञायाएं  
नमो ल्लोएस्त्वस्त्वाहुएं  
एसो पंचनमुककारो,  
स्त्वपावप्पणास्पणो  
मंगल्भाएं च शत्वेसि  
पठमं हवइ मंगलं॥

प्रथेाग न०.-८

पृष्ठ न०. ७०







વાયજ છે. માટે તે પ્રયત્ન ચાલુ રાખવો. આ પ્રયત્નની સાથે પહેલી રીત પ્રમાણેનો જાપ પણ ચાલુજ રાખવો.

કહાય શરૂઆતમાં અક્ષરો ન હેખાય તો પણ અક્ષર હેખાય છે તેવો જ ભાવ રાખવો. ધીમે ધીમે સ્પષ્ટ અક્ષરો હેખાશે. અક્ષરો ચળકતા હેખાવા શરૂ થાય ત્યારે સાધનાની-ધ્યાનની શરૂઆત થઈ છે તેમ સમજવું. અક્ષરો હેખાય છે ત્યારે મંત્ર સાથે સંબંધ બંધાય છે. મંત્રમાં આપણું ચૈતન્ય લણે છે. આપણા આત્મ પ્રદેશોમાં અક્ષર ધ્યાનથી એક કંપન થાય છે જેનાથી અનાદિના મોહનીય કર્મના સંસ્કારો મંદ થાય છે. આત્માના શુદ્ધ ચૈતન્યની દિશામાં વિકાસ થાય છે. આ રીતે નમસ્કાર મંત્રની ચૂલ્હિકાના ચાર પહોમાં બતાવેલ ફળનો અનુસવ શરૂ થાય છે. આવું મહત્વતું ધ્યાન ખાળડો પણ કરી શકે છે.

સફેદ ચળકતા સેટિક જેવા અક્ષરો હેખાવા શરૂ થયા પછી ભીજે પ્રયોગ નીચે સુજબ કરવો.

### ધારણાથી માનસિક પૂજા

ત્રણુ નવકારનાં ર૭ પહોથી લગવાનની પ્રતિમાની પૂજા ધારણાથી એ વખત નીચેના કંસે કરવી.

(૧) જમણું પગનો અંગુઠો, (૨) ડાઢા પગનો અંગુઠો,  
 (૩) જમણું જાનુ, (૪) ડાઢો જાનુ, (૫) જમણું કાંકુ, (૬)  
 ડાઢુ કાંકુ, (૭) જમણું ખલ્સો, (૮) ડાઢો ખલ્સો, (૯) શિર-  
 શિખા, એ દૂરેદૂ સ્થાન ઉપર નવકારના એક એક પદને યોલ-

વाथी અહીં એક નવકાર પૂરો થશે પછી (૧૦) ભાતપ્રદેશ,  
થીજા નવકારનું પહેલું પદ અહીં આવશે. પછી (૧૧) કંડ,  
(૧૨) હૃદય, (૧૩) નાલિકમળ, (૧૪) હથેળી, પુનઃ (૧૫)  
જમણા પગનો અંગુઠો, (૧૬) ડાખા પગનો અંગુઠો, (૧૭)  
જમણા જનુ, (૧૮) ડાખો જનુ, અહીં થીજો નવકાર પૂરો  
થશે અને ત્યાંથી નાલિ સુધી દરેક સ્થાન પર એક એક પદ  
ગણુતાં વ્રીજો નવકાર પૂરો થશે. આ રીતે દર્શન, પૂજન,  
વિગેર કરતી વખતે, તેમ જ ધારણાથી પ્રતિમા કલ્પિને પણ  
ત્રણ નવકાર ગણુવા, એથી એકાશતાનો અલ્યાસ કેળવાય છે.  
ચિત્તની એકાશતાના અલ્યાસ માટે અહીં તો માત્ર 'દિક્ષસૂચન'  
કથ્યું છે. જે રીતે સાધકની ચિત્તવૃત્તિ પરમેષ્ઠિઓના ધ્યાનમાં  
એકાશ બને તે રીતિએ આ અને આવા પ્રકારના થીજા પણ  
જરૂરી પ્રયત્નનો કરવા પ્રયત્નશીલ બનવું એ તાત્પર્ય છે.

કહું છે કે 'અભ્યાસः કર્મણાં કૌಶલમાવહતિ' અર્થાત्  
કિયાનો અલ્યાસ કાર્યમાં કુશલતા પ્રગટાવે છે. જે ખાળકને  
એકડો ધુંટતાં મહિનાઓ વીતે છે, તેવા ખાળકો પણ રાજના  
અલ્યાસથી સુભર્થ વિક્રાન બન્યાનાં દ્ધાંતો મળે છે. તેમ  
પ્રારંભમાં મુશકેલ જણાતું પણ જાપ અને ધ્યાન સતત  
અલ્યાસ થયા પછી સુકર બની જાય છે, માટે સાધકે જાપ  
તથા ધ્યાનમાં પ્રગતિ સાધવા માટે તેનો અલ્યાસ સતત  
ચાલુ રાખવો.

**પ્રયોગ નં. ૬ :—**

ચોગિસમાદ્ય ૫૦ શ્રી હેમચંદ્રાચાર્યજી શ્રી ચોગશાસ્ના

આઠમા પ્રકાશમાં પહુસ્થ ધ્યાનતું વણુંન કરતાં જણું વે છે તે-

તथા પુણ્યતમં મન્ત્રં, જગત્ત્રિતયપાવનમ् ।

યોગી પંચપરમેષ્ઠિ-નમસ્કારં ચિચિન્તયેત ॥૧॥

—ત્રણ જગતને પવિત્ર કરતાર અને અત્યાંત પવિત્ર એવા પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રને સાધકે વિશેષ પ્રકારે ચિંતવવો.

અષ્પત્રે સિતોમ્ભોજે, કર્ણિકાયાં કૃતસ્થિતિમ ।

આચ્છ સત્તાક્ષરં મન્ત્રં, પવિત્રં ચિન્તયેત તત: ॥૨॥

સિદ્ધાદિકचતુર્ષકં ચ, દિક્પત્રેષુ યથાક્રમમ ।

ચૂલાપાદચતુર્ષકં ચ, વિદિકપત્રેષુ ચિન્તયેત ॥૩॥

— આઠ પાંખડીતું શ્વેત કમળ ચિંતવલું, તે કમળની કણ્ઠિકામાં એટલે મધ્ય લાગમાં, સાત અક્ષરવાળા પહેલા પવિત્ર મંત્ર ‘નમો અરિહંતાણ’ ને ચિંતવવો, પછી સિદ્ધાદિક ચાર મંત્રોને દિશાઓના પત્રોમાં અનુકૂળે ચિંતવવા અને ચૂલિકાના ચાર પત્રોને વિદિશાનાં પત્રોમાં ચિંતવવા.

શ્રી નમસ્કાર મહામંત્રતું ધ્યાન કરવા માટે કણ્ઠિકા સહિત અષ્ટલઙ્ક કમલમાં શ્રી નમસ્કાર મહામંત્રના નવ પદોની ડેવી રીતે સ્થાપના કરવી તેનો જ્યાલ આવે તે માટે અહીં તેનું ચિત્ર મૂકવામાં આયું છે.

પિંડસ્થ અને પહુસ્થ ધ્યાન આકૃતિ અને રંગના જ્યાલ વિના થઈ શકતું નથી, એટલે અક્ષરો અને તેટલા સુંદર અને મરોડાર રક્ખ્યવા અને પરમેષ્ઠિઓના વર્ણ પ્રમાણે તેના ધ્યાન

धરવु'. અથોત् 'નમો અરિહંતાણ' પદમાં ચંદ્રની જ્યોતસ્ના સમાન રવેત વણોને ચિંતવવા. 'નમો સિદ્ધાણ' પદમાં અરુણુની પ્રલાસ સમાન રક્તા (લાલ) વણોને ચિંતવવા. 'નમો આયરિયાણ' પદમાં સુવણુ' સમાન પીળા વણોને ચિંતવવા. 'નમો ઉવજ્જ્ઞાયાણ' પદમાં નીલમ રત્ન સમાન લીલા વણોને ચિંતવવા અને 'નમો લોએ સવ્વસાહૂણ' પદમાં અંજન સમાન શ્યામ વણોને ચિંતવવા. આ અક્ષરો જ્યારે ખરાખર રૂપણ્ટ અને સ્થિર દેખાય, તથા તેના રંગો અદ્વાર્ધ ન જાય, ત્યારે આપણું મન તેના પર સ્થિર થયું સમજવું. આ રીતે જ્યારે અક્ષરો પર મનની સ્થિરતા ખરાખર થાય છે, ત્યારે એ અક્ષરોમાંથી પ્રકાશની રેખાઓ ઝૂટતી જણાય છે અને છેવટે તે અફ્લુટ જ્યોતિર્મય બની જાય છે. અક્ષરોને જ્યોતિર્મય નિહાળતાં પરમ આતંક આવે છે અને આપણું હૃદ્યકમળ જે અધીમુખ હોય છે, તે ઉધ્વર્મભુખ થવા માંડે છે.

નમસ્કાર મંત્રના અક્ષરો તે સામાન્ય અક્ષરો નથી પરંતુ ભવઅટનીમાં ભૂલા પડેલા પથિકના માર્ગદર્શક છે. નવકારના અક્ષરો અજરામર પદને અપાવનાર જડિયુદ્ધી છે. નવકારના અક્ષરોનો જાપ અને ધ્યાન એ આત્મ-અનુભવની દિવ્ય પ્રક્રિયાના મંગલમય સોાપાન છે. ચિંતામણુ, કલ્પ-વૃક્ષ અને કામધેનુ કરતાં અધિક ઝળાયી છે. નવકારના પ્રત્યેક અક્ષર ઉપર ૧૦૦૮ વિદ્યાઓનો વાસ છે. પ્રત્યેક અક્ષરના અધિષ્ઠાયકો છે.

ધ્યાન વખતે નોચે પ્રમાણે ભાવના કરી આત્માને

ભાવિત કરવો. પોતાના મનને નીચેના વિચારોથી પુષ્ટ કરવું,

### પ્રણિધાન

હે પરમ મંગળ નવકાર ! તારા શરણે  
 આવેલો હું એટલું જ માગું છું કે તારા અચિત્ય  
 પ્રભાવથી નિયમિત, અખંડ રીતે, ઉત્સાહથી  
 અને એકાશ્રતા સાથે પરમપદની પ્રાપ્તિના  
 ઉદ્દેશથી તને આરાધવાનું સામથ્ય મારામાં  
 પ્રગટો ! બસ, તે સિવાય બીજું કંઈ પણ  
 મારે જોઈતું નથી,

મેરુપર્વત જેટલું સોનું, વિશાળ સાગ્રાન્ય, દેવલોક  
 આદિ સંપર્હાયો આ ખંડું મળવું સુલભ છે પણ નવ-  
 ચક્રમાં ભાવથી નમસ્કાર મંત્ર મળવો અતિ હુલ્લાલ છે.  
 માટે જપ વર્ખતે મનને સમજાવવું. “હે મન ! આ નવકાર  
 શું ચિંતામણિ છે, કામધેનું છે, કદ્વપવૃક્ષ છે ? ના. નવ-  
 કાર તો આ સર્વથી અધિક છે. કારણ કે ચિંતામણિ,  
 કદ્વપવૃક્ષ આદિ કદ્વપેદી વસ્તુ આપે છે. પણ નવકાર તો  
 અકદ્વપનીય એવું ભોક્ષ આપે છે, માટે હે મન ! તને હું  
 ભાવથી વિનંતિ કરું છું કે તે નમસ્કાર મંત્રના સમરણમાં  
 જરા પણ પ્રમાણ કરીશ નહીં.”

## નવકારની સાધનાની ત્રીજી ભૂમિકા

Continuous Concentration and Meditation  
Towards Most High.

જગતની ક્ષર્વેચ્ય શક્તિ પ્રત્યે એકાત્મતા  
અને ધ્યાન દ્ર્ષ્ટિ-નમસ્કાર

તાત્ત્વિક નમસ્કારનું સ્વરૂપ કલિકાલસર્વજ્ઞ ભગવાન  
શ્રી હેમચંદ્રાચાર્ય વિરાચિત “સિદ્ધહેમ શાખાનુશાસન”  
નામના ત્રથમાં બતાવેલું છે.

તે મૂળ પાઠ નીચે મુજબ છે.

અહીં

‘અહીં ઇત્યેતदક્ષરમ्, પરમેશ્વરસ્ય પરમેષ્ઠિનો વાચકમ,  
સિદ્ધચક્રસ્યાદિવીજમ्, સકલાગમોપનિષદ્ભૂતમ्,  
અશોષવિદ્ધનવિદ્ધાતનિધનમ्,  
અખિલદૃષ્ટાદૃષ્ટકલસંકલપકલ્પદ્રુમોપમમ, આશાસ્ત્રાધ્યયના—  
ધ્યાપનાવધિ પ્રણિધેયમ् ।

પ્રણિધાન’ ચાનેનાઽત્મનઃ સર્વત: સંભેદસ્તદમિધેયેન ચાભેદ:  
વયમપિચैતચ્છાસ્ત્રારમ્ભે પ્રણિદધમહે ।  
અયમેવ હિ તાત્ત્વિકો નમસ્કાર ઇતિ ॥૧॥

‘અહીં’ એ અક્ષર પરમેશ્વર એવા પરમેષ્ઠિનો વાચક છે,  
સકલ રાગાદિ ભલદ્ર્ષ્પ કલંકથી રહિત, સર્વ જીવોના ચોગ  
અને ક્ષેમને વહુન કરનારા, પ્રસન્નતાના પાત્ર, જ્યોતિસ્વરૂપ,  
દેવાધિહેવ, સર્વજ્ઞ, એવા પરમાત્મા અરિહંત દેવનો વાચક

‘अहं’ મંત્ર છે.

આ અહોનું આત્મભન, પ્રણિધાન માટે સર્વશ્રેષ્ઠ છે. તે પ્રણિધાનના એ પ્રકારો છે :—

(૧) સંલેદ પ્રણિધાન\*

(૨) અલેદ પ્રણિધાન.

**સંલેદ પ્રણિધાન :**—અહોં ઇપ વાયક પદ સાથે દ્યાતાનો સંશ્રિલષ્ટ સંબંધ તે સંલેદ પ્રણિધાન.

**અલેદ પ્રણિધાન :**—અહોં અક્ષરના અલિધીય જે પ્રથમ પરમેષ્ઠિ તેમની સાથે દ્યાતાના આત્માનો સર્વ પ્રકારે એકીભાવ અથવા ઐકચતા તે અલેદ પ્રણિધાન છે.

આવું અલેદ પ્રણિધાન જ વિદ્ધોને નિમૂળ કરવામાં સૌથી અધિક સમર્થ છે. તેથી જ તે પરમાત્મસ્વરૂપ “અહોં”ના આ અલેદ પ્રણિધાનને તાત્ત્વિક નમસ્કાર કરેવામાં આવે છે.

દૂંકમાં સંલેદ એટલે ચારે બાજુ ‘અહોં’ શાખથી આપણા આત્માને વીંટળાચેલો જેવો. અર્થોત્ પોતાના આત્માનો અહોંની મધ્યમાં ન્યાસ (સ્થાપન) કરવો.

**અલેદ એટલે પોતાના આત્માનું અરિહંત-ઇપ દ્યાન કરવું.**

---

\*સંલેદ અલેદ પ્રણિધાનનું વર્ણન યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશ વિવેચનના આધારે લખ્યું છે.

‘नमस्कारनु’ ઉપर સુજબ તાત્ત્વિક સ્વરૂપ કલિકાલ-  
સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય લગવાને ખટાંયું છે, તેનું રહસ્ય  
જ્યારે સાધના દ્વારા સમજાય છે, ત્યારે સર્વે પાપ (કર્માને)  
મૂળમાંથી જિભેડી નાખવાની અને શેષ મંગલ રૂપ આત્મ-  
સ્વરૂપ પ્રાપ્ત કરાવવાની નમસ્કારની અચિત્ય શક્તિ ઉપર  
પૂણું શ્રદ્ધા થાય છે.

સંલેદ પ્રણિધાનમાં પરમેષ્ઠિ પહોનું આલંખન હોય  
છે અને મંત્ર પહોમાં ચિત્તવૃત્તિની એકત્તાનતા સાધવાની  
હોય છે અથવા મંત્રપહો સાથે સાધકે તન્મયીલાલ સાધવાનો  
હોય છે.

‘નમસ્કાર મંત્રના જાપ અને ધ્યાન દ્વારા વિશીષ્ટ  
અનુભવો થાય છે, તેમાંના કેટલાક નીચે સુજબ છે.

નવકાર મંત્રનાં નવપહોનો જ્યારે આપણે તીવ્ર  
એકાયતાથી જાપ કરીએ છીએ અને મનમાં અધિષ્ઠિત  
પણ પરમેષ્ઠિ લગવંતો સાથે તન્મય બની જઈએ છીએ  
ત્યારે કોઈ અગ્રય પ્રદેશમાં આપણે પ્રવેશ થાય છે. આરંસ-  
માં મંત્રના અક્ષરો સંક્રેદ ચણકતા જોવા અને તેમાં  
એકાય બનવું જોઈએ અને તીવ્રપણે મંત્રના અક્ષરોમાં  
એકાય થતાં તે અક્ષરોનાં દ્વાર ખૂલી જતાં તેમાંથી નીકળતા  
અમૃતતા કુવારામાં સનાન કરતાં આપણા સધણા રોગ, શોક,  
હુખ્ય, લય, ચિત્તા નાશ થઈ જતાં હોય એવું અને સુખ,  
શાન્તિ, આનંદ અને નિર્બિયતાથી આપણે પૂણું ભરાઈ  
જતા હોઈ એ તેવું અનુભવાશે.

પરમાત્માની ભૂર્તિનું પણ આ રીતે ધ્યાન થતાં  
પરમાત્માના નેત્રમાંથી વરસતા કરેણું ભૂતના વરસાહમાં  
સ્નાન કરતાં આપણે હિંય આનંદથી છલકાઈ જઈશું.

મંત્રના અક્ષરોમાંથી નીકળતી અભિજ્ઞવાળામાં આપણાં  
ખંડાં જ પાપો, ફુલ વૃત્તિએ અને મલિન વાસનાએ।  
બળીને લસમ થતી આપણે અનુભવીશું.

મંત્રાક્ષરોમાંથી વરસતા ગુણોના વરસાહમાં સ્નાન  
કરતાં કરતાં આપણે અનેક ગુણોથી પૂર્ણ લરાઈ જઈશું.

મંત્રાક્ષરે અને પરમાત્માનાં સર્વાંગોમાંથી નીકળતા  
હિંય પ્રકાશમાં પરમાત્માના પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શાન  
થશે. અને તે પ્રકાશ જ્યારે આપણને (આપણા આત્માને)  
લેટીને પસાર થાય છે, ત્યારે તે પ્રકાશના હિંય તેજમાં  
દેહથી લિન્ન, તેવળજ્ઞાન આદિ ગુણ લક્ષ્મિથી ચુક્તા,  
અનંત આનંદસ્વરૂપ, અભ્યાબાધ સુખથી પૂર્ણ, અચિન્ત્ય  
શક્તિના લંડાર સ્વરૂપ આપણા શુદ્ધ આત્માનું  
દર્શાન થાય તેવી હિંય પણો આવશે.

પરમાત્માના પૂર્ણ પ્રકાશના આદાંબને સ્વ-  
આત્માના હિંય રવરૂપનું દર્શાન થવું તે જ સાચો.  
નમસ્કાર છે, તેને જ સાચો પુરુષાર્થ કહેવાય. તેનું  
જ જીવન ધૂન્ય છે કે જે પરમાત્માના આદાંબને  
સ્વ-આત્માનો અનુભવ કરે છે.

ધ્યા. પ્ર. ૬

તે જ મહાન આત્માચોનું જીવન ધર્ય છે, જે અરિહંત આદિ પહોના ઉપયોગમાં સહા લીન છે.

નમસ્કાર અરિહંતને, વાસિત જેહતું ચિત્ત,  
ધર્ય તેહ કૃતપુષ્ટયતે, જીવિત તાસ પવિત.

આ રીતે નવકારની આરાધનામાં પ્રગતિ સાધતાં  
આપણે સાધનામાં આગળ વધીએ છીએ. હવે નવકારની  
વિશેષ આરાધના માટેના પ્રયોગો જેઈએ.

**નવકારની સાધનાના વિશિષ્ટ પ્રયોગો:**

**ધ્યાન પ્રયોગ નં. ૧૦ :—**

નવકારની આરાધનાની ૧૨ રીતો અહીં બતાવી છે,  
જે આ જીવનમાં આત્મ-સાક્ષાત્કાર અને ભવાંતરમાં યોગ્ય  
સામચ્ચી-સંચોગ મળતાં કેવળજ્ઞાન અપાવે છે.

જિનશાસનમાં કોઈ પણ મહત્વના પ્રસંગે ૧૨ નવકાર  
ગણુવાની પરંપરા ચાલતી આવે છે. દીક્ષા લેવાનો પ્રસંગ  
હોય ત્યારે નાણું માંડવામાં આવે છે, ચતુર્મુખ લગવાનની  
ત્રણું પ્રદક્ષિણું ફરેક લગવાનની સામે એક એક નવકાર  
ગણીને કરવામાં આવે છે.

આ રીતે ઉપધાનના પ્રવેશપ્રસંગે, કોઈ બત લેતું  
હોય ત્યારે, તીર્થમાળાના પ્રસંગે આ જ રીતે ફરેક  
લગવાનની સામે એક નવકાર ગણુવાથી ચતુર્મુખ લગવાન  
સામે કુલ ચાર નવકાર એક પ્રદક્ષિણુંમાં થાય. એવી ત્રણ  
પ્રદક્ષિણામાં ૧૨ નવકાર ગણવાની પરંપરા જિનશાસનમાં

આલતી આવે છે. અહીં પણ નવકાર ગણુવાની (૧૨) આર રીતો બતાવી છે,

(૧) ત્રણ ચોગ :—

મનયોગ, વચનયોગ, કાયયોગ જોડવાપૂર્વક પ્રથમ નવકાર ગણુવો. કાયાને સ્થિર કરી, નમસ્કારમાં જોડવી. વચનથી નવકારના પહોંચું ઉચ્ચારણ કરવું. મનને જગતની ચીજેમાંથી ભરકતું પાછું વાળીને નમસ્કારના સ્મરણમાં સ્થિર કરવું.

(૨) ત્રણ કરણ :—

A              B              C

કરણ, કરાવણ, અનુમોદન.

A કરણ એટલે ઉપર મુજબ મનયોગ, વચનયોગ, કાયયોગ જોડીને કરવું.

B કરાવણ એટલે મને આવો જગતનો સર્વોત્તમ મહામંત્ર શ્રી નવકાર મહ્યો, તે નવકાર સર્વને મળો. જગતના અનંત જીવોને નમસ્કાર મંત્ર-પંચ પરમેષ્ઠિ મંત્ર, પ્રભુનું શાસન મહ્યું નથી તે સર્વને મળો તેવી ભાવના — તે કરાવણ.

C અનુમોદન, ત્રણ ભુવનમાં ત્રણે કાળ અસંખ્ય આત્માએ પરમેષ્ઠિ નમસ્કારની આરાધના કરતા હોય છે, તે સર્વનું અનુમોદન કરવું. ત્રણ કરણમાં જગતના સર્વ જીવ સાથે અનુસંધાન થાય છે. જેને મહ્યો છે તેનું અનુમોદન, નથી મહ્યો તેને મળો તેવી ભાવના, તેમાં સમય વિશ્વના

લુવોનો સંધાર થાય છે. મૈચ્યાદિ લાવેથી લાવિત થવું  
તે ધ્યાનના અનુસંધાન માટેનું પરમ રસાયણ છે.

મૈત્રીગ્રમોદકારુણ્ય-માધ્યસ્થયાનિ નિયોજયેત् ।  
ધર્મધ્યાનમુપસ્કર્તું, તર્દ્ધિ તસ્ય રસાયનમ્ ॥

( યોગશાખ યોગો પ્રકાશ )

મૈત્રી, પ્રમેદ, કરુણા, માધ્યસ્થય આ ચાર લાવનાયો  
આત્માની સાથે પ્રયોજવી, કેમ કે આ લાવનાયો ધ્યાનને  
રસાયણુની માફક પુષ્ટ કરે છે.

(૩) દ્વારો પ્રાણુ જોડવાપૂર્વક નમસ્કાર કરવો :—

આપણા દ્વારો પ્રાણુ જગતની અન્ય વસ્તુઓમાં જોડા-  
યેલા છે, ત્યાંથી છોડવી, દ્વારો પ્રાણુ પરમેષ્ઠિ નમસ્કારમાં  
જોડવા. પાંચ ધનિદ્રયો, મનબળ, વચનબળ, કાયબળ,  
શ્વાસોધ્યાસ અને આચુષ્ય આ દ્વારા પ્રાણુ છે.

નમસ્કાર વખતે પાંચ ધનિદ્રયોના ઉત્કૃષ્ટ પ્રશરત  
વિષયનો અનુભવ કરવો.

અરિહંત પરમાત્માની વાણી પાંત્રીસ શુણુથી ચુક્તા  
હોય છે. લગવાન સુમધુર માલકોષ રાગમાં સમવસરણુની  
મધ્યમાં એસીને દેશના આપે છે. પ્રલુની દેશનાના શરીરમાં  
ઓત્રેનિદ્રયને જોડવી. સિદ્ધ લગવંતોના મહાસૌન્દર્યથી લર-  
પૂર જીતિસ્વરૂપ અફ્લુત-અરૂપી એવા રૂપને નિહાળવામાં  
નેત્રેનિદ્રયને જોડવી. આચાર્ય લગવંતોના શીલની સુગંધમાં  
દ્વારોનિદ્રયને જોડવી. ઉપાધ્યાય લગવંતોના સ્વાધ્યાયના.

સુમધુર રસમાં રસનેન્દ્રિયને જોડવી. સાધુ લગવાતોના અતિ મધુર શાન્ત આપનાર સ્પર્શમાં સ્પર્શોન્દ્રિયને જોડવી.

ઉપરના પાંચ સવોત્તમ વિષયમાં પાંચે ઇન્દ્રિયો જોડાઈ જવી જોઈએ. મનબળ, વચનબળ, કાયબળને નમસ્કારમાં વિશેષ સ્થિરતાવાળું ખનાવવું. શાસોચ્છવાસને પણ તેમાં જ વણી લેવો. અને આચુષ્યબળના અતીક રૂપે હૃદ્યના બબડારામાં નમસ્કારને વણી લેવો. આ રીતે દ્વારા પ્રાણું નમસ્કારમાં જોડવા.

(૪) સાત ધાતુ જોડાય તે રીતે નમસ્કાર કરવો :—

“રંગ લાગ્યો સાતે ધાત પ્રલુષું રંગ લાગ્યો”

નમસ્કારના સ્મરણું વખતે સાતે ધાતુ પ્રલુસ્મરણુમાં જોડાઈ જવી જોઈએ. “અહો ! હું ધન્ય છું, હૃતપુષ્ટય છું કે આજે મને ભવચકમાં અતિ હુર્દાલ એવો નમસ્કાર મંત્ર સ્મરણું કરવા માટે મળ્યો છે ! કલ્પવૃક્ષ, ચિતામણિ અને કામધેનુ કરતાં પણ અતિ પ્રલાવશાળી પરમેષ્ઠિ પદોના સ્મરણુમાં હે પ્રાણ ! હે મન ! હે મારા શરીરની સાતે થાતુઓ ! તેમાં જોડાઈ જાઓ. આજે અનંતકાળનું હુઃખ-ફારિદ્ય અને હૌલીંગનાશ કરવાનો અવસર મળ્યો છે. આજે સુખ, શાન્તિ, આનંદ અને નિર્ભયતા તથા આત્મઅનુભવ પ્રાપ્ત કરવા પરમેષ્ઠિઓનો અતિ ઝીમતી યોગ મળ્યો છે. તો તમે સર્વ સાવધાન થઈ નમસ્કારમાં રક્ત બનો. આવી કોઈ વિશિષ્ટ ભાવનાં શરૂઆતમાં કરી લેવી, જેથી હિંદુસિંહ થયેદી સાતે ધાતુ નમસ્કારમાં જોડાઈ જાય.”

(૫) સાડાત્રણુ કરેડ રોમરાળુ વિકસવર થવાપૂર્વક નમસ્કાર કરવો :—

મયણુસુંહરીને અમૃતકિયા વખતે રોમાંચ થયો છે. અતિશાય આશ્ર્ય, સંભ્રમ, અહોભાવ, અતિ બહુમાન અને અત્યંત આદર જ્યારે થાય છે, ત્યારે “રોમાંચ” થાય છે. અને તે અમૃતકિયાનું લક્ષણુ છે. આંધળાને ચક્ષુની પ્રાપ્તિ થાય છે. નિર્ધાર મનુષ્યને નિધાનની પ્રાપ્તિ થાય છે, જન્મથી મહારોગીને આરોગ્યની પ્રાપ્તિ થાય છે, ત્યારે જેવું આશ્ર્ય, અહોભાવ અને આનંદ થાય તેવું આશ્ર્ય અહોભાવ અને આનંદ, પરમેષ્ઠિ લગવંતોના નમસ્કાર વખતે થાય છે અને ત્યારે હર્ષથી સમચ રોમરાળુ વિકસવર થાય છે.

આપણુને પરમ ઈષ્ટ કલ્પવૃક્ષ કે ચિત્તામણિ સમાન વસ્તુ મળે ત્યારે રોમાંચ અને વિસમય થાય છે, તે રીતે પરમ ઈષ્ટ નવકાર પ્રાપ્ત થવાથી રોમરાળુ વિકસવર થઈ જય ત્યારે પ્રત્યેક રોમ નવકારને ચોકારે છે, તેવો ભાવ ધારણ કરવો. નવકાર ગણ્ણાય છે એક વખત, પરંતુ પ્રત્યેક રોમમાં વ્યાપક તેની અસર હોવાથી ફળ મળે છે સાડાત્રણુ કરેડ વખત ગણ્ણવાનું.

(૬) આત્માના અસંજ્ય પ્રદેશો નવકારમાં લીન અન્યા છે, નવકાર આપણા આત્માના પ્રદેશો-પ્રદેશો જ્યાપત અની ગયો છે તેવો ભાવ ધારણ કરવો. આવા ભાવથી નવકાર ગણ્ણાશે એક વખત પણ આત્માના પ્રત્યેક પ્રદેશો

તે વ્યાપ્ત હોવાથી ઝળ મળશે અસંગ્રહ વખત ગણુવાનું, કારણ કે અસંગ્રહ વખત ગણ્ણાય તેટલી વિશુદ્ધિ તે વખતે થાય છે.

(૭) અહીંથી હવે અક્ષર અનક્ષર રૂપ ધારણ કરશે. ઉથી ૧૨ સુધીના નમસ્કારમાં નીચે મુજબ ભાવ આવશે :

નમનું એટલે પરિણમનું. પરિણમનું એટલે તત્ત્વ સ્વરૂપ બનનું, તદાકાર, ઉપયોગે પરિણમનું, તત્ત્વ સ્વરૂપ બનનું એટલે તે રૂપ હોવાનો અનુભવ કરવો. અને છેવટે તરૂપ બનનું એટલે તે રૂપ થઈને રહેનું. અહીં પાંચે પરમેષ્ઠિઓને અરિહંત પ્રલુભમાં સંગાવી લેવા.

આપણા આત્માના ક્ષયોપશમ ભાવના જે ગુણો, જ્ઞાન, દર્શાન, ચારિત્ર, વીર્ય આહિ અસુક અંશે ખુલ્લા છે. તે અત્યારે વિલાવમાં પડેલા છે. પરપુદ્ગલ અનુયાયી અનેલા છે. તે ક્ષયોપશમ ભાવના ગુણોને પરમાત્મ-સ્વરૂપના અનુયાયી બનાવીને છેવટે આત્મસ્વરૂપના અનુયાયી બનાવવા.

એટલે પ્રથમ પરમાત્મ-સ્વરૂપના અવલંબનવાળું આપણું ચૈતન્ય બનાવવાનું છે. પરમાત્મ-સ્વરૂપ અનુયાયી આપણી ચેતના બનાવવાની છે. પરપુદ્ગલના રંગે રંગાયેલી આપણી ચેતનાને પરમાત્મગુણોના રંગે રંગાયેલી બનાવવાની છે. તેની પ્રક્રિયા ઉમા નવકારથી શરૂ થાય છે.

સાતમે નમસ્કાર ક્ષયોપશમ ભાવથી અંશાતઃ ખુલ્લા થયેલા આપણા જ્ઞાન અને દર્શાનગુણુને પરમાત્મસ્વરૂપમાં

નેડવાપૂર્વક કરવાનો છે. જાનગુણુનું કાર્ય “જાણવાનું” છે. દર્શનગુણુનું કાર્ય “દુચિ” કરવાનું છે. તે જાન-દર્શન બંને ગુણોને પરમ વિશુદ્ધ પરમાત્મતત્વમાં નેડવા. પરમાત્માના અનંત ઉપકારો અને પરમાત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપને જાણી તેમાં જ દુચિ કરવી. તેમાં જ અભિજ્ઞાન પ્રકર્ષપૂર્વક ગ્રેમ કરવો.

(૮) ક્ષયોપશમ લાવથી અંશતઃ ખુલ્લા થયેલા આપણું ચારિત્રગુણુને પરમાત્મસ્વરૂપમાં નેડવાપૂર્વક આઠમો નમસ્કાર કરવો. ચારિત્રગુણુનું કાર્ય રમણુતા કરવાનું છે. અત્યારે રમણુતા પરમુદ્ગલમાં એટલે કે વિલાલમાં છે, ત્યાંથી છોડાવી સ્વભાવમાં સ્થિર એવા પરમાત્મ-સ્વરૂપમાં આપણે રમણુતા કરવાની છે. રમણુતા કરવાની શક્તિને (ચારિત્રગુણુને) પરમાત્મામાં નેડવી, એટલે પરમાત્માના ગુણો-પરમાત્માના ઉપકારો, પરમાત્માના પરમનિશ્ચ કેવળ-જાન, પરમાનંદ, અંયાભાધ સુખ, અચિંત્ય શક્તિ આદિમાં રમણુતા કરવી તે આઠમો નમસ્કાર છે.

(૯) આત્મા અનંત શક્તિનો ધણી છે. તેમાંનો કેટલોક સાગ ક્ષયોપશમ લાવથી અત્યારે ખુલ્લો છે. તે ક્ષયોપશમ લાવની શક્તિને પરમાત્મતત્વમાં રમણુતા, તદ્દૂ-પતા, તન્મયતાના કાર્યમાં ફોરવવી, એટલે આપણી સંપૂર્ણ શક્તિને પરમાત્મતત્વ સાથે તન્મય, તદ્દૂપ બનાવવી, તે નવમો નમસ્કાર છે. ઉપરોગને પરમાત્મ આકારે પરિણમાવવો. (In tune with infinite.) જે રીતે સાકર, હૃધમાં

નાભવાથી ઓગળી જાય છે, તે રીતે મનને પરમાત્માના સ્વરૂપમાં ઓગળી નાખવું. To harmonise our Self with Divine Power.

કહ્યું છે કે :—

“ દર્શાન શાનાદિક ગુણ આત્મના રે.

પ્રભુ પ્રભુતા લયદીન,  
શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી રે,  
તસુ આસ્વાદન પીન ”  
( પીન એટલે પુણ )

— ‘શ્રી હેવચંડજી કૃત ૧૨મા અગવાનતુ’ સ્તવન.

૭-૮-૬ આ ગુણ નમસ્કારમાં આપણું ચેતન્ય પરમાત્માના સ્વરૂપમાં તન્મય, તદ્ગૂપ બન્યું છે. આપણું ચેતન્ય સંપૂર્ણપણે પરમાત્માના સ્વરૂપમાં લીન, તદ્ગૂપ, પરમાત્મ-સ્વરૂપને અવલાભેલું બને, ત્યાં સુધી ૭-૮-૬માં કહ્યા મુજબની આરાધના કરવી.

અહીં સાધકની પરિણુતિ આ પ્રમાણે છે. આત્માના ક્ષયોપશમ ભાવના દર્શાન, શાન, ચારિત્ર અને વીર્ય ગુણું તે સર્વ પ્રભુની પ્રભુતાથી લીન થયા છે. ખડુમાન અરિહંતનું છે. રુચિ અરિહંત પ્રભુના અનંત ગુણું-સ્વરૂપમાં છે. ઉપ-ચોગ અરિહંતના સ્વરૂપમાં લીન છે. રમણુતા પરમાત્માના સ્વરૂપમાં જ છે, વીર્યશક્તિ-જિનલક્ષ્મિને વિષે જ કાર્યશીલ છે. અહીં ક્ષયોપશમ ભાવની આત્મગુણની સર્વ પ્રવૃત્તિ અરિહંત પરમાત્માના ગુણોને વિષે તન્મયપણું પામી છે.

(૧૦) સુવિધિનાથ લગ્વાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજા કહે છે કે :—

ક્ષાયોપશમિક ગુણુ સર્વ થયા તુજ ગુણુ રસી,  
સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલ્લસી.”

અહીં સુધી અરિહંત આકાર ઉપયોગ હતો. હવે ઉપયોગ આકાર આત્મામાં પ્રવેશ થાય છે.

પરમાત્મ ઉપયોગમાં સંપૂર્ણ લીનતા આવવાથી પરમાત્મા સાચે એકત્વ-અલેટ ધ્યાન અહીં શરૂ થયું છે.

“ શુદ્ધ તત્ત્વ રસ રંગી ચેતના રે,  
પામે આત્મ સ્વભાવ;  
આત્માલાંખી નિજ ગુણુ સાધતો રે,  
પ્રગટે પૂજ્ય સ્વભાવ.”

( શ્રી દેવચંદ્રજી કૃત ૧૨ મા લગ્વાનતું સ્તવન)

હવે અત્યારે આપણો આત્મા અરિહંત આકારવાળો અન્યો છે, કારણુ કે જે ઉપયોગમાં આપણે સ્થિર બનીએ છીએ, તે આકારવાળો આપણો આત્મા થાય છે.\*

અત્યારે આપણો ઉપયોગ પરમાત્મ આકારમાં સ્થિરતાને પામેદો છે, તે પરમાત્મ આકારવાળા બનેલા આપણુ આત્માને આપણુ જોઈએ છીએ. પરમાત્માના ઉપયોગમાં પરિણમેલા એટલે વિશુદ્ધ આત્મચૈતન્યમાં લીન બનેલા.

\* ઉપયોગથી ઉપયોગવાન આત્મા અલિન્ન (એક) છે.

આપણા આત્માને આપણે જોઈ એ છીએ અને જાણું એ  
છીએ, તે દર્શાનાના ઉપયોગપૂર્વક ૧૦માં નમસ્કાર થયો।

(૧૧) ચારિત્ર એટલે આત્મરમણુતાપૂર્વક ૧૧ મેં  
નમસ્કાર છે. પરમાત્મા વિશુદ્ધ આત્મચૈતન્ય સ્વરૂપ છે.  
અને આપણા આત્મા તદાકાર રૂપે તેમાં પરિણિમલો છે,  
એટલે કે આપણા આત્મા વિશુદ્ધ આત્મચૈતન્ય રૂપે પરિ-  
ણિમલો છે, તેમાં ચારિદ્યગુણ જોડવાથી આત્મરમણુતા હવે  
હવે શરૂ થઈ છે. ઉપર સુજાપ પરમાત્માના અને ઉપલક્ષણુથી  
આપણા આત્મસ્વરૂપમાં રમણુતાપૂર્વક ૧૧ મેં નમસ્કાર થયો।

(૧૨) વીર્યગુણ જેટલા અંશો ખુલ્લો છે તે ક્ષાયોપ-  
શમભાવી વીર્ય દર્શાન-શાન-ચારિત્ર ગુણને સહકારી બને  
છે અને તેનાથી સ્વરૂપ સ્થિરત્વની શક્તિ પ્રાપ્ત થાય છે.

“ ક્ષાયોપશમિક ગુણ સર્વ થયા તુજ ગુણ રસી,  
સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલ્લંસી। ”

વીર્યગુણ ( દર્શાન, શાન, ચારિત્રને સહકારી બનવાથી) આત્મસત્તામાં રમણુતા-તન્મયતા - તર્દ્દેપતા અને એકત્વતા માટેની શક્તિ વ્યક્ત કરે છે. અહીં આત્મસ્વરૂપમાં રમ-  
ણુતા, તન્મયતા, સ્થિરતા આવે છે. તે સ્થિરતા અંતર્મૂહૂર્ત  
ટકે તો ક્ષપળુશ્રેષ્ઠી મંડાઈ કેવળશાન થાય. તેથી કહ્યું કે,

“ હવે સંપૂરણ સિદ્ધિ તરણી શી વાર છે,  
દેવચંદ્ર જિનરાજ જગત આધાર છે.”

આ વસ્તુ પૂજય શ્રી દેવચંદ્રજી મહારાજના પોતાના

કાખેલ ટખામાં આ રીતે છે : “ એમ શુદ્ધ નિર્મલ તત્ત્વ શ્રી અરિહંતદેવ સિદ્ધ ભગવાન તેના રસે (સાધકની ચેતના) રંગાણી તેહના ગુણુની લોળી જે મારે (સાધકની) ચેતના-મથી અન્ય વિકલ્પ ટાળી અનુભવ ભાવના સહિત પ્રભુ સ્વરૂપે (સાધકની ચેતના) રસીલી થઈ તે વારે તે ચેતના, પોતાના આત્મસ્વભાવને પામે. આત્મસ્વભાવ રૂપિ (સમ્યગુ દર્શન) આત્મસ્વભાવ ઉપયોગી (સમ્યગુ જ્ઞાન) આત્મસ્વભાવ રમણી (સમ્યગુ ચારિત્ર) આત્મા અનુભવી થાય..... એટલે પહેલા હું (પરમાત્મા જેવો જ) અનંત ગુણી છું એ નિર્ધારદ્વષ્પ સમ્યગુ દર્શન પ્રકાશો, સ્થાદ્વાર સત્તાનુભાસન (જ્ઞાન) થાય, પછી જે સત્તા પ્રગટી તેહનો (તેમાં) રમણ અનુભવ ચારિત્ર ગુણ પ્રગટે, પછી નિરાબરણ કેવળજ્ઞાન નીપણે (પ્રગટે) એ પરમ મૂળય શ્રી અરિહંતને પૂજાથી ચોતાનો પૂજય સ્વભાવ પ્રગટે.

“ ( જિન્દર પૂજ રે તે નિજ પૂજના રે ) ”

નવકારની સાધનાની ૧૨ રીતો આપણે જોઈ.

એક પછી એક ચઢતી ભૂમિકાની આરાધના આપણા જીવનમાં વિકસિત થતી જાય તેવા સંકલ્પપૂર્વક આગળ વધવું. પરમાત્મા આપણને જરૂર સહાય કરશે. પરમાત્મા તો કલ્પવૃક્ષ છે. તેમનાં ચરણ કમળમાં કરેલ શુલ સંકલ્પ અવશ્ય ફળદાયી બને છે.

કેટલુંક વધુ તત્ત્વજ્ઞાન જોઈશું એટલે નવકારની

આચિત્ય શક્તિ ઉપર આપણુંને પૂર્ણ શ્રદ્ધા અને સાધનાં દ્વારા અનુભવ પણ થશે.

નમો = About turn पાછા ઇસ્વું. (હન્યવી વસ્તુ સંખ્યાંધના વિચારમાંથી).

અરિહંતાણું = Turning towards the Divinity—

હન્યવી વસ્તુએ સંખ્યાંથી વિચારમાંથી પરમાત્મા તરફના પ્રયાણને મંત્ર છે : ‘નમો અરિહંતાણું’?

Namo is the turning point from वિભાગ to સ્વભાગ. Namo is the turning point from subconscious to superconscious.

આપણા ચૈતન્યને પરદ્રષ્ટય (પુષ્ટગલ દ્રોષ)ના સંખ્યાંધનાંથી છોડાવવાની અને આત્મ-સ્વરૂપમાં સ્થિર કરવાની પ્રક્રિયા ‘નમો અરિહંતાણું’ના ધ્યાનમાં છે.

નમવું = પરિણમવું.

પરિણમવું = તત્ સ્વરૂપ બનવું, (તદાકાર ઉપયોગે પરિણમવું.)

તત્ સ્વરૂપ બનવું = તે રૂપ હોવાનો અનુભવ કરવો, અને છેવટે તે રૂપ થઈને સ્થિર રહેવું:

પરમાનંદને અનુભવવાની પ્રક્રિયા નમસ્કાર લાવમાં છે. પરમાત્માના ધ્યાન દ્વારા પરમાત્માની પૂર્ણતાનો દિવ્ય પ્રકાશ આપણા અંતરાયાત્મામાં જીવી શકાય છે, અને તે દ્વારા આત્મસ્વરૂપના અનુભવરૂપ રત્નતરયીમાં રમણુતા

અને તત્ત્વત્રથીનો ત્રિવેણીસંગમ પ્રાપ્ત થાય છે અને તેના પરમાનંદનું અનુસવન સર્વ સિદ્ધિઓને પ્રાપ્ત કરાવે છે.

નમો એટલે પરરૂપેણ નાસ્તિત્વ.

અરિહંતાણું એટલે સ્વરૂપેણ અસ્તિત્વ.

નમો એટલે વિલાવમાંથી છૂટવું.

અરિહંતાણું એટલે સ્વભાવમાં સ્થિર થવું.

નમો એટલે પરભાવનું વિસમરણું.

અરિહંતાણું એટલે સ્વભાવમાં રમણું.

નમો એટલે અહિરાત્મલાવનો ત્યાગ.

અરિહંતાણું એટલે અંતરાત્મલાવ દ્વારા પરમાત્મલાવનો અનુલબ્ધ.

નમો એટલે અહંકારનો નાશ End of Egoism.

અરિહંતાણું એટલે નમસ્કારની પરાકાષ્ઠા.

નમો એટલે સંસારની અસારતાની કણૂલાત.

અરિહંતાણું એટલે મોક્ષ જ સાર છે, તેવી સલાનતા.

નમો એટલે જડ-ચૈતન્યનું લેદ વિજ્ઞાન.

અરિહંતાણું એટલે ચૈતન્યને સારભૂત સમજ તેમાં સ્થિર થવાની પ્રક્રિયા.

નમો એટલે પરિધમાંથી (circumference) એટલે કે સંસારના વિચારેમાંથી છૂટવું.

અરિહંતાણું એટલે મધ્યબિન્હ center (આતમા)માં  
સ્થિર થશું.

નમો = approach (પ્રવાણ).

અરિહંતાણું = towards absoluteness (પૂર્ણતા  
તરફ.)

નમો = Direction (લક્ષ્ય કેન્દ્રિત કરવું.)

સિદ્ધાણું = towards destination (ધ્યેય તરફ.)

આ ખંને પહોના ધ્યાન દ્વારા પરમાત્મા સાથે એકત્વ (oneness with Immortality) સધાય છે. માટે નમસ્કાર મંત્રના નમસ્કાર્ય શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ ભગવંતોમાં વૃત્તિઓને વિલીન કરવાથી, અર્થાત્ જેવી રીતે સાકરને હૃધમાં નાખવાથી, તે હૃધમાં ઓગળી એક-મેક થઈ જય છે, તે રીતે મનને પરમાત્મામાં ઓગળી નાખવાથી પરમાત્મામાં (જે ઉપલક્ષણુથી આપણું પોતાનું જ સ્વરૂપ છે) એટલે આત્મામાં મન તદ્દાકાર રૂપે પરિ-ખુમબાથી શાખત, સિદ્ધ, ઝુદ્ધ, નિરંજન, નિષ્કલંક, શુદ્ધ, ચિદાનંદધન, ચેતન સ્વરૂપ, અનંત અવ્યાખાધ સુખ સ્વરૂપ, અનગર્ભ આનંદના દિવ્ય લંડારસ્વરૂપ આત્મસ્વરૂપમાં તનમયતા, તક્ષુપતા, એકત્વ અને સ્થિરતા રૂપ મહાન સિદ્ધિનું ઇળ પ્રાપ્ત થાય છે, અને ત્યારે જ આત્મઅનુભવ દ્વારા પરમાનંદનો આસ્ત્વાદ મળે છે.

નમો અરિહંતાણું is the Master Key to enter

the boundless ocean of joy within our Divine self. ‘નમો અરિહંતાણુ’ આપણા આત્મામાં રહેલા અમર્યાદ આનંદના મહાસાગરમાં પ્રવેશ કરવાનું પરમક્ષાર છે, ‘નમો અરિહંતાણુ’ પરમતત્ત્વના અનુભવ માટેનું મહૂન સૂત્ર છે.

નમસ્કાર મહામંત્રની આરાધનાનો વિષય સરળ પણ છે અને અતિગછુન પણ છે. નમસ્કાર મંત્રના જાપની સાધનામાંથી ધ્યાન દ્વારા નમસ્કાર મંત્ર આત્માના અનુભવ સુધી કેવી રીતે લઈ જય છે તે આપણે જેયું: પોતાની ભૂમિકા અનુસાર સાધકે આગળ વધવા પ્રયત્ન કરવો.

આ વિષયમાં વધુ જાળવાની લુણાસાવાળા સુમલુણ આત્માચોચે શ્રી નમસ્કાર મહામંત્રના પરમ સાધક અધ્યાત્મ ચોગી પૂજય પંન્યાસળ અદ્રંકરવિજ્ઞયજી મહારાજનું લખેલું સાહિત્ય આસ વાંચ્યાનું. આ મહાપુરુષના સાનિધ્ય દરમ્યાન નમસ્કાર વિષયક જે તાત્ત્વિક વિચારશૈખું પ્રાપ્ત થયેલી તે પણ “જીવનની સર્વાંગે કળા શ્રી નવકાર લેખક આણુભાઈ કર્ણીવાળા” પુસ્તક રૂપે બહાર પડેલ છે.

નમસ્કાર મંત્ર વિષયક કે વિશિષ્ટ વિચારણા આ પુસ્તકમાં કરવામાં આવી છે તેમાંના કેટલાક સુદૂર નીચે મુજબ છે.

**નમરકાર મંત્રનું ધ્યાન - પ્રયોગાત્મક અભ્યાસ**

(૧) ગ્રાથમિક ભૂમિકા :—આસન અને સુદ્રા દિશા, માળા, સંખ્યા અને સમય આ વિષયમાં લક્ષ આપી નિયમિત નમસ્કાર મંત્રનો જપ કરવો.

(૨) ધ્યાનાલ્યાસની રીત :—નવકારના અક્ષરો છાપેલું કાડું વાંચવું.

આંખ બંધ કરીને અક્ષરો જેવા પ્રયત્ન કરવો,

આંખ બંધ કરીને ‘નમો અરિહંતાણુ’ એવા અક્ષરોનેવા માટે ચાંદીના ઝોખામાં હીરા સેટ કરવા માનસિક પ્રયોગ કરવો.

અષ્ટદશ કમલમાં નવકારના અક્ષરો જેવા પૂર્વક જાપ અને ધ્યાન કરવું.

(૩) ધ્યાન અને સંવેદન :—

A પ્રણિધ્યાન પૂર્વક લાવના કરવી.

B મંત્રાક્ષરોને સંશોધ ચણકતા જેવા અને તેમાં એકાચ બનવું.

C મંત્રાક્ષરોના કાર ખુદી જતાં તેમાંથી નીકળતા અમૃતના કુવારામાં સ્નાન કરવું.

D મંત્રાક્ષરોમાંથી નીકળતી અજિનજવાળામાં પાપ વૃત્તિઓનું ફરજન.

E મંત્રાક્ષરોમાંથી વરસતા ગુણોના વરસાદમાં ઉત્તમ ગુણોથી ભરાઈ જવું.

F મંત્રાક્ષરોના દિવ્ય પ્રકાશમાં આત્મહર્ષનની દિવ્ય પ્રોણોનો અનુલબ કરવો.

(૪) નવકારની ધ્યાન સાધનના વિશિષ્ટ પ્રયોગો.

ધ્યા. પ્ર. ૭

- (i) ત્રણુ ચોગ જોડવા પૂર્વક.
- (ii) ત્રણુ કરણુ સહિત.
- (iii) દશ પ્રાણુ જોડવા પૂર્વક.
- (iv) સાત ધાતુ જોડાઈ જવા પૂર્વક.
- (v) સાડા ત્રણુ કોડ રોમરાળુ વિકસવર થવા પૂર્વક.
- (vi) આત્માના અસંખ્ય પ્રદેશો નવકારમાં લીન થવા પૂર્વક.
- (vii) ધ્યાનાભ્યાસ :—અરિહંત આકાર ઉપયોગ.  
ક્ષયોપશમ ભાવથી અંશતઃ ખુલ્લા થયેતા જીન દર્શન ગુણુને પરમાત્મામાં જોડવા પૂર્વક.
- (viii) ચારિત્ર ગુણુને પરમાત્મામાં જોડવા પૂર્વક.  
( પરમાત્મ સ્વરૂપમાં રમણુતા.)
- (ix) ક્ષયોપશમ ભાવી અંશતઃ ખુલ્લી આત્મશક્તિનું પરમાત્મામાં સ્થિર કરવા પૂર્વક.
- (x) ઉપયોગ આકાર આત્મા.  
જીનાપયોગ, દર્શનોપયોગ આત્મસ્વરૂપમાં લીન.
- (xi) આત્મ સ્વરૂપમાં રમણુતાનું ધ્યાન.  
આત્મ સ્વરૂપમાં વિર્યસ્કૃરણું પૂર્વકનું ધ્યાન.
- (xii) આત્મ સાક્ષાત્કારનો હિંય અનુભવ.  
નમસ્કાર મંત્રના ઉપકાર અને શક્તિઓનું ચિંતન.

અયોગ નં. ૧૧ :—

સાધનામાં આવતાં વિધનો શાંત કરવા માટેનો  
અયોગ :—

(૧) આઠ પાંખડીવાળા કમળની ચિંતવના કરવી.

(૨) કમળની કણ્ઠિકામાં સૂર્યના તેજ સ્વરૂપ પોતાના  
આમાને સ્થાપન કરવો.

(૩) આઠ પાંખડીઓમાં કેમશા: ઊં નમો અરિ-  
હંતાણું.

આ આઠ અક્ષરો સ્થાપન કરવા. આઠ દિવસ સુધી  
આ પ્રમાણે સ્થાપન કરી નીચે મુજબ વિધિ કરવી.

(૪) પ્રથમ દિવસે ઊં લખેલું છે તે પાંખડી તરફ  
લક્ષ રાખી ઊં નમો અરિહંતાણુંનો ૧૧૦૦ વખત જાપ કરવો.

(૫) બીજી દિવસે મો લખેલું છે તે પાંખડી તરફ  
લક્ષ રાખી ઊં નમો અરિહંતાણુંનો ૧૧૦૦ વખત જાપ કરવો.

(૬) તે પ્રમાણે આઠ દિવસ સુધી એક એક પાંખડી  
તરફ લક્ષ રાખી દરરોજ ૧૧૦૦ વખત જાપ કરવો.

(૭) ધ્યાન સ્થિર કરી મંત્રનાં અધિકૃતા અરિહંત  
પરમાત્માની મહા મંગલકરી વિધન વિનાશક શક્તિ ઉપર  
પૂર્ણ શ્રદ્ધા રાખી ધ્યાન પૂર્વક જાપ કરવો.

(૮) આ ધ્યાન પૂર્વકના જાપથી સાધનામાં આવતા  
વિધનો નાશ પામે છે.

(૬) જપ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્મામાં ધ્યાન સ્થિર રાખી જપ કરવો. જપ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની ઉપસ્થિતિ કાર્ય-કુસદ્ધિનું પ્રધાન અંગ છે.

### શ્રી નમસ્કાર મંત્રની અચિંત્ય શક્તિએ

Economically Effective-Shree NAMASKAR  
Maha Mantra.

અર્થશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક

શ્રી નમસ્કાર મહામંત્ર.

Constitutionally Correct.

જાધારણુની દષ્ટિએ શાખત સત્ય.

Politically perfect.

રાજકીય દષ્ટિભિંડુમાં સર્વોત્કૃષ્ટતા.

Mathematically Mature

ગણિતશાસ્ત્રની દષ્ટિએ ઉત્કૃષ્ટ શ્રી નવકાર.

Psychologically Sensitive.

માનસશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક.

Astrologically Assured.

જ્યોતિષશાસ્ત્રની દષ્ટિએ વાસ્તવિક સત્ય શ્રી નવકાર.

Geographically Genuine.

લોગોલિક દષ્ટિએ સર્વોચ્ચ-શ્રી નમસ્કાર મહામંત્ર.

Science of Supremacy.

આત્મવિજ્ઞાનનો પ્રયોગ.

Computer of Cosmic Communion Shree NAVKAR.

વિશ્વ સાથે સમત્વયોગ સાધવાની મહાન પ્રક્રિયા  
૩૫ શ્રી નવકાર.

Art of life - NAMASKAR.

નમસ્કાર એ જીવનની કળા છે.

Foundation of Faith-Shree Namaskar.

શ્રદ્ધાનો પાયો-શ્રી નમસ્કાર મહામંત્ર.

Fulfilment of Faith.

શ્રદ્ધાની સરવાણી-શ્રી નવકાર.

Creator of Charactership.

ચારિત્રગુણનો સર્જક-શ્રી નવકાર.

Produces of Peace.

શાંતિપ્રદાયક-નમસ્કાર મહામંત્ર.

International Prayer-Shree Navakar,

સકಲ વિશ્વને માન્ય મંત્ર-શ્રી નવકાર.

Turning point from Sub-conscious  
to Super-conscious.

વિભાવમાંથી સ્વભાવમાં જવાની પ્રક્રિયા 'નમો' પદમાં છે.

Generator of Joy-Shree Namaskar Mantra.

આનંદનો ઉત્પાદક-નમસ્કાર મંત્ર.

Master Key to enter in to the boundless  
Ocean of Joy-within our Divine self.

'નમો અરિહંતાણ'-પરમાત્માનંદમાં પ્રવેશનું પરમદ્વાર.

Direct Discipline towards Divinity.

“ सर्वोत्तम शिष्टत ”—श्री नवकार.

Divine Song of Soul—Shree NAVAKAR.

आत्मानुं छिंय संगीत—श्री नवकार.

Direct dialling to Divinity.

परमात्मा साथे सीधी वातचीत करवानी कणा तमै  
अरिहंताणुंभां छे.

Hot line to Parmatma Shree NAVAKAR.

परमात्मा साथेना ज्ञेयाणी प्रक्षिया स्वरूप श्री नवकार.

Supramental Seminar of Supreme Authorities  
—Shree Navakar and Navpad.

विश्वनी सर्वोत्कृष्ट शक्तिओनो लांडार-नवकार अने  
नवपद्मो.

Intellectually Appealing.

भुज्जिने संतोष आपनार—श्री नवकार.

Surrender to Supremacy—NAMASKAR  
MANTRA.

सर्वोक्त्यनी शरण्यागति—नमस्कारमंत्र.

End of Anxiety.

चिंताचूरक—श्री नवकार.

Dissolution of Difficulties,

हुःअविनाशक—श्री नवकार.

Supermost Art and Secret of Cosmos.

વિશ્વની સરોતકૃષ્ટ કળા અને સિદ્ધિઓનું  
ગુપ્ત રહસ્ય નમસ્કાર ભાવમાં છે.

A Key to Cosmic Secret—NAMASKAR.

આત્માના શુદ્ધ લંડારની ચાવી નમસ્કાર છે.

‘NAMO’ is entering in to Abundant energy.

અચિંત્ય શક્તિના વિધાનનું પ્રવેશદ્વાર નમસ્કાર  
ભાવ છે.

Higher Mathematics.

સરોવર ગણ્યુત-શ્રી નવકાર.

A Key to Radiant-Success-Shree Navkar.

નવલાંત સર્કણતાની ચાવી-શ્રી નવકાર.

Royal Road to Self-Realisation.

આત્મસાક્ષાત્કારનો રાજમાર્ગ,

Scientifically Secured-Shree NAVAKAR.

and NAVPAD.

નવકાર અને નવપદો એ વિશ્વ ઉપરનું સ્વયં

સિદ્ધ, સરોતકૃષ્ટ મહાવિજ્ઞાન છે.

Cosmic Dynamo of Self-Realisation.

આત્મસાક્ષાત્કારની અનુભવસિદ્ધ પ્રક્રિયા.

Spiritually Supreme-Shree NAVAKAR.

સરોતમ આધ્યાત્મિક શાસ-શ્રી નવકાર,

Essence of Agam-Shree NAVAKAR.

ચૌહ્યુર્વનો સાર-શ્રી નવકાર.

આ મુહાયોના વિસ્તૃત વિવેચન માટે આ પુસ્તક વાંચો. “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર” લેખક આણુભાઈ કડીવાળા.

### પુરિશિષ્ઠ

પરમેષ્ઠિ વિદ્યાયંત્રકર્ષપમાં ખતાવેલ ધ્યાનમાં આવતા વિદ્ધનોનો નાશ કરવાનો પ્રયોગ.

શાસ્ત્રન્તિત જન્તવઃ કુદ્રા વ્યન્તરા ધ્યાનઘાતિનઃ ।

તદ્દ બદ્ધ્યે<sup>૧</sup>દ્વારદ્વિકૃપત્રે ગર્ભે સૂર્યમહઃ સ્વકમ્ ॥ ૪૯ ॥

‘ॐ નમો અરિહંતાણ’ ક્રમાત પૂર્વાદિપત્રગમ ।

પ્રત્યાશમેકમેકાહઃ એકાદશશતીં જપેત् ॥ ૫૦ ॥

ધ્યાનાન્તરાયાઃ શાસ્ત્રન્તિત મન્ત્રસ્વાસ્ય પ્રભાવતઃ ।

કાર્યે સપ્રણવો ધ્વેય: સિદ્ધ્યે પ્રણવં વિના ॥ ૫૧ ॥

આ દિશારૂપ પત્રની મધ્ય (કણ્ઠિકા)માં સૂર્યના તેજ સ્વરૂપ પોતાને સ્થાપન કરવો અને ‘ॐ તમો અરિહંતાણ’ (એ મંત્ર)ને કુમશઃ પૂર્વ આદિ પ્રત્યેક દિશામાં તેમ જ વિદ્ધિશામાં સ્થાપન કરવો અને તેનો પ્રત્યેક દિશામાં એકેક દિવસે અગિયારસે વાર જાપ કરવો જોઈએ. આ મંત્રના પ્રલાવથી ધ્યાન કરતી વેળા આવતા અંતરાયો શરીર જાય છે. (ઇહલૌકિક) કાર્ય માટે (સકામ ધ્યાન કરવું હોય તો) પ્રણુવ-‘ॐ’ પૂર્વક ધ્યાન કરવું અને સિદ્ધિને માટે (નિષ્કામ ધ્યાન માટે) પ્રણુવ-‘ॐ’ વિના તેતું ધ્યાન કરવું । ૪૯-૫૧.

ॐ हौँ अहूँ नमः

## सालं धन ध्यानना प्रयोग॥

पाठ त्रीजे

परभातमानी भूर्तिनुं ध्यान याने इपस्थ ध्यान

सकलाऽहतप्रतिष्ठानमधिष्ठानं शिवश्रिथः ।

भूर्भुवः स्वख्यीशान-मार्हन्त्यं प्रणिदध्महे ॥ १ ॥

नामाऽकुतिद्रव्यभावैः, पुनतस्त्रिजगज्जनम् ।

क्षेत्रे काले च सर्वस्मि-न्रहतः समुपास्महे ॥ २ ॥

કलिकाल सर्वश सावान छेमय-द्रसूरीश्वरज्ञ महाराज सकलाहृत् स्तोत्र उत्तरता श्वेतोमां इरमावे छे के :-

(१) “सर्व अरिहंतोमां रहेता भेक्षिप्ती लक्ष्मीना कारणभूत, पाताणलोक, मनुष्यलोक अने देवलोक एव त्रणेना स्वाभी एवा अरिहंतपथानुं अभे ध्यान ठरीए छीअ.

(२) नाम, स्थापना, द्रव्य अने सावनिक्षेप वडे त्रण जगतना लोकने पवित्र करनार एवा, सर्व क्षेत्र अने सर्व काणने विषे अरिहंतोने अभे सारी रीते सेवीए छीअ.

આર્થન્ય એક ત્રિલુલન્યાપી શક્તિ વિશેષ છે અને તેને આધીન વિશ્વચક ચાલી રહ્યું છે. પ્રાણીમાત્રની આધ્યાત્મિક ઉત્કાંતિનું કાચ્યા આર્થન્ય પ્રદર્શિત ધર્મચક્ષના આધારે અનાદિ અનંતકાળ પર્યાંત \*સતત ચાલી રહ્યું છે. આર્થન્ય સકલ અરિહંતોમાં છે અને તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. અરિહંત પરમાત્માનો સ્થાપના નિક્ષેપ એટલે પ્રતિમા (મૂર્તિ)નું ધ્યાન, આ પ્રકરણુમાં આપણે જોઈશું તેને ડ્ર્યુસ્થ ધ્યાન ચોગશાસ્કમાં કર્યું છે.

જિનેશ્વરહેવની મૂર્તિ દ્વારા-અમૂર્તિ એવા પરમાત્માના મૂર્તિ સ્વરૂપનું દર્શાવ થાય છે. તેથી મૂર્તિના માધ્યમ દ્વારા આરાધક આત્મા પરમાત્મ-તત્ત્વનું મીલન કરે છે. સર્વોત્તમ દ્રોધોથી પ્રલુની મૂર્તિની પૂજા કરે છે. ભગવાનના ત્રિલુલન તારક અદ્ભુત સ્વરૂપને દેખી નૃત્ય કરે છે. પરમાત્માના સ્તોત્ર-સ્તવન વિગેરે દ્વારા પરમાત્મા સાથે તન્મખતા સાધે છે.

“જિન પ્રતિમા જિન સારિખી” વિગેરે વચ્ચેનો દ્વારા શાસ્કડાર મહર્ષિઓએ જિનેશ્વરની પ્રતિમાની પૂજાનું ફળ સાક્ષાત ભગવાનની પૂજા જેટલું જ બતાવ્યું છે. આત્માના શુદ્ધ ચતુંચારુસ્થ-સ્વરૂપનો અનુભવ કરવા માટે જિનલક્ષ્ણ સૌથી સરળ માર્ગ છે.

\* “જૈનો ઈશ્વરને સ્વીકારતા નથી” આવો આક્ષેપ અનુભૂતિ તરફથી થએ રહ્યો છે. તેનો સારામાં સારો રદ્દીયો જૈનોના સ્તુતિ સ્તોત્ર સાહિત્ય વડે આપી શકાય છે. આ એ ગાથામાં પ્રાણી-માત્રની આધ્યાત્મિક ઉત્કાંતિના મૂળમાં અરિહંત પરમાત્મા છે, તે સ્પષ્ટ સમાજય છે.

સકલ આગમ શાસ્ત્રોનું અવગાહન કરીને મહોપાઠ્યાય  
શ્રી ચંદોવિજયજી મહારાજ ઇરમાવે છે કે :—

સારમેતન્મયા લઘું શ્રુતાભેરવગાહનાત ।

ભક્તિર્ભાગવતી-બીજા, પરમાનંદસંપદામ ॥

શ્રુતસાગરનું અવગાહન કરવાથી આ પ્રકારનો સાર  
મેં પ્રાપ્ત કર્યો છે કે પરમાત્માની લક્ષ્ણિત એ જ એક  
પરમાનંદ-મોક્ષ લક્ષ્ણીનું ખીજ છે.

દર્શનાત् કૂરિતધ્વંસી, બંદનાત् વાંछિતપ્રદः

પૂજનાત् પૂરકઃ શ્રીણાં, જિનઃ સાક્ષાત् સુરદ્રુમઃ ॥

જિનેખર લગ્નવંત કલ્પવૃક્ષની જેમ ઇળ આપનારા  
છે. સાધક જ્યારે દર્શન, પૂજન, વંદન કરા પરમાત્મા  
સાથેના નિકટના સંખાંધમાં આવે છે, પોતાના મત-વચન-  
કાચાના યોગોને પ્રભુ લક્ષ્ણિતમાં ભાવોદ્વાસ પૂર્વક પ્રવતાવે  
છે, ત્યારે સર્વ સંપત્તિઓ અને સિદ્ધિઓ તેના હાથમાં  
આવીને વસે છે અને આત્માના પરમાનંદનો લોક્તા બને છે.  
God is my instant constant abundant supply  
of every Potent Good.

**પરમાત્માનું દર્શન અને ધ્યાન (ભૂમિકા પહેલી)**

પ્રભુ દર્શિશન સુખ સંપદા, પ્રભુ દર્શિશન નવનિધ;

પ્રભુ દર્શિશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ.

દર્શનં દૈવદૈવસ્ય, દર્શનં પાપ નાશનં;

દર્શનં સ્વર્ગ સોધાનં, દર્શનં મોક્ષ સાધનં

જીવની એ શક્તિ છે દર્શન અને જ્ઞાન. આ બનને જ્યારે પ્રયોગમાં હોય ત્યારે તેને દર્શન ઉપર્યોગ, જ્ઞાન ઉપર્યોગ કહેવાય છે. દર્શન સામાન્યને અહણું કરે છે તેથી વિકલ્પ રહિત હોય છે. જ્ઞાન વિશેષને અહણું કરે છે તેથી વિકલ્પ સહિત હોય છે.

### પ્રયોગ નં. ૧૨ દર્શનમાં ધ્યાન :—

પરમાત્માના ભાવિતમાં જઈ પ્રલુ મૂર્તિ આગળ, અગર સામે પરમાત્માનું ચિત્ર અગર પટ રાખીને દર્શન કરવું. દર્શન ખુલાં નેત્રથી કરવું. તે વખતે કાંઈ પણ વિચારવાનું નથી. મનને પણ દર્શનમાં રોકવાનું છે. થોડીક મિનિટ અનિભિષ નેત્રે ( પોપચું હલાંઘા સિવાય ) પરમાત્માની સામે જોઈ રહેવું. દર્શન કરવું, માત્ર દર્શન જ કરવું બીજું કાંઈ નહિ. થોડી ક્ષણુમાં મન શાન્ત થઈ જશે. આનંદનો અનુભવ થશે. જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે વિચાર શાન્ત હોય છે. જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે દર્શન બંધ થઈ જાય છે. આ પ્રયોગ પાંચથી પંદર મિનિટ સુધી નિયમિત કરવાથી મન શાન્ત થશે. આનંદ અનુભવાશે. દૃષ્ટિની શુદ્ધિ થશે.

### પ્રયોગ નં. ૧૩ ધ્યાનમાં દર્શનિ :—

આંખ બંધ કરીને સામે હતા તેવા જ લગવાન જોવા પ્રયત્ન કરો. થોડા દિવસમાં બંધ આંખે તેવા જ લગવાન દેખાવા શરૂ થશે.

પ્રયોગ નંખર (૧૨)માં દર્શનમાં ધ્યાન છે. દર્શન સિવાય બીજુ ડેઝી પણ વસ્તુમાં ધ્યાન ન હોય તેવું દર્શન અદ્ભુત આનંદની અનુભૂતિ કરાવે છે. હવે પ્રયોગ નંખર (૧૩)માં ધ્યાનમાં દર્શન છે. બીજા ધ્યાન પ્રયોગોમાં ધ્યાનમાં દર્શન વારંવાર આવે છે તે માટે આ પ્રયોગને અલયાસ બૂઝ જ ધ્યાનપૂર્વક કરવાનો છે. આંખ બંધ કરીને પરમાત્માનાં દર્શન કરવાનો અલયાસ કરવો. પરમાત્મા આંખ બંધ કરીને કહાય આંખા હેખાય, ન હેખાય તો પણ લગવાન સામે છે જ તેવો સંકલ્પ રાખવો. ધીમે ધીમે આંખ બંધ કરીને હાલતા-ચાલતા ઓલતા લગવાન હેખાવા માંડશે. આંખ બંધ કરીને લગવાન હેખાય ત્યારે દર્શનમાં ચૈતન્ય જાગૃત થાય છે.

ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા ‘પ્રતિમાશતક’ નામના ચંથમાં લખે છે :—

નામાદિત્રયે હૃદયસ્થિતે સતિ ભગવાન् પુર ઇવ સ્ફુરતિ ।  
હૃદયમિવાઽનુપ્રવિશતિ, મધુરાલાપમિવાઽનુવદતિ, સર્વાઙ્ગીણ-  
મિવાઽનુભવતિ, તન્મયીભાવમિવાપવતે; તેન ચ સર્વકલ્યાણ-  
સિદ્ધિ:, તત્કથં નિક્ષેપત્રયાદરં વિના ભાવનિક્ષેપાદરઃ ?  
ભાવોલ્લાસસ્ય તદધીનત્વતા ॥

**ભાવાનુવાદ:** નામ, સ્થાપના અને દ્રોય એ ગ્રણ હૃદયમાં સ્થિર થવાથી ભગવાન જાણે સાક્ષાત् સામે હેખાય છે, જાણે હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છે, મધુરાલાપથી જાણે આપણી સાથે ઓલી રહ્યા છે, જાણે આખા શરીરમાં ભગવાન

વ्यापी ગયા હોય, જણે તનમય ભાવને પાર્યા હોય તેવું અનુભવાય છે તેથી સર્વ કલ્યાણની સિક્ષિ થાય છે. માટે ત્રણ નિષ્ઠેપના આદરથી જ ભાવ નિષ્ઠેપનો આદર થઈ શકે છે, અને ભાવોદ્વાસ વધે છે.

મહાપુરુષોએ આ રીતે પરમાત્માને ચારે નિષ્ઠેપે હૃદયમાં સ્થિર કરવા અને તે દ્વારા થતા વિશિષ્ટ અનુભવોને જીવનમાં અનુભવવા ઉપરેશ આપેલ છે. ઉપરના શાસ્ત્રવચ્ચનો સાક્ષી પૂરે છે કે ભગવાન આપણા હૃદયમાં પ્રવેશો છે, આપણી સાથે મધુર વાતોલાપ કરે છે, આખા શરીરમાં વ્યાપી જય છે. આવો અમૃત અનુભવ કરવો તે જ માનવજીવનનું લક્ષ્ય છે.

ધીમે ધીમે આપણને પણ આવો જ અનુભવ થશે. દર્શન પ્રયોગ નં. ૧૨ અને પ્રયોગ નં. ૧૩ નિયમિત ચાલુ રાખવાથી જરૂર આવો અનુભવ થશે.

ઉપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજ ભરૂચ બંદરે સાધના કરવા માટે ગયા. અહુમનો તપ કર્યો. દેવાધિદેવ મુનિસુનત સ્વામી ભગવાનના મદ્દિરમાં ત્રણ દિવસ આરાધના કરી. છેલ્લા દિવસે અનુભવ થયો. તેમનું સ્તવન અનાદ્યુઃ

આજ સર્ઝા દિન મુજ તણો, મુનિસુનત દીઠા;  
લાંગી તે ભાવઠ ભવ તણી, દિવસ હુરિતના નીઠા;  
અંગણે કદ્વપવેલી રેળી, ઘન અમીયના વુઠચા;  
આપ માર્યા તે પાસા ઢળ્યા, સુર સમકિત તુઠા.

नियति हितहान सन्मुख हुओ, स्वपुण्योदय साथे,  
जश कहे साहेबे मुगतिनु; करियुं तिलक निज हाथे.

આજે મારે દિવસ સર્જણ થયો, આજે મને પ્રભુનું  
દર્શન થયું. આજે ભવની લાવઠ લાંગી ગઈ. હુઃખના  
દિવસો હવે પૂરા થયા. ધણા વખતની પરમાત્મ-દર્શનની  
મારી ધર્યા પૂરી થઈ. આજે મારે આંગણે કલ્પવેલી ઈણી.  
આજ મારા આંગણામાં અમૃતનો વરસાદ થયો.

ગ્રચોગ નં. ૧૪ :—

પરમાત્માની પૂજનો ગ્રચોગ “પૂજામાં ધ્યાન”  
(ભૂમિકા થીલુ.)

જિનમંહિરમાં પૂજા નિત્ય નિયમિત સ્વદ્રબ્ધથી કરવી.  
તેમાં કદ્દી પ્રમાદ ન કરવો. પૂજાની ફરેક પ્રક્રિયામાં ધ્યાન  
છે. થોડાક લાવો નીચે મુજબ કરવાથી અફભૂત લાવ  
કર્પન થશો. આજે કરવાથી આજે જ દિવ્ય અનુભવ થશો.

અલિષેક પૂજા :—હૃધથી લરેલા કળશથી પ્રભુજીનો  
અલિષેક કરતાં ભસ્તક ઉપરથી હૃધની ધારા કરવી. તે  
નણે કર્દણાની ધારાએ પ્રભુના અંગોને સ્પર્શીને સમગ્ર  
પૃથ્વીને પાવન કરે છે તેવો લાવ કરવો.

જળ કળશથી અલિષેક પ્રભુજીના જમણા ચરણના  
અંગુઠે આપણું સર્વસ્ત્ર ભગવાનને સમર્પિત કરતા હોઇએ  
તેવા લાવ સાથે કરવો.

કેસર ચંદ્રનથી પૂજા એ આપણી જત ભગવાનને

સમર્પણ કરવાનું માધ્યમ છે. કે આંગળીથી લગવાનની પૂજા કરીઓ છીએ તે આંગળીને કેસરમાં રાખી સંકલ્પ કરવો કે, મને આ જીવનમાં કે કાંઈ મન, વચ્ચે, કાયા, ધન આદિ મળ્યાં છે તે સર્વ આ કેસર ઇથી માધ્યમ દ્વારા હું પરમાત્માને સમર્પણ કરેં છું. તે કેસરનાળી આંગળી પ્રલુના ચરણના અંગુહી ઉપર ૧૫-૨૦ સેકન્ડ સુધી રાખી આ સમર્પણનો લાવ કરવો. થોડી સેકન્ડમાં જ પરમાત્મામાંથી શક્તિનો પ્રવાહ નિકળી આપણા અંદર તે આંગળી દ્વારા જ અવેશ કરવો શરૂ થાય છે તેવો અનુભવ થશે.

**પુષ્પ પૂજા :**—એક સુંદર અખંડ પુષ્પ બન્ને ઢાથ વડે લઈ લાવના કરવી. “હે કરુણાનિધાન પરમાત્મા ! આ પુષ્પ મારા હૃદયના ભાવોનું પ્રતીક છે. એ કુલ નથી પરંતુ મારું સર્વસ્વ છે. આ પુષ્પરૂપી પ્રતીક દ્વારા મારું સર્વસ્વ હું આપના ચરણમાં સમર્પિત કરેં છું. આવા લાવથી ભાવિત બની પુષ્પ પ્રલુના ચરણે સમર્પિત કરીશું ત્યારે કાઈ અલોકિક લાવ આવશે. આ રીતે અષ્ટ ગ્રહારી પૂજા ઉત્તમ સામની વડે ઉત્કૃષ્ટ લાવપૂર્વક કરવી. ઉપરોગ પૂજા વખતે લગવાનમાં જ રાખવો. તે પછી હવે બતાવવામાં આવે છે તે “ધ્યાનમાં પૂજા” કરવી.

**પ્રચોગ નં. ૧૫ :**—

**પરમાત્માની પૂજાનો પ્રચોગ “ધ્યાનમાં પૂજા”**

મનથી જગતની સર્વોત્તમ સામની વડે પૂજા કરવી.

**સિદ્ધગિરિ ઉપર આદેશર લગવાનની અગર શાંખેશર**

જઈ પાર્શ્વનાથ દાદાની અગર કે અનુકૂળ પડે તે પરમાત્માની પ્રતિમાની કદ્યપનાથી સરોતમ દ્રવ્યોથી પૂજા કરવી.

દા. ત. સિદ્ધગિરિ ઉપર ચુગાદિ આહેશ્વર દાદાની પૂજા કરવા માટે સિદ્ધગિરિ ઉપર દાદાના મંદિરે કદ્યપનાથી પહોંચ્યા છીએ.

દાદાના મંદિરમાં પ્રવેશ કરતાં પરમાત્માનું દર્શાન કરી પાવન થઈએ છીએ.

પૂર્ણોનંદમયં મહોદ્યમયં, કૈવલ્યચિહ્નમયં  
શ્રૂતીતમયં સ્વરૂપરમણં, સ્વાલાવિકી શ્રીમયં  
શાનોદોતમયં કૃપારસમયં, સ્યાદ્વાદ વિદ્યાતયં  
શ્રી સિદ્ધાચલ તીર્થરાજમનિશાં, વન્દેઽહમાહીશ્વરં ॥

આ પ્રમાણે સુતિ કરી અતિ વીરોદ્ધાસ, આનંદ,  
સંભ્રમપૂર્વં લગદાનના ગર્ભાગુહમાં પ્રવેશ કરી પૂજામાં  
દીન બનવું.

પૂજાની સામચ્ચો કદ્યપનાથી લોગી કરવી. (આપણે  
અત્યારે ત્રણ જગતના અધિપતિ છીએ. આપણી ધર્માધ્યાત્મક  
મુજબ સર્વ સામચ્ચો હાજર થાય છે તેવો ભાવ કરવો.)

(૧) સોનાના, હીરાના, મણી, માણુકના કળશો.

(૨) માગધ, વરદામ આદિ તીર્થોના જળ.

(૩) દેવહુણ્ય વચ્ચના બનાવેલા અંગવચ્ચ.

(૪) મલયાચલ પર્વત ઉપર રહેલા ચંદ્રનના વૃક્ષના

ધ્યા. પ્ર. ૮

ચંદ્ર રસથી લરેલા સુવર્ણના રત્નજડિત કટોરા, કેસર કસ્તુરી, ખરાસ આદિથી મિશ્રિત વિલેપન.

- (૫) નંદનવનના પુષ્પ.
- (૬) હીરા, માણેક, મોતી આદિ અંગરચના માટે.
- (૭) સુવર્ણના રત્નજડિત ધૂપધાનામાં સુગંધી લર્પૂર કૃષ્ણાગર્ડ ધૂપ.
- (૮) રત્નમણિના હીપક.
- (૯) મોતીના અક્ષત.
- (૧૦) સર્વોત્તમ પ્રકારના ઘરેરસ પૂર્ણ નૈવેદ્ય.
- (૧૧) કલ્પવૃક્ષના ઝણ.
- (૧૨) રત્નની આરતી અને મંગળ હીપક.
- (૧૩) રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચામર.

સર્વોત્તમ સામની કલ્પનાથી એકઠી કરી, તેનાથી હવે માનસિક પૂજા શરૂ કરવી.

પ્રયોગ નં. ૧૪માં ખતાંબા પ્રમાણે જળ પૂજાથી પુષ્પ પૂજા સુધી સર્વોત્તમ સામનીથી પૂજા કલ્પનાથી કરવી. જાણે સાક્ષાતું કરતા હોધાએ તેવા ભાવથી ભાવિત બનનું. પુષ્પ પૂજા સાથે હીરા, માણેક, મોતી આદિથી અંગ રચના કરી ચારે તરફ કુલ ગોઠવવા. ચારે તરફ કુલની દિંબ સુગંધ આવી રહી છે.

સુવર્ણના રત્નજડિત ધૂપધાનામાં કૃષ્ણાગર્ડ વગેરે સર્વોત્તમ

સુગંધિ ધૂપ વડે પૂજા કરવી. ધૂપધાનામાં ધૂપ બળે છે તે અરેખર ધૂપ નથી બળતો પણ આપણા પાપ બળે છે તેવો અનુભવ કરવો. આરતી મંગળ હીવો કરવો.

કરણાના સાગર પરમાત્માને કેવળજ્ઞાન થયું, તે સમયે જગતમાં મહાન ઉદ્ઘોત થયો. તે ઉદ્ઘોતના પ્રતીક રૂપે પરમાત્માની આગળ પ્રગટ કરવામાં આવેલો આ હીપક અમારા અજ્ઞાન અંધકારનો નાશ કરીને અમને મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવર્જાન અને કેવળજ્ઞાનને આપનારો બને છે તેવા ભાવોથી સલર બનવું.

અક્ષત પૂજા અક્ષય એવા આત્મસ્વરૂપને આપે છે તેવા ભાવોથી ભાવિત બનવું. ષટ્ઠરસ લોજનના થાળ પ્રભુ-જીની આગળ ધરાવી અણુધારી મોક્ષપહની ભાવના કરવી. કલ્પવૃક્ષના ઝણથી પ્રભુજીની પૂજા કરવી.

“કલ્પતર્ણના ઝણ લાવીને કે જુનવર પૂજે,  
કાળ અનાદિ કર્મ તે સંચિત સત્તાથી ધૂજે.”

“ઝણ પૂજા વીતરાગની રે, કરતાં પાપ પલાય સદ્ગુણે.”

આવા ભાવોથી ભાવિત બનવું.

સુવર્ણાના રત્નજડિત ચામરો બંને હાથમાં લઈ નૃત્ય કરવું. તે વખતે શરીરનું પણ ભાન જુલાઈ જાય છે. આ પ્રમાણે કલ્પનાથી પણ જણે સાક્ષાતુ દેવાધિહેવની પૂજા કરતા હોઈએ તેવા ભાવોથી પૂજા કરવી.

**નોંધ :—કોઈએ એવું ન સમજવું કે કલ્પનાથી**

પૂજા કરીશું તો ચાલશે. મંહિરમાં જઈને અષ્ટપ્રકારી પૂજાની શું જરૂર ? એટલા માટે જ આહીં પૂજામાં ધ્યાન પ્રયોગ નાં. ૧૪માં પ્રથમ બતાવ્યું. આપણી યથાશક્તિ સામગ્રીથી પૂજા કરવી. હવે વધુ સર્વોત્તમ સામગ્રીથી પૂજા કરવી છે તો આ પ્રયોગ નાં. ૧૫માં બતાવ્યા પ્રમાણે કલ્પનાથી ઉત્તમ સામગ્રીથી પૂજા કરવી.

૩૦૪ પૂજા અફ્ફભૂત ફોને આપે છે તે પ્રયત્નિત છે, તેથી વિસ્તારના લયે આહીં લખ્યું નથી. અન્યત્ર અંથેમાથી જોઈ લેવું. અદ્યાત્મ યોગી પૂજય પંન્યાસ પ્રવર લદંકરવિજ્યજુ મહારાજનાં લુનસક્તિ અને પ્રતિમા પૂજન આ અન્ને પુસ્તકે આ વિષયમાં ખાસ વાંચવા જેવા છે.

જૈન શાસનમાં તો સામુદ્દરિક મોટી પૂજા જેવી કે અષ્ટોતરી સનાત્ર, શાંત સનાત્ર, સિદ્ધચક્ર પૂજન, અર્ધદ્વિ મહાપૂજન આહિ અનેક મોટી પૂજાએ થાય છે. સર્વોત્તમ દ્રોઘો લાવીને આવી મોટી પૂજા શા માટે કરવામાં આવે છે તે તે બાળતમાં મહોપાધ્યાય યશોવિજ્યજુ મહારાજના પ્રતિમાશતક નામના અંથમાં ફરમાવે છે.

પૂજાપૂજકપૂજયસઙ્ગતગુણધ્યાનાવધાનક્ષણે ।

મૈત્રી સત્ત્વગુણોષ્વનેન વિધિના ભવ્ય: સુખીસ્તાદિતિ ।

વૈર વ્યાધિ વિરોધ મત્સર મદ, ક્રોધૈશ્ચ નોપલ્લબ-

સ્તત્કો નામ ગુણો ન દોષદલનો, દ્વાયસ્તવોપ્રકર્મે ॥૩૩॥

નાનાસંઘસમાગમાત્સુકૃતષ્ટતસદ્ગન્ધહસ્તિવ્રજ ।

સ્વસ્તિપ્રશ્નપરંપરાપરિચ્યાદપ્યદ્ર્ભૂતોદ્રભાવના ॥

વिणावेणुमृदङ्गसङ्गमचमत्काराच्च नृत्योत्सवे  
स्फाराहर्दूगुणलीनताभिनयनाद् भेदभ्रमप्लावना ॥३६॥  
( प्रतिमाशतक )

આ સામુદ્દાયિક-સંઘ મળીને કરે છે તે મોટી પૂજા-  
ઓમાં-પૂજા, પૂજક અને પૂજય. દિશા, દશ્ય અને દગ્ધ.  
ધ્યાતા, ધ્યાન અને ધ્યેય—એ ત્રણેની એકતા સધાય છે.  
આ રીતે ધ્યાતા આપણા આત્મા છે, ધ્યેય પરમાત્મા છે,  
અને પૂજા દ્વારા ધ્યાન પ્રક્રિયા ચાલે છે તે સમયે ધ્યાતાનું  
ચેતન્ય ધ્યેયમાં નિષ્ઠ થઈ જાય છે ત્યારે ધ્યાતાના હૃદયમાં  
સકલ ભવ્ય લોક સુખી થાઓ તેવો મૈત્રીભાવ ઉત્પજ્ઞ થાય  
છે. આજ સુધી ધ્યાતા એટલે આપણા હૃદયમાં “મને  
સુખ મળો અને માર્દ હુઃખ ટળો” એટલો જ લાવ હતો  
પરંતુ પ્રાણીમાત્રના કલ્યાણુ લાવની પરાકાશાચે પહેંચેલા  
અરિહંત પરમાત્માની પૂજા અને ધ્યાન દ્વારા આપણા હૃદયમાં  
“સકલ ભવ્ય લોક સુખી થાઓ” તેવો મૈત્રી લાવ ઉત્પજ્ઞ  
થાય છે.

વેર, વિરોધ, મદ, મત્સર આદિ દોષો આ પૂજા  
દ્વારા શાંત થઈ જાય છે. કયો એવો દોષ છે કે આ પૂજા  
દ્વારા શાંત થતો ન હોય? અર્થીત, પરમાત્માની મોટી પૂજા  
અને તે દ્વારા થતું પરમાત્માનું ધ્યાન અને તે દ્વારા થતી  
ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતાથી સર્વ પ્રચોજન સિદ્ધ  
થાય છે.

પરમાત્માની આવી મોટી પૂજામાં જુદા જુદાં સ્થળેથી  
સંઘ આવે છે અને તે એકઠા થયેલાં સંઘના પુષ્યાત્માએ।

એક ખીજનો પરિચય સાથે છે. તે વખતે અફલૂત ભાવ ઉત્પત્ત થાય છે. વીણા, વેળું, મુહંગ આદિની સાથે ગીત નૃત્ય અને વાળુંતના નાદ સાથે પરમાત્માના ગુણગાન ગવાય છે. તે વખતે અધારું મન પરમાત્માના શુણેના વિષે લીનતા પામે છે. “મેદ બ્રમ પ્લાવના” તે વખતે લેદનો બ્રમ લાંગીને લુંઝો થઈ જાય છે. પરમાત્મા અને આપણા આત્મા વર્ચયેના લેદનો બ્રમ લાંગી જાય છે. એકતા સધાય છે.

લગવાન શ્રી હરિલદ્રસુરિજી મહારાજ “બોડશક પ્રકરણુ” નામના વંથમાં ઈરમાવે છે કે :—

આ જિનેશ્વર લગવાંત જારે હૃદ્યમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વે પ્રયોજન સિદ્ધ થવાનું કારણ એ છે કે આ શ્રી જિનેશ્વર લગવાંત પુરમ ચિંતામણિ છે. તેઓ હૃદ્યમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે.

આવી માટી પૂજા અને તેમાં થતું પરમાત્માનું સામુદ્દ્રાવિક ધ્યાન કેટલું અફલૂત છે તે આ શ્લોકેના મર્મ જાણ્યા પછી પૂજા કરારા થતું ધ્યાન આપણા જીવનનું મહત્વનું અંગ ખતી જાય છે.

નેમ માણુસ રમવા એઠો હોય અને માણ્યો પાસો પડે અને કાર્ય સિદ્ધ થઈ જાય છે, તે રીતે આજ મારી પરમાત્મદર્શનની અંખના પૂરી થઈ, સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયાં. સમ્યગ્રૂહ હેવો પણ તુષ્ટમાન થયા. પાંચ કારણ અનુકૂળ થઈ ગયાં. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. આ પાંચ કારણ મળે ત્યારે કાર્ય થાય છે પરંતુ એ પાંચે

કારણ ઉપર આધિપત્ય કોનું છે ? મહાપુરુષ કહે છે કે કાળ સ્વભાવ અવિત્યતા, એ સધણાં તારાં દાસો રે; મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સખળ વિશ્વાસો રે.

આ પાંચ કારણો ઉપર નિમિત્તાર્થે બદલવતીરતા અરિહંત પરમાત્માની છે. જે મનુષ્યનું મન અરિહંત પરમાત્માની સાથે તદ્દાકાર ઉપયોગે પરિણિમે, તેને પાંચ કારણો આધીન બની જાય છે અને પાંચે કારણો અનુકૂળ બનવાથી આજે પરમાત્મા મારી પાસે આવ્યા. અને મારા કુપાળમાં સુક્રિતનું તિલક કરી ગયા. મહાપુરુષોએ આવું અનુભંગું છે. જીવનમાં આપણે પણ પરમાત્માને મેળવવાનો સંકલ્પ કરીએ છીએ, તો પરમાત્મા આપણુંને પણ અવશ્ય મળે.

‘જશ કહે સાહેબે સુગતિનું, કરીયું તિલકનિજ હાથે.’

પરમાત્માએ સુક્રિતનું તિલક પોતાના હાથે કર્યું છે.

લગ્બાનની મૂર્તિને જે મનુષ્ય પથ્થર માને છે તેને પથ્થર જેટલું જ ફળ મળે છે. પ્રભુની મૂર્તિને જે મનુષ્ય મૂર્તિ માને છે તેને તે સાક્ષાત્ સફ્રગતિનો હેતુ બને છે. અને પ્રભુની મૂર્તિને જે સાક્ષાત્ પરમાત્મા માને છે તેને તે પરમાત્મા કલ્પવૃક્ષની જેમ જીવનમાં ફળે છે. ફળનો આધાર વર્સુ ગ્રત્યે આપણા છૂદ્યમાં કેવો ભાવ રહેલો છે તેના ઉપર આધારિત છે.

## ( ભૂમિકા ત્રીજી )

આ પ્રમાણે પૂજન કર્યો પછી ચૈત્યવંહન કરવું અને પરમાત્માના સ્તવનમાં ધ્યાન કરવું.

## પ્રચોગ નં. ૧૬ :—

એકાદ સ્તવન આપણે જોઈ એ. સ્તવન અને ધ્યાન. ( સ્તવનમાં ધ્યાન. )

ગિરિઓરે શુણુ તુમ તણુા, શ્રી વર્ધમાન જીનરાયા રે;  
સુષુપુતાં શ્રવણે અમી અરે, માહરી નિર્મણ થાયે કાયા રે.

હે કરુણા નિર્ધાન પરમાત્મા ! હે અનંત શુણુના પ્રલુ ! આપના શુણો અનંત છે. આપના શુણો ગિરિવર જેટલો છે. પરમાત્માના શુણોનો હિમાલય પર્વત જેવો માટો પહાડ છે. “વર્ધમાન” એટલે વધતું છે માત્ર-પ્રમાણુ જેનું એટલે અનંતા અનંત શુણુ છે પ્રલુના, તેના પ્રતીકર્પે આપણી સામે હિમાલય જેવડો પ્રલુના શુણુનો ઢગલો છે તેવું દૃશ્ય આપણે જોઈએ છીએ. પરમાત્માના શુણોના સમૂહને જેતાં આપણે અહિભૂત આનંદમાં આવી ગયા છીએ. આપણા રોમે રોમ વિકસવર થઈ ગયાં છે.

તુમ શુણુ ગણુ ગંગાજળે, હું જીવીને નિર્મણ થાઉં રે;  
અવર ન ધ્યાધો આદર્દં, નિશાદિન તોરા શુણુ ગાઉં રે.

પરમાત્માના શુણુ રૂપી હિમાલય ઉપરથી ગંગાનીનો ધોધ બણે છે. પ્રલુનો તે શુણુ ગંગાનો ધોધ આપણા ઉપર પડે છે. ( તેવું દૃશ્ય આપણે જોઈએ છીએ. ).....

પ્રભુના શુણુ ગંગાજળમાં આપણે સ્નાન કરીએ છીએ.  
(આવું સંવેદન કરવું.).....

શુણુ ગંગાજળમાં સ્નાન કરવાથી આપણે નિર્મળ  
પવિત્ર બનીએ છીએ.....(આવું સંવેદન કરવું.)

પ્રભુના શુણુ ગંગાજળનો ધોધ આપણા ઉપર પડે  
છે તેમાં સ્નાન કરી આપણે પવિત્ર બનીએ છીએ. (આવું  
પાંચ દશ મિનિટ સુધી અનુભવવું.).....

પરમાત્માનું શુણુ ગંગાજળ આપણા મસ્તકમાંથી  
આપણા શરીરમાં પ્રવેશ કરે છે.....(આવું દશ જોવું)

આપણું આખું શરીર પરમાત્માના શુણોથી ભરાય  
છે તેવું અનુભવવું.....(થોડી ક્ષણ આવો અનુભવ કરવો)

આપણે ઉત્તમ શુણોથી ભરાઈ ગયા તેવો સંકલ્પ  
કરવો.....

ઉત્તમ શુણોથી ભરાઈ જતાં આપણી નિર્મળતા  
વધવા લાગી. પવિત્રતા વધવા લાગી. રોમાંચ અને આન-  
દનો અનુભવ થવા લાગ્યો.

પરમાત્માના શુણુ ગંગાજળમાં સ્નાન કરી આપણે  
આનંદથી ભરાઈ ગયા.....(આવા સાચોપૂર્વક ધ્યાન કરવું.)

ઝીલ્યા ને ગંગાજળો તે, છીલ્લાર જળ નવિ પેસે રૈ;  
ને માલતી કુલે માહીયા, તે બાવલ જઈ નવિ પેસે રૈ.

ગીતા ૧૦

પરમાત્માના શુણુ ગંગાજળમાં પવિત્ર ખની આનંદ અનુભવયો. હવે ખાંચિયાના જળમાં કોણુ સ્નાન કરે ? સંસારના વિષય રસને કોણુ સેવે ? પાંચે ઈન્દ્રિયોના વિષયોના રસ કરતાં અધિક રસ આજે પરમાત્માનું ધ્યાન કરતાં આવ્યો, હવે તુચ્છ રસમાં કોણુ જય ! માતૃતીતું કુલ મહિયા પછી બાવળીએ જઈને કોણુ એસે ? જગતના પદાર્થોમાં સુખ અને આનંદ આપણો જીવ શોધતો હતો, પણ તેમાં સુખ કે આનંદ હતો નહીં. છતાં સુખ અને આનંદ છે તેમ સમજુ દોડતો હતો, પરંતુ આજે પ્રત્યક્ષ પરમાત્માના ધ્યાનનો આનંદ આવ્યો, હવે જગતના રસ ક્રીકા પડી ગયા.

જશ પ્રભુ ધ્યાયો મહારસ પાયો, અવર રસે નવિ રાચું; અંતરંગ ફ્રસ્ટ્યો દરિસન તેરો, તુજ શુણુ રસ સંગ માચું.

પરમાત્માની લક્ષ્ણ, નમસ્કાર, ઉપાસના, દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન, સમરણાદિ દ્વારા પરમ રસનો અનુભવ થાય છે. ઈન્દ્રિયોના અને કષાયના રસો કરતાં અનેકગણ્યો ચિહ્નિતો પરમાત્મ-સ્વરૂપનો રસાનુભવ થાય ત્યારે, જગતના સર્વ રસ નીરસ ખની જય છે.

ખરી રીતે તો પાંચ ઈન્દ્રિયોના અને કષાયના રસો તે રસ નથી, પણ આલાસ માત્ર છે. છતાં અનાદિ મિથ્યા મોહના કારણે જીવને વિષયકષાયમાં રસ પડે છે અને તે રસ કરતાં અતિ ઉચ્ચ કોટીનો પરમાત્મ-ધ્યાનનો રસ પ્રાપ્ત થાય છે ત્યારે તુચ્છ રસો નાશ પામી જય છે.

ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ ઉપર્યુક્ત  
પંક્તિમાં કહે છે કે પ્રભુ, તારા ધ્યાનનો મહારસ આજે  
થીધો. હવે બીજી રસ શિક્ષા પડી ગયા. અંતરંગમાં તારા  
સ્વરૂપતું દર્શન મળ્યું, હવે તારા સિવાય મારે બીજું કાંઈ  
ન જોઈએ. તું જ મારું સર્વસ્વ છે, તું જ મારું સ્વરૂપ છે.

આ પ્રમાણે પરમાત્મ-સ્વરૂપનો ઉપલક્ષણથી આત્મ-  
સ્વરૂપના-પરમાનંદનો રસાસ્વાદ ચાખ્યા પછી જ  
જગતના બધા રસોમાંથી સાધકનું મન ઉઠી જાય છે.

તું ગતિ, તું મતિ આશરો, તું આલંખન મુજ ખ્યારો રે;  
વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે.

હે કર્તૃણાનિધાન પ્રભુ ! તું જ મારું સર્વસ્વ છે. તું જ  
માતા, પિતા, નેતા, બંધુ, પ્રાણુ આધાર છે. તારા આલં-  
ખને જ મારું શુદ્ધ ચૈતન્ય પ્રગટ થાય છે. તું જ મારી  
જીવન આધાર છે.

માહરો આત્મા તુજ થકી નિપન્ને,  
માહરી સંપદા સયલ મુજ સંપન્ને;  
તેણે મન મંદિરે ધર્મ પ્રભુ ધ્યાઈએ,  
પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ.

મારા અંદર, આત્મામાં અનંત સુખ અને આનંદતું  
નિધાન છે. અને તે નિધાનની પ્રાપ્તિ પરમાત્માના આલં-  
ખને જ થાય છે. માટે નિરંતર પરમાત્માનું સમરણ-ધ્યાન  
કરવું. એ જ સિદ્ધિના પરમ સુખની પ્રાપ્તિનો ઉપાય છે.

આ રીતે સ્તવનમાં ધ્યાન કરી શકાય. પછી સ્તવન આપણા માટે ફેરા ગાવાની વસ્તુ નહી પણ અનુભવવાની વસ્તુ બની રહેશે. અને સ્તવનોમાં રહેલા ભાવોનો અનુભવ થતો જશે તેમ પરમાત્માના ગુણગાન દ્વારા પરમાત્માનું ધ્યાન અને પરમાત્માના ધ્યાન દ્વારા આત્મ અનુભવ સુધી પહેંચવાનાં દ્વાર ખુલતાં જશે.

આ વિષયક ભીજ સ્તવનોની કઠીએ વિચારી તે સુજાય ધ્યાન કરીએ.

### જૈન દર્શાનની વિશિષ્ટ કેાદિની આધ્યાત્મિક સ્તવન પ્રક્રિયા

A wonderful Arr of Spiritual Prayer  
in Jainism :

આપણા પૂર્વોચ્ચાયોએ આત્મ-સાક્ષાત્કારની દિંય ગ્રહીયાથી ભરપૂર પરમાત્માનાં સ્તવનોની રચના કરી, જૈન શાસનમાં મહાન ઉપકારક કાર્ય કર્યું છે. મહાપુરુષોએ આત્મસ્વરૂપના અનુભવની કળા સ્તવનો દ્વારા સકળ સંઘમાં વ્યાપક બનાવી છે. જેમ કે :—

“ જે હોવે સુજ શક્તિ ધર્સી,  
સવી જીવ કરું શાસન રસી,  
શુચિ રસ ફલતે તિણાં બાંધતા,  
તીર્થ કર નામ નિકાયતા.”

પ્રભુ સત્તાગ્રહ મહોત્સવની આ પંક્તિએ લાખે કરેડે વખત શ્રી સંઘમાં ગવાઈ ગયા પછી તીર્થંકર નામ કર્મના ઉપાજ્ઞનનો હેતુ 'સવી જીવ કરું' શાસત રસી'ની લાવના છે, તે આપણું બાળક પણ જાણે છે. જગતના સર્વ જીવોના કલ્યાણ લાવની પરાકાઢાએ પહોંચેલા છે તે આપણું ભગવાન છે, એ તરત્વ સર્વ સામાન્ય સૌને યાદ રહે તેવી વસ્તુ અની ગઈ છે. જૈન સંઘમાં આજે પણ હજારો આત્માએ આ પંક્તિ આનંદવિલોચ અનીને ગાય છે. પ્રભુ-ભક્તિના સ્તવનમાં આત્માનુભવ લરેલો છે તે જરા જોંડાણુમાં જતાં જ ખ્યાલ આવે છે.

મહોપાઠ્યાચ શ્રી યશોવિજયજી મહારાજના એક રત્વન ઉપર થોડી વિચારણા કરીએ.

“સવામી તુમે કાંઈ કામણુ કીધું;  
ચિતડું અમારું ચારી લીધું;  
અમે પણ તુમણુ કામણુ કરશું,  
લક્તે અહી મન ધરમાં ધરશું;  
સાહિયા વાસુપૂજ્ય જિણુંદા.  
મોહના વાસુપૂજ્ય જિણુંદા.

હે કરુણાના સાગર, કૃપાના અવતાર, દ્યાના સમુર્દ્ર, વાત્સલ્ય રસના લંડાર, અરિહંત પરમાત્મા ! તમારા અફલુત સ્વરૂપે અમારા ઉપર કામણુ કર્યું છે. તમારી લોકોત્તર ઉપકારકતા, તમારી અનંત કરુણામય અમૃતજરતી દષ્ટિ અમે નિગોદમાં રહેતા ત્યારથી જ એટલે કે અનંતકાળથી

તમારી અમને તારવાની વિશ્વકર્માણુકારી લાવનાએ અથોતું આપના આવા મહાન ગુણોએ અમારું ચિત્ત ચોરી લીધું છે.

હે પ્રભુ ! તમે છેલ્લાથી ત્રીજા સવે સમ્યગું દર્શાનની અસાધારણું નિર્માળ કક્ષાએ પહોંચ્યા ત્યારે અનંત હુઃખમાં સખડતા જગતના અનંતા જીવો પ્રત્યેનો આપના છૂદ્યમાં કરુણાભાવ પરાકાણ્ટાએ પહોંચ્યો હતો.

“ અહો ! આ વિશ્વમા જિનેશ્વર લગવંતનું અનંત કર્માણુકારી શાસન વિદ્યમાન હોવા છતાં, મિથ્યાત્ત્વ આદિ મોહંધકારના કારણે જગતના જીવો હુઃખી થઈ રહ્યા છે. જો મને કોઈ એવી શક્તિ પ્રાપ્ત થઈ જય તો જગતના સર્વ જીવોને જુન શાસનની આરાધના કરાવવા - કારા નિસર્ગથી જ્યાં અનંત સુખ છે એવા - મોક્ષની પ્રાપ્તિ કરાવનાર બનું; “આ લાવનાની સરોચ્ચ કક્ષાએ (Climax) પહોંચીને, આપે તીર્થંકર નામ કર્મ નિકાયિત કર્યું. વર્ચ્યે એક ભવ કરી, પૃથ્વી તળ ઉપર આપે જગતના ઉદ્ધાર માટે સર્વર્વનો ત્યાગ કર્યો. જગતના ઉદ્ધાર માટે અનિવાર્ય એવું તીર્થ સ્થાપવા માટે જરૂરી કેવળજીન પ્રાપ્ત કરવા માટે આપે ઉપસગો અને પરિષહો સહન કરી ક્ષપકશેણી માંડી, કેવળ જીન પ્રાપ્ત કર્યું અને વિશ્વ ઉદ્ધારક એવું તીર્થ સ્થાપયું. અતિશયો અને પ્રાતિહાયોથી ચુક્તા એવા આપે સમવસરણુમાં એસી, પાંત્રીસ ગુણોથી ચુક્તા, ચોજનગામિની, સર્વ આનંદાચિની સર્વ પાપમ્રણાશિની, મોહિતમિરવિનાશિની, કર્માણુપરંપરાવર્ધની, મોહવિષનિવારણી, કર્મ-

કષ્ટકાહિની, લવસંતાપહારિણી, સકલસંજીવની, જીવન-જ્યોતિપ્રકાશિની અનંત કલ્યાણુકારિણી, માલકોષરાગમયી, એવી હિંય દેશના આપી.

આપની આવી ઉપકાર સંપદા જાણી અમે એવો નિશ્ચય કર્યો છે કે, વિશ્વમાં સૌથી વધારે નિકટના સ્નેહી સ્વજન અમારા માટે તમે એક જ છો. તેથી હવે અમારું મન તમારા સિવાય બીજે કથાંય લાગતું નથી.

વળી આપનું મૂળ સ્વરૂપ-આત્માનું હિંય સચિયદાનંદ સ્વરૂપ, આપનું ડેવળજ્ઞાન, આત્માનું અનંત શક્તિયુક્ત શુણુંય સ્વરૂપ, શુદ્ધ ચિહ્નાનંદધન ચેતન સ્વરૂપ હેઠી, હવે અમે એવો વિચાર કર્યો છે કે અમે પણ લક્ષ્ણિતું કામણું કરીને આપને અમારા મનરૂપી ધરમાં સહા રાખીશું. અમારા મનમાં એવી લક્ષ્ણ ધારણું કરીશું, કે તમે ક્ષણું પણ ત્યાંથી ખસી ન શકો. અમારા સમરણ-પટ ઉપર તમને સહા ધારણું કરી રાખીશું અને આપને બિરાજમાન કરીને અમારા મનમાંહિરને આપના ગુણોથી વાસિત કરીને હિંય દીતે શાણુગારીશું.

“ મન ધરમાં ધરીયા ધર શોલા,

દેખત નિત્ય રહેશો થિર થોલા;

મન વૈકુંઢ અકુંઠિત લકૃતે,

ચોંગી લાખે અનુભવ ચુકૃતે.”

અકુંઠિત લક્ષ્ણ દ્વારા એટલે અમારા ઉપયોગને કુંઠિત થવા દીધા સિવાય, એટલે અરિહંત આકાર ઉપ-

ચોગના સતત અચોગ ક્રારા અમે આપની એવી લક્ષ્ણિ કરીશું કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાઅદ્ધ રીતે ઉપચોગને આપના સ્વરૂપમાં જોડવા દ્વારા જે રીતે પરમાત્મ-સ્વરૂપનો અનુભવ કર્યો તે રીતે અમે પણ અનુભવ કરીશું.

ઇલેશોવાસિત મન સંસાર

ઇલેશ રહિત મન તે ભવપાર;

ઇલેશોવાસિત મન એટલે અશુદ્ધ ઉપચોગ, કર્મકૃત વસ્તુઓ અને બનાવેમાં સુખ-દુઃખનો અનુભવ કરતું અમારું મન, તેમજ રાગદેખ રૂપે પરિણમેલું અમારું મન તે જ સંસાર છે.

કર્મફળનું લોકતૃત્વ (સુખ-દુઃખ) અને રાગદેખનું કર્તૃત્વ - આ બંને અશુદ્ધ ઉપચોગનાં કારણો છે. તે બંને છોડીને ઉપચોગ જ્યારે પરમાત્મા આકારે પરિણમે છે, ત્યારે જ ભવસાગરનો અંત આવે છે.

(“ઇલેશ રહિત મન તે ભવપાર”)

જે વિશુદ્ધ મન ઘર તુમે આયા.

પ્રભુ તો અમે નવનિધિ ઝર્ણ પાયા.”

પરમાત્મ-ઉપચોગમાં જ્યારે આપણે સ્થિર બનીએ છીએ, એટલે કર્મફળનું લોકતૃત્વ અને રાગદેખનું કર્તૃત્વ રૂપ અશુદ્ધ ભાવ છોડીને આપણા ઉપચોગને પરમાત્મા આકારે (ઉપલક્ષણુથી આત્મા આકાર) પરિણમાવીને તેમાં

સ્થિર બનીએ છીએ ત્યારે કેવળજાન આદિ નવ ક્ષાયિક  
લખિધાએ રૂપ નવ નિધાનની પ્રાપ્તિ થાય છે.

“ ધ્યાતા ધ્યેય ધ્યાન સવિ એકે,  
લેદ છેદ કરશું હવે ટેકે;  
ખીર નીર પરે તુમશું મીલશું,  
વાચક જશ કહે હેળે હળશું.”

ધ્યાતા આપણો આત્મા છે, ધ્યેય પરમાત્મા છે અને  
ધ્યાન પ્રક્રિયા ચાલે છે.

જે સમયે ધ્યાતાનું ચૈતન્ય ધ્યેયમાં નિષ્ઠ થઈ જાય  
છે, ધ્યાતાનો ઉપયોગ ધ્યેયાકાર રૂપે પરિણમે છે, ધ્યાતા  
જ્યારે ધ્યેયમાં તદ્દાકાર રૂપે તન્મય-તરૂપ બને છે, ત્યારે  
ધ્યાતા અને ધ્યેય વર્ચેના લેહનો છેદ થઈ, ધ્યાતા પોતે જ  
આગમથી લાવ નિષ્ઠેપે પરમાત્મ-રૂપ થાય છે.

જેવી રીતે હૃધમાં સાકર નાખીએ છીએ અને તે  
હૃધમાં એકમેક થઈ જાય છે. તે રીતે ખીર-નીર પેઠે તુમશું  
મીલશું. એટલે હે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા !  
આપના આવા અલોહ મિલન દ્વારા અમે પણે હેળે  
હલશું એટલે પરમાનંદનો અનુભવ કરીશું. અર્થાત्  
તાત્ત્વક હાણિએ આપનું અલોહ મિલન તે જ  
આત્મસાક્ષાત્કાર એટલે આત્મસ્વરૂપના અનુભવની  
પ્રક્રિયા છે.

ધ્યા. પ્ર. ૮

આવા આત્મ-અનુભવની પ્રક્રિયા, આપણા મહા-પુરુષોએ રચેલાં પ્રબુસુત્તિ-સ્તવનોમાં વારંવાર આપણે જોઈએ છીએ. અનુભવરસનું અમૃત મહાપુરુષોએ ચાખણું છે, અને અર્થી આત્માઓને અનુભવ અમૃત ચખાડવા સ્તવનોમાં તેનો માર્ગ બતાવ્યો છે, તેના થોડાં ઉદાહરણ આપણે જોઈએ :

પ્ર. ઉપા. શ્રી માનવિજ્યળુ મ. રચિત અનુભવનાથ લગવાનનું સ્તવનઃ

“ અનુભવ જિનેખર ચરણની સેવા, હેવાએ હું હળીએ; કંહીએ અણુચાખ્યો પણ અનુભવ, રસનો ટાણા મળીએ.  
હું અનુભવ રસ હેવા સમરથ, હું પણ અરથી તેહનો,  
પ્રબુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પાડ્યો.”

અનુભવ-અમૃતનું પાન કરવા માટે પરમાત્મા એ જ પુષ્ટ નિમિત છે, આપણા ચૈતન્યને પરમાત્મ-સ્વરૂપ અનુધારી અનાવીએ તો જ અનુભવ-અમૃત મળે તેમ છે.

શ્રી ચિદાનંદલુ મહારાજ નેમનાથ લગવાનના સ્તવનમાં પણ કહે છે.

“ પણ તુમ હરિશન ચોગથી, થયો હૃદયે હો અનુભવ  
પ્રકાશ; અનુભવ અજ્ઞાસી કરે, હુઃખાચી હો સહુ કર્મ  
વિનાશ.”

પરમાત્મદર્શિન એ જ આત્માનુભવનો પ્રકાશ પ્રાપ્ત કરવાની કળા છે

મહોપાઠ્યાચ શ્રી માનવિજ્યજી મહારાજ પણ એ જ  
વસ્તુ બતાવે છે.

તુજ શુણ જ્ઞાન ધ્યાનમાં રહીએ,  
ઇમ મિત્રવું પણ સુલખ જ કહીએ;

માનવિજ્ય વાચક ગ્રલુ ધ્યાને,

અનુભવ રસમાં હળીએ એકતાને.

( અલિનાંદન જિન સ્તવન )

વિમલ વિમલ મિલી રહ્યા, લેદલાવ રહ્યો નાહીં;

માનવિજ્ય ઉવજાયને, અનુભવ સુખ થયો ત્યાંહી.

પૂર્વોચ્ચારોએ અનુભવ-રસ ચાખ્યો છે અને તે રસ  
ચખાડવા આપણુને પરમાત્મભક્તિ-ધ્યાન આદિનો હિંય  
માર્ગ બતાવ્યો છે.

પરમ પૂજય જ્ઞાનવિમલસૂર્યિ કૃત શુભતિનાથ લગ-  
વાનના સ્તવનમાં :

તુજ સ્વરૂપ જબ ધ્યાવે, તથ આતમ અનુભવ પાવે;  
જે અનુભવ રૂપ જેવે, તો મોહ તિમિરને જોવે.

અનાદિના મોહનીય કર્મના સંસકારોને મૂળમાંથી  
નષ્ટ કરવા માટે પરમાત્મધ્યાન હિંય ઉપાય છે.

કાચા કષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરેદ રે,  
શુદ્ધ દ્રોઘ શુણ પરોય ધ્યાને, શિવ હીએ ગ્રલુ સખરાણો રે.

( ઉ. ચશોનિજ્યજીજીકૃત અરનાથ ભગવાનનું સ્તવર્ણ.)

જિનશાસનમાં સ્તવનો, પૂજાએ આદિ ક્ષાર મહા-

પુરુષોએ આત્માનુભવની ગંભીર પ્રક્રિયાને સરળતાપૂર્વક ખતારી આપણા જેવા બાળજીના ઉપર મહાઉપકાર કર્યો છે. “સાત રાજ અળગા જઈ એડા, પણ લક્તે અમ મનમાણે પેડા.”

આપણું મૂળ સ્તવનની આ પંક્તિમાં અદ્ભુત લાવ છે, ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી મોક્ષમાં ગયા; વર્તમાન લરતશૈવમાં વિહૃરમાન તીર્થંકર ડોર્ધ હાજર નથી, આપણે ગમે તેટલી પ્રાર્થના કરીએ તો આપણી પ્રાર્થના કોણું સાંભળશે? મોક્ષમાં ગચેત ભગવાન આવે કેવી રીતે અને આપણું ચોગ-ક્ષેમ થાય શી રીતે? મહાપુરુષો કહે છે ભગવાન લલે ગમે તેટલા ફર હોય પણ અમારા હૃદયમાં જ્યારે સાચી લક્ષ્ણા ઉત્પન્ન થાય છે ત્યારે પરમાત્મા અમારા મનમંહિરમાં હાજર છે, પૂર્વાચારોની આવી અદ્ભુત સ્તવન-પદ્ધતિ જોઈ આપણું હૃદય આનંદી નાચી જોઈ છે. અહોભાવનું આશ્રીર્ય ઉત્પન્ન થાય છે.

સ્તવન અને ધ્યાન એ વિષયમાં સ્તવન કરતી વખતે ગાવા તરફ જ લક્ષને આપવાનું છે. વળી સુમધુર કંઠે લાવવાહી ગાવું તે તો ધણું જ ઉપયોગી છે. પણ સ્તવન ગાવા ઉપરાંત તેના શખ્ષોમાં કહેલા લાવોથી લાવિત અની તેમાં લખેલા લાવોનો અનુભવ કરવો તે મહત્વનું છે.

શાન્તિ જીનેશ્વર સાચ્ચા સાહીબ,  
શાન્તિકરણ ધન કદીમેં હો જીતજી.

તું મેરા મનમેં તું મેરા દિલમેં,  
ધ્યાન ધરું પલપલમેં સાહીબજી.....  
“તું મેરા મનમેં, તું મેરા દિલમેં”

આ ભાવથી ભાવવિલોચ બની પરમાત્મા આપણા મન  
અને શરીરમાં વ્યાપી જતા હોય તેવું અનુભવવું અને  
આપણા મન અને શરીરમાં વ્યાપી ગયેલા પરમાત્માના  
ધ્યાનમાં આપણે લીન બની જઈએ તેવી સ્થિતિમાં  
પ્રવેશ કરવો.”

એક ખીજું દૃષ્ટાંત જોઈએ.

### પ્રચોગ નં. ૧૭ “અમૃતકિયા”

હુશમન રાજાએ ઉજાજૈની નગરીની ચારે તરફ મારો  
ઘરો નાખ્યો છે. ઉજાજૈની નગરીના દરવાજા રાજાએ બંધ  
કરી હોધા છે. આખું નગર ભયબ્રદ્ધ બની ગયું છે.  
હુશમનનું સૈન્ય જોઈ સૌ ડોઈ ચિંતાતુર બની ગયા છે.  
ઉજાજૈની નગરીમાં જ શ્રીપાલના માતાજી કમલપ્રસા અને  
મધ્યણાસુંદરી રહેલાં છે.

માતા કમલપ્રસા પુત્રવધૂ મધ્યણાસુંદરીને કહે છે :-  
“હે પુત્રી ! ડોઈ બળવાન હુશમન રાજના સૈન્યે આપણા  
નગરને ઘરો ધાલ્યો છે. આખું નગર અત્યારે ભયબ્રદ્ધ  
બની ગયું છે. સર્વત્ર એક જ વાત ચાલે છે, હુશમન  
રાજનું સૈન્ય ધાણું મોઢું છે. આપણા ઉપર મહાન આપણિ  
આવી છે. નગરજનોનું શું થશે ? વળી હે પુત્રી ! તારે

પ્રિયતમ પરહેશ ગયો છે. તેને ધણા દીવસ વીતી ગયા છે. તેનો આવવાનો વાયરો પણ પૂરો થઈ ગયો છે પણ હજુ આવેલ નથી. આપણા નગરજનોનું શું થશે તેની ચિંતાથી હું બહુ ડઃખી છુ."

તે વખતે મયણા કહે છે :-

મયણા રે ઓલે મ કરો એદ, મ ધરો લય મનમાં પરચંકનો જી. "હે માતાજી ! જરા પણ એદ ન કરશો. હુશ્મન રાજનો લય જરાપણ મનમાં ધારણુ કરશો મા."

નવપદ ધ્યાને રે પાપ પલાય, ફરિત ન ચારો છે અહુ વડનો જી. નવપદના ધ્યાનના પ્રભાવથી સધળાંએ પાપો બળીને ભર્મ થઈ જાય છે. ગમે તેવા બળવાન હુશ્મનો હોય, રોની શક્તિ પણ નવપદની પાસે ક્ષીણ થઈ જાય છે.

વળી મયણાસુંદરી કહે છે : "મનુષ્યના માથે સાત પ્રકારના લય નિરંતર જરૂરી રહ્યા છે. હુશ્મનનો લય, જગદી પશુઓનો લય, વ્યાધિનો લય, મૃત્યુનો લય, જૈવખાનાનો લય, આળવિકાનો લય, આખરનો લય. આ સાતે પ્રકારના લય આપણા સર્વાના ઉપર રહેલા છે, પરંતુ આ સાતે પ્રકારના લય-

લય રે જ્યતાં નવપદ જાપ, લહે રે સંપત્તિ ધર્હિ-  
ભવ પરલવે જી.

આ સાતે પ્રકારના લય નવપદનો જાપ જ્યતાં એટલે

કે પરમાત્મા હૃદય મંહિરમાં આવતાં જ તત્કાળ નાશ પામી જય છે અને સંપત્તિઓ, સિદ્ધિઓ અને લક્ષ્મીઓ નવ-પદના આરાધકોની પાસે આવીને વસે છે.

મધ્યણાસુંદરીનો કહેવાનો ભાવાથી એ છે કે, હુન્યવી સુરક્ષકેલીઓમાં મનુષ્યને હેરાત કરવાની જેટલી શક્તિ છે, તેના કરતાં અનંતગુણી શક્તિ પરમાત્માની ઉક્તિમાં તે સુરક્ષકેલીઓ હર કરવાની છે. પરમાત્મા મનમંહિરમાં આવતાં શુલ અધ્યવસાય ઉત્પન્ન થાય છે તેથી અશુલ કર્મ શુલમાં સંક્રમણ થઈ જય છે, અશુલનો સ્થિતિ અને રસ ઘટી જય છે, શુલમાં સ્થિતિ અને રસ વધી જય છે, વગેરે કારણોથી જિનલક્તિમાં અંતરાયને તોડવાની અફભૂત શક્તિ છે. માટે માતાજી ! જરાપણ ચિંતા ન કરશો.

નૈન મહાલારતનો એક પ્રસંગ આપણુને અહીં ખૂબ ઉપયોગી છે.

પાંચ પાંડવો, દ્રૌપદી અને કુંતામાતાજીએ ઘણ્ણી યાતના લોગવી છે. હુઃખનો અંત હળુ પણ આવતો નથી. જંગલમાં રહેલાં છે તે વખતે એક વિદ્યાધર મુનિરાજ પથારે છે. કુંતામાતા મુનિરાજને પૂછે છે, “હવે હુઃખનો અંત કચારે આવશે ? મારા પુત્રો અને દ્રૌપદીનું હુઃખ મારાથી હવે સહન થતું નથી.”

મુનિરાજ કહે છે - “ હવે પછીના આઠ દિવસ હળુ પણ લયુંકર હુઃખ તમારા ઉપર આવી રહ્યું છે.”

કુંતામાતાના કહેવાથી તે મુનિરાજ હુઃઅમાંથી છુટ્ટવાનો ઉપાય બતાવે છે.

મુનિરાજે બતાવેલા ઉપાય મુજબ સાતે જણા આડ દિવસના ઉપવાસ કરે છે અને પરમાત્મા અદિહંત દેવનાં સમરણ અને ધ્યાનમાં આડ દિવસ લીન થઈ જાય છે.

ઓળ તરફ હુચોધનની છાવણીમાં હવે હુચોધન ખૂબ અકળાઈ ગયો છે. બધા પ્રયત્નો અજમાવી જોયા, પણ પાંડવો દરેકમાંથી બચી જાય છે. હવે ગમે તે રીતે પાંડવાના માથાં નીચે પડવા જોઈએ. સર્વ ઉપાયો શોધે છે, સર્વને પૂછે છે. એક ઉપાય પાંડવોને મારી નાંખવાનો મહ્યો. એક રાક્ષસીને સાધવાની છે. તે રાક્ષસી પાંડવોનું મૃત્યુ કરાવી શકો. રાક્ષસીને સાધી પાંડવોના પ્રાણ લેવા માટે માંકલી છે, તે વખતે જ કુંતામાતાને વિદ્યાધર મુનિ મળે છે. અને આડ દિવસના ઉપવાસ કરી પાચ પાંડવો, દ્રૌપદી અને કુંતામાતા પરમાત્માના ધ્યાનમાં સ્થિર થઈ જાય છે. રાક્ષસી પ્રાણ લેવા આવી, પણ તપ અને ધ્યાનના પ્રલાવથી કંઈ કરી શકતી નથી. થાકીને આડમા દિવસે પાછી ચાલી ગઈ. અહીં નવમા દિવસે સવારે પારણા માટે તૈયારી કરી છે. તે વખતે વિદ્યાધર મુનિરાજ પથારે છે. તેમને વહોરાવે છે. હેવો પાંચ હીંયની વૃષ્ટિ કરે છે. મુનિરાજ કહે છે, “હુચોધને માંકલેલી રાક્ષસી તમારો પ્રાણ લેવા આવી પણ તમારા ધર્મના પ્રલાવથી તેનું કંઈ ચાલ્યું નથી. હવે સંકટનો સમય તમારા માટે પૂરો થયો છે.”

આ દૃષ્ટાંતથી આપણુને સમજશે કે, જિનલક્ષ્મિમાં અંતરાયને તોડવાની તેવી અનોદ શક્તિ છે !

Fear is the faith in evils. જગતના અનિષ્ટ પદાર્�ોની શ્રદ્ધામાંથી ભયનું સર્જન થાય છે. કેટલાંક ગામનાં નામ એવા હોય છે—દા. ત. ગોઝરીયા, લાંઘણુજ, સાયલા, મરોલી વગેરે એ ગામ કોઈ માણુસ સવારે જતો હોય અને કોઈ પૂછે કે, કયા ગામ જાઓ છો ? તો કહેશે કે, લગતના ગામ જાઉં છું. સ્ટેશન ઉપર જાઉં છું. પણ તે ગામનું નામ કોઈ લેશે નહિ. કારણું કે તે ગામનું નામ લઈશું તો દિવસ ખરાબ જશે. મરમણું શોઠનું નામ લઈશું તો ખાવા નહિ મળે, તેમાં માણુસને શ્રદ્ધા છે. મરમણું શોઠના નામમાં ખાવા ન મળે તેવી શક્તિ છે તો પ્રભુ મહાવીરના નામમાં કાંઈ શક્તિ છે કે નહિ ? ગૌતમ ગણધરના નામમાં કાંઈ શક્તિ છે કે નહિ ? આ બાધત આપણે કદ્દી વિચારી નથી. ‘પ્રભુ નામે આનંદ કંદ’ ‘ગૌતમ નામે નવે નિધાન’ એ જીવનમાં અનુભવવાની વસ્તુ છે.

Where there is faith in God, Fear has no power.

આપણી શ્રદ્ધા જ્યારે પરમાત્મા, નવપદ, સિદ્ધયકે, આપણો આત્મા વગેરે ઉપર કેન્દ્રિત થાય છે તે વખતે સર્વો ભય તત્કાલ નાશ પામી જાય છે.

Where there is God, there is only Good.  
જ્યાં પરમાત્મા હોય ત્યાં ખંડું સાર્દું જ હોય છે.

Fear nothing but lack of faith in God.  
પરમાત્મામાં શ્રદ્ધાનો અભાવ ચેતું જ નામ લય છે.

આખા નગરના લોકો ફુથમનમાં કેટલી શક્તિ છે તેનો વિચાર કરતા હતા તેથી તે લયઅસ્ત બની ગયા છે. મયણું પરમાત્મામાં કેટલી અચિંત્ય શક્તિ છે તેનો વિચાર કરતી હતી તેથી એક મયણું જ આખા નગરમાં નિર્બિદ્ધ છે. જે વસ્તુનો માણુસ નિરંતર પોતાના મનમાં વિચાર કરતો હોય છે તે વસ્તુ તેના જીવનમાં અવશ્ય ઇળહાયી થાય છે. ખરાબ વિચારો કરે છે તેને ખરાબ રૂપે તે ફેણે છે. સારા વિચારો કરે છે તેને સારા રૂપે ફેણે છે. જે જૈનશ્કર જગવાતના નિરંતર વિચારો કરે છે તેના જીવનમાં પરમાત્મા કલ્પવૃક્ષની લેમ ઇળહાયી બને છે. તે માટે શ્રીપાળ અને મયણાનું પ્રત્યક્ષ દ્ધારાત આપણે જોઈ રહ્યા છીએ.

મયણુંએ કહ્યું; નવપદના પ્રલાવથી સર્વ જયો નાશ પામી જય છે. ત્યારે માતા પૂર્ણે છે “પુત્રી ! નવપદનો આવો અચિંત્ય પ્રલાવ છે, તેનું તારી પાસે પ્રમાણ શું છે ?

ત્યારે મયણું કહે છે -

“ બીજાં રે યોજે કોણ પ્રમાણ,  
અનુભવ જાગ્યો મુજને એ વાતનો જ;  
હુએ રે પૂજનો અનુપમલાવ,  
આજ રે સંધ્યાએ જગતાતનો જ,”

“ માતાજી ! શાસ્ત્રમાં તો નવપદના પ્રલાવનું વણ્ણોન  
અનેક સ્થળોએ આવે છે. પરંતુ મને પોતાને જ એ વાતનો

આજે અનુભવ થયો છે. આજ સંધ્યાકાળે હું લગવાનતા મંહિરમાં પૂજા કરવા ગઈ હતી. સંધ્યાકાળે પરમાત્માનાં આરતી મંગળ દીવો અને ધૂપ પૂજા કરતાં મારા હૃદયમાં એવા અદ્ભુત ભાવો ઉત્પન્ન થયા કે જેના પ્રભાવથી આપણા સર્વ ભયો આજે જ નાશ પામી જવા જેઈએ.”

માતા પૂછે છે, “હે મારી વહાલી પુત્રવધુ! તને પૂજામાં કેવો અનુપમ ભાવ આવ્યો?” ત્યારે મયણા કહે છે—“આજે મને અમૃતકિયાનો પરિણામ મારા હૃદયમાં ઉત્પન્ન થયો છે.” અમૃતકિયાના સાત લક્ષણો મયણા-સુંદરી અણી બતાવે છે. ઉપાધ્યાય યશોવિજ્યાળ મહારાજ કહે છે કે આ સાત લક્ષણો ચુક્તા લગવાનની પૂજા અગર ધર્મનું કેચ્છ પણ અનુષ્ઠાન જે થઈ જય છે તો આજીના કરેલા ધર્મના ઇણ ભારે આવતા ભવ સુધી નહીં પરંતુ આવતી ડાલ સુધી પણ રાહ જોવાની જરૂર નથી. “અમૃત-કિયા સિદ્ધિઝ્ય, તુર્ત ઇણે છે-તિહાં નથી આંતરોળુ” આજના કરેલા ધર્મનું ઇણ આજે જ પ્રાપ્ત થાય છે.

અમૃતકિયાના સાત લક્ષણો મયણાસુંદરી બતાવે છે. આપણે પણ પરમાત્માની લક્ષ્ણ આવા અમૃતકિયાના લક્ષણો ચુક્તા કરવાની છે. ધ્યાનપૂર્વક આ લક્ષણો આપણે સૌચે હૃદયમાં ધારણ કરવાના છે.

**પ્રથમ લક્ષણ:-તદ્ગતચિત્ત,** જે વખતે જે કિયા ચાલતી હોય તેમાં મન, વચન, કાચાના ચોગોની સ્થિરતા.

બીજું લક્ષણઃ—સમયવિધાન. સમય એટલે શાસ્ત્રમાં જિને શરૂ ભગવંતો એ જે કિયા જે વિધિ મુજબ જે સમયે કરવાની કહી છે તે કિયા તે વિધિ મુજબ તે સમયે કરવામાં આવે તે સમયવિધાન.

ત્રીજું લક્ષણઃ—ભવનો ભય.

જન્માન્તરેડપિ તવ પાદ્યુગં ન હેવ !

મન્યે મયા મહિતભીહિત-દાનદક્ષમુ;

તેનેહ જન્મનિ સુનીશ ! પરાલવાનાં,

જાતો નિકેતનમહં ભધિતા-શયાનામુ.

( કલ્યાણુમંહિર સ્તોત્ર ગાથા ૩૬ )

મનુષ્ય જારે અણુચિંતવી મુશ્કેલીમાં ઈસાઈ જાય છે ત્યારે તેના હૃદયમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. “મારા આશયોત્તું મથન કરી નાખે તેવી ઉપાધિઓથી હું શા માટે ઘેરાઈ રહ્યો છું ! મારા મર્મસ્થાનને લેહી નાખે તેવાં હુઃએ શા માટે મને ઘેરી રહ્યાં છે ? હું ધાર્ઢાં છું કાંધ અને એના કરતાં વિપરીત પ્રકારના બનાવો શા માટે મારા જીવનમાં બની રહ્યાં છે ?”

પૂજ્ય સિદ્ધસેનહિવાકરસુરીશરળ મહારાજા આ પ્રશ્નોનો ઉકેલ કલ્યાણુમંહિર સ્તોત્રમાં બતાવી રહ્યા છે. ‘જન્માન્તરેડપિ તવ પાદ્યુગં ન હેવ, મન્યે મયા મહિત ભીહિત-દાનદક્ષમુ, હે સક્લ મનવાંછિત પૂર્ણું કરવાને સર્વાર્થ એવા જિને શરૂ ભગવંત ! હે કલ્યાણવૃક્ષ ચિંતામણિ અને કામધેતુ કરતાં પણ અધિક ફળહાતા પરમાત્મા !

આપના ચરણુકમળને પૂર્વજનમમાં લાવપૂર્વક કહી  
પણ મેં સેવ્યા નથી. નહીં તો આ લવમાં મારી  
આવી હાલત કહી હોઈ રહે નહીં.

આકર્ષિતોડાપિ મહિતોડપિ નિરોક્ષિતોડપિ,  
નૂન ન ચેતસિ મયા વિધૃતોડપિ લક્ષ્યા,  
જતોડદિન તેન જનબાન્ધવ ! હુઃખ-પાત્ર,  
ચરમાત્કિયાઃ પ્રતિક્ષલન્તિ ન લાવશૂન્યાઃ !

હે કરુણાના સાગર, કૃપાના અવતાર, પરમાત્મા !  
પૂર્વજનમમાં મેં આપને સાંલજ્યા પણ છે, પૂજ્યા પણ  
છે, આપનું દર્શન પણ કર્યું છે. પરંતુ આપને લાવપૂર્વક  
હૃદયમાં મેં કહી ધારણ કર્યા નથી. તેથી જ આ લવમાં  
હું હુઃખનું લાજન બન્યો છું. અને આ જનમમાં પણ  
જે મેં આપને લાવપૂર્વક હૃદયમાં ધારણ ન કર્યા  
તો લવચક્રમાં મારો શોધ્યો કુકોડો પણ હાથ  
નહીં આવે. અનંતકાળ હુર્ગતિના ફેરા સિવાય મારી  
કોઈ ગતિ નથી. આ છે લવનો લય.

જેવી રીતે કાંટાથી કાંટાનું નિવારણ થાય છે, જેરથી  
ઓરનો નાશ કરાય છે, તેવી રીતે ભયથી લયનો નાશ  
થાય છે. સાત પ્રકારના લયનું નિવારણ કરવા માટે મહા-  
પુરુષોએ આઠમો લય બતાવ્યો તે લવભ્રમણુનો લય છે.  
સાત પ્રકારના લય આપણી વર્તમાન નાનકડી જિંહારી  
સંબંધીના છે. આઠમો-સવભ્રમણુનો લય અનંતકાળના  
આપણા લાવી સંબંધનો છે. અનંતકાળના આપણા લાવી

સંબંધી વિચાર ઉત્પન્ન થતાં વર્તમાન જીવતની પાંચ-પચચીસ વરસની નાનકડી જિંદગી સંબંધીના લય આપણું મનમાંથી નીકળી જય છે. ભવભ્રમણુનો લય તે અમૃત-કિયાતું ત્રીજું લક્ષણ થયું.

ચોથું લક્ષણ છે ભાવની વૃદ્ધિ. ભવભ્રમણુનો લય ઉત્પન્ન થતાં જ ભવભ્રમણના લયનું નિવારણ કરનારા એકમાત્ર અરિહંત પરમાત્મા જ છે. તે આપણું સર્વસ્વ અની જય છે. પરમાત્માનું દર્શન, પૂજન, વંદન, સ્તવન, ધ્યાન અને આશાપાલન કરતી વખતે ભાવોદ્વાસ વધી જય તેને ભાવની વૃદ્ધિ કહેવાય છે. હે કરુણાસાગર પરમાત્મા ! આપનું દર્શન, પૂજન, ધ્યાન કરતાં આજે હું આપની કરુણાનો પાત્ર અન્યો, આજે મારાં સર્વ હુઃખ હૌલ્લાંય નાશ પામી ગયાં, આજે સર્વ ચિંતાએ ચૂણું થઈ ગઈ, આજે સર્વ લય નાશ પામી ગયા, આજે સર્વ પાપો ફર થઈ ગયાં. આજે મહાન મહોદ્યને હું પામ્યો, આજે મને સુખશાનિત અને આનંદનો અનુભવ થયો, આજે મારા સર્વ મનોરથ પૂર્ણ થઈ ગયા, આજે આત્માના પ્રદેશો પ્રદેશો અમૃત વડે હું છાંટાયો, આજે મારા આત્માના ઈતિહાસની સુવર્ણભય પળ પ્રાપ્ત થઈ, આજે મને કલ્પ-વૃક્ષ કામધેનું અને ચિંતામણિની પ્રાપ્તિ થઈ.

આ રીતે ક્ષણે ક્ષણે આત્મામાં ભાવોદ્વાસ વધતો જતો હોય, તે છે “ભાવની વૃદ્ધિ” ઇય અમૃતકિયાતું ચોથું લક્ષણ.

પાંચમું લક્ષણું “વિસ્તરય” એટલે આશ્ર્ય.

આંધળા મનુષ્યને ચક્ષુની પ્રાપ્તિ થાય, દરિદ્રી માણસને ધનના પુંજની પ્રાપ્તિ થાય ત્યારે જેવું આશ્ર્ય થાય તેવું આશ્ર્ય પરમાત્માનાં દર્શાન વખતે થાય તે અમૃતકિયાનું પાંચમું લક્ષણું છે.

છુંં લક્ષણું પુલકું એટલે રોમાંચ.

પરમાત્માના શુણો, પરમાત્માની આપણને તારવાની અચિંત્ય શક્તિ, પરમાત્માનું સ્વરૂપ, તેનું ચિંતન કરતાં રોમરાળુ વિકુલર થઈ જાય તે રોમાંચ, અમૃતકિયાનું છુંં લક્ષણું છે.

સાતમું લક્ષણું ગમેદ એટલે આનંદ.

પરમાત્માનું પૂજન ધ્યાન વગેરે કરતી વખતે આનંદથી હૃદય ભરાઈ જાય, જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ સત્તાએ આપણા પોતાના અંદર રહેલું છે તે આત્મ સ્વરૂપનો પરમાત્માનું દર્શાન, વંદન, પૂજન, સ્તવન, ધ્યાન કરતી વખતે બતકિંચિત અનુભવ થતાં જે આનંદ અનુભવાય છે, તે અમૃતકિયાનું સાતમું લક્ષણું છે.

અમૃતકિયાના સાત લક્ષણોનુંકું પરમાત્માની પૂજા અગર ધર્મનું કોઈ પણ અનુભાન થઈ જાય છે, ત્યારે આજના કરેલા ધર્મનું ઈણ આન્દે જ પ્રાપ્ત થાય છે.

ગમે તેવો ભયંકર રોગ થયો હોય પરંતુ ઔષધમાં જે અમૃત મળી જાય છે તો બીજા કોઈ ઔષધની જરૂર

રહેતી નથી. તેમ લવચક્કમાં એક જ વખત આવી અમૃત-  
કિયા પ્રાપ્ત થઈ જાય છે તો મીંકે જવામાં કોઈ વસ્તુ  
આડે આવતી નથી.

મયણું કહે છે :-

એહેવો રે પૂજામાં સુજ લાવ,  
આવ્યો રે લાવ્યો ધ્યાન સોઢામણ્યો જુ;  
હર્ષિય ન માચે મન આણુંદ,  
બંધુ ભિણુ હોવે પુલક નિઃકારણ્યોજુ.

આજે પૂજામાં મને આવા પ્રકારનો લાવ ઉત્પન્ન  
થયો. તે લાવમાં સુંદર રીતે પરમાત્માનું ધ્યાન થયું તે  
પરમાત્માની પૂજા અને ધ્યાનનો આનંદ હજુ પણ મારા  
હૃદયમાં ઊલરાય છે. સંધ્યાકાળે કરેલી પૂજાનો આનંદ હજુ  
મધ્યરાત્રીએ પણ મારા હૃદયમાં ઊલરાઈ રહ્યો છે. ક્ષણે  
ક્ષણે અત્યારે પણ રોમાંચ થાય છે.

પરમાત્માની આરતી મંગળહીવો અને ધૂપની પૂજા,  
તથા તે પૂજા વખતની લાવના, અને તે લાવનામાં થયેલું  
ધ્યાન, અને તે ધ્યાનનો આનંદ....બધુંએ મયણુંનું અલૌ-  
કિક છે, અદ્ભુત છે, આશ્ર્યકારી છે.

મયણું પોતાની સાસુ કમળાપ્રભાને કહે છે : “હે  
માતાજી ! હે મારા વઢાલાં સાસુજી ! આજે સંધ્યાકાળે  
પરમાત્માની પૂજા કરતી વખતે મારા હૃદયમાં આવા અમૃ-  
તકિયાના લાવો આવ્યા અને તે લાવોમાં મેં પરમાત્માનું”

ધ્યાન કર્યું અને તે ધ્યાનમાં અહૃતુત આનંદ અનુભવ્યો.  
તે સંધ્યાકાળની પૂજનો આનંદ હજુ પણ મારા હૃદયમાં  
ઓભરાય છે. વિના કારણું ક્ષણું ક્ષણું રોમાંચ થાય છે.  
વળી આ અમૃતકિયા તુરત જ ઝણવાવાળી છે. તેના ઝણમાં  
આજ અને કાલ જેટલું પણ અંતર નથી.

બીજું રે અમૃતકિયા સિદ્ધિદ્ય,  
તુરત ઝેણે તિંદાં નહિ આંતરોળ;  
કુરકે રે વામ નયન ઉરોજ,  
આજ મિલે છે વાલિંલ માહેરોળ.

વળી મારું ડાખું નેત્ર અને ડાખું અંગ પણ ઝરકે  
છે. તેથી હે માતાળ ! તમે ધ્યાન દઈને સાંલળો. મારા  
પ્રિયતમ હમણું જ અહીં પધારશો.

મયણુંએ કહું કે, “મારા પ્રિયતમ હમણું જ પધા-  
રવા જોઈએ” ત્યારે સાસુ કમળપ્રભા કહે છે -

કમળપ્રભા કહે વત્સ સાચ,  
તાહરી જુલે અમૃત વસે સદાળ.  
તાહડાં રે વચન હોશે સુપ્રમાણ,  
ત્રિવિધ પ્રત્યય છે તે સાધ્યો સુધાળ.

“ હે વત્સ ! હે મારી વહાલી પુત્રવધૂ ! તું જ્યારથી  
મારા ઘરમાં આવી છે ત્યારથી નિરંતર તારા સુખમાંથી  
અમૃત જરી રહ્યું છે. જ્યારે પણ તું કાંઈ એલે છે ત્યારે સૌને  
આનંદ આપનારી બને છે. હે પુત્રી ! તું જ્યારે લગ્ન  
થા. પ્ર. ૧૦

કરીને આવી તે વખતે તારો પતિ કોઠના રોગથી ઘ્રસ્ત હતો. તે શ્રીપાલને તેં નવપહની આરાધનામાં જોડયો. નવ-પહના પ્રલાવથી શ્રીપાલની આખરું સર્વત્ર વિસ્તૃત બની, તેમાં સુખ્ય નિમિત્ત કારણું હે પુત્રી ! તું છે. તું મારા ધરની પરમ લક્ષ્મી છે. તેં આજે મન વચન અને કાચાના ચોગો પૂર્વક ત્રિવિધે ત્રિવિધે પરમાત્માની લક્ષ્ણ કરી છે. તારું વચન જરૂર પ્રમાણું થશે. તારો પ્રિયતમ તને હમણું જ પ્રાપ્ત થશે.

કરવા રે વચન પ્રિયાનું સાચ,  
કહે રે શ્રીપાલ તે બાર ઉધારિયેલુ.

જાણે પોતાની પ્રિયતમાનું વચન સત્ય કરવા માટે ન હોય ! તે રીતે ભારણાની બહાર જિલા રહીને સાસુ વહુને વાતોલાપ સાંલળી આનંદિત બનેલા શ્રીપાલ કહે છે : “ભારણું જોલો.”

“કમળપ્રલા કહે, એ સૂતની વાણી,  
મયણા કહે, જિનમત ન સુધા હુયેલુ”

તે વખતે અંદર કમળપ્રલા કહે છે : “આ તો મારા પુત્રનો અવાજ છે. અત્યારે મધ્યરાત્રીએ તે કચાંથી આવ્યો ? તે તો પરદેશ ગયેલો હતો.” મયણા કહે છે : “માતાજી ! પરમાત્માનું દર્શન કરી પણ નિષ્કળ જતું નથી ! આજે સંધ્યાકાળે જ પરમાત્માની લક્ષ્ણ કરતાં મારા હૃદ્યમાં ભાવ આવેલો તેથી મને આત્મી હતી કે આજે મારા પ્રિય-તમ જરૂર પધારશો.

મયણું ખારણું ખોલે છે. શ્રીપાલ અંહર આવી માતાના ચરણુમાં નમસ્કાર કરે છે. માતા આશીર્વાદ આપે છે. મયણું વિશેષ વિનય વડે પતિને પ્રણામ કરે છે. શ્રીપાલ મનોહર પ્રેમલર્યો વચન વડે મયણુને ખોલાવે છે.

આપણે પણ પરમાત્માની પૂજા વખતે આ અમૃત-કિયાના સાત લક્ષણોથી ભાવિત બની ધ્યાનમાં સ્થિર બનીએ તો પૂજાનાં પ્રત્યક્ષ ઝૂળ માટે આવતા લવ સુધી નહિં, આવતી કાલ સુધી પણ રાહ જેવાની જરૂર નથી.

આ રીતે અમૃતકિયાનાં આઠ લક્ષણો પૂર્વક પૂજા વખતે ધ્યાન કરવું.

હસ મગન લયે પ્રભુ ધ્યાનમેં,

બિસર ગઈ હુનિયા તનમનકી, અચિરાસુત શુનગાનમેં.

પરમાત્માના ધ્યાનમાં આપણે લીન બની ગયા. પરમાત્મા ધ્યાનના પ્રભાવથી આપણા હુઃખ, હુસોગ્ય, ચિંતા, લય, અશાંતિ હૂર થઈ ગયા. સુખ, શાંતિ આનંદનો અનુભવ થયો.....પરમાત્માના ધ્યાનના પ્રભાવથી આવું અનુભવવું. પ્રત્યેક ભાવથી ભાવિત બનવું અને અનુભવ કરવો. છેવટે આ રીતે પ્રભુના સ્તવન, શુણુગાન, તે દ્વારા થતું ધ્યાન આત્માના પૂર્ણોનંદ સ્વરૂપનો અનુભવ કરવશે. આ પદ્ધતિથી સ્તવન કરવાથી સ્તવનના ભાવોની અનુગ્રહા દ્વારા ધ્યાનમાં પ્રવેશ કરી છેવટે આત્માનુભવ સુધી પહોંચી શકાશે.

## વિશિષ્ટ આરાધકો માટે જુનલક્ષ્મિની સર્વોચ્ચ ભૂમિકા

પરમાત્માની સાથે તન્મય બનવાની પ્રક્રિયા.

અનંતકાળથી આપણી ચેતના પરપુદ્ગલ સંચોડે પુદ્ગલ અનુયાયી બની છે. આદ્ય ખંહુમાન પરપુદ્ગલનું છે. ઇચ્છિ પરપુદ્ગલમાં છે. રમણતા, તન્મયતા, તદ્ગુપતા, એકત્વતા પુદ્ગલ સાથે છે. આપણી ચેતના વિલાખ દર્શામાં પુદ્ગલ પરિણામી બનેલી છે. આ વિલાખ પરિણુતિ આપણો મૂળ ધર્મ નથી, તેથી તેનું નિવારણ કરવાનો ઉપાય કરીએ તો તે જય તેમ છે. તેનો ઉપાય વિચારતાં જો તેને આપણા શુદ્ધ સ્વરૂપ સાથે જોડવા પ્રયત્ન કરીએ તો ટકી શકીએ તેમ નથી. અને આત્મા પુદ્ગલના સંગે કર્મના બંધને વધારે છે. માટે જોમનું શુદ્ધ સ્વરૂપ ગ્રગટ થયું છે તેવા શુદ્ધ, પૂર્ણ અને પરમાત્માંદ સ્વરૂપ પરમાત્મા સાથે આપણી ચેતનાનું જોડાણું થાય તો આપણી ચેતના આત્મસ્વરૂપ અનુયાયી બને છે. અને તો જ આત્માનુભવ કે આત્મસ્વરૂપની આસ્તિ શક્ય બને છે.

અનંત કાળથી પુદ્ગલ અનુયાયી બનેલી આપણી ચેતનાને આત્મસ્વરૂપ અનુયાયી બનાવવાનો ઉપાય આપણી ચેતનાને પરમાત્મ સ્વરૂપ અનુયાયાં બનાવવી તે છે. પરમાત્માના ગુણોને રંગો રંગાયેલી આપણી ચેતના કેવી રીતે બનાવવી ? પરમાત્મ સ્વરૂપને અવલાંખેલું આપણું ચૈતન્ય

કેવી રીતે થાય? પરમાત્મ ગુણુરસિક આપણું ચેતના કેવી રીતે બનાવવી?

અનંત કાળથી જીવને પુછગલતું (જડ પદ્ધર્થનું) આદર અને બહુમાન છે. તે પલટાવીને પરમાત્મા અરિહંત દેવના ગુણો પ્રત્યે આદર બહુમાન કરવું. પરમાત્માના ગુણોના સુખ્ય ત્રણ વિલાગ છે.

પહેલો વિલાગ ઉપકાર સંપદા-પરમાત્મા કર્દણુના સાગર, કૃપાના અવતાર, દ્વારા સમુદ્ર, વાત્સલ્યના લંડાર, અશરણુના શરણ, અનાથના નાથ, અનંત જીવોના પરમ ઉદ્ધારક, મહાસાર્થકાહ, મહાગોપ, મહાનિર્યામક, મહા-માહણ આદિ ગુણોનું ભાવપૂર્વક ચિંતન કરવું.

થીજુ અતિશય સંપદા— \*૩૪ અતિશયો, ઉપ વાણીના ગુણો, પ્રાતિહાર્યો, સમોસરણુની ઋદ્ધિ આદિનું ચિંતન કરવું.

ત્રીજુ મૂલગુણુસંપદા—શુદ્ધ આત્મચૈતન્ય પ્રગટ થવાથી પરમાત્મામાં જે જે અનંત ગુણ સંપદા પ્રગટ થઈ છે તેનું ચિંતન કરવું. સ્વરૂપરમણી, સ્વરૂપલોાળી, સ્વરૂપાનંદી, અનંતગુણ સમૃદ્ધિના નિધાન, ડેવળ જ્ઞાન આદિ અનંત ગુણલક્ષ્મીના સ્વામી, અચિંત્ય શક્તિના લંડાર, અનંત વીર્ય આદિ ગુણોથી યુક્તા, એકાંતિક,-આત્માંતિક-અનંત-અવ્યાખાધ-સ્વતંત્ર-સ્વાધીન એવા પરમ સુખથી પરિપૂર્ણ-

---

\* અતિશયો, પ્રાતિહાર્યો આદિનું વર્ણન આ પુસ્તકમાં છેલ્લા ૩૪ મા પ્રયોગમાં છે.

પરમાત્મસ્વરૂપને વિચાર કરતાં જીવનું અનંત  
કાળનું પુણ્યગલ ઉપરનું આદર બહુમાન પદ્ધટાઈને  
પરમાત્મા ઉપર આદર બહુમાન થાય છે.

માહરો આત્મા તુ જ થકી નિપજે,  
માહરી સંપદા સયલ મુજ સંપજે;  
તેણે મનમંહિરે ધર્મ પ્રભુ ધ્યાઈએ,  
પરમ દૈવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ.  
શ્રી દૈવચંદ્રજી કૃત ધર્મનાથ ભગવાનનું સ્તવન.

હે વીતરાગ, સર્વજ્ઞ અરિહંત પરમાત્મા ! તમારા  
નિમિત્તે જ મારું અવ્યાખાધ સુખ મને પ્રાપ્ત થશે.  
તમારા નિમિત્તે જ હું મારા આત્માની પૂર્ણતાને પ્રાપ્ત  
કરી શકીશ. તે સિવાય બીજે કોઈ ઉપાય નથી. મારા  
પરમાનંદને પ્રાપ્ત કરવા માટે હે અરિહંત પરમાત્મા !  
તમે એક જ આધાર છો, પ્રાણુ, ત્રાણુ, શરણ છો.

માહરે પૂર્ણાનંદ, પ્રગટ કરવા લણી રે;  
પુષ્ટાલંબન રૂપ સેવ પ્રભુજી તણી રે.  
દૈવચંદ્ર જીતચંદ્ર ભક્તિ મનમેં ધરો રે;  
અવ્યાખાધ અનંત અક્ષયપદ આહરો રે.  
શ્રી દૈવચંદ્રજી કૃત મલિનનાથ સ્તવન.

આ રીતે આપણું પૂર્ણાનંદ સ્વરૂપ પ્રગટ  
કરવા માટે અરિહંત પરમાત્મા જ પુષ્ટાલંબન  
છે તેવો હદ નિર્ધાર કરી દ્વારિ પરમાત્મામાં કરવી.

દ્વિચિ અનુયાયી વીર્ય થાય છે તેથી દ્વિચિ પરમાત્મામાં થતાં વીર્ય સંકુરણું પરમાત્મ લક્ષિતને વિષે થશે.

પ્રભુ સુદ્રાને ચોગ પ્રભુ પ્રભુતા લખે,  
દ્રબ્ધતણે સાધ્યમ્ય સ્વસંપત્તિ ઓળખે;  
ઓળખતાં બહુમાન સહિત દ્વિચિ પણ વધે,  
દ્વિચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે.

શ્રી હેવચંડજી કૃત સુવિધિનાથ ભગવાનનું સ્તવન.

જીવને જ્યારે અનંતકાળે મહાપુણ્યોદ્યે અનંત કર્મનો નિગમ થતાં અરિહંત પરમાત્માનો મીળાપ થાય છે, અરિહંત પરમાત્માના સ્વરૂપની ઓળખાણ થાય છે. ત્યારે કેવું પરમાત્માતું સ્વરૂપ છે, તેવું જ સ્વરૂપ સત્તાએ પોતાના અંદર રહેલું છે તેની સલાનતા થાય છે. પ્રભુની પ્રભુતાની ઓળખાણ થતાં પોતાની અંદર પણ તેવી જ અંધાભાધ સુખ, પરમાનંદ, અનંત શક્તિ, કેવળજ્ઞાન આદિ શુણું લક્ષ્મી રહેલી છે તેનું ભાન થાય છે. અને તે સ્વરૂપ (સત્તા) પ્રાપ્ત કરવાની ઉંખના થાય છે. કહ્યું છે કે—

દીઠા સુવિધિ જીણું દ સમાધિ રસે લયો,  
ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસયો;  
સકલ વિલાલ ઉપાધિ થડી મન ઓસયો;  
સત્તા સાધન માર્ગ ભણ્યો એ સંચયો.

શ્રી હેવચંડજી કૃત નવમા ભગવાનનું સ્તવન.  
આત્માના અનંત આનંદ અને સુખને પ્રાપ્ત કરવાની

તीવ્ર અંખના થતાં તે માટેના પરમ કારણું પરમાત્મા પોતાનું સર્વસ્વ બની જાય છે. એ જ આપણા ભાતા, પિતા, નેતા, બંધુ, પ્રાણુ, ત્રાણુ, શરણુ, આધાર ઇપ લાસે છે. ઇચ્છિ પરમાત્મામાં, વીર્ય સ્કુરણું પરમાત્મ લક્ષ્ણિતમાં, રમણુતા પરમાત્માના સ્વરૂપમાં, તન્મયતા, તદ્દૂપતા અને એકત્વતા પરમાત્મામાં ઉત્પન્ન થાય છે. અને તે એકત્વતા પ્રલુસાથે ઉત્પન્ન થતાં પરમાનંદની પ્રાપ્તિ થાય છે.

કહ્યું છે કે :—

સહજ અકૃત્રિમ નિર્મણ જ્ઞાનાનંદને,

દૈવચંદ્ર એકત્વે સેવનથી વરે રૈ લોલ.

આ પ્રમાણેનો માર્ગ જોતાં અર્થિત પરમાત્માના ધ્યાનની સાધનાનો કુમ નીચે મુજબ નક્ષી થાય છે.

(૧) આદર (૨) બહુમાન (૩) ઇચ્છિ (૪) વીર્ય-  
સ્કુરણું (૫) રમણુતા (૬) તન્મયતા (૭) તદ્દૂપતા  
(૮) એકત્વતા.

આ આઠ સ્ટેજની સાધના પરિપૂર્ણ બને છે.

હક્કીકતમાં આપણું ક્ષયોપશમલાવી બે આત્મ-  
ગુણો ખુલ્લા છે તેને પ્રલુની પ્રલુતા સાથે જોડવા તે  
આપણી સાધના છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય આદિ  
આપણું આત્માના ગુણો ક્ષયોપશમ લાવે અત્યારે અંશત:  
ખુલ્લા છે. દર્શન એટલે ઇચ્છિ, જ્ઞાન એટલે જાળવું,  
ચારિત્ર એટલે રમણુતા કરવી, વીર્ય એટલે શક્તિ ફોરવવી,

આ અધી આત્મશક્તિ અત્યારે વિલાવ દર્શામાં પર પુછગલ અનુયાયી, પુછગલ પરિણામી અનેલી છે. બહુમાન પુછગલનું છે, ત્યાં પુછગલમાં છે, રમણીતા પુછગલમાં છે. પરંતુ જીવનમાં જ્યારે અરિહંત પરમાત્મા પરમ નિમિત્ત મળે છે. અને જીવ જ્યારે પરમાત્માને સર્વસ્વ માની પોતાના ક્ષયોપશમલાવી ગુણોને પરમાત્મામાં જોડે છે, એટલે કે ત્યાં ( દર્શાન ગુણ ) પરમાત્માના સ્વરૂપમાં, જીબન ( જીબન ) પરમાત્માના ગુણોનું, રમણીતા ( ચારિત્ર ) પરમાત્માના ( સ્વરૂપ ) ગુણોમાં, વીર્યશક્તિ પરમાત્મ લક્ષ્ણ-ધ્યાન આદિમાં જોડે છે ત્યારે-પરમાત્મ સ્વરૂપ અનુયાયી ચૈતના બને છે. પરમાત્મ ગુણોના રંગો રંગાયેલી આપણી ચૈતના બને છે. પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચૈતન્ય બને છે. કહ્યું છે કે :—

દર્શાન જીબનાદિક ગુણ આત્મના, પ્રભુ પ્રભુતા લયલીન,  
શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી, તસુ આસ્વાદન પીત.

પૂજના તો કિને બારમા જીન તણી.

શ્રી દેવચંડજી કૃત બારમા લગ્વાનનું સ્તવન.

આ રીતે આત્મના ક્ષયોપશમલાવી ગુણો દર્શાન, જીબન, ચારિત્ર, વીર્ય આદિ પ્રભુની પ્રભુતામાં લીન બને છે ત્યારે-શુદ્ધ આત્મ ચૈતન્યને પ્રાપ્ત થયેલા પરમાત્માના સ્વરૂપમાં ત્યાં, રમણીતા, તન્મયતા, તરૂપતા, એકત્વતા આપ્ત થાય છે.

શુદ્ધ તત્ત્વ રસ રંગી ચૈતના, પામે આત્મ સ્વલાવ;

આત્માલંધી નિજ ગુણ સાધતો, પ્રગટે પૂજય સ્વલાવ.

આ રીતે શુદ્ધ નિર્મલ તત્ત્વ શ્રી અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન તેના રસમાં આપણું ચૈતન્ય જ્યારે રંગાય છે, એટલે પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચૈતન્ય જ્યારે બને છે, ઉપરોગ સંપૂર્ણપણે પરમાત્મ સ્વરૂપને અવલંબેલો હોય છે, ત્યારે ઉપરોગથી આપણો આત્મા અલિન હોવાથી આત્મસ્વરૂપમાં ડ્રચિ (સમ્યગુ દર્શન), આત્મસ્વરૂપમાં ઉપરોગી (જ્ઞાન), આત્મસ્વરૂપ રમણી (સમ્યગુ ચારિત) આપણો આત્મા બને છે. આત્મ અનુભવનો પરમ આનંદ ત્યારે અનુભવાય છે તેનો દિવ્ય પ્રયોગ નીચે મુજબ છે.

**પરમાત્મ લક્ષ્ણિતના આડ સ્ટેજ ક્રારા આત્મા-  
નુભવનો પ્રયોગ : નં. ૧૮**

આંખ બાંધ કરીને પરમાત્મા આપણી સામે બિરાજમાન છે તેવું દર્શય જોવું. નીચે મુજબ અનુભવ કરતા જવું અને આગળ વધવું. પરમાત્માના અનંત ગુણોના સ્વરૂપને આપણે ચાહ કરીએ છીએ.....ઉપકાર સંપર્દા, અતિશય સંપર્દા અને મૂળ ગુણું સંપર્દાના પરમાત્માના અનંત ગુણોનું ચિંતન કરવું અને આપણા મૂળ ચૈતન્યના પરમાનંદ સુધી પહોંચાડવાની પરમાત્માની દિવ્ય શક્તિથી ભાવિત બનવું. આ રીતે ભાવિત થવાથી આપણુંને પ્રભુ પ્રત્યે (૧) અત્યંત આદર અને

(૨) બહુમાન ભાવિત થાય છે.....અત્યારે પરમા-

- તમાના આદર અને બહુમાનવાળી આપણી ચેતના  
છે....( આવું અનુભવવું.)
- (૩) પરમાત્માના સ્વરૂપ પ્રત્યે અંતરંગમાં ઝાંચી એમ  
ઉત્પન્ત થાય છે..... ( આવું અનુભવવું.)
- (૪) આપણી વીર્યશક્તિ પરમાત્મા પ્રત્યે સ્કુરાયમાન  
થાય છે.
- (૫) પરમાત્માના ગુણોમાં રમણુતા થાય છે.....  
.....આવું અનુભવવું. .... પરમાત્માના સ્વરૂપમાં  
રમણુતા થઈ રહી છે.
- (૬) અત્યારે આપણે પરમાત્માના સ્વરૂપમાં તન્મય છીએ.
- (૭) આપણે પરમાત્મામાં તર્દૂપ બની જઈએ.
- (૮) ધ્યાનમાં પરમાત્મા સાથે એકત્વ થયું છે.

આપણી ચેતના પરમાત્મામાં તહાકાર ઉપયોગે  
પરિણામ પામી ગઈ છે. કે રીતે ઝ્વધમાં સાકર ઓગળી  
જાય તે રીતે અત્યારે આપણું મન પરમાત્મામાં ઓગળી  
ગયું છે.

અત્યારે આપણી ચેતના સંપૂર્ણપણે પરમાત્મ સ્વરૂપને  
અવલંબેલી છે. અત્યારે આપણો ઉપયોગ ( ધ્યાન )  
સંપૂર્ણપણે પરમાત્મામાં લીન છે..... ( ધ્યાન કરવું.)  
આવી સ્થિતિ શ્રાડી વાર સ્થિરતાપૂર્વક અનુભવવી.)

પૂર્ણ પણે ઉપયોગ પરમાત્માના ધ્યાનમાં લેડેલો  
રાખવો .....

પરમાત્મ સ્વરૂપમાં સંપૂર્ણ લીનતા આવવાથી પરમાત્મા સાથે એકત્વ-અસેહ દ્વારા ચાલી રહ્યું છે.

જે ઉપરોગમાં આપણે લીન બનીએ છીએ તે આકાર-વાળો આપણો આત્મા થાય છે. તેથી હવે અત્યારે આપણો આત્મા અરિહંત આકારવાળો બન્યો છે. (આવું અનુભવવું.) (ઉપરોગથી ઉપરોગવાન આત્મા અસિન છે.)

હવે અરિહંતમાં લીન બનેલા અને તેથી અરિહંત આકારવાળા આપણો આત્માને આપણે લેઇએ છીએ.....

અરિહંત આકારવાળા બનેલા આપણો આત્માનું આપણે દ્વારા કરીએ છીએ. આપણો ઉપરોગ, “અરિહંત આકારવાળા બનેલા આપણો આત્માના સ્વરૂપમાં” સ્થિર બનવાથી આત્માનુભવની સ્થિતિમાં આપણે અત્યારે છીએ..... (આવું અનુભવવું.)

પરમ આનંદ અને સુખનો અનુભવ થઈ રહ્યો છે ....  
..... થોડી ક્ષણું આ સ્થિતિમાં સ્થિર બનવું.....  
ઉપરોગ બહલાય તો ઇરી ઇરી સ્થિર કરવા પ્રયત્ન કરવો.  
..... પ્રયત્ન ચાલુ રાખવો.....આત્માના અનુભવની સ્થિતિમાં અત્યારે આપણું ચૈતન્ય છે.....  
..... પરમ આનંદ અને સુખ આપણે અનુભવી રહ્યા છીએ.

આનંદ અમૃતરસ પીવો..... ઇરી ઇરી પીવો.  
..... અમૃતથી લરાઈ જશો.

ઉં શાન્તિ શાન્તિ શાન્તિ....

પરમાત્માના પૂર્ણ ગ્રકાશના આદિબને સ્વ આત્મ ના દુષ્ય સ્વરૂપનું દર્શાન થતું તે જ સાચો નમસ્કાર છે, તેને જ સાચો પુરુષાર્થ કહેવાય છે. તેનું જ જીવન ધન્ય છે કે જે પરમાત્માના આદિબને સ્વ આત્માનો અનુભવ કરે છે.

તે જ મહાન આત્માઓનું જીવન ધન્ય છે, જે અરિહંત આહિ પદોના ઉપરોગમાં સદ્ગ લીન છે.

તે જ સાચી સાધના છે, જેમાં પરમાત્માનું આદિબને તેના આધારે પોતાના આત્માનું અરિહંત, સિદ્ધ લગવંત રૂપે ધ્યાન કરવામાં આવે છે.

અહીં પ્રશ્ન થાય છે કે જે આપણો આત્મા અરિહંત કે સિદ્ધ નથી તો જે જેવો નથી, તેમાં તેવાની માન્યતા રૂપ ભાન્તિ તો નથીને ?

આ પ્રશ્ન અને ઉત્તર અક્ષરશઃ “નમસ્કાર સ્વાધ્યાય પૃ. ૨૩૦ માં નીચે મુજબ છે.

તન્નચોદ્યं યતોऽસ્વાભિર્ભવિંહન્નયમર્પિતः ।

સ ચાર્હદ્ધ્યાનનિષ્ઠાત્મા, તત્સ્તત્ત્વૈવ તદ્ગ્રહઃ ॥૧૮૯॥

પરિણમતે યેનાત્મા ભાવેન સ તેન તન્મયો ભવતિ ।

અર્હદ્ધ્યાનાવિષ્ટો ભાવાર્હન् સ્યાત્સ્વર્યં તસ્માત ॥૧૯૦॥

યેન ભાવેન યદ્ર રૂપું ધ્યાયત્યાત્માનમાત્મવિત ।

તેન તન્મયતાં યાતિ, સોપાધિઃ સ્ફટિકો યથા ॥૧૯૧॥

તત્ત્વાનુશાસન શ્લોક ૧૮૮-૧૬૦-૧૬૧

આ શલોકેનું તાત્પર્ય એ છે કે ઉપર જે શાંકા કરી તે કરવા ચોગય નથી. આરણુ કે અમે અમારા આત્માની ભાવ-અરિહંત ઇપે અર્પણા (ચિંતવના) કરીએ છીએ. અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા તે આગમથી ભાવ-અરિહંત છે, તેથી અતતમાં તદ્દ્વારાદ્વારા ભાન્તિ નથી, કિન્તુ તતમાં (તેમાં) જ તતની (તેની) વથાર્થ માન્યતા છે. ૧૮૬.

જે (અરિહંતાદિ) ભાવ વડે આત્મા પરિણમે છે તે (અરિહંતાદિ) ભાવ વડે તે આત્મા તન્મય (અરિહંતાદિમય) બને છે; તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા તે (અરિહંત ભાવ) થકી પોતે જ ભાવઅરિહંત થાય છે. ઉપાધિ સહિત એવા સ્ક્રિટિક રત્નની જેમ આત્મજ્ઞ પુરુષ જે (અરિહંતાદિ) ભાવ વડે જે (અરિહંતાદિ) ઇપે આત્માનું ધ્યાન કરે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તન્મયતા (તદ્દ્વારાદ્વારા)ને પામે છે, (અર્થાત્ જેમ સ્ક્રિટિક-મણિ પોતાની સામે રહેલી વસ્તુનું ઇપ ધારણુ કરે છે, તેમ આત્મા પણ ધ્યાન વડે ધ્યેયમય બને છે.) ૧૬૦-૧૬૧.

આ રીતે અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. આ વાત જાળ્યા પછી એક ક્ષણુ પણ આપણે અરિહંત પરમાત્માના સમરણુ, જપ કે ધ્યાન સિવાય રહી શકતા નથી. પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની એકાચ્ચતા, ઉપ-ચોગની સ્થિરતા કરવાની છે, દ્વાર્ધમાં સાકર ઓગળી જય, તેમ મનને પરમાત્મામાં ઓગળી હેવાનું છે. અને એ રીતે

આપણા આત્મમાં શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ થાય, તે લક્ષ્યબિંદુને સિદ્ધ કરવાનું છે.

તે માટે પૂર્વોચ્ચાયોએ અગાધ પ્રયત્ન કરેલો છે.

ભગવાન શ્રી હરિલદ્રસૂરિજી મહારાજ “બોડશક પ્રકરણ” નામના અંથમાં ફરમાવે છે કે —

આ જિનેશ્વર ભગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વ પ્રયોજન સિદ્ધ થવાનું કારણ એ છે કે આ શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય છે.

આ સમરસાપત્તિ યોગીઓની માતા છે, અને નિર્વાણુ દળની પ્રસાધક છે. આત્મા જ્યારે સર્વજ્ઞના સ્વરૂપમાં ઉપયોગવાળો બને છે, ત્યારે તેનો અન્યત્ર ઉપયોગ ન હોવાથી તે સ્વયં સર્વજ્ઞ જેવો થાય છે. એવો નિયમ છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વર્તે છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણ કરે છે.

( નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ૨૬૩ )

આ રીતે પરમાત્મ-સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણું પૂરતું આપણું ચૈતન્ય આગમથી ભાવ-નિષ્ઠાપે પરમાત્મ-સ્વરૂપ બને છે. જે એકાઈ ક્ષણું પૂરતું પણ આપણું ચૈતન્ય પરમાત્મરૂપ આ રીતે બનતું હોય તો તેથી વધુ આપણું આ જીવનમાં શું કમાઈ શકવાના હતા? અર્થાતું સૌથી વધુ કમાણીને આ વ્યાપાર છે, તેને છાડીને આંદો વ્યાપાર કરવો તે કદ્યવૃક્ષને છાડીને બાવળિયાને પકડવા જેવું છે.

આ રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન જગતની  
સરોવર્ય સ્થિતિ પરમાત્મ-પદની ગ્રાહિ સુધી પહોંચાડનારું  
છે. Meditation on Most High છે. માટે જ કલ્યાણ છે કે,

તાહું ધ્યાન તે સમકિત દૃપ,

તેહિ જ જાનને ચારિત્ર તેહ છે જ,

તેહથી જાયે સધળાં હો પાય,

ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોય પછે જ.

ઉપાધ્યાય યશોવિજ્યજી મં ૨૦ કૃત-શાંતિનાથ લગ્વાનાનું સ્તવન.  
અરિહંત પરમાત્માનું ધ્યાન સમ્યગુ દર્શન, જાન  
અને ચારિત્ર દૃપ છે. તેનાથી સર્વ પાપનો નાક્ષે  
થાય છે અને ધ્યાતા પોતે ધ્યેય એટલે પરમાત્મ-  
સ્વરૂપને પામે છે.



### મનની ચંચળતાનું રહસ્ય

જ્યાં સુધી મનને સાચી જગ્યા મળતી નથી, ઠરીને  
ડામ બેસતું નથી, ત્યાં સુધી તેના માટે સાચી જગ્યા  
અરિહંતના ચરણુકમળ છે. એકવાર જુનના ચરણુકમળના  
સેવનથી અનુભવ રસનો પરમ આનંદ ચાપ્યો તે પછી મન  
હોડાહોડી છાડી દેશો. અમીરસનો કટોરો મળ્યા પછી જેર પીવા  
કોણું તૈયાર થશે !

સાચું સુખ, શાન્તિ કે આનંદ જગતના પદાર્થોમાં  
નથી પરંતુ આત્મા અને પરમાત્માના મિલનમાં છે.  
Super most art is to realise oneness with Supreme Power.

## ગ્રયોગાત્મક ધ્યાનાલ્યાસ

**પરમાત્માની મૂર્તિનું ધ્યાન થાને રૂપસ્થ ધ્યાન**

**(૧) દર્શનમાં ધ્યાન—**

ખુદ્વા નેત્રથી પરમાત્માનું દર્શન કરવું.

મનને દર્શનમાં રૈકી રાખવું.

વિચારની શાંત અવસ્થા અને આનંદનો અનુભવ.

**(૨) ધ્યાનમાં દર્શન.**

આંખ બંધ કરીને પરમાત્માનું દર્શન કરવું.

(વારંવાર અલ્યાસ કરવો.)

દર્શનમાં ચેતન્ય જાગૃત થતાં, હાલતાં, ચાલતાં, ઓલતાં, હૃદયમાં બિરાજમાન, આપણી સામે એકમેક ભળી જતા પરમાત્માનો અનુભવ.

**(૩) પૂજામાં ધ્યાન—**

અલિષેક, કેસર, મુદ્ય પૂજામાં ધ્યાન અતાંયા મુજબ કરવું.

**(૪) ધ્યાનમાં પૂજા દ્વારા વિશિષ્ટ અનુભવ અને લાવના કરવી.**

**(૫) સ્તવનમાં ધ્યાન—**

A સ્તવન ગાતી વખતે તેની પંક્તિના લાલોમાં પ્રભુ-લક્ષ્મિ અને ધ્યાનના રસનો અનુભવ કરવો.

B પરમાત્માના સ્તવન દ્વારા ધ્યાન અને ધ્યાન દ્વારા આત્માનુભવ સુધી પહોંચવું.

- (૬) અમૃતકિયાના આઠ લક્ષણો પૂર્વક પૂળ અને ધ્યાન કરવું.
- (૭) પરમાત્મ સ્વરૂપને અવલાયેલું આપણું ચૈતન્ય, પરમાત્માના શુણુના રંગે રંગાયેલી આપણી ચૈતના પરમાત્મ શુણુ રસિક બનાવવી.
- (૮) તે માટે આદર, અહુમાન, ઝચિ, વીર્યસ્કુરણા, તન્મયતા, તદ્ગૂપતા, ઓક્તવ આ સ્ટેજની સાધનાનો પ્રયોગ કરવો.
- (૯) આ પ્રયોગ દ્વારા આત્માના અનુભવનો પરમાનંદ પ્રાપ્ત કરવો.



ગુરુ વિના જાન નથી જાન વિના શ્રદ્ધા નથી.  
શ્રદ્ધા વિના લક્ષ્ણ નથી. લક્ષ્ણ વિના મુક્તિ નથી.  
માટે અધ્યાત્મ મૂળમાં ગુરુ છે. ગુરુનો યોગ પરમ-  
ગુરુ પરમાત્માનો સંખ્યાંધ કરાવી આપે છે.

ॐ ह्लौं अहौं नमः

## सालंणन ध्यानना प्रयोगो॥

पाठ चेत्यो।

प्रयोग नं. १६ :-

साधनाना प्रयोगो खाणके माटे खास.

( सर्वने लागु पಡे छे. )

मानी जोदमां खाणकनी जेम हुं ग्रभुती जोदमां  
ऐठो छुं..... ( आवुं दश्य जेवुं. )

मने परमात्मानुं असीम वात्सल्य प्राप्त थयुं छे.  
..... ( परमात्माना वात्सल्य रसमां आपणे रनान  
करीचे छीचे..... अवुं अनुलववुं. )

( परमात्मा मारा मस्तक उपर हाथ फेरवी रह्या  
छे तेवुं अनुलववुं. )

तेथी हुं पूर्णपणे आपति रहित अन्यो छुं.....  
( आंतर मन सुधी आ विचार ओढे उतारवो. ) ( ओटो  
सज्जेसन छे. )

मारां सर्व रोग, शोक, हुःअ, कथ, चिंता याव्यां  
गयां छे..... ( ओटो सज्जेसन छे. )

મારા અંદર સુખોની વર્ષી થઈ રહી છે.....  
 ( આંતર મન સુધી આ વિચાર જીંડો ઉતારીને તેવો જ  
 અનુભવ કરવો. )

હું આનંદથી ગદગદિત થઈ ગયો છું.....  
 ( આનંદ મન સુધી આ નિચાર જીંડો ઉતારીને તેવો જ  
 અનુભવ કરવો. )

પરમાત્માના પ્રકાશથી મારા રૈમેરોમ પુલકિત થઈ  
 ગયાં છે..... ( આંતર મન સુધી આ વિચાર જીંડો ઉતારીને તેવો જ  
 અનુભવ કરવો. )

હું પરમ શાંતિનો અનુભવ કરી રહ્યો છું.....  
 ( આંતર મન સુધી આ વિચાર જીંડો ઉતારીને તેવો જ  
 અનુભવ કરવો. )

મારા જીવનનો હોર મેં પ્રભુના હાથમાં સેંપી દીધો  
 છે.....( આવો સંકદ્ય કરવો. )

પરમાત્માની કરુણા સદ્ગતા અને સર્વત્ર વરસી રહી છે,  
 તે પ્રભુની કરુણામાં જ હું નિરંતર વસું છું.....  
 તેથી સદ્ગતા સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતામાં છું.....  
 ( આવું અનુભવવું. )

( હૃદયની જીંડી શ્રદ્ધા જ ફોળે છે. શ્રદ્ધા અને વિશ્વાસ  
 નહીં કદ્યેલાં શુલ પરિણામો લાવે છે. )

નીચેનું ગીત ગાવું ( સમર્પણ ગીત ).

૧ અથ સેંપ દીયા ઈસ જીવનકો, લગવાન તુમહારે ચરણોંમેં,  
 મેં હું શરણાગત પ્રભુ તેરા, રહો ધ્યાન તુમહારે ચરણોંમેં: (૨)

- २ मेरा निश्चय वस एक वही, मैं तुम यरणोंका पूजनी भत्तुं,  
अपर्णु कर हुं हुनियासरका, सब खार तुम्हारे यरणोंमें (२)
- ३ जे जगमें रहुं ते एसे रहुं, जयुं जलमें इमलका झूल रहे,  
है मन वच काय छूट्य अपर्णु, लगवान तुम्हारे यरणोंमें (२)
- ४ जहां तक संसारमें अमणु कर, तुझ यरणोंमें लुवन के धर;  
तुम स्वामि मैं सेवक तेरा, धर ध्यान तुम्हारे यरणोंमें (२)
- ५ मैं निर्बय हुं तुझ यरणोंमें, आनंद मंगल है लुवनमें,  
आतम अनुलवकी संपत्ति, मिल गर्छ है प्रभु तुझ लक्ष्मि (२)
- ६ मेरी इच्छा वस एक प्रभु, एक खार तुझे मिल जाउं मैं,  
इस सेवककी एक रगरगका, हो तार तुम्हारे हाथोंमें (२)  
निद्रा लेती वर्खते लगवानना खोणामां माथुं मूँझीने  
उंधी जवुं.

बाणको माटे ध्यान प्रयोगो :—

शीज पाठमां प्रयोग नं. ८ :

आंख बांध करी नवकारना अक्षरो जेवानो प्रयोग  
ते बाणकने पछु लागु पड़ी शके तेवा छे.

शीज पाठमां प्रयोग नं. १२ :

भुद्वा नेत्रथी लगवानतुं दर्शन.

प्रयोग नं. १३ : आंख बांध करीने लगवानना दर्शन माटेनो  
प्रयोग.

उपरना तरणे प्रयोगो बाणको माटे करी शकाय  
तेवा छे. पाठशालामां पछु उपरना ध्यानना चित्रो  
राखी प्रयोग शीघ्रवाडी शकाय.

ॐ ହଁ ଅହଁ ନମः

## સાલંખન દ્યાનના પ્રચોગો

પાઠ પાંચમો

### દ્યેય-લક્ષ

૨૦૧૭ના ચૈત્ર મહિનાની લીલડીયાજુ મહાતીર્થમા શાશ્વતી ઓળિની આરાધનાનો મહામંગળકારી પ્રસંગ છે. ત્યાં અધ્યાત્મ ચોણી પં. લદ્રંકર વિજયજુ મહારાજની પરમ પાવનકારી નિશ્ચામાં શાશ્વતી ઓળિનું આરાધન ચાલી રહ્યું છે.

\*‘સાધક’ પૂજ્ય શુલ્ક મહારાજના પ્રવચનોથી ખૂબું પ્રલાવિત થયેલ છે. હજુ સાધકને પૂજ્ય શુલ્ક મહારાજનો પ્રથમ પરિચય છે. છતાં પૂ. શુલ્ક મહારાજની મહાનતા, વાત્સ-દ્વયલાવ અને અધ્યાત્મમની ઉચ્ચય અવસ્થાના પ્રલાવથી સાધકના હૃદયમાં પવિત્ર લાવોનું ખીજારોપણ શરૂ થયું છે.

---

\* પૂ. પં. લદ્રંકર વિજયજુ મહારાજને પૂ. શુલ્ક મહારાજના ટૂંકા નામથી સંભોધન કરવામાં આવશે અને આ પુસ્તકના લખનાર બાબુભાઈ કરીવાળા તે ‘સાધક’ના ટૂંકા નામથી સંભોધન કરવામાં આવશે.

આ ઓળિમાં જ ૨૦૧૫ના ચૈત્ર સુહ ૧૩ ના અપેણે  
એક વિશિષ્ટ પ્રસંગ બન્યો—

પ્રશ્નો ‘સાધક’ — જીવનનું લક્ષાંક શું રાખવું ?

ઉત્તરો પુ. શુરુ મહારાજ — અનંત ઉપકારી  
જિનેશ્વર ભગવાનોએ “આત્મ સ્વરૂપની પ્રાપ્તિ”  
એ જીવનનું લક્ષાંક બતાવ્યું છે. સંપૂર્ણપણે “આત્મ  
સ્વરૂપની પ્રાપ્તિ” આ જન્મમાં શક્ય નથી, અપેક્ષિત સામચ્ચી  
પ્રાપ્ત થયે બીજી જન્મમાં થશે. વર્ત્માન જીવનનું  
લક્ષ્યબિનનુ “આત્મ સ્વરૂપનો અનુભવ કરવો”  
તે રાખવું. ભગવાનના દર્શાન, પૂજનથી માંડીને સંયમ-  
જીવન સુધીની બધી ઘર્મ અવૃત્તિનું લક્ષાંક “આત્મ  
અનુભવ” પ્રાપ્ત કરવો તે છે.

સાધક :— તે લક્ષાંક શા માટે રાખવું જોઈએ ?

પુ. શુરુ મહારાજ —

જીવની પાંચ મુખ્ય ઈચ્છાઓ છે :-

(૧) જીવની પહેલી ઈચ્છા જીવવાની છે. એકસે  
વર્ષની ઉંમર થઈ હોય, છતાં થોડું વધારે જીવવા માટે મનુષ્ય  
પ્રયત્ન કરે છે. દેવદોકમાં પદ્યોપમ, સાગરોપમનાં આચુષ્ય  
હોય છે, છતાં મૃત્યુ આવે છે તે ગમતું નથી. સૌથી મોઢું  
આચુષ્ય અનુત્તાર વિમાનવાસી દેવોને હોય છે, છતાં ત્યાં  
પણ મૃત્યુ આવે છે. જીવની સૌથી પ્રયત્ન ઈચ્છા ‘જીવવાની  
છે’, છતાં તે કઢી પૂરી થતી નથી. મૃત્યુ કચારે પણ ન

આવે અને શાંક્ત જીવન મળે તે માટે આપણું મૂળભૂત આત્મસ્વરૂપ પ્રગટ કરવું જરૂરી છે. આપણું આત્મસ્વરૂપ અગટયા પછી જ અજરામર શાંક્ત જીવન મળે છે અને આપણી શાંક્ત જીવનની ઈચ્છા પૂરી થાય છે.

(૨) જીવની બીજી ઈચ્છા જ્ઞાન મેળવવાની છે. આપણે આખું ભારત રેણી આવીએ, છ અંદની પૃથ્વીતી પ્રહ્રક્ષણા કરી આવીએ, તો પણ નવું જાણવાની (જ્ઞાન મેળવવાની) ઈચ્છા પૂરી થતી નથી. અભિલ અલ્હાંડ ઝૂંઢી વળીએ તો પણ જ્ઞાન મેળવવાની ઈચ્છા સંપૂર્ણ થતી નથી. આપણી અંદર એક જ્ઞાન એવું એહું છે કે જેના વડે સર્વ જીવ અને સર્વ પુદ્ગલના ત્રણ કાળના સર્વ પથ્યોને એક સમયમાં જાણી શકાય. આ લોકલોક પ્રકાશક જ્ઞાન પ્રગટ થયા સિવાય જીવની જ્ઞાન મેળવવાની ઈચ્છા કરી પણ પૂરી થતી નથી. માટે ‘જ્ઞાન મેળવવાની ઈચ્છા’ પરિપૂર્ણ કરવા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે.

(૩) જીવની ત્રીજી ઈચ્છા સુખ મેળવવાની છે. જીવને એવા સુખની ઈચ્છા છે કે ભારા કરતાં કોઈની પાસે અધિક સુખ ન હોય નેઈ એ. આપણી પાસે એક કોડ છે, પણ ભાજુવાળા પાસે સવા કોડ છે; તો આપણે એક કોડનું સુખ લોગવી શકતા નથી. વળી આપણે એવું સુખ નેઈ એ છે કે જે મહિયા પછી કરી પણ જય નહીં અને જેમાં જરા પણ હુઃખનું મિશ્રણ ન હોય. આવા સુખની પ્રાપ્તિની

તીવ્ર ઈચ્છા જીવને હોય છે, પણ તે કહી પૂરી થતી નથી. અનંત અધ્યાત્માધ સુખનો પરમ લંડાર આત્મામાં પરિપૂર્ણ રહેલો છે. સિદ્ધના જીવોને કોઈ ને ઓછું કે અધિક સુખ હોતું નથી. અધાને સરખું હોય છે. તે મળ્યા પછી કહી પણ જતું નથી, તેની વચ્ચે કહી પણ હુઃખ આવતું નથી. સિદ્ધભગવતોના જેવું જ અનંત સુખ આપણા આત્મામાં રહેલું છે. આવું આપણું આત્મસ્વરૂપ પ્રગટ કરીએ તો જ સુખ મેળવવાની ઈચ્છા પરિપૂર્ણ થાય છે.

(૪) જીવની ચોથી ઈચ્છા સ્વતંત્ર અનવાની છે. આપણે પરતંત્રતામાંથી છૂટવા રાતદિવસ પ્રયત્ન કરીએ છીએ. અધી જ બાધ્ય સ્વતંત્રતા મેળવ્યા પછી પણ આ શરીરનું બંધન એવા પ્રકારનું છે કે શરીર માટે રોટલી જોઈએ. તે માટે અનાજ જોઈએ. તે માટે પૈસા જોઈએ. ઘઉં પકવનાર જોઈએ. રોટલીનો બનાવનાર જોઈએ. આમ શરીર છે ત્યાં સુધી પરતંત્રતા રહેવાની જ. માટે આપણું અશરીરી મૂળ સ્વરૂપ પ્રગટ કરવાનું છે. આપણે અ-શરીરી અનીએ તો જ સ્વતંત્રતાની ઈચ્છા પરિપૂર્ણ થાય.

(૫) જીવની છેલ્લી ઈચ્છા—“અધા મને આધીન રહેવા જોઈએ.” આ ઈચ્છાની તૃપ્તિ માટે જગતમાં વિશ્વાસ્ત્રો એવાયાં છે, પણ તે કહી પૂરી થતી નથી. એક કેવળશાનની અવસ્થા જ એવી છે કે કેવળશાનનીએ પોતાના શાનમાં એક હળવ વર્ષ પછી આવો અનરો કે અમુક જીવાતમા

એક હજાર વર્ષ પછી આ કાર્ય કરશે એમ જેયું હોય તો તે પ્રમાણે જ બનાવ અને છે અને તે જીવાત્મા તે પ્રમાણે જ કરે છે. એટલે હડીકતમાં સમય વિશ્વ અપેક્ષાએ કેવળજ્ઞાનીએ એમના જ્ઞાનમાં જેયું છે તે પ્રમાણે ચાલે છે. તેમના જ્ઞાનને આધીન સમય વિશ્વ છે, એવું એક નયથી કહી શકાય. એટલે આપણે કેવળજ્ઞાન પ્રગટ કરીએ તો આપણા જ્ઞાનને આધીન સમય વિશ્વ ચાલે.

આ રીતે આપણું મૂળ દ્વારા અનંતજ્ઞાન, અવ્યાખ્યાસુભ, અનંત આનંદ, અનંત શક્તિમય અને શાશ્વત છે, તે પ્રગટ થાય ત્યારે જ સર્વ પ્રચોજન સિદ્ધ થાય છે. માટે આત્મસ્વરૂપ પ્રગટ કરવું તે જ પરમ ધ્યેય-લક્ષ્ય છે. પૂર્ણપણે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે આજે આપણું પાસે પરિપૂર્ણ સામની નથી. માટે વર્તમાન જીવનનું ધ્યેય - લક્ષ્ય આત્માનુભવ કરવો. અને હવે પછીના જન્મનું લક્ષ્યાંક પૂર્ણ આત્મચૈતન્ય પ્રગટ કરવું તે છે.

**સાધક :—**આ જીવનનું ધ્યેય-લક્ષ્ય આત્મસ્વરૂપનો અનુભવ કરવો, તે ધ્યેય સુધી પહોંચવા માટે સામાન્ય શરૂઆત કેવી રીતે કરવી ?

**પુ. ગુરુ મહારાજ :—**જેમનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રગટ થયું છે તેવા પરમેષ્ઠિ ભગવાંતો સાથે સંબંધ જોડવાથી આ કાર્ય સિદ્ધ થાય છે. પરમેષ્ઠિ સાથે સંબંધ જોડવા માટે પ્રથમ શરૂઆત નમસ્કાર મહામંત્રની આરા-

ધનાથી કરવી. સાથે પરમાત્માનું દર્શાન, પૂજન, વંહન, સ્તવન, ધ્યાન અને આજાપાલન દ્વારા કાર્યોસ્લિદ્ધ થાય છે.

ઉપરોક્ત હકીકત આપણા જીવનનું લક્ષાંક નાઝી કરવા માટે અફ્ફભૂત ગ્રેરણું આપે છે. આ પુસ્તકમાં આત્મસ્વરૂપના અનુભવ સુધી પહોંચવાના લક્ષપૂર્વકની પ્રક્રિયાએ છે, એટલું ખાસ યાદ રાખવું કે આપણે કે ભૂમિકા ઉપર છીએ તે ભૂમિકાને અનુરૂપ વ્યવહાર ધર્મની સર્વક્રિયામાં રક્ત રહેનાર જ આગળ વધી શકે છે. પહેલા ગુણસ્થાનકે રહેલ માર્ગાનુસારીતાના ગુણોમાં, ચોથે ગુણસ્થાનકે રહેલ સાધક સર્વયગ્ર દર્શાનને ચોંચ આચારોમાં, પાંચમે ગુણસ્થાનકે રહેલ સાધક શ્રાવકોચિત કિયા અને કર્તાંચોમાં, છદ્રા ગુણસ્થાનકે રહેલ સાધુ લગવંતો સાધુને ચોંચ સામાચારીતા પાલનમાં સ્થિર હોય તે જ આત્માના અનુભવની દિશામાં આગળ વધે છે. કલ્યાં છે કે—

નિશ્ચય દર્શિ હૃદયે ધરી, પાણે જે વ્યવહાર;  
પુષ્યવંત તે પામરો, લવ સમુર્દનો પાર.

( સવાસો ગાથાનું સ્તવન )

વળી આ અંથમાં પ્રથમ ભૂમિકા, બીજી ભૂમિકા, ત્રીજી ભૂમિકા એમ દરેક આરાધનાના વિભાગો છે. આપણે જ્યાં હોઈએ ત્યાંથી આગળ વધવાનું છે. વાંચનાર લિન્ન લિન્ન ડ્રચિવાળા અને લિન્ન લિન્ન ક્ષયોપશમવાળા હોય છે. જેને જે પ્રક્રિયા લાગુ પડે તેમાં તેને ત્યાંથી આગળ વધવાનું છે. સર્વયગ્રલાંબે પુરુષાર્થ કરતાર દેવગુરુ કૃપાથી

જરૂર આગળ વધે છે. આપણે પણ આપણી ભૂમિકા અનુસાર આગળ વધીએ.

### દયોય - લક્ષ્ય

“આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તે લક્ષ્ય છે. આત્મસ્વરૂપનો અનુભવ તો આ જત્તમાં જ કરવો છે.” આ નિશાન મજબૂત બાંધી તેના તરફ ચાલવા નિરંતર પ્રયત્ન કરીએ. આપણા આ મહાન નિર્ણયને ડેલાવવા માટે અનેક વિધનો આડાં આવશે. અનેક લાલચો આવીને ઉભી રહેશે. વિવધ પ્રકારના ચમત્કારો અનુભવવાની ઈચ્છાએ. થશે, ચમત્કાર કરીને પોતાના અહૃંને પોષવાની અનેક તમના જગશે. પરંતુ તે તરફ જરા પણ લલચાયા - આપણે મૂળ લક્ષ્યને મૂકીને ખીલુ દિશામાં ગયા - નિશ્ચય-માંથી ડંગા તો જરૂર સમજવું કે વહેલા મોડા પતનના માર્ગે પહોંચી જવાશે અને પછી આત્માના અનુભવરસના પરમાનંદને અનુભવવાના લક્ષાંકને હજારો માઈલનું અંતર પડી જશે અને તે પછી હજારો વર્ષ કે હજારો લવો પછી પણ મૂળ માર્ગ કયારે મળશે તે નષ્ટી નથી. કારણું કે મોહ, અજ્ઞાન, મમતા, ઈન્દ્રિયોના વિપયો, અહંકૃતિનું પોષણ ધાણું જ આકર્ષક છે અને આત્મલાનને ભૂલાવનારા છે અને આપણા સત્ય નિશાનથી ઝર જેંચી જનારા છે. માટે સૂક્ષ્મ ચિંતન કરી લક્ષ્યમાં જ સ્થિરતા કેળવવા પૂછું પ્રયત્ન કરવો!.

દ્રોષ્યાચાર્યે પાંડવો અને કૌરવોને પરીક્ષા લેવા માટે

એવાંયા. આડ ઉપરની પૂતળીની ડાણી આંખ વીંધવાની હતી. એક પછી એક અધાને પૂછ્યું: ‘તમને શું દેખાય છે?’ ‘અધું જ દેખાય છે.’ તેમ ફરેકે કહ્યું: છેલ્લે અજુંનને પૂછ્યું, ત્યારે અજુંને કહ્યું: ‘લક્ષ્ય સિવાય કંઈ પણ દેખાતું નથી.’ ગુરુએ આજા કરી અને અજુંને લક્ષ્ય વીંધ્યું; અર્થાત જ્યાં સુધી લક્ષ્ય (પરમાત્મા) સિવાય બીજું અધું જ દેખાતું બંધ ન થાય, ત્યાં સુધી પરમાત્મા મળતા નથી. બીજા અધામાંથી વૃત્તિએ નીકળી ન જાય, ત્યાં સુધી પરમાત્માના દર્શાન થતાં નથી. દર્શાનની સાચી લગની, પરમાત્માના ભિલનની તીવ્ર અંખના અને તેના માટે જ સર્વો પ્રયત્ન થાય ત્યારે પરમાત્મા મળ્યા સિવાય રહેતા નથી.

ધ્યેય-લક્ષ, પરમાત્માની પ્રાપ્તિ કે પરમાત્મ દર્શાન, આત્મદર્શાન, આત્માનુસ્વ, આત્મસાક્ષાત્કાર આ સર્વો એકાથી વચ્ચેનો છે. આપણે લક્ષ પ્રત્યે સદા જગૃત રહેવું જરૂરી છે.

(૧) આ જન્મનું લક્ષાંક આત્માનુસ્વ.

હવે પછીના જન્મનું લક્ષાંક આત્મસ્વરૂપનું સંપૂર્ણ પ્રગટીકરણ.

(૨) આપણી ભૂમિકાને અનુરૂપ બ્યવહાર ધર્મની કિયામાં રક્તા રહી આત્માનુસ્વ આ જન્મમાં જ કરવા માટે પુરુષાર્થ કરવો.

(૩) આ અંથમાં જુદી જુદી ભૂમિકા ખતાવી છે. આપણે જ્યાં હોઇએ ત્યાંથી સાધનામાં આગળ વધવું.

(૪) ચમત્કાર, અહંપોષક લાલચો, હુન્યવી આકર્ષણો વગેરે આત્મલાન ભૂલાવનાર તરવોમાં લપટાયા વગર આત્માનુભવ આ જન્મમાં જ કરવો છે તેવું મજબુત લક્ષાંક રાખવું.

(૫) લક્ષ પ્રત્યે સંપૂર્ણ જગૃતી રાખવી.

**પૂજ્ય પન્થાસળ ભદ્રંકરવિજ્યજ્ઞ સાથેનો વાર્તાલાય**

**આત્મસાક્ષાત્કાર અને ઉપયોગ**

અરિહંત આકાર ઉપયોગ આત્મસાક્ષાત્કારની સાધનામાં મહત્વનું અંગ શા માટે ?

પ્રથમ પરમાત્મામાં ઉપયોગ લીન કરવો જોઈએ. તે માટે પરમાત્મામાં આહર, બહુમાન, ઋચિ, વીર્યસ્કુરણા, તન્મચતા, તદ્દુપતા, એકત્વતા, સાધવી જોઈએ. પરમાત્માના ધ્યાનમાં લીન બનવાથી અરિહંતાકાર ઉપયોગ થાય છે. (આત્માનો શાનગુણ સહિય હોય તેને ઉપયોગ કરેવાય.) (ઉપયોગ એટલે સામાન્ય અર્થમાં એન્સન કરેવાય.)

અરિહંતાકાર આપણો ઉપયોગ અને છે તે વખતે ઉપયોગથી અલિજ્ઞ એવા આપણા આત્મામાં લીન બની શકાય છે. ઉપયોગ શુદ્ધ થવાથી આપણો પર્યાય જે મલીન છે તે શુદ્ધ થાય છે. પર્યાય શુદ્ધ થવાથી પર્યાયવાન આપણા આત્મમાં લીન થઈ શકાય છે. આપણા મલીન પર્યાયને શુદ્ધ કરવા માટે અરિહંતાકાર ઉપયોગ

કરવો જોઈએ. કરવો જોઈએ. અરિહતાકાર ઉપયોગ વખતે ઉપયોગવાન આત્માને પર્યાય શુદ્ધ થાય છે.

યોતાના આલંબનમાં ગાઢ રૂપે સંદર્ભન થવાના કારણે ધ્યાતાત્મન ચિત્ત નીષ્પ્રકાર થઈ જાય તે ચિત્ત 'ધ્યાન કહેવાય છે.'

ઉપયોગ એ જ્ઞાત-જયોતિ છે. આપણે જોઈ વસ્તુને નિરખીએ છીએ તે વખતે તે વસ્તુને આપણે નથી જોતા પણ વસ્તુ આકાર બનેલા આપણા ઉપયોગને જોઈ એ છીએ. કદ્વપનાથી પરમાત્માને આપણે જોઈએ છીએ તે વખતે પરમાત્મા આકાર બનેલા આપણા ઉપયોગને જોઈ એ છીએ. તે વખતે આપણે ઉપયોગ પરમાત્મા આકારવાળો બને છે. અને ઉપયોગથી આત્મા અલિજ્ઞ હોવાથી આપણો આત્મા જ પરમાત્મા આકારવાળો બને છે. તે વખતે આત્મહર્ષન થાય છે. આંખને જેવા માટે અરિસો જોઈએ. આત્માતું દર્શન કરવા માટે પરમાત્માને જેવા જોઈએ.

ધ્યેયાકાર ઉપયોગનો ધ્યાન છે. વિજ્ઞતીય જ્ઞાન જ્યાં નથી અને સંજ્ઞતીય જ્ઞાનની ધારા છે તે 'ધ્યાન' છે.

મોતીની માળા બનાવીએ તેમાં મણુકા તે પર્યાય છે. હોરો તે ઉપયોગ ( શુણ ) છે. તેની માળા તૈયાર થાય તે દ્રવ્ય છે. મણુકાને દોરામાં પરોવવાની કોયા વ્યવસ્થીત થવી જોઈએ, ઉપયોગ પરમાત્મક આકાર વ્યવસ્થીત થવો જોઈએ. માળા તૈયાર થયા પછી મણુકા, હોરા વીગેરેનું

ધ્યાન રાખવાનું નથી. માણા પહેરવાનું સુખ લોગવવાનું છે. તે રીતે અરિહંતાકાર ઉપયોગ અન્યા યધી અને ઉપયોગ આકાર આત્મામાં આઠ્યા પછી (વિકલ્પ છોડીને) આત્મામાં પરમાનંદનો અનુભવ કરવાનો છે. ઉપયોગ - આત્મા અને પરમાત્માને જોડી આપનાર પૂલ છે.

ધ્યાનલંગ શાથી થાય છે ?

દોરો આચો હોવાથી મણુકા વીખરાઈ જાય છે. દોરો વણુંને મજબુત કરવો જોઈએ, એટલે કે ઉપયોગને પરમાત્મામારી વધુ લીન અને સ્થિર કર્યો પછી ઉપયોગથી અસિન્ન એવા આત્મામાં આવતાં વધુ સ્થિરતા અને આત્માના આનંદનો અનુભવ થશે.



વષો સુધી જય કર્યો, માળાચો ફેરવી છતાં  
મનમાં પવિત્રતાનું એક કિરણ પણ ન કુટચું,  
કામ કોધરૂપી હુશમનો પર વિજય ન મળ્યો, એક  
આણુ જોટલો પણ રાગ ઘટયો નહિ, તે સુવર્ણ  
ભસમને બદ્લે પત્થર ભસમ ખાંધી અથવા અંદર  
કોઈ છૂપો વિકાર હતો તે સુવર્ણભસમની શક્તિને  
આઈ ગયો.

ॐ હ્રી અહો નમઃ

## સાલંખન ધ્યાનના પ્રયોગો

પાઠ છઠો

### નવપદ્તું ધ્યાન

લિન્ન લિન્ન રૂચિવાળા અને લિન્ન લિન્ન પ્રકારના ક્ષયોપશમવાળા આત્માઓને જે પ્રક્રિયા લાગુ પડે તેમાં તેઓ આગળ વધી શકે તે હેતુથી આ પુસ્તકમાં પરમાત્મ ઉપાસના, લક્ષ્ણ અને સાલંખન ધ્યાનના અનેક પ્રયોગો અને પ્રક્રિયાઓ બતાવી છે.

શરૂઆતમાં સાલંખન ધ્યાન પ્રયોગો બતાવ્યા છે. ધીજા પાઠમાં નમસ્કાર મહામંત્રના જાપની પ્રથમ ભૂમિકા બતાવી છે. જાપમાં સ્થિરતા માટેની પ્રક્રિયા બતાવી છે. ધીજુ ભૂમિકામાં મંત્રાક્ષરોને સફેદ ચણકતા અને તે પછી જુદા જુદા રંગવાળા જોવાની અને તે રીતે મંત્રાક્ષરોમાં ચૈતન્ય જગાડવાની પ્રક્રિયા બતાવી છે. અક્ષરોમાં ચૈતન્ય જગૃત થતાં થતા અનુસરે બતાવ્યા છે. ત્રીજુ ભૂમિકામાં

ધ્યા. પ્ર. ૧૨

તात्त्विक नमस्कारनु' स्वરूप अतावी જુહી જુહી બાર રીતે નવકારની આરાધના અને ધ્યાન દ્વારા આત્મ અનુસ્થ, આત્માના પરમાનંદની અનુભૂતિ સુધીની પ્રક્રિયા અતાવી છે. નમસ્કાર મંત્રનુ' ધ્યાન તેને પહસ્ય ધ્યાનનુ' સ્વરूપ કહેવાય છે, તે પરમાત્માના નામનિષ્ઠેપની સાધના છે.

તીજા પાઠમાં પરમાત્માનુ' મૂર્તિદ્વારે દર્શાન, પૂજન, સ્તવન અને ધ્યાન અતાંયુ' છે. પ્રથમ ભૂમિકામાં દર્શાન અને ધ્યાનની પ્રક્રિયા અતાવી છે, બીજી ભૂમિકામાં પરમાત્માની પૂજની ધ્યાન પ્રક્રિયા અતાવી છે. તૃજી ભૂમિકામાં પરમાત્માના સ્તવનમાં ધ્યાનની પ્રક્રિયા અતાવી છે. વિશિષ્ટ સાધકો માટે જિનલક્ષ્ણિત દ્વારા આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયા અતાવી છે.

ચોથા પાઠમાં ભાળકો માટેનુ' સહેલુ' ધ્યાન અતાંયુ' છે.

પાંચમા પાઠમાં જીવનનુ' ધૈર્ય-લક્ષ શું રાખવુ' ? તે માટે આ પુસ્તકના લેખકને ૨૦૧૩ માં ભીલડીયાળ તીર્થમાં ચૈત્ર મહિનાની આચંબિતની ઓળિ પ્રસંગે અધ્યાત્મ ચોણી પૂ. પં. લદ્રંકરવિજયજી મહારાજ સાથે થયેલ વાતૌલાય અતાવી - આ જીવનનુ' લક્ષાંક “આત્મઅનુસ્થ કરવો” - અને આવતા જીવનનુ' લક્ષાંક “પૂણુ' આત્મસરવરૂપ પ્રગટ કરવુ'” તે નિર્ણિત કર્યું.

તે પછી હવે પાંચમા-છ્ટા પાઠમાં નવપદ્ધની આરાધના ધ્યાન આપણે જોઈએ.

A Key to Radiant Success જવલંત સરેળતાની ચાવી શ્રી નવપદની આરાધના ખતાવી છે. નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકામાં રોજની નવપદની આરાધના છે. શ્રીજી ભૂમિકામાં નવપદનું ધ્યાન. શ્રીજી ભૂમિકામાં સાધનાના છ સ્ટેજમાં નવપદમાં આત્મા અને આત્મામાં નવપદનું ધ્યાન ખતાંથું છે. અને નવપદના ધ્યાન ક્રારા આત્મ અનુભવની પ્રક્રિયા ખતાવી. હેલ્વે સાતમા-આડમા પાડમાં સિદ્ધચક્કનું ધ્યાન ખતાંથું છે. તે ત્રણ પ્રકારે-કલશાકાર આકૃતિ રૂપ, કલ્પવૃક્ષાકાર આકૃતિ રૂપ અને ચકોકાર આકૃતિ રૂપે ખતાંથું છે.

આપણે હવે નવપદનું ધ્યાન કરીએ,  
નવપદની આરાધનામાં વિકાસ સાધીએ.

★ Supramental Seminar of Supreme ★  
Authorities-Shree Navpad.

“વિશ્વની સર્વોત્કૃષ્ટ શક્તિઓનો ભંડાર : નવપદો”

### નવપદનું ધ્યાન

અરિહંત લગવંતો ઉપકારના ભંડાર છે.

સિદ્ધ લગવંતો સુખના ભંડાર છે.

આચાર્ય લગવંતો આચારના ભંડાર છે.

ઉપાધ્યાય લગવંતો વિનયના ભંડાર છે.

સાધુ લગવંતો સહાયના ભંડાર છે.

પાંચેય પરમેષ્ઠિઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપમય છે.

સમ્યગુદ્દર્શન (Real and Creative Faith) સફળાવનાઓનો લંડાર છે.

સમ્યગુજ્ઞાન (Real and Creative Knowledge) સફળવિચારોનો લંડાર છે.

સમ્યગુચ્યારિત્ર (Real and Creative Character) સહૃવત્તનનો લંડાર છે.

સમ્યગુત્પ સંતોષનો લંડાર છે.

આ નવે પહોં જગતનાં ઉત્કૃષ્ટ મહાનિધાનો છે. છેલ્ખાં ચાર પહોં પંચ પરમેષ્ઠિઓમાં ઉત્કૃષ્ટ રીતે રહેલાં છે. જગતની સર્વોત્તમ મહાવિભૂતિઓનો સત્ત્સમાગમ, સત્ત્સંગ કરવાનું સ્થાન નવપહોં છે. નવપદની આરાધના વખતે જગતના ત્રણે ડાળના અનંત અરિહંત લગવંતો, અનંત સિદ્ધ લગવંતો, અનંત આચાર્ય લગવંતો, અનંત ઉપાધ્યાય લગવંતો અને અનંત સાધુ લગવંતોનો સત્ત્સમાગમ થાય છે. આવી અનંત ઉપકારી મહાન વ્યક્તિઓનો મેળાપ નવપદ અને નમસ્કાર મંત્રમાં થાય છે.

“ એતદારાધનાત् સમ્યગારાધ્યं જિનશાસનમ्  
યતઃ શાસનસર્વસ્વમેતદેવ નિગચતે ।

એમ્યો નવપદેમ્યોऽન્યત્ નાસ્તિ તત્ત્વં જિનાગમે  
તતો નવપદી જ્ઞેયા સદા ધ્યેયા ચ ધીધનૈः ॥”

(સિદ્ધચક્ર પૂજન વિધિ)

આ નવપદનું આરાધન કરવાથી સમ્યગ જિનશાસનનું આરાધન થાય છે, કારણું કે આ નવપહોં એ જ જિત-

શાસનતું સર્વસ્વ છે. સમય જિનાગમમાં નવપદ સિવાય ભીજું કોઈ પણ તત્ત્વ રહેલું નથી. માટે યુદ્ધિમાન જનોએ નવપદોનું સમ્યગું પ્રકારે જીબ મેળવીને, નિરંતર તેણું ધ્યાન કરવું તે જ સમ્યગું યુદ્ધિતું પરમ કણ છે.

આવા નવપદોમાં આપણે શ્રીપાલ અને મયણાની જેમ કેવી રીતે લીન બનવું તે વિષે વિચારણા કરીએ.

### નવપદની આરાધના અને ધ્યાન

**નવપદની આરાધનાની પ્રથમ ભૂમિકા :-**

નવપદની આરાધના જિનશાસનમાં ખૂબ જ પ્રચાલિત છે. જેની શરૂઆત પ્રથમ ભૂમિકામાં આ રીતે કરીએ.  
**દરરોજની આરાધના :-** પ્રયોગ નં. ૨૦

(૧) નવપદ (દેરાસરમાં નવપદનો ગઢો-મૂર્તિ હોય છે તે) ની અષ્ટપ્રકારી પૂજા.

(૨) નવપદના નવ સાથિયા.

(૩) નવપદનાં નવ અમાસમણું. ('અરિહંતપદ ધ્યાતો થકો' વગેરે ફુહા ઓલીને)

(૪) નવપદની નવ માળાનો જપ.

ॐ હ્રીं નમો અરિહંતાણુं

ॐ હ્રીં નમો સિધ્યાણું

ॐ હ્રીં નમો આયરિયાણું

ॐ હ્રીં નમો ઉવજાયાણું

ॐ હ્રીં નમો લોચે સંવસાહ્લણું

ॐ હ્રીં નમો દંસણુસ્સ

ॐ હ્રીં નમો નાણુસ્સ

ॐ હ્રીં નમો ચારિતસ્સ

ॐ હ્રીં નમો તવસ્સ

(૫) ઈચ્છાકારેણુ સાંહિસહ લગવનુ! નવપદ આરાધનાર્થું કાઉસગુ કરું? એ રીતે નવપદની આરાધના નિયમિતે નવ લોગસસનો કાઉસગુ.

(૬) નવપદનું ચૈત્યવંદન, અનુકૂળતા હોય તો સ્તવનમાં ઉપાધ્યાય યશોવિજ્ઞયળુ વિરચિત નવપદની એક પૂજા ગાવી. પહેલા હિંસે અરિહંત પદની પૂજા. બીજા હિંસે સિદ્ધપદની પૂજા. આ રીતે દુષ્ટમા હિંસે ઇરીથી અરિહંત પદની પૂજા આવશે.

(૭) આવકોચિત નવકારશી, ચોવિહાર, અલક્ષ્ય ત્યાગ આદિ નિયમિત કરવા.

(૮) આથાંભિલની ઓળી આવે ત્યારે ઓળી કરવી.

(૯) નવપદનું ધ્યાન નિયમિત કરવું.

(૧૦) ઓળી સિવાયના હિંસોમાં ઉપરના સ્ટેજની આરાધના નિયમિત ચાલુ રાખવી. કારણુ કે એક પથ્થરને આપણે જીચે જીયકીએ, તેવી રીતે આથાંભિલની ઓળીમાં આરાધના કારા આપણા આત્માને જીચે જીયકીએ છીએ; પરંતુ ઓળી પૂરી થાય એટલે પાછેં નીચે હતો ત્યાં જ મૂકી

દઈ એ છીએ. તેથી બીજુ ઓળિમાં આત્માને ફરીથી પાછો નીચેથી જિયકવો પડે. પરંતુ જીંચે જિયકેલ પથરની નીચે ને ટેકા મૂકી દઈ એ તો બીજુ વખત ત્યાંથી આગળ જીંચે લઈ જવાય. તે રીતે ઓળિ પૂરી થયા પછી દરરોજના જીવનમાં ઉપરની આરાધના ચાલુ રાખી એ તો બીજુ ઓળિ આવે ત્યારે ત્યાંથી આગળ જીંચે જવાય. નવો વિકાસ સાધી શકાય. આ રીતે નવપદની આરાધના નિયમિત રોજના જીવનમાં ચાલુ રાખવી.

**નવપદના ધ્યાનના વિષયમાં હવે વધુ વિચારીએ :-**

જૈન સંધમાં નવપદની ઓળિની આરાધના મીઠા પ્રમાણમાં થઈ રહી છે. હજારોની સંખ્યામાં ઓળિની આરાધના સર્વત્ર થાય છે. આપણા સંધના ચુવાન વર્ગમાં પણ ઓળિની આરાધના માટે અહલુત આકર્ષણું વધી રહ્યું છે તે આપણું ભાવી શુભ છે તેનું સૂચક છે. હવે આટલે સુધી પહેંચ્યા પછી આ નવપદજીની આરાધના ઉપયોગ જેડવાપૂર્વકની કરીએ તો વધુ ઉદ્ઘોતના પંથે આપણે આગળ વધી શકીશું, તે નિઃસંશય છે. ઉપયોગ જેડવાપૂર્વકની કિયા કરવી તે ધ્યાન છે. ઉપયોગ અન્યત્ર ફરતો હોય અને ખમાસમણું પણ લેવાતાં હોય અને માળા પણ ગણ્યાતી હોય, તેનું કેળ અદ્ય છે. સાંપૂર્ણ કેળ મેળવવા ઉપયોગની સ્થિરતાપૂર્વક કિયા કરવી જરૂરી છે.

**નવપદના ધ્યાનની બીજુ ભૂમિકા :-**

## અરિહંતપદ્ધતિ ધ્યાન :- ગ્રચોગ નં. ૨૧.


જે અરિહંત પરમાત્મા આપણા પરમ ઉદ્ઘારક છે, આપણા પ્રત્યે પૂર્ણ ગ્રેમ અને કરુણાથી લરેલા છે, જે પરોપકારની પરિસીમાને ખેણાંચી ગયા છે તેમના પ્રત્યે જેટલી કૃતજ્ઞતા આપણા હૃદયમાં લાવિત થાય છે, તેટલા આપણે વધારે તેમની કરુણાના પાત્ર બનીએ છીએ. વરસાદ પડતો હોય ત્યારે જેનું પાત્ર જીધું હોય, તેનું પાત્ર ભાવી રહે છે. જેનું પાત્ર સીધું હોય, તેનું પાત્ર લરાય છે; પછી પાત્ર વાઠકા જેવડું હોય કે થાળી જેવડું હોય કે પછી સરેવર જેવડું હોય, અધું જ લરાઈ જાય છે. પરમાત્માની કરુણા તો સર્વ જીવા પર એકસરખી-એકધારી રહેલી છે. જે જીવાત્મા તે કરુણાને પોતાના હૃદયમાં જીવે છે, તેને તે કરુણાનો પૂર્ણ લાલ મળે છે. પ્રભુની તે કરુણાને આપણા હૃદયમાં જીલવાનો મંત્ર છે : ‘નમો અરિહંતાણુः’ તે મંત્ર દ્વારા પરમાત્માની કરુણાને આપણા હૃદયમાં જીલવાની ચોચ્યતાનો વિકાસ થાય છે. Receptive attitude (અરુણશીલ વૃત્તિ) જેને પ્રાપ્ત થાય છે, તે પ્રભુની કરુણાના સ-પૂર્ણ પાત્ર બને છે. તેના જીવનમાં પરમાત્માની કરુણા કાર્યશીલ બની જાય છે. આ રીતે પરમાત્માની કરુણા એ મહાન શક્તિ છે. તે નિરંતર આપણને સહાય કરી રહી છે.

**ગ્રચોગ :-** પરમાત્મા અરિહંત હેવ આપણી સમક્ષ બિરાજમાન છે.

**કરુણાના પૂર્ણ નિધાન છે.**

# “तिजयविजयचक्रं सिद्धचक्रं नमामि” श्री सिद्धचक्र महायन्त्रम् ॥

ॐ ज्ञाने नमो सिद्धाणं



ॐ ज्ञाने आवश्याणं

ॐ ज्ञाने उद्यावरणं

प्राप्तपद एवं देयाण



તેમના નેત્રમાંથી કરુણાની સક્રૈદ હૃદ જેવી ધારા  
બહી રહી છે.

તેમાં આપણે સ્નાન કરીએ છીએ.

પરમાત્માની કરુણા આપણા મસ્તકમાંથી આપણા  
શરીરમાં પ્રવેશ કરે છે.

આપણું હૃદય પૂર્ણ ભરાય છે.

આખા શરીરમાં કરુણા વ્યાપક બની જાય છે.

તેના પ્રલાવથી આપણાં શોક, હૃદય, ચિંતા  
નાશ પામે છે.

આપણે સુખ, શાન્તિ અને આનંદનો અનુભવ  
કરીએ છીએ.

આવું દશ્ય નજરની સામે રાખી “ તું હું ” નમે અર્દ-  
હુંતાણુ ” પહોનો જાપ કરવો. જાપની એક માળા થયા પછી  
પણ ઉપરનું દશ્ય નજર સામે રાખી પ્રલુની કરુણામાં થોડો  
સમય સ્નાન કરવું. વિશેષ વિગતવાર પ્રયોગો આ પુસ્ત-  
કમાં અન્યત્ર છે તેથી અહીં વધુ વિગત લીધી નથી.

### સિદ્ધપદનું દ્યાન :-

સિદ્ધ ભગવંતો સર્વ કર્મઆવરણથી મુક્તા અનેલા  
છે. તેઓ અનંત, અંધાખાધ, સ્વતંત્ર, સ્વાધીન એવા  
સુખમાં સદ્ગ નિમગ્ન છે, નિષ્કલંક છે, નિરામય છે અને  
અનર્ગણ આનંદના હિંદ્ય લંડાર છે. સ્વરૂપમાં રમનારા,  
સ્વરૂપના લોાગી અને સ્વરૂપસ્થિરત્વવાળા સચિયદાનંદ રૂપ છે.

અનંત સિદ્ધ ભગવંતો તેમના કેવળજ્ઞાનમાં વિશ્વના સર્વ જડ-ચૈતન્યના ત્રણે કાળના સર્વ પર્યાયોને જુએ છે અને જાણે છે. પરંતુ જગતના માણુસોની જોવાની રીત જુદી છે, અને પરમાત્માની જોવાની રીત જુદી છે. પરમાત્મા કઈ દિષ્ટિથી જગતને જુએ છે, તે શ્રી દેવચંદ્રજી મહારાજ સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં આ પ્રમાણે કહે છે :

“તુમ પ્રખુ જાણુંગ રીતિ સર્વ જગ દેખતા,  
નિજ સત્તાએ શુદ્ધ સહુને દેખતા,  
પરપરિણુતિ અદ્રેષ્પણે ઉવેખતા.”

અનંત સિદ્ધ ભગવંતો અત્યારે જ આપણુને લોઈ રહ્યા છે, પરંતુ તે આપણી વિલાવદશા, દોષલરી હાલત, પરપરિણુતિઓ વગેરે પાપથી ખરડાયેલી આપણી વર્તમાન અવસ્થાની ઉપેક્ષા કરે છે અને ‘નિજ સત્તાએ શુદ્ધ સહુને દેખતા.’ પ્રત્યેક જીવમાં સત્તાએ રહેલું જે શુદ્ધ સ્વરૂપ છે, તેનું મૂલ્યાંકન કરે છે.

“દ્વલતથા પરમાત્મા એવ જીવાત્મા.”

સત્તાથી દરેક જીવાત્મા પરમાત્મા સ્વરૂપ છે, અર્થાતુ આપણી અંદર સત્તાથી તેમના જેવું જ જે પૂર્ણરૂપ રહેલું છે, તે રૂપમાં અનંત સિદ્ધ ભગવંતો આપણુને લોઈ રહ્યા છે. એટલે તેમના ઉપયોગમાં આપણું શુદ્ધ સ્વરૂપ છે અને જિનાગમના આલંખનથી જયારે આપણા ઉપયોગમાં તેમનું શુદ્ધ સ્વરૂપ આવે છે, ત્યારે આપણો અને તેમનો એક વૈજ્ઞાનિક સંબંધ થાય છે. તેમના ઉપયોગમાં આપણું

શુદ્ધ સ્વરૂપ અને આપણા ઉપયોગમાં તેમનું શુદ્ધ સ્વરૂપ આવતાં એક વિશિષ્ટ સંબંધ થાય છે, જેમાંથી આપણી અંહર રહેલા તેમના જેવા જ શુદ્ધ સ્વરૂપની સભાનતા ઉત્પન્ન થાય છે.

શુદ્ધ સ્વરૂપની સભાનતા ( Awareness in Absoluteness ) થતાં શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની તીવ્ર અંખના ઉત્પન્ન થાય છે, અને તેનો ઉપાય પરમાત્માનું દર્શાન, પૂજન, વંદન, સ્તવન, સ્મરણુ, ધ્યાન અને આજાપાલન જ છે. તેથી પરમાત્મા આપણું સર્વસ્વ અની જાય છે. પરમાત્મા જ આપણાં પ્રાણુ, ત્રાણુ, શરણુ, આધાર બની જાય છે. તે જ આપણા માતા, પિતા, નેતા અને બંધુ છે.

ત્વं મે માતા પિતા નેતા, દેવો ઘરો ગુરુ: પરઃ ।

પ્રાણા: સ્વગોડિપર્વર્ગશ્ચ, સત્ત્વં તત્ત્વં ગતિર્મતિ: ॥

—શ્રી સિદ્ધસેન દિવાકરસ્સરીશ્વરાજ કૃત શક્તસ્તવ.

વિશ્વમાં દર્શાન કરવા લાયક, વંદન કરવા લાયક, પૂજન કરવા લાયક, સ્તવન કરવા લાયક ડોઈ હોય તો તે અરિહંત અને સિદ્ધ લગવંતો જ છે, તેવા લાવથી સાધકનું હૃદય પરિપૂર્ણ ભરાય છે, સાધકની સર્વ વૃત્તિ અને પ્રવૃત્તિ પરમાત્મા ભણો જેંચાય છે, તથા પર વસ્તુ પ્રયે જે આહર અને બહુમાન હતું તે પરમાત્મા પ્રત્યે ઉત્પન્ન થાય છે. ઇચ્છિ પરમાત્માના સ્વરૂપમાં, રમણતા પરમાત્માના શુણોમાં, તન્મયતા-તદ્ગુપતા અને એકત્વ પરમાત્મામાં સધાય છે; અને છેવટે Absorption in Atmaswarup-સર્વ-

વृत्तिए પરમात્મામાં અને ઉપલક્ષણથી આત્મસ્વરૂપમાં વિશ્રાંતિ પાડે છે—Relaxation in Reality (in real self) જેને આ માનવ જીવનનું પરમ અમૃત કહેવાય છે.

સાકરને હૃદયમાં નાખવાથી તે ઓગળી જય છે, તેમ મન આત્મા કે પરમાત્મામાં ઓગળી જય, મન આત્મ-જીવચોગે—આત્મારૂપે પરિણામે તે જ સિદ્ધપદની પ્રાપ્તિનો ઉપાય છે. આપણે સિદ્ધપદની પ્રાપ્તિના પરમ હેતુભૂત અનંત શુણુના નિધાન સિદ્ધલગ્નંતોની ઉપાસના કરવાની છે.

### અચોગ :—

સિદ્ધ લગવંતો અનંત શુણુના નિધાન છે.

તે સિદ્ધ પરમાત્મા આપણી સમક્ષ બિરાજમાન છે....

આપણે અનંતશુણુના સંદાર પરમાત્માનું દર્શાવ્યું કરીએ છીએ.....

હે કરુણામય પ્રભુ ! આપ તો અનંત શુણુના પરમ નિધાન છો. મને અનંત શુણોથી લરી દેવા કૃપા કરો....

પરમાત્માના સર્વ અંગોમાંથી શુણોનો વરસાઈ ફડવો શરૂ થયો છે.....(આવું દશ્ય જોવું.)

પ્રભુના શુણુરૂપી ગંગાજળનો ધોધ આપણા ઉપર પડી રહ્યો છે.....(આવું સંવેદન કરવું.)

તુમ શુણુગણ ગંગાજળે, હું જીલીને નિર્મણ થાડું રે;

અવર ન ધંધો આદરું, નિશાહિન તોરા શુણ ગાડું રે.

ગીરુઆરે શુણ તુમ તણુ.....

પ્રભુના શુણુરૂપી ગંગાજળમાં આપણે સ્તાન કરીને  
નિર્મણ બનીએ છીએ..... ( થોડો સમય સ્થિર બની  
આવું સંવેદન કરવું.)

પ્રભુના શુણુરૂપી ગંગાજળ આપણા મસ્તકમાંથી આપણી  
અંદર પ્રવેશ કરે છે..... આપણે ઉત્તમ શુણોથી ભરાઈ  
રહ્યા છીએ..... ( આવું દશ્ય જોવું.)

પ્રભુના શુણું ગંગાજળમાં સ્તાન કરતાં કરતાં “ તું  
હી “નમો સિદ્ધાંશુ” પદનો મંત્ર જાપ કરવો. ક્ષમા, નઅતા,  
સરળતા, સંતોષ, અહિંસા, સત્ય, અચૌર્ય, પ્રાણચચ્યદ્, અપ-  
રિથ્રહ્, હ્યા, હાન, પરોપકાર, કૃતશતા, મૈત્રી, પ્રમોદ,  
કંદુણ્ણા, માધ્યસ્થ આદિ ઉત્તમ શુણોથી આપણે ભરાઈ ગયા  
છીએ..... આપણે અનંત શુણોથી પૂર્ણ ભરાઈ ગયા....  
..... ( સંકદ્વયપૂર્વક આવું અનુલબ્ધવું.)

**આચાર્યપદનું ક્યાન :**

“આચાર્યારનું” પાલન કરનારા અને કરાવનારા, જિને-  
થ્રે લગવંતના શાસનનો જગતમાં વિસ્તાર કરનારા, છત્રીસ  
શુણુના ભંડાર, આચાર્ય લગવંતોની આરાધના આપણે  
કરવાની છે. આચાર્ય લગવંતોની આરાધના કરવાથી આચાર-  
પાલનનું બળ આપણને પ્રાપ્ત થાય છે.

**પ્રયોગ :**

સર્વ આચાર્યોના પ્રતિનિધિ ગૌતમ ગણુધર લગવંત  
આપણી સમક્ષ બિરાજમાન છે.

પીળા વર્ણવાળા ( સોના જેવા વર્ણવાળા ) ગૌતમ મહારાજનું ધ્યાન કરવું.

ગૌતમ મહારાજમાંથી પીળા વર્ણનો પ્રકાશ નીકળે છે..... ( આવું દશ્ય જેવું ) તે પ્રકાશને આપણું આંતરાત્મામાં જીવીએ છીએ..... તે પ્રકાશ આપણું આપણા શરીરમાં અને આત્મપ્રદેશોમાં ફેલાય છે.....

તેમાંથી આપણને આચારપાલનનું બળ પ્રાપ્ત થઈ રહ્યું છે તેવો સંકલ્પ કરવો. આચાર્યપદનો મંત્ર : ઊં હીં નમો આચરિયાણું નો જપ ઉપરના દશ્યના દર્શન અને સંવેદન પૂર્વક કરવો.

તે પછી અનંત લખિના નિધાન ગૌતમ મહારાજના પીળા વર્ણના પ્રકાશથી આપણને આચારપાલનનું બળ પ્રાપ્ત થઈ રહ્યું છે તેવો સંકલ્પ થોડી ક્ષણ માટે સ્થિર કરીને ધ્યાન કરવું. ( આપણું કોઈ નિયમ લીધો હોય અને નિયમ પાળવા માટે આપણું મન જ્યારે ડામાડોળ થાય તે સમયે ઉપર મુજબનો પ્રયોગ કરવાથી આપણું વ્રતનિયમમાં સ્થિરતા આવે છે.) ધીજુ રીતે પણ આ પ્રયોગ કરી શકાય.

**ધીજુ રીત :—**

શ્રી ગૌતમ ગણુધર લગ્નવંત આપણું હૃદયમાં બિરાજમાન છે.

હૃદયમાં બિરાજમાન ગૌતમ મહારાજનું ધ્યાન કરવું....

હૃદયમાં ભિરાજમાન ગૌતમ મહારાજમાંથી પીળા વર્ણને  
પ્રકાશ નીકળે છે..... તે પ્રકાશ આપણા આત્મપ્રદેશોમાં  
કેલાય છે..... (આવું સંવેહન કરવું) તે પ્રકાશના ડિરણોના હિંય પ્રલાવથી આપણુંને આચાર-  
પાલનનું બળ પ્રાપ્ત થાય છે .....

(આવા સંકલપપૂર્વક સંવેહન કરવું)

આવું ધ્યાન થોડો સમય અનુકૂળતા મુજબ કરવું. આ  
પ્રયોગથી આચારપાલનનું બળ પ્રાપ્ત થાય છે.

### ઉપાધ્યાય પદનું ધ્યાન :—

ઉપાધ્યાય લગવંતો વિનય ગુણુના લંડાર છે. દ્વાદ-  
શાંગી - કુતરણાનનું અધ્યયન કરનારા અને કરાવનારા છે. ઉપાધ્યાય લગવંતોના હૃદયમાં એવા પ્રકારનો કરુણાભાવ  
હોય છે કે મૂર્ખ એવો મનુષ્ય પણ જે ઉપાધ્યાય લગવંતને  
શરણે જાય તો પંડિત બને છે. પથ્થર જેવો જડ મનુષ્ય  
પણ ઉપાધ્યાય લગવંતની ઉપાસના કરે તો તેનામાં પણ  
જાનકૃતી અંકુરા જોગે છે.

“જે ઉવન્નાય સદ્ગ તે નમતાં, નાવે લવલય શોાગ”

આવા ઉપાધ્યાય લગવંતને નમસ્કાર કરવાથી લવ-  
લયનો શોાક અને ચિંતા ચાલ્યાં જાય છે. સંસારના આધિ,  
વ્યાધિ અને ઉપાધિથી પીડાતા જીવો જ્યારે ઉપાધ્યાય  
લગવંતના શરણે જાય છે ત્યારે ખાવનાચંદનની જેમ શીત-  
ળતાનો અનુભવ કરે છે. આથી ઉપાધ્યાય લગવંતોની

આપણે ઉપાસના કરવાની છે. તેનો મંત્ર છે - “ તું હી નમો ઉવજાયાણુ,” ઉપાધ્યાય ભગવંતોની ઉપાસના કરવાથી જ્ઞાનની પરિણુતિ પ્રાપ્ત થાય છે. જ્ઞાન આપણે પુસ્તકોમાંથી, શિક્ષકો પાસેથી અગર ણીને ગમે ત્યાંથી મેળવી શકીએ છીએ, પરંતુ તે જ્ઞાન મોક્ષહેતુક બની શકતું નથો. ઉપાધ્યાય ભગવંતની ઉપાસના દ્વારા તેમનો જે અનુયઃપ પ્રાપ્ત થાય છે, તે અનુયઃપ દ્વારા ઓડું પણ જ્ઞાન આપણુને પ્રાપ્ત થાય છે તે પરિણુત જ્ઞાન થાય છે, અને મોક્ષહેતુક બને છે.

### પ્રયોગ :—

નીલમ રત્નના વર્ણવાળા ઉપાધ્યાય ભગવાન આપણું સમક્ષ બિરાજમાન છે.....

(આવું દશ્ય આંખ બંધ કરીને નજર સામે લાવવું.)

તે ઉપાધ્યાય ભગવંતમાંથી લીલા વર્ણનો પ્રકાશ નીકળે છે.....

તે પ્રકાશ આપણે જીલીએ છીએ.....

તે પ્રકાશ આપણું આત્મપ્રદેશોમાં ફેલાય છે.....

તે પ્રકાશના પ્રલાવથી આપણુને જ્ઞાનની પરિણુતિ પ્રાપ્ત થાય છે.....(આવો સંકલ્પ કરીને અનુલખ કરવો.)

(આપણું હૃદયમાં લીલા વર્ણવાળા ઉપાધ્યાય ભગવંત બિરાજમાન છે. તેમાંથી પ્રકાશ નીકળી આપણું અંદર ફેલાય છે તે રીતે પણ કરી શકાય.)

## સાધુપદનું ધ્યાન :—

જેએ જિનેશ્વર લગવંતની આજાને અનુરૂપ જીવન જીવવાવાળા છે, જે કંચન-કામિનીના ત્યાગી છે, પાંચ મહાત્મતોને જે ધારણ કરનારા છે એવા સાધુ લગવંતોની આપણે આરાધના કરવાની છે.

સકલ વિષય વિષ વારોને, નિઃકામી નિઃસંગીળ,  
લવ દ્વારા તાપ શમાવતા, આતમ સાધન રંગીળ.

( શ્રી દેવચંડજી કૃત સાધુપદની પૂજામાંથી.)

વિષયોનું ઊર જેમને નિવારણ થઈ ગયું છે, નિષ્કામી એટલે આત્માનું શુદ્ધસ્વરૂપ પ્રગટ કરવા સિવાય જેમને કોઈ ઈચ્છા બાકી નથી, સકલ પુદ્ગલ સંગનો ત્યાગ કરવાનો જેમણે નિર્ણય કર્યો છે, જેમનો લવદ્વીપી હાવાનળ શાંત થઈ ગયો છે અને જેમની પાસે જનારનો લવ હાવાનળ પણ શાંત થઈ જાય છે, જે આત્મસાધનામાં સહા રક્ત છે તેવા સાધુ લગવંતોની આપણે ઉપાસના કરવાની છે.

મુનિરાજ કરુણાસિંહ ત્રિભુવન-ખાંડુ પ્રણમું હિત લણી.

( સાધુ પદની પૂજા.)

મુનિરાજ કરુણાના સિંહ છે. ગ્રણ જગતના પરમ બાંધવ છે. સુરિ પુરંદર હરિલદરસૂરિ મહારાજા “લલિત વિસ્તરા” ગ્રથમાં ‘ધર્મમહયાણ’ પાઠની ટીકામાં સાધુપદની વ્યાખ્યા કરે છે :—

ધ્યા. પ્ર. ૧૩

सामायिकादिगतविशुद्धक्रिया अभिव्यंग्य सकल सत्त्व-हिताशय अमृत लक्षण स्वपरिणाम पव साधुधर्मः ।

सर्वे ज्ञेयोना हितना आशयदृप आत्मामां उत्पन्न थयेला (अजराभर पहने अपाववावाणा) अमृतलक्षणु परिणामने साधु लगवंतो सामायिक आहि विशुद्ध किया द्वारा अलिंब्यक्त करे छे. तेवा साधुलगवंतो साधुधर्मनुं पालन करनारा, अदार हल्जर शीलांगरथने धारणु करनारा अने हश प्रकारना यतिधर्मनुं वहन करनारा छे. क्षमा, नम्रता, सरणता, संतोष, सत्य, शौच, अकिञ्चन, तप, संयम, अहायर्य - आ हश प्रकारना धर्मने साधु लगवंतो ज्ञवनमां धारणु करे छे. हश प्रकारना धर्मना प्रलावनुं वर्णन करता कलिकाल सर्वज्ञ लगवान हेमचंद्रसूरिज्ञ महाराज योगशास्त्रना योथा प्रकाशमां धर्म लावनाना अधिकारमां कडे छे : “आ पृथ्वी निराधार टडी रही छे, सूर्य, चंद्र नियमित गति करे छे, समुद्र पोतानी मर्यादा भूकर्तो नथी वर्गेरे विश्वनुं आ अधुं तंत्र हश प्रकारना यतिधर्मना प्रलावथी व्यवस्थित याले छे.” आवा साधु लगवंतो आपणी आराधनामां सહाय करनारा छे. आपणने पण आवुं साधुपाणुं क्यारे प्राप्त थाय ! तेवा संकल्प करीने “ॐ झीं नमो लोचे सर्वसाहुणुः” आ प्रमाणे माणा गणुवी. माणा गणुती व खते नीचेनुं दश्य नज्जर सामे राख्वु.

**प्रयोग :-**

सकलसत्त्वहिताशय ३५ अमृत परिणाम जेमने

નિરંતર છે એવા સાધુભગવંતનો નીલ આકાશ જેવો વર્ણં  
કહ્યવો. એવા સાધુભગવંત આપણી સમક્ષ બિરાજમાન છે.

તેમનામાંથી નીલ વર્ણનો પ્રકાશ નોકળે છે.....

તે પ્રકાશ આપણા અંતરાત્મામાં જીલીએ છીએ....

તે પ્રકાશ આપણા આત્મપ્રદેશોમાં ફેલાય છે....

તેમાંથી સકલસત્તવહિતાશય અમૃત પરિણામ પ્રાપ્ત  
થાય છે. તે પરિણામથી સમિતિ, શુભિતનું પાલન, મહા-  
પતોતું પાલન તથા દુઃ યત્તિધર્મની પ્રાપ્તિની તીવ્ર  
ઈરણી ઉત્પન્ન થાય છે.

### સમ્યગ્રૂહર્થન :-

જે જિનેશ્વર ભગવંતોએ કહેલું છે તે જ સત્ય અને  
શાંકા વગરનું છે - આવો શ્રદ્ધાનો પરિણામ તે સમ્યગ્-  
રૂહર્થન છે. સમ્યગ્રૂહર્થન શુણુના અધિકારી બનવા માટે  
આપણુંને આ જીવનમાં જે જ્ઞાન અને શ્રદ્ધા મળ્યાં છે  
તેનું માપ કાઢવું જોઈએ.

મોટા ભાગે મનુષ્ય પોતાને મળેલાં જ્ઞાન અને બુદ્ધિના  
અહુંકારમાં રાચતો હોય છે. ચાર દિવસ પહેલાં બગોરે કચું  
લોજન કર્યું હતું? ભીંતની પાછળ શું છે? ક્ષણું પછી  
શું બનવાનું છે? પોતાના ધરની સીડીનાં કેટલા પગથિયાં  
છે? આઠલું પણ જેને જ્ઞાન નથી, તેવો મનુષ્ય આ બુદ્ધિ-  
વાદના જમાનામાં પોતાને મળેલ અદ્ય જ્ઞાન અને બુદ્ધિ  
ઉપર મુસ્તાક હોય છે. પરંતુ બીજબુદ્ધિના ધણી ગૌતમ

ગણુધર લગવંતની બુદ્ધિ પાસે આપણી બુદ્ધિ કેટલી? અતિ અદ્વય. કેવળજ્ઞાની લગવંતોના જ્ઞાનની પાસે આપણું જ્ઞાન કેટલું? અતિ અદ્વય. આવી આપણી અદ્વય બુદ્ધિ અને અદ્વય જ્ઞાનના મહમાંથી છૂટવા માટે શું કરવું? અતિ નિર્મણ બુદ્ધિ અને પરિપૂર્ણ જ્ઞાનને વરેલા પરમાત્માનું આલાંખન લેવું અને તેમના પરિપૂર્ણ જ્ઞાન પાસે પોતે કેટલો અદ્વય જ્ઞાનવાળો છે તથા પોતાની બુદ્ધિ કેટલી વિચિત્ર વાસનાઓથી ખરડાયેલી છે તેનું ભાન થતાં પરમાત્મા તીર્થાંકર દેવનું કૃથન એ જ તેની શ્રદ્ધાનું કેન્દ્ર બને છે. “તમેવ સચ્ચં નિઃશાઙ્ક જં જિણેહિ પવેદ્યં” એ ભાવ પ્રગટ થવો શરૂ થાય છે. પોતાની બુદ્ધિ અને જ્ઞાનનો અહુંકાર છોડીને મનુષ્ય જ્યારે વીતરાગ સર્વજ્ઞ તીર્થાંકર પરમાત્માએ કહેલાં તત્ત્વને સમજવા માટે પોતાની બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ કરે છે, ત્યારે તે સમ્યગુદ્ધર્ણન શુણું ગ્રાપ્ત કરવાનો અધિકારી બને છે.

સમ્યગુદ્ધર્ણનની બીજી ભૂમિકા પણ એટલી જ સહેલો છે. “શુદ્ધ દેવ શુરૂ ધર્મ પરીક્ષા સદ્ગુરુણા પરિણ્ણામ.” સુદેવ, સુગુરૂ, સુધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા તે સમ્યગુદ્ધર્ણનની બીજી ભૂમિકા છે.

સમ્યગુદ્ધર્ણનની ત્રીજી ભૂમિકા આત્મ અનુભવર્દ્ધ સમ્યગુદ્ધર્ણન છે.

“આત્મજ્ઞાનકો અનુભવ દર્શાન, સરસ સુધારસ પીજુઓ.”  
(પદ્મવિજય કૃત સમ્યગુદ્ધર્ણનની પૂજા.)

આ આત્મ અનુભવરૂપ સમ્યગુદ્ધર્ણની પ્રાપ્તિ માટે મોહનીય કર્મની સાત પ્રકૃતિનો ક્ષયોપશમ થવો જરૂરી છે. (ક્ષયોપશમ સમકિત વખતે સમકિત મોહનીયનો ઉદ્ય અને બીજુ છ પ્રકૃતિનો ક્ષયોપશમ હોય છે.) તે માટે જડ અને ચૈતન્યના લેદવિજ્ઞાનની જડર પડે છે. પુફગલ વિનાશી છે, હું અવિનાશી છું. પુફગલનું લક્ષણું શખદ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે, મારું લક્ષણું રાન, દર્શાન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ છે. પુફગલ જડ છે, હું ચૈતન્ય સ્વરૂપ છું. આવું જડ-ચૈતન્યનું લેદવિજ્ઞાન દર્શાન મોહનીયના ક્ષયોપશમનું કારણું છે. તેમાં પુફગલથી લિન્નતા ભાવિત થાય છે. અને ચૈતન્યથી એકતા ભાવિત થાય છે. જેવું પરમાત્માનું સ્વરૂપ છે, તેવું જ મારું સ્વરૂપ સત્તાએ છે અને મારી અંદર જેવું ચૈતન્ય છે, તેવું જ ચૈતન્ય જગતના જીવમાત્રમાં છે. તેવી ભાવનાથી સર્વ જીવ સાથે આત્મ-સમાન ભાવ ઉત્પન્ન થાય છે અને મૈત્રી આહિ ભાવોથી ભાવિત બનાય છે, જેનાથી અનંતાનુભંધી કૃપાયનો ક્ષયોપશમ થઈ આત્મ અનુભવરૂપ સમ્યગુદ્ધર્ણન ગુણનો અનુભવ થાય છે.

આ રીતે સમ્યગુદ્ધર્ણની આરાધનાથી સર્વ જીવ સાથે આત્મસમાન ભાવથી-મૈત્રીભાવથી ભાવિત બનાય છે, અને આપણું અંદર રહેલા પરમાત્માના જેવા જ શુદ્ધ આત્મ-ચૈતન્યની સફળણા, પ્રતીતિ અને કિંચિત અનુભવ પણ થાય છે. આપણું અંદર રહેલા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિ અને

અનુભવ માટે જિનલક્ષિત એ તેનું અનુષ્ઠાન છે; અને સર્વો  
જીવ આત્મ સમાન છે, તે માટે જીવમૈત્રી એ અનુષ્ઠાન  
છે—આવું આત્મઅનુભવ રૂપ સમ્યગ્રહર્શન આપણને પણું  
પ્રાપ્ત થાય તે માટે સમ્યગ્રહર્શનની આરાધના કરવાની છે.  
સમ્યગ્રજાન, સમ્યગ્રચારિત્ર, અને સમ્યગ્રતપ-હવે પછીના  
આ ગ્રણે પહનો પાયો સમ્યગ્રહર્શન છે. તેનું ધ્યાન કેવી રીતે  
કરવું, તે જોઈએ. આ ધ્યાનપ્રક્રિયાથી વિકસિત સમ્યગ્-  
ર્હર્શન છેવટે સમ્યગ્રચારિત્રમાં પરિણામ પામે છે. અને આ  
પ્રક્રિયાથી શમ, સંવેગ, નિવેદ, અનુકર્પા અને આસ્તિક્ય  
આદિ સમ્યગ્રહર્શનના લક્ષણો અનુભવાય છે.

મैત્રી પ્રમોદ કારુણ્ય માધ્યસ્થાનિ નિયોજયેત् ।

ધર્મધ્યાનમુપસ્કર્તૃ તદ્વિ તસ્ય રસાયનમ् ॥

(યોગશાસ્ત્ર-યોયો પ્રકાશ.)

મैત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આ ચાર લાવનાએઓ  
આત્માની સાથે પ્રયોજવી. કારણું કે આ લાવનાએઓ  
ધ્યાનને રસાયણુંની માર્કેક ખુદી કરે છે.

આ દષ્ટિએ આપણે જે ધ્યાન કરવા હુદ્ધીએ છીએ  
તેના પ્રારંભમાં મैત્રી આદિ લાવથી લાવિત બનવું જરૂરી છે.

**પ્રયોગ :—**

આવા મહાકરુણાના નિધાન, કૃપાના અવતાર, દ્યાના  
સમુર્દ, વાત્સલ્યસના ભંડાર પરમાત્માની કરુણા જગતના  
જીવ માત્ર ઉપર સિદ્ધશિલાથી છેક નીચે સાતમી નારકી  
સુધી વરસી રહી છે. ચૌદ રાજબોક પરમાત્માની કરુણાથી

પરિખાવિત થઈ રહ્યું છે.....  
.....( આવું દશ્ય આપણે જોઈએ છીએ.)

અતિ અફલુત અને આનંદમય દશ્ય આપણે જોઈએ  
છીએ.....તેનાથી આપણા હૃદયમાં લાવેલ્લાસ ઉત્પન્ન  
થાય છે. આપણા હૃદયમાં પણ સર્વ જીવ સાથે મૈત્રીભાવ  
ઉદ્ઘસ્ત થાય છે. આપણું જગતના જીવમાત્રના કલ્યાણની  
લાવના પણ પરમાત્માની કર્તૃણા સાથે મળે છે.....

અફલુત લાવેલ્લાસ આપણામાં ગ્રગટે છે.....

“ સર્વ જીવોનું કલ્યાણ થાઓ.....

સર્વ જીવો હુઃખ સુક્રત બનો.....

સર્વ જીવોનાં પાપ નાશ પામો.....

સર્વ જીવોને પરમાત્માનું શાસન મળો.....

અધા જ ઐધિભીજને પામો.....

સર્વને મીકાદ મળો.....

આ જીવ મારા આત્માની સમાન છે.....

મને સર્વ પ્રત્યે મૈત્રી છે.....

મને સર્વ પ્રત્યે સ્નેહભાવ છે.....

સર્વ જીવો સત્તાએ પરમાત્મતુલ્ય છે.....

પરમાનંદ કંદ છે અને અનંત શુણુના વુંદ છે....

સર્વ જીવ પ્રત્યે મને પૂર્ણ ગ્રેમ છે.....

સર્વનું કલ્યાણ-મંગળ થાઓ. સૌને આનંદ થાઓ....

સર્વ જીવો પ્રભુની કરુણાના યાત્ર છે, તેથી મારા પરમ ખાંધવ છે.

સર્વ જીવ ઉપર કરુણાને વરસતી જોવી.....પ્રભુની કરુણામાં આપણો કરુણાલાવ લેજો મહ્યો છે. પ્રભુની કરુણાના મહાસાગરમાં આપણો બિન્હુરૂપ લાવ લઈ જાય છે.

“ઉદ્દ્દેશ બિન્હુ સાયર ભયો.” (In tune with Infinite) આવી અવસ્થા છે.....(આવું સંવેહન કરવું.) આપણું અલગ વ્યક્તિત્વ ઓળખી ગયું છે..... સમાચિતમાં આપણે લઈ ગયા છીએ..... વિશ્વમય પરમાત્મા એ આપણું સર્વસ્વ છે..... મૈત્રીલાવનો પરમ આનંદ આપણે અનુભવીએ છીએ.....

નોંધ: આ રીતે મૈત્રીલાવનાનું ધ્યાન કરવાથી જગતના જીવો પ્રત્યે સ્નેહપરિણામ - સર્વના હિતની ઝુદ્ધિ વધતી જાય છે. તેનાથી જીવનમાં અનુકંપા, દ્વારા, દાન, પરૈ-પકાર આદિ ગુણો જીવે છે. છેવટે તે જગતના જીવો પ્રત્યેનો આત્મસભાન ભાવ, અહિંસાદિ વ્રતો, ક્ષમાદિ ધર્મો, સમિતિ, ગુરુતના પાલનમાં પરિણુભવા રૂપ ચારિત્રધર્મને એંચી લાવે છે.

આ આરાધના નિત્ય કરવાથી સર્વ જીવો પ્રત્યે પ્રેમ, કરુણા, મૈત્રી વિકસિત થાય છે. કોધ, માન, માયા આદ કંધાચો પાતળા પડે છે અને સાધના સમયે હિંય આનંદ

અને સુખનો અનુભવ થાય છે. જેની સાથે વેર, અમૈત્રી થઈ હોય તેના ઉપર કરેણું આસ વરસાવવી; તેથી સામાના લાવો બહલાઈ જશે. પરસ્પર મૈત્રી ઉત્પત્ત થશે.

આ મૈત્રીભાવનાની આરાધના - ક્ષયાનથી સમૃદ્ધિદર્શનનાં શામ અને અનુકંપા ગુણું વૃદ્ધિ પામે છે. શામ અને અનુકંપા સમૃદ્ધિદર્શનનાં લક્ષણો છે.

**સમૃદ્ધિદર્શનના ક્ષયાનનો ભીજો પ્રયોગ :-** આ પુસ્તકના પ્રયોગ નંબર ચાર પ્રમાણે કરવો.

તેનાથી સમૃદ્ધિદર્શન સમયે આત્મસ્વરૂપની પ્રતીતિ અને કિંચિત અનુભવ થાય છે. આત્મસ્વરૂપના આનંદનો થાડો રસ ચાખ્યા પછી જીવ નિરંતર તેની ઝંખના કરે છે. આવો અનુભવ કરવા માટે પ્રયોગ નંબર ચાર સુજખ ક્ષયાન કરવું.

આત્મરમણુતાનો પરમાનંદ તો સર્વ સંગ છોડચા પછી ચારિત્રધર્મમાં જ મળે. તે કારણે ચારિત્રપદ પ્રાપ્તિની તીવ્ર ઝંખના થાય છે. “સાધુ ધર્માલિકાખાશય ઇપ શ્રાવક ધર્મ.” સાધુધર્મની તીવ્ર અલિકાખા ઇપ શ્રાવકધર્મ આવે છે. જેમાં શ્રાવકધર્મને અનુરૂપ કિયા-અનુધાનની ઇચ્છિ વધતી જાય છે. સમૃદ્ધત્વની અને શ્રાવકધર્મની આચરણમાં ઉત્સાહ વધતો જાય છે. કારણું કે જેમ જેમ તેની જિનાજા-પાલનની ઇચ્છિ વધે છે, તેમ તેમ આત્મઅનુભવ અને મીલાનની પ્રાપ્તિ માટેની ચોંઘતા વધતી જાય છે. અને છેવટે “સંયમ કુદુર્મ મિલે? ચું સમકિત ગુણુઠાણુ ગવારા, આત્મસે કરત

વિચાર” આ વિચાર તેને ચારિત્રપદમાં એંચી જાય છે. સમ્યકૃત છેવટે ચારિત્રમાં પરિણમે છે.

### સમ્યગ્રજ્ઞાન પદ :—

જીવનનો ડોષપણ મહત્ત્વનો નિર્ણય શ્રુતજ્ઞાનના આલંબને કરવામાં આવે છે. શ્રુતજ્ઞાનનો અલ્યાસ કરવાથી વિવેક બુદ્ધિ ઉત્પન્ત થાય છે અને વિવેકથી જીવનનો સાચો નિર્ણય આપણે કરી શકીએ છીએ. આપણે આ જીવનમાં શું કરવું અને શું ન કરવું? કઈ વસ્તુ મૈળવવી અને કઈ વસ્તુ છોડી દેવી? શું ‘આવું’ અને શું ‘ન આવું’? આવા પ્રક્ષોનો નિર્ણય જો આપણી બુદ્ધિથી કરવા જરૂરી, તો આપણો બુદ્ધિ મિથ્યામોહથી વાસિત હોવાથી આપણી બુદ્ધિથી કરેલા નિર્ણયો એટા અને અધૂરા થાય છે. માટે હેઠ અને ઉપાહેય, કર્તાંય અને અકર્તાંય, લક્ષ્ય અને અલક્ષ્ય, તેનો નિર્ણય શ્રુતજ્ઞાનને આલંબને કરવામાં આવે છે. તે શ્રુતજ્ઞાન જ્યારે જોંડું ચિંતન સ્વરૂપ બને છે ત્યારે તે ભાવનાજ્ઞાન બને છે; અને ભાવનાજ્ઞાન જ્યારે પરમેષ્ઠિપહોના ધ્યાન સ્વરૂપ બને છે ત્યારે અનુભવજ્ઞાન બને છે. આવું અનુભવજ્ઞાન-જોમાં શુદ્ધ આત્મસર્વરૂપના અનુભવનો પરમાનંદ હોય છે-તે માટેનો ધ્યાનપ્રયોગ સમ્યગ્રદર્શનમાં ભતાવ્યો. તે વધારે જોંડાણમાં જરૂર કરવાનો હોય છે. અગર ધીજા અનેક પ્રકારે આત્મઅનુભવ રૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે.

### સમ્યગ્રચારિત્ર પદ :

સમ્યગ્રદેષિ આત્માના હૃદયમાં નિરંતર ભાવ રહે છે

કે સર્વ જીવો આત્મસમાન હોવા છતાં, હું સર્વ જીવ સાથે આત્મસમાન લાવે વર્તન કરી શકતો નથી; તેથી મને કચારે જિનેશ્વર ભગવંતોએ કહેલો ચારિત્રધર્મ પ્રાપ્ત થાય અને સર્વ જીવ સાથે આત્મસમાન લાવે હું વર્તન કરવાવાળો બનું ? બીજુ તરફ સમ્યગુદૃષ્ટિ આત્મા પોતાના આત્મામાં પરમાત્માના જેવું જ સ્વરૂપ સત્તાએ રહેલું છે તે જાણીને તે સ્વરૂપનો અનુભવ કરવા માટે નિરંતર પરમાત્માની લક્ષ્ણ, અજ્ઞાપાલન આદિમાં રક્ત હોવા છતાં સંસારમાં અનેક પ્રકારની વિટંખણા હોવાથી સંપૂર્ણપણે પરમાત્મા સાથે ધ્યાનની એકતા દ્વારા પરમાનંદનો અનુભવ અને સંપૂર્ણ આજાનું પાલન કરી શકતો નથી. તેથી સમ્યગુદૃષ્ટિ આત્મા જંખે છે કે કચારે મને પરમાત્માએ કહેલો (પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયરૂપ) ચારિત્ર ધર્મ પ્રાપ્ત થાય અને પૂર્ણપણે પરમાત્માની આજાનું પાલન કરી પરમાત્મા સાથે અલેં ધ્યાન સિદ્ધ કરી, આત્મસરૂપ રમણુતારૂપ શુદ્ધ-ચારિત્રના પરમાનંદનો અનુભવ કરું ?

ઉપાધ્યાય બશોવિજયજી કૃત ‘સમ્યગુદર્શન’ની પૂજામાં “નિજ શુદ્ધ સત્તા પ્રગટ અનુભવ કરણું રુચિતા ઉછળે” એટલે સમ્યગુદૃષ્ટિ આત્માને પોતાની શુદ્ધ આત્મસત્તાનો અનુભવ કરવાનો તીવ્ર ઈચ્છા ઉછળા મારે છે,

૫. પદ્મવિજયજી કૃત ‘સમ્યગુદર્શન’ની પૂજામાં

‘પ્રભુ નિર્મણ દર્શન કીજુએ;

આત્મજ્ઞાનકો અનુભવદર્શન સરસ સુધારસ પીજુએ.’

એટલે કે ‘હે ગ્રલુ! મારુ’ દર્શાન-સમ્યકૃત્વ નિર્મળ કરો. આત્મસ્વરૂપનો અનુભવ તે સમ્યગ્રૂહર્થાન છે, તે સમ્યગ્રૂહર્થાનરૂપ ઉત્તમ અમૃતરસનું પાન કરીએ.”

સમ્યગ્રૂહર્થાન ગુણસ્થાનકે રહેલ આત્મા ભાવના કરે છે :  
“સંયમ કબ્ધ મીલે ? સસનેહી ખારા હો.

શું સમકિત ગુણઠાણ ગવારા, આત્મસે કરત વિચારા હો.

સંયમ કબ્ધ મીલે ?”

સમ્યગ્રૂહષિ આત્માની આવી નિર્મળ પવિત્ર જંખના છેવટે શુદ્ધ ચારિત્રક્રષે પરિણિમે છે અને સમિતિ ગુપ્તિના પાલન, મહાબ્રતો અને ક્ષમાદિ ધર્મો દ્વારા સર્વ જીવો સાથે આત્મસમાન શુદ્ધ વ્યવહાર ઉત્પન્ન થાય છે; અને પરમાત્માના અલોદ ધ્યાન દ્વારા સ્વરૂપરમણુતા અને તે દ્વારા પરમાનંદના અનુભવરૂપ નિશ્ચય ચારિત્રક્રષે આત્મા સ્થિર બને છે. તે વખતે સ્વરૂપરમણુતાના પરમાનંદના અનુભવનું સુખ બાર માસના ચારિત્ર પર્યાયવાળાને અનુત્તર વિમાનવાસી હેવ કરતાં અધિક સુખનો અનુભવ કરાવે છે.

“બાર માસ પર્યાયે જેહને, અનુભવ સુખ અતિક્બીએ.”

( ઉ. યશોવિજયજી કૃત નવપદ પૂજા )

“જણુ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવમાં રમતો રે.”

“ચારિત્ર ગુણ વળી વળી નમો, તત્ત્વ રમણ જસુ મૂલોઝુ.”

( ચારિત્રયદ્ધની પૂજા )

આવા નિર્મળ સ્વરૂપરમણુતા રૂપ શુદ્ધ ચારિત્રના મૂળમાં સમ્યગુદ્ધર્થન છે. અને સમ્યગુદ્ધર્થનની નિર્મળતા અરિહ્ઠંતાદિ પરમેષ્ઠિએના ધ્યાન, ઉપાસના અને આજ્ઞાપાલન ક્રારા થાય છે.

પરમાનંદની પરાકાઢાએ પહેંચેલા પરમાત્માનું સમરણ, દર્શન, પૂજન, વંદન, સ્તવન અને ધ્યાન સાધકને પરમાનંદની પ્રાપ્તિનું પરમ કારણ છે.

શરૂઆતમાં તો આપણો જીવ બાધ્ય વસ્તુઓમાં સુખ અને આનંદ માટે હોડતો હોય છે અને રાત-દિવસ તે માટે જ પ્રયત્નરીત હોય છે. પરંતુ જીવનમાં જ્યારે સફ્ઝગુરુનો કૃપા ક્રારા પરમાત્મસરૂપને પિછાને છે અને જેવું પરમાત્માનું સ્વરૂપ છે; તેવું જ પોતાનું સ્વરૂપ છે -એવું જણે છે, ત્યારે તેના જીવનમાં સાચો રાહ જિઘડે છે.

“પ્રભુ મુદ્રાને ચોગ પ્રભુ પ્રભુતા લખે;  
ક્રોધ તણે સાધર્થ્ય સ્વરૂપચી ચોળખે.”

પરમાત્મા સાથે આત્મદ્રવ્યનું સાધર્મિકપણું ખ્યાલમાં લાવીને, પોતાની અંદર અનંત સુખ અને આનંદનું નિધાન રહ્યું છે તેવી ઓળખાણું સાધકને થાય છે.

“ઓળખતાં બહુ માન સહિત રુચિ પણ વધે;  
રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.”

આજ સુધી આદર-બહુમાન પુછ્છગલનું છે, રુચિ પર-પુછ્છગલની છે, વીર્ય પરઅનુયાયી છે, રમણુતા પરવસ્તુમાં

છે, આપણી આખી ચેતના પુષ્ટગલ અનુયાયી બની ગઈ છે. તે ચેતનાને આત્મસ્વરૂપ અનુયાયી બનાવવા માટે જેનું સંપૂર્ણ શુદ્ધ પરમાનંદ સ્વરૂપ પ્રગટ થયું છે, તેવા પરમાત્માનું આલાન લેલું પડે છે. પરમાત્મસ્વરૂપને અવલાંભેલું આપણું ચૈતન્ય, પરમાત્મ ગુણોના રંગો રંગાયેલી આપણી ચેતના, પરમાત્મગુણુ રસિક અનેલી આપણી ચેતના, છેવટે આત્મસ્વરૂપ અનુયાયી બની શકે છે. તેથી પરમાત્મા મીક્ષ પ્રાપ્તિના પુષ્ટ નિમિત્ત છે. તે જ એક આધાર, પ્રાણ, ગ્રાણ, શરણુ છે. તે જ એક દર્શાન, પૂજન, વંદન, સ્તવન, દ્યાન, સમરણુ કરવા લાયક છે - તેવો લાવ પ્રગટ થતાં અનાહિથી પુષ્ટગલ અનુયાયી બનેલું ચૈતન્ય, પરમાત્મા તરફ આદર, અહુમાન, રુચિવાળું બને છે. પરમાત્માના ગુણોમાં રુચિ થતાં, 'રુચિ અનુયાયી વીર્ય' તે નિયમ મુજબ આત્માની અધી શક્તિઓ પરમાત્માની નિકટ હિશામાં કાર્યશીલ બને છે.

દર્શાન જ્ઞાનાદિક ગુણ આત્મના, પ્રભુ પ્રભુતા લયલીન, શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી, તસુ આસ્વાદન પીત. પૂજના તો કીને રે બારમા જિનતણું.

( શ્રી દેવચંદ્રજી કૃત )

ક્ષયોપશમ ભાવે અંશતः ખુલ્લાં થયેલાં આપણું દર્શાન, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય ને પરપુષ્ટગલ અનુયાયી હતાં, તે પરમાત્મ અનુયાયી બને છે; અને પરમાત્મામાં તન્મયતા, તર્ફૂપતા, એકત્વતા ઉત્પન્ત થાય છે.

“શુદ્ધ તત્ત્વ રસ રંગી ચેતના, પામે આત્મસ્વભાવ.”

પરમાત્મ તત્ત્વ સાથે એકત્વ સાધતાં પોતાના આત્મામાં રહેલા પરમાનંદમાં પ્રવેશ થાય છે; અને તેમાં સ્થિરતા થતાં, આત્મસ્વરૂપનો અનુભવ થાય છે. તે અનુભવ જ વિશ્વ ઉપરનું પરમ અમૃત છે. આવા પરમામૃતનું પાન કરવું તે માનવજીવનનું પરમ લક્ષ્ય છે. તે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ચારિત્રયદની પ્રાપ્તિની તીવ્ર અભિલાષાપૂર્વક “અ હ્રીં નમો ચારિતરસ” પહનો જાપ કરવો — આ રીતે ચારિત્રયદની આરાધના કરવી. સમ્યગુદ્ધર્ણન પદમાં બતાવેલ પરમાત્મ ધ્યાન અને મैત્રીલાલાવનાનું ધ્યાન વિકસિત થતાં છેવટે ચારિત્રમાં પરિણ્ણામ પામે છે. તે વખતે સ્વરૂપરમણુતા રૂપ ચારિત્રનો પરમાનંદ અનુભવાય છે. આવું ચારિત્ર આપણુને પણ પ્રાપ્ત થાય તેવા લક્ષ્યપૂર્વક ચારિત્રયદનું આરાધન કરવું:  
**સમ્યગુત્તપ પદ :**

ઇ બાધ્ય અને ઇ અલ્યાંતર એમ આર પ્રકારનો તપ છે; જેનું ક્રણ મોક્ષ પદ છે. ધન્દ અને યકૃવતીની સંપત્તિ એ જેનું કૂલ છે. સમતારૂપ અમૂલ્ય જેનો રસ (મકરંદ) છે, તે તપને શાની પુરુષો કલ્પવૃક્ષ સરીખું કહે છે. કહ્યું છે કે—

ક્રણ શિવસુખ મહોદું, સુર નરવર સંપત્તિ જેહનું કૂલ;

તે તપ સુરતર સરિઓ વંદું, સમ મકરંદ અમૂલ રે.

લવિકા સિદ્ધયક પદ વંદો.

વંદીને આનંદો રે લવિકા, નાવે લવભવ ઝંદો રે લવિકા;  
યાળે દુરિતહ દંદો રે લવિકા, સેવે ચોસઠ ધનદો રે લવિકા;

ઉપશમ રસનો કંદો રે ભવિકા, જિમ ચિરકાલે નંદો રે ભવિકા;  
શ્રી શ્રીપાલે સેવ્યો રે ભવિકા, મધ્યણુએ આરાધ્યો રે ભવિકા.

સિદ્ધચક્ર પદ વંદો.  
( નવપદની પૂજા )

આ તપ્યપદ જગતનું સર્વોત્કૃત મંગલ છે. તે તપ  
ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે.  
‘કર્મ’ નિકાચિત પણ ક્ષય થાયે, ક્ષમા સહિત જે કરતાં.

આવા અપૂર્વ ભાવપૂર્વક તપ પદનો મંત્ર જપ  
“ ઓ હ્રી નમો તત્ત્વસ્ત” કરવો.

તાત્ત્વિક રીતે ઈચ્છાઓના નિરોધિત્ય સંવર કરી,  
મન, વચન, કાયાની એકાચ્ચતાથી સમતારસમાં પરિણુમન  
કરી, આત્મા પોતાના ગુણોનો લોગ કરી સ્વરૂપમાં રમણુતા  
કરે તે જ તપ છે.

સમ્બ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના છેલ્દે  
સ્વરૂપરમણુતામાંથી સ્વરૂપસ્થિરતા ઝેપે તપપદમાં પરિણુમશે.

ઇમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે;  
નવમે લવ શિવ જાવે, હેવ નરસવ પાવે.

આ રીતે નવપદનું ધ્યાન આપણે સૌ આરાધીએ.  
આપણી ભૂમિકાને અનુરૂપ કિયા - અનુષ્ઠાન પૂર્વક નવપદનું  
ધ્યાન નવ લવમાં મોક્ષને આપનાર બને છે.

જ્ઞાન વિમલ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રલાવે;  
સવિ હુરિત ગમાવે, વિશ્વ જ્યકાર પાવે.

પ્રે. શાનવિમલસૂરીશરળ કહે છે - આ સિદ્ધયકેતા પ્રભાવે સર્વ હુઃખ અને કર્મનો ક્ષય થઈ, પરમ આનંદમય આત્મસ્વરૂપ પ્રગટ થાય છે.

ધર્મયા નવપદ ધ્યાનને જોહ ધ્યાયે,  
સદાનંદ ચિહ્નપતા તેહ પાવે.

આ નવપદના ધ્યાનને આપણે નિરંતર ધ્યાઈએ; જેનાથી પરમાનંદમય આત્મસ્વરૂપનો અનુભાવ અને છેવટે તેની પ્રાપ્તિ થાય છે.

એમ નવપદ શુષ્ટાતો તિહાં લીનો, હુઓ તનમય શ્રીપાલ.

શ્રીપાલ અને મયણુએ નવપદનું ધ્યાન કર્યો હતું. આપણે પણ આપણી ભૂમિકા સુજાપ નવપદની સર્વ પ્રકારે આરાધનાપૂર્વક ધ્યાન કરીએ.

નવપદની આરાધનાનું મૂળ આત્મભાવ છે. નવપદમાં આત્મા છે અને આત્મામાં નવપદ છે. આ વસ્તુને આપણે વિશેષ રૂપે સમજુએ.

**નવપદની સાધના દ્વારા વિકાસકેમની ભૂમિકાએ :**

Observation of Absoluteness

**નવપદમાં આપણા આત્માના પૂર્ણસ્વરૂપનું દર્શાન :**

જ્યારે આપણે પરમાત્માનું દર્શાન કરીએ છીએ, ત્યારે અનંતકાળથી (એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના અનંત લવોમાં) વિસરાઈ ગયેલું આપણું પોતાનું આત્મયા. પ્ર. ૧૪

સ્વરૂપ છે, તેની સભાનતા થાય છે. મહાપુરુષે કહ્યું છે —

“ હૃઠી સુવિધિ જિલ્લાં સમાધિરસે લયો,  
ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો બીસ્યો.”

જ્યારે દેવાધિહેવ પરમાત્માનું દર્શાન કરીએ છીએ  
ત્યારે આપણું આપણું પોતાનું પરમાત્મા જેવું જ  
વિસરાઈ ગયેલું ભૂળ સ્વરૂપ ચાદ આવે છે. પરમાત્માનું  
દર્શાન કે સમરણ તે આપણા પોતાના જ અભૂત સ્વરૂપનું Observation-દર્શાન છે. નવપદો એ આપણાં  
પોતાનાં જ નવ દિવ્ય રૂપો છે.

### Determination of Destination

#### દ્યેયનો નિર્ણય

પરમાત્માના દર્શાનથી, તેમના જેવા જ આપણા આત્મ-  
સ્વરૂપની સભાનતા થાય છે. અને ‘સત્તાએ આપણા આત્મામાં  
પરમાત્માના જેવો જ અનંત સુખ અને આનંદનો ખણનો  
છે’ તેવું સમજાય છે, ત્યારે ‘મારે હવે તે જ જેઈએ?’  
સેવો વિચાર આવે છે. પછી તે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું  
તેવું દ્યેય નક્કી થાય છે.

પ્રભુ સુદ્રાને યોગ, પ્રભુ પ્રભુતા લખે;

દ્રોય તણે સાધભ્ર્યે સ્વ-સંપત્તિ ઓળખે,

ઓળખતાં બહુમાન, સહિત તુચ્છ પણું વધે;

તુચ્છ અનુયાયી વીર્યે, ચરણધારા સધે.

( શ્રી દેવચંદ્રજી કૃત સુવિધિનાથ લગ્નવાનનું સ્તરન. )

માટે 'નમો સિદ્ધાંશુ' તે સર્વ ધ્યેયોનું મૂળ - ધ્યેય-  
બિંદુ છે. પ્રાપ્ત કરવા લાયક શું છે? તેનો નિર્ણય 'નમો  
સિદ્ધાંશુ'ના ધ્યાન દ્વારા થાય છે.

અત્યારે તો માત્ર આપણું ધ્યેય એટલું જ છે કે મારી  
પાસે ૧૦ લાખ અને પાડોશી પાસે ૨૦ લાખ છે, તો  
મારે ૨૦ લાખ લેગા કરવા. આપણે ૨૦ લાખ લેગા  
કરવા જઈએ છીએ, ત્યાં તો પાડોશી પાસે ૪૦ લાખ થઈ  
જાય છે. એટલે આપણે પણ ૪૦ લાખ લેગા કરવા જઈએ  
છીએ. અને આપણી પાસે ૪૦ લાખ થાય, ત્યાં તો પાડોશી  
પાસે કોડ થઈ જાય છે. એટલે આપણે પણ કોડ લેગા  
કરવા જઈએ છીએ. ત્યાં વચ્ચે આચુષ્ય પૂરું થઈ જાય છે,  
અગર તો પૈસા આપણી પાસે પૂરતા થઈ જાય છે ત્યારે  
અસો-ચારસો માણસના સર્કલમાં - જેમાં આપણે વસીએ  
છીએ તેમાં 'અમે કાંઈ જેવા તેવા નથી' એવું સાભિત  
કરવા પાછળ દોડીએ છીએ. 'થીજા કરતાં અમે પણ ચઠિ-  
યાતા છીએ' તેવું સાભિત કરવા માનવજીવનનો મોટા  
લાગનો સમય ખર્યોય છે.

આ કાંઈ માનવજીવનનું ધ્યેય નથી. પરંતુ જ્યારે  
મનુષ્ય પરમાત્માનું સ્વરૂપ જાણે છે અને તેવું જ સ્વરૂપ  
પોતાની અંદર રહેલું છે અને તે પ્રાપ્ત થઈ શકે તેમ છે,  
તેવું જ્ઞાન તેને અરિહંત - સિદ્ધ જગ્ન તોનાં દર્શાન, પૂજન,  
વંદન, સ્તવન, ધ્યાન, સમરણ રૂપ નમસ્કારસાવથી થાય છે,  
ત્યારે મનુષ્ય પોતાનું આત્મસ્વરૂપ પ્રગટ કરવું તેવું ધ્યેય-લક્ષ્ય

નક્કી કરે છે. જો કે આત્મસ્વરૂપ પ્રગટ કરવાનું ધ્યેય પૂર્ણપણે  
આ જીવનમાં ગ્રાહ્ય થઈ શકે તેમ નથી, કારણું કે અત્યારે  
આપણી પાસે તે માટેની પરિપૂર્ણ સામચ્ચી નથી; પરંતુ આ  
જીવનમાં તે ધ્યેયને પહોંચવા માટે કચાં સુધી જઈ  
શકાય તેમ છે?

તો બધા જાની પુરુષોનો એક જ અલિપ્રાય છે કે  
આ જીવનમાં આત્માનુભવ, આત્મહર્ષન, આત્મસાક્ષાત્કાર  
કરી શકાય છે અને તે દ્વારા પરમાનંદનો અનુભવ થઈ શકે  
છે. તથા જીવાન્તરમાં અનુકૂળ સંયોગ-સામચ્ચી મળતાં પૂર્ણ  
આત્મસ્વરૂપ પ્રગટ કરી શકાય છે. વર્ત્તમાનમાં જીવનનું લક્ષ્ય-  
બિંદુ આત્મસાક્ષાત્કાર દ્વારા પરમાનંદનો અનુભવ, અને  
જીવાન્તરનું લક્ષ્યબિંદુ પૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થની તે  
આ રીતે નિર્ણીત થાય છે. તેને જ Dynamic desire of  
Destination – મોક્ષની તીવ્ર ઈচ્છા ( સંવેગ ) કહેવાય છે.  
નવપદનું જે સ્વરૂપ છે તેથું જ દિવ્ય સ્વરૂપ મારા અંદર  
છે અને મારે હવે તે જ જોઈજો છે તેવા ધ્યેયનો નિર્ણય  
નવપદના આલંખને થાય છે.

Architect of Originality.

**મૂળભૂત આત્મચૈતન્ય પ્રગટ કરવાનો હલ્યુ મિન્ડ**

આત્મસ્વરૂપ પ્રગટ કરવું એ જ એક માનવજીવનનું  
ધ્યેયબિંદુ છે-તેવો નિર્ણય પરમાત્મદર્શન તથા અરિહંતા  
અને સિદ્ધપદના ધ્યાન દ્વારા થાય છે. મકાન બાંધવામેં

નિર્ણય કર્યો પછી આર્કિટેક્ટની પાસે નક્શો આપણે કરાવીએ છીએ. અને લૌકિક આર્કિટેક્ટની કળાને સારી રીતે જાણુનાર Civil Engineer મકાન બાંધતાં પહેલાં blue print - નક્શો તૈયાર કરી આપે છે. તે રીતે આઠે દ્રવ્યક્રમના અને ભાવકર્મ (રાગ-ક્રેષ-મોહ અને અજાન)ના બાંધનમાં રહેલા આપણા આત્માને પ્રથમ ગુણુસ્થાનકથી આરમા ગુણુસ્થાનકના અંત ભાગ સુધી પહેંચાડવાનો blue print - નક્શો નવપદના ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય છે. આર્કિટેક્ટની સર્વોત્કૃષ્ટ કળા જે આપણા મૂળ સ્વરૂપ સુધી પહેંચાડે છે, તે કળા નમસ્કાર મહાભંગ અને નવપદમાં રહેલી છે.

પ્રથમ ગુણુસ્થાનકથી ચતુર્થ ગુણુસ્થાનકે કેવી રીતે 'પહેંચાવું' ? ચરમ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ ઇય મહાસમાધિ, અનિવૃત્તિકરણ અને અંતરકરણ દ્વારા સમ્યગુદર્શન કેવી રીતે પ્રાપ્ત કરવું ? પાંચમા અને છઢ્ઠા ગુણુસ્થાનકની આરાધના દ્વારા અપ્રમત્ત ગુણુસ્થાનકના સ્પર્શ ઇય આત્મરમણુતાના પરમાનંદને કેવી રીતે અનુભવવેા અને ક્ષપકશેણી દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયના પુથ્ર પુથ્ર અને છેવટે એકત્વ ઇયે દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાન દ્વારા અલેદ રતનતરથીને સ્પર્શી 'સ્વરૂપ એકત્વપણે પરિણુમી, ધાતી કર્મોનો ક્ષય કરી' કેવળજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે Architect of Originalityનો Blue Print - નક્શો નવપદના ધ્યાનથી પ્રાપ્ત થાય છે. (વિશેષ વિગત માટે જુઓ પ્રચીણ નં. ૩૪.)

## Organization To Immortality

**દ્યોય-લક્ષ્યને પહોંચવા માટેની વ્યવસ્થાશક્તિ**

મકાન માટેનો નકશો તૈયાર થયા પછી, તે નકશો અસામાં લઈને કુરવાથી મકાન બંધાતું નથી. તે માટે વ્યવસ્થાશક્તિ (Organization Power)ની જરૂર પડે છે, તેમ નવપહ્ના ધ્યાન કારા આત્મસ્વરૂપની પ્રાપ્તિનો હદ્દું પ્રિન્ટ નકશો પ્રાપ્ત થયા પછી સાધના માટેની વ્યવસ્થાશક્તિ (Organization Powet)ની જરૂર પડે છે. તે આત્મસ્વરૂપપ્રાપ્તિ માટેનો ઉત્સાહ (વ્યવસ્થાશક્તિ) નવપહ્નની વિશેષ આરાધના અને ધ્યાન કારા પ્રાપ્ત થાય છે.

**Business Organization – વ્યાપારનું વ્યવસ્થાતંત્ર**  
 શીખવા માટે ધણ્ણા માણુસો અમેરિકા જાય છે, પરંતુ આપણું ચોતાનું શાશ્વત, આનંદમય, અચિંત્ય શક્તિયુક્તા, અન્યાખ્યાધ સુખમય સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરવું તે કળા શીખવી જરૂરી છે અને તેનું શિક્ષણ નવપહ્ના ધ્યાનમાંથી મળે છે. અને તે પછી જીવનમાં Science of Supremacy (આત્મવિજ્ઞાનના પ્રયોગ કારા) (Realisation of Realily) (આત્મસ્વરૂપનો અનુભવ) પ્રાપ્ત થાય છે.

**Scientifically Secured – shree NAVPAD**

**નવપહ્નો એ વિશ્વ ઉપરનું સ્વર્યાંસિક્ષ, સર્વોત્કૃષ્ટ,  
 મહાવિજ્ઞાન છે.**

અનંત કરુણામય પ્રભુ શ્રી મહાવીર લગ્નાન  
 દેશનામાં કહે છે કે :-

“આરાધનાતુ” મૂળ જસ, આતમલાવ અહેહ; તિણે નવપદ છે આતમા, નવપદ માંહે તેહ.”

શ્રી નવપદમાં આત્મા છે, અને આત્મામાં નવપદો છે. નવપદમાં આત્મા અને આત્મામાં નવપદોનો અનુભવ કરવા માટે લગવાન દેશનામાં આગળ કહે છે કે :-

“ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણુ;  
તિણે નવપદ છે આત્મા, જણે કોઈ સુનાણુ.”

પહેલી નજરે આપણુને એવું લાગે છે કે નવપદમાં આત્માનો અને આત્મામાં નવપદોનો અનુભવ કરવો એ ખડુ કહિન કાર્ય છે. તેવો અનુભવ કરવા માટે તો હિમાલયની ગુઝામાં ચોગી બનીને એસવું પડે, પરંતુ તેવું કરવાની કોઈ જરૂર નથી. તેવો અનુભવ કરવા માટે જિનાગમ અને જિનબિંબ (મૂર્તિ)નું આલંબન લેવાની જરૂર છે. નવપદમાં આત્માને સહેલાઈથી સમજવા માટે એક દ્યાંત જોઈ એ :-

એક શોડ જિનમંહિરમાં પૂજા કરવા માટે ગયા. તેમના વેર મહેમાન આવ્યા. મહેમાને શોઠાણીને પૂછ્યું કે, શોઠ કુચાં ગયા છે? શોઠાણીએ કહ્યું કે શોઠ અત્યારે વક્તીલને વેર ગયા છે. થોડી વારમાં શોઠ જિનમંહિરથી પૂજાના કપડામાં પૂજાની સામગ્રી સાથે વેર આવ્યા. મહેમાને જિન-મંહિરથી શોઠને આવતાં જોઈને શોઠાણીને કહ્યું કે શોઠ તો જિનમંહિરથી આવે છે! ત્યારે શોઠાણીએ કહ્યું કે શોઠને પૂછો : જિનમંહિરમાં હતા, તે વખતે તેમનું ધ્યાન કચાં

હતું ? શેઠે કખૂલ કખૂલ કર્યું કે તે મંદિરમાં હતા, ત્યારે તેમનું ધ્યાન ડોર્ધિની પાસે પૈસા લહેણા હતા તે વસૂલ કરવા માટે વકીલની સલાહ લેવામાં હતું. શેઠ હતા તો જિનમંહિરમાં, પણ તેમનું ધ્યાન, તેમનો ઉપયોગ (Attention) વકીલમાં હતો. તેથી શેઠ વકીલને ઘેર ગયા હતા, તેવું આપણે કહુંએ છીએ. એટલે જ્યાં ઉપયોગ ત્યાં આત્મા. જેમાં ધ્યાન તેમાં આત્મા - આવો નિયમ આમાંથી નીકળે છે.

હવે આપણો ઉપયોગ, આપણું ધ્યાન નવપદમાં હોય ત્યારે, આપણો આત્મા કચાં છે ? એનો ઉત્તર સ્પષ્ટ છે કે જ્યારે આપણે આપણો ઉપયોગ નવપદમાં લીન કરીએ છીએ ત્યારે આપણો આત્મા નવપદમાં છે.

હવે, આત્મામાં નવપદો કેવી રીતે છે તે દૃષ્ટાંતથી જોઈએ.

એક માણુસ ચરમાને જેવામાં લીન બની ગયો. તે જેવામાં તન્મય-તદ્ગૂપ બની ગયો, તે વખતે તેના આત્માએ ચરમાનો આકાર ધારણ કર્યો.

સિનેમાની નટીના દશ્યમાં તન્મય, બનેલો માણુસ તે નટીના ધ્યાનથી પોતાના આત્માને તે સિનેમાની નટીના આકારે પરિણિમાવે છે. એવી જ રીતે કોઇના, માનના, માયાના, લોભના ઉપયોગમાં પોતાના આત્માને પરિણિમાવે છે, ત્યારે આત્મા કોઈ, માની, માયાવી, અને લોભી આકારે પરિણિમે છે. તે જ ન્યાય લગવાનના મંહિરમાં છે. પરમાત્માના મંહિરમાં જઈ, જ્ઞારે આપણે આપણો ઉપયોગ પરમાત્મામાં સ્થિર કરીએ.

છીએ, પરમાત્મામાં તદાકાર ઉપયોગે સ્થિર રહીએ છીએ, ત્યારે આપણો આત્મા પરમાત્માનો આકાર ધારણ કરે છે. જ્યારે આપણે નવપદના ધ્યાનમાં તન્મય, તરૂપ, તદાકાર-રૂપે રહીએ છીએ, ત્યારે આપણો આત્મા નવપદના આકાર વાળો બને છે. એટલે કે આપણો આત્મા નવપદના ઉપયોગમાં સ્થિર થાય છે, ત્યારે આપણો આત્મામાં નવપદો છે. જે સમયે ઉપયોગ સ્થિર થવાથી નવપદમાં આત્મા છે, તે જે સમયે આત્મામાં નવપદો છે. objectively એટલે નિમિત્ત દિષ્ટિભિન્હથી નવપદમાં આત્મા છે; અને subjectively એટલે ઉપાદાન દિષ્ટિભિન્હથી આત્મામાં નવપદો છે.

પ્રભુ મહાવીરે ખતાવેલું આ તરત્વજ્ઞાન જગત ઉપરનું સર્વોત્કૃષ્ટ વિજ્ઞાન Supreme Science છે.

જે (અરિહંત આદિ) ભાવ વડે આત્મા પરિણુભે છે, તે (અરિહંતાદિ) ભાવ વડે તે (આત્મા) તન્મય (અરિહંતાદિમય) બને છે. તેથી અરિહંતના ધ્યાનમાં નિષ્ઠ એવો આત્મા તે (અરિહંત ભાવ) થડી પોતે જ ભાવ અરિહંત (આગમથી) થાય છે.

એટલા માટે લગ્વાન મહાવીર પરમાત્મા અહીં કહે છે —

‘ધૈર્ય સમાપત્તિ હુએ, ધ્યાતા ધૈર્ય પ્રમાણુ;  
તેણે નવપદ છે આત્મા, જણે કોઈ સુનાણુ.’’

ધૈર્ય નવપદ છે. ધ્યાતા આપણો આત્મા છે અને ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનું ચયતન્ય ધૈર્યમાં નિષ્ઠ થઈ

નાય છે, જે સમયે ધ્યાતાનો ઉપરોગ ધ્યેયાકારે પરિણું મેળે છે, તે સમયે નવપદમાં આત્મા અને આત્મામાં નવપદનો અનુભવ થાય છે.

આજ સુધીમાં નવપદમાં આત્મા અને આત્મામાં નવપદના ધ્યાનથી અનંત આત્મા સિદ્ધિપદને પામ્યા છે. આજે પણ તેના ધ્યાનથી આપણી ભૂમિકાને ઉચ્ચિત આત્મસ્વરૂપનો અનુભવ (Realisation of Reality) પ્રાપ્ત કરી શકીએ છીએ. તે માટે પ્રયોગાત્મક સાધના કરવી પડે.

જગતનું સુપ્રીમ સાયન્સ હાથમાં આવ્યા પણી, તે પ્રયોગનો કાગળ ખીસામાં લઈને ફરીએ તો પણ કાર્યસિદ્ધિ થતી નથી. કાર્યસિદ્ધિ માટે સ્વયં પ્રયોગ કરવો પડે છે. દા. ત., “પ્રભુ નામે આનંદ કંદ” આ વાક્યમાં પ્રભુનું નામ તે પ્રિન્સીપલ (સિદ્ધાંત) છે, અને આનંદનો કંદ રીઝિટ (ક્રણ) છે. આ એ વસ્તુ ચાંદ કરવાથી કાર્યસિદ્ધિ થતી નથી પણ આ કાર્યસિદ્ધિની ફોમ્યુલા છે.

Principle + Application = Result

સિદ્ધાંત + પ્રયોગ = ક્રણ

એપ્લીકેશન - પ્રયોગ દ્વારા જ કાર્યસિદ્ધિ થાય છે.

કેમેસ્ટ્રીનો નાનામાં નાની ફોમ્યુલા -  $H_2O$  = water

એ ભાગ હાઇડ્રોજન + એક ભાગ એક્સ્ટ્રીજન = પાણી

હવે એક ખાટલામાં હાઇડ્રોજન અને એક ખાટલામાં એક્સ્ટ્રીજન લરીને દસ વર્ષ રાખીએ તો પણ પાણી બનતું

નથી. તે પ્રયોગની સિદ્ધિ માટે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન કરવું પડે છે. તે રીતે પરમાત્મા તેમના ડેકાણે અને આપણે આપણા ડેકાણે - તે પ્રમાણે વખો સુધી પ્રયત્ન કરીએ તો પણ કાર્યસિદ્ધિ ન થાય. પરમાત્મા અને આપણા આત્માનો ભેળાપ થવો જોઈ એ. ધ્યાન ક્ષારા, ઉપરોગ ક્ષારા પરમાત્મા અને આપણા આત્માનું જોડાય થાય છે ત્યારે કાર્યસિદ્ધિ થાય છે.

સમજપૂર્વક આપણા ઉપરોગ નવપદમાં જોડીએ તે વખતે નવપદમાં આત્માનો અને વધુ સ્થિરતા આવતાં આત્મામાં નવપહેનો અનુભવ શ્રીપાલ મહારાજાને મયણા-સુંદરીની જેમ આપણે પણ કરી શકીએ છીએ.

નવપહેના એક-એક પદનું છૂટું ધ્યાન કરી, છેવટે નવ-પદનું લેગું ધ્યાન કરવું. હૃદયમાં આઠ પાંખડીવાળા કમળની આકૃતિ કદ્વપવી. તેમાં કંચિદ્કામાં અરિહંત પદ, ચાર વિદ્યાની ચાર પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા ચાર વિદ્યાની ચાર પાંખડીમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-આ રીતે કમળાકારે નવપદનું ધ્યાન આત્માનુભવ-સુધી લઈ જશે.

શ્રીપાલ મહારાજને જીવનમાં જે સિદ્ધિએ પ્રાપ્ત થઈ તથા નવમા જીવે મોક્ષ પર્યાત પહેંચી શક્શે તેના મૂળમાં ગ્રલુ મહાવીરસ્વામીએ બતાવેલી આ નવપદમાં આત્મા અને આત્મામાં નવપહેની પ્રત્યક્ષ અનુભવસિદ્ધ સાધના છે.

## નવપદના ધ્યાનની સર્વોચ્ચ ભૂમિકા

શ્રીપાલના રાસમાં મહાવીરસ્વામી દેશનામાં કહે છે —

અરિહંત પદ ધ્યાતો થકો, દંબહ ગુણ પજળય રે;

લેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.

મહાવીર જિનેશ્વર ઉપદિશો, તુમે સાંભળજો ચિત્ત લાઈ રે;

આતમ ધ્યાને આતમા, ઋષિ મળે સવિ આઈ રે.

વીર જિનેશ્વર ઉપદિશો.

અરિહંત પરમાત્માના ધ્યાનમાં ને સમયે ધ્યાતા ( ધ્યાન કરનાર ) સ્થિર બની જાય છે, ને સમયે ધ્યાતાને ઉપયોગ ધ્યેય — પરમાત્મામાં તાન્મય — તદ્દૂપ થઈ જાય છે, તે સમયે ધ્યાનમાં સ્થિર હોય તેટલા સમય પૂરતો ધ્યાતા આગમથી ભાવનિક્ષેપે અરિહંત રૂપ બને છે. ઉપરની પ્રબુ મહાવીરની દેશનામાં સાલંખન ધ્યાન બતાવ્યું છે. તે આપણે વિગતથી સમજુએ.

આવું ‘સાલંખન ધ્યાન’ એટલે કે પરમાત્માના આકારે ઉપયોગને પરિણમાવવાની કળા શીખવી અને હંમેશાં તે મુજબ આરાધના કરવી તે આપણું ચેતનાની ઓદ્વાગમનની મહાન પ્રક્રિયા છે. જૈનશાસનની ધ્યાન પ્રક્રિયા દ્વારાણુમાં માત્ર ચાર જ નાના વાક્યોમાં આવી જાય છે.

૧. નોઆગમથી ભાવનિક્ષેપે પરમાત્મા.

૨. આગમથી ભાવનિક્ષેપે પરમાત્મા.

૩. અરિહંતાકાર ઉપયોગ.

૪. ઉપયોગાકાર આત્મા.

(૧) સમવસરણુમાં બિરાજમાન જગતના જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપી રહેલા સાક્ષાત અરિહંત પરમાત્મા તે નોઆગમથી લાવનિક્ષેપે પરમાત્મા છે.

(૨) તે પરમાત્માના ધ્યાનમાં તદ્દૂપ બનેલો ધ્યાતા તે આગમથી લાવનિક્ષેપે પરમાત્મા છે.

(૩) અરિહંત પરમાત્માના ઉપયોગમાં તદ્દાકારપણે પરિણામ પામવું તે અરિહંતાકાર ઉપયોગ છે.

(૪) જે વખતે ધ્યાતા અરિહંતના ઉપયોગમાં તદ્દૂપ હોય છે, તે સમયે ધ્યાતાનો આત્મા અરિહંતના આકારવાળો બને છે.

ત્રીજા નંખરના કાર્ય માટે આપણે પુરુષાર્થ કરવાનો હોય છે. આપણો ઉપયોગ અરિહંતાકાર બનાવવો - એટલે કે અરિહંત પરમાત્માના (ધ્યાનમાં) ઉપયોગમાં સ્થિર અનલું.

જે સમયે ધ્યાતાનો ઉપયોગ ધ્યેય એટલે પરમાત્મામાં લીન બની જાય છે, તે સમયે ધ્યાતા પોતે આગમથી લાવનિક્ષેપે અરિહંત બને છે, એટલે કે ધ્યાતાનું ચૈતન્ય (ધ્યાન સમયે) ધ્યેયાકાર એટલે અરિહંતાકારવાળું બને છે.

અરિહંત પહ ધ્યાતો થકો, ફંબડ ગુણ પજનાય રે;

લેદ છેદ કરી આત્મા, અરિહંત ઇપી થાય રે.

આ એ પંક્તિમાં નોઆગમથી લાવનિક્ષેપે પરમા-

તમાનું ધ્યાન થયું. તેનાથી ધ્યાતાનું ચૈતન્ય અરિહંતાકારવાળું બન્યું.

હવે આગમથી ભાવનિક્ષેપે પરમાત્માનું ધ્યાન બીજુ પંક્તિમાં પરમાત્મા બતાવે છે -

‘આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈરે.’

અરિહંતાકાર બનેલા પોતાના આત્માનું ધ્યાન જ્યારે થાય છે, ત્યારે મોક્ષપર્યાતની સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

દૂંકમાં અરિહંતના ધ્યાનથી આપણો આત્મા આગમથી ભાવનિક્ષેપે અરિહંત બને છે, અને અરિહંતાકાર બનેલા આપણો આત્માનું ધ્યાન સર્વ આત્મસંપત્તિઓ પ્રાપ્ત કરાવે છે.

પહેલી એ પંક્તિમાં ધ્યેય પરમાત્મા છે, ધ્યાતા આપણો આત્મા છે, ધ્યાન પ્રક્રિયા ચાલે છે. જે સમયે ધ્યાતાનું ચૈતન્ય ધ્યેયમાં નિષ્ઠ-તનમય-તદ્દૂપ થઈ જાય છે, ત્યારે ધ્યાતાનું ચૈતન્ય ધ્યેય એટલે પરમાત્મ આકારવાળું અને છે.

હવે બીજુ એ કઢીમાં ધ્યેય શું છે ?

અરિહંતના ધ્યાનમાં તદ્દૂપ બનવાથી ધ્યાતાનો ઉપયોગરૂપ પર્યાય ( અવસ્થા ) અરિહંતાકાર બન્યો. ધ્યાતામાં પોતાનો અરિહંતાકાર બનેલો. ધ્યાતપર્યાય તે ધ્યેય છે. ધ્યાતા આત્મા પોતે છે, અને પોતાના ઉપર સુજખના પર્યાયતું ધ્યાન કરે છે. પર્યાયથી દ્રોઘ અસિન્ન

છે; એટલે આત્મા જ્યારે અરિહંતાકાર ખનેલા પોતાના પર્યાયનું ધ્યાન કરે છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણે એક થઇ ગયાં. એટલે કે -

(૧) ધ્યાન કરનારો આત્મા તે દ્રવ્ય.

(૨) ધ્યાતાનો પોતાનો અરિહંતાકાર ખનેલો પર્યાય તે ધ્યેય. અને

(૩) ધ્યાન પણ આત્માના ગુણોના સ્વરૂપનું જ છે.

આ રીતે દ્રવ્ય, ગુણ અને પર્યાય - ત્રણોની એકતા થાય છે, ત્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય - ત્રણોની એકતા એટલે સમાપ્તિ થાય છે. જ્યારે આત્મા આત્માનું ધ્યાન કરે છે, ત્યારે સર્વ આત્મસિદ્ધિઓ આવીને મળે છે. માટે ખેલાં જ પ્રભુએ કહ્યું કે —

“ધ્યેય સમાપ્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણું.”

### સિદ્ધપદનું ધ્યાન :—

રૂપાતીત સ્વલ્પાવ જે, કેવળ દંસણ નાણી રે;

તે ધ્યાતા નિજ આત્મા, હોય સિદ્ધગુણ ખાણી રે.

વીર જિનેશ્વર ઉપદિશો.

કેવળજ્ઞાન સ્વરૂપ, શુદ્ધ, નિરંજન, નિરાકાર, અભ્યાધ સુખસ્વરૂપ, અનંત આનંદમય, અચિંત્ય શક્તિ શુક્ત, નિરાકાર જ્યોતિ સ્વરૂપ સિદ્ધ લગ્નવંતની ધારણા કરવી.

તે પછી આવા સિદ્ધલગ્નવંતનું ધ્યાન કરવું. ધ્યાતા

જ્યારે ધ્યાનમાં સ્થિર બની જાય છે, ત્યારે ધ્યાતાનો ઉપયોગ ધ્યેયાકાર સિદ્ધ પરમાત્માના આકારવાળો બને છે- ઉપયોગથી ઉપયોગવાન આત્મા અલિન્ન હોય છે. સિદ્ધ પરમાત્માના આકારવાળા બનેલા પોતાના ઉપયોગ (રૂપ-પર્યોગ)નું ધ્યાન કરતી વખતે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતારૂપ સમાપ્તિ થાય છે. ટૂંકમાં સિદ્ધ પરમાત્મારૂપે પોતાના આત્માનું ધ્યાન કરવું. સર્વ આત્મસંપત્તિ તેનાથી પ્રાપ્ત થાય છે. ( અનુભવાય છે.)

અહીં પ્રભુ મહાવીરદેવે પરમાત્માનું આલંબન લઈને તેના આધારે પોતાના આત્માનું અરિહંત, સિદ્ધ અગવંત રૂપે ધ્યાન કરવાનું બતાવ્યું.

આ રીતે અરિહંતના ધ્યાનમાં નિંઠ એવો આત્મા આગમથી ભાવ નિક્ષેપે અરિહંત છે. આ વાત જાણ્યા પછી એક ક્ષણું પણ આપણે અરિહંત પરમાત્માના સ્મરણું, જાપ કે ધ્યાન સિવાય રહી શકતા નથી. પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની એકાશતા, ઉપયોગની સ્થિરતા કરવાની છે. હૃથમાં સાકર એગાળી જાય, તેમ મનને પરમાત્મામાં એગાળી હેવાનું છે. અને એ રીતે આપણા આત્મામાં શુદ્ધ આત્મસ્વરૂપનો અનુસવ થાય, તે લક્ષ્ય બિંદુને સિદ્ધ કરવાનું છે.

તે માટે પૂર્વોચ્ચેણીએ અગાધ પ્રયત્ન કરેલો છે.

અગવાન શ્રી હરિલઙ્ગસૂરિજી મહારાજ “ બોડીક  
પ્રકરણ ” નામના અથમાં ફરમાવે છે કે-

આ જિનેશ્વર લગવંત જ્યારે હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે સર્વ પ્રયોજન સિદ્ધ થવાતું કારણ એ છે કે શ્રી જિનેશ્વર લગવંત પરમ ચિંતામણિ છે. તેઓ હૃદયમાં પ્રતિષ્ઠિત થતાં, તેમની સાથે ધ્યાતાની સમરસાપ્તિ થાય છે.

આ સમરસાપ્તિ ચોગીઓની માતા છે, અને નિર્વાણ ઇળની પ્રસાધક છે. આત્મા જ્યારે સર્વજ્ઞના સ્વરૂપમાં ઉપયોગવાળો બને છે, ત્યારે તેનો અન્યત્ર ઉપયોગ ન હોવાથી તે સ્વયં સર્વજ્ઞ જેવો થાય છે. એવો નિયમ છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વતો છે, તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણું કરે છે.

( નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ૨૬૩ )

આ રીતે પરમાત્મ-સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા કરવાથી તેટલી ક્ષણું પૂરતું આપણું ચૈતન્ય આગમથી ભાવ-નિષ્ઠાપે પરમાત્મ-સ્વરૂપ બને છે. જો એકાદ ક્ષણું પૂરતું પણ આપણું ચૈતન્ય પરમાત્મારૂપ આ રીતે બનતું હોય તો તેથી વધુ આપણા આ જીવનમાં શુ કમાઈ શકવાના હતા ? અર્થાત્ સૌથી વધુ કમાણુંને આ વ્યાપાર છે. તેને છોડીને ખીંચે વ્યાપાર કરવો તે કલ્પવૃક્ષને છોડીને ભાવળિયાને પકડવા જેવું છે.

આ રીતે અરિહંત પરમાત્માનું ધ્યાન જગતની સર્વોચ્ચ સ્થિતિ પરમાત્મ-પદની ગ્રાન્તિ સુધી પહેંચાડનારું છે. Meditation on Most High છે.

ધ્યા. પ્ર. ૧૫

## આચાર્યપદનું ધ્યાન :—

ધ્યાતા આચારજ લલા, મહામંત્ર શુલ ધ્યાની રે;  
પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે.

મહાવીર જિનેશ્વર૦

મહા સૂર્યમંત્રને જપનારા, શુલ ધ્યાન કરનારા  
આચાર્યપદનું ધ્યાન કરવાથી ધ્યાતા પોતે આગમથી ભાવ  
નિષ્ક્રિપે આચાર્ય થાય છે.

## ઉપાધ્યાયપદનું ધ્યાન :—

તપ સન્જાયે રત સહા, દ્વાદશ અંગનો ધ્યાતા રે;  
ઉપાધ્યાય તે આતમા, જગતખંધવ જગ ભ્રાતા રે.

વીર જિનેશ્વર૦

તપ અને સ્વાધ્યાયમાં સહા રહ્ણા, બાર અંગનું  
ધ્યાન કરનારા જગતના પરમ બાંધવ સમાન ઉપાધ્યાય-  
પદનું ધ્યાન કરવાથી ધ્યાતા પોતે આગમથી ભાવનિષ્ક્રિપે  
ઉપાધ્યાય બને છે.

## સાધુપદનું ધ્યાન :—

અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરએ નવિ શોચે રે;  
સાધુ સુધા તે આતમા, શું મૂંડે શું લોચે રે.

વીર જિનેશ્વર૦

જે નિરંતર અપ્રમત્તપણે મોક્ષમાર્ગની સાધના કરે  
છે, શુલ કે અશુલ કર્મના કારણે ઉત્પજ થયેલી અનેક  
પ્રકારની ખાદ્ય પરિસ્થિતિ વચ્ચે પણ જે રાગ, ક્રૈષ, સુખ,

હુઃખ અનુભવતા નથી, તેવા સમર્પલાવમાં સ્થિર સાધુ-  
પદ્ધતિ ધ્યાન કરવાથી સ્વદ્ય આત્મા આગમથી લાવનિશ્ચે  
સાધુ બને છે.

### સમ્યગુદ્ધર્ણન :—

શમ સંવેગાદિક ગુણો, ક્ષય ઉપશમ જે આવે રે;  
દર્શન તેહી જ આત્મા, શું હોય નામ ધરાવે રે.

વીર જિનેશ્વર૦

મોહનીય કર્મની પ્રથમ સાત પ્રકૃતિના ક્ષયોપશમ  
કારા શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકર્પા  
આદિ ગુણો પ્રગટ થાય છે. આવો આત્મા તે સમ્યગુદ્ધર્ણન છે.

### સમ્યગુજ્ઞાન :—

જ્ઞાનવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે;  
તો હુએ એહી જ આત્મા, જ્ઞાન અભોધતા જાય રે.

વીર જિનેશ્વર૦

આત્માના જ્ઞાન ગુણને રોકનાર્દ જે કર્મ છે, તેને  
ક્ષયોપશમ થવાથી આત્માનો જ્ઞાન શુલ્પ પ્રગટ થાય છે.  
આવો આત્મા તે જ્ઞાન છે.

### ચારિત્રપદ :—

જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવમાં રમતો રે;  
લેશયા શુદ્ધ અદાંક્યો, મોહ વને નવિ ભરતો રે.  
વીર જિનેશ્વર૦

આત્મા સિવાયના અન્ય પદ્ધાથોને મોહનું વત સમજુને

આતમા સિવાયના અન્ય પહાર્થોમાં જેની વૃત્તિ કહી પણ જતી નથી, જે શુદ્ધ લેશ્યા અને શુદ્ધ ભાવોથી અલંકૃત છે, અને જે આત્માના શુદ્ધ ચૈતન્યમાં રમણુતાનો પરમાનંદ નિરંતર અનુભવે છે - આવો આત્મા તે ચારિત્ર છે. પરમાત્માના ધ્યાનના અલેદ દ્વારા પોતાના આત્માના વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં રમણુતાનો પરમાનંદ જે અનુભવે છે - આવો આત્મા તે ચારિત્ર છે. સ્વરૂપ રમણુતાના પરમાનંદના સુખને અનુભવતાં બાર મહિનાના ચારિત્ર પથીયમાં અનુંતર વિમાનવાસી દેવ કરતાં અધિક સુખનો અનુભવ હોય છે.

### તત્પ્રદાશ:

ઇચ્છારોધે સંવરી, પરિણુતી સમતા ચોગે રે;  
તત્પ તે એહી જ આત્મા, વતો નિજ ગુણ લોગે રે.

વીર જિનેશ્વર૦

આત્મસ્વરૂપના અનુભવનું જે સુખ છે તેની તુલનામાં જગતનું કોઈ સુખ આવી શકતું નથી. અને આવા સુખનો જીવનમાં અનુભવ થયા પછી જગતના કોઈ પહાર્થની ઇચ્છા રહેતી નથી. સત્તામાં પડેલાં કર્મ ઉદ્ઘયમાં આવે ત્યારે પણ જે સાધક આત્મા રાગ-દ્રષ્ટ રૂપે, સુખ-દુઃખ રૂપે પરિણમતો નથી, પણ સમતાભાવમાં પરિણમે છે-તેવો આત્મા જે નિજ ગુણુના લોગમાં પ્રવતો છે - તે આત્મા જ તત્પ છે.

નિજ ગુણનો લોગ આત્મા કેવી રીતે કરતો હશે ?

સાતમા સુપાર્વિનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજા, પરમાત્મા પરમાનંદનો લોગ કેવી રીતે કરે છે તે બતાવે છે. અનંત લોગશુણુ પરમાત્મામાં પૂર્ણપણે ગ્રાગટ થયેલો છે; તો પરમાત્મા શાનો લોગ કરે છે? આત્માના શુણોનો (નિજ શુણુનો) લોગ કરે છે. આત્મામાં રહેલા અનંત શુણો એકધીજને સહકારી હોય છે. નિજ શુણુના લોગમાં અનંતવીર્ય શુણ સહકારી બને છે, તેથી અનંત આસ્વાદપૂર્વક નિજ શુણુનો લોગ શુદ્ધ આત્મામાં હોય છે. વળી તેમાં ચારિત્રશુણ સહકારી બને છે. ચારિત્રનું કાર્ય રમણુતા કરવાનું હોય છે. તેથી અનંત રમણુતાપૂર્વક, અનંત આસ્વાદપૂર્વક, અનંત શુણોના, અનંત લોગના પરમાનંદનું અનંત સુખ પરમાત્મામાં પૂર્ણપણે અધ્યાત્માધપણે રહેલું છે. આવા પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું દિવ્ય સુખમય સ્વરૂપ જોઈને આપણુને આપણી અંદર પરમાત્મા જેવા જ આત્મસ્વરૂપનું ભાન થાય છે, અને તેવા સ્વરૂપની પ્રાપ્તિ અને અનુભવની તીવ્ર જંખના થાય છે.

શુદ્ધ આત્માના અનંત આનંદમય સ્વરૂપનો અનુભવ અને પ્રાપ્તિ કરવાની જંખના થતાં તીવ્ર સંવેગ ભાવે સમ્યગુદર્શન સ્પર્શો છે, તે વખતે એક જ જંખના રહે છે -

ત્યાગીને સંવિ પરપરિણુતી રસ રીજ જે,

જાગી છે નિજ આત્મ અનુભવ ધૂષ્ટતા જે.

(શ્રી દેવચંદ્રજી કૃત નમિનાથ ભગવાનનું સ્તવન)

આતમઅનુભવ એ જ પરમ ધૂષ-પ્રાપ્તિવ્ય લાગે છે, અને વિબાવ ઉપાધિથી મન પાણું કરે છે. આત્મ-સ્વરૂપની અનુભવ પ્રાપ્તિના માર્ગો પ્રયાણ શરૂ થાય છે. અને તે આપણા લક્ષ્યાબિન્ડને સિદ્ધ કરવા માટે પ્રભુ મહાવીરસ્વામીએ આ રીતે નવપદનું ધ્યાન અને આરાધના અતાવી છે.

પ્રભુ મહાવીરની દેશનાની આ પંક્તિએ આચંબિલની ઓળિમાં પ્રદક્ષિણા, ખમાસમણામાં સર્વત્ર ગાવામાં આવે છે. આપણા પૂર્વોચ્ચાયો અને તેમાં વિશેષ રીતે મહોપાદ્યાય યશો-વિજયણુ મહારાજાએ આવી નવપદમાં આત્મા અને આત્મામાં નવપદ જેવી ગંભીર વસ્તુ ખમાસમણાં અને પ્રદક્ષિણામાં જોડવીને શ્રી સંધ ઉપર મહાન ઉપકાર કર્યો છે. હન્દરો, લાખો, કરોડો વખત પ્રભુ મહાવીરની દેશનાના આ ફુલા જૈનસંધમાં ગવાઈ રહ્યા છે. તેનો મર્મ જ્યારે આપણી સમજમાં આવે ત્યારે આપણી સાધનામાં પરમાત્માનો હિંય પ્રકાશ પથરાય છે. આચંબિલની ઓળિમાં થતી કિયા કેટલી અફલુત અને મહરવની છે, તે હવે આપણને સમજાય છે.

સકલ જૈનસંધમાં આચંબિલની ઓળિની વિધિ-પૂર્વકની આરાધના થાય તે માટે વર્તમાન આચાર્ય લગવંતો અને ઉપકારી સાધુ-સાધ્વી લગવંતોએ જૂથ અનુમીદીય પ્રયત્ન કર્યો છે. તેનાં મીઠાં ઇણ આજે આપણે જોઈ એ છીએ કે હન્દરો અને લાખોની સંખ્યામાં ઓળિ

કરનારા પુષ્યશાળીએ આજે જૈનસંઘમાં છે. તે કિયાનું એક-એક ખમાસમણું લેતી વખતે ગાવામાં આવતી પ્રભુ મહાવીરની દેશનાની પંક્તિએ કેટલી અફલુત છે ! આપણે સૌ તેમાં રહેલું તરત્વ સમજુએ અને તેની જાંડી સમજ-પૂર્વકની આરાધના કરી, આપણે આત્માના અનુભવ અને પ્રાપ્તિની હિસામાં આગળ વધીએ એ જ અર્થાયના....

આ પ્રમાણેની ગંભીરતા સમજયા પછી, હવે આ નવ હુંડા બોલી રોજ નવ ખમાસમણું આપણે લઈએ ત્યારે કેવો આનંદ આવશે ! કિયા શરૂ કર્યો પછી જ તેનો મર્મ સમજય છે, અને મર્મ સમજયા પછી સાચ્યા આનંદ આવે છે. તેને જ ધ્યાન કહેવાય. ઉપરોગ જોડવા-પૂર્વકની કિયાને ધ્યાન કહેવાય.

નોાયાગમ તણો, ભાવ તે જણો સાચ્યા રે;  
આત્મભાવે થિર હોને, પરભાવે મત રાચ્યા રે.

પરભાવ એટલે આત્મા સિવાયના અન્ય પદ્ધારોમાં આપણો વૃત્તિએ લધ જવી તે. આ પરભાવ લવ-સંસારમાં રખડાવનાર છે તેવું સમજુ પરભાવમાંથી વૃત્તિએ પાછી એચી લધ, આત્મસ્વરૂપમાં સ્થિરતાવાળી ઘનાવવી. તે ઘનાવવા માટે શુદ્ધ આત્મચૈતન્ય જેમનું પ્રગટ થયું છે, તેવા અરિહંત, સિદ્ધ લગવાનમાં ઉપરોગ જોડવો તેને નોાયાગમથી પરમાત્માનું ધ્યાન કહેવાય. અને તે દ્વારા આપણો આત્મા પરમાત્માના આકારવાળો અને છે. આગ-

મથી લાવનિશ્ચે પરમાત્માના આકારવાળા બનેલા આપણા આત્માનું ધ્યાન શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કરાવે છે.

જગતલરમાં અત્યારે ધ્યાનનું આકર્ષણી વધતું જાય છે. અનેક આશ્રમો, મઠો, શિથિરો વગેરેમાં ધ્યાન પ્રક્રિયા બતાવવામાં આવે છે, પરંતુ પ્રભુ મહાવીરે બતાવેલી આ ધ્યાનપ્રક્રિયા જગતલરમાં સર્વ શ્રેષ્ઠ ધ્યાનપ્રક્રિયા છે; અને તે શીધ આત્માની અનુભૂતિ સુધી લઈ જાય છે.

અષ્ટ સકલ સમૃદ્ધિની, ઘટ માંહે ઋદ્ધિ હાથી રે;  
એમ નવપદ ઋદ્ધિ જાણુંલે, આત્મરામ છે સાખી રે.

#### વીર જિનેશ્વર૦

જ્યારે આત્મસાક્ષીએ નવપદનું ધ્યાન કરવામાં આવે છે, ત્યારે સર્વ સંપત્તિએ, સિદ્ધિએ અને મોક્ષ પર્યાતની સર્વ સંપદાઓનું કેન્દ્ર નવપદમાં રહેલું અનુભવાય છે.

જિનેશ્વર લગવંતોએ અસંખ્ય યોગો મોક્ષની પ્રાપ્તિ માટે બતાવ્યા છે. તેમાં નવપદની આરાધના તે મુખ્ય ધોરી માર્ગ છે, કારણું કે નવપદના આલંખનથી આત્મધ્યાન પ્રાપ્ત થાય છે, આત્મધ્યાનથી આત્મસ્વરૂપનો અનુભવ અને છેવટે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.

આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ આપણું મૂળભૂત લક્ષ્ય છે. જિનશાસનની ડોઈ પણ આરાધના આત્મસ્વરૂપની પ્રાપ્તિ (મોક્ષ) માટે જ કરવામાં આવે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે આત્મસ્વરૂપનો અનુભવ કરવાની જરૂર પડે છે. (જ)

આ જીવનમાં શક્ય છે.) આત્મસ્વરૂપનો અનુભવ કરવા માટે આત્મધ્યાનની જરૂર પડે છે.

પરંતુ “લક્ષ્મિના પરિણામ સિવાય જ હું આત્મા છું, પૂર્ણ છું; કેવળ જ્ઞાન સ્વરૂપ છું.” તેવું સીધું શુદ્ધ નથનું ધ્યાન કરવા જતાં, આપણી ભૂમિકા ન હોવાથી ભ્રમ જિલ્લો થાય છે.

લક્ષ્મિ એ માતા છે. જ્ઞાન એ પુત્ર છે. જ્ઞાનરૂપી પુત્ર માટે લક્ષ્મિરૂપી માતાની અનિવાર્ય આવશ્યકતા છે.

તેટલા માટે કહ્યું કે -

“એહ તણે અવલંબને આત્મધ્યાન પ્રમાણે રે”  
નવપદના આદિધ્યાનથી જે ‘આત્મધ્યાન’ પ્રાપ્ત થાય છે તે મોક્ષનો હેતુ બને છે. અને નવપદનું આદિધ્યાન લેવા માટે અરિહંત-લક્ષ્મિ, નવપદનું ધ્યાન, સિદ્ધ્યકનું પૂજન, નમસ્કાર મંત્રની સાધના વગેરે અનેક અનુષ્ઠાનો કરવામાં આવે છે, જેનાથી પરમાત્માનું ધ્યાન થાય છે, અને પર-માત્માનું ધ્યાન તે જ આત્મધ્યાન છે.

### નવપદના ધ્યાનાલ્યાસની ગ્રહીયા

- (૧) નવપદના મહિમાથી લાવિત બનવું.
- (૨) પ્રથમ ભૂમિકાની આરાધના વ્યવસ્થિત કરવી.
- (૩) નવપદનું ધ્યાન.

(A) આરેહંત પદનું ધ્યાન :- પરમાત્માની કર્ણાને હૃદયમાં જીલવા પૂર્વક કરવું અને ભય, શોક,

- ચિંતા, અશાનિતમાંથી સુક્રત બનવું. સુખ, શાનિત,  
આનંદ અને નિર્ઝયતાનો અનુભવ કરવો.
- (B) સિદ્ધયપદનું ધ્યાન :— પરમાત્માના ગુણ ગંગા-  
જળમાં સ્નાન કરી ઉત્તમ ગુણોથી લરાઈ જવું.
- (C) આચાર્યપદનું ધ્યાન :— ગૌતમસ્વામીમાંથી  
નીકળતા પીળા વર્ષાના પ્રકાશને અંતરાત્મામાં  
ઓલવો. અને તેનાથી આચાર પાલનનું થળ  
પ્રાપ્ત થાય છે તેવું ધ્યાન કરવું.
- (D) ઉપાધ્યાય પદનું ધ્યાન :— ઉપાધ્યાય લગ્નવંતના  
લીલા વર્ષાના પ્રકાશને આપણા અંતરાત્મામાં  
ઓલવો. તેનાથી જ્ઞાનની પરિણુતી પ્રાપ્ત થાય  
છે, તે સંકલપપૂર્વક ધ્યાન કરવું.
- (E) સાધુપદનું ધ્યાન :— નીલ વર્ષાના સાધુ  
લગ્નવંતના ‘પ્રકાશ’ને અંતરાત્મામાં ઓલવો.  
તેનાથી સકલ સત્ત્વ હંતાશયનો લાવ પ્રાપ્ત  
થાય તેવા સંકલપપૂર્વક ધ્યાન કરવું.
- (F) મૈત્રી લાવનાનું ધ્યાન સમ્યગુદ્દર્શન માટે કરવું.  
જીવ માત્રના કદ્યાણના લાવથી લાવિત અની  
આનંદ અનુભવવો, જીવો પ્રત્યેના ગ્રેમના  
લાવતું ધ્યાન કરવું.  
સમ્યગુદ્દર્શન :— પરમાત્માના હિંય પ્રકાશમાં  
આત્મસ્વરૂપનું દર્શન કરવું. આત્માના આનં-

## ૨૩૫

દના મહાસાગરમાં દૂધકી મારી આનંદનો  
અનુભવ કરવો. પ્રયોગ નં. ૪ મુજબ કરવું.

- (G) સમ્યગું જ્ઞાન, દર્શન, ચારિત્રયદના ધ્યાન માટે સૂર્યનું બિંબ હૃદયમાં પ્રકાશિત થઈ આત્મ-પ્રદેશોમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનો પ્રકાશ હેલાવે છે, તેથી આપણું સ્વયં જ્ઞાન, દર્શન, ચારિત્રદ્વારા અનીએ છીએ તેવું ધ્યાન કરવું.
- (H) નવપદનું છૂઢું છૂઢું ધ્યાન કર્યો પછી હૃદયમાં આડ પાંખડીવાળું કમળ કદ્દી, કર્ણિકામાં અરિહંતપદ અને આડ પાંખડીમાં આડ પદો સ્થાપ્તી ધ્યાન કરવું.
- (I) આત્મામાં નવપદો અને નવપદમાં આત્મા તેવું ધ્યાન સિદ્ધ કરવું.
- (J) ‘અરિહંતપદ ધ્યાતો, થકો’ વગોરે પદોનું આદાં-બન લઈને તે પછી આપણા આત્માનું નવપદ-દ્વારે ધ્યાન કરવું. જ્યારે આત્મા આત્માનું ધ્યાન કરે છે ત્યારે કેવળજ્ઞાન આદિ ગુણું સંપત્તિનો માલિક અને છે.

“આત્મ ધ્યાને આત્મા, ઋષિ મણે સવિ આઈ રે,  
વીર જિનેશ્વર ઉપદિશો.”



ॐ ହଁ ଅହଁ ନମः

## ସାଲିଖନ ଧ୍ୟାନନା ପ୍ରେସ୍‌ଗୋ

ପାଠ ସାତମୀ

### ସିଦ୍ଧ୍ୟକେନୁଁ ଧ୍ୟାନ

ଜ୍ଞାନବଦ୍ଧି: ସମାମ୍ନାତ ବଜ୍ରସ୍ଵାମ୍ୟାଦିଭି: ସ୍ଫୁଟଂ ।  
ବିଦ୍ୟାବାଦାତସମୁଦ୍ରଧୃତ୍ୟ ବୀଜଭୂତ ଶିଵଶ୍ରିଯ: ॥ ୭୫ ॥  
ଜନମଦାଵହୁତାଶସ୍ୟ ପ୍ରଶାନ୍ତିନବବାରିଦିଂ ।  
ଗୁରୁପଦେଶାଦ୍ଵିଜାୟ ସିଦ୍ଧଚକ୍ର ବିଚିନ୍ତ୍ୟେତ ॥ ୭୬ ॥

( ଯୋଗଶାସ୍ତ୍ର : ଅଷ୍ଟମ ପ୍ରକାଶ—ଶ୍ଲୋକ ୭୫-୭୬.)

ବିଦ୍ୟା ପ୍ରଵାଦଥୀ ଉଦ୍ଧାର କରୀନେ, ବଜ୍ରସ୍ଵାମି ଆହି  
ଜାନୀ ପୁରୁଷେଣେ ପ୍ରଗଟପଣେ ଭୀକ୍ଷ ଲକ୍ଷଭିନା ଧିଜ ସର୍ବଜୁ  
ମାନେଲୁଁ ଅନେ ଜନମରଣ୍ୟାଦି ଦାଵାନଣେ ପ୍ରଶାନ୍ତ କେବାନେ  
ନବୀନ ଜଳଧର (ମେଘ) ସମାନ, ସିଦ୍ଧ୍ୟକେନେ ଗୁରୁନା ଉପ-  
ଦେଶଥୀ ଜାଣୁନେ (କର୍ମକ୍ଷୟ ମାଟେ) ଯିଂତବୁଃ.

ଅଧ୍ୟାତମ୍ୟୋଗୀ ଅନୁଲବଜାନୀ ପୁ. ପ. ଶ୍ରୀ ଲଦଂକର  
ବିଜ୍ୟଙ୍ଗ ମ. ପାସେଥୀ ସିଦ୍ଧ୍ୟକେନୁଁ ଧ୍ୟାନ ତ୍ରଣ ପ୍ରକାରେ  
ଜାଣୁଵା ଭଜ୍ୟୁଁ ଛେ. (୧) କଳଶାକାରେ. (୨) କର୍ମପୃଷ୍ଠ ଆକାରେ  
(୩) ଚଙ୍କାକାରେ ସିଦ୍ଧ୍ୟକେନୁଁ ଧ୍ୟାନ କରାଯ ଛେ.

## (૧) કળશ આકૃતિથી સિદ્ધયકેનું ધ્યાન :—

પ્રયોગ નં. ૨૨

ચિત્રમાં આપેલ આકૃતિ મુજબ પ્રથમ વલયમાં આઠ પાંખડીવાળા કળણની કર્ણિકામાં વચ્ચે અરિહંત અને ચાર દિશાની ચાર પાંખડીમાં લિંદ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા ચાર વિદ્યાની ચાર પાંખડીમાં હર્ષન, જ્ઞાન, ચારિત્ર, અને તપ-આ પ્રમાણે નવપદની સ્થાપના કરવી. બીજા વલયમાં અષ્ટ વર્ગ, ત્રીજા વલયમાં અડતાલીસ લભિધપદો અને ચોથા વલયમાં આઠ ગુરૂપાહુકા. તે પછીના વલયોમાં જ્યાહિ આઠ દેવીઓ, અઢાર અધિષ્ઠાયક દેવો, સોળ વિદ્ધાદેવીઓ, ચોવીસ યક્ષયક્ષમણીઓ જોગાકારમાં લેવાં. તે પછી ચાર દિક્ષામાં ચાર દ્વારપાળ, ચાર વીર જોડવવા. દશ દિશામાં દશ દિક્ષપાલ, કંઠમાં નવ નિધિ અને નીચે મૂળમાં નવ અહ-આ રીતે કળણની આકૃતિમાં જગતનાં સર્વ ઉત્કૃષ્ટ પહો-અમૃતમય પહો રહેલાં છે, તે વિચારી કળણાકાર આકૃતિથી ચિદ્ધયકેનું ધ્યાન કરવું.

અગાર ઉપરના બધા પહોની ધારણા અનુકૂળ ન લાગે તો કળણ આકૃતિમાં જગતનાં સર્વ અમૃતમય ઉતામ પહો રહેલાં છે, તે વિચારી કળણાકાર આકૃતિથી સિદ્ધયકેનું ધ્યાન કરવું.

## (૨) કદ્વપવૃક્ષની આકૃતિથી સિદ્ધયકેનું ધ્યાન :—

પ્રયોગ નં. ૨૩

“જો ધૂરિ સિરિ અરિહંત, મૂલ દઢ પીડ પહંદુંચો”

કલ્પવૃક્ષના મૂળમાં અરિહંત પદ છે. સિદ્ધ, આચાર્ય, ઉપા-  
દ્યાય અને સાધુ-આ ચાર પદો કલ્પવૃક્ષની મુખ્ય શાખાઓ  
છે. દર્શાન, શાન, ચારિત અને તપ તેની પ્રશાખાઓ છે.  
અષ્ટવર્ગ, અડતાલીસ લભિધયપદો, આઠ શુરૂપાહુકા કલ્પવૃક્ષનાં  
પાંડડી છે. જ્યાહિ આઠ દેવીઓ, અઢાર અધિક્ષાયક, સોળ  
વિદ્યાહેવીઓ, ચોવીસ યક્ષ, ચોવીસ યક્ષિણી, ચાર દ્વારપાળ,  
ચાર વીર, દશ દિક્કાપાલ, નવ અહ અને નવ નિધિ-આ તે  
વૃક્ષનાં ઝૂલ છે. મોક્ષ એતું ઇણ છે.

“સે। સિદ્ધચઙ્ક શુરૂ કર્પતર્દ, અમૃત મન વંચિય ક્રત દિયો”

આવું સિદ્ધચઙ્કર્પ કલ્પવૃક્ષ અમારા સકલ મત-  
વાંચિત પૂર્ણ કરેલા. આમ કલ્પવૃક્ષ આકૃતિથી સિદ્ધચઙ્કનું  
ધ્યાન કરલું.

(૩) ચક્કાર આકૃતિથી સિદ્ધચઙ્કનું ધ્યાન :-

ગ્રાંયોગ નં ૨૪

“તિજ્ય વિજ્ય ચઙ્કં સિદ્ધચઙ્કં નમામિ.” તીર્થ-  
કર લગવાનની આગળ ધર્મચક હોય છે, ચક્કવતી આગળ  
ચક્કરતન હોય છે, તેમ સિદ્ધચઙ્કના આરાધકો ચક્કારારે સિદ્ધ-  
ચક થંત્રને પોતાની આગળ રાખી સિદ્ધચઙ્કનું ધ્યાન કરે છે.  
આવી આકૃતિવાળા સિદ્ધચઙ્કનું ધ્યાન કરવાથી જેમ ચક-  
વતી રાજને છ ખંડનું સાઓન્ય મળે છે, તેમ સિદ્ધ-  
ચકના આરાધકને ગ્રણ બુવનનું સાઓન્ય પ્રાપ્ત થાય છે.

ચકી ચક ને રથ બલે, સાધે સયલ છ ખંડ લાલ રે,  
તેમ સિદ્ધચક પ્રભાવથી, તે જ પ્રતાપ અખંડ લાલ રે.

મયણું ને શ્રીપાલજી, જ્યતાં ખડુ કુલ લીધ લાલ રે,  
ગુણુ જશવંત જિતેન્દ્રનો, શાન વિનોદ પ્રસિદ્ધ લાલ રે.

આમ ત્રણુ પ્રકારે સિદ્ધચંકનું ધ્યાન કરવાનું કુળ  
ગૌતમ ગણુધર લગવંત કહે છે કે :—

સિદ્ધચંકના ધ્યાને રે, સંકટ લય ન આવે;

કહે ગૌતમ વાણું રે, અમૃત પદ પાવે.

સિદ્ધચંકને લબ્ધી રે, કે ભવિયણુ લાવ ધરી.

આ પ્રમાણે ત્રણુ રીતે સિદ્ધચંકનું ધ્યાન કરશું.

આ ત્રણુ રીતે ધ્યાન કરવાથી જગતની સરોકુષ  
સર્વ શક્તિઓનું ધ્યાન થઈ જાય છે. તેનું કુળ અચિંત્ય છે.  
'સિરિ સિરિવાલ કહા' અને 'શ્રીપાલ મહારાજના રાસ' માં  
તેનું ધણું મહત્વ ખતાંયું છે.

વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળાએ "શ્રીપાલ  
અને મયણુના આધ્યાત્મિક જીવન રહસ્યો" લેખક : બાણુલાઈ કંડીવાળા-આ પુસ્તક વાંચવા  
ખાસ લલામણું છે.

શ્રીપાલ અને મયણુનું વૃત્તાંત જૈન સંઘમાં નવપદ  
સિદ્ધચંકની આરાધના માટે ખૂબ જ પ્રચલિત છે.

શ્રીપાલ અને મયણુની જીવન સિદ્ધિઓના મૂળમાં  
ધૂપાયેલ સાધનાના રહસ્યોને આ પુસ્તકમાં જોલવામાં  
આવ્યાં છે. આત્માની અખૂટ સંપત્તિના ઘણનાને જોલ-  
વાની હિંય કુળ આ પુસ્તકમાં ખતાવવામાં આવી છે.

આ પુસ્તકના લેખક શ્રી બાણુલાઈ કંડીવાળાએ ૨૩

વર્ષ, સુધી અધ્યાત્મચોગી પૂ. પં. શ્રી લદંકરવિજયજી મહારાજશ્રીના સાંનિધ્યમાં રહી સાધના સંખારી જે અણુમેલ રહ્ને પ્રાપ્ત કર્યાં છે, તે રહસ્યેને નિચોડ સાધના અને ધ્યાન દ્વારા અનુભવ કરી આ પુસ્તકમાં બતાવ્યો છે.

શ્રીપાલ અને ભયણાની સાધનાના રહસ્યેને જીવનમાં ઉતારી આપણા જીવનને વામનમાંથી વિરાટ બનાવવાની, સામાન્ય મનુષ્યમાંથી મહામાનવ બનવાની, અને વ્યક્તિત્વના કોચલાને તોડી અમરત્વના દ્વાર ઓલવાની કળાથી લર્પૂર આ પુસ્તક આપણા જીવનની અણુમેલ સંપત્તિરૂપ છે.

આ પુસ્તકમાં શ્રીપાલ અને ભયણાની જીવનસિદ્ધિ-ઓના મૂળમાં કેવા પ્રકારની સાધના અને ધ્યાન રહેલાં છે - તે તરત્વ વૈજ્ઞાનિક પદ્ધતિથી બતાવવામાં આવ્યું છે. શ્રીપાલ અને ભયણાના જીવનના દિંય પ્રસંગોના આલાં-અને આપણે પણ અશાન્તિ, લય, શોક, ચિંતા અને આત્મધ્યાનની પીડાથી મુક્ત બનીને, આત્માના શુદ્ધ ચૈતન્યને અનુભવ કરી શકીએ તેવી કળા અને અનુભવ-સિદ્ધ પ્રક્રિયા આ પુસ્તકમાં બતાવી છે.

શ્રી નવપદજી અને સિદ્ધચક્કા ઉપર વૈજ્ઞાનિક દિશિએ ડાંડા સંશોધનરૂપ આ પુસ્તકમાં રજૂ થયેલ તાત્ત્વક વિચારણા સમજુ મુસુક્ષુ વર્ગને અરિષ્ટંત પરમાત્મા, નવપદો, સિદ્ધચક્ક અને નમસ્કાર મંત્ર પ્રત્યે લક્ષ્ણ અને આરાધક લાવ જગાડવા માટે પ્રેરણારૂપ બનશે. પુસ્તકના પાને પાને પરમાત્મા લક્ષ્ણની રસગંગા વહી રહી છે, જે વિવેકી

વाचकना મનોમાલિત્યને શુદ્ધ કરવानું અચિંત્ય સામર્થ્ય ધરાવે છે. પુસ્તકની લાખા સરળ છે; તેટલી જ સુવાચ્ય છે. ડેર ડેર શાસ્ત્ર આધારો ટાંકીને પુસ્તકને પ્રમાણભૂત પૂરતી કાળજી રખાઈ છે.

In human plan there is scarcity of every thing, In Divine plan there is infinite supply.

મનુષ્યના સ્તર ઉપર દરેક, ચીજની અછત છે; અને પરમાત્માના સ્તર ઉપર અનંતની ઉપસ્થિતિ છે—તે સત્ય -શ્રીપાલ અને મયાણા આધ્યાત્મિક લુલન રહેસ્થો—આ પુસ્તકમાં વૈજ્ઞાનિક દાખિલે લેખકે બતાવ્યું છે.

### સકલ મંત્રતંત્રયાધિરાજરાજેશ્વર શ્રી સિદ્ધચંડુનો અદ્ભુત મહિમા

યત્રાર્થિતે યત્ર નમસ્કૃતે ચ, યત્ર સ્તુતે યત્ર નમસ્કૃતે ચ ।  
જના મનોવાચ્છતમાણુબન્તિ, શ્રી સિદ્ધચક્ર તદહં નમામિ ॥

જેનું દર્શાન કરવાથી, વંદન કરવાથી, પૂજન કરવાથી,  
સ્તવન કરવાથી, ધ્યાન કરવાથી, સમરણ કરવાથી સકલ  
મનોવાચ્છિત પૂર્ણ થાય છે; એવા આ સિદ્ધચંડુ લગ-  
વાનને અમે અંતરાત્માથી લાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ.

ઇત્�તિ ત્રિદશગોમણિદ્રૂમો – દૃત્પ્રભાવપટલ શિવપ્રદમ ।  
અર્હદાદિસમલદ્રકૃતં પદૈ: સિદ્ધચક્રમિદમસ્તુ ન: શ્રિયે ॥

કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ  
અધિક પ્રલાવશાળી અરિહંત આદિ પદો જેમાં અલંકૃત  
ધ્યા. પ્ર. ૧૬

થયેલાં છે; તેવું આ સિદ્ધયકુ મહાબંત્ર અમને મોક્ષ ઇણને આપનાડું થાઓ.

(સિદ્ધયકુ પૂજન વિધિ : સિદ્ધયકુ સ્તોત્ર શ્લોક ૮-૯)

આ સિદ્ધયકુ એ કલ્પવૃક્ષ છે; કારણુ કે તેની આરાધના કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. આ સિદ્ધયકુ ચિંતામણિ છે; કારણુ કે સકલ ચિંતિત વસ્તુઓને આપનાર બને છે. આ સિદ્ધયકુ કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અધિક પ્રલાવશાળી છે; કારણુ કે કલ્પનાતીત, વચ્ચનાતીત એવા આત્માના સર્વિદ્ધાનંદ સ્વરૂપને આ જન્મમાં જ અનુભવ, અને ભવાંતરમાં આત્માના પૂર્ણ શુદ્ધ ચૈતન્યને પ્રગટ કરનાર બને છે. જેવી રીતે ચક્કવર્તી રાજી ચક્કરતના આધારે છ ખંડનું સાંગ્રાન્ય પ્રાપ્ત કરે કરે છે, તે જ રીતે સિદ્ધયકુનો આરાધક સિદ્ધયકુ લગ્નવાનના પ્રલાવથી ત્રણ લુલનનું સાંગ્રાન્ય પ્રાપ્ત કરે છે. ચક્કવર્તી રાજીને છ ખંડનું સાંગ્રાન્ય મળે છે અને સિદ્ધયકુના આરાધકને ત્રણ લુલનનું સાંગ્રાન્ય મળે છે.

યસ્ય પ્રભાવાદ્વિજયો જગત્યાં

સપ્તાંગરાજ્યં ભૂષિ ભૂરિમાણ્યમ् ।

પરત્ર દેવેન્દ્રનરેન્દ્રતા સ્યાત्

તત્ સિદ્ધચક્રं વિદ્ધાતુ સિદ્ધિમ् ॥

(સિદ્ધયકુ પૂજન વિધિ-મંગલાચરણ)

જેના મહાપ્રલાવ વડે વિશ્વમાં સર્વત્ર વિજ્યની પ્રાપ્તિ થાય છે, સાત અંગવાળું વિશાળ રાજ્ય પ્રાપ્ત થાય છે, પર-

લોકમાં દેવેન્દ્ર અને નરેન્દ્રની પદવી પ્રાપ્ત થાય છે, એલું  
આ સિદ્ધચક્ર મહાયંત્ર અમને સિદ્ધ આપો.

કિં બ્રહ્મકતેન ભો ભવ્યા:, અસ્યૈવારાધકૈર્નરૈ: ।  
તીર્થકૃત્ત્રામકર્માંપિ, હેલયા સમુપાર્જતે ॥

( સિદ્ધચક્ર પૂજન વિધિ-ત્રીજી ચોવીશી-છેલ્સો શ્લોક. )

આ સિદ્ધચક્રભૂતા શુણોનું બહુ વર્ણન કરવાથી શું ?  
અર્થાત् આ સિદ્ધચક્રભૂતની આરાધનના પ્રલાવથી તેનો  
આરાધક ત્રણ ભુવનને પૂજનિક એલું તીર્થંકર નામક્રમ  
ક્ષણું માત્રમાં ઉપાર્જન કરે છે. માટે જ શ્રીપાલના રાસમાં  
ખીલ ખંડમાં વિદ્યાધર મુનિરાજની દેશનામાં કહ્યું છે —

નવપદ મહિમા તિહાં વર્ણવેળુ, સેવો લવિક સિદ્ધચક રે;  
ધર્મભસ્વ પર લવ લહિએ એહથીલુ, લીલા લહેર અથજી રે.

દેશનામાં નવપદના મહિમાનું વર્ણન કરે છે : “ હે  
લભ્ય જીવો ! તમે સકલ ભંતિન્યાંત્રાધિરાજ રાજેશ્વર, સકલ  
મનવાંછિતપૂર્ણ કરનાર, ચિંતામણિ અને કલ્પવૃક્ષ કરતાં અધિક  
પ્રલાવશાળી એવા સિદ્ધચક્ર લગવાનની સેવા કરો. તેમની  
સેવાથી આ લોક અને પરલોકમાં સર્વત્ર કાર્યસિદ્ધ થાય છે.

“હુઃખ દોહંગ સવિ ઉપશમેળુ, પગ પગ પામે ઝાંદ્રિ રસાલ રે;  
એ નવપદ આરાધતાંજુ, જિમ જગ કુંવર શ્રીપાલ રે.”

આ સિદ્ધચક્ર લગવાંતના પ્રલાવથી સર્વ હુઃખ  
અને દૌર્લભ્ય નાશ પામે છે, સર્વ ચિંતાએ વ્યૂણું  
થઈ જાય છે, સર્વ લય, શોક અને ઉપાધથી

સુક્તા બની જવાય છે, સુખ, શાન્તિ, આનંદ અને  
નિર્ભયતા પ્રાપ્ત થાય છે, આત્માના પૂર્ણ શુદ્ધ  
ચૈતન્યનો અનુભવ અને પ્રાપ્તિ થાય છે. “હે  
લભ્ય આત્માએ! જે રીતે શ્રીપાલ મહારાજાએ  
નવપદમય સિદ્ધચક્ષું આરાધન કર્યું, તે રીતે તમે  
પણ આરાધના કરો. તેના પ્રભાવથી તમે મોક્ષ  
પણ તની સર્વ સંપત્તિએ, સિદ્ધિએ, લક્ષ્મીએ,  
અને શક્તિએને પ્રાપ્ત કરશો.”

### સિદ્ધચક્ષુંનો ધ્યાનાલ્યાસ :

- (૧) કલશાકાર આકૃતિથી સિદ્ધચક્ષું ધ્યાન.
- (૨) કલપવૃક્ષાકાર આકૃતિથી સિદ્ધચક્ષું ધ્યાન.
- (૩) ચક્કાકાર આકૃતિથી સિદ્ધચક્ષું ધ્યાન.
- (૪) સિદ્ધચક્ષુંનો મહિમા આત્મામાં લાવિત કરવો.
- (૫) ચાવીસે કલાક ત્રણમાંથી ગમે તે આકૃતિવાળા  
સિદ્ધચક ભગવાનનું સમરણ રાખવું. જીવનના  
દરેક પ્રસંગમાં સિદ્ધચકને આગળ રાખવું. તે  
જે માર્ગ જતાવે તે માર્ગ ચાલવું.



God is my Instant Constant Abundant Supply of every potent Good.

સંપત્તિએ અને સિદ્ધિએનું પુરવઠા કેન્દ્ર પરમાત્મા છે.  
(નવકારનું પુસ્તક અનુક્રમણીકા આઈટમ નં. ૮૬ પાનું ૧૩.)

ॐ हूँ ई अहो नमः

## સાલિંગન ધ્યાનના પ્રયોગો

પાઠ આઠમો

અનુપ્રેક્ષા સવાર્ધ્યાય દ્વારા ધ્યાન

પૂર્વિચાર્ય રચિત સૂત્રો, સ્તવનો, સ્તુતિ, સ્તોત્રો  
દ્વારા ધ્યાન.

પ્રતિક્રમણુ જિનશાસનની આવશ્યક અને અફલુત  
સાધનાની પ્રક્રિયા છે. તેમાં આવતાં સૂત્રો ધ્યાનમય છે.  
જૈનશાસનની પ્રત્યેક કિયા ધ્યાનમય છે. આવી આવશ્યક  
કિયા પ્રાણુવાન બને, ઉપયોગ જેડવાપૂર્વકની બને, ભાવ-  
વાહી બને તે રીતે કરવામાં આવે તો મોક્ષ માર્ગની  
સાધનામાં અફલુત વિકાસ થાય.

પ્રતિક્રમણમાં જેટલા કાઉસગ્ગ આવે છે, તે તો ફરેક  
આરાધકે સ્વયં જ કરવા પડે છે. તેમાં આવતા લોગસ્સ  
કે નવકાર પણ સાચા ગણ્ણી શકતા નથી તેવી ઘણાની  
ખરિસ્થિતિ છે. તેથી નવકાર અને લોગસ્સનો કાઉસગ્ગ કેવી

રીતે કરવાથી સ્થિરતા આવે તે પ્રફિયા બતાવવાની ખાસ જરૂરિયાત જીભી થઈ છે.

એક ઘરડાં માળ હરરોજ પ્રતિકમણુ કરે છે. તેમનાં ઘરની સામેના ભાગમાં ઉપાશ્રય છે. વચ્ચે માટે રોડ કોસ કરવો પડે છે. રોડ ખૂબ દ્રારીકવાળો છે, છતાં ઘરડાં માળ હરરોજ રોડ કોસ કરીને ઉપાશ્રયે પ્રતિકમણુ કરવા જાય છે. માળ લણેલાં નથી. સૂત્રોના અર્થ પણ અખર નથી. છતાં “મારા લગવાને કહ્યું છે માટે હું પ્રતિકમણુ કર્દાં છું.” તેથી શ્રદ્ધાથી કરે છે. ઘરના માણુસો કહે છે; “મા, તમે આ રીતે રસ્તો કોસ કરીને જાઓ છો, રસ્તામાં કોઈ દિવસ મોટર નીચે આવી જશો, ઘરે જેસી રહ્ણ તો સાર્દાં.” માળ કહે છે : “એક દિવસ મરવાનું તો છે જ. પરંતુ મારા લગવાને પ્રતિકમણુ કરવાનું કહ્યું છે. તે હું નહીં છોડું.”

આ પ્રમાણે ઘરડાં માળના પ્રતિકમણુની કિંમત કેટલી.

જાની પુરુષો કહે છે - “પરમાત્માએ કહ્યું છે માટે કર્દાં છું.” તે જનાજાપાલનનો અધ્યવસાય માળને મોક્ષ પર્યાત પહેંચાડનાર છે.

આપણી પવિત્ર કિયાની આટલી મહાન કિંમત છે. તેને આપણે હૃદયમાં અંકિત કરવાની છે. હવે અત્યારે બુધ્ધિવાદ વધ્યો. સમજુને કિયા કરીએ તો રસ આવે તેમ કહેવાય છે. અને તે સાચું પણ છે. સમજુને કિયા કરવી તે આપણા પોતાના માટે છે. ( ધીજની ટીકા કરવા માટે નહીં.) લોગસ્સ, નસુત્થુણું, જકિંચિ વગેરે કેવાં

અફલુત સૂત્રો છે ! તે હરેકને આપણે તેમાં રહેલાં અર્થ—  
ભાવનાપૂર્વક કહીએ તો આપણને રસ જરૂર પડશો. આપણી  
કિયા પ્રાણુવાન બનશો. આ રીતે કરવાથી કિયા કરવાનો  
રસ જગશો અને કિયા કરનારની સંખ્યા પણ વધશો.

આપણા પૂજયો અને વડીલોને નમૃતાપૂર્વક વિનાિતિ  
છે કે પ્રતિકમણુનાં સૂત્રો બાખ્તમાં વધુ ગ્રકાશ પાડે તેવાં  
ચિત્રો સાથેનું સાહિત્ય બહાર પાડે તો આપણી પવિત્ર  
કિયામાં જરૂર રસ વધે.

આ વિષયમાં સુંદર અંથ તૈયાર કરી શકાય. જેમાં  
પૂર્વીચાર્ય રચિત સૂત્રો, સ્તવનો, સ્તુતિઓ, સ્તોત્રો વગેરેનું  
ધ્યાનપૂર્વક ઉચ્ચારણું કરી તે હરેકનું ધ્યાન કરી શકાય તેવી  
પ્રક્રિયા બતાવી શકાય.

આપણે સ્વયં આપણી બુધિ અનુસાર વિકાસ કરી  
શકીએ અને સૂત્રોના આત્મભને ધ્યાન કરી શકીએ.

દા. ત. “ સંસાર દાવાનદ્વારા દાહ નીર ” આ દિવ્ય  
શલોક સંખ્યાચી ભાવના-ધ્યાન આ પ્રમાણે કરી શકાય :—

**ગ્રંથાંગ નં. ૨૫ :—**

સંસારઝપી દાવાનળ સણગી રહ્યો છે. લયંકર  
આત્મધ્યાન અને રૌદ્રધ્યાનથી સૌ પાડાઈ રહ્યાં છે. લયંકર  
હિંસા અને પાપના કારણે સંસાર દાવાનળમાં આપણે  
દાઢી રહ્યા છીએ. આ સંસાર દાવાનળનો દાહ આપણુને  
લયંકર વેહના આપી રહ્યો છે, કોઈ બચાવે તેમ નથી. તે

સ્થિતિમાં કરુણાના સાગર, કૃપાના અવતાર, દ્યાના સમુર્દ્ર, અશરણુના શરણ, અનાથના નાથ પ્રભુ મહાવીર પરમાત્માના દર્શન થાય છે. પ્રભુ સંસાર દાવાનળમાં ફાડી રહેલા જીવોને શીતળ જળનો છંટકાવ કરે છે. આપણું લક્ષ્ય પ્રભુ તરફ જેંચાયું. સહરાના રણમાં પાણી મળે તેમ લયંકર બાતનામાંથી આપણુને ઉગારનાર કરુણાના સાગર પ્રભુ મળ્યા. પ્રભુ અમૃતજળનો છંટકાવ કરે છે. પ્રભુમાંથી કરુણારસનો ધોધ પડે છે. “સ્વયંભૂરમણુસ્પાઈધ, કરુણારસ વાચિણું” કરુણાના ધોધમાં આપણે સ્નાન કરીએ છીએ. આપણો સંસારનો દાહેન્દર શાંત થાય છે. સંસારના મમત્વમાંથી છૂટીને પ્રભુનું મમત્વ સર્જન થયું. આજ સુધી આપણે સંસારની માયાળળમાં એટલા આસક્ત હતા કે શીતળ જળરૂપી કરુણારસ વરસાવનાર પ્રભુના કરુણારસને જીવવા માટે હૃદય પણ જોંધું રહ્યું. કરુણાનો ધોધમાર વરસાદ તો પડતો હતો; પરંતુ આપણું હૃદયપાત્ર જોંધું હતું તેથી આલી રહ્યું અને સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિનો અંત ન આપ્યો.

આજે પરમાત્મા અરિહંત દેવની વરસતી કરુણાને જીવવા માટે આપણું હૃદયપાત્ર સન્મુખ બન્યું.

‘પ્રભુની કરુણાથી આપણું હૃદય ભરાઈ ગયું.....

હૃદયમાંથી ઉલ્લાસ ને કરુણા આપણા આખા શરીરમાં અને આત્મપ્રદેશોમાં વ્યાપક અની ગઈ.....

આપણો દાહનવર શાંત થયો, આત્મ-રૌદ્ર ધ્યાનની પીડા  
શરીર ગઈ.....  
ભય, ચિંતા, હુઃઅમાંથી છુટકારે મળ્યો.....

હજુ આપણે તો પ્રલુની કરુણામાં સ્નાન કરવાનું  
ચાહુ રાખ્યું છે. તેના પ્રભાવથી શાન્તિ, આનંદ, સુખને  
અનુભવ થયો. “આ રીતે સંસાર દ્વારાનાં નીરં” આ  
સૂત્રનું ધ્યાન કરી શકીએ.

અનુપ્રેક્ષા સ્વાધ્યાય દ્વારા ધ્યાનની બીજી ઓક  
રીત જોઈએ.

ધ્યાનપ્રયોગ નં. ૨૬

વામન અને વિરાટનો મેળાપ

ભક્તામર સ્તોત્ર ૧૪મી ગાથા :-

સ'પૂર્ણ મંદલ શશાંકલાકલાપ-

શુભ્રાગુણાચ્છિભૂવતં તવ લ'ધયન્તિ

યે સંશ્રિતાચ્છિજગદીશ્વરનાથમેકં,

કરતાચિવારયતિ સંચરતો યથેષ્ટમ॥

હે શરદપૂર્ણમાના ચંદ્રની કલાના પૂર્ણ નિધાન  
પરમાત્મા ! તમારા શુભ્ર - ઉજાવલ શુણો ત્રણ ભુવનને  
ઉલ્લંઘન કરી ગયા છે. લોકલોકમાં પ્રસરી ગયા છે. ચૌદ  
રાજલોકમાં સર્વત્ર આપ છો, સર્વત્ર આપની હાજરી છે.  
તેથી સર્વેશ્વર, લુલેશ્વર, લોકેશ્વર, અભિલ અળ્ણાંના

સાર્વભૌમ ચક્રધીશ્વર એવા હે પરમાત્મા ! આપનો જો જે આશ્રય કરે છે તેને પોતાનું ધર્મિત સ્થાન એટલે મોક્ષપર્યાત પહોંચવામાં કોણું રોકી શકે ?

હે કર્ણાસાગર, કૃપાના અવતાર, હ્યાના સમુદ્ર, અશરણુના શરણ, અનાથના નાથ, પરમાત્મા ! આપનું તેવળજાન લોકને ઓળંગીને અલોક સુધી પહોંચી ગયું છે. આપનો લોકલોક પ્રકાશક તેવળજાન ગુણું પૂર્ણપણે લોક અને અલોકમાં પહોંચી ગયો છે. ચંદ્રને લોકની ઉપમા છે. ચંદ્રની આસપાસ જે સંપૂર્ણમંડલ (આલામંડલ) હોય છે, તેને અલોકની ઉપમા છે. આવું લોકલોક બ્યાપી પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે. (તેવળી સમુદ્રઘાત વખતે તેવળજાની પરમાત્માના આત્મપ્રદેશો લોકબ્યાપી બને છે. અને તેમનું તેવળજાન તો લોક અને અલોક સુધી પહોંચેલું સહી માટે હોય છે.) પરમાત્મા લોકલોક પ્રકાશક જ્ઞાનવાળા હોવાથી લોકસ્વરૂપ જેવી આકૃતિવાળા હોય છે અને ચૌદશજ્યોતિશાસ્ત્રની અગ્નિધાજુ અલોક છે અને અલોકમાં પણ પરમાત્માનો જ્ઞાનપ્રકાશ હોવાથી તે પ્રકાશ સંપૂર્ણમંડલ જેવો લાગે છે. અલોક મંડલથી ચુક્તા, લોકસ્વરૂપ પરમાત્મા વિરાટ સ્વરૂપ છે. તેમના ચરણુકમળમાં નિજ (આપણો) આત્મા નમસ્કાર કરતો અનુભવાય ત્યારે વામન અને વિરાટનું ભિલનથતું હોય તેવું લાગે છે. તે વખતે વિરાટ સ્વરૂપ પરમાત્માનો અનુગ્રહ અને વામનરૂપ આપણો લક્ષ્ણિતનો પ્રકર્ષણ

-અત્તનેનો મેળાપ થાય છે ત્યારે પરમાત્માની અચિંત્ય શક્તિના અનુશ્રણના ગ્રલાવે વામન સ્વરૂપ આપણે વિરાટ સ્વરૂપનો અનુભવ કરી શકીએ છીએ; આવું ધ્યાન કરવું. તે ધ્યાન ગ્રલાવથી પરમાત્માના જેવું આપણા અંદર રહેલા વિરાટ સ્વરૂપનું ગ્રગઠીકરણ થાય છે.

“કસ્તાનિવારયતિ સંચરતો યથેષ્ટમ्” આ પંક્તિ છેવટે ઝણિબૂત થાય છે.

હવે તાત્ત્વિક દષ્ટિએ આ વસ્તુ વિચારોએ.

ત્રણ જગતના નુશ એવા અરિહંત પ્રલુનો જે આશ્રય કરે છે તેને પરમાત્માના આલંખને પોતાના આત્માના પૂર્ણ સ્વરૂપની સલાનતા થાય છે. પરમાત્માના જેવું જ પૂર્ણ સ્વરૂપ પોતાના અંદર રહેલું તેવી પ્રતીતિ થાય છે તેથી પૂર્ણ થવાનો પુરુષાર્થ ગ્રગટે છે. પોતાની પૂર્ણતા પ્રત્યક્ષ થાય છે, પોતાની પૂર્ણતા ઉપર શ્રદ્ધાપૂર્વકનો પૂજયલાવ ગ્રગટે છે. પૂર્ણતા હૃદયમાં સ્થિર થાય છે તેને મુક્તિમાં જતાં કોણ રોકી શકે? અથીતું આપનો આશ્રય એ જ મુક્તિનો રાહ છે. પરમાત્માની અને ઉપલક્ષણથી પોતાના આત્માની પૂર્ણતાને લક્ષ્યમાં લાવવાની આ વાત જે સાધક આત્માને ઝાંબી ગઈ છે, તેના લક્ષ્યમાં પૂર્ણ પરમાત્માન તત્ત્વ નિરંતર હોય છે. પરમાત્માની સાથે એકા-કારતા થાય તે હિયા અને તે જ ધ્યાન ચાલુ રહે છે અને તે જ કરવા લાયક લાગે છે. જેને આવો શુદ્ધ નિર્ણય થાય છે તેને વ્યવહાર પ્રધાન બની જાય છે.

આવી રીતે શાસ્ત્રની ડોઈ પણ પંક્તિ લઈ અનુગ્રહા સ્વાધ્યાય દ્વારા ધ્યાનમાં સ્થિર બની શકાય છે.....

આ રીતે પૂર્વાચાર્યો રચિત સૂત્રો, સ્તવનો, સ્તોત્રોનું આલાંખન લઈ આપણે પરમાત્માને આપણા જીવનમાં કેન્દ્ર સ્થાનમાં લાવીએ. અમાસમણું વગેરે કિયા વખતે ડેવા પ્રકારનું ધ્યાન કરશું? તે માટે નવઘનની આરાધનાની ત્રીજી ભૂમિકામાં “અરિહંતપદ ધ્યાનો થકો” વગેરેનું વર્ણન આ પુસ્તકમાં જ વાંચો. તે સુજાય કિયા કરવાથી હરેક કિયા ધ્યાનમય બની જશો.

પ્રસન્નચંદ્ર રાજર્ષિં ધ્યાનમાં ઓલા હતા. બહાર ડોઈ ચુંદ ન હતું; શાસ્ત્ર ન હતાં, હૃદમન પણ ન હતા; પરંતુ ધ્યાનમાં ઓલેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનમાં હૃદમન સાથે ચુંદ ચાલતું હતું. તે વખતે સાતમી નરકનાં ફળીયાં એકઢાં થયાં. ધ્યાનમાં ચુંદ કરતાં શાસ્ત્રો ખૂટી પડયાં. માથા ઉપરથી સુગટ લધને શાશ્વતે માર્દ તેવો વિચાર કરી માથા ઉપર હાથ મૂકે છે; પરંતુ માથું મૂંડન કરેલું છે. ‘હું સાંધુ છું’—એ લાન આંધું. રાજ્ય માર્દ સ્વરૂપ નથી, પુત્ર માર્દ સ્વરૂપ નથી. હું તો સચિચદાનંદ આત્મસ્વરૂપ છું. એ લાવનાએ ચઠદ્યા. સર્વोર્ધ્મસિદ્ધ વિમાન સુધી પહોંચાય તેવા લાવોથી ભાવિત બન્યા છે. તે લાવોમાં પણ વૃદ્ધિ થઈ, કેવળજાન પ્રગટ થયું.

મનુષ્યના મનમાં ચાલતી વિચારની ઘટ-માળમાં ચૌદ રાજલોકના બનને છેડા સુધી

સ્પર્શવાની શક્તિ છે ! આપણા મનમાં નિરંતર જગતના પદાર્થોનું ધ્યાન ચાલુ છે. તે ધ્યાનને જગતના પદાર્થોમાંથી છોડાવો પરમાત્મા તરફ વાળી લેવામાં આવે તો આપણું જીવન દિવ્ય બની જાય. સામાન્ય મનુષ્યમાંથી આપણે મહામાનવ બની શકીએ, વામનમાંથી વિરાટ બની શકીએ. આત્માના શુદ્ધ ચૈતન્ય સુધી પહોંચવાની આપણી ચાત્ર અફલુત રીતે આગળ વધે.

આ અંથતું લક્ષ્યાંક એટલું જ છે કે આપણું મન જગતના પદાર્થોના વિચારોમાંથી છૂટીને પરમાત્મામાં સ્થિર બને. આપણા મનના એ દોષ છે. એક ચંચળતા, બીજે મલિનતા. ચંચળતા એ એવો દોષ છે કે મનગમતું આલંબન મળે છે ત્યારે મન સ્થિર થાય છે. હા. ત., ધન, ખી આદિ જગતના પદાર્થોમાં આપણું મન સ્થિર થાય છે; પરંતુ તે આલંબન અશુદ્ધ હોવાથી આપણા મનની મલિનતા વધી જાય છે. માટે શુદ્ધ આલંબનના વિષે મનને બાંધવું જોઈએ. એવું ‘સિરિ સિરિવાલ કહા’ની પીડિકામાં ગૌતમ ગણુધર લગ્બવંત કહે છે. શુદ્ધ આલંબનોમાં નવપદ સર્વશ્રીષ્ઠ આલંબન છે. નવપદના કેન્દ્ર સ્થાનમાં રહેલા અરિહંત પરમાત્મા સર્વોત્કૃષ્ટ આલંબન છે. દ્રુંકમાં આપણા ધ્યાનનો વિષય અત્યારે જગતના પદાર્થો છે. હવે ધ્યાનનો વિષય પરમાત્માને ડેવી રીતે બનાવવા તે માટેના પ્રયોગોમાં હવે આપણે વધુ આગળ વધી પરમાત્માને આપણું જીવનના કેન્દ્ર સ્થાનમાં રાખીએ.

## અનુગ્રહકા સ્વાધ્યાય દ્વારા ધ્યાનાલ્યાસ

- (૧) સંસાર દ્વારાનળમાં બળી રહેલા જીવો ઉપર પ્રભુ મહાવીર કર્ણારસનું સિંચન કરે છે તેવું ધ્યાન કરવું. આપણે પણ લગવાનના કર્ણારસમાં સ્નાન કરવું.
- (૨) લોકલોક સ્વરૂપ - વિરાટ સ્વરૂપ પરમાત્માના ચરણ-કમળમાં વામનરૂપે નમસ્કાર કરતી આપણી જાતને અનુભવવી. પરમાત્માના અચિંત્ય પ્રભાવથી આપણે પણ વામનમાંથી વિરાટ સ્વરૂપ બનીએ છીએ તેવો અનુભવ કરવો.
- (૩) વિરાટ પરમાત્માના આલાંખને આપણા અંદર રહેલા વિરાટ સ્વરૂપને લાવિત કરી, તેને પ્રગટ કરવાને પુરુષાર્થ કરવો.
- (૪) મનુષ્યના મનમાં ચાલતી વિચારની ઘરમાળામાં ચૌદ રાજલોકના બનને છેડાને સ્પર્શદ્વાની શક્તિ છે. વિચારધારાને જગતના પદાર્થોમાંથી પાછી ઝેરવીને પરમાત્મા તરફ લાવવાની પ્રક્રિયા સાલાંખન ધ્યાનના પ્રયોગોમાં આવે છે.
- (૫) અરિહંત આહિ પહોની આરાધનામાં ખમાસમણું-વગેરેના હુંડા - “અરિહંતપદ ધ્યાતો થડો” વગેરેનું ડાંડું ચિંતન કરી, ખમાસમણું આહિ કિયાને મીકલક્ષી બનાવવી.

## પરિશિષ્ટ I

શ્રી અનુયોગદાર સૂત્રમાં લોકેન્ટર ભાવાશ્વકનું જે માર્ભિક સ્વરૂપ હર્ષાવાયું છે, તેમાંને કેટલોક અંશ-ધ્યાન, સમરણ કે વિચિન્તન પ્રક્રિયાને પણ લાગુ પાડી શકાય તેવો હોવાથી તે પ્રસ્તુત વિષયને અનુદૂળ થાય એ રીતે આહી આપેલ છે :—

ધ્યાનાદિ કિયા કરતાર સાધક આવે હોવે જેઠાં :—

૧            ૨            ૩            ૪            ૫  
તચ્ચિતે, તમ્મણે, તલ્લેસે, તદજ્ઞવસિષ, તત્ત્વજ્ઞવસાણે,  
૬            ૭            ૮            ૯            ૧૦  
તદદૃવત્તે, તદપ્રિયઅકરણે, તબ્ધાવણાભાવિષ, અણણત્થ  
કત્થિઝ મણં અકરેમાણે.

તચ્ચિત, તન્મન, તલ્લેશ્ય, તદ્ધ્યવસિત, તત્તીત્રાધ્ય-  
વસાન, તધ્યોપયુક્તા, તદ્પર્િતકરણુ, તદ્ધાવના ભાવિત (ધ્યેય  
સિવાય) બીજે કચાંય પણ મનને ન કરતો.

૧. તચ્ચિત (Attention) = તેમાં (તે ધ્યાનાદિમાં)  
ચિત્તવાળો (સામાન્યોપયોગવાળો)
૨. તન્મન (Interest) = તે (ધ્યાનાદિ)માં મનવાળો  
(વિશેષ ઉપયોગવાળો)
૩. તલ્લેશ્ય (Desire) = તેમાં લેશ્યવાળો (શુલ પરિ-  
ણામવાળો)
૪. તદ્ધ્યવસિત (will) તેમાં અધ્યવસિતવાળો (કિયાને

સુંદર રીતે પરિપૂર્ણ કરવાના ઉત્સાહ અથવા નિશ્ચયવાળો )

૫. તત્તીત્રાધ્યાવસન (Imagination) = તેમાં તીવ્ર (પ્રારંભ કાળથી માંડીને પ્રતિ ક્ષણું પ્રકર્ષને પામતા)
૬. તદ્દેરીપયુક્ત (Awareness) = અત્યંત પ્રશાસ્ત સંવેગથી વિશુદ્ધ થતો હોઈ ને તેના અર્થમાં ડિપ્યોગવાળો.
૭. તદ્પિતકરણ (Visualisation) = જેના મન, વચ્ચત અને કાયારૂપ કરણો તે ધ્યાનાદિમાં અત્યંત અર્પિત - સુનિયુક્ત થઈ ગયાં છે એવો.
૮. તદ્દાલાવનાલાવિત (Indentification) = તેની ભાવનાથી લાવિત, તેના પુનઃ પુનઃ અદ્યાસથી લાવિત.
૯. ધીજે કયાંય પણ મનને ન કરતો :- (Absorbtion) = પ્રસ્તુત ધ્યાનાદિ કિયાથી લિન્ન એવી કિયાદિમાં મનને ન જવા દેતો.

સારાંશ એ છે કે :—

(૧) સામાન્યોપયોગ રૂપ ચિત્ત, (૨) વિશેષોપયોગ રૂપ મન, (૩) શુલ્પ પરિણામ રૂપ વૈશ્યા, (૪) કિયાને સંખાહિત કરવામાં દદ નિશ્ચય અને પ્રવર્ધમાન ઉત્સાહરૂપ અધ્યવસ્તિત, (૫) કિયાના આરંભથી જ પ્રતિ ક્ષણું પ્રકર્ષને પામતા પ્રયત્નરૂપ તીત્રાધ્યાવસાન, (૬) અત્યંત પ્રશાસ્ત સંવેગથી ઉત્પન્ન થયેલી વિશુદ્ધ સહિત અર્થોપયોગ, (૭)

મન, વચન અને કાયારૂપ કરણોની સમર્પિતતા, (૮) તેની લાવનાથી લાવિતપણું અને (૯) પ્રસ્તુત કિયા સિવાયના વિષયોમાં મનની અપ્રવૃત્તિ-આ નવથી સહિત એવા ધ્યાનાદિ શીખ્રતઃ સિદ્ધિને આપનારા છે.

અથવા આ બધા વિશેષણો એક જ અર્થવાળા (ઉપયોગ અર્થવાળા) સમજવા; પણ ઉત્તરોત્તર વિશેષણમાં પ્રસ્તુત ઉપયોગની પ્રવર્ધમાન વિશુદ્ધિ સમજવી.

દૂંક સાર :—ઉપયોગ જ્યારે ઉત્તરોત્તર એકાથતા-પૂર્વક ધ્યેયમાં સ્થિર થતો જય, ત્યારે છેવટે ઉપયોગથી ઉપયોગવાન (ધ્યાતા આત્મા) અલિન્ન બને છે. તેથી ધ્યાતા પોતે જ ધ્યેયાકાર બને છે અને ધ્યેયાકાર (પરમાત્મ આકાર) બનેલો ધ્યાતા તે સમયે પરમાત્માથી અલિન્ન પોતાના આત્માનો અનુસંધ કરે છે.



હું આત્મા છું તેવી જગૃતિપૂર્વક જે કાંઈ થશે તે ભૂલ વિનાનું હશે.

પ્રભુના નામનું સ્મરણ એટલે ચોતાના નામનું વિસ્મરણ.

## પરિશિષ્ટ II

સ્વાધ્યાય દ્વારા પરમાત્માની હૃદયમાં પ્રતિષ્ઠા  
યાકિનીમહત્ત્ત્રાદ્વારુ-ભવવિરહાક્ક-ભગવત-શ્રીહરિમદ્રસ્તરિ-  
કૃત-'ષોડશકપ્રકરણ' સંર્દર્મ

અસ્મિન્ હૃદયસ્થે સતિ, હૃદયસ્થસ્તત્વતો મુનીન્દ્ર ઇતિ ।  
હૃદયસ્થિતે ચ તસ્મિન્, નિયમાત્સવર્થિસંસિદ્ધિ: ॥ ૨ ॥ ૧૪॥  
ચિન્તામણિ: પરોડસૌ, તેનૈવ ભવતિ સમરસાપત્તિ: ।  
સૈષેહ યોગિમાતા, નિર્બાણફલપ્રદા પ્રોક્તા ॥ ૨ ॥ ૧૫ ॥

x                    x                    x                    x

### અનુવાદ

આ જિન પ્રવચન જ્યારે હૃદયમાં સ્વાધ્યાયાદિ દ્વારા  
પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે પરમાર્થથી શ્રી જિનેશ્વર પર-  
માત્મા જ હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે અને જ્યારે શ્રી  
જિનેશ્વર ભગવંત હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે  
અવશ્યકીય સર્વપ્રયોજનોની સિદ્ધિ થાય છે. ॥૨-૧૪॥

સર્વ પ્રયોજનોની સિદ્ધિ થવાનું કારણું એ છે કે આ  
શ્રી જિનેશ્વર ભગવંત પરમ ચિન્તામણિ છે. તેઓ હૃદયમાં  
પ્રતિષ્ઠિત થતાં તેમની સાથે ધ્યાતાની સમરસાપત્તિ થાય  
છે. આ સમરસાપત્તિ ચોગીઓની માતા છે અને નિવોષુ-  
ક્લની પ્રસાધક છે. ( આત્મા જ્યારે સર્વજ્ઞના સ્વરૂપમાં  
ઉપયોગવાળો અને છે ત્યારે તેનો અન્યત્ર ઉપયોગ ન

હોવાથી તે સ્વયં સર્વસત્ત્રણ થાય છે. નથવિશેષ જેમ માને છે કે જે જે વસ્તુના ઉપયોગમાં આત્મા વર્તે છે તે તે વસ્તુના સ્વરૂપને તે ધારણું કરે છે. જેમ નિર્મળ સ્ક્રિટકમણિમાં ઉપાધિ (જેનું મણિમાં પ્રતિભિન્ન પડે તે વસ્તુ) પ્રતિભિન્નત હેખાય છે અને તે મણિ ઉપાધિના વર્ણાદિને ધારણું કરે છે, તેમ નિર્મળ આત્મા પણ ધ્યાન વડે પરમાત્મણપતાને ધારણું કરે છે. એ જ સમાપ્તિ. અથવા ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા પણ સમાપ્તિ કહેવાય છે.) ॥ ૨-૧૫ ॥

**x**                    **x**                    **x**

આનંદનો પ્રેમી આત્મા પ્રગટ આનંદના લંડાર  
પરમાત્મા પ્રત્યે પ્રેમ કરે છે. તેનો તે પરમાત્મપ્રેમ પોતે  
જ પરમાનંદ સ્વરૂપ બની આત્માને આનંદથી લરી હે છે.

આતમ અનુભૂતિ પહેંચવા માટે તે સ્થિતિએ પહેંચેલાનું સમરણ, ધ્યાન, વિચિત્રતા આવશ્યક છે. સમરણ આદિ વડે તે સ્થિતિએ પહેંચેલાનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે.

અહેંના નમસ્કાર અને ધ્યાન વડે સંકુચિત અહેંનું કોચલું કૂટી જાય છે. અને અમરતત્વના દ્વાર ખુલ્લાં થાય છે.

A decorative horizontal border element featuring a repeating pattern of stylized, symmetrical floral or scroll-like motifs. The design is composed of thin, dark lines forming intricate, three-lobed shapes with small circular dots at the intersections.

ॐ हौं अर्हुं नमः

## સાલંબન ધ્યાનના પ્રયોગો

પાઠ નવમો

વર્ણ માતૃકાનું ધ્યાન

કલિકાલ સર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંડસૂરીશ્વરજી મહા-  
રાજે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં પહેલા ચાર શલોકમાં  
વર્ણ માતૃકાના ધ્યાનનો વિધિ અતાંયો છે.

પ્રયોગ નં. ૨૭

શ્રી સિદ્ધચક્યંત્રમાં નવપદ પછી ધીજા નંખરનું સ્થાન  
( બારાક્ષરીના ૪૬ અક્ષરો ) વર્ણમાતૃકાને આપવામાં  
આંયું છે. બારાક્ષરી ( બારાખડી ) ના અથી હ સુધીના ૪૬  
અક્ષરો જે સ્કૂલમાં લખાવવામાં આવે છે તેને યોગના  
અંશો “અનાહિ સિદ્ધ વર્ણમાતૃકા”ના નામથી સંખોધન  
કરે છે. તેનું વર્ણન નીચે મુજબ છે.

(૧) આત્માની જ્ઞાનશક્તિ તે જ માતૃકા છે.

(૨) માતૃકા જ્ઞાનશક્તિદ્વય હોવાથી તેને ‘વિશ્વભોગ  
વિધાયિની’ એટલે કે સર્વ પદાર્થોને બોધ કરાવનાર કહે-  
વામાં આવે છે.

(૩) તે ખુદ્ધિમાન પુરુષોના શાનભય તેજનું માતાની જેમ જતન, પારેપાલન અને વિશોધન કરનારી હાવાથી માતૃકા કહેવાય છે.

(૪) માતૃકા આત્માની પરમ જ્યોતિ છે.

(૫) બારાક્ષરીના અથી હ સુધી ૪૬ અક્ષરોનું ચોગશાસ્કમાં ખતાવેલ આવું ધ્યાન કરનાર સાધક શુદ્ધિશાનનો પારગામી થાય છે. આ ૪૬ અક્ષરો Raw Material - આણુમાં રહેલા કાચા હીરાના સ્થાને છે અને જિનાગમ Polishd - તૈયાર હીરા સમાન છે. આ ૪૬ અક્ષરોના ધ્યાનમાં તન્મય અનનાર સાધકને સકલ આગમમાં રહેલાં રહુસ્થો, હાથમાં રહેલાં આમળાની જેમ રૂપી અનુભવમાં આવે છે.

(૬) કોઈપણ શાખદ અગર ભાષા ૪૬ અક્ષરોમાંથી અને છે. જિનેશ્વર ભગવંતની વાણી ૪૬ અક્ષરોમાંથી ગુંથાય છે. ગણુધર ભગવંતો દ્વારથાંગીની ર્યાના ૪૬ અક્ષરોના જુદી જુદી રીતે સંકલન કરે છે. જગતનો સર્વ લૌકિક અને લોકોત્તર વ્યવહાર ચલાવનારી મહાશક્તિ તે આ ૪૬ અક્ષરોનું વણુંમાલા છે. તેનું ધ્યાન કરનારને અપ્રતિમ વાણીનો પ્રવાહ મળે છે. ( Influent Flow ) વણુંમાલાનું ધ્યાન કરનારને કાંઈ પણ કહેવું હોય તો શાખ શોધવો પડતો નથી. શાખને તેની પાછળ દોડતા આવવું પડે છે. એક હન્દર વક્તૃત્વની કળા ( Art of Speaking ) ના પ્રસ્તકો વાંચવાથી જે વક્તત્વ કળા મારોન જાન મળે

છે, તે કરતાં અનેકગણું અધિક વક્તૃતવકળાનું જ્ઞાન ૪૬ અક્ષરોના ધ્યાનમાંથી મળે છે. કારણું કે સર્વ ભાષા અને શખ્ષો ૪૬ અક્ષરમાંથી ઉપન્તન થાય છે (માત્ર ધર્મોપહેશ માટે જ આ પ્રયોગથી પ્રાપ્ત થતી શક્તિનો ઉપયોગ કરવા વિનંતી છે.) તેના ધ્યાનનો વિધિ નીચે મુજબ છે —

### સાધક આત્મા

નાલિકંદ (મણીપૂર ચક) સ્થાનમાં ૧૬ પાંખડીવાળું કમળ ચિંતવે. તેમાં સેળ સ્વરોને અત્યંત સ્થિરતાપૂર્વક ચિંતવે. (૧૬ સ્વરો આ પ્રમાણે - અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઊં, લુ, લૂ, એ, એ, ઓ, ઓં, અં, અઃ. )

(૨) તે પછી હૃદયસ્થાન (અનાહત ચક)માં ચોવીસ પાંખડીવાળું કમળ ચિંતવે. તેમાં કથી ભ સુધીના ૨૪ વણોને ચિંતવે. અને તે કમળની કણિકામાં ‘મ’ ચિંતવે. ૨૪ વણો આ પ્રમાણે - (ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, ઝા, ટ, ઠ, ડા, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ. )

(૩) તે પછી મુખસ્થાનમાં આઠ પાંખડીવાળું કમળ ચિંતવાનું. તેમાં ય થી હ સુધીના આઠ વણો ચિંતવે. આઠ વણો આ પ્રમાણે - (ય, ર, લ, વ, શા, ષ, સ, હ ).

આ પ્રકારે નિત્ય વિધિપૂર્વક સમરણ કરતો સાધક શુત-જ્ઞાનનો પારગામી થાય છે, અપ્રતિમ વાક્યાતુર્યને મેળવે છે, મહાપુરુષોના પૂજા સત્કારને પામે છે, અને ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલ ગતિ (મીક્ષા)ને પામે છે.

આ પ્રમાણે :—

નાભિકમળમાં ૧૬ સ્વરો,

હૃદયકમળમાં કથી મ સુધી ૨૫ વણો,

અને મુખકમળમાં ય થી હ સુધી ૮ વણોનું  
ધ્યાન કરવું.

ઉપરોક્ત ધ્યાન પ્રયોગ અને તેનો ઇણાદેશ સમજતાં  
કોઈ પણ સુસુલ્લુ આત્માને આ પ્રયોગ કરવાનું સૌલાગ્ય  
પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તે સહજ સ્વાભાવિક છે. માત્ર જગ-  
તના પદાર્થોની પાછળ આપણું ચેતના બંધાચેતી હોવાથી  
શાસ્ત્રકાર મહર્ષિઓ બતાવેલ આવી તદીન સરળ અને અફલુત  
સાધના તરફ આપણું લક્ષ જેંચાયું નથી. એક વખત આ  
વર્ણમાતૃકાની સાધના લુચનમાં શરૂ થયા પછી અનુભવથી  
જ તેના લાલ સમજાય છે. આપણે તો માત્ર કરંસી  
નોટમાં જ લક્ષ્મીનું સ્વરૂપ જેયું છે; પરંતુ લક્ષ્મી ક્યાં ક્યાં  
વસે છે તે મહાપુરુષ કહે છે —

### લક્ષ્મીના દિવ્ય અકારો।

જિહ્વાગ્રે શાસ્ત્રલક્ષ્મી કરતલ કમલે દાન પૂજાદિ લક્ષ્મી,  
હોર્ડણે વીર્યલક્ષ્મી હૃદય સરસિજે, સત્ય કારુણ્ય લક્ષ્મી ।  
ખડુગાગ્રે શૌર્યલક્ષ્મી નયન કમલયો: ક્ષેમ સૌભાગ્ય લક્ષ્મી,  
સર્વઙ્ગે સૌર્ય લક્ષ્મી, ભવતુ મમ વિભો ! મોક્ષલક્ષ્મી ચ પ્રાન્તે ॥

જીલના અગ્રલાગ ઉપર શાસ્ત્ર રૂપી લક્ષ્મી,

કરકમલ (હાથ)માં દાન અને પૂજન રૂપી લક્ષ્મી,

અને કુળાંશમાં શક્તિ રૂપી લક્ષ્મી,

હૃદયમાં સત્ય અને કરુણા રૂપી લક્ષ્મી,  
 તલવારના અગ્રભાગ (રક્ષણ માટે) શૌય રૂપી લક્ષ્મી,  
 નયન કુમલ (નેત્ર)માં સર્વના કલ્યાણ રૂપ ભાવ  
 અને સૌભાગ્ય રૂપી લક્ષ્મી,  
 શરીરના સર્વ અંગોમાં સુખાકારી (આરોગ્ય)રૂપ લક્ષ્મી,  
 અંતે મોક્ષરૂપી લક્ષ્મી આપના પ્રભાવથી  
 હે પ્રભુ ! મને મળો.

આ શ્લોક ઉપરથી લક્ષ્મીનું અનેક પ્રકારનું સ્વરૂપ જાણ્યા પછી સમજાય છે કે માત્ર પૈસા, હીરા, સોનું વગેરેમાં જ આપણી ચેતના બાંધવા જેવી નથી, પણ જગતમાં અનેક ઉત્તમ તરફે પણ પ્રાપ્ત કરવા લાયક છે. મહાપુરુષ કહે છે કે નિત્ય વિધિપૂર્વક માત્ર બારાઘડીના અક્ષરોની સરળ અને સહેલી ધ્યાનની સાધના કરનાર, (૧) શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. (૨) અપ્રતિમ વાક્યા-તુર્યને મેળવે છે. (૩) મહાપુરુષોના સત્કારને પામે છે. (૪) ઉત્તમ પુરુષોએ પ્રાપ્ત કરેલ ગતિ (મોક્ષ) ને પામે છે.

સુસુલુ વાચકો ! આપ શાંતિથી વિચારો કે, આપણા ઉદ્ધાર માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ આવી અનુભવસિદ્ધ ધ્યાન પ્રક્રિયા બતાવી આપણા ઉપર કેટલો મહાન ઉપકાર કર્યો છે ! પૂ. પ. અધ્યા-ત્ત્મયોગી શ્રી લદ્રંકરવિજયજી મહારાજે આ પુસ્તકના લેખકને આ પ્રયોગ ૨૦૧૬ ની સાલમાં બતાવેલો અને

# वर्णांकुर द्यान

१

गालिकन्दपद्मम्




२

हृदयपद्मम्



३

मुख्यपद्मम्



२५६. नं. ७६१. २५६  
१८८१. नं. ४२५



નિત્ય તેની સાધના કરવા પ્રેરણું આપેલી. આ પછીના ચોગશાસ્કના આહમા પ્રકાશના પાંચમાથી ખાવીશમા શ્રીલોક સુધીની સાધના પણ ૨૦૧૮ માં જતાવી, નિત્ય સાધના કરવા પ્રેરણું આપેલી. જે શુદ્ધકૃપાથી આજ પર્યાત ચાલુ રહી શકી છે.

આ દિવ્ય પ્રક્રિયામાં ચોગય આત્માએ રસ લઈ મોક્ષમાર્ગની સાધનામાં આગળ વધે તે જ અહ્યર્થના....

વિશેષ પ્રેરણું માટે ડેટલીક શાસ્ક્રીય હક્કીકત નીચે મુજબ છે.

(૧) શ્રી સિદ્ધસેનસૂરિ વિરચિત ‘સિદ્ધમાતૃકાલિધ ધર્મ પ્રકરણ’ ગત સંદર્ભઃ—

તાં માતૃકાં તૈઘમહં સ્મરામિ ॥

તથાહિ—

ઓડશાચ્છદજુષિ સ્વરમાલાં નાભિકન્દકમલે વિચરન્તીમ ।  
ચિન્તયેદથ સકર્ણિકપદ્મે દ્વાદશદ્વયદલે હૃદિ વર્ણાન ॥૫૭॥  
અષ્પત્રયુજિ વકત્રસરોજે યાદિવર્ણનિકરં પ્રણિદધ્યાત ।  
સંસ્મરનનિતિ જિતાક્ષકષાયો માતૃકામ સકલવિન્મનુજ્ઞઃ  
સ્યાત ॥ ૫૮ ॥

તે માતૃકાનું હું ત્રણ પ્રકારે (ત્રણ કમળોમાં) સ્મરણ  
કરું છું.

તે આ રીતે :—

(૧) નાલિકંદસ્થાને સોળ પાંખડીવાળા કમળમાં  
વિચરતી સ્વરમાણાને ચિંતવે. તથા

(२) हृह्यस्थाने चोवीस पांखडीवाणा कण्ठिका सहित कमणमां वर्णोने (क थी म सुधीना २५ व्यंजनोने) अने

(३) आठ पत्रवाणा मुखकमणमां य आहि वर्ष-सभूळ (य थी ह सुधीना वर्णो) तुं प्रणिधान करे.

इन्द्रिये। अने कषायेने ज्ञातनारु पुरुष ने निर्दिष्ट रीते भातृकातुं संस्मरणु करे तो ते सर्वं शाय.

सुधियां चिन्मयधाम्नो जननात् परिपालनात् विशोधनतः ।  
श्री सिद्धमातृकैवं कमलश्रीर्जयति मातेव ॥ ९९ ॥

आवी रीते त्रिषु कमणोमां शोभती ऐवी सिद्धभातृका युद्धिभानु पुढेपोना ज्ञानमय तेजतुं ज्ञातन, परिपालन अने विशोधन करनारी होवाथी भातानी नेम ज्यवंती वते छे.

(२) लट्ठारक सकल कीर्ति विरचित ‘तत्त्वार्थ सार-हीपक’ संहर्स :-

ध्यायेदनादिसिद्धान्तविख्यातां वर्णमातृकाम् ।

आदिनाथमुखोत्पन्नां विश्वागमविधायिनीम् ॥ ३७ ॥

श्री आहिनाथ लगवंतना मुखथी निकलेली, सधणां आगमेनी रथना करनारी अने अनाहि सिद्धांतमां विख्यात ऐवी वर्षुभातृका (सिद्धभातृका) तुं ध्यान करवुं नेई अे.

(३) श्री संहितिलक्ष्मूरि विरचित ‘मंत्राज्जरुसम्’ संहर्स :-

षोडश चतुरधिविश्वतिरष्टौ नाभौ दलानि हृदि मूर्ध्नि ।  
आद्यं हान्तं वर्णाः शरदिन्दुकला नभः प्रभवाः ॥ ४४८ ॥

બિનદુ અને કલામાંથી ઉત્પન્ન થયેલાં ‘અ’ થી ‘હ’ સુધીના (૪૬) વણો ચિંતવવા. તે આ રીતે – ‘અ’ થી ‘અः’ સુધીના સોળ સ્વરે નાલિકમળના સોળ ફળોમાં, ‘ક’ થી ‘મ’ સુધીના ચોવીશ વ્યંજનો હૃદ્યકમળના ચોવીશ ફળોમાં તથા ‘મ’ કણ્ઠિકામાં અને ‘ય’ થી ‘હ’ સુધીના આઠ વ્યંજનો મૂર્ધસ્થાનના આઠ ફળોમાં ચિંતવવા. (૪૪૮)

ઉક્તં—

કમલદલોદરમદ્યે ધ્યાયન્ વર્ણનિનાદિસંસિદ્ધાન્ ।  
નષ્ટાદિવિષયबોધો, ધ્યાતુઃ સંપદ્યતે કાલાન્ ॥ ૪૫૧ ॥

કણું છે કે —

અનાદિ સંસિદ્ધ વણોનું કમલપત્રોમાં જે ધ્યાન કરે છે તેને નષ્ટ (ચોરાયેકી) વસ્તુ વગેરે વિષયનું જ્ઞાન અદ્વય-કાળમાં થાય છે. (૪૫૧)

કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત  
યોગશાસ્ત્રના મૂળ શ્લોકો અર્થ સાથે  
યત્પદાનિ પવિત્રાણિ, સમાલઘ્ય વિધીયતે ।  
તત્પદસ્થં સમાખ્યાતં, ધ્યાનં સિદ્ધાન્તપારગૈ: ॥ ૧ ॥

પવિત્ર, પાપને વિનાશ કરનાર, નાનાવિધ સિદ્ધિઓને  
આપનાર પદ-મંત્રાક્ષર લઈને જે ધ્યાન કરાય છે, તેને  
સિદ્ધાંત પારગ-ચૌહ પૂર્વધર ગણુધરે પદસ્થ ધ્યાન કરું છે. (૧)

હુએ ત્રણું શ્લોકો વડે વિશેષ કરું છે :—

તત્ત્વ ષોડશાપત્રાદ્ગ્રે નામિકંદગતાંબુજે ।  
સ્વરમાલાં યથાપત્ર બ્રમંતી પરિચિતયેત ॥ ૨ ॥

चतुर्विंशतिपत्रं च हृदि पद्मं सकर्णिकम् ।  
वर्णान्यथाक्रमं तत्र चितयेत्पंचविंशतिम् ॥ ३ ॥

बक्त्राब्जेऽष्टदले वर्णाष्टकमन्यत्ततः स्मरेत् ।  
संस्मरन् मातृकामेव स्थाद्युतज्ञानपारगः ॥ ४ ॥

नालिकिंद्र पर रहेला सोण पांखडीवाणा प्रथम कुम-  
णा हरेक पत्र पर सोण स्वरनी पक्षित (अ, आ, इ, ई,  
उ, ऊ, ऋ, झ, ल, लू, प, षे, ओ, औ, अं, अः) भ्रमणु  
करती चिंतवयी. हृदयमां रहेला, चोवीस पांखडीवाणा  
कण्ठिंडा सहित कुमणमां अनुकूले व्यञ्जनता क, ख, ग,  
घ, ङ, च, छ, ज, झ, ब, ट, ठ, ड, ढ, ण, त, थ, द, ध,  
न, प, फ, ब, भ, म चिंतवया, तेमां आहिना चोवीस  
पांखडीचोमां अने पचीसमें (म) कण्ठिंडामां चिंतवया,  
तथा मुखमां (मोढामां) आठ पांखडीवाणा कुमणनी कवयना  
करती. तेमां थीज्ज खालीना आठ वर्णो य, र, ल, व, श,  
ष, स, ह स्मरवा. आ अभाणु आ मातृकाने स्मरणु  
करते।—चिंतवन-ध्यान करते। श्रुतज्ञानने पारगाभी  
थाय. (२, ३, ४.)

### मातृकाना ध्याननुं इण

ध्यायतोऽनादिसंसिद्धान् वर्णनेतान्यथाविधि ।  
नष्टादिविषयेज्ञानं ध्यातुरुत्पद्यते क्षणात् ॥ ५ ॥

अनाहि सिद्ध आ अकाराहि वर्णेणुं विधिपूर्वक (पूर्व  
अतावेल त्रेण कुमणोमां गोडवीने अकात्रतापूर्वक) ध्यान

કરતાં થોડા વખતમાં ધ્યાન કરવાવાળાને નષ્ટાહિ સંભંધી ( ગયું-આયું, થયું-થવાનું-થતું, અવિત અને મરણાહિ સંભંધી ) જ્ઞાન ઉત્પજ્ઞ થાય છે. ૫

( ચોગશાસ્ક, અધ્યમપ્રકાશ. રૂપો. ૧, ૨, ૩, ૪, ૫ )

### વાર્ષિકમાતૃકાનો ધ્યાનાલ્યાસ

- (૧) નાલિ કમળમાં સોળ પાંખડીવાળા કમળમાં સોળ સ્વર અ, આ આદિનું ધ્યાન કરવું.
- (૨) હૃદયમાં ચોવીસ પાંખડીવાળા કમળમાં ક થી ભ સુધીના ૨૪ વ્યંજનોનું ધ્યાન કરવું અને કણ્ઠિકામાં ‘મ’ નું ધ્યાન કરવું.
- (૩) સુખ કમળમાં ય થી હ સુધીના આઠ અક્ષરરનું આઠ પાંખડીવાળા કમળમાં ધ્યાન કરવું.
- (૪) આ ધ્યાનથી આગમમાં રહેલાં રહેસ્થે હાથમાં રહેલાં આમળાની જેમ સ્પષ્ટ સમજય છે.
- (૫) આ ધ્યાનથી વાર્ષિકાનો અવિહંડ પ્રવાહ ( Influent Flow ) પ્રાપ્ત થાય છે.

### વાર્ષિકાનું વિશિષ્ટ રીતે ધ્યાન.

અચોંગ નં. ૨૮ :—

અનાહિ સિદ્ધ વાર્ષિકમાતૃકાનું ધ્યાન વિશિષ્ટ સાધકો માટે હવે જોઈએ.

આ. શ્રી સિંહતિલકસરીશરળ મહારાજાએ “પરમેનિ

વિદ્યા ચંત્ર-કલ્પ” નામના ચંથમાં આ વસ્તુ ખતાવેલી છે. આત્મહર્ષનના અને ધ્યાન વિષયક ચંથોમાં ધણા સ્થાને આ વસ્તુ છે. Serpent Power નામના ચોગ વિષયક ચંથમાં આ વસ્તુ સંવિસ્તર વણ્ણવેલો છે.

પ. પુ. પં. અધ્યાત્મચોગી લદ્રંકરવિજ્યજી મહારાજ-શ્રીએ આ પુસ્તકના લેખકને ૨૦૧૬ના મોટામાંઠાના ચાતુર્મોસ દરમ્યાન આ પ્રચોગ ખતાવેલો, જે આજ પર્યાત ચાલુ છે.

(૧) મૂલાધાર ચક્કા :— સ્થાન-ગુફા મૂલ. તેમાં ચાર દલવાળું કમળ ચિંતવવું. કમળનો વણ્ણ (૨ંગ) લાલ છે. તે કમળની ચાર પાંખડીમાં બ, શ, ષ, સ આ ચાર અક્ષર ચિંતવવા. આ ચાર પાંખડીવાળા કમળની કણ્ઠિકામાં લ પૃથ્વી બીજ ચિંતવવું. બું, ઝા, બું, સું આ પ્રમાણે અહીં અને હવે પછીના અક્ષરો પણ બિન્હુ સહિત ચિંતવવાથી વિશેષ લાલ થાય છે.

(૨) સ્વાધ્યિક્ષાન ચક્કા :— આ ચક્કાનું સ્થાન પેઢુમાં (લિંગમૂલ) છે. તેમાં છ પાંખડીવાળું કમળ ચિંતવવું. કમળનો વણ્ણ (૨ંગ) અર્દથ (ઉગતા સૂર્ય જોવો) છે. તેની પાંખડીઓમાં બ, ભ, મ, ય, ર, લ અનુક્રમે ચિંતવવા. આ કમળની કણ્ઠિકામાં બું વર્ણા (જલ) બીજ ચિંતવવું. ( અક્ષરો બિન્હુ સહિત ચિંતવવાથી વિશેષ લાલ થાય છે. )

(૩) મણ્ણપૂર ચક્કા :— આ ચક્કાનું સ્થાન નાલિ છે. તેમાં સકૈદ વણ્ણવાળું દશ પાંખડીનું કમળ ચિંતવવું. તે પાંખડીઓમાં અનુક્રમે ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ

ચિંતવવા. આ કમળની કણ્ઠિકામાં અજિન ખીજ હું  
ચિંતવવું.

(૪) અનાહત ચક્ર :- આ ચક્રનું સ્થાન હૃદય  
છે. તેમાં ૧૨ પાંખડીવાળું કમળ ચિંતવવું કમળનો વર્ણ  
પીણો છે. તેમાં ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, ઝા, ટ, ઠ  
આ બાર અક્ષર અનુક્રમે ચિંતવવા. તેનો કણ્ઠિકામાં વાયુ  
ખીજ ય ચિંતવવું.

(૫) વિશુદ્ધ ચક્ર :- આ ચક્રનું સ્થાન કંઠ છે. તેમાં  
૧૬ પાંખડીવાળું કમળ ચિંતવવું. તેનો વર્ણ (રંગ) સફેદ છે.  
તેમાં દરેક પાંખડીમાં અનુક્રમે અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ,  
ऋ, લ્લ, લ્લ, એ, ઓ, ઔ, અં, અઃ-આ ૧૬ સ્વર ચિંત-  
વવા. આ કમળની કણ્ઠિકામાં આકાશ તત્ત્વ હું ચિંતવવું.

(૬) આજ્ઞાચક્ર :- આ ચક્રનું સ્થાન ભૂમધ્ય છે.  
તેમાં એ પાંખડીવાળું કમળ છે. તેનો વર્ણ (રંગ) લાલ  
છે. તેમાં હ, ક્ષ,-આ અક્ષર અનુક્રમે ચિંતવવા. આ  
કમળની કણ્ઠિકામાં મહાતત્ત્વ ઉં ચિંતવવો. તેમાં શુરૂ  
તત્ત્વની વિશેષ સાધના થાય છે. જેની નોંધ આ પ્રયોગના  
છેદ્વે લીધી છે. ઉં અર્ધમાગધીનો લેવો.


(૭) સહસ્રાદ્ધ પદ્મ અથવા સહસ્રાર ચક્ર :-  
આ ચક્રનું સ્થાન સહસ્રાર (મગજ) પ્રહરંધ છે. તેમાં  
એક હાજર પાંખડીવાળું કમળ છે. તેનો વર્ણ સફેદ છે.  
તે કમળની કણ્ઠિકામાં મંત્રાધિરાજ અર્હ બિરાજમાન

છ. તે કમળના બહારના ગોળાકારની પાંખડીઓમાં પહેલા રાઉન્ડમાં ઉપરના કુલ ૫૦ અક્ષરો અથી ક્ષ સુધીના ચિંતવવા. પછી અંદર એનિ રાઉન્ડમાં ક્રીથી ૫૦ અક્ષર ચિંતવવા. આ પ્રમાણે ૨૦ રાઉન્ડ કરવા. તેમાં કુલ એક હજાર પાંખડીમાં ૨૦ વખત ૫૦ અક્ષરો આવશે. છેલ્દો રાઉન્ડ કણ્ઠિકામાં રહેલા અહોની આનુભાળુ આવશે. કમળના બહારના રાઉન્ડથી ચિંતવતાં ચિંતવતાં અંદર છેલ્દે ૨૦ મા રાઉન્ડમાં કણ્ઠિકામાં રહેલા અહોની સુધી પહેંચવાનું છે. તે પછી પ્રહૂરંપ્રમાં અહોનું ધ્યાન કરવું. આ ધ્યાનના અગણિત લાલો છે. અહોના ધ્યાનમાં તન્મય બની, ઉપરોગ અહોનું સ્થિર કરી, સંલેઘ પ્રણિધાન કરવું. તે પછી આપણા આત્માનું અહોંદેખે ધ્યાન કરવું. એટલે પહેલાં સલેઘ પ્રણિધાન કર્યો પછી અસેંદ પ્રણિધાન કરવું. એટલે આપણા આત્માનું અહોંદેખે ધ્યાન કરવું. આ ધ્યાનથી આત્મસાક્ષાત્કાર સુધી પહેંચી શકાય છે. ( અહોં મંત્રાધિરાજ વિષયમાં વધુ વિવેચન આ પુસ્તકમાં ‘થોગશાસ્ક દ-૧૬ શલોકની ધ્યાન પ્રદિયા પાઠ દર્શભે પ્રયોગ નં. ૩૦ માં છે. )



પ્રભુના નામરૂપ મંત્રને ચૈતન્યનો મહા લંડાર સમજુ ઉપાસના, જ્ય કે ધ્યાન કરવામાં આવે છે ત્યારે પરમાત્મા કલ્પવૃક્ષની જેમ તત્કાળ ઇળજાયી થાય છે.







## ଫିରୁ ପାଖ

प्रयोग नं. २८

ਪੰਨਾ ੨੫੮

પ્રયોગ નં. ૨૫ પૃષ્ઠા સાઢે



ગોતમ ગાણધિરની હ્યાન શાલીત મુખુકુદીલ  
(બેટ્ટકરણિકાલનું)માં સ્વીકારીત થાયે છે. અને  
મુખુકુદીલ અનુભૂકુદીલ રાંપણ હ્યાનશાલીત આપે છે.



# ગુરુચ્યરણારવિંહે

ચેન જ્ઞાનપ્રદીપેન, નિરસ્યાલ્યંતરં તમઃ ।  
મમાત્મા નિર્મલીચહે, તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥

## ગુરુપદ

ભક્તિ વિના મુક્તિ નથી, શ્રદ્ધા વિના ભક્તિ નથી.  
શ્રદ્ધા માટે જ્ઞાન બોઈએ, જ્ઞાન માટે ગુરુ બોઈએ.  
ગુરુવિનય વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના શ્રદ્ધા નથી.  
શ્રદ્ધા વિના ભક્તિ નથી, ભક્તિ વિના મુક્તિ નથી.  
મુક્તિ વિના સુખ નથી.

તેથી અધાના મૂળમાં ગુરુ છે,

ગુરુ તત્ત્વને મુજબ બનાવ્યા વિના જીવનમાં એક પણ  
સહગુણ સાચા સ્વરૂપમાં પ્રાપ્ત થતો નથી. અહંકારને  
છોડવા માટે જે વિનય ગુણ અતિ જરૂરી છે, તે સહગુરુને  
આધિન છે. સહગુરુની કૃપા વડે પરમ ગુરુ (પરમાત્મા)-  
ને પામી શકાય છે. પરમ ગુરુનો (પરમાત્માનો)  
સંખ્યાધ કરવી આપે તે જ સહગુરુ છે. ભક્તિ  
સહગુરુને સ્વાધીન છે. મુક્તિ પરમગુરુને આધિન છે. વિનય  
ગુણની પરાકાષ્ઠા એટલે અનંત લખિનિધાન શ્રી ગૌતમ  
સ્વામી મહારાજ. શ્રી ગૌતમ સ્વામીનું ધ્યાન દ્વારા અનુ-  
સંધાન કરવાનો આ હિંય પ્રયોગ છે.

ધ્યા. પ્ર. ૧૮

આજાચકમાં શુરૂતત્વનું વિશેષ ધ્યાન :—

પ્રચોગ નં. ૨૯

આજાચકમાં એ પાંખડીવાળું કમળ છે. કમળનો રંગ લાલ છે. એ પાંખડીમાં “હું” “ક્ષે” અક્ષરો છે. કણ્ઠિકમાં ઉંના બિન્હમાં ગૌતમસ્વામીનું પીળા વર્ણથી ધ્યાન કરવું. તે ઉંના પેટાળમાં આપણા આત્માનું સ્થાપન કરવું. અને બિન્હમાં બિરાજમાન ગૌતમસ્વામીમાંથી જાનામૃતની વૃષ્ટિ થાય છે. તેમાં ઉંના પેટાળમાં રહેલો આપણો આત્મા સ્નાન કરે છે, તે જાનામૃતને ચરણું કરે છે અને પોતે સ્વયં જાનસ્વરૂપ અને છે. આવું ધ્યાન કરવું. આ ધ્યાનમાં પરમ શુરૂ ગૌતમસ્વામીજી લગતંત જાયે સીધો સંબંધ જોડાય છે. ધ્યાન કરતી વખતે ઉંં અર્ધ માગધી લિપીનો દેવો.

અંગૂઠે અમૃત વસે, લખિધ તણું લંડાર;  
શ્રી શુરૂ ગૌતમ સમરીયે, વાંછિત કળ હાતાર.

થીજી રીતે પણ આ ધ્યાન કરી શકાય. ઉંના બિન્હમાં પરમ શુરૂ ગૌતમસ્વામી બિરાજમાન છે. ઉંના પેટાળમાં આપણા વર્તમાન જીવનના શુરૂ છે અને તે શુરૂના ચરણુકમળમાં આપણો આત્મા છે. ગૌતમસ્વામીમાંથી વરસતા જાનામૃતના પ્રલાવથી ઉંના પેટાળમાં રહેલા આપણા વર્તમાન જીવનના શુરૂમાં વિશિષ્ટ શર્જિલ ઉત્પન્ન થાય છે. અને તેમના ચરણુકમળમાં રહેલા આપણામાં તે

શક્તિનું પ્રદાન શુરૂ કરે છે તેવું ધ્યાન પણ કરી શકાય,  
આ રીતે શુરૂતત્વની ઉપાસના અને ધ્યાન કરવું.

અજ્ઞાનતિમિરાન્ધાનાં, જ્ઞાનાઙ્જનશલાકયા ।

નેત્રમુન્મીલિતં યેન, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ॥

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દૈવો મહેશ્વરः ।

ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ॥

ધ્યાનમૂલં ગુરોર્મર્તિઃ, પ્રજામૂલં ગુરોઃ પદામ् ।

મન્ત્રમૂલં ગુરોર્વાક્યં, મોક્ષમૂલં ગુરોઃ કૃપા ॥

પ્રવચન અંજન ને સફશુરૂ કરે, ટેએ પરમ નિધાન;

હૃદય નથન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન.

ધમ્ભ જિનેશ્વર ગાઉ રંગણુ....

( મહાયોગી આનંદધનાલુ કૃત ધર્મનાથ ભગવાનનું સ્તવન.)

અસાનડ્રી અંધકારથી બિડાઈ ગયેલાં આપણા  
નેત્રમાં સહશુરૂ જ્યારે પરમાત્માએ પ્રકાશેલા પ્રવચનનું  
અંજન કરે છે, ત્યારે પરમ નિધાનનું દર્શન થાય છે.  
આત્માની નવ ક્ષાયિક લખિદ્રી મહા નવનિધાન આપણા  
આત્માની અંદર જ રહેલાં છે. જ્યારે જીવનમાં શુરૂ ઉપા-  
સના દ્વારા, શુરૂકૃપા પ્રાપ્ત થાય છે ત્યારે શુરૂકૃપાથી  
આ નવનિધાનનું દર્શન આપણા આત્મામાં થાય છે.  
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય,  
અનંત દ્વાન, અનંત લાલ, અનંત લોગ, અનંત ઉપલોગ,  
અનંત સુખ-આ નવ નિધાન આપણા આત્મામાં રહેલાં

છે. તેનું દર્શાન સફળગુરુની કૃપાથી થાય છે. અને આપણા અંદર આ મહાનિધાન આત્માની ક્ષાલિક લખિંઘાએ રહેલાં છે તેનું ભાન આપણને જ્યારે થાય છે, ત્યારે તે આત્માના હિંય સ્વરૂપનો અનુભવ અને પ્રાપ્તિની ઝંખના આપણને થાય છે. અને તે માટેનો પુરુષાર્થ પણ દેવ, શુક્રની કૃપાથી શરૂ થાય છે. અને તે માટે પુરુષાર્થમાં જ્યારે સાધક આગળ વધી પરમાત્માની સાચે અલેદ ધ્યાનની અવસ્થામાં આવે છે, ત્યારે “હૃદય નથન નિહાળે જગધાણું.” ધ્યાન દ્વારા હૃદયમાં પરમાત્માનું અને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શાન-અનુભવ થાય છે. શુદ્ધ આત્મ-સ્વરૂપનું દર્શાન, અનુભવ કે સાક્ષાત્કાર એ જ આ વિશ્વ ઉપરનું અમૃત છે. બધી સાધના તેના માટે જ કરવાની છે. તે જ આપણું લક્ષિંઠનું છે. તે માટેનો પુરુષાર્થ તે જ મોક્ષમાર્ગનો સાચો પુરુષાર્થ છે. અને તેનો મહિમા અપરંપાર છે. મોક્ષ પર્યંતની સર્વ સંપર્દા અને સિદ્ધિઓનું પ્રાપ્તિસ્થાન પણ તે જ છે.

### ધ્યાનાર્થયાસ :—વર્ણોક્ષરોનું વિશિષ્ટ ધ્યાન

નીચે પ્રમાણે ચક્રોમાં વર્ણોક્ષરોનું ધ્યાન કરવું.

સ્થાન

મૂલાધાર ચક્ર :— વ, શ, ષ, સ

શુદ્ધમૂલ

સ્વાધિષ્ઠાન ચક્ર :— ખ, લ, મ, ય, ર, લ

લીંગમૂલ

મણુપૂર ચક્ર :— ડ, ઠ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ઝ નાલિ

અનાહતચક્ર :— ક, ખ, ગ, ધ, ઙ, ચ, છ, જ, ઝ, -ા, ટ, ઠ હૃદય

વિશુદ્ધ ચક્ર :— ૧૬ સ્વર

કંઠ

આજાચક્ર :— હ, ક્ષ

ભૂમદ્ય

સહખાર :— એક હળર પાંખડીવાળા કમળમાં અક્ષર  
૫૦ x ૨૦ રાઉંડમાં કુલ ૧૦૦૦ અક્ષર.  
કર્ણિકામાં ‘અહ’

ઉપર મુજબ ધ્યાન કરી અહનું અલેહ ધ્યાન  
કરવું.

આ ધ્યાનથી મોક્ષ પર્યાતની સર્વ સંપર્કાચોની ગ્રાસિ  
થાય છે.

આજાચક્રમાં શુરૂતત્વનું વિશેષ ધ્યાન કરવું.

¤



તમને જીવનમાં અમુક સંભેગોમાં Extra Protection  
—વિશેષ રક્ષણુની જરૂર પડે ત્યારે તમારા હૃદયમાં રહેલ  
પરમાત્માની દિવ્ય શક્તિઓનો પ્રકાશ તમારી ચારે તરફ  
આલામંડલ રચે છે તેની કદ્વિના કરો અને પરમાત્માની  
દિવ્ય શક્તિઓનું આલામંડલ તમારી ચારે તરફ છે તેથું  
ધ્યાન કરો. ( ગુરૂએ પ્રચોગ નં. ૬ અને તેની સમીક્ષા.)



ॐ હ્રિ અહો નમઃ

## સાલંખન ધ્યાનના પ્રચોરો

પાઠ દસમે

‘અહો’તુ ધ્યાન

યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશના આધારે “અહો”ના  
ધ્યાનના આલંખને આત્મસાક્ષાત્કારની અનુભવ  
પ્રક્રિયા :—

તાત્ત્વિક નમસ્કારતું સ્વરૂપ કલિકાલસર્વજ્ઞ ભગવાન  
શ્રી હેમચંદ્રાચાર્ય વિરचિત “સિદ્ધહેમ શણાનુશાસન”  
નામના અંથમાં ખતાવેલું છે.  
તે મૂળ પાઠ નીચે મુજબ છે.

अहं

‘अहं’ इत्यેतदક્ષરમ्, परमेश्वરस्य परमेष्ठिनो वाचकम्,  
सિદ્ધચક્રસ્થાદિબીજમ्, સકલાગમોપનિષદ્ભૂતમ्,  
अશોષવિઘ્નવિઘાતનિધનમ्,  
અખિલદૃष્ટાદૃષ્ટફલસંકલપકલ્પદ્રુમોપમમ्, આશાસ્ત્રાધ્યયના—  
ધ્યાપનાવધિ પ્રણિધેયમ् ।

प्रणिधानं चानेनाऽऽत्मनः सर्वतः संभेदस्तदभिधेयेन चाभेदः  
वयमपिचैतच्छाद्यारम्भे प्रणिदध्महे ।  
अयमेव हि तात्त्विको नमस्कार इति ॥१॥

‘अहं’ ए अक्षर परमेश्वर एवा परमेष्ठिनो वाचक छ.  
सकल रागादि भलइप कलंकथा रहित, सर्व ज्ञाना योग  
अने द्वेषमने वहन करनारा, प्रसन्नताना पात्र, ज्येतिस्वरूप  
देवाधिदेव, सर्वश, एवा परमात्मा अदिहंत देवनो वाचक  
‘अहं’ मंत्र छे.

आ अहं तु आलंभन, प्रणिधान माटे सर्वश्रेष्ठ  
छे. ते प्रणिधानना ए प्रकारे छे :—

\* (१) संलेह प्रणिधान.

(२) अलेह प्रणिधान.

**संलेह प्रणिधान :**— अहं इप वाचक पह साथे  
ध्यातानो संश्लिष्ट संबंध ते संलेह प्रणिधान.

**अलेह प्रणिधान :**— अहं अक्षरना अलिधेय ने  
प्रथम परमेष्ठिछे, तेमनी साथे ध्याताना आत्मानो सर्व प्रकारे  
अष्टीभाव अथवा ऐक्यता ते अलेह प्रणिधान छे.

आलुं अलेह प्रणिधान ज विद्नोने निर्मूण करवामां  
सौथी अधिक समर्थ छे. तेथी ज ते परमात्मस्वरूप  
“अहु” ना आ अलेह प्रणिधानने तात्त्विक नमस्कार  
कर्णेवामां आवे छे.

---

\* संलेह अलेह प्रणिधानतुं वर्णन योगशास्त्र अष्टम प्रकाश  
विवेयनना आधारे लघ्युं छे.

દ્વારા કમાં સંલેદ એટલે ચારે બાજુ ‘અહો’ શબ્દથી આપણા આત્માને વીંટળાયેલો જેવો. અર્થાત્ પોતાના આત્માનો અહોની ભધ્યમાં ન્યાસ (સ્થાપન) કરવો.

**અલેદ એટલે પોતાના આત્માનું અરિહંત-  
ઝે ધ્યાન કરવું:**

નમસ્કારનું ઉપર મુજબ તાત્ત્વિક સ્વરૂપ કલિકાલ-  
સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય લગ્નાને બતાયું છે. તેનું રહસ્ય  
ન્યારે સાધના દ્વારા સમજાય છે, ત્યારે સર્વે પાપ (કર્મોને)  
મૂળમાંથી જીએડી નાખવાની અને શ્રેષ્ઠ મંગલ રૂપ આત્મ-  
સ્વરૂપ પ્રાપ્ત કરાવવાની નમસ્કારની અચિંત્ય શક્તિ ઉપર  
પૂણું શક્તા થાય છે.

સંલેદ પ્રણિધાનમાં પરમેષ્ઠિ પહોનું આલંખન હોય  
છે અને મંત્ર પહોમાં ચિત્તવૃત્તિની એકતાનતા સાધવાની  
હોય છે અથવા મંત્રપહો સાથે સાધકે તન્મથીલાવ સાધવાનો  
હોય છે.

અહોમિત્યેતદક્ષરં પરમેશ્વરસ્ય પરમેષ્ઠિનો  
વાચકં સિદ્ધચક્ષ્યાદિબીજં સકલા-  
ગમોપનિષદ્ભૂતં અશોષવિવિનિધનં,  
અશિલદષ્ટદષ્ટકલસંકલ્પકલ્પદ્રુમોપમમ ॥ ૧૪૧ ॥

‘અહોમ્ભુ’ એ પરમેશ્વર પરમેષ્ઠિનું વાચક છે, સિદ્ધ-  
ચક્ષુનું આદિ બીજ છે, સકલ આગમાનું રહસ્ય છે, સર્વ  
વિવિનાશક છે અને દષ્ટ-અદષ્ટ સર્વ ઇણોને એકી  
સાથે પૂણું કરવા માટે કદ્દપવૃક્ષ સમાન છે.

अर्हमित्यक्षरं यस्य, चिते स्फुरति सर्वदा ।

परं ब्रह्म ततः शब्दब्रह्मणः सोऽधिगच्छति ॥ १४२ ॥

अर्हम् ए प्रभाणेना अक्षर ज्ञेना चित्तने विषे सहा  
स्कुरायमान थाय छे, ते आत्मा शपहथ्रहना ध्यानथी  
परथ्रहने अवश्य प्राप्त करै छे.

**आथभिंडि विधि :** (अथोग नं. ३०) अहंतुं देयान.

(१) ध्यानमां ऐसतां पहेलां कायानी स्वस्थता करवी  
अने मन परमात्म समरणु आहि द्वारा प्रसन्न करवुं.

(२) बने त्यां सुधी पञ्चासने ऐसवुं. न झावे ते  
सुञ्चासने ऐसवुं.

(३) कायाने सुस्थिर राखवी.

(४) पूर्व अगर उत्तर दिशा तरङ्ग मुख राखवुं.  
(जिन मंहिरमां परमात्मा सन्मुख ऐसवुं ते पूर्व दिशा  
गण्याय छे.)

(५) अने होठ सुश्रिलष्ट (अंध) राखवा.

(६) हांतोने परस्पर अडाडवा नहीं. जुल हांतने  
अडाडवी नहीं. जुल मुखमां उपरना लागमां चिटकाडी  
राखवी.

(७) झावे ते त्रण वर्खत ग्राण्यायाम करवे. श्वास  
लेतां (भूरङ्ग) वाचु साथे प्रकाशनी कृद्यना करी, ते प्रकाश  
भूताधार यक सुधी जय छे अने श्वास भूक्तां (रेच्यक) ते  
वाचु साथे राग-द्रेष अहार वर्जी नाखवानी कृद्यना करवी.

શાસ લેતાં ઉત્તમ તરવો પ્રવેશ પામે છે અને શાસ મૂકૃતાં  
વિધાતક તરવો (રાગદેખ આહિ) બહાર નીકળે છે તેવું  
ચિંતવવું. આ પ્રક્રિયા પ્રાણ્યાયામથી ત્રણ વખત કરવી. (જે  
આ પ્રક્રિયા ન કરી શકો તો પણ ચાલી શકે છે. તે પણી  
કુંભક કરવો.)

(૮) આજે પરમાત્માનો મેળાપ થવાનો છે તે ભાવથી  
મનને પ્રસંગતા અને આનંદમાં લાવવું.

(૯) ‘તીર્થ્યાંકર ગણુધર પ્રસાદાત् એવ યોગઃ ઇલતુ  
ઇલતુ’.

‘તીર્થ્યાંકર અને ગણુધર ભગવંતોના અનુયાહથી આ  
સાધના ઇળાયી બનો’. તેવી ભાવના ત્રણ વખત કરવી.



\*\*\*\*\*  
ધ્યાનં ચૈકાગ્રયસંવિત્તિ ।

—શ્રી શાનસાર ધ્યાનાષ્ટક

ધ્યાન એટલે એકાશ બુદ્ધિ, અર્થાત્ વિનાતીય જ્ઞાનના  
અંતર રહિત સંનાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે. ધાર-  
ણ્યામાં જ્ઞાનની વરચ્ચે વરચ્ચે વિચછેદ પામે છે, જ્ઞાનાં ધ્યાનમાં  
તેવું થતું નથી. પાતંજલ યોગસૂત્રમાં પણ કહ્યું છે કે –  
‘તત્ત્વ પ્રત્યૈકતાનતા ધ્યાનમ’। અર્થાત્-ધારણાના વિષયમાં  
ચિત્તની વૃત્તિઓના પ્રવાહને તેલની ધારાની જેમ અવિ-  
ચિંતનપણે ચાલુ રાખવો તે ધ્યાન છે.

\*\*\*\*\*

કલિકાલ સર્વજ્ઞ ભગવાનશ્રી હેમયંત્રાચાર્ય રચિત  
 ‘અહો’ના દ્યોપાન ભાટેના થોગશાસ્ત્રના આડેમા  
 પ્રકાશના શ્લોકે।

અથવા નાભિકંદાધ: પદ્મમષ્ટદલં સ્મરેત ।  
 સ્વરાલિકેસરં રમ્યં વર્ગાષ્ટકયુતૈર્દલૈ: ॥ ૬ ॥

દલસંધિષુ સર્વેષુ સિદ્ધસ્તુતિવિરાજિતમ્ ।  
 દલાયેષુ સમગ્રેષુ માયાપ્રણવપાવિતમ્ ॥ ૭ ॥

તસ્યાંતરંત્રિમંબર્ણમાચર્ણપુરસ્કૃતમ્ ।  
 રેફાક્રાંતં કલાબિન્દુરસ્યં પ્રાલેયનિર્મલમ્ ॥ ૮ ॥

અર્હમિત્યક્ષરં પ્રાણપ્રાંતસંસ્પર્શિ પાવનમ્ ।  
 હ્રસ્વં દીઘે પ્લુતં સ્વક્ષમમતિસ્વક્ષમં તતઃ પરમ ॥ ૯ ॥

યંથીન વિદારયન્નાભિકંઠહૃદધંટિકાદિકાન ।  
 સુસ્વક્ષમધ્વનિના મધ્યમાર્ગયાયિ સ્મરેત્તતઃ ॥ ૧૦ ॥

અથ તસ્યાંતરાત્માનં પ્લાચ્યમાનં વિચિત્રયેત् ।  
 અબદુતપ્તકલાનિર્યત ક્ષીરગૌરામૃતોર્મિભિ: ॥ ૧૧ ॥

તતઃ સુધારસ: સ્વતંષોડશાબજદલોદરે ।  
 આત્માનં ન્યસ્ય પત્રેષુ વિદ્યાદેવીશ્વ ષોડશઃ ॥ ૧૨ ॥

સ્ફુરત સ્ફક્ટિકભુંગાર-ક્ષરક્ષીરામિતામૃતૈ: ।  
 આભિરાપ્લાચ્યમાનં સ્વં ચિરં ચિત્તે વિચિત્રયેત् ॥ ૧૩ ॥

અથાસ્ય મંત્રરાજસ્યાભિધેયં પરમેષ્ઠિનમ્ ।  
 અર્હતં સૂર્યનિ ધ્યાયેત શુદ્ધસ્ફક્ટિકનિર્મલમ ॥ ૧૪ ॥

સદ્ગ્યાનાવેશતઃ સોહં સોહમિત્યાઽલપનમુહુ: ।  
 નિઃશાકમેકતાં વિદ્યાદાત્મન: પરમાત્મન: ॥ ૧૫ ॥

તतोनीरागमद्वेषममोहं सर्वदर्शिनम् ।  
सुराच्यै समवसृतौ कुर्वण्ठ धर्मदेशनाम् ॥ ૧૬ ॥

### ‘અહો’ ‘પદ્ધતિ’ સમરણ :

(૧) \*નાલિકંદની નીચે આઠ પાંખડીવાળું કુમળ  
ચિંતવલું. ( ધારણા કરવી.)

(૨) આઠ પાંખડીમાં અષ્ટ વર્ગની કુમસર  
સ્થાપના કરવી.

(િ) અ વર્ગ (ii) ક વર્ગ (iii) ચ વર્ગ (IV) ટ  
વર્ગ (V) ત વર્ગ (vi) પ વર્ગ. (vii) ય વર્ગ. (viii) શ વર્ગ.  
એક પાંખડીમાં એક વર્ગ સ્થાપન કરવો.

(૩) તે આઠ પાંખડીઓની સંધીમાં ( એક પાંખડી  
અને બીજી પાંખડીનું આંતર્દ્વારા તે સંધી) ‘હ્રી’ સ્થાપન  
કરવો.

(૪) આઠ પાંખડીના અથ લાગ ઉપર ડાં હ્રી સ્થાપન  
કરવા.

(૫) આ કુમળની કણ્ઠિકાના મધ્ય લાગમાં અહો  
અક્ષર અમૃત સમાન નિર્મણ છે તેમ ચિંતવલું.

(૬) અહો અક્ષર મનથી સમરણ કરવા માત્રથી પવિત્ર  
કરનાર છે. અહો અક્ષર પ્રથમ પરમેષ્ઠિ અરિહંત પર-

\* કદાચ અથ બધું જ ચિંતવલું ન ક્ષાવે તો નાલિકંદમાં  
‘અહો’ મંત્રાધિરાજતું સમરણ કરવું.

માત્માનો વાચક છે. તે અરિંગત પરમાત્મા પરમ અધ્યાત્મિક સ્વરૂપ છે.

જેના ચિત્તમાં ‘અહો’ અક્ષર સહા સ્કુરે છે, તે કેવળજ્ઞાનને સહજ રીતે પ્રાપ્ત કરી શકે છે. ( ૭. યશોવિજ્ઞયજી. )

અહો અક્ષર સિદ્ધયકેનું પરમ (પ્રધાન) ભીજ છે.

અહો અક્ષરનો અ સાક્ષાત્ અમૃતમય મૂર્તિ હોવાથી સુખ કરે છે.

સ્કુરાયમાન રેઝ (૨) સંપૂર્ણ રત્નત્રયને સંકલિત કરે છે.

‘હું’ માહસહિત કર્મના સમૂહને એક સાથે હણી નાખે છે.

આવા ‘અહો’ અક્ષરનું કર્મળની કણ્ઠિકામાં ધ્યાન કરવું.

(૭) અહો અક્ષરને નાલિકાદથી પ્રાણુશક્તિ સાથે અહારંધ્રમાં લઈ જવો છે તેવો સંકલ્પ કરવો.

અહો અક્ષરનું અહારંધ્ર સુધી પહોંચવું :—

(૧) અહો અક્ષરનું નાદ અને પ્રાણુ સાથે અહારંધ્ર તરફ ગમત હવે શરીર થાય છે.

(૨) પ્રથમ હુદબ અ ના ઉચ્ચારણ વડે મણિપૂરચક (નાલિચક)નું લેદન થાય છે તેવી લાવના કરવી.

(૩) પછી હના દીર્ઘ ઉત્ત્યારણ વડે હૃદ્યથંથિ (અનાહતચક)નું લેદન થાય છે તેવો લાવના કરવો.

(૪) તે પછી કંઠની ધારિકા (વિશુદ્ધચક)નું લેદન મંત્રરાજ અહોના મના ખુલુત ઉત્ત્યાર વડે થાય છે તેવી લાવના કરવી.

(૫) તે પછી ખૂબમધ્ય (આજાચક) માં અહો મંત્રના બિન્હ (મ નું અનુસ્વરાત્મક ઉત્ત્યારણ) ના ઉત્ત્યારણ વડે આજાચકનું લેદન થાય છે એવું ચિંતવવું.

(૬) અહીં અક્ષર, હવે અનક્ષર લાવને પામે છે. નાદ (અવાજ) પ્રકાશમાં પરાવર્તન (ડ્રાન્સફર) થાય છે. આજાચકથી (લલાટના અગ્રભાગથી) અહૃતરંધ્ર સુધી નાદ અંશના ઉત્ત્યારણ વડે સૂક્ષ્મ ધ્વનિ (પ્રકાશરૂપ બનેલો) વર્ણના ચકોનું લેદન કરતો અહૃતરંધ્રમાં પહોંચે છે તેવું ચિંતવવું.

(૭) આ પ્રમાણે પ્રક્રિયા કરવી, અગર લાવના કરવી. અને અહૃતરંધ્રમાં અહો અક્ષરનું સમરણ કરવું.

(૮) પ્રાણમાં બળ અહૃત્યાસ વડે ઉત્પન્ન થાય છે. અને અહૃત્યાસ વડે બળવાન બનેલો પ્રાણ, જ્યારે ધ્વનિ સહિત હૃદસ, દીર્ઘ, ખુલુત, સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ ધ્વનિ સહિત અહો અક્ષર સાથે ઉપર જાય છે, ત્યારે અંથિયોને લેદવામાં કેમે કેમે સંક્રાંતા મળી શકે છે.

(૯) અહૃતરંધ્રમાં પહોંચેલ મંત્રધિરાજ 'અહો'માં મનને સ્થિર કરી ધ્યાન કરવું.

(૧૦) હવે અહીં અધ્યરંધમાં અતિ સૂક્ષ્મ સ્વરૂપે  
લય પામેલા અહોના ધ્યાનની અતિશાય તન્મયતા થવાથી  
અધ્યરંધમાંથી અહો અક્ષરની તપ્ત કલામાંથી અમૃતની  
વર્ણ થાય છે. પ્રકાશમય મંત્રનું સ્વરૂપ હવે અમૃતરૂપે  
પરાવર્તન (ડ્રાન્સિફર) થાય છે. અમૃતવર્ણ અધ્યરંધમાંથી  
નીચેની તરફ પ્રવાહિત થાય છે. તે વર્ણમાં અંતરઆત્માને  
સિંચાતો-ભીજતો-તરણોળ થતો ચિંતવવો.

(૧૧) તે અમૃતથી એક સરોવર બને છે અને  
તેમાંથી એક સોળ પાંખડીવાળું કમળ બહાર આવે છે.

(૧૨) નાલિ સ્થાને સરોવરની સપાઈ ઉપર આ  
સક્રેદ કમળ ૧૬ પાંખડીવાળું છે. તેની કર્ણિકામાં આપણા  
આત્માને સ્થાપન કરવો.

(૧૩) કમળની ૧૬ પાંખડીઓમાં ૧૬ વિદ્યાહેવીઓ છે.

આ વિદ્યાહેવીઓના હાથમાં સ્ક્રિટિક રેલના કળશો  
છે. તેમાં અમૃત ભરેલું છે. તે કળશોમાંથી અરતા અમૃ-  
તથી, કમળની કર્ણિકામાં રહેલો આપણો આત્મા ખાવિત  
થઈ રહ્યો છે તેથું ઘણા વખત સુધી ચિંતવવું.

(૧૪) વિદ્યાહેવીઓ\* “અ-વિદ્યા”નો નાશ કરનારી  
શક્તિ વિશેષ છે. (અવિદ્યા એટલે દેહમાં આત્મત્વની જ્ઞાતિ).

વિદ્યાહેવી “માતા” આપણા આત્માને ઉદેશીને “તારા

---

\* સંતિકરં અને મોટી શાન્તિમાં નામો આવે છે તે ૧૯  
રેખિષ્ણી આદિ વિદ્યાહેવીઓ અહીં સમજવાની છે.

શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન બન. તારા સ્વરૂપમાં રૂચિ, રમણુતા, તન્મયતા કર. અને તારા પરમ આનંદમય સ્વરૂપનો અનુભવ કર. શરીરથી તું લિન્ન છે. મન, વચન, પુષ્ટિગત, કર્મ આદિ પરદ્વયથી લિન્ન છે. હે વત્સ ! તારા સચ્ચિયાનંદ સ્વરૂપમાં સ્થિર બની, તારા આત્મામાં રહેલા પરમ દિંય આનંદરસત્તું પાન કર.” (વિદ્યાદેવીએ અલિષેક કરતી વખતે આ લાલ આપે છે.)

(૧૫) વાત્સલ્યપૂર્ણ “વિદ્યાદેવીએ “માતા”ના ગ્રેમાળ સંયોગનથી આપણો આત્મા ઉત્સાહિત બને છે. અલ્હારંગમાં પરમ “પિતા” પરમાત્મા અરિહંતદેવ બિરાજમાન છે. પરમાત્મામાં સંપૂર્ણ સમર્પણ કરો, ધ્યાનના અલેહ દ્વારા પરમ આનંદ રસનો અનુભવ કરવા તત્પર બનેલો આપણો આત્મા નાલિકંદમાંથી મધ્યમાગે (સુધુમણા નાડી-દ્વારા) અલ્હારંગમાં પહોંચી જાય છે.

(૧૬) બલ્લારંગમાં (સહસ્રહલ પદ્મ એટલે મસ્તકનો મધ્ય ભાગ) મંત્રરાજ ‘અહો’ના વાચ્ય (અભિધેય) પર-શેખર પરમેષ્ઠિ અરિહંત પરમાત્મા બિરાજમાન છે. તે શુદ્ધ સ્ક્રિટિક જ્ઞેવા નિર્મણ, જ્યોતિસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવું. એકાથતાપૂર્વક પરમાત્માના સ્વરૂપમાં તન્મય, તરૂપ અનવું.

---

(x) ‘માતા’ની છચ્છા પોતાનો પુત્ર તેના પિતા (અરિહંત પરમાત્મા)ને સંપૂર્ણ આધીન રહી પિતાની સંપત્તિ (શાનાદિ)નો માલિક બને તેવી હોય છે.

અહેંનું દ્વારા શક્તિબાળાની દિવ્યપ્રક્રીયા





(૧૭) અહીં આપણો આત્મા, પરમાત્માના સ્વરૂપમાં સંપૂર્ણ એકાશતાપૂર્વક સ્થિરતા પાડ્યો છે. ધ્યાનના આવેશથી, પરમાત્મામાં સંપૂર્ણ તન-મયતા થવાથી મંત્રરાજના અલિધીય શ્રી અરિહંત પરમાત્માના શુદ્ધ સ્ફેરિક સમાન નિર્મિણ ઇપનું ધ્યાન થતાં ધ્યાતામાં (આપણામાં) ધ્યાનાવેશ એટલે મૂળ શ્લોકમાં\* નીચે લગ્યા પ્રમાણે “સોડહ”—“તે જ હું” આવે લાવ જત્તાવે છે. તે સમયે ધ્યાતાને પોતાનામાં રહેલું પરમાત્મદૃપતું પરમ ઝાન થાય છે. પરમાત્માના ધ્યાનથી આત્મામાં રહેલ પરમાત્મ તત્ત્વનો અનુભવ થાય છે. આત્મસ્વરૂપમાં પરમાનંદનો અનુભવ થાય છે.

(૧૮) પરમાત્માની સાથે ધ્યાનનો અલેઠ સિદ્ધ થતાં (મિથ્યાત્મ આહિ મીઠનીય પ્રકૃતિઓ ગળી જતાં) પરમાનંદમાં આપણો આત્મા સ્થિર બને છે. અને પોતાનામાં<sup>x</sup> રહેલ પરમાત્મ તત્ત્વનો અનુભવ થતાં પાપ નાશ થતાં (નિજરા થતાં) આત્મામાં પરમાત્મદ્વારાંતિ સ્કુરાયમાન થાય છે.

( વિશિષ્ટ સમજ માટે પરિશિષ્ટ વાંચો )

(૧૯) આત્મામાં રહેલ પરમાનંદનો અનુભવ કરવાની

\* મૂળ શ્લોક આઠમો, પ્રકાશ ૧૫ના શ્લોકમાં તદ્દુ ધ્યાના-  
વેશાતઃ સોડહે સોડહું ઇતિ મુહુ: આલપન આત્મન: પરમાત્મ-  
ના એકતાં નિશ્ચક્ષ: વિદ્યાત્ત ” આ ભાવેને સ્પર્શિત્વા પ્રયત્ન કરવે।  
(૫) મૂળ શ્લોકમાં આત્માનં એવ પરમાત્મના અભિજ્ઞ ધ્યાયન ।  
ધા. પ્ર. ૧૬

મહાન પ્રક્રિયા ચોગશાસ્કના આઠમા પ્રકાશના ૫ થી ૧૬ શ્લોકમાં ખતાવીને કલિકાલ સર્વજ્ઞ લગવાન હેમચંદ્રસૂરી-શરળ મહારાજાએ આપણા ઉપર અનંત ઉપકાર કર્યો છે. તેમને અંતરથી પ્રણામ કરવા.

કલિકાલ સર્વજ્ઞ લગવાન હેમચંદ્રસૂરીશરળ મહારાજને આ ‘અહું’ મંત્રના ધ્યાન દ્વારા શક્તિ જાગરણ, કુંડલિની ઉત્થાન, પરમાત્મ તત્ત્વ સમાપત્તિ, આત્મઅનુભવ, આત્મસાક્ષાત્કાર માટેનો આ હિંય પ્રયોગ સાધક વર્ગને અફ્લુત અભ્યસ છે. જગતલરમાં કુંડલિની ઉત્થાન માટે જેટલા પ્રયોગો મળે છે, તેમાં કલિકાલ સર્વજ્ઞ લગવાને ખતાવેલ આ પ્રયોગ સર્વશ્રેષ્ઠ લાગે છે. સામાન્ય રીતે શક્તિ જાગરણ પછી અનેક પ્રકારના રિઓર્ધન (પ્રત્યાધાત) સાધકોને અનુભવાય છે. મનની વિકૃતિ, શરીરમાં અભ્યવસ્થા, વાસનાની જગૃતિ વગેરે અનેક વિકૃતિઓ કુંડલિની ઉત્થાન સમયે થાય છે. આ એક મોડું લયસ્થાન છે.

આ લયસ્થાનને ધ્યાનમાં રાખીને કલિકાલ સર્વજ્ઞ લગવાન આ પ્રયોગમાં હૃદ્વ, હીધ્ર, ઘુલ, સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ ઉચ્ચારણ દ્વારા અડોનું લેદન કરીને શક્તિને અદ્ભુત-પ્રમાં લઈ ગયા. અને તે જગૃત થયેલ આત્મ શક્તિને “સૌચ્ય” બનાવવા માટે નાલિમાં અમૃત સરોવરમાં જિગેલા ૧૬ પાંખડીવાળા કમળની કર્ણિકામાં, જગૃત થયેલ આત્મ-શક્તિને ૧૬ વિદ્યાદેવીના કુંલમાંથી જરતા અમૃતથી ખાવિત થતી ખતાવી છે. આ રીતે અમૃત સેનાન

કરવાથી જગૃત થયેલ આત્મશક્તિ “સૌભ્ય” અની જય છે. તેથી કોઈ વિકૃતિ કે પ્રત્યાધાત ઊભા થતા નથી. તે માટે આ અફલુત પ્રયોગ છે. વિદ્યાહેવી માતાના ચેમાળ સંબોધનથી ભાવિત જગૃત આત્મશક્તિમાં કોઈ વાસના કે વિકૃતિ થતી નથી. તે પછી જગૃત આત્મશક્તિની પરમાત્મ તત્ત્વ સાથે અનુસ્થાન કરી પરમાત્મદ્વિપત્રનું હિંય શાન અને અનુભવ થાય છે.

### ધ્યાનાલ્યાસ પ્રયોગ નં. ૩૦ સાંક્ષિક નીચે સુજાપુ :

(૧) ‘અહો’ના ધ્યાન માટે પૂર્વ તૈયારી લખ્યા મુજબ કરવી.

(૨) નાલિકંદની નીચે આઠ પાંખડીવાળા કંમળની કર્ણિકામાં ‘અહો’ મંત્ર સ્થાપન કરી તેનું ધ્યાન કરવું.

(૩) ‘અહો’ મંત્રના હુસ્વ, દીર્ઘ, ખુલુત, સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ ઉચ્ચારણ કરાનું અહો મંત્ર નાલિમાંથી ઉપર જય છે તે અનુકૂળ મણિપુર ચક (નાલિ), અનાહત ચક (હૃદય), વિશુદ્ધ ચક (કંઠ), આશાચક (શુભમદ્ય)નું વિદ્યારણ (લેદાન) કરી અનુસ્થાન કરી લય પામે છે.

(૪) અનુસ્થાન અતિ સૂક્ષ્મ સ્વરૂપે લય પામેલા અહોના ધ્યાનની તન્મયતાથી અનુસ્થાન અમૃતની વર્ષા

આય છે. તે અમૃતવધોમાં આપણો આત્મા તરણોળ અને છે.

(૫) તે અમૃતનું સરોવર અને છે. તેમાં નાભિસ્થાને ૧૬ પાંખડીવાળા સંક્રૈદ કર્મણની કણ્ઠિકામાં આપણો આત્મા છે. સોળ પાંખડીમાં રહેલ ૧૬ વિદ્યાહેલીઓ સ્ટેટિક રલના કળશથી આપણો અલિબેક કરે છે. અને આત્મવિદ્યાનું દાન આપે છે.

(૬) આપણો આત્મા નાભિકંદમાંથી મધ્ય માગે અદ્વારંપ્રમાં પહોંચી, લાં બિરાજમાન શુદ્ધ સ્ટેટિક જેવા નિર્મણ, ક્ષેત્રિ સ્વરૂપ અરિહંત પરમાત્માનું તન્મયપણે ધ્યાન કરે છે.

(૭) તે ધ્યાનાવેશમાં “સોડહ”-પરમાત્મા ‘તે જ હું’ આવું આત્મજ્ઞાન આય છે.

(૮) ધ્યાતા-ધ્યાન-ધ્યેયની એકતાથી પરમ તત્ત્વનો અનુભવ એટલે કે આત્મસાક્ષાત્કારનો પરમાનંદ પ્રગટે છે.

(૯) આ પ્રચોગના બતાવનારા કલિકાલ સર્વજ્ઞ જગતાન હેમચંદ્રસૂરીજીને અંતરથી પ્રણામ કરવા.

તે પછી ૧૬ મા શ્લોકમાં—

તતો નીરાગમદ્રેષમમોહં સર્વદર્શિનમ् ।

સુરાચ્યું સમવસ્તુતૌ, કુર્વાણ ધર્મદેશનામ् ॥ ૧૬ ॥

( મોગશાસ્ત્ર-અષ્ટમ પ્રકાશ શ્લો. ૧૬ )

સમવસરણમાં બિરાજમાન થઈ ધર્મ દેશના આપતા છ્યાતાના આત્માને આ શ્રીલોકમાં બતાવ્યો છે. જગૃત થયેલી આત્મશક્તિને શું ઉપરોગ કરવો તેનું રહસ્ય અહીં બતાવ્યું છે. વિશ્વકર્માણુની સર્વોત્કૃષ્ટ કોઈ અવસ્થા ડોય તે સમવસરણસ્થ જિન છે. અને તે વિશ્વકર્માણુની સર્વોત્કૃષ્ટ સ્થિતિમાં સાધકને બતાવીને, જગૃત આત્મશક્તિને ઉપરોગ જગતના જીવ માત્રના કલ્યાણ માટે કરવાનો છે તેવો માર્ગ શાસ્કકાર મહાપુરુષે બતાવ્યો છે. આ રીતે જગૃત થયેલ આત્મશક્તિને ૧૬ વિદ્યાદેવીના અમૃત પ્રાવન દ્વારા સૌભ્ય બનાવી, અને તે જગૃત આત્મશક્તિને પ્રદ્ધારંગમાં પરમાત્મા સાથેના અલેહ દ્વારા આત્મઅનુભવનો રસાસ્વાહ કરાવી, જગતના જીવ માત્ર માટે આ શક્તિને વાપરવો. આવો અમૃત અનુષ્ઠાનરૂપ હિંય પ્રયોગ સાધકે માટે કલિકાલ સર્વજ્ઞ લગવાન હેમચંદ્રસૂરીશરણ મહારાજાએ બતાવ્યો છે. તેમને કોટી કોટી વંદન-નમસ્કાર કરવા દ્વારા આ પ્રયોગ અહીં પૂર્ણ થાય છે.

અધ્યાત્મયોગી પુ. પંન્ચાસળ મહારાજ લદ્રંકર-વિજયજી મહારાજે આ પ્રયોગ આ પુસ્તકના લેખકને ૨૦૧૬ માં શિખવાડેલો, જે તેમની કૃપાથી આજ પયંત ચાલુ રહી શક્યો છે.

જૈન શાસ્કકારોએ શક્તિ જગરણ, કુંડલિની ઉત્થાન, પદ્મચક લેદન, અને તે દ્વારા આત્મસાક્ષાત્કાર આદિ માટે બતાવેલા કેટલાક શાસ્ત્ર આખારો પરિશિષ્ટમાં લખેલા છે તે જોવાથી વશોષ માલિતી મળી શકશે.

### પરિશિષ્ટ III.

કુંડલિની ઉત્થાન, શક્તિ જગરણ માટેનો આ અદ્ભુત પ્રયોગ છે. પદ્મચંડ લેહન દ્વારા પરમાત્મ તત્ત્વ સાથે સમાપત્તિ અને અસ્થેષ ધ્યાન દ્વારા આત્મ સાક્ષાત્કારનો આ અદ્ભુત પ્રયોગ છે.

જૈન શાખાકાર મહિંદ્રાંભો કુંડલિનાના વિષયમાં શું કહે છે તે શાખના આધાર સહિત દ્વારાણુમાં જેઠું છે.

ધ્યાનાભ્યાસપ્રકર્ષાત् પવનસહચરીભૂતચેતઃપ્રશાન્તિ,  
સંપ્રાપ્યોપાધ્યપાયાત् સહજનિરૂપમાનન્દસાન્દ્રપ્રબોધૈः ।  
યોગીન્દ્રૈઃ કુણદલિન્યાં નિયમિતમરૂપાપૂરિતવ્રદ્ધારન્દ્રૈઃ ।  
ધ્યેયં યસ્ય સ્વરૂપં સ જયતિ પુરુષઃ કોડપિ સર્વાર્થવેદી ॥૩॥

શ્રી મુનિસુંદરસૂરિ રચિત-સર્વજ્ઞાષ્ટક ૧૬૧. ૩.

‘સર્વજ્ઞાષ્ટક’માં પ્રાપ્ત થતો કુણદલિનીને। નિર્દેશ :-

આચાર્ય શિરોમણિ શ્રી મુનિસુંદરસૂરિવિરચિત ‘સર્વજ્ઞાષ્ટક’માં કુણદલિની શક્તિને। નિર્દેશ આ રીતે મળે છે :-

યોગીન્દ્રો કે જેએઓ

૧. ધ્યાનના અભ્યાસની પરાક્રાથી પવન સહિત ચિત્તના નિરોધને પ્રાપ્ત કરીને અને

૨. એ પ્રકારે માનसિક વિક્ષેપ (વિષયાન્તરગામિ મન)ને ફર કરીને

૩. સહજ અને નિરૂપમ એવા આનંદથી ભરપૂર રસવાળા સ્વાનુભવરૂપ પ્રયોગને પ્રાપ્ત કરેલ છે.

— તેઓ વડે સ્વાધીન, પવનથી અલારંઘને પૂરીને  
જેના સ્વરૂપનું ધ્યાન કુષ્ણલિનીમાં કરાય છે, તે અધિનત્તુ  
મહિમાવાળા, સર્વજ્ઞ, પરમપુરુષ પરમાત્મા જ્ય પામે છે.

X

X

X

X

ભલતે જનાય નવતત્ત્વસુધાં ભલતેસ્થિતાં નવવિધાંગવૃત્તામ ।  
નવપાપકારણગં ભલતે તદ્દસૌ ભલીતિ ભળિતા ગુણિભિ:  
॥ ૧૩ ॥

ભલે ભલે કુણદલિનિ શ્રીય તથા દ્રભૂતાં મહભૂતગુણાત્મિકાં તદા ।  
જાડ્યાન્ધકારં ભલસે યદા તદા સંવિત્તિવિત્તાં ભલસે સનાતનં  
॥ ૧૫ ॥

શ્રી સિદ્ધસેનસૂરિ વિરચિત સિદ્ધમાતૃકાલિધ ધર્મ-  
પ્રકારણું માં કુણદલિની અંગે આ રીતે નિર્દેશ મળે છે :-

“લોકને નવતત્ત્વરૂપ (નવતત્ત્વના શાનદાર) અમૃત  
આપે છે, નવ પ્રકારના જીવોની અસ્તિત્વા-સત્તાને સમબલવે  
છે, નવ પ્રકારના પાપ કારણોના સમૂહનો નાશ કરે છે.  
તેથી આ કુણદલિની શક્તિને ગુણવાન પુરુષો લાભ  
કરે છે.” ૧૩

“હે ભલે ! ભલે ! કુણદલિની ! જ્યારે તું જડતારૂપ  
અધકારનો નાશ કરે છે, ત્યારે તું તારી અફલુત એવી  
મહાભૂતોના શુણોરૂપ લક્ષ્મી આપે છે અને સાથે સાથે  
સનાતન એવું શાનધન પણ આપે છે. ( કુણદલિનીના ધ્યાનથી  
સર્વ મહાભૂતો વશ થતાં અધી સિદ્ધિઓ સાખડને સ્વયં

પ્રાર્થ થાય છે. એટલું જ નહિ કિન્તુ સનાતન એવું આત્મ-  
જીન પણ પ્રાપ્ત થાય છે.)” ૧૫

બીજા પણ અનેક અંગોમાં કુણદલિની શક્તિ વિષે  
આધારો મળે છે.

આચાશક્તિરસૌ પરા ભગવતી કુબ્જાકૃતિ બિબ્રતી,  
રેખા [કુણદલિનીતિ] વર્ણનપદા, વ્યોમાન્તવિદ્યોતિની ।

પ્રેષ્યા પુ [સ્તક] માતૃકાદિ લિખિતા, કાર્યેષુ ચ શૂયતે,  
દેવી બ્રહ્મમયી પુનાતુ ભવતઃ, સિદ્ધિર્ભલે વિશ્વુતા ॥ ૩ ॥

‘કાંબ્યશિક્ષા’માં પ્રાપ્ત થતો કુણદલિનીનો નિર્દેશ :-

શ્રી વિનયચંડ્રસૂરિ વિરચિત કાંબ્યશિક્ષામાં કુણદલિનીનો  
નિર્દેશ આ રીતે પ્રાપ્ત થાય છે. “ભલિ” નામે વિશ્રિત જે  
પરમશક્તિ છે, આધશક્તિ છે, પરા લગવતી છે, કુપળ-  
કૃતિને ધારણુ કરનાર છે, તેનું રેખા અથવા કુણદલિનીને  
વધુંન કરવામાં આવે છે. તે કાદશાંત સુધીના સમગ્ર  
મહેયમાર્ગની વિદ્યોતિની (પ્રકાશિકા) છે, તેનું પુસ્તકેના  
અથવા ભારાખડીના પ્રારંભમાં આદેખન કરવામાં આવે છે.  
કાંબ્યોમાં મંગલાચરણમાં તેની સ્તુતિ સંલગ્નાય છે. તે  
દેવતા છે, તે બ્રહ્મમયી છે, તે સિદ્ધિ છે, તે તમને પવિત્ર કરો.”

x

x

x

x

સકોચ્યાપામરણં હૃતબહૃસદરી તન્તુચત્યાહમર્દયં,  
ચૂત્વા હૃત્યાસકોચે તદ્વસુ ચ ગઢકે તાલુનિ પ્રાણશક્તિનિ

नीत्या शून्यातिशून्यां पुनरपि स्वगतिं दीप्यमानां समन्तात् ।  
दोकालोकाथबलोकां कलयति स कलां यस्य तुष्टो जिनेशः ॥ १ ॥ ५४ ॥

ग्र. क. श्लो. ५४नी टीकामां (ध्यानदंडे स्तुतिभाष्या ३५४वृत.)  
भले भलेरी जोगी जाणि, आगम वेद पुराण प्रमाणि ।  
जोई लाधड तिमहिइ तत्ता, जिणवरदेव निरंजण पत्ता ॥१॥  
जाभिसूलि नागिणी भइ रूपि, वरूण हृयासण चक्ष समीपि ।  
सकति कुंडलिनी तेहनुं नाम, कोडि बीजना..... ॥३९॥  
थिर आकूची भीउउ उडीयाण, जागइ जोगिणि जिम जिग भाणा  
कोडि बीज जिम अबका करइ,..... न धरइ ॥ ४१ ॥  
देवि कहुं कुंडलिनी सकति, तहनइ नाम हुइ सवि भगति ।  
उजमांहि दीवड भहिताण, दीप सम उज्ज्ञइ तेहनुं ठाण ॥४२॥

चि. आ. इृत. अ. भा., छ. प्र.

‘अध्यात्मभातृका’मां प्राप्त थतो कुण्डलिनीने।  
निर्देशः—

अध्यात्मभातृकामां कुण्डलिनीने। निर्देश आ रीते  
मળे छे :—

“योगी पुकुषो ए कुण्डलिनी शक्तिने “लते”  
अथवा ‘ललि’ नामथी ओળणे छे. ए शक्तिनुं वर्ष्णन  
देहो, पुराणो। तेभज आगमीथी प्रभाषित छे.”

“नाभिना भूण यासे वरुण्ययक\* अने अग्नियकनीx

\* स्वाधिकानयक, ने लिंगभूल पासे छे. x भण्यपूरयक, ने  
नाभि यासे छे.

વરચે એક અત્યંત સુંદર એવી નાગિણી છે, તેનું નામ  
કુષ્ણલિની શક્તિ છે.”

“સ્થિર આકૃંધન (મૂલખંધ) કરવાથી અને ઉહીયાખું  
ખંધ કરવાથી તે યોગિની (કુષ્ણલિની શક્તિ) જાગે છે, જગ-  
તમાં સૂર્યની જેમ તે ઉદ્ઘિત થાય છે.”

“કુષ્ણલિની શક્તિ તે હેવી છે, તેનું સ્થાન હીયક  
સમાન ઉદ્ઘોતિત છે.”

X

X

X

X

નામિકન્દસમુદ્ગતા લયવતી યા બ્રહ્મરન્ધ્રાન્તરે,  
શક્તિ: કુષ્ણલિનીતિ નામ વિદિતા કાડપિ સ્તુતા યોગિમિઃ ।  
ગોન્મીલન્નિરૂપાધિબન્ધુરપરાડ્ઝનન્દામૃતસાવિણી,  
સ્વતે કાવ્યફલોત્કરાન કબિવરૈનોતા સ્મરૂતેગોચરમ ॥ ૪ ॥

મુ. સુ. સુ. વિરચિત શા. સ્ત.

‘શારહાસ્તવાષ્ટક’માં પ્રાપ્ત થતો કુષ્ણલિનીને  
નિર્દેશ :—

શ્રી ભુનિસુંદરસૂરિ વિરચિત શારહાસ્તવાષ્ટકમાં કુષ્ણ-  
લિનીને નિર્દેશ આ રીતે મળે છે :—

“તે અનિર્વચનીય પ્રલાવનાળી કુષ્ણલિની શક્તિ  
ચોગીએને સુવિદ્ધિત છે અને તેઓ વડે (વિવિધ રીતે)  
સ્તવાએલી છે. તે નાભિકંદમાંથી સમ્યગું રીતે ઉદ્ઘગત થઈને  
(મધ્યમાર્ગ વડે ઉધ્ર્યગતિને પ્રાપ્ત કરીને) અધ્યરંધ્રમાં લય  
ખામે છે. અધ્યરંધ્રમાં લય પામતી તે કુષ્ણલિની શક્તિ  
સતત પ્રવિકસવર, ઉપાધિરહિત અને પરમોતૃપ્ત એવા પરમ  
આનંદરૂપ અમૃતને ખ્રવનારી (અરનારી) છે. આવી કુષ્ણલિની

શક્તિને જ્યારે કુવિવરો સમૃતિપંચે લાવે છે, ત્યારે તે કાળ્યકૃપ કૂદોના સમૂહને જન્મ આપે છે.”

#### પરિશિષ્ટ IV

‘અહ’ મંત્રનું હિંય સ્વરૂપ.

આ પ્રયોગમાં ‘અહ’ નું ધ્યાન કરવામાં આવ્યું છે. ‘અહ’ નું સ્વરૂપ અતિ હિંય છે. તેનું સાક્ષાતું વણ્ણન તો કેવલજ્ઞાતી સિવાય ડોઈ કરવાને સમર્થ નથી.

‘અહ’ એ પરમેક્ષર પરમેષ્ઠિનો વાચક છે. સર્વોત્તમ અભ્યર્થવાળા પરમેક્ષરનું સ્વરૂપ તે ‘અહ’ મંત્ર છે. સકલ રાગાદિમલ રૂપ કલંકથી રહિત, સર્વ લુદોના યોગ અને ક્ષેમને વહુન કરનારા, પ્રસન્નતાના પાત્ર, જ્યોતિસ્વરૂપ, દેવાધિદેવ, સર્વજ્ઞ એવા અરિહંતદેવનો વાચકમંત્ર ‘અહ’ છે.

‘અહ’ સકલ આગમોમાં ઉપનિષદ સૂત્ર છે. એટલે કે ધર્મલૌકિક, પરલૌકિક-સર્વ રૂપોં આપનાર ગણ્યપિટકરૂપ સમય દ્વારાશાંગી આગમનું રહુસ્ય છે. સ્વ-પર સમયના સર્વ આગમોના તત્ત્વરૂપે ‘અહ’ નું પ્રણિધાન કરાય છે. આ મહામંત્ર ‘અહ’ ના ધ્યાનના પ્રલાવથી વિદ્ધનોનું સમૂહ ઉચ્છેદન થાય છે. પુનઃ ઉત્પન્ત ન થઈ શકે તે રીતે વિદ્ધનોનો વિચ્છેદ થાય છે.

“ અખિલ દૃષ્ટાડૃષ્ટ ફલ સંકલપકલપદ્રુમોપમં ”

—સિદ્ધહેમ શાણદાનુશાસન બૃહ્દ્બૃત્તિ-  
ચહેવતીંપણું, દેવલોકથી માંડીને મોક્ષપથુંતની સર્વ

જાપડાને દેનાર આ ‘અર્હ’ મંત્ર કલ્પવૃક્ષથી અધિક ઝળાણથી છે. આપણું પ્રાણુથી પણ અધિક ભાવનાથી ભાવિત બનીને જે ‘અર્હ’ અક્ષરનું પ્રણિધાન કરવામાં આવે તો આત્મ સાક્ષાત્કારની અનુભવ પ્રાપ્તિમાં પ્રધાન હેતુ બની જાય છે.

( પરમેષ્ઠિ ધ્યાનમાળા-ગાથા ૬-૭ અર્થ )

‘અર્હ’ અક્ષરને શુદ્ધતાશાન, ચિંતાશાન, ભાવનાશાનથી ભાવિત કરવામાં આવે તો મોક્ષપર્યાત લઈ જનાર અને છે.

એતે ષામે કર્મપર્યાર્હના મુચ્ચચારય ન્નઘૈ : ।

મુચ્ચયતે કિ પુનઃ સર્વાણિયર્થજાસ્તુ જિનાયતે ॥

( કિનસહસ્રનામસ્તોત્ર ) પંડિત આશાધર વિરચિત શ્લોક ૧૨.

શ્રી તીર્થાકર ભગવાનના નામના એક જ પહેને સંપૂર્ણ રીતે જાણવામાં આવે તો આત્મા સ્વયં તીર્થાકર થાય છે.

આ ધ્યાન પ્રયોગમાં ‘અર્હ’ ની વૈજ્ઞાનિક, શાસ્ત્રીય આધ્યાત્મિક સાધના અતાવી છે, જે મોક્ષપર્યાતના સર્વ દૃષ્ટ અને અદૃષ્ટ ઝણો આપનાર બને છે.

કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી  
વિરચિત “સંસ્કૃત દ્રચાશ્રય” મહાકાળ્યના પ્રથમ શ્લોકમાં  
અતાંયું છે-

અર્હમિત્યક્ષરં બ્રહ્મ, વાચકં પરમેષ્ઠિનઃ ।

સિદ્ધચક્કાલ્ય સદ્ગુરીઝં, સર્વતઃ પ્રણિદ્ધમહે ॥

‘અહી’ અક્ષર એ પ્રથમ પરમેષ્ઠિ અરિહંત પરમા-  
ત્માનો વાચક છે. તે અરિહંત પરમભ્રણ સ્વરૂપ છે, તેથી  
‘અહી’ પરમભ્રણ સ્વરૂપ છે અને સિદ્ધયક્તનું મુખ્ય બીજ  
છે તે ‘અહી’નું અમે પ્રણિધાન કરીએ છીએ.

અહીમિત્યક્ષરમ યસ્ય, ચિત્તે સ્ફુરતિ સર્વદા ।  
પરં બ્રહ્મ તત્ત્વઃ શબ્દબ્રહ્મણઃ સોऽધિગચ્છતિ ॥ ૨૮ ॥

૭. ધરોચિજ્યણ કૃત દ્વાત્રિંશદ દ્વાત્રિંશિંકા-શ્લોક ૨૮-

‘અહી’-ઓવે અક્ષર જેના ચિત્તમાં સદા સ્કુરે છે  
તે ‘અહી’ સ્વરૂપ બ્રહ્મથી મોક્ષને પ્રાપ્ત કરે છે.

એક જ શખણ ‘અહી’ને હુસ્વાહિ ઉચ્ચારણ કરે  
સુષુપ્તા દ્વારા નાલિ આહિ અંથિએને બેદીને પ્રાંતે બ્રહ્મ-  
રંધમાં પહેંચાડવામાં આવે તો કામધેનુ ડે કદ્વપૃષ્ઠ કરતાં  
અધિક ઈણાયો નીવડે છે. તેથી ‘અહી’ને ઈહલોક, પરલોકના  
કુળ સંબંધી સર્વ સંકલ્પોને પૂર્ણ કરવા માટે કદ્વપૃષ્ઠ સમાન  
કહેવામાં આવે છે. ધ્યાન પ્રક્રિયાનો પ્રેક્ટીકલ પ્રેરોગ  
અહીં યોગશાસ્ના આઠમા પ્રકાશના ૬ થી ૧૬ શ્લોકના  
આધારે બતાવ્યો છે. ‘યોગશાસ્ન અષ્ટમ પ્રકાશનું સવિસ્તર  
વિવરણ લાગ-૧’ પ્રકાશક-જૈન સાહિત્ય વિકાસ મંદળ  
-આ અફલુત અંથનો પણ આ પ્રેરોગમાં આધાર લેવામાં  
આવ્યો છે. વિશેષ જાણવાની જિઝાસાવાળા સાધકોએ આ  
અંથ વાંચવા ખાસ લલામણ કરવામાં આવે છે.



त्वद्बिस्बे विधृते हृदि स्फुरति न प्रागेव रुपान्तरं,  
 त्वद्वृपे तु ततः स्मृते भुवि भवेन्नो रुपमात्रप्रथा ।  
 तस्मात्त्वन्मदभेदबुद्धयुदयतो नो युष्मदस्मत्पदो—  
 ललेखः किंचिदगोचरं तु लसति ज्योतिःपरं चिन्मयम् ॥

હે પ્રભુ ! તમારું બિંબ હૃદયમાં ધારણ કરવાથી  
 બીજું કોઈ રૂપ હૃદયમાં સ્કુરાયમાન થતું નથી. અને  
 તમારા રૂપનું સમરણ થતાં પૃથ્વીમાં બીજા કોઈ રૂપની  
 પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “તું એ હું” એવી અલેદ  
 યુદ્ધિના ઉદ્યથી “યુષ્મત અને અસ્મત” પહોના ઉલ્લેખ  
 પણ થતો નથી. અને કોઈકિ અગોચર પરમ  
 ચૈતન્યમય જયોતિ અંતરમાં સ્કુરાયમાન  
 થાય છે.

પ્રતિમા શતક સ્વોપ્નવૃત્તિ. શલોક ૬૬. ૭. યશોવિજ્યજ્ઞત



ॐ हौं ई अहो नमः

## સાલંખન ધ્યાનના પ્રચોગો

પાઠ અગિયારમો

“નામસ્મરણુ” દ્વારા ધ્યાન

નામ રૂપાત્મક આ વિશ્વમાં આપણુને સૌથી વધુ  
મહત્ત્વ આપણા પોતાના નામ અને રૂપનું છે. પોતાનું  
નામ અને રૂપ એ સંસાર પરિભ્રમણનો હેતુ છે.

પોતાના નામનું વિસ્મરણુ કરવા માટે પ્રલુના  
નામનું સ્મરણુ છે.

પોતાના રૂપનું વિસ્મરણુ કરવા માટે પ્રલુના રૂપનું  
કશાન છે.

નામ અહે આવો મળો, મન લીતર લગવાન;  
મંત્રબળો જેમ દેવતા, હડાલો કીધો આહુવાન.

જેમ કોઈ મંત્ર-દેવતાનું આહુવાન કરવાથી મંત્ર-  
દેવતાને હાજર થવું પડે છે, તેમ પ્રલુના નામરૂપ મંત્રનું  
સ્મરણુ કરવાથી પરમાત્મા આપણા મનમંદિરમાં મળવા-  
માટે આવે છે.

નામ અને નામીનો કથાંચિતું અલેદ સંખંધ છે.  
 ‘લાડુ’ શાખ બોલવાથી તેનો હેખાવ, સ્વાદ, ખંડું નજર  
 સમક્ષ આવે છે. ‘રસગુલ્લા’ શાખ બોલીએ છીએ ત્યારે  
 કેટલાક રસલોલુપી માણ્ણુસોને માદામાં પાણી આવે છે,  
 તે બતાવે છે કે વસ્તુના નામને વસ્તુ સાથે સીધો સંખંધ  
 છે. તેવી રીતે ‘અરિહંત’ એવા નામને સાક્ષાત્ અરિહંત  
 પરમાત્મા સાથે સીધો સંખંધ છે. માટે કંધું છે કે,  
 ‘નામ થણે આવી મળો, મન લીતર લગવાન.’

માટે પરમાત્માને મૈળવવાની તીવ્ર અંખના Dynamic Desire આપણામાં ઉત્પન્ન કરવી અને તે અંખના પૂર્ખું કરવા માટે ચારે નિષ્ઠેપે ત્રિવિધે ત્રિવિધે પ્રભુલક્ષિત કરવી. ( Devotion to Divinity ).

નૈનશાસનમાં ચાર નિષ્ઠેપોનું અહિસુત તત્ત્વસાન છે. ભાવ નિષ્ઠેપે તો અતિ ઉપકારી છે જ; પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્યની પણ અતિ ડિંમત છે. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ પ્રતિમાશતકું નામના અંથમાં લખે છે :-

નામાદિદ્રયે હૃદયસ્થિતે સતિ ભગવાન् પુર ઇવ સ્ફુરતિ ।  
 હૃદયમિવાઽનુપવિશતિ, મધુરાલાપમિવઽનુબદતિ, સર્વાઙ્ગીણ-  
 મિવાઽનુભવતિ, તનમયીમાવમિવાપદ્યતે; તેન ચ સર્વકલ્યાણ-  
 સિદ્ધિઃ, તત્કથં નિષ્ઠેપત્રયાદરં વિના ભાવનિષેપાદરઃ ?  
 માઓહ્લાસસ્ય તદ્ધધીનત્વાત् ॥

**ભાવાનુવાદ :** નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણું  
 હૃદયમાં સ્થિર થવાથી ભગવાન જાણે સાક્ષાત્ સામે હેખાય

છે, જણે હૃદયમાં પ્રવેશ કરી રહ્યા છે, મધુરાલાપથી જણે આપણી સાથે બોલી રહ્યા છે, જણે આખા શરીરમાં લગવાન બ્યાપી ગયા હોય, જણે તન્મય ભાવને પામ્યા હોય તેવું અનુભવાય છે. તેથી સર્વ કલ્યાણની સિદ્ધિ થાય છે. માટે ત્રણ નિષેખના આહરથી જ લાવ નિષેખનો આહર થઈ શકે, અને લાવોલાસ વધે છે.

મહાપુરુષોએ આ રીતે પરમાત્માને ચારે નિષેખે હૃદયમાં સ્થિર કરવા અને તે દ્વારા થતી વિશિષ્ટ અનુભવાને જીવનમાં અનુભવવા ઉપદેશ આપેલ છે. ઉપરનાં શાસ્ત્રવચ્ચનો સાક્ષી પૂરે છે કે કે લગવાન આપણા હૃદયમાં પ્રવેશે છે, આપણી સાથે મધુર વાતોલાપ કરે છે, આખા શરીરમાં બ્યાપી જય છે. આવો અમૃત અનુભવ કરવો તે જ માનવજીવનનું લક્ષ્ય છે.

પ્રભુનું નામ દેવાથી પ્રભુ આપણને મળવા માટે આવે છે. અને પ્રભુનો મેળાપ છેવટે લવથી પાર ઉતારે છે.

કહ્યું છે કે —

“તુંહી અલગો ભવ થકી પણ, લવિક તાહરે નામ રે;  
પાર ભવનો તેહ પામે, એહિ અચિરજ ઠામ રે.  
પ્રભુ તુંહી, તુંહી, તુંહી, તુંહી, ચુંહી ધરતા ધ્યાન રે;  
તુજ સ્વરૂપી જે થયા, તેને લખ્યું તાહુરું તાન રે.

( શાનવિમલસૂરી વિરચિત સ્તવન. )

## ગ્રયોગ નં. ૩૧

પ્રભુનું નામસમરણું એ પદ્ધતિ ધ્યાનની પ્રક્રિયા છે.

ધ્યાતા સમક્ષ ધ્યેય વસ્તુ સ્વરૂપે વિદ્યમાન નથી, પરંતુ તેને તેના બોધ રૂપે ઉપલબ્ધિ છે. તેથી ધ્યેય જે પરમાત્મા છે, તે વાચ્ય છે. તેનો વાચ્યક પ્રભુનામ અહો, અરિહંત વર્ગેરે છે.

અહીં ઇત્યેતदક્ષરમ પરમેશ્વરસ્વય પરમેષ્ઠિનો વાચકમ् ।

(સિદ્ધહેમ શબ્દાનુશાસન.)

પરમાત્માનું વાચ્યક જે નામ છે, તેના દ્વારા ધ્યેયની ઉપલબ્ધિ સાધકને થાય છે.

પરમાત્મા નામ દ્વારા ધ્યેય જે પરમાત્મા છે, તેની સાથે ઔર્કય સધ્યાય છે. તેનાથી ધ્યાતાને પદ્ધતિ ધ્યાન સિદ્ધ થાય છે.

નામના ઉચ્ચારણું સાથે નામી (પરમાત્મા)ની ઉપસ્થિતિનો અનુલબ તે નામાલ્યાસની અગતિનું મહત્વપૂર્ણ લક્ષણું છે.

વ્યવહારમાં પણ આપણા એ છોકરા પરહેશ ગયા હોય ત્યારે જે છોકરાનું નામ બાદ કરીએ છીએ, તે જ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. પરમાત્માના નામસમરણું વખતે પરમાત્મા સાક્ષાતું રૂપમાં ધ્યાતાને મળે છે.

પદ્ધમપ્રભુજીના નામને, હું જાં બલિહાર, લવિજન; નામ જ્યાંતા દીહા ગમું, લવલય લંજનહાર, લવિજન,

પદ્ધમ૦ ॥૧૧॥

नाम सुषुप्तां मन उद्दिसे, लोचन विकसित होय, लविज्ञन;  
रोमांचित हुये देहडी, जाणे भिलिये। सोय, लविज्ञन.

पद्धम० ॥२॥

पंचम काणे पामवो, दुलहो प्रबु हीदार, लविज्ञन;  
तो पणु तेहना नामनो, छे भोटो आधार, लविज्ञन,

पद्धम० ॥३॥

नाम अहे आवी भिले, मन लीतर लगवान, लविज्ञन;  
मंत्र अणे किम देवता, वहावो कीदो आळवान, लविज्ञन.

पद्धम० ॥४॥

ध्यान पद्धस्थ प्रभावथी, चाघयो अनुलव स्वाद, लविज्ञन;  
मानविज्ञय वाचक कुहे, मूँडे थीजे वाढ, लविज्ञन.

पद्धम० ॥५॥

(पद्धस्थ ध्यान विषयक उ. मानविज्ञयलु कृत पद्मप्रबुनु  
स्तवन.)

नाम स्मरणु वर्खते साधकने शुं अनुलव थवो जोऽच्चे  
ते अहीं अतांयुं छे.

- (१) नाम स्मरणु करतां मन उद्दिसित अने,
- (२) लोचन (आंगो) विकसित अनी जय,
- (३) रोमराजु विकस्वर थर्ध जय,
- (४) साक्षात् प्रबु भज्या होय तेवो अनुलव थाय.

नाम स्मरणु वर्खते उपरनां चार लक्षणा सिद्ध  
करीच्चे तो योथी कडीमां अतांया मुज्ज्य-“नाम अहे आनी

મિલે, મન ભીતર લગવાન.” તે સત્યપણે અનુભવમાં આવે. નામ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકાય.

અને છેલ્લી કદીમાં —

ધ્યાન પહુસ્થ ગ્રલાવથી, ચાખ્યો અનુભવ સ્વાહ;

માનવિજ્ય વાચક કહે, મૂડો બીજો વાદ. (૫)

ગ્રલુના નામનું ધ્યાન એટલે પહુસ્થ ધ્યાન થવાથી આત્મસ્વરૂપના અનુભવ સુધી પહોંચી શકાય છે. માટે બીજો વાદવિવાદ મૂડીને પરમાત્માના નામના ધ્યાન દ્વારા આત્માના અનુભવ રસનો આપણે આનંદ ચાખીએ તે જ પરમ દૃષ્ટ છે. મહાપુરૂપ કહે છે કે, નામ દ્વારા કેવી રીતે આત્મઅનુભવ થાય તે વાદવિવાદ અને તકને છોડીને, ગ્રલુના નામનું ધ્યાન કરી, આત્મસ્વરૂપનો અમે અનુભવ કર્યો છે; અને તમે પણ કરો.

માટે જ કહ્યું છે કે —

શુદ્ધધાશય થિર ગ્રલુ ઉપરોગોં, જે સમરે તુજ નામજી,

અંધાખાધ અનંતુ પામે, પરમ અમૃત સુખ ધામજી.

( શ્રી દેવચંદ્રજી કૃત શીતલનાથ લગવાનનું સ્તવન.)

ધ્યેય-લક્ષની શુદ્ધિપૂર્વક એટલે કે આત્મઅનુભવ પ્રગટ કરવા માટે ગ્રલુનું નામ લેવું અને આ રીતે શુદ્ધાશયપૂર્વક પરમાત્માનું ધ્યાન કરવા માટે જે સાધક ગ્રલુનું નામ સમરણું કરે છે તે પરમાત્મ સ્વરૂપને અવલાંખી, છેવટે પરમ અમૃતમય આત્મસ્વરૂપને પામે છે.

નામ દ્વારા આત્મસ્વરૂપનો અનુભવ કેવી રીતે થાય  
છે તે જેઈએ —

પરમાત્માના નામ દ્વારા આત્મઅનુભવ —

**દ્રવ્ય ગુણુ પર્યાય :** — દા. ત., સોનાનો હાર છે.  
તેમાં સેતું તે દ્રવ્ય છે. પીળાશ, ચીકાશ અને લારેપણું તે  
ગુણુ છે. અને હાર તે પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા.  
તે બદ્ધલાયા જ કરે છે. ગુણુ હંમેશાં દ્રવ્ય સાથે જ રહે, એટલે  
તે સહભાવિ છે. અને પર્યાય બદ્ધલાય છે, તેથી તે કુમ  
ભાવિ છે. “ગુણુ પર્યાયવતુ દ્રવ્ય” (તત્ત્વાર્થ સૂત્ર). દ્રવ્ય  
હંમેશાં ગુણુ પર્યાય સહિત હોય છે.

નામનો સંબંધ દ્રવ્ય સાથે છે, અને દ્રવ્યનો સંબંધ  
ગુણુ પર્યાય સાથે છે. પ્રભુનું નામ સ્મરણુ કરવાથી, પ્રભુનું  
આત્મદ્રવ્ય સ્મરણુપટ ઉપર આવે છે. પ્રભુનું આત્મદ્રવ્ય  
અનંત શુદ્ધ ગુણ અને પર્યાયનું ધામ છે. પ્રભુ નામ  
સ્મરણુથી પરમાત્માના દ્રવ્ય, ગુણુ અને પર્યાયનું સ્મરણુ  
અને તેમાં લીનતા આવતાં ધ્યાન થાય છે. અને પરમા-  
ત્માના દ્રવ્ય, ગુણુ અને પર્યાયના જેવા જ આપણા આત્માના  
દ્રવ્ય, ગુણુ પર્યાયનું જીબન થાય છે. કહ્યું છે કે-

ધર્મ જગનાથનો ધર્મ સુચિ ગાઈએ,

આપણો આત્મા તેહવો ભાવીએ;

જાતિ જસુ એકતા તેહ પલટે નહીં,

શુદ્ધ ગુણુ પણજવા વસ્તુ સત્તા મયિ.

( શ્રી દેવચંદ્રજી વિરચિત ધર્મનાથ લગ્નવાનનું સ્તવન. )

સત્તાએ આપણું સ્વરૂપ પરમાત્માના જેવું છે. તેવું  
જ્ઞાન પરમાત્માના સમરણ કરા થાય છે અને છેવટે તે  
જ્ઞાન, ધ્યાનએકત્વમાં પરિણામે છે, ત્યારે આત્માનો પરમાત્મ  
રૂપે અનુભવ થાય છે.

**નામ રૂપ ધન મળ્યા પછી સાધકની સ્થિતિ —  
ગીત :—**

આજ મૈંને નામ રતન ધન પાયો,  
પાયોણ મૈંને નામ રતન ધન પાયો.  
કહા કરું અખ યે ધન દોલતકો,  
કહા કરું અખ યે માન સન્માનકો,  
નામ હી શરન હમારો.....  
પાયોણ મૈંને નામ રતન ધન પાયો.  
અચેં ન ઝૂટે એ તો, ચોર ન લૂટે,  
દિન દિન બઢત સવાયો, પાયોણ મૈંને  
લાગી લગની પ્રભુ નામકી,  
પરમ આનંદ રસ પાયો;  
નામ જપું જલધાર પ્રભુ તુલ,  
અનુભવ અમૃત રસ પાયો. પાયોણ મૈંને  
મન ભી તેરા, તન ભી તેરા,  
તેરા ફીંડ ઔર પ્રાણ;  
સખ કુછ તેરા, તું હૈ મેરા,  
તું હી શરન આધાર. પાયોણ મૈંને

(આ ગીત અંજનશલાકા પ્રાણુપ્રતિષ્ઠા વિધિમાં  
નામકરણું પ્રસંગે આ પુસ્તકના લેખકે જેશીતું કાર્ય કરેલું,  
ત્યારે સ્ટેજ ઉપર રચાઈ ગયું હતું.)

### ભક્તા હૃદયની પ્રાર્થના

જૈન શાસનની આગવી શૈલી મુજબ નથનિક્ષેપા,  
સપ્તસંગી, વ્યવહાર, નિશ્ચય વગેરે સર્વ રીતે પ્રલુની સ્તુતિ  
કર્યા પછી, સમય શ્રુતસાગરને સાર જિનલક્ષ્ણ છે તેવો  
નિષ્કર્ષ મહોપાદ્યાય યશોવિજયાલ મહારાજે કાઢ્યો છે.

સાર મેતતુ મયા લબ્ધા, શ્રુતસાગર અવગાહનાત् ।  
ભક્તિ ર્ભાગવતી બીજા, પરમાનંદ સંપદા ॥

પરમાનંદની સંપૂર્ણાનું ખીજ જિનલક્ષ્ણ છે તેવું  
અમૃત સમય શાખ્યોના અવગાહનથી મને મળ્યું - તેવું  
મહાપુરુષનું કથન છે.

માટે જ “હે પ્રલુ ! મારા મનથી એક ક્ષણું પણ  
હું ખસતો નહીં; તેવી પ્રાર્થના કરે છે.

હું તો શ્રુતસાગરનું બિનહુ પણ જાણુતો નથી, માટે  
જ પ્રલુને પ્રાર્થના કરે છું.

હે કર્માભય પ્રલુ ! હું મારી જતને તારી કૃપા પર  
છાડું છું.

મને સતત તારા સમરણુમાં રાખ.

મને તો ડેવળ તારી ગ્રેમ જેઠાં છે.

આ તારો ખાળ હુનિયાના પ્રવોલનોથી મોહ પામીને  
તને ભૂલી ન જય તેણું કરજે.

આ હુનિયાની માયાજળ, સુવર્ણનું આકર્ષણ, કીર્તિનું  
પ્રવોલન, અને વાસનાનું ભૂત મને તારાથી વિઘૂટો ન  
પાડી હે એટલું જ પ્રભુ ! તારી પાસે માગું છું.

તારી અસીમ કૃપા વડે મને સહા સિંચતો રહેજે.  
સિંચને તું સહા વિધુલ કરણું રસે,  
મુજ મને શુદ્ધ ભતિ કલ્પવેલી.

હે પ્રભુ ! હું એટલું ધર્છું છું કે તારા કરણારસનું  
તું મારા ઉપર નિરંતર સિંચન કરજે, જેનાથી મારી બુદ્ધિ  
શુદ્ધ થાય.

હે વાતસદ્વય રસના લંડાર પ્રભુ ! મારી બુદ્ધિ તો  
મિથ્યા મોહથી વાસિત છે. અસત્માં સત્ત અને અતત્માં  
તત્ત સ્વરૂપને જોતી મારી મિથ્યા બુદ્ધિએ મારા પુરુષાર્થને  
અવળા માર્ગે વાળ્યો છે.

હુઃખની ખાણુમાં સુખનું સુવર્ણ શોધું છું.  
માયાનું પાણી વદોવી તેમાં શાંતિને શોધું છું.

ધીજને હુઃખી કરી, મને સુખ કચાંથી મળે ? પ્રભુ !

તારાં ખાળકો સમા, તારી કરણાના પરમ પાત્ર  
જગતના જીવાને સંતાપ આપીને મને શાંતિ કચાંથી  
મળે ? પ્રભુ !

હે દ્વારામય ! માટે જ કહું છું કે, તારી કર્ણાનું  
સિંચન કરીને તું મારી બુદ્ધિ શુદ્ધ કર.

અને જેના ઉપર તારી કર્ણા વરસે છે, તેની બુદ્ધિ  
તો કદ્વપવૃક્ષ સમાન બની જય છે. માટે જ શુદ્ધ ભતિને  
કદ્વપવેદી મહાયુરથે કહી છે.

પ્રભુ ! તને મારી અંતિમ એક પ્રાર્થના છે.

“વેગળો મત હોને દેવ, મુજ મત થકી,  
કમળના વન થકી નેમ પરાગો.”

( ૩. બશોવિજયજી મહારાજ કૃત ૩૫૦ ગાથાનું સ્તવન.)

એક ક્ષણું પણ પ્રભુ ! મારા મનમાંથી તું ખસતો  
નહીં. જે રીતે કમળના વનથી તેની સુવાસ હુર થઈ શકતી  
નથી, તેમ હે પ્રભુ ! મારા મનમંહિરમાં તું નિરંતર રહેને.  
તારું અખંડ સ્મરણું મને સદા રહો એ જ પ્રાર્થના છે.

( નામ સ્મરણું વિષયક અનેક અંથો જૈન-કૈનેતરોમાં  
લખાઈ ગયા છે. નામતા આલંબને અનેક લભ્ય આત્માઓ  
સંસાર સમુક્ર તરી ગયા છે. વધુ વિસ્તાર માટે સાધકોએ  
ખીજું સાહિત્ય પણ જેવું. વિસ્તારના લયે વધુ અહીં  
લખ્યું નથી. )

ॐ हूँ अहो नमः

## सालं खन ध्यानना प्रयोगो

पाठ वारमो

योगशास्त्रना सातमा प्रकाशना आधारे  
पिंडस्थ ध्यान

प्रयोग नं. ३२

(१) आगण खताव्या प्रमाणे ध्यान माटे आसन  
आहि सर्व तेयारी करवी.

(२) आंख खंध करीने नीचे मुज्ज्य पार्थिवी,  
आग्नेयी, भाद्रती, वाइष्णवी अने तत्त्वभू — आ पांच  
धारणा करवी.

(३) तिर्णलोक प्रमाण लांघो, पहेलो एक क्षीर-  
समुद्र चिंतववे. ते क्षीरसमुद्रना भध्यमां जंभुक्षीप प्रमाण  
एक लाख योजन विस्तारवाणुं एक हजार पांखडीवाणुं  
कमળ चिंतववुं. ते कमળनी कर्णिकामां भेड़ पर्वत एक  
लाख योजन ऊंचा चिंतववे. ते भेड़ पर्वतनी उपर  
स्फटिक रत्नतुं हजारवण सिंहासन छे. ते सिंहासनमां  
आपणे घेते घेठेला छीचे तेवुं हस्य जेवुं.....

આવું દશ્ય અરોખર સ્થિરતાપૂર્વક જેવું. (આ પાર્થીવી ધારણા છે.)

(૪) ઉપર મુજબ મેરુ પર્વતના શિખર ઉપર સ્ક્રિટિક રતનના સિંહાસનમાં એઠેલો આપણો આત્મા આડે કમેને મૂળથી જાખેડી નાખવા તત્પર અન્યે છે તેવી ભાવના કરવી.

(૫) ઉપર મુજબ સ્ક્રિટિક રતનના સિંહાસનમાં આપણે એઠેલા છીએ. આપણી નાલિમાં ૧૬ પાંખડીવાળું કમળ ચિંતવવું. તે કમળની પાંખડીઓમાં ૧૬ સ્વર ચિંતવવા. અને નાલિમાં રહેલા કમળની કણ્ઠિકામાં “અહુ” મંત્ર સ્થાપન કરવો. હૃદયમાં આડ પાંખડીવાળું કમળ ઊંઘું લટકતું રાખવું. અધ્યાત્માખવાળા આ કમળની આડ પાંખડીમાં આડ કર્મ - (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેહનીય, (૪) મોહનીય, (૫) આચુષ્યકર્મ, (૬) નામકર્મ, (૭) ગોત્રકર્મ, (૮) અંતરાય કર્મ સ્થાપન કરવાં. નાલિમાં રહેલા ૧૬ પાંખડીના કમળની ઉપર જણે અધ્યર જુલતું હોય તેમ હૃદયના સ્થાને આ કમળનું સુખ નીચું રાખવું.

(૬) નાલિમાં રહેલા કમળની કણ્ઠિકામાં “અહુ” મહામંત્રનું ધ્યાન કરવું. ધ્યાનના પ્રલાવથી અહુંતા રૈદ-માંથી ધીમે ધીમે અગ્નિ પ્રગત થાય છે. પછી તે અગ્નિ પ્રજ્વલિત થઈ જવાલાડ્યું બને છે તેવું દશ્ય જેવું.

(૭) તે અગ્નિન્યાયા હૃદયની અંદર રહેલાં આડ કર્મથી બનેલાં આડ પાંખડીવાળા કમળને ખાળે છે. આડે

કર્મ બળી રહ્યાં છે, તેવો સંકદ્યક કરવો.....  
શાડો સમય અગિનજવાળામાં આઠે કર્મો બળી રહ્યાં છે  
તેવું સંકદ્યપૂર્વક અનુભવવું.....  
.....

(૮) અગિનજવાળા આપણું આખા શરીરમાં ફેલાઈ  
નાય છે. તેમાં આત્મપ્રદેશોને લાગેલા ભાવ કર્મ-રાગ,  
ક્રેષ, મોહ, અજ્ઞાન - બળી રહ્યાં છે - તેવો સંકદ્યક કરવો.

(૯) ત્રિકોણ અગિનકુંડ ચિંતવવો. અને આપણે તે  
અગિનકુંડમાં એકેલા છીએ. ભયંકર અગિનજવાળામાં આપણું  
શરીર (નોકર્મ), ભાવકર્મ, અને જ્ઞાનાવરણીય કર્મ આદિ  
આઠ કર્મો બળીને લસ્તમ થઈનાય છે તેવું દશ્ય સંકદ્યપૂર્વક  
નેવું: તે બધાં બળીને લસ્તમ થઈ ગયાં.....  
.....

આવું દશ્ય નેવું. આવું અનુભવવું.....  
બળવાની વસ્તુ ખતમ થવાથી અગિન શાંત થાય છે.....  
.....

(અહીં સુધી આગનેયી ધારણા છે.)

(૧૦) ત્યાર પછી પવંતને પણ ચલાયમાન કરે તેવો  
પ્રચંડ પવન આવે છે તેવું દશ્ય નેવું.....  
.....  
તે પવન આપણું ઉપરથી પસાર થાય છે.....  
.....(આવું અનુભવવું.)  
તે પવનના અપાટામાં શરીર અને કર્મો બળી જવાથી જે

રાખ રહી હતી તે જાહી જાય છે તેવો સંકલ્પ કરવો.....  
હુએ પવન શાન્ત થાય છે.....

( અહીં સુધી માર્ગી ધારણા છે.)

(૧૧) અમૃત સરખા વરસાદને વરસાવનાર વાદળથી  
આકાશ ઘેરાઈ ગયું છે. તેવું દશ્ય જોવું.....  
અધ્ય ચંદ્રાકાર વડણુ (વૈ) બીજાનું સ્મરણુ કરવું.  
અમૃતનો વરસાદ આપણા ઉપર પડી રહ્યો છે.....  
.....( આવું દશ્ય જોવું.)

તે વરસાદમાં આપણે સ્નાન કરીએ છીએ.....  
અમૃતના વરસાદમાં સ્નાન કરવાથી આત્મા ઉપર ચોંટી  
રહેલી રજ ધોવાઈને આત્મા શુદ્ધ-નિર્મણ બને છે.....  
( અહીં સુધી વાર્ણી ધારણા છે.)

(૧૨) દ્રવ્યકર્મ (સાનાવરણી આહિ), લાવકર્મ (રાગ,  
દ્રોષ, મોહ, અજાન આહિ) અને શરીર (નોકર્મ) થી રહિત  
શુદ્ધ, નિર્મણ, સર્વશ સમાન આત્માનું ચિંતન કરવું.....  
.....

( આ તત્ત્વભૂ ધારણા કહેવાય છે.)

અહીં પ્રથમ આત્મભાવના કરવી. પછી શુદ્ધાત્માનું  
ધ્યાન કરવું.

સત્તધાતુવિનાભૂતં પૂર્ણદુવિશદ્યુતિમ् ।  
સર્વજ્ઞકલ્પમાત્માનં શુદ્ધબુદ્ધિઃ સ્મરેત્તતઃ ॥ ૨૩ ॥

ततः सिंहासनरुदं सर्वातिशयभासुरं ।

विघ्वस्ताशेषकर्माणं कल्याणमहिमान्वितम् ॥ २४ ॥

स्वांगगर्भे निराकारं संस्मरेदिति तत्त्वभूः ।

साभ्यास इति पिंडस्थे योगी शिवसुखं भजेत ॥ २५ ॥

यार धारणा कर्या पछी शुद्ध भुद्धिवाणा साधके सात  
धातु विनाना, पूर्णचंद्रनी भाईक निर्मल कांतिवाणा अने  
सर्वज्ञ सरभा पेताना आत्माने स्मरवो. (यितववो.)  
पछी सिंहासन उपर आइठ थयेला सर्व अतिशयोथी  
सुशोभित, सर्व कर्मेनो नाश करनारा अने उत्तम महिमा-  
वाणा, पेताना शरीरनी अंदर रहेला, निराकार आत्माने  
स्मरवो. ए तत्त्वभू नामनी धारणा जाणुवी. आ पिंडस्थ  
ध्याननें सहा अह्यास करनार योगनो साधक आत्मा  
भाक्ष सुअने पामे छे.

(योगशाख, सम्म प्रकाश-श्लोक नं. २३, २४, २५.)

अहुँ विशेष दीते तत्त्वभू धारणा करवी, अने  
आत्मध्यान करवुँ. हुँ आत्मा हुँ.....

माझं लक्षण शान, इर्शन, चारित्र, वीर्य अने  
उपयोग छे.....

पुढगल द्रव्य माराथी लिन्न छे.....

पुढगल द्रव्यनु लक्षण शब्द, दृप, रस, गंध अने  
स्पर्श छे.....

पुढगल विनाशी छे.....

હું અવિનાર્થી આત્મા છું.....

પુદ્ગલ રૂપી છે.....

હું અરૂપી છું.....

શરીર પુદ્ગલનો સ્કંધ છે, હું તેનાથી લિન્ન છું....

કર્મથી સજ્જન પામેલા પદાર્થો અને ભાવેથી હું  
લિન્ન છું.....

જગતમાં દશ્યમાન પુદ્ગલ પદાર્થોથી હું લિન્ન છું....

મન, વાણી, કર્મ પુદ્ગલ સ્વરૂપ છે; તેનાથી પણ  
હું લિન્ન છું.....

પાંચ ધારણાના ધ્યાન કારા દ્રવ્યકર્મ, લાવકર્મ, નો  
કર્મથી હું લિન્ન બન્યો છું.....

પુદ્ગલથી લિન્ન રૂપે ભાવિત અનેલો હું હવે આત્મ-  
ભાવના અને આત્મધ્યાનમાં પ્રવેશું છું.....

હું પૂણું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું તે ભાવ  
મને ભારામાં સ્થિર થવા માટેનું સામર્થ્ય પ્રગટાવે છે....

આત્મા પૂણું આનંદ અને સુખનું ધામ છે.....

**આત્મભાવના અને આત્મધ્યાન**

(તરવભૂ ધારણા)

હું આત્મા છું.....

આનંદનો કંદ છું.....

અનંત સુખનું ધામ છું.....  
 હું મને જ લેઉં છું.....  
 હું મને જ જાણું છું.....  
 હું મને જ અનુભવું છું.....  
 હું મારામાં જ રમું છું.....  
 હું મારામાં જ તૃપ્ત છું.....  
 હું મારામાં જ હરીને એઠો છું.....  
 તેથી પરમ સુખી છું.....( આવી.  
 ભાવના અને ધ્યાન કરવું : )

પરમ આનંદને જોગવું છું. (આવો અનુભવ કરવો.)

આથી હું પરમ તૃપ્તિને અનુભવું છું.....  
 .....( અનુભવવું : )

( અહીં સ્થિરતાપૂર્વક ધ્યાન કરવું : )

આવી રીતે તૃપ્ત થયેલા મને મારા આત્મસ્વરૂપ  
 સિવાય કોઈ ધરછા નથી.....  
 હું મારામાં જ હરીને એઠો છું.....

મારા જ્ઞાનમાં અનેક જ્ઞય પદાર્થો અળકે છે. હું તેનો  
 શાતા-દધા જ છું.....

તે પર દ્રવ્યો, પર દ્રવ્યોના ભાવો મને મારી તૃપ્તિ  
 કે સ્થિરતામાં ફેરફાર કરી શકતાં નથી. કર્મના ઉદ્દ્યથી

ઉત્પન્ન થતાં વિચિત્ર નિમિત્તો વક્ષે પણ હું માત્ર તેનો  
જાતા-દ્વારા છું. તે નિમિત્તો મને સુખ-હુઅ કે રાગ-દૈવ  
ઉત્પન્ન નહીં કરી શકે.....

હું મારા આત્માથી પરિપૂર્ણ-તૃપ્ત બન્યો છું.

આત્માના અનુભવરસના પરમ આનંદમાં તૃપ્ત બનીને  
હું સ્થિરતાપૂર્વક તે આનંદ અનુભવું છું.....  
( થોડી ક્ષણું સ્થિરતાપૂર્વક ધ્યાન કરીને આનંદ અનુભવવો.)  
.....

આ કાળની ‘આવલી’ ને પ્રવાહથી અતંત છે, તે  
આત્માના જ્ઞાન અને આનંદની તૃપ્તિમાં જ વહી જાઓ.  
તેવો પરમાત્માને લાવપૂર્વકની મારી માર્યાના છે.....

મને મારા આત્મામાં જ સહા આનંદ રહેણા.....

મારા આત્માનું સમરણ કરાવનાર પૂણુંનંદને પામેલા  
પરમાત્માનું જ મને નિરંતર સમરણ રહેણા.....

સર્વ જીવોને પણ આત્મ-સ્વરૂપનો આનંદ મળેણા.....  
( આ રીતે પાંચ ધારણાનો નિત્ય અહ્યાસ કરવો.).....  
.....

આત્માં સચ્ચિદાનંદો, જ્ઞાન દર્શન લક્ષણः ।

શુદ્ધાત્મ દ્રષ્ટ્ય મેવાહં, શુદ્ધ જ્ઞાન ગુણો મમ ॥

સિદ્ધાત્મા શુદ્ધ રૂપોસ્મિ, જ્ઞાન દર્શન લક્ષણः ।

( શુદ્ધાધ્યોગ તથા જ્ઞાનસાર, અથ )

ધ્યાન પૂર્વં થયા પછીની પરમાત્માને આર્થના :-

પ્રભુ છે ત્રિલુલનાથ, હાસ છું તાહરો,

કરુણાનિધિ ! અલિલાખ એ છે મુજ એ ખરો;  
આતમ વસ્તુ સ્વભાવ સહા મુજ સાંસરો,

લાસન વાસન એહ ચરણ ધ્યાને ધરો.

( શ્રી દેવચંડળ કૃત સુવિધિનાથ ભગવાનતું સ્તવન.)

હે ત્રણ જગતના નાથ ! કરુણાનિધાન પરમાત્મા !  
આપની પાસે મારી એક જ અલિલાખ છે. આત્માનું શુદ્ધ  
ચૈતન્ય રવદ્રષ્પ મને નિરંતર યાહ રહો. હું કહી આત્માના  
સ્વદ્રષ્પને ભૂલું નહીં તેવું તમારા પ્રભાવથી થાએ. આત્મ  
સ્વદ્રષ્પમાં જ તૃપ્તિ અને રમણુતાનો પરમ આનંદ મારા  
અંદર નિત્ય રહો તેવી મારી અલિલાખ છે.....

અયોગ નં. ૩૨ આત્મ અનુભવની દિવ્ય અંકૃત્યા  
ધ્યાનાલ્યાસ

(A) એક હળાર પાંખડીવાળા કમળની કર્ણિકામાં  
રહેલા મેરુ પર્વતના શિખર ઉપર રહેલા સ્ક્રિટ રતના  
સિહાસનમાં આપણે બેડા છીએ.

(B) નાલિમાં ‘અહુ’ મંત્રનું ધ્યાન કરવું.

(C) ‘અહુ’ના રેઝમાંથી અગ્નિજવાળા પ્રગટ થાય છે.

(D) હૃદ્યમાં ઊંઘું લટકતું કમળ છે. તેમાં આઠ  
કર્મ છે. ‘અહુ’ના રેઝમાંથી નીકળેલી અગ્નિજવાળામાં  
( જ્ઞાનાવરણીય આદિ ) આઠે કર્મો બણે છે. અગ્નિ વધુ

વિસ્તૃત થતાં ભાવ કર્મ (રાગ, દ્રોષ, મોહ, અજ્ઞાન) બળે છે, પ્રચંડ અગ્નિજીવાળામાં આપણું શરીર બળે છે. ધ્યાના-વસ્થામાં દફન થતું અનુભવવું.

(E) પ્રચંડ પવનમાં રાખ જિડી જાય છે.

(F) ઘટાટોય વાઢળમાંથી અમૃતનો વરસાદ પડે છે. તેમાં સ્નાન કરી આપણે સ્વર્ચા-નિર્મણ બનીએ છીએ.

(G) માત્ર શુદ્ધ આત્મા રહે છે. અહીં આત્મલાવના-આત્મક્ષયાત કરવું. અને આત્મસ્વરૂપનો અનુભવ કરી પરમાનંદમાં લીન બનવું.

(H) છેદ્વે પ્રાર્થના કરવી. ‘પ્રલુ છે। ત્રિભુવનનાથ....’



મનુષ્યની સૌથી પ્રથળ ઈચ્છા સુખ, શાન્તિ ઝણે આનંદ પ્રાપ્ત કરવાની છે.

આનંદ આત્મા છે.

પ્રગાટ પરાકાષ્ઠાએ પહોંચેલો આનંદ પરમાત્મા છે.

સાચું સુખ અને આનંદ આત્મામાં અને પરમાત્માના મિલનમાં.



ॐ ह्रीं अर्हं नमः

## सालं खन ध्यानना प्रयोगे।

पाठ तेरमें

सिद्धिगिरिनुं ध्यान अने नित्य हिव्य देहनी रथना  
अने ध्यान पूजा

प्रयोग नं. ३३ :—

મेरુ પર्वત ઉપર તરવભૂ ધારણાતું આસ્વાહન કર્યા  
પછી, આત્મસ્વરૂપની વધુ નિકટતા અનુભવવા માટે મેરુ  
પર्वત ઉપરથી વિશ્વ ઉપરની સિદ્ધશિલાદ્રિપ સિદ્ધગિરિ  
—શાનુંજય ગિરિરાજ ઉપર સાધક આત્મા આવે છે. ત્યાં  
અનુકૂળ ચોથ્ય સ્થળે નીચે મુજબ ધ્યાનસ્થ બની સાધના કરવી.

સિદ્ધગિરિ એ ચૈતન્ય શક્તિનો લાંડાર છે. અનંત  
સિદ્ધ પુરુષોએ પોતાની સાધના પૂર્ણ કરી, પૂર્ણ શુદ્ધ  
આત્મસ્વરૂપ અહીં સિદ્ધગિરિ ઉપર પ્રગટ કર્યું છે. ત્યાં  
એસી સાધક આત્મા અનંત સિદ્ધ આત્માએ સાથે પોતાના  
આત્માની એકતાનો અનુભવ કરે છે :—

દ્રવ્ય :—બેલું સિદ્ધ લગબંતોતું આત્મદ્રવ્ય છે,

તેલું જ આપણું આત્મ દ્રોધ છે તેલું ભાવિત કરી, સિદ્ધ લગવંતો સાથે દ્રોધની એકતા.

**ક્ષેત્ર :**—આપણે જે ક્ષેત્ર ઉપર બેઠા છીએ, ત્યાં જ અનંતા સિદ્ધ થયા છે તે રીતે ક્ષેત્રની એકતા.

**કાળ :**—વર્તમાન ક્ષણું સર્વત્ર એક જ છે. સિદ્ધચિલા ઉપર, મહાનિદેહમાં, ભરતમાં, કે ચૌદ રાજલોકમાં સર્વત્ર વર્તમાન ક્ષણું ( સ્વસમય ) એક જ છે તે રીતે કાળની એકતા.

**ભાવ :**—સ્વરૂપ સ્થિરતા, સ્વરૂપ રમણીતા, સ્વરૂપ લોકૃત્વ, સ્વરૂપાનંદ, વગેરે ભાવ સિદ્ધ પુરુષોના સ્પર્શ અનુભવથી આપણામાં ઉત્પન્ન થયા છે તે ભાવ એકતા.

આ રીતે અનંત સિદ્ધ લગવંતોની સાથે દ્રોધ, ક્ષેત્ર, કાળ, ભાવથી એકતા સાધવી. અને તે ધ્યાનમાં સ્થિર બની આત્મ અનુભવ કરવો.....

આ રીતે સિદ્ધ લગવંત સાથે દ્રોધ, ગુણું, પર્યાયનો એકતા સાધી આત્મઅનુભવ કરવો.....

**સિદ્ધગિરિ** ઉપર આપણો સાધક આત્મા પસાર થાય છે. તે ચૈતન્યના મહાસાગરમાંથી પસાર થઈ રહ્યો છે. અનંત સિદ્ધ પુરુષોના નિર્મણ ચૈતન્ય સાથે એકમેક બનીને ચાલે છે. અને આત્મસ્વરૂપના આનંદને અનુભવતો અનુભવતો પસાર થાય છે. સર્વત્ર ચારે તરફ તેને ચૈતન્ય જ હેખાય છે..... “ જ્યોતિ સ્વરૂપી તું જિન દીઠો, તેને ન ગમે બીજું કંઈ રે; જ્યાં જઈએ ત્યાં પૂરણું સધણે, દીસે તુંણી જ તુંણી રે.

( દેષ રહિત આત્મા ઇપે જ અત્યારે સાધક છે. તે હવે વિશિષ્ટ ખીજુ પ્રકારની આરાધનામાં પ્રવેશ કરવાનો હોવાથી હિંય શરીરની રચના કરે છે.) “ દેવો ભૂત્વા દેવ થજેત ” દેવ બનીને દેવની પૂજા કરવી. શત્રુંજ્ય ગિરિરાજ ઉપર ચુગાહિ પ્રભુ આદીથર દાદાની પૂજા કરવા માટે સાધક હિંય શરીર બનાવે છે.

તીર્થાંકર લગવંતોના શરીર જેવા પુછગલ પરમાણુમાંથી અને છે, તેવા જ પુછગલ પરમાણુને સંકદ્પના બળથી જેંચી લાવી, નવું શરીર બનાવે છે.

સમ્યગું દષ્ટ આત્માઓની જેવી મનની સ્થિતિ હોય છે, તેવા મનોવર્ગાણુના પુછગલ દ્વારા પોતાના મનતું બંધારણ કરે છે. ( મન અનાવે છે.)

તીર્થાંકર પરમાત્માની ઉપ વાણીના ગુણોથી ચુક્તા ભાષાવર્ગાણુના પુછગલો-ને વિશ્વમાં ફેલાય છે-તે ભાષા-વર્ગાણુના પુછગલોથી પોતાની વાણી અનાવે છે. એટલે જગતના સર્વોત્તમ શરીર, મન અને વાણીની રચના કરી હિંય દેહ આદીથર દાદાની પૂજા લક્ષ્ણ માટે જય છે.

પરમાત્માની પૂજાનો પ્રયોગ-ધ્યાન પ્રયોગ નં. ૧૫ પ્રમાણે હિંય સામનીથી પરમાત્માની પૂજા કરવી.

તે પછી ધ્યાન પ્રયોગ નં. ૧૮ પ્રમાણે આદર, ખડુમાન, રૂચિ, વીર્ય સ્કૂરણા, રમણુતા, તન્મયતા, તદ્દૂપતા અને એકત્ર-આ આઠ સ્ટેજની સાધના દ્વારા પરમાત્માનું અલેહ ધ્યાન કરી, પરમાનંદનો અનુભવ કરવો.

## ધ્યાનાહૃત્યાસ :—

- (૧) મેરુ પર્વત ઉપરની આત્મલાવના અને આત્મધ્યાન કર્યા પછી, દેહરહિત આત્મરૂપમાં જ સિદ્ધગિરિ ઉપર આવવું.
- (૨) ચોંચ સ્થળે ધ્યાનમાં રહી સિદ્ધ લગવંત સાથે દ્રોધ, ક્ષેત્ર, કાળ અને લાવથી એકતા સાધવી.
- (૩) દ્રોધ, ગુણ અને પર્યાયથી સિદ્ધ લગવંતો સાથે એકતા સાધવી.
- (૪) આ એકતામાં ધ્યાનાવસ્થામાં આત્માની સાક્ષાત અનુભૂતિ કરવી.
- (૫) તીર્થાંકર લગવંતના શરીર બને છે તેવા પુછગાત્ર પરમાણુમાંથી નવા દેહની રચના કરવી. દિંય મન અને વાણીની રચના કરવી.
- (૬) દિંય દેહથી સવોત્તમ દ્રોધથી યુગાદિ આદીશર દાઢાની પૂજા કરવી.
- (૭) તે પછી પરમાત્માની સાથે ધ્યાનનો અલેહ કરવો. આદર, બહુમાન, ઇચ્છિ, વીર્યસ્કુરણું, રમણુતા, તનમયતા, તર્ફુપતા, એકત્વતા-આ આઠ સ્ટેજની સાધના કરી, પરમાત્માના અલેહ ધ્યાન દ્વારા આનંદ અનુભવવો.

કષ્પદમંગ્રિ તરુણો, મणિણો ચિતામણિંગ્રિ જહ સંઘે ।  
જિણભત્તીએ ધર્મા તષ્ફલદાણા તહા સંઘે ॥

જેમ કદ્વપવૃક્ષમાં તમામ વૃક્ષો સમાઈ જાય છે,  
ચિત્તામણિરતનમાં બધા મળિઓ સમાઈ જાય છે, તેવી  
દીતે તમામ ધર્મો શ્રી અરિહંત લક્ષ્ણિમાં સમાઈ  
જાય છે.

અરિહંત લક્ષ્ણ તમામ ધર્મના ઝળને આપનાર  
હોવાથી અરિહંત લક્ષ્ણિમાં તમામ ધર્મો સમાઈ જાય છે.

જહ બહુકાલ ધન્ને પુકખલસંબહુમેહજલબુટી ।

તહ જિણભસ્તી ઇકા જીવે સુચિરે સુહે દેહ ॥

જેમ પુષ્કરાવર્ત્ત મેધની જલવૃષ્ટિ ધણ્ણા કાળ સુધી  
ધાન્યને હે છે, તેમ એક અરિહંત લક્ષ્ણ જીવેને ધણ્ણા  
લાંખા કાળ સુધી સુખોને આપે છે.

( નમસ્કાર ચિંતામણિ શ્લોક ૬૪, ૬૫. )

દિવા રાત્રો સુખે દુઃખે, શોકે હર્ષે ગૃહે બહિઃ ।

ક્ષુધિ તૃપ્તો ગમે સ્થાને, ધ્યાતવ્યા: પરમેષ્ઠિનઃ ॥

દિવસે કે રાત્રે, સુખમાં કે દુઃખમાં, શોકમાં કે  
હર્ષમાં, ધરમાં કે બહાર, ભૂખ્યા કે તૃપ્તિમાં, ગમનમાં કે  
સ્થાનમાં (સ્થિરતામાં) પરમેષ્ઠિઓનું ધ્યાન કરવું જોઈએ.

અપવિત્ર: પવિત્રો વા, સુસ્થિતો દુઃસ્થિતોઽથવા ।

ધ્યાયન પઞ્ચનમસ્કારં, સર્વપાપૈ: પ્રમુચ્યતે ॥

અપવિત્ર હોય કે પવિત્ર હોય, સુખી હોય કે દુઃખી  
હોય, પણ જે નવકારનું ધ્યાન કરે છે, તે સર્વ પાપોથી  
અનુક્રત થાય છે.

अपवित्रः पवित्रो वा, सर्वाक्षस्थां गतोऽपि वा ।  
यः स्मरेत् परमात्मानं, स वाश्यभ्यन्तरे शुचिः ॥

જે મનુષ્ય પવિત્ર હોય કે અપવિત્ર હોય, ગમે તે અવસ્થામાં રહેલો હોય, પણ જે તે પરમાત્માનું સ્મરણું કરે છે, તો તે અંદર અને ખાડાર સર્વાનું પવિત્ર જ છે.

परमेष्ठિ नमस्कारः, सारः सद्धर्मकर्मसु ।  
नवनीतं यथा दध्नि, कवित्वे च यथा ध्वनीः ॥  
'इय पञ्च नमोङ्कारो' सारो निसेसधमस्स ॥

જેમ દહીનો સાર માખણું છે, કવિતાનો સાર ધ્વનિ છે, તેમ જિનેશ્વરે કહેલા સર્વ ધર્માનુષ્ઠાનોનો સાર શ્રી નવકાર છે.

એ પ્રમાણે પંચ નમસ્કાર (નવકાર) એ સમગ્ર ધર્મનો સાર છે.

कर्णिकाष्टदलाढ्ये, हृत्पुण्डरीके निवेश्य यः ।  
ध्यायेत् पञ्चनमस्कारं, संસारं सन्तरेत्तराम् ॥

કર्णિકા સહિત આઠ પત્રવાળા હૃદયકમળમાં શ્રી નવ-કારના નવપદને સ્થાપન કરીને જે ધ્યાન કરે છે, તે સંસાર સાગરને શીદ્રિતઃ તરી જાય છે.



ॐ हूँ अहो नमः

## सालं अन् ध्यानना प्रयोगो।

पाठ चौहमो

महाविदेह ध्यान

प्रयोग नं. ३४ :—

ખીજ જ-મમાં મહાવિદેહ ક્ષેત્રમાં પરમાત્મા વિચરતા  
હોય તે ક્ષેત્રમાં આપણો જ-મ થાય, આઠમા વર્ષો પ્રભુ પાસે  
દીક્ષા થાય, પ્રભુ આશા મુજબનું જીવન જીવી આપણું કેવળ-  
જ્ઞાન સ્વરૂપ પ્રગટ કરીએ—આવો આપણે સંકલ્પ કરીએ તો  
તે ફળીભૂત થાય? હા, જરૂર થાય. આચુષ્યનો બંધ પડી  
ગયો હોય તો ત્રીજા લવે અને બંધ ન પડયો હોય તો  
ખીજ લવે સાક્ષાત્ પરમાત્મા પાસે આપણે પહોંચી શકીએ  
છીએ. પરમાત્મા પાસે દીક્ષા લઈ શકીએ અને મોક્ષ માર્ગમાં  
આગળ વધી શકીએ. પરંતુ તે માટે આજથી જ કલ્પનાથી  
મહાવિદેહ ક્ષેત્રમાં સિમંધરસ્વામી લગવાન પાસે જવું,  
તેમની દેશના સાંસળવી, તદ્દનુરૂપ સર્વગુહર્ષિન-જ્ઞાન પામી  
આરિત્ર અંગીકાર કરવું. પ્રભુની આશાને અનુરૂપ સાધના

કરી, અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી, શુદ્ધ ધ્યાન આરો-  
હણું કરી ઘાતીકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું  
વગેરે પ્રક્રિયા કદ્વપતાથી લાવનારૂપે આજે જ શરૂ કરવી  
જરૂરી છે.

### પરમાત્મ-મિલનની તીવ્ર ઝંખના

નિષ્પાર્વકના સલ્ય સંકલ્પ સિવાય સફ્વસ્તુઓ  
જીવનમાં પ્રાપ્ત થઈ શકતી નથી. સંકલ્પને કલ્પવૃક્ષ  
કહેવામાં આવે છે. જ્યારે જીવને પરમાત્માની પ્રાપ્તિની  
તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે, ત્યારે પરમાત્માને ત્યાં આવવું  
પડે છે, તેવું જ્ઞાનીપુરુષો કહે છે.

મહાયોગી શ્રી આનંદધનાજી મહારાજ કહે છે કે—

‘દરિશન પ્રાણુજીવન મોહે હીજે,  
થીન દરિશન મોહે કલ ન પરત હૈ  
તરદે-તરદે તનુ છીજે.’

હે પરમાત્મા, હે કરોણાસાગર, દર્શન આપો.

તમારા દર્શન વિના હવે આ દેહમાં પ્રાણ ટકી  
શકે તેમ નથી.

મીરાંખાઈ લજનમાં ગાય છે :

‘મૈં તો પ્રેમ હીવાની, મેરા હું ન જને કોઈ.’

આવી તીવ્ર ઝંખના પરમાત્માનાં દર્શન માટે થાય  
છે ત્યારે મહાપુરુષો કહે છે કે,

“ સાતરાજ અળગા જઈ એડા,  
પણ ભગતે અમ મનમાંહે પેડા.”

—૬. અશોવિજયજી મ૦

જ્યારે સાચી લક્ષ્ણ ઉત્પન્ન થાય છે ત્યારે પરમાત્મા  
ત્યાં હાજર હોય છે.

પરમાત્માનાં દર્શન કે મિલન સિવાય શરીરમાં પ્રાણ  
ન ટકે, તેવી પ્રલુભિલનની તીવ્ર ઝંખના આપણા જીવનમાં  
લાવવા માટે સંકલ્પનું બળ વધારવું જરૂરી છે. જ્યારે  
આપણુંને આવો પ્રલુભિલનનો સત્ય સંકલ્પ નિષ્પાપૂર્વકનો  
થાય છે, (Appointment with the Highest) ત્યારે  
પરમાત્માનો અવશ્ય મેળાપ થાય છે, પણ તે માટે પ્રલુ-  
બિરહની એક ક્ષણું વરસ સમાન લાંખી લાગવી જેઈએ.  
“સાહિબા એક ઘડી પ્રલુભ તુમ વિના, જય વરસ સમાન (૨)  
ગ્રેમ વિરહ હવે કેમ ખમું, જણો વચન પ્રમાણ (૨)  
ઘડી ચે ન વિસરો હો સાહિબા.”

પ્રલુદર્શનની આવી લગની જ્યારે મનુષ્યને લાગે છે  
ત્યારે જ પરમાત્મા મળે છે. પરમાત્માના વિચોગ વખતે થયેલા  
લાવો, વિચોગમાં રહેલા વિશિષ્ટ ચોગને જીતાવે છે. વિચોગ  
વખતે આપણે જેની ધર્ઢા કરીએ છીએ તે વસ્તુ (object)  
ઘણી હુર હોય છે, પણ વિચોગ વખતે એક વિશિષ્ટ ચોગ  
થાય છે, જેનાથી સમરણ અને ધ્યાન દ્વારા વસ્તુની નિકટતા  
અનુભવાય છે.

રાવણ સીતાને ઉપાડી લંકામાં લઈ ગયેઠા. રામે

હતુમાનને સીતાની ખખર લેવા મોકદ્યા. હતુમાન સીતાની ખખર લઈને રામ પાસે આવીને નિવેહન કરે છે કે સીતાના પ્રાણું રામના ધ્યાનમાં એવી રીતે જોવાઈ ગયા છે કે સાક્ષાત્ યમરાજ સીતાના પ્રાણું હરણું કરવા આવ્યા; પરંતુ સીતાના પ્રાણું તો રામના ધ્યાનમાં જોવાઈ ગયા હતા, તેથી યમરાજને સીતાના પ્રાણું જડાયા નહિ અને યમરાજ પાછા ચાલ્યા ગયા છે.

કરીથી હતુમાન કહે છે : “રામવિષયક ધ્યાન રૂપી બારણું સીતામાં એવા રીતે બંધ થઈ ગયું છે, કે સીતાના પ્રાણું શરીરમાંથી છૂટવા માટે દ્વાર શોધે છે; પરંતુ રામના ધ્યાન રૂપી દ્વાર સીતામાં બંધ થઈ ગયેલ હોવાથી, સીતાના પ્રાણું શરીરમાંથી છૂટી શકતા નથી. રામનું ધ્યાન છૂટે તેની સાથે સીતાના પ્રાણું છૂટે તેવી પરિસ્થિતિ છે. રામ અને સીતા વચ્ચે હળવો માઈલનું અંતર છે, છતાં વિચોગ સમયે અંતરંગમાં સમરણું અને ધ્યાન દ્વારા તહેન નિકટતા અનુભવાય છે.

પરમાત્માના વિચોગ વખતે થતું આવું ધ્યાન અને સમરણ - પરમાત્માની તહેન નિકટતાનો અનુભવ કરાવે છે. પરમાત્મમિલનની તીવ્ર ઝંખના (Dynamic Desire) જેને થાય છે તેને પરમાત્મા અવશ્ય મળે છે.

X                    X                    X

આપણું અત્યારે ભરતક્ષેત્રમાં લાવ જિનેશ્વર સાક્ષાત્ રૂપે નથી મળી શકતા. સાક્ષાત્ લાવ જિનેશ્વર સિમંધર-

સ્વામી ભગવાન અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં પુજખલવધ વિજયમાં વિચરી રહ્યા છે. વિદેશ એટલે વિશિષ્ટ ચોગ એ અર્થમાં હુર રહેલ સિમંધરસ્વામી પરમાત્માની નિકટતા સમરણ અને ધ્યાન દ્વારા અનુભવી શકાય છે.

હવે દદ સંકલ્પ કરી આપણે મહાવિદેહની ધ્યાન ચાત્રામાં પ્રવેશાયો.

જે વસ્તુ આપણે મળવવા ઈચ્છાએ છીએ અગર આપણે જેવા બનવા ઈચ્છાએ છીએ, તેનું સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ સાક્ષાત ઇપમાં ઉપસ્થિત કરવું અને જેમ જેમ તે સંકલ્પ દદ અને ચિત્ર સ્પષ્ટ હોય છે તેમ તેમ તે વસ્તુ મળવાનાં અને તેવા બનવાના કારણો ઉપસ્થિત થાય છે; અને કારણું ઉપસ્થિત થતાં કાર્યસિદ્ધ અવશ્ય થાય છે.

પ્રિય અધ્યાત્મગ્રેમી વાચક ! આપણે એકાંતમાં બેસી વિચારીએ કે આપણે શું સાધવું છે ? એકાચ થર્ડ આપણે વિચારીએ કે આપણે જેવા બનવું છે અને શું પ્રાપ્ત કરવું છે ? જેવા બનવાનો આપણા સંકલ્પ છે, તેવું યથાર્થ ચિત્ર રચીએ. આપણી વૃત્તિએને તે ચિત્ર જેવામાં લીન અનાવીએ. આપણી કલ્પનાશક્તિ વડે રચાતું ચિત્ર ભવિષ્યમાં થનાર આપણી સ્થિતિનો નમૂનો છે. તે નમૂના પ્રમાણે આપણી સ્થિતિ રચાય છે. કલ્પનાશક્તિ વડે આપણે જે કાર્ય સિદ્ધ કરવું છે, તેનું ઉત્તમ પ્રકારનું માનસિક ચિત્ર આપણે રચવાનું છે, અને તે ચિત્ર યથાર્થ રચાયું

એટલે બાકીનું કાર્ય એની મેળે થયે જ જવાનું. તેથી માનસિક રચેતા ચિત્રને સ્થૂલ રૂપમાં કેવી રીતે પ્રત્યક્ષ કરવું તે વિષે ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ર સ્પષ્ટ રચાતાં અને ભાવ જિનેશ્વરનું સાંનિધ્ય નિત્ય સાધનામાં અનુભવમાં આવતાં, સ્થૂલરૂપમાં આપણે કેવી રીતે ભાવ જિનેશ્વર ભગવંત પાસે પહોંચીશું તે કાર્ય ધર્મ મહાસત્તાને સોંપી હો. સાધનામાં રચેતા ચિત્રનું સ્થૂલરૂપ પ્રગટ કરવાનું કાર્ય ધર્મસત્તા પોતે જ કરશે. તે માટે જે સાધનો, પુષ્ય પ્રકૃતિ, સાધના વગેરેની જરૂર હશે તે બધું જ એચાઈને આપણી પાસે આવવાનું જ છે. વિચાર જોઈલો સ્પષ્ટ અને શુદ્ધ હશે અને જોઈલો વધુ અંદર ઘૂંટાશે, તેમ સ્થૂલ સ્વરૂપ પ્રગટ કર્યા સિવાય રહેતો નથી. આવા સેંકડો દાખાતો શાખમાં નોંધાયેતાં છે અને પ્રત્યક્ષ વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ. (આ પુસ્તકમાં Ideal Reality-મનોમય ભૂમિકા ઉપરનું સત્ય તે લેખ કરીથી વાચી લેવો.) તે મુજબ આપણે મહાવિદેહની ક્ષાન્યાત્રા (ભાવયાત્રા) કરીએ છીએ, અને તે દ્વારા આપણી ચેતનાને બદલીએ છીએ. જગતના પદાર્થો મેળવવાના લોગવવાના કે ડોડપતિ ખનવાના, ઉદ્યોગપતિ ણનવાના, સંકલ્પો કરી આપણે ધર્થું સંસાર પરિભ્રમણું કર્યું છે. હવે સાક્ષાત્ ભાવ જિનેશ્વરના દર્શન કરવાનો, તેમની દેશના સંભળવાનો, તેમની પાસે ચારિત્ર લેવાનો, આપણામાં દ્રોયરૂપે રહેતા અહ્રતું પર્યાયને પ્રગટ કરવાનો સંકલ્પ આપણે કરીએ છીએ. વર્તમાન જીવનના નામ અને રૂપથી

લિજ આપણે ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ તેવી ભાવના, પ્રતીતિ, અનુભવ પરમાત્મા સિમંધરસ્વામીના પ્રકાવથી કરીએ છીએ અને આપણું મૂળ ચૈતન્ય સ્વરૂપ પ્રગટ કરવાનો સંકદ્ય (મનોરથ) કરીએ છીએ. કહ્યું છે કે :—

અથવા ભાવિનો ભૂતા, સ્વપર્યાયાસ્તદાત્મકાઃ ।

આસતે દ્રવ્યરૂપેણ, સર્વ દ્રવ્યેષુ સર્વદા ॥ ૧૯૨ ॥

તતોऽયમહર્ત્પર્યાયો, ભાવી દ્રવ્યાત્મના સદા ।

ભદ્રેષ્વાસ્તે સતશાસ્ય, ધ્યાને કો નામ બિન્નમઃ ॥ ૧૯૩ ॥

તત્વાનુશાસન.

સર્વ દ્રવ્યોમાં દ્રવ્યાત્મક એવા ભૂત અને ભાવિના સર્વ પર્યાયો દ્રવ્યરૂપે સહા રહે છે. ( અર્થાત् પ્રત્યેક દ્રવ્યમાં તેના ભૂત અને ભાવિ સર્વ પર્યાયો વર્તમાનમાં દ્રવ્યરૂપે રહેલા છે. ) તેથી સર્વ લંઘોમાં ભાવિમાં થનાર એવા આ ‘અહૃત્પર્યાય’ દ્રવ્યરૂપે સહા રહેલ છે. તો પછી સહા વિદ્યમાન એવા પર્યાયનું ધ્યાન કરવામાં આંતિ શી ? અર્થાત્ આપણા ભાવિ ‘અહૃત્પર્યાય’નું આપણે ધ્યાન કરીએ છીએ તે યોગ્ય જ છે. હવે આપણે સીમંધરસ્વામીના ધ્યાનમાં પ્રવેશ કરીએ.

( પ્રયોગ નં. ૧માં ધ્યાન શરૂ કરતાં પહેલાંની પ્રાર્થના છે. તે ત્રણુ પ્રાર્થના કરવી. )

(૧) ‘દ્યાસિનંધુ, દ્યાસિનંધુ, દ્યા કરજે, દ્યા કરજે.’  
આ ત્રણુ કડીની પ્રાર્થના કરવી.

(૨) દર્શન ક્ષારા મન શાન્તિનો પ્રયોગ કરવો.

( પ્રયોગ નં. ઓક મુજબ. )

- (૩) સ્થિર આસને એસવું. વાણી અને મનને શાંત કરવાં.
- (૪) પ્રાણુ શુદ્ધિનો પ્રયોગ કરવો. (પ્રયોગ નં. ૧ના પહેલાં લખેલ છે તે.)
- (૫) હૃદય શુદ્ધિનો પ્રયોગ કરવો. (પ્રયોગ નં. ૧માં લખેલ છે તે મુજબ.)
- (૬) આંખ બંધ કરી ધ્યાનમાં એસવું.
- (૭) મહાવિદેહમાં સાક્ષાત् સીમંધરસ્વામીના દર્શન કરવાની તીવ્ર લાવના કરવી.
- (૮) ધન્યાનેત્ર મહાવિદેહજી, ધન્ય પુંડરીગિણિ સાર; ધન્ય તીર્ણાંના માનવીજી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ. સીમંધર રવામી કહીએ રે, હું મહાવિદેહ આવીશ; જ્યવંતા જિનવર કહીએ રે, હું તમને વાંદીશ.

ધ્યાનમાં ગવેશ : પ્રયોગ નં. ૩૪ :—

(આંખ બંધ રાખવી.)

ઉપર પ્રમાણે લાવના આપણે લાવીએ છીએ. લાવના તીવ્ર થતાં આપણા કોઈ મિત્રદેવ આવ્યા છે. મીઠું દેવ-વિમાન લાવ્યા છે. આપણુને તેમા એસાડી હે છે. મહાવિદેહની યાત્રા કરવા લઈ જય છે. આપણે તે વિમાનમાં એસી ગચ્છા છીએ. આપણું વિમાન આકાશમાં જોંબે ચઢી રહ્યું છે.....

આ ધ્યાન ને સાધુ-સાધ્વીજ મહારાજ કરતાં હોય  
ધ્યા. પ્ર. ૨૨

તો વિવાધર મુનિરાજ પધારી, આકાશગામિની વિદ્યા આપે  
તેવો સંકલ્પ કરવો. અને તે આકાશગામિની વિદ્યાના  
પ્રભાવે આકાશમાર્ગે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ રહ્યા છીએ  
તેવી લાવના કરવી.

વિમાન આકાશમાં ઈશાન દિશામાં આગળ વધી  
રહ્યું છે.....

હિમાલયના પહાડ તરફ જઈ રહ્યું છે.....

હિમાલયના હિમાચાલિત ગિરિશૂંગો ઉપરથી આપણે  
પસાર થઈ રહ્યા છીએ.....

હિમાલય પર્વત ઓળંગી આપણે રશિયાના પ્રદેશ  
ઉપરથી પસાર થઈ રહ્યા છીએ.....(આવું દશ્ય જેવું.)

ઉત્તર દ્રુવ ઓળંગી આપણે અધ્યાપદ પર્વત તરફ  
વધી રહ્યા છીએ.....

અધ્યાપદ પર્વત ઉપરના દિવ્ય મંહિરમાં ૨૪ તિર્થીંકર  
સગવાનના મનોહર બિમખનું આપણે હર્ષન કરીએ છીએ.  
.....

વૈતાણ્ય પર્વત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ.

હિમવંત પર્વત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા  
છીએ.....

હિમવંત ક્ષેત્ર ઉપરથી આપણે જઈ રહ્યા છીએ.....

મહા હિમવંત પર્વત ઓળંગી આપણે હરીવંશ ક્ષેત્ર  
ઉપરથી પસાર થઈ રહ્યા છીએ.....

નિખિદ્ધ પર્વત ઓળંગીને આપણે મહાવિદેહના કંચિ  
જામના વિજય ઉપરથી પસાર થઈ રહ્યા છીએ.....

સીતા નહી ઓળંગી આપણે મહાવિદેહના પુષ્યલવધ  
વિજય ઉપર આવી પહોંચ્યા છીએ.....

પુંડરીગિણી નગરી તરફ આપણે આગળ વધી રહ્યા  
છીએ.....

આપણું વિમાન ધીમે ધીમે નીચે આવી રહ્યું છે....

મહાવિદેહની પરમ પવિત્ર પુષ્યભૂમિ ઉપર આપણે  
ઉત્તરાણું કર્યું છે.....

અનાણયો પ્રદેશ છે, લગવાન કંઈ બાળુ વિહાર  
કરતા હોશે ? કોઈ દિશા તરફથી અવાજ આવતો હોય તે  
સાંભળવા લક્ષ્ય એંચયું.....

ત્યાં તો હુર હુર દેવહું હુલિનો અવાજ સાંભળવા  
લાગ્યો.....

આનંદથી હૈયું ભરાઈ ગયું.....

જે દિશામાંથી દેવહું હુલિનો અવાજ આવતો હોટો  
તે દિશામાં આપણે પ્રથાણું શરૂ કર્યું.....

હુર હુરથી લગવાન આવી રહ્યા છે.....

.....( આવું દશ્ય જેવું )

વૃદ્ધો! નમે છે.....(આવું દર્શય જોવું.)

પણ્ખીએ પ્રદક્ષિણા કરે છે.....(આવું દર્શય જોવું.)

છએ ઋતુ સમકાળે ઇણેલી દેખાય છે.....

.....(આવું દર્શય જોવું.)

સુગંધિત પવન આવી રહ્યો છે.....

કંઠા જાંખા થઈ ગયા છે.....(આવું દર્શય જોવું.)

પ્રકૃતિની મહાસત્તાના સરોપરી મહાસત્તાધીશ અરિ-  
હંત પરમાત્માને આવકારવા માટે સમચ્ચ કુદરત કામે લાગી  
હોય તેવું દેખાય છે. (આ અને હવે પણીનું દર્શય જોવું,  
આનંદવિલોર બની અનુભવવું.).....

સર્વત્ર ધર્તિ, ભીતિ, ચોરી, રોગ, શોક, લય, સંતાપ,  
હુલેશા, ફુઃખ, દારિદ્ર, ફર્ભાગ્ય, ફર્લિક્ષ (ફર્કાળ) આદિ  
દ્વાર થઈ ગયાં છે. છએ ઋતુના ઇણકૂલથી વતરાળ ઉસરાંચ  
ગઈ છે. પાંચે વિષયો અનુકૂળ થઈ ગયા છે.....  
.....(આવું દર્શય જોવું.)

જૈનેન્દ્રં ધર્મचક્રं પ્રભવતું સતતં, સર્વ સૌખ્ય પ્રદાયી.

સકલ સુરેન્દ્ર, નરેન્દ્ર, દેવેન્દ્ર અને સભ્રાટ યકૃવર્તીના  
પણું સરોપરી તિર્થંકર પરમાત્મા છે તેવું દર્શાવતું, દરો  
દિશામાં પ્રકાશને પાથરતું ધર્મચક્ર પ્રલુની આગળ ચાલી  
રહ્યું છે. એક હન્દર ચોજન જાંચો ધવજ સગવાનની આગળ  
ચાલી રહ્યો છે.....(આવું દર્શય જોવું.)

સકલ પ્રાણી-સંસારના પ્રાણુષ્યર, વિશ્વના મહાન વિલુ,

જગતના મહાન જ્યોતિર્ધર, ત્રણુ ભુવનના ત્રિલુલનેશ્વર, અભિલ પ્રહાંડના સર્વ લૌમચકાધીશ્વર, સર્વેશ્વર, જીવેશ્વર, લોકેશ્વર, જગતના મહાન સાર્થવાહ પરમાત્મા-સુષુંગના મખમલ જેવા સુલાયમ કમળ ઉપર અધિષ્ઠિત થઈને આવી રહ્યા છે.....( આવું દશ્ય જેવું.)

આપણે ચોતે પણ હેવહું ડલિનો ગાંભીર નાદ—“હે લભ્ય આત્માચો ! તમે જે સંસારના ત્રિવિધ તાપથી પીડા-ચેલા છો, અને જે લવસમુદ્રથી પાર ઉત્તરવા ધ્યાનતા હો તો જગતના મહાન સાર્થવાહ, કોટાનુકોટી જીવોના પરમ ઉદ્ઘારક તીર્થંકર પરમાત્માનું શરણું અંગીકાર કરે।” સાંલળી કરૃણાસાગર પ્રભુની પાસે પહોંચી ગયા. ( આવું દશ્ય જેવું.)

પ્રાતિહાયોથી યુક્ત પરમાત્માના દર્શન થતાં આનંદ-વિલોચ બની ગયા....રોમરાણ વિકસવર થઈ ગઈ. ( આવું સંવેદન કરવું.).....

પાઢ્યો આનંદ પૂર કે હુઃખ હુરે ગયાં,  
                દીઠે તુમ દેદાર કે વાંચિત સવિ ઇજ્યાં;  
પાઢ્યો નવનિધિ રિદ્ધિ કે સિદ્ધિ સવિ મિલી,  
                દીઠે તુમ દેદાર કે આશા સવિ ઇળી.

મહાપ્રભુના પ્રભાવથી અહિસાનું આંહોલન ઉત્પન્ન થયું છે. જતમજાત વૈરને ધારણુ કરતારા પ્રાણીઓ નૈસર્જિક વૈરલાવથી મુક્ત બની પરસ્પર વાતસદ્ય લાવમાં વર્તવા લાગ્યાં. મૈત્રી લાવનો મધુર રસ સમય પૂર્વી મંદળમાં

અયાપ્ત થઈ ગયો.....( આવું દર્શય જોવું.)

આ સમયે કેવું દર્શય ખડું થયું છે ?

છત્ર ચાલે આકાશમાં અરિહંતાળ,

દૈવહુંહલિ વરયુત ભગવંતાળ.

ચામર ચડું સિહાસન અરિહંતાળ,

પાદધીઠ સંચુક્ત ભગવંતાળ.

સહસ્ર ચોજન ધવજ શોલતો અરિહંતાળ,

પ્રભુ આગળ ચાલંત ભગવંતાળ.

કનક કમલ નવ ઉપરે અરિહંતાળ,

વિચરે પાય ઠવંત ભગવંતાળ.

કાંદા પણ હોય જોંધા અરિહંતાળ,

પંચ વિષય અનુકૂળ ભગવંતાળ.

બડુઝતુ સમકાળે ક્રોણે અરિહંતાળ,

વાયુ નહીં પ્રતિકૂળ ભગવંતાળ.

પંખી હીએ સુપ્રદક્ષિણા અરિહંતાળ,

વૃક્ષ નમે અસરાલ ભગવંતાળ.

જિન ઉત્તમ પદ પદ્મની અરિહંતાળ,

સેવા કરે સુર કોડી ભગવંતાળ....

વૃક્ષ, લતાઓ વિવિધ વર્ણના પુણોથી વિભૂષિત  
અની, સુમધુર રસવાળાં ક્રોણો વડે મનોરંજક બની ગઈ....  
.....( આવું દર્શય જોવું.)

પવિત્ર પ્રાકૃતિક સૌંદર્યના વાતાવરણમાં દેવેન્દ્રો, તરેન્દ્રો, ચમરેન્દ્રો, કલેન્દ્રો, અવનેન્દ્રો, રાજાંગધિ, દેવ-કંદ્ધિથી પરિવરેલા મહાપ્રભુના પાદારવિંદના દર્શનાથે આવી રહ્યા છે.....( આવું દર્શય જોવું.)

આપણે સધળાં મહાપ્રભુની સાથે જ્યાં દેવોએ સમવસરણુની રૂચના કરી છે, તે તરફ જઈ રહ્યાં છીએ.....  
.....( આવું દર્શય જોવું.)

દેવોએ એક યોજન ભૂમિ પરિશુદ્ધ કરી, સુગંધિત વાયુનો સંચાર કરી શુદ્ધ બનાવી. તે ઉપર વજામય પીઠિકા (Plinth) ૧૦૦૦ પગથિયાં જાંચી બનાવી, તેના ઉપર પ્રથમ ચાંદીનો ગઢ અને સેનાના કાંગરા બનાવ્યા છે. તે ઉપર દર્શા હજાર પગથિયાં જાંચે થીને સેનાનો ગઢ અને રતનના કાંગરા બનાવ્યા છે. તે ઉપર ૫૦૦૦ પગથિયાં જાંચે ત્રીજે રતનનો ગઢ અને મણીના કાંગરા બનાવ્યા છે.....  
.....( આવું દર્શય જોવું.)

આપણે સૌથી ઉપરના ગઢમાં.....  
....હૈવી શક્તિ દ્વારા ક્ષણુમાં ઉપર પહોંચી ગયા.....

સૌથી ઉપરના ગઢની મધ્યમાં પ્રભુની જાંચાંધી ૧૨ ગણું જાંચ્યું, એક યોજન વિસ્તારવાળું, મનોહર, રમણીય અશોકવૃક્ષ છે. ને સમવસરણ ભૂમિને શીતળ છાપા આપી રહ્યું છે.....

અશોકવૃક્ષની નીચે વિવિધ રતનો, હીરા, માણોક,

નીલમ આહિથી વિભૂષિત પાદપીડ સિંહાસન છે.....  
.....(આવું દર્શય આપણે જોઈ રહ્યા છીએ.)

ત્યાં સકળ વિશ્વના ઉદ્ધારક, દેવેન્દ્રોને દર્શાનીય, સુરે-  
ન્દ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, યોગીન્દ્રોને આદરણીય,  
વિશ્વને વંદનીય, પ્રાણીમાત્રાને પૂજનીય ત્રિભુવનેશ્વર, દેવા-  
ધિદેવ, કર્ણાંસાગર પરમાત્મા જગતના ઉદ્ધારને અશે  
સમવસરણુ ભૂમિમાં પદ્ધાર્યા.....(આવું દર્શય જોવું.)

મહાપ્રભુનો સમવસરણમાં પ્રવેશ થતાં સમય પ્રાણી  
સંસાર આનંદ પ્રમેદ-ધ્વનિથી પ્રભુને વધાવે છે.....  
.....(આવું દર્શય જોવું.)

પ્રણમામિ પરમેશ્વરં, વન્દે વિશ્વનાયકઃ;  
જય જય જગાદીશ્વરં, જય જય જગૈતિર્ધરઃ.

સુસ્વાગતમ्, શુલાગમનમ्-આવા ભધુર ધ્વનિથી સૌ  
દોઈ પરમાત્માને વંદન, નમન, પ્રણામ કરી કૃતાર્થ બને  
છે. આપણે પણ અધારની સાથે જ છીએ.....  
.....(આ બધું દર્શય જોઈએ છીએ.)

અને તે વખતે મહાપ્રભુએ વિશ્વના સર્વલૌમચક-  
ધિશ્વરના સિંહાસન પાસે પહોંચ્યો. “નમો તિથથસ્સ” કહી,  
ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી, કર્ણાંસાનિધ્યાન પરમાત્માએ  
વિશ્વેશ્વરના સિંહાસન ઉપર આડદ થઈ, સકળ  
જગતને સનાથ બનાવ્યું. અશરણુ એવા આપણને

પરમાત્માએ શરણ આપણું. આવે સમયે આપણી  
ત્યાં ઉપસ્થિતિ આપણા જીવનની સુવણ્ણું મય ધન્ય પળ બની  
ગઈ. લગવાનતું દર્શન કરી આપણે રોમાંચ અને આતંક  
અનુભવીએ છીએ.....(આવે અનુભવ કરવો.)

---

તે કૃપાના અવતાર, હથાના સમુર્દ, વાત્સલ્યના લંડાર  
લગવંતના મસ્તકની પાછળ સૂર્ય સમાન તેજસ્વી લામંડળ  
શોભી રહ્યું છે. અનેકવિધ મહિં માણેક રત્નોથી વિભૂષિત  
ત્રણ છિંદો લગવંતના મસ્તક ઉપર શોભી રહ્યાં છે.  
આકાશમાં દેવહુદુંલિઓનો ગંભીર નાઢ ગાજ રહ્યો  
છે. ૧૨૧ કોડ દેવહુંદુલિઓ તાઉન કર્યો વગર વાગી રહી  
છે. જાનુ પ્રમાણુ પુષ્પવૃણિ થઈ રહી છે. દેવોની જોડીઓ  
ચામરો વિંઝી રહી છે.

ચોસઠ ઈન્દ્રો ચોતાની સર્વશક્તિથી ને પરમાત્માના  
ડાખા ચરણનો એક અંગૂઠો પણ બનાવી શકતા નથી. પરંતુ  
પરમાત્માના જેવા જ અદ્ભુત ખીજા ત્રણ રૂપો ત્રણ દિશામાં  
એક જ વ્યાંતર દેવે વિરચિત કર્યો. તે લગવાનની હાજરીનો  
અતિશય છે. પ્રત્યેક પ્રાતિહાર્યમાં આપણુંને પર-  
માનું દર્શન થાય છે.....(આવું દર્શય જેવું.)

પ્રાતિહાર્યોથી યુક્તા, ૩૪ અતિશયોથી અલંકૃત પર-  
માત્મા કેવા શોલે છે!

જિનજ ! તારા વૃક્ષ અશોકથી શોક ફૂરે ગયો રે લોલ....

જિનજ ! લામંડલ શિર પૂઠે કે સૂર્ય પરે તપે રે લોલ....

જિનજી ! ત્રણ છત બિરાજે કે ત્રિભુવનપતિ પણો રે લોલ....  
 જિનજી ! દેવહું હુલિનો નાદ ગંભીર ગાંજે ધણો રે લોલ....  
 જિનજી ! જનુ પ્રમાણ ગીવાણ કુસુમવૃષ્ટિ કરે રે લોલ....  
 જિનજી ! ચામર કેરી હાર ચલાંતી એમ જણો રે લોલ....  
 જિનજી ! જે નમે અમ પરે તે લખી ઉર્ધ્વગતિ લહેરે લોલ....  
 જિનજી ! પાહ્યીઠ સિહાંસન ઘ્યાંતર વિરચીએ રે લોલ....  
 જિનજી ! તિહાં એસી જિનરાજ સવિક દેશના હીથે રે લોલ....  
 જિનજી ! દિવ્ય ધ્વનિ સૂર પૂરૈ કે વાંસલીએ સૂરૈ રે લોલ....  
 (આ રીતે અતિહાર્યચુક્ત પરમાત્માના દર્શન કરવા.).....

બાર પર્વદાની રચના થઈ. સૌ પોતપોતાના યોગ્ય  
 સ્થળો દેશના સાંભળવા ઉપસ્થિત થયા. આપણે પણ યથા-  
 યોગ્ય સ્થાન ઉપર દેશના સાંભળવા એડા છીએ. તે સમયે  
 પ્રભુને નિહાળતાં આપણું હૃદ્ય પોકારે છે —

“આજ અમારું પુણ્ય પરાકાઢાએ પહોંચ્યું છે,  
 ત્યારે જ આપનું દર્શન અમે પામ્યા છીએ. આપની વાણીનું  
 શ્રવણ અને આશાનું પાલન એ જ અમારા મહાન મહો-  
 દ્યનું કારણ છે. આપની વાણીનું શ્રવણ અમારાં સર્વ  
 પાપોને નષ્ટ કરી, આત્માના પરમાનંદની પ્રાપ્તિનું પરમ  
 કારણ છે.”

પ્રભુના મધુર શર્ષદને જીલવા માટે હૃદ્ય અતિ  
 તત્પર બન્યું છે.....(આવું સંવેહન કરવું.)

તે સમયે અત્યંત કરણુંવંત પરમાત્માએ પ્રવચન મુક્રા કરી, અને સકળ પ્રાણી સંસાર શાન્ત થની ગયો. અને તે વાણીના શુણેથી ચુક્ત યોજન ગામિની, સર્વ આનંદપ્રદાયિની, સર્વ પાપ પ્રણાશિની, મોહ તિમર વિનાશિની, કલ્યાણ પરંપરાવર્ધિની, કર્મકષ્ટદાહિની, લવ-સંતાપ હારણી, મોહ-વિષ નિવારણી, સકલ જીવ સંજીવની, જીવનજીવોતિ પ્રકાશિની, પરમાત્મલાવ પ્રકાશિની, અનંત કલ્યાણ કારણી સુમધુર વાણીથી માલકોશ રાગમાં પરમાત્માની દેશના શરૂ થઈ. તેને દેવોએ વાંસળીના સુમધુર સૂરથી - 'હિંય ધ્વનિ'થી વિલૂષ્ટિ કરી.

પ્રભુની દેશના સંભળવામાં આપણું દરે ગ્રાણ, સાડા ગ્રાણ કોડ રોમરાળ, આત્માના અસંખ્ય પ્રહેણો લીન થઈ ગયાં. આપણી સાતે ધાતુ લોહાઈ ગઈ. પરમાત્માની દેશનાનો શખ્ફે શખ્ફ આપણું આત્મામાં પરિણામ પામવા લાગ્યો. આપણું રોમેરોમ વિકસિત થઈ પ્રભુના વચનને અહૃતું કરે છે.....  
.....( આવું સંવેહન આપણુંને થઈ રહ્યું છે.)

પ્રભુની વાણીનો એવો અતિશય છે કે સંભળતાં જ આપણું પરિણામા-ભાવો પ્રભુની વાણીને અતુર્દ્ય બનવા લાગે છે.\* પ્રભુ કહે છે તેવું જ આપણુંમાં બને છે તેવી

\* વહું આગળ આરાધનાને યોગ્ય આપણું મન કે 'હિંય' ન હોય તો ત્યાં એસી જપ, સમરણ, ધ્યાન, ચૈત્યવંદન આદિ કરી, પાછું જઈ શકાય છે. પણ આવી અણુમેલ પળ ડાણ છોડે ?

\*ભાવુકતા ઉત્પન્ન થાય છે. પ્રલુભને જ કહી રહ્યા છે તેવું દરેકને લાગે છે.

### પરમાત્માની દેશના :—

“ હે ભગ્યાત્મા ! અનંતકાળ પરિભ્રમણું કર્યા પછી, આજ્ઞ થયેલ મનુષ્યસવ આદિ સામચીને સંક્રાન્ત કરવા માટે તત્પર બન.

આ દેહ તારું સ્વરૂપ નથી. તારું જે નામ છે તે તું નથી. દેહને લગતા પદાર્થો તારા નથી. સર્વ સંયોગ સંબંધે મજ્યા છે. પરમાર્થે તેમાં તારું કાંઈ નથી. કર્મ પુદ્ગલનું આ બધું સર્જન છે.

તું તો અનંત શક્તિનો સ્વામી આત્મા છે. કેવળ-જ્ઞાન આદિ અનંત ગુણુસંપત્તિનો તું નિધાન છે. અભ્યાસાધ સુખનો તું ભંડાર છે. તું આત્મા-અસંખ્ય પ્રદેશી, પરમાત્માનો મહાસાગર, સત્તાચિહ્નાનંદ સ્વરૂપ, નિર્જલાંક, નિરામય, શુદ્ધ, ચિહ્નાનંદધન સ્વરૂપ છે. ( અત્યંત ભાવ-વિલોચ બની પ્રલુની વાણી આપણે સાંસારણી રહ્યા છીએ. .... )

પુદ્ગલનું લક્ષણું સરળું પડણું વિધવંસન છે. તું અવિનાશી ચૈતન્ય લક્ષણું આત્મા છે. શાખદ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ પુદ્ગલના ગુણો છે. તારા ગુણો શાન, દર્શન, ચારિત્ર, વીર્ય \*મિથ્યાત્વ મોહનીયને કાઢયા સિવાય કોણું પાછું જય ? પ્રલુભ મિથ્યા-વનો ધ્વંસ કરવા માટેની, સમ્યગુર્દર્શનની પ્રાપ્તિ માટેની દેશના રારું કરે છે.

અને ઉપયોગ છે. પુછગલ રૂપી છે, તું અરૂપી છે. કર્મકૃત લાવોથી તું બિનન છે.

ખૂટ દ્રવ્યના સ્વરૂપને ઓળખીને લક્ષણબેદથી પર-પુછગલ દ્રવ્યથી તું બિનન છે તે સમજ.

નવ તરવની સફ્ફાલાંથી કરી જીવ અને અજીવનો બેદ સમજીને, અજીવ પરપુછગલ દ્રવ્ય છે, તું જીવ ચૈતનદ્રવ્ય છે તેવો વિવેક કર. તરવ સમજીને પુછગલથી બિનન તારા ચૈતન્ય સ્વરૂપને ઓળખ અને તેની શ્રદ્ધા કર. પર દ્રવ્ય અને પરલાવને છોડી તું તારા સ્વરૂપમાં ઇચ્છિ કર. અનંત આનંદ અને સુખના પરમ લંડાર તારા આત્મસ્વરૂપને પ્રગટ કરવાનો સંકલ્પ કર.

જેવું સિદ્ધ ભગવંતનું પ્રગટ સ્વરૂપ છે, તેવું જ શુદ્ધ આત્મચૈતન્ય તારામાં રહેલું છે. તેમાં ઇચ્છિ કરીને તે સ્વરૂપનો અનુભવ કરવા ઉધ્યમવંત બન.

માટે તત્ત્વાભૃતનું પાન કરી, પર પુછગલ સંગ છોડી, તારા સ્વરૂપમાં સ્થિર બનવા માટે, જેનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું છે તેવા પરમાત્મામાં, તારી ચૈતનાને જોડીને સ્વસ્વરૂપનો અનુભવ કર.

પર વસ્તુનું રાગીપણું, કર્તૌપણું, ભોક્તાપણું તારં કાર્ય નથી. માટે તે છોડીને તારા સ્વરૂપમાં ઇચ્છિ કર.

---

( હેડ મન વચન પુછગલ થકી, કર્મથી બિજી તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. )

તારા નિર્મણાનંદને અનુભવ કરવા તત્પર બન. સમ્યગુદર્શન રૂપ અમૃતનો અનુભવ કરવા ઉત્સાહિત બન.”

( લગ્નવાનની દેશનાથી આપણું ઉપર નીચે મુજબ અસર થાય છે.)

સાક્ષાત્ જણે અમૃતરસનું પાન કરતા હોઈએ તે રીતે જિનવાણી રૂપ અમૃતનું પાન થતાં આપણુંમાં બપૂર્વ જીવોદ્ધાસ પ્રગટ થયો છે.....  
શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની તીવ્ર જંખના ઉત્પન્ન થઈ. પરમાત્માના આવા હિવ્ય વચ્ચનો સાંસળતાં, પ્રલું કહે છે તેવું જ આપણુંમાં બને છે. દ્રોધ કર્મ (જ્ઞાનાવરણી આદિ) ભાવ કર્મ (રાગ, દ્રોધ, મોહ, અજ્ઞાન) અને નો કર્મ (શરીર આદિ)થી લિન્ન હું આત્મા છું તેવો ભાવ ઉલ્લસ્યે.....

ચરમયથાપ્રવૃત્તિકરણની સ્થિતિએ અત્યારે આપણે છીએ. હું આત્મા જ છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. પરમાનંદનો કંદ છું. સત્તાએ શુદ્ધ નિર્મણ છું.....( સંકદપૂર્વકનું સંવેદન કરવું.)

કર્મ સંયોગે આત્મા અશુદ્ધ હેખાય છે, પણ જિનવાણી રૂપ અમૃતનું પાન થતાં તેની શુદ્ધતા

(તહવી સત્તા ગુણે જીવ એ નિર્મણો,

અન્ય સંશોદ જેમ સ્ક્રિટિક નવી શામળો;  
જે પરોપધિથી હુણ્ટ પરિણતી અહી,

ભાવ તાદાત્મયમાં માહરં તે નહીં.)

નિર્મણતા જાણી, તેની ઝંકા થઈ. અને પર ઉપાધિથી ફુષ્ટ પરિણુતી કર્મકર્તાપણું અહીને, તાદાતમલાબમાં તાદાતમ્ય સંબંધ કરી હેતે સર્વ ઉપાધિક ભાવ મારો નથી. સંચોગ સંબંધ મળ્યો છે, સમવાય સંબંધ નથી. તફુલ્યત્પત્તિ સંબંધ છે, પરંતુ તાદાતમ્ય સંબંધ નથી. દ્રવ્યાર્થિક સંશોધ નયની અપેક્ષાએ મારો જીવ નિર્મણ છે. આ ભાવનાએ ચઢતાં હું આત્મા જ છું, પૂર્ણ છું, કેવળજ્ઞાન સ્વરૂપ છું, અનંત ગુણમય છું-તેવો અપૂર્વ ભાવાત્મક ઉછાળો, વીર્યાદ્વાસ થવાથી અપૂર્વિકરણ\* રૂપ મહાસમાધિ થઈ. ( અહીં દ્વાનમાં સ્થિર ખંની અનુભવ કરવો.)

ਹੁਂ ਸ਼ੁਦਾ ਆਤਮਸਵਰੰਧ ਜ ਛੁਂ-ਤੇਥੁਂ ਫਲੀਕਰਣਾਨੁਂ ਭਾਵਨ ਚਾਲੁ ਰਹਿੁਂ। ਅਨਿਖੁਤਿ ਕਰਣੂ ਥਥੁਂ। ਤੇ ਭਾਵਨੀ ਧਾਰਾ ਚਠਤੀ ਗਈ।

\* અહીં અપૂર્વ એટલે કદી નહીં અનુભવેલો અને કરણ એટલે અધ્યવસાય ઉત્પન્ત થયા છે. અપૂર્વ કરણ રૂપ મહાસમાધિ લાવમાં થોડી ક્ષણ સ્થિર બની અનુભવ કરવો.

(થોડી ક્ષણું અહીં ધ્યાનમાં સ્થિર બનવું.....)

અને પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ માણું નથી-તે લાવમાં ભિથ્યાત્વનું એક પણ દલિક ઉક્ખયમાં નથી, એટલે આત્મા સિવાયના અન્ય પદાર્થમાં અહીં, મમત્વરૂપ એક પણ વિકલ્પ નથી ( અંતરકરણની સ્થિતિ છે.) માત્ર શુદ્ધ ચૈતન્યરૂપ અપૂર્વ કિરણ (કરણ=અધ્યયસાય) લાવમાં સ્થિરતા છે. અંતમુંહૂર્ત આ લાવમાં ધ્યાનમાં સ્થિર બનવું....

---

અપૂર્વ ઉદ્વાસ અને આનંદ અનુભવવો.....(ધ્યાન કરવું.)

ભિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થતાં આત્મ અનુભવ રૂપ સમ્યગ્રૂદર્શન સમ્યગ્રૂદાન ઉત્પન્ન થયું. (આત્મજ્ઞાનકો અનુભવ દર્શન, સરસ સુધારસ પીળુએ-પ્રલુનિર્મણ દર્શન કીળુએ.)

આવા લાવે ચઢતાં નિર્મણ આનંદનો અનુભવ થયો. દેહથી લિન્ન હું આત્મસ્વરૂપ છું તેવી પ્રતીતિ થઈ.....

પરમાત્માની અમૃતવાણી કરીથી શરૂ થઈ.

“જેવું તાર્દ આત્મચૈતન્ય છે, તેવું જ ચૈતન્ય જગતના જીવ માત્રમાં છે. સર્વ જીવો આત્મ સમાન છે.\*

\*આત્મ સર્વ સમાન નિધાન મહાસુખ કંદ,

સિતતણું સાધમી સત્તાએ ગુણવુંદ;

જેહ સ્વજલતી તેહથી ઊણ કરે વધ બંધ,

પ્રગટયો લાવ અહિસક જાણે શુદ્ધ પ્રભંધ.

સર્વ જીવો સિદ્ધ ભગવંતના સાધર્મિક, સત્તાએ અનંત શુણુના ચુંદ, મહાસુખના કંદ છે. સર્વ જીવો પ્રત્યે અહિસક ભાવ પ્રગટાવ. તેમના કલ્યાણ માટે, રક્ષણ માટે ઉત્સાહિત ખન. જેને હણે છે, તે તું પોતે જ છે તેવું સમજ, અને સમજુને બદ્દ જીવનીકાયના રક્ષણ અને હિતને માટે અહિ-સાહિક મહાત્મતો માટે ઉદ્ઘમવંત ખન.

જે રીતે દીપક ઉપર આચછાદન કરનારી વસ્તુ મૂકવાથી પ્રકાશનો અભાવ થતો નથી, આચછાદન સમયે અગર આચછાદન ન હોય તે સમયે દીપક તો તે જ સ્થિતિમાં છે; તે રીતે અનંત જ્યોતિસ્વરૂપ શુદ્ધ આત્મા-હેઠ સંબંધ કે કર્મ સંબંધરૂપી આચછાદન સમયે પણું-સત્તાએ શુદ્ધ અને નિર્મળ છે. પરંતુ ખુદ્ધિના વિપર્યોગ અને મિથ્યા અમણુના કારણે તેવો અનુભવમાં આવતો નથી. અંતરાત્માની શુદ્ધ પ્રતીતિ અને અનુભવને આવરણ કરનાર મિથ્યાત્વ મોહનીય છે. મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમથી, સમયગુદ્ધાના પ્રકાશથી જે નિર્મળ આનંદમય આત્મસ્વરૂપને થતુંકિયિત તે અનુભવ કર્યો, તે આત્માના પૂર્ણાનંદ સ્વરૂપને પ્રગટ કરવા માટે સર્વ બાધ્ય ઉપાધિક લાવો છોડીને, બાધ્ય-અધ્યાત્મર પરિશ્રણનો પરિત્યાગ કરીને, આત્મ ઉપરોગે સ્થિર થઈ, સ્વરૂપ રમણુતાના પરમાનંદને અનુભવવા તત્પર ખન.”

ઉપર મુજબ પ્રલુની, સર્વજીવ વિષયક અમૃત દેશના ચા. પ્ર. ૨૩

સાંભળી સર્વ જીવ સાથે આત્મસમાન લાવે વર્તેન તો  
એક માત્ર જિનેથીર લગવંતે કહેલા ચારિત્રધર્મમાં જ છે.  
તે વિચારોથી ( સકલ સત્ત્વ હિતાશય અમૃત લક્ષ્ણ સ્વ-  
પરિણામ એવ સાધુ ધર્મ.) સકલ જીવરાશિના હિતના  
પરિણામ દ્વારા લાવે ઉત્પન્ન થયા. મારા એક જીવ ખાતર  
રોજના અસંખ્ય જીવની હિંસા થઈ રહી છે, તે હવે હું  
સહન નહિ કરી શકું. હું તે જીવને હણુતો નથી. મને  
પોતાને જ હણું છું. જ્યાં જ્યાં વિશ્વમાં ચૈતન્ય છે તે  
મારું જ પોતાનું સામાન્ય દ્વારા એ  
ચહ્યાં સાધુપણાની પ્રાપ્તિની તીવ્ર ઝંખના થઈ.....  
.....( સંવેદન કરવું.)  
( દેશનાની આપણા ઉપર અસર થાય છે તેવું સંવેદન કરવું.)  
.....

પરમાત્માની દેશનામાં આત્માના સ્વરૂપ અને પરમા-  
નંદનું અદ્ભુત વર્ણન, આત્માના અનંત જ્ઞાન, અનંત  
દર્શન, અનંત ચારિત્ર, અભ્યાસાધ સુખ, અનંત સોગ,  
પૂર્ણાનંદ વગેરેનું વર્ણન સાંભળી તે ઉપદેશને લાવાત્મક  
રીતે અહણું કર્યો. તે શુદ્ધ આત્મસ્વરૂપની રૂચિ થઈ, પિપાસા  
થઈ, વૈરાગ્ય થયો, સંસારથી ઉદ્દાસીનપણું થયું. આ સંસારી  
વિલાસ ઉપાધિ મારે અધટતી છે. પર વસ્તુનું અહણું કરવું,  
રક્ષણું કરવું, કર્તૃત્વ, બોકૃતૃત્વ, બ્યાપકત્વ તે વિલાસ છે,  
મારું સ્વરૂપ નથી. પરપુરુષગલને લોગવવું મારા માટે યોગ્ય  
નથી. તે સર્વને ત્યજું. વિલાસ દર્શાને વિષ લક્ષ્ણ સમાન

જાણીને વિલાવ પ્રત્યે ઉદ્દાસીનતા થઈ. પોતાની અનંત ગુણ સંપદા, પરમાનંદ, અનંત સુખ અને કેવળજ્ઞાનની અતિ તીવ્ર અભિલાષાથી પ્રબુદ્ધને પ્રાર્થના કરેં છું. (આવી લાવનાથી તીવ્ર રીતે લાવિત બનવું.).....

હે પ્રબુદ્ધ ! હે દ્વારાના સાગર ! હે અનાથના નાથ ! હે પરમ ઉદ્ધારક ! પરમ તારક ! પરમાત્મા ! આપને કોટી કોટી વંદના કરો આપની સન્મુખ જીલો રહીને માગું છું- “હે તારક ! મને તાર ! મને તાર, તાર, તાર ! લવ અમણ્યથી ઉગાર ! હવે આ વિલાવ દરશા અમાતી નથી. મારો અનંતો સ્વાધીન આતંદ અને સુખ પરાધીન થયું છે. અને હું પુછગલ ચાહી, પુછગલ લોગી, પરનો કર્તા, પરનો લોકૃતા બન્યો છું. તેથી તત્ત્વચાહી, આત્મતત્ત્વ લોગી હોવા છતાં તત્ત્વને જાણી શકયો નથી. ઔદ્ઘિક લાવ રૂપ અશુદ્ધ પર્યાયની પરંપરાની શ્રેષ્ઠીમાં પડી રહ્યો છું. તો હે નાથ ! તારા શરણે આવ્યો છું. આપના અમૃત-તુલ્ય વચ્ચનો સાંલળી, માર્ગં વિશુદ્ધ આત્મચૈતન્ય, તેના અનંતગુણ પર્યાય, પરમાનંદ અને અવ્યાભાધ સુખની પ્રાર્થિતની અભિલાષા થઈ છે. તીવ્ર અંખના થઈ છે. તે સ્વરૂપનો પ્રગટ અનુભવ કરવા તીવ્ર દુર્ઘટા થઈ છે. તો હે પ્રબુ ! સમ્યગુર્હર્ણન ચુકૃતા ચારિત્રનો પ્રાસાદ કરી આ આ જીવને સત્ય બનાવો.” ..... (તીવ્ર લાવે સંવેદન કરવું.)

પરમાત્માના સામું જેઈ રહ્યા છીએ. પ્રબુએ ચારિત્ર

માટે સંમતિ આપી. આપણે હર્ષવિલોર બની ગયા.

ચતુર્મુખ પ્રભુને ત્રણુ નમસ્કાર કરી નીચે મુજબ બાર  
નવકાર ગણુવા.

- (૧) ત્રણુ યોગ પૂર્વક ગ્રથમ નમસ્કાર.
- (૨) ત્રણુ કરણુ જોડવા પૂર્વક બીજો નમસ્કાર.
- (૩) દશ પ્રાણુ જોડવા પૂર્વક નમસ્કાર.
- (૪) સાત ધાતુ લેદાઈ જવા પૂર્વક નમસ્કાર.
- (૫) સાડા ત્રણુ કોડ રોમરાળ વિકસિત થવા પૂર્વક  
નમસ્કાર.
- (૬) આત્માના અસંખ્ય પ્રદેશોમાં દરેક પ્રદેશો પ્રદેશો  
ભાવપૂર્વક નમસ્કાર.
- (૭) ક્ષયોપશમ ભાવી દર્શન-શાન શુણુને પરમાત્મ  
સ્વરૂપમાં જોડવા પૂર્વક નમસ્કાર.
- (૮) ચારિત્ર (રમણતાનો શુણ)-પરમાત્મ સ્વરૂપમાં  
રમણુતા પૂર્વક નમસ્કાર.
- (૯) વીય શુણુ જોડવા પૂર્વક - પરમાત્મ સ્વરૂપમાં  
-ગુણોમાં વીયોદ્વાસ પૂર્વક નમસ્કાર.
- (૧૦) આમસ્વરૂપમાં દિયિ-શાન પૂર્વક.
- (૧૧) આત્મસ્વરૂપમાં રમણુતા પૂર્વક.
- (૧૨) આત્મસ્વરૂપમાં વીયેસ્કૂરણુ પૂર્વક.

( વિશેષ વિગત માટે આ પુસ્તકમાં જ નવકારની સાધનાની ત્રીજી ભૂમિકા જુઓ પ્રયોગ નં. ૧૦ પાણું ૮૨.)

ઉપર મુજબ ૧૨ નવકાર ત્રણુ પ્રદર્શિણામાં ગણુંબા.

પ્રભુએ વાસ્ક્રોપ કર્યો. આશીર્વાદ આપ્યા. અને અનુયાખ કર્યો.....

આરિત્ર પહ અર્પણ કર્યું..... આનંદવિલાર ખની આપણું હૈયું નાચી ઊઠયું..... વિશુદ્ધ ચારિત્રના ભાવો પરિણામ પાઢ્યા છે. સર્વ જીવ સાથે આત્મસમાન -ભાવપૂર્વક આત્મસમાન વર્તન છે. તિર્યંગ સામાન્યના ભાવપૂર્વક સમય વિશ્વના અનંત જીવો સાથે ભાવાત્મક તાહામ્ય છે. દશવિધયતિધર્મ, અહિંસાદિક વ્રતોનું નિરતિચાર પાલન, સમિતિ-ગુજીતમાં પ્રવર્તન આહિ સમાચારીના પાલનમાં સાધક આત્મા સ્થિર ખન્યો છે.....

નિરંતર પરમાત્માના સ્વરૂપમાં (૧) આદર, (૨) અહુમાન, (૩) રૂચિ, (૪) વીર્ય સ્કૂરણા, (૫) રમણુતા, (૬) તન્મયતા, (૭) તદૂપતા, (૮) એકત્વતાના સતત અલ્યાસ દ્વારા અપ્રમત્ત ભાવને સ્પર્શાવા સાધક પ્રયત્નશીલ છે. પરમાત્મ સ્વરૂપના અલેંડ ધ્યાન દ્વારા પ્રત્યેક અંતર્મુહૂર્તે અપ્રમત્ત ગુણ સ્થાનકને સ્પર્શ કરી સાધક આત્મ સ્વરૂપના આનંદની પ્રાપ્તિ માટે નિરંતર પ્રયત્નશીલ છે. ( આ આઠ કટેજની સાધના પ્રયોગ માટે જુઓ જિન ભક્તિની સર્વોચ્ચ ભૂમિકા. પ્રયોગ નં. ૧૮ પાણું ૧૫૪. અહીં આ પ્રમાણે પ્રયોગ કરી, ધ્યાનમાં સ્થિર ખની ટકી રહેવું. )

છડો, સાતમા ગુણુસ્થાનકના લાવોને સ્પર્શીતો, અપ્રમાત્ર  
અવસ્થાના પરમાનંદને સાધક અનુભવે છે. વૃત્તિઓને અને  
મનને અનાસક્ત લાવ કરા જગતના દેશભૂમાન પહોંચાના  
આકારે પરિણુમતી અટકાવીને પરમાત્મા અને આત્મા આકારે  
ઉપયોગને પરિણુમાવવા સહા જગૃત છે. આત્મા આકારે  
પરિણુમેલો ઉપયોગ તે જ તેનું લક્ષ્ય છે. અને  
આત્મ ઉપયોગમાં રહીને પરમાનંદ અનુભવે છે.

“ બાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવમાં રહ્મતો રે,  
દેશયા શુદ્ધ અલંકર્યો, મોહ વને નવિ રહ્મતો રે.”

જગદાકારે, પુષ્ટિગલાકારે વૃત્તિને પરિણુમાવવી તેને મોહનું વન સમજુ તેનાથી ફૂર રહે છે. અને આત્મમસ્તખાવ રમણુતામાં પ્રયત્નશીલ રહેવું તે જ ચારિત્ર છે તેવા ભાવમાં સાધક અનુત્તર વિમાનવાસી હેવ કરતાં અધિક સુખને અનુભવ કરે છે. ( સ્વરૂપ રમણુતાનો ક્યાત ઢારા અનુભવ કરવો. ).....

( અહીં પરમાત્માના ધ્યાનના અલેટ દ્વારા સ્વરૂપ  
રમણુતાનો આનંદ સ્થિર બનીને અનુભવવો.)

તે સમયે અનંત ઉપકારી પરમાત્મા અવસર જાણી  
ક્ષપક શ્રેષ્ઠીમાં પ્રવેશ કરવા માટે દેશના આપે છે :-

“ હે ચૈતન હંસ ! તું પરલાવનો કર્તા, લોક્તા,  
શાહુક નથી. તું તો સંપૂર્ણાનંદનો શુદ્ધ વિલાસી છો. અને  
તું જે પરલાવમાં રમી રહ્યો છે, તથા પરલાવનો લોળી  
થઈ રહ્યો છે તે તુજ્હને ન ઘટે. તાર્દું કાર્ય તો અનંત  
ગુણ પરિણામિક રૂપ સ્વરૂપ કર્તા-લોક્તાપણું છે. તે માટે  
હે ચૈતન ! તું યથાર્થ જિનવાણી રૂપ અમૃતનું પાન  
કરીને-અનાહિ વિલાવ વિષ વારીને-પોતાનું તરવ સંલાળ  
સ્વ અને પર દ્રોધનું વિલંબન કરીને, દ્રોધકર્મ, લાવકર્મ  
અને નો કર્મને લિન્ન સમજુ, તારા શુદ્ધ આત્મ દ્રોધને  
અહણુ કર. અને તારા સ્વરૂપમાં એકત્ર ધ્યાને પરિણામી,  
સહજાતંદને તું કર. તે જ તાર્દું કાર્ય. તેનું નિમિત્ત કારણું  
પરમાત્મા અને ઉપાદાન કારણ તારો આત્મા અનંત શક્તિ-  
વંત છે. માટે જડ અને ચૈતન્યની લેણ જ્ઞાન ધારાથી  
આત્મા અને પરનું વિલંબન કરી, માત્ર એક શુદ્ધ  
આત્મ ઉપયોગે સ્થિર બની, તારા પોતાના શુદ્ધ,  
નિર્મણ, અખંડ અવિનાશિ કેવળજ્ઞાન સ્વરૂપ પૂર્ણ  
આત્મ સ્વરૂપને ગ્રગટ કરવા શુક્લ ધ્યાનની ધારાએ  
ચઢી આત્મસ્વરૂપ એકત્રે પરિણામ પામ.”

પરમાત્માની દેશનાની આપણા ઉપર અફલુત અસર

થઈ છે. આપણી અનંત વીર્યશક્તિ ઉલ્લસિત બની છે.

રોમાંચ.....

વિસ્મય.....

ભાવોલ્લાસ.....

વીર્યનો ઉછાળો.....

આનંદનું મોજું.....

જીવનની અફલુત પળ છે.....(આવું અનુભવવું)

કહી નહીં અનુભવેલી અત્યંત નિર્મણ અધ્યવસાયની ધારા છે.....( આવું અનુભવવું.)

સંકલપશક્તિ અતિ ખળવાન બની છે..... ( આવું અનુભવવું.)

શુદ્ધલદ્યાનની પૂર્વ તૈયારી.....

(હષ્કૃત ગઠી) આજ પર્યાંત કોઈ પણ જીવની સાથે મેં જે અચોભ્ય વહેવાર કર્યો હોય તે સર્વ જીવની ક્ષમા માણું છું. આજ પર્યાંત જે પર દ્રવ્યને મેં માડું માન્યું, પર દ્રવ્ય પ્રત્યે જે મમત્વ કલ્યું, તે મમત્વને સારું માન્યું -તે મારા હૃષ્કૃતની ગઠી કરી તેમાંથી હું પાછો હકું છું.

આગામી કાળ માટે જે પરદર્શ પ્રત્યેના મમત્વ ભાવને મેં અહણું કરી રાખ્યો છે, જે પરભાવને મેં સારો માન્યો છે, લાલિ કાળ માટે પર દ્રવ્યનો સંગ કરવાની મેં જે ભાવના રાખી છે, તેનો હું ત્યાગ કરું છું.

વર्तमान કાળમાં જે કર્મ ઉદ્ઘયમાં આવે, તે ગમે તેવી વિચિત્ર સામની મારી સામે ઉપસ્થિત કરે, તે સમયે તેના કારણે હું સુખ-હુઃખ કે રાગ-ક્રેષનો અનુભવ નહીં કરે. હું મારા શાન-દર્શનમાં જ સ્થિર રહીશ.

આ રીતે ત્રણે કાળના કર્મોથી બિનન બનીને હું હવે ક્ષપક શ્રેણિ આરોહણની પૂર્વ તૈયારી કરે છું. હું શાના-વરણી આદિ દ્રોધ કર્મને લોગવતો નથી. હું મારા આત્માના શાન આદિ અનંત ગુણને લોગવું છું. એકાશ્રતાપૂર્વક મારા અનંત ગુણોનું સંવેદન કરે છું.....

અનુભવ કરે છું.....

લોગવટો કરે છું..... ( એવું ધ્યાન કરવું. )

.....  
.....  
.....  
.....

..... ( આવો અનુભવ કરવો. )

### ક્ષપક શ્રેણીની ભાવના

ક્ષપક શ્રેણિ આરોહણની ભાવનામાં પ્રવેશ :—

\*હું આત્મા ! શાનાદિ અનંત ગુણ પર્યોયર્પ છું,  
પર પુદ્ગાલથી ન્યારો છું, નિક્ષય નથે કરી શુદ્ધ છું,

---

\* આ પ્રયોગની બધી જ આત્મભાવના શ્રી દેવચંદ્રજી મહારાજના સ્તવનોના ટખાના આધારે લખેલ છે.

જ્ઞાન-દર્શાન સ્વરૂપ નિર્મણ છું, મારા સ્વરૂપમાં જ હવે હું સ્થિર બનું છું. ચેતના ગુણું તે મારી સત્તા છે. મારા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં સર્વ કર્મનો ક્ષય કરું છું: અનંત જ્ઞાનાદિ ગુણુભય, શુદ્ધ, [નિષ્કલંક, નિરામય છું: આવો લાવ કરું છું.....

આત્મસ્વરૂપમાં એકત્વ ધ્યાન....(આત્મ ધ્યાનમાં સ્થિર બનવું)  
આત્મસ્વરૂપ સ્થિરતા પામું છું.....

આતમસ્વરૂપનું તન્મયપણે ધ્યાન કરે છું....(ધ્યાન કરવું.)  
અનંત વીર્યશક્તિની સહાય વડે સ્વરૂપમાં સ્થિર બનું છું....

( ધ્યાનમાં સ્થિર બની આવો અનુભવ કરવો.)

પર્યાય ગુણમાં ભાગી જાય છે.....

ગુણુ અને પર્યાય અને દ્રોધમાં લળી જાય છે.....

ગુણ-પર્યાય અત્યારે દ્વંદ્વમાં લળી ગયા છે. તેથી

આતમદ્રવ્યમાં સ્થિરતાનો પરમ આનંદ અહીં પ્રવતે છે.

( આવી ભાવનાનો અનુભવ કરવો. )

દર્શાન અને ચારિત્ર બંને ગુણો જ્ઞાનધારામાં એકત્વ-  
પણે પરિણમયા છે.....

અલેદ રત્નત્રયીના પરિણામની ધારા છે.....

અહીં મોહના સર્વથા ક્ષયની ભાવના કરવી.....

ધાતી કર્મના ક્ષયની ભાવના કરવી.

કેવળજ્ઞાનની પ્રાપ્તિના પૂર્ણ ભાવથી ભાવિત બનવું.

અદ્ભુત ચોગ.....

અદ્ભુત ભાવ.....

અદ્ભુત પરિણામની ધારા....

અહીં થોડી ક્ષણો આત્માની કેવળજ્ઞાન અવસ્થાથી  
ભાવિત બની સ્થિર બનવું..... ( આવી ભાવના કરવી.)

અભ્યાખ્યાય સુખ અને પૂર્ણ આનંદનો અનુભવ કરવો.

ધ્યાનમાં લીન બની સ્વરૂપ સ્થિરતાનો પરમાનંદ  
અનુભવવે।.....

.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....  
.....

( અહીં કેવળી સમુદ્ધાતની લાવનાનો પરમ આનંદ  
પણ અનુભવી શકાય. અને છેલ્લે શુક્લધ્યાનના છેલ્લા એ  
પાચાનું ચિંતન કરી, સિદ્ધશિલા ઉપર અનંતસિદ્ધ લગ્નવંતો  
સાથે જ્યોતિમાં જ્યોતિ મળી હોય તેવી ક્ષણેના અનુભવની  
લાવનાનો આનંદ પણ લઈ શકાય. ).....

.....  
.....

અહીં છેલ્લે હવે લાવના કરીએ છીએ — હે કરુણા-  
સાગર પરમાત્મા ! મારો એવો સમય કચારે આવશે કે  
જ્યારે આપની આજા મુજબ હું શુક્લધ્યાન આરોહણ કરીશ !  
અને ઘનધાતી કર્મનો કથ્ય કરી કેવળ સ્વરૂપ ગ્રગટ  
કરીશ ! અને અહીં જે મેં લાવના કરી છે તે  
પ્રત્યક્ષરૂપે મારા આત્મામાં બને તેવી મારી તીવ્ર અભિ-  
કાષાઓ અંતર્યામી ગ્રલુઃ ! તમે જ પૂરી કરવાને સમર્થ છો !

## પરમાત્મા સિમંધુરસ્વામીની છેલ્લી દેશના :—

“હે ચૈતન્ય આત્મા ! તારી ઉત્તમ ભાવના જરૂર પરિપૂર્ણ થશો ! હજુ તારે થોડાં કર્મ લોગવવાનાં બાકી છે. ત્યાં સુધી આરાધનામાં લીન રહેને.

“હે જીવાત્મા ! જીવના એ સ્વરૂપ છે. એક વિભાવ સ્વરૂપ, ખીંજું સ્વભાવ સ્વરૂપ. કર્મના કારણે ઉપસ્થિત થયેલું સ્વરૂપ તે વિભાવ રૂપ છે. કર્મથી લિન્ન શુદ્ધ ચૈતન્ય તે આત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે. હવે તું અહીંથી જઈ રહ્યો છે, તો તું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમાનંદનો કંદ, અનંત શક્તિનો સ્વામી, અનર્ગલ આનંદનો દિંય લંડાર, કેવળજ્ઞાન આદિ શુણુલક્ષ્મીનો માલિક આત્મા છે. તે નિશ્ચય સ્વરૂપને હૃદયમાં લાવિત રાખને. અને શુદ્ધ વ્યવહારનું પાલન કરને. સર્વ જીવ સાથે મैત્રીપૂર્ણ વ્યવહાર કરને. જિન આજાના પાલનમાં તત્પર રહેને. તારા ગુણું સ્થાનકને યથાચોઽય ઉચિત કર્તૌંય-પાલનમાં તત્પર રહેને અને તારા યથાચોઽય ધર્માનુષ્ઠાનમાં રક્ત રહેને. જીવ માત્ર સાથે આત્મ સમાન વ્યવહાર રાખને અને સાથે સાથે તું શુદ્ધ આત્મા છે તે લાવને હૃદયમાં ધારણ કરી, જિન આજાનું પાલન કરને.”.....

આ ભાવને હૃદયમાં લાવિત કરતા આપણે હવે પરમાત્માની પ્રદક્ષિણા કરી, સમવસરણમાંથી નીચે ઉત્તરીએ છીએ.....

સમવસરણુમાંથી આપણે નીચે આવી ગયા છીએ.....

મિત્રદેવનું વિમાન મળી ગયું તેમાં હેસી ગયા છીએ....

સાધુ-સાધી મહારાજાઓ આકાશગામિનો વિદ્યા  
ક્ષારા જઈ રહ્યા છે.....

આકાશમાં ઉહુયન શરૂ થયું.....

સીતા નહી ઉપરથી પસાર થઈ રહ્યા છીએ.

પૂર્વમહાવિદેહના કંચ વિજય ઉપરથી જઈ રહ્યા  
છીએ....

નિષિદ્ધ પર્વત ઓળંગી રહ્યા છીએ.....

હરિવંશ ક્ષેત્ર ઓળંગી આપણે મહા હિમવંત  
પર્વત ઉપરથી પસાર થઈ રહ્યા છીએ.....

હિમવંત ક્ષેત્ર ઓળંગીને હિમવંત પર્વત ઉપરથી  
પસાર થઈ રહ્યા છીએ.....

વैતાણ્ય પર્વત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા  
છીએ.....

અણાપદ પર્વતની પ્રદક્ષિણા કરી, આપણે ઉત્તર ધ્રુવ  
ઓળંગી રશિયાના પ્રદેશ ઉપરથી હિમાલય પર્વત તરફ  
જઈ રહ્યા છીએ.....

હિમાલય પર્વતના હિમાચાલિત ગિરિશૃંગો ઉપરથી  
આપણે જઈ રહ્યા છીએ.....

શત્રુંજય ગિરિશાખ ઉપર ચુગાહિ આહીથર દાદાનું

દર્શન કરી, આપણા મૂળ સ્થાને આપણે આવી પહોંચા છીએ.....

( હજુ આપણી આંખો બંધ છે. થોડી વધુ વાર આંખો બંધ રાખવી. )

આકે આપણે હિંય અનુભવ કર્યો. સિમંધરસ્વામી લગવાને આત્મા અને પુછગલ બનનેનો લેદ કરી આપ્યો. અને મહાવિદેહમાં દેહથી વિમુક્ત ચૈતન્ય અવસ્થાનો અનુભવ કરાવ્યો.

“મહાવિદેહની ધ્યાન યાત્રા પૂરી થાય તે સમયની ગ્રાર્થના.”

મન થકી મિલતમે તુજ કીયો, ચરણ તુજ લેટવા સાંદ્ર રે; કિન્નુંએ જતન જિન એ વિના, અવર ન વાંછિએ કાંઈ રે.

સ્વામી સિમંધરા તું જયો ૧૦

મુજ હોને ચિત્ત શુલ ભાવથી, લવોલવ તાહરી સેવ રે; ચાચિએ કોડિ યતને કરી, એહ તુજ આગળે દેવ રે.

સ્વામી ૧૦

વળી વળી વિનવું સ્વામીને, નિત્ય પ્રત્યે તુંહી જ દેવ રે; શુદ્ધ આશયપણે મુજ હોને, લવોલવ તાહરી સેવ રે.

સ્વામી ૧૦

સ્વામી સિમંધરા વિનતિ, સાંભળો માહરી દેવ રે; તાહરી આણુ હું શિર ધરું, આદરું તાહરી સેવ રે.

સ્વામી ૧૦

(સવાસો ગાથાનું સ્તવન.૭. યશોવિજયળુ કૃત દાલ ૧૧મી )  
 લવોલવ સેવા રે તુમ પદ કમળની, હેણે હીન દ્યાળ,  
 એ કર જેડી રે ઉદ્યરતન વહે, નેક નજરથી નિહાળ.  
 વિનતી માહરી રે સુષુંજે સાહિબા....(૧)

મહાવિદેહની ધ્યાન ચાત્ર કર્યો પછી, પ્રાર્થના કરી  
 આપણે અંખ ઉઘાડીએ છીએ.....

હિંય અનુભૂતિ, હિંય લાવ, અનુભૂત પરિણામની  
 વિશુદ્ધ ધારા-ધ્યાનમાં આપણે અનુભવી.....

અંખ ઉઘાડીને બહાર જોઈએ અને જે જગત  
 દેખાય છે, તે બહારના જગત કરતાં, અંદરનું જગત  
 ધાણું મોકું છે.

“પુરુષ આપા બિહું પણ થાપા.” પુરુગલ અને  
 આત્માને પરમાત્માએ જુદા પાડી આપ્યા. અને આપણે  
 દેહથી લિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ તેવી સલાનતા,  
 પ્રતીતિ, અનુભવ થયો. હિંય આનંદ અને આત્મિક સુખનો  
 અનુભવ કરવાનો માર્ગ આપણા માટે ખુલ્લો થઈ ગયો.  
 આ દેહ અને તેનું નામ તે હું છું તેવા અહંકાર, અને હું  
 કર્મકૃત ભાવોમાં મારાપણુંની ખુદ્દી નાશ પામી. અને હું  
 શુદ્ધ આત્મસ્વરૂપ છું. અનંત આનંદ અને સુખનું પરમ-  
 નિધાન, અચિંત્ય શક્તિનો સ્વામી, કેવળજ્ઞાન આદિ અનંત  
 શુણુનો લંડાર, ચૈતન્યરૂપ, સત્તાએ શુદ્ધ આત્મા છું-તેવા  
 ભાવો ઉત્પન્ન થયા. હીપક ઉપર આચછાદન ઢાંકવામાં આવે  
 ત્યારે પ્રકાશ દેખાતો નથી. આચછાદન ફર કરીએ ત્યારે

પ્રકાશ હેખાય છે. પરંતુ આચછાદન સમયે કે આચછાદન દ્વાર કર્યું તે સમયે હીપક તો એવો જ પ્રકાશિત હતો. તેમ આત્માની “આત્સ જ્યોતિ” નિરંતર પ્રકાશિત જ છે. તેથું લાન સિમંધરસ્વામી લગ્નાનની કૃપાથી થયું. હજુ પણ પ્રભુની દેશનાના લાયો ઉદ્દ્વસ્તિ થઈ રહ્યા છે. વિભાવ દશા અને સ્વભાવ દશાનો લોક સમજમાં આવ્યો. નિશ્ચય અને વ્યવહારનો સમન્વય થયો.

‘સમાધિ વિચાર’ અંથમાં બારમા દેવલોકના દેવનું દષ્ટાંત આવે છે. બારમા દેવલોકનો દેવ કૌતુકથી જગત ઉપર શું ચાલે છે તે જોવા માટે પૃથ્વી ઉપર આવ્યો અને રંક મનુષ્યનું ડ્રપ ધારણું કર્યું. એક નગરમાં નાનકડું ઘર વસાવીને પુત્ર, પુત્રી, ઝી આહિ પરિવાર સાથે રહે છે. જંગલમાંથી લાકડાં લાવી કઠિયારાનું જીવન જીવે છે. કોઈ વખત મજૂરી કરવા પણ જાય છે. કોઈક દ્વિવસ ભી અંગવા પણ જાય છે. કોઈ વખત વેપાર કરવા પણ જાય છે. પરહેઠી રાજાએ નગરને ઘેરો ધાર્યો. લોકો નગરમાંથી નાસવા લાગ્યા. આપણા આ બારમા દેવલોકના દેવ પણ નગરમાંથી નીકળીને જંગલમાં જાય છે. એક પુત્રને ખાલી ઉપર લીધો, ભીજાને હાથ ઉપર લીધો, લીના માથે સામાનું એક પોટલું ઉપડાવ્યું, ભીજું પોટલું પોતાને માથે ઉપાડીને જંગલમાંથી પસાર થઈ, એક નાનકડા ગામમાં આવી વસે છે. મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ ધ્યા. પ્ર. ૨૪

ગ્રમાણે જગતમાં અનેક પ્રકારના ખેલ કરતી વખતે તેના અનમાં શું વિચારે છે ?

મેં તો બારમા કલ્પકો, હેવ મહા ઋષિવંત; અનુપમ સુખ વિલસું સદા, અફલુત એહ વિરવંત.

એ ચૈધા જે મેં કરી, તે સવિ કૌતુક કાજ; રંક પર્યાય ધારણુ કરી, તિતકો એ સવિ કાજ.

જેમ સુર એહ ચરિત્રને, નવિ ધરે મમતા લાવ; હીન લાવ પણ નવિ કરે, ચિંતવે નિજ સુર લાવ.

(સમાધિ વિચાર)

આપણા આ બારમા હેવલોકના હેવ પૃથ્વી ઉપર અનેક અવસ્થામાંથી પસાર થતાં અંદર વિચારે છે કે— ‘હું તો બારમા હેવલોકનો હેવ છું?’ આ પરિસ્થિતિમાંથી પસાર થતાં તેને હીનપણું નથી, અને ડાંડ આસક્તિ પણ નથી. કારણ કે હું બારમા હેવલોકનો મહાન સુખી હેવ છું તેથી મનમાં ધારણુ કરે છે. તેને પરિસ્થિતિનું સુખ-હુઃખ કે રાગ-દ્રોષ નથી.

આ ગ્રમાણે આપણે પણ પરવશપણે જ્યારે કર્મના કારણે અનેક વિચિત્ર સંલેગો ઉપસ્થિત થાય, તે વખતે તેમાં સુખ-હુઃખ કે રાગ-દ્રોષ ન કરતાં અંદરથી વિચારીએ કે— “લગવાન સીમંધરસવામી પરમાત્માએ કહું છે તે સુજખ હું સત્તાએ શુદ્ધ, સત્ત્વિદ્ધાનંહ સ્વરૂપ-અનંત સુખ અને આનંદનો પરમ લંડાર છું. અચિંત્ય શક્તિનો સ્વામી છું. કેવળજ્ઞાન આદિ અનંત શુણુ-લક્ષ્મીનો નિધાન છું.”

સુખ હમારો રૂપ હૈ, શોલિત જિંદગી સમાન;  
કેવળ લક્ષ્મી કો ધર્ણી, અનંત ગુણ નિધાન.

(સમાધિ વિચાર)

બારમા દેવલોકનો દેવ પૃથ્વી ઉપર વિચિત્ર સંઝે-  
ગોમાં હોવા છતાં તે અંહર તો સમજે છે કે હું તો  
બારમા દેવલોકનો દેવ છું. લીલા જોવા માટે પૃથ્વી ઉપર  
આવ્યો છું. તે રીતે આપણે પણું પ્રભુ સીમાંધરસવામીએ  
કહ્યું છે તેમ “અનંત સુખ, અચિત્ય શક્તિના સ્વામી  
છીએ. કર્મના કારણે અનેક વિચિત્ર સંઝેગો વરચે અત્યારે  
છીએ. પણ કર્મ બહલાય તેમ બહારની પરિસ્થિતિ પણું  
બહલાય છે. તેમાં મને સુખ-હુઃખ, ગમો-અણુગમો કે રાગ  
-દ્રોષ નથી. જ્ઞાન, દર્શાન માર્દ કાર્ય છે. હું તો આનંદમય  
આત્મા છું.” આ રીતે અંતરંગમાં નિશ્ચય દર્શિ ધારણું  
કરી જીવન જીવવાનું છે.

સુજ વાચક મિત્રો ! આ પ્રચોગ આપણે નિત્ય  
કરીશું. પ્રચોગમાં બતાવેલ સમવસરણુમાં બિરાજમાન પર-  
માત્માને આપણી નજર સામે રાખીશું, તેમની દેશના  
સાંભળી આપણે સમ્યગુ દર્શાન, સમ્યગુ જ્ઞાન, સમ્યગુ ચારિત્ર  
પ્રાપ્ત કરીએ છીએ અને ક્ષપક શ્રેણી આરોહણ કરી,  
કેવળજ્ઞાન સ્વરૂપ પ્રગટ કરીએ છીએ. આવી ભાવનાથી  
નિરંતર ભાવિત બનીશું તો ચ્યાઙ્કસ તે મુજબ જ સાક્ષાત્  
ભાવજિનેથર પાસે પહોંચવાનું અને કેવળજ્ઞાન સ્વરૂપ પ્રાપ્ત  
કરવાનું કારણું આપણું જીવનમાં ઉપસ્થિત થશો. અને

કારણું ઉપસ્થિત થતાં કાર્ય પણ અનવાતું જ છે. જે વિચાર નિરંતર અનમાં ધૂંયાય તે છેવટે ભૌતિક સ્વરૂપ પ્રગટ કરે જ છે. આપણી કલપનાશક્તિ વડે રચાતું ચિત્ર અવિષ્યમાં થનાર આપણી સ્થિતિનો નમૂનો છે. અને નમૂના પ્રમાણે આપણી અવિષ્યની સ્થિતિ રચાય છે. આઠલું જેયા પછી થીજા જન્મમાં ભગવાન સીમાધરસ્વામી આદિ (વિહરમાન તિર્થિંકરો) જ્યાં વિચારે છે, ત્યાં જન્મ થાય અને આઠ વર્ષની ઉંમરે આપણે હીક્ષા લઈએ અને પ્રભુ આજા સુજખ જીવન જીવીને આપણે કેવળજ્ઞાન સ્વભાવ પ્રગટ કરીએ તેના માટે આ જન્મમાં શું સાધના કરવી તે આપણે આ પ્રયોગ કરારો જેયું: ઉપરાંત આપણી મીક્ષમાર્ગની સાધના માટે સીમાધરસ્વામી પરમાત્મા પાસેથી આપણું અફલુત માર્ગદર્શિં મળ્યું. તે સુજખ આ જન્મમાં જ આપણે સાધના શરૂ કરીએ અને આ જન્મમાં જ આત્મઅનુભવ માપત કરી, પરમ આનંદના લોકતા અનીએ તે જ અહૃથર્થના. (આ કાળમાં અપેક્ષિત સામચી નહીં હોવાથી ક્ષપકશ્રેણી આરોહણ કરી શકવાતું સામર્થ્ય આપણામાં નથી. માટે તેવી ભાવનાથી તીવ્રપણે લાવિત અનબું.)

### સમવસરણું સ્તવન (શ્રી હેવચંડ્ર કૃત)

આજ ગઈતી હું સમવસરણમં, જિનવચનામૃત પીવા રે;  
શ્રી પરમેશ્વર વદન કમલ છધી, નિરખ નિરખ હરખવા રે. ૧

તीન ભુવન નાયક શુદ્ધાતમ, તત્ત્વામૃત રસ વુહું રે;  
સકલ લવિક વસુધાની લાણી, માર્ગ મન પિષુ હુહું રે. ૨  
મનમોહન જિનવર, મુજને,

અનુભવ પિયાલો હીધો રે;

પૂર્ણાનંદ અક્ષય અવિચલ રસ,

લક્ષ્મિ પવિત્ર થઈ પીધો રે. ૩

જ્ઞાનસુધા લાલીની લહેરે, અનાહિ વિભાવ વિસાયો રે;  
સમ્બ્યગુ જ્ઞાન સહજ અનુભવ રસ, શુચિ નિજ ઘોધ સમાર્થો રે. ૪  
લોલી સખીઓ એમ શું જેવો, મોહ મગન મત રાચો રે;  
દેવચંદ્ર પ્રભુ શું એક તાને, મિલવો તે સુખ સાચો રે. ૫

(આ સ્તવતના રચનારા શ્રી દેવચંદ્રજી મહારાજ  
આજે વિહુરમાન ભગવાનની પર્વતમાં કેવળજ્ઞાની ઇપે  
જિરાને છે. તેમને ડોટી ડોટી વંદના.)

પરમાત્મા સાથે સાચ્યા હૃદયથી પ્રેમ કરો.

\*પરમાત્મા પ્રત્યેનો સાચ્યો પ્રેમ, જ્ઞાનનું ઇપું  
ધારણું કરે છે.

જિન કથિત સાચ્યું જ્ઞાન પરમાત્મા પ્રત્યેના  
પ્રેમનું ઇપું ધારણું કરે છે.

પ્રેમ એ જ્ઞાનનો રસ છે અને જ્ઞાન એ પ્રેમની  
જ્યોતિ છે.

\* નેમ નેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સહુણ્ણા.

(૪૫ આગમની પૂજનમાંથી.)

ગ્રલુ ગ્રત્યેનો ગાઢ પ્રેમ જ્ઞાનને ઉત્પન્ન કરે છે.

અગાધ જ્ઞાન, પ્રેમને ઉત્પન્ન કરે છે.

તેનું અંતિમ ઝળ આ જન્મમાં આત્મ અનુભવ છે.

આવતા જન્મમાં આત્મસ્વરૂપનું પ્રગટી કરણું છે. (મોક્ષ છે.)

આ પ્રેમનું અમૃત અને જ્ઞાનનો હિંદુ મહારી પ્રાણી ભાગને મળો તેવી જ્ઞાનના.

પ્રચોગ નં. ૩૪ : ધ્યાનાલ્યાસ—

- (૧) મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા ભાવજિનેશ્વર પાસે પહોંચી શકાય તે માટેની સાધનાની દિવ્ય પ્રક્રિયા.
- (૨) કોઈ પણ વિચાર મનમાં ધૂંટાય છે એટલે કે ધર્મને છે ત્યારે ભૌતિક સ્વરૂપે પ્રગટ થાય છે.
- (૩) ધ્યાનની પ્રાર્થના—પૂર્વે તૈયારી લળ્યા મુજબ કરવી.
- (૪) ધ્યાન દ્વારા મહાવિદેહમાં પહોંચવું.
- (૫) સાક્ષાત્ ભાવ જિનેશ્વર સીમાંધરસ્વામીનું અતિશયે અને પ્રાતિહાર્ય ચુક્ત દર્શાન અને ધ્યાન કરવું.
- (૬) સમવસરણુમાં પ્રલુની દેશના સાંભળવા આપણા યથાચીન્ય સ્થાન ઉપર પહોંચવું.
- (૭) પદમાત્મા સીમાંધરસ્વામીની આ સભ્યગ્ર દર્શાનની દેશના. તેની આપણા ઉપર થયેલી અસર. “હું આત્મ

स्वरूप हुँ.” तेवा लावमां लावित अनी, आत्म ध्यान करी आनंद अनुसववो.

- (८) परमात्मानी चारित्र धर्म माटेनी ग्रेच्छा सांखणी आपणु हुद्य लेहाई जाय छे. चारित्रना हिंय परिष्ठुभिं लावित अनवुँ. चारित्र माटे प्रार्थना. चारित्र पहनी प्राप्ति.
- (९) व्यवहार चारित्रना लावमां निष्णात अनी, निश्चय चारित्रमां प्रत्येक आंतर्मुङ्गते सातमा अप्रभत्त गुण्ड-स्थानकना स्पर्शनी प्रक्रिया.
- (१०) क्षपकश्रेष्ठी आरोहणु माटेनी परमात्मानी देशना सांखणी अपूर्व लावेद्वास. क्षपकश्रेष्ठी आरोहणुनी हिंय तैयारी अने लावना.
- (११) परमात्मानी छेल्ली देशना—‘ हुँ आत्मचैतन्यरूप हुँ’ लावथी लावित अनीने शुद्ध व्यवहारनुँ पालन.
- (१२) हुद्यमां उव्य लावो धारणु करी, मित्रदेवना विमान द्वारा आपणु झूला स्थान उपर पाठा आवी, प्रार्थना करवी.
- (१३) बारमा हेवलोकना दृष्टांतथी ज्ञवनमां कर्मना कारणे उपनिषद थती विचित्र परिस्थिति वव्ये पछु ‘ हुँ चैतन्य आत्मा हुँ.’ ते लावथी लावित रहेवानें संकल्प.
- (१४) परमात्मानी देशनामांथी लावि ज्ञवनतुँ खानींग उरी वर्तमानमां साधनानें परम आनंद अनुसववो.

(૧૫) કહ્યું છે કે—કિયાએ કર્મ, પરિણામે ખંધ, ઉપયોગે ધર્મ અને ભાવનાએ મોક્ષ છે. મહાવિહેની ધ્યાન યાત્રા અનંત ઈળદાયી શ્રેષ્ઠ ભાવનાને પ્રકાર છે. મારા પ્રિય વાચક આત્મા !

પરમ પૂજય અધ્યાત્મયોગી પં. શ્રી લદ્રંકરવિજયજી મહારાજના રંગ વર્ષના સાંનિધ્ય દરમ્યાન ધ્યાન વિષયક મળેલ પ્રયોગો અને ધ્યાન અનુભવેની કેટલીક પ્રસાદી આ યુસ્તકમાં રજૂ કરી છે. ‘અનુભવ’ને શાખદોમાં ઉતારવાનું કામ કઢિન છે, છતાં તે માટે થતકિંચિત પ્રયત્ન કર્યો છે. તેમની પાસેથી મળેલ કેટલાક અફલુત ધ્યાન પ્રયોગો અને અનુભવો માત્ર વિશિષ્ટ સાધકને જ ખતાવી શકાય તેવા હોવાથી, આ ચંથમાં રજૂ કર્યો નથી. પૂજય ગુરમહારાજ અનુભવજ્ઞાની મહાપુરુષ હતા. તેમની કૃપાથી મળેલ તત્ત્વનો સર્વ યોગ આત્માઓને લાલ મળે તે હેતુથી આ ધ્યાનના પ્રયોગો અહીં રજૂ કર્યો છે. ખંતપૂર્વક, નિષ્ઠાવાન ખનીને પૂર્ણ શક્તા પૂર્વક જે કોઈ સાધક આત્મા આ માર્ગે પ્રયાણ કરશે, તેને હિંદુ અનુભવો થશે. તેનું જીવન વામતમાંથી વિશાટમાં ઉધીંકરણ પામશે. માટે મારા વહાલા સાધકો ! હું પ્રયાણ શરૂ કરે ગુનિત પંથે !

(૧) પ્રણિધ્યાન કરો કે પરમાત્માના ધ્યાન દ્વારા આત્મ સાક્ષાત્કાર આ જીવનમાં જ કરવો છે. આ જીવનમાં આત્મ અનુભવ દ્વારા સમ્યગુદ્દર્શન પ્રાપ્ત કરવું છે.

પછી શરૂ કરો (૨) પ્રવૃત્તિ. નિયમિત સાધના કરો.

અમ્ભ મહાસત્તા તમને જરૂર સહાય કરશે. નિષ્પાપૂર્વકના શુલ સંકલપો કાળજીમે અવશ્ય રેળદાચી બને છે. માટે પ્રમાણ છોડી ધ્યાન સાધવા માટેની ગ્રલૂપી શરૂ કરો.

**વિધન જ્યઃ**—વિધન આવે ત્યારે ઉરો નહીં. પરમાત્મા તમારી સહાયમાં છે. વિધન આવતાં, સાધના છોડી દેવી તે કાયરતું કામ છે. હિંય તરવો તમારી સહાયમાં છે. વિધન જ્ય અવશ્ય થશે. નિષ્પાપૂર્વક આગળ વધો. વિધનોને હઠવા સિવાય છૂટકો જ નથી. હિંમતથી આગળ વધો.

**(૪) સિદ્ધિ**—હેવ-ગુરુ કૃપાથી તમને અવશ્ય સિદ્ધિ મળશે. અંતપૂર્વકનો પ્રયત્ન સિદ્ધિ સુધી અવશ્ય પહોંચાડે છે. સિદ્ધિ મળતાં તૃપ્તિનો આનંદ અનુભવાશે. જીવન હિંય બની જશે.

**(૫) વિનિયોગ**—તમને સિદ્ધિ મળે ત્યારે ચોગ્ય પાત્રને તેની પ્રસાહી જરૂર આપો. જેમ તમારી ઉપર કોઈની કૃપા થવાથી તમને તત્ત્વ મળ્યું તેમ તમે પણ ચોગ્ય પાત્રને આપનો.

### સમાપ્તિ

સમાપ્તિ એટલે સમ્યગ્ર પ્રકારે ગ્રાપિત.

અહીં અંથ પૂરો થયો. સમાપ્તિ થઈ, એટલે સમ્યગ્ર પ્રકારે ગ્રાપિત થઈ. અહીં કામ પૂર્ણ ન થયું, અણું અહીં નવી (opening) શરૂઆત થઈ. આપણા જીવ-

નતું હિંય પાતું ખૂલ્યું. પરમાત્માના કેયાનની આરા-  
ધૂના દ્વારા આત્મસ્વરૂપનો અતુલવ અને આત્મ-  
સ્વરૂપની પ્રાસિ માટેનું નતું દ્વાર ખૂલ્યું.

આપણી આ નાનકડી જિંદગીમાં પરમાત્મા સાથે  
આપણા આત્માનો લાવસંબંધ બાંધવા માટે દેવગુરુ કૃપાથી  
ને કાંઈ આ બંધમાં લખાયું છે, તેમાં ને કાંઈ સાર્દાં છે.  
તે પૂજય પંન્યાસળુ મહારાજની કૃપાતું ક્રણ છે. ને કાંઈ  
ભૂલચૂક છે તે મારા છબ્બસ્થપણાના દોષના કારણે છે. પર-  
માત્મા સૌના છુદ્ધયમાં વસો ! સૌ લાવપૂર્વક પરમાત્મા.  
અરિહંતદેવને પેતાના છુદ્ધયમંહિરમાં પધરાવો ! અને પરમી-  
પકારી, પરમપૂજય, નમસ્કાર લાવ સંનિષ્ઠ, પંન્યાસળુ મહા-  
રાજ લદ્રંકરવિજયશુની આ લાવના સર્વત્ર જગત ઉપર  
પહેંચો તેવા લાવ સાથે આ બંધ પૂર્ણ થાય છે,

લિ. સંતોની ચરણુરજ સમાન.

ગિરનારજુ મહાતીર્થ,  
૨૦૪૨, વૈશાખ સુદ ૩  
તા. ૧૨-૫-૮૬

બાધુલાઈ કંડીવાળાના  
આ બંધના વાચકોને  
લાવસર્યો વંદન. પ્રણામ..

મેરી ધરણા ખસ એક ગ્રલુ, એક બાર તુઝે મિલ જાઉં મૈં;  
ધસ સેવકડી એક રગ રગકા, હો તાર તુમારે હાથોમૈં.



મહાવિહેઠ દ્યાનના પરિશિષ્ટો।

પરિશિષ્ટ—૨

શ્રી હેવલદ્રાચાર્ય વિરચીત શ્રી પાઢેનાથ  
ચરિત્રના આધારે

સર્વકર્મ પ્રણાશક

ધ્યાન વિધિ\*

૧. સમરણુ

પવિત્ર આચારવાળો, પવિત્ર શરીરવાળો અને સમાધિ  
( મન શાન્તિ )થી ચુકૃત એવો ધ્યાતા પ્રથમ પ્રવિત્ર જગ્યાએ  
સુખપૂર્વક પૂર્વભિસુખ અથવા ઉત્તરાભિસુખ એસે. તે પછી :-

(૧) પર્યાકાસન કરે.

---

\* શિવદત્ત નામનો મંત્રી છે. તેતું કુદુર્ભ દારિદ્ર અને રાજના  
અપમાનથી પીડાય છે. કુદુર્ભમાં ગણુ જળુ છે. મંત્રીની પત્ની,  
દૈવપ્રસાદ નામનો પુત્ર અને પુત્રની પત્ની.

શિવદત્તને એક વખત શાની સુનિનો યોગ થાય છે. તે પોતાના  
દારિદ્રાદ્ધિનાં કારણુ પૂછે છે. સુનિ તેઓનાં પૂર્વભવનું વૃત્તાન્ત ડલે છે  
અને જળુએ છે કે પૂર્વકૃત સાધારણુ કર્માના કારણે તમો બધાંને  
એક કુદુર્ભ મળ્યું છે. તમારા બધામાં દૈવપ્રસાદનું અંતરાયકર્મ બહુ  
લોારી છે તથા તમો બધાને આ દારિદ્ર અને અસન્માન ઉપરિથિત  
થણું છે.

(૨) પ્રસ્તુતમાં અતુપયોગી એવા મન, વચન અને કાચાના વ્યાપારનો નિરોધ કરે.

(૩) નાસિકાના અયલાગ ઉપર નેત્રોને સ્થિર કરે અથવા નેત્ર નિભીલિત (અંધ) રાખો.

(૪) શાસ અને નિઃશાસને મંદ કરે.

(૫) પોતાના દુશ્શરિતની ગર્હી કરે

(૬) સર્વ પ્રાણીઓને અમાવે.

(૭) પ્રમાદને ફર કરે.

(૮) શ્રી જિનેશ્વર ભગવંતના ધ્યાન માટે એકચિત્વાળો થાય.

(૯) શ્રી ગણુધર ભગવંતોનું સમરણ કરે.

(૧૦) શ્રી સહસ્રાંશોનું સમરણ કરે.

## ૨. વિચિંતન

(અ) તે પછી આ રીતે વિચિંતન કરે :

(૧) સમવસરણ માટેની ભૂમિ વાયુકુમારો શુદ્ધ કરે છે.

(૨) મેધકુમારો સિંચે છે.

દૈવપ્રસાદ મુનિના ચરણોમાં પડે છે અને તે કર્મને જલદીથી અપાવબાનાં ઉપાયને પૂછે છે. તે વખતે મુનિ ભગવંત તેને ચોંધ જાળીને આ ધ્યાનવિધિ દર્શાવે છે.

આ ધ્યાનવિધિ અશેષ કર્મવૃક્ષોને મૂળથી ઉઘેડી નાખવામાં નયંડ વાયુ સમાન છે.

- (૩) અતુદેવતાઓ જનુ પર્યંત પુંયો વરસાવે છે.
- (૪) વૈમાનિક દેવતાઓ ભષિયોને રમણીય પ્રાકાર અનાવે છે.
- (૫) જ્યોતિષ્ક દેવતાઓ સોનાને રમણીય પ્રાકાર અનાવે છે.
- (૬) ભુવનપતિ દેવતાઓ ઢ્રાપાને રમણીય પ્રાકાર અનાવે છે.

(આ) પછી તે જ ભૂમિ અનુકૂળ :-

- (૧) પાદ્યીડ અને ત્રણુ છત્રથી ચુક્તા એવું પ્રવર સિંહાસન,
- (૨) લામંડલ.
- (૩) ચૈત્યવૃક્ષ,
- (૪) તોરણો, વાપીઓ, પતાકાઓ વગેરે અને
- (૫) ચક્રધ્વજ, સિંહધ્વજ, ધર્મધ્વજ અને અન્ય ધ્વજાઓની પતાકાઓથી શોલી રહી છે, એમ ચિંતિતે.
- (ઇ) તે પછી શ્રી જિનેન્દ્ર પરમાત્માનું આ રીતે વિચિંતન કરે : -

- (૧) પ્રભુ જ્યંતરોએ રચેલા સુવર્ણકુમળોની કર્ણિકાના મધ્યમાં ચરણુ ચુગલને મૂકે છે.
- (૨) દેવો પ્રભુને ચામર વીંજી રહ્યા છે અને 'જ્ય જ્ય' શાખણી ઘોષણા કરી રહ્યા છે.

(૩) પ્રભુની આગળ ચાલતા ઈન્ડ્રો માર્ગમાં રહેલા લોકોને બાજુએ કરી રહ્યા છે.

(૪) પ્રભુ પૂર્વે દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી રહ્યા છે.

(૫) દેવતાઓના વાળુંતોના દેવનિઃશ્વાસ સમૂહથી આકાશ લરાઈ ગયું છે.

(૬) તે પછી આ રીતે વિચિંતન કરે :-

(૧) અગવાન સિંહાસન ઉપર પૂર્વાભિમુખ એસે છે.

(૨) અન્ય ત્રણું દિશાઓમાં દેવતાઓએ રચેલું અગવાનનું પ્રતિકર્ષય છે.

(૩) હર્ષથી પુલકિત ઈન્ડ્રો, હાથવડે રતનના દંડવાળા શ્વેત ચામરો વીંજી રહ્યા છે.

(૪) પ્રભુના પદકમલને, ચારે દિશાઓના ખૂણાઓમાં રહેલા અન્ય જીવો સેવી રહ્યા છે (તેઓ પ્રભુના પગ પાસે એડા છે).

(૫) વિવિધ પ્રકારના તિર્યંચીના સમૂહો અનીજ વલયમાં છે. તેઓએ પરેસ્પર વિશે વૈરનો ત્યાગ કર્યો છે. તેઓ પ્રભુના પદકમલની પચ્ચાસના કરી રહ્યા છે (તેઓ અનીજ વલયમાં પ્રભુ પ્રત્યેના લક્ષ્ણલાવ-પૂર્વક રહ્યા છે).

### ૩. ધ્યાન

(૧) તે પછી અગવાનનું આ રીતે ધ્યાન કરે.

- (૧) એકી સાથે એકજ કાળે ઉદ્ઘયને પામેલ બાર  
સૂચોના સમૂહ સમાન દેહીભ્યમાન સર્વ અંગોવાળા,
- (૨) દેવેન્દ્રો અને અસુરેન્દ્રોના સમૂહથી ચુક્તા એવા  
ત્રણે લોકને પોતાના દૃપથી જીતનારા,
- (૩) માહવૃક્ષનો સમૂહ નાશ કરનારા,
- (૪) રાગરૂપ મહારાગનો નાશ કરનારા,
- (૫) કોધરૂપ અજિનને શમાવનારા,
- (૬) સર્વ દેખોના અવંદ્ય ઔષધરૂપ,
- (૭) અવિનાશી એવા કેવલજાનવડે અશોષ વસ્તુએના  
કરમાર્થને પ્રગટ કરનારા,
- (૮) હુસ્તર ભત્રસમુક્રમાં પડતા જીવોનો ઉદ્ધાર કરવા  
માટેના સામર્થ્યવાળા,
- (૯) ત્રણે લોકના મસ્તકમણિસમાન, ત્રણે લોકના ગુરુ,  
ત્રણે લોક જેમના ચરણોમાં નસે છે એવા, ત્રણે લોકાનો  
ઉદ્ધાર કરનાર જેમનું માહાત્મ્ય છે એવા,
- (૧૦) કલ્પવૃક્ષ અને છત્રત્રય નીચે સિંહાસન પર  
વિરાજમાન,
- (૧૧) સરવોના ( જીવોના ) ઉપકારમાં નિરત, કલ્યાણ-  
કારક ધર્મને કહેતા,
- (૧૨) લોકના સર્વ પાપોનો પ્રણાશ કરતા, ભંધ  
જીવોને માટે સર્વ સંપત્તિના ભૂળ કારણ,

(૧૩) સર્વ લક્ષણોથી સંપુર્ણ, સર્વોત્તમ પુષ્ટયાતુખાંધી  
પુષ્ટયથી નિર્ભિત હેઠવાળા,

(૧૪) ધ્યાન કરનારાઓનાં નિર્વાણનું સાધન, પરમ  
ચોગીઓના મનને રંજિત કરનારા (ચોગીઓના મનમાં  
રમનારા),

(૧૫) જરૂર, જરા અને રોગથી રહિત, સિદ્ધ જેવા  
હેવા છતાં પણ જાણે ધર્મ માટે જ કાયામાં રહેલા,

(૧૬) હિમ, હાર કે ગાયના હૃદ જેવા નિર્મલ,

(૧૭) કર્મ સમૂહાનો નાશ કરનારા,

આ રીતે ધ્યાન નિશ્ચિલ ચિત્તથી ત્યાં સુધી કરવું કે  
જ્યાં સુધી પરમાત્મા જાણે સાક્ષાત્ હોય તેવા લાસે.

તે પછી પોતાના જનુ (ધૂંટણ) ભૂમિ ઉપર રાખવા.  
અત્યંત લક્ષ્મિપૂર્વક નમીલા શીર્ષ વડે પરમાત્માના ચરણ-  
કુમલનો સ્પર્શ કરવો. તે વખતે આત્મા પરમાત્માના શરણમાં  
છે, એમ ભાવવું.



योगशास्त्र नवमो प्रकाश

रूपस्थध्यानम्



मोक्षश्रीसंमुखीनस्य विध्वस्ताखिलकर्मणः ॥  
चतुर्मुखस्य निःशेषभुवनाऽभयपदायिनः ॥ १ ॥  
इंदुमंडलसंकाशच्छ्रुतत्रितयशालिनः ॥  
लसद्भामंडलाभोगविडंबितविवस्तः ॥ २ ॥  
दिव्यदुंदुभिनिर्घोषगीतसाग्राज्यसंपदः ॥  
रणदूद्विरेकज्ञंकारमुखराऽशोकशोभिनः ॥ ३ ॥  
सिंहासननिषणस्य वीज्यमानस्य चामरः ॥  
सुरासुरशिरोरत्नदीप्तपादनखद्युतेः ॥ ४ ॥  
दिव्यपुष्पोत्कराऽकार्णसंकार्णपरिषद्भुवः ॥  
उत्कंधरं भृगकुलैः पीयमानकलध्वनेः ॥ ५ ॥  
शांतवैरेभसिंहादिसमुपासितसंनिधेः ॥  
प्रभोः समवसरणस्थितम्य परमेष्ठिनः ॥ ६ ॥  
सर्वातिशययुक्तस्य केवलज्ञानभाख्यत ॥  
अर्हतो रूपमालंब्य ध्यानं रूपस्थमुच्यते ॥ ७ ॥

सप्तमिःकुलकम्

ध्या. प्र. २५

મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરવાની હવે તૈયારી છે, સધાતી ક્રમાનો જેમણે વિનાશ કર્યો છે, દેશના દેતી વખતે (હેવેએ કરેલા વણુ પ્રતિજ્ઞાયોથી) ચાર સુખ સહિત છે, વણુ ભુવનના સર્વ જીવાને અસર્વાન આપી રહ્યા છે, (કોઈ જીવાને નહિ મારવા તેવી દેશના આપનારા) ચંદ્ર મંડળ સદશ ઉજવળ વણુ છતો જેમના મસ્તક પર શોલી રહ્યાં છે, સૂર્ય મંડળની પ્રભાને વિડંબન કરતું લામંડળ જેમની પછાડી અણણાટ કરી રહ્યું છે, દ્વિંદ્ય દુંહલિ વાળુંતના શાખદો થઈ રહ્યા છે, ગીત ગાનની સંપદાનું સાઓન્ય વતૌઈ રહ્યું છે, શાખ કરતા બ્રમરેના અંકારથી અશોક વૃક્ષ વાચાલિત થયો હોય તેમ શોલી રહ્યો છે, વચ્ચમાં સિંહાસન ઉપર તીર્થંકર મહારાજ ધીરાનેલા છે, એ બાળુ ચામરે વીંઆઈ રહ્યાં છે, નમસ્કાર કરતા હેવો અને દાનવોના મુકુટના રત્નોથી પગના નાખેની કાંતિ પ્રદીપ્ત થઈ રહી છે, દ્વિષ્ય પુષ્પોના સમૂહોથી પર્વતાની ભૂમિકા સંકીર્ણ થઈ ગઈ છે, ઉચ્ચી ડાકો કરીને મૃગાદિ પશુઓના સમૃહો જેની મનહર ધ્વનિતું પાન કરી રહ્યા, સિંહ તથા હાથી પ્રમુખ વેર સ્વભાવવાળાં પ્રાણ્યિઓ પોતાનું વેર શાંત કરી નશુકની બાળુમાં ઘેઠેલાં છે, સર્વ અતિશયોથી પરિપૂર્ણ, કેવળ જાનથી શોલતા અને સમવસરણુમાં રહેલા, તે પરમેષ્ઠિ અરિહંતના રૂપનું આવી રીતે આલાંખન લઈ જે ધ્યાન કરવું. તેને રૂપસ્થ ધ્યાન કર્ણે છે. ૧-૭.

## પ્રકારાંતરે રૂપસ્થ ધ્યાન

રાગદ્વેષમહામોહવિકારૈકલંકિતમ् ।

શાંતં કાંતં મનોહારિ સર્વલક્ષણલક્ષિતં ॥ ૮ ॥

તીર્થિકૈરપરિજ્ઞાતયોગમુદ્રામનોરમમ् ॥

અક્ષણોરમંદમાનંદનિસ્યંદે દદદૃભૂતં ॥ ૯ ॥

જિનેદ્રપ્રતિમારૂપમપિ નિર્મલમાનસઃ ॥

નિર્મિમેષવદ્યા ધ્યાયન્ રૂપસ્થધ્યાનવાન્ ભવેત् ॥ ૧૦ ॥

ત્રિભિર્વિશેષકમ्

રાગ, દ્વેષ અને મહામોહ અજ્ઞાનાદિ વિકારેના કલંક રહિત, શાંત, કાંત, મનહર, સર્વ ઉત્તમ લક્ષ્ણોથી એણાખ્યાયેલ અન્ય દર્શાનકારોએ નહિ જાણેલ, યોગ મુદ્રા (ધ્યાન મુદ્રા)ની મનોહરતાને ધારણુ કરનાર, આંખને મહાન આનંદ અને અહભૂત અચ્યપળતાને આપનાર, જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું, નિર્મલ મન કરી નિર્મિષોન્મેષ રહિત (ખુલ્લી આંખ રાખી) એક દષ્ટિએ ધ્યાન કરનાર, રૂપસ્થ ધ્યાનવાન્ કહેવાય છે. ૮, ૯, ૧૦.

**વિવેચન**—જિનેશ્વર ભગવાનની શાંત અને આનંદિ મૂર્તિના સન્મુખ, ખુલ્લી આંખ રાખી, એક દષ્ટિથી જોઈ રહેણું, આંખ મીંચવી કે હલાવવી નહીં, તેમ કરતાં શરીરનું પણ ભાન ભૂલી જઈ એક નવીન દશામાં પ્રવેશ કરાય છે. જેમાં અપુર્વ આનંદ અને કર્મની નિર્જિશ થાય છે. તે દશાવાગાને રૂપસ્થ ધ્યાનવાન કહે છે. ગમે તે

જાતનું આલંબન હોય પણ, તેમાં કાંઈ પણ આત્મિક શુદ્ધ  
પ્રગટ થાય તો, તેને તે આલંબન નામનું ધ્યાન કહેવાય છે.

### રૂપસ્થ ધ્યાનનું ફળ

યોગી ચાડ્મ્યાસયોગેન તન્મયત્વમુપાગતઃ ॥  
સર્વજ્ઞીભૂતમાત્માનવલોકયતિ સ્ફુર્તં ॥ ૧૧ ॥  
હૃદયમુદ્ધુરમધ્યે ધીમતામુલ્લસંતુ ।  
પ્રચિતભવશતોત્થકલેશનિર્ણિશહેતો: ॥ ૮૧ ॥

આ પ્રમાણે મુખ્ય ગણુધરે પ્રગટ કરેલા, પ્રવચન રૂપ  
સમુદ્રથી ઉદ્ધાર કરેલા આ તત્ત્વરૂપ રહનો, અનેક સેંકણેં મે  
લવથી ઉત્પન્ન થયેલા કલેશનો નાશ કરવા માટે, યુદ્ધિમાન  
મનુષ્યોના હૃદય દ્વારા આરિસામાં ઉલ્લાસ પામ્યા. ૮૧.



યાહિનીમહતરાસૂનું આચાર્ય શ્રી હરિલદસૂરિએ  
 ‘પોડશક પ્રકરણુ’માં નિરૂપિત કરેલ  
 પરમાત્માનું ધ્યાન

સર્વ ગ્રાણીઓને હિતકર, જેના શરીરાહિના સૌન્હયેને  
 કોઈ ઉપમા નથી એવા અનુપમ, અનેક અતિથ્યોથી  
 સંપત્તન, આમધૌષધિ વગેરે નાના પ્રકારની લખિયોથી  
 સહિત, સમવસરણુમાં સાતિશય વાણીવડે દેશના આપતા.  
 દેવનિર્મિત સિંહાસન પર વિરાજમાન, છત્રત્રય અને કલ્પ-  
 વૃક્ષ નીચે રહેલા. દેશના દ્વારા સર્વ સત્ત્વોના પરમ અર્થ  
 -મોક્ષ માટે પ્રવૃત્ત, અત્યંત મનોહર, શારીરિક અને માન-  
 સિક પીડાઓનું પરમ ઔષધ, સર્વ સત્ત્વિભાગું અનુપડત  
 અવન્ધય થીજ, ચકાદિ લક્ષણોથી ચુક્ત, સર્વોત્તમ પુષ્યના  
 પરમાણુઓથી અનેલા, પૃથ્વી પર ભણ્યોને માટે નિવોણુનું  
 પરમ સાધન, અસાધારણ, માહાત્મ્યવાળા, દેવો અને સિદ્ધ  
 ચોણીઓ ( વિદ્યામંત્રાહિસિદ્ધો )ને પણ વંદનીય અને ‘વરેષ્ય’  
 શર્ષદ વડે શ્રી જિનેન્દ્રના ઇપનું વિધિપૂર્વક ધ્યાન કરવું જોઈએ.

મિથ વાચક મિત્રો :—

આ પુરસ્તકમાં લખેલ પ્રયોગો શીધુ કુળહાથી  
કરવા માટે.

(૧) તમારો સંકલ્પ સ્પષ્ટ અને દઢ કરો. દા. ત.  
પ્રયોગ નં. ૧ ની સાધના વખતે ચિંતા, લય, શોક,  
અશાંતિ, ટેન્શનમાંથી છૂટા થવું અને સુખ, શાંતિ, આનંદ  
અને નિર્ભયતા મેળવવી જ તેવો સંકલ્પ દઢપણે કરવો.

પ્રયોગ નં. ૨ ની સાધના વખતે પાપવૃત્તિએ, મહિન  
વાસનાએ, હુણ લાવોનો નાશ કરવો જ છે તેવો સંકલ્પ  
રાખવો.

પ્રયોગ નં. ૫ વખતે પરમાત્માની દિવ્ય શક્તિનો  
પ્રવાહ મારામાં વહેતો રાખીને મારે દિવ્ય જીવન, ગ્રેમ-  
કુણ્ણામય, સુખ-આનંદ અને શક્તિથી પરિપૂર્ણ, ગુણ-  
સમૃદ્ધિથી ભરપૂર મારું જીવન બનાવવું જ છે. એવો  
સંકલ્પ કરવો. દરેક પ્રયોગને અનુકૂળ હોય તેવા હેતુ  
સુજબ સંકલ્પ કરવા.

(૨) પરમાત્માની અચિંત્ય શક્તિ ઉપર નિષ્ઠાપૂર્વક  
દઢ શર્દી રાખવી.

(૩) પ્રયોગ સુજબતું ચિત્ર સ્પષ્ટ રાખો. આ માત્રસ-  
ચિત્રમાં સર્જનાત્મક દિવ્ય શક્તિ છે.

(૪) પ્રયોગમાં બની રહેલ વસ્તુને વર્ત્માન કાળમાં  
બનતી જુએ. ( ભવિષ્યમાં આવું બનશો તેમ નહીં.)

(૫) આશ્ર્યકારક રીતે તર્ફે બહલાઈ ગયા છો તેવા  
અનુભવો.

(૬) તમારા જીવનના ભૂતકાળને ભૂલી જાઓ. ગઈ કાલને યાદ કરી નિરાશા ન બનો. આજથી નવું હિંય જીવન શરૂ કરો.

(૭) ખુલ્લા મનથી, છુદ્ધયના લાવપૂર્વક, નઅલાવે, પ્રેમપૂર્વક, દદ શ્રદ્ધા સાથે, શાંત ચિંતા, આનંદમય રીતે, તીવ્ર લાવે ધ્યાન કરો.

(૮) સંકદ્વય શક્તિસાંજીવિનાત્મક દર્શાન, પરમાત્મા ઉપરની દદ શ્રદ્ધા અને ધ્યાનની તીવ્રતા તમારા માટે કેટલું આશ્ર્યજનક પરિણામ લાવી શકે છે તેનો પ્રત્યક્ષ અનુભવ કરો.

(૯) પરમાત્મા તરફથી મળેલી સહાય માટે આત્મકરણપૂર્વક પરમાત્માને નમસ્કાર કરો. પરમાત્મા ઉપર શ્રદ્ધા ઉન્નિત કરો. પ્રભુ-ભક્તિથી સલર જીવન જીવો.

(૧૦) તમે સુંદર કલાકાર ( artist ) છો, તમારું જીવન તે જ તમારી ડળા ( art ) છે. પ્રત્યેક પણ નવસર્જન કરો. ધ્યાન પ્રયોગોની નિયમિત સાધના કરો. પરમાત્માની પ્રાપ્તિ થશો. સત્ય સંકદ્વપૂર્વકની સાધના આત્મસાક્ષાત્કાર સુધી પહોંચાડશો. તમારું જીવન અનેકને હિતકારક ઘનશો. જૈન શાસનની હિંય પ્રલાવના કરી શકશો.

(૧૧) દદ વિશ્વાસ રાખીને શ્રીપાલ અને મયણુની જેમ જીવનની રંગભૂમિ ઉપર આવતા પ્રત્યેક પ્રસંગનું જિનશાસનની દાખિએ મૂલ્યાંકન કરો. જિન આજ્ઞા મુજબ સત્યના માર્ગે ચાલો. જ્વલંત સરણતા ( radiant success ) તમારા હાથમાં જ છે. સાધના નિયમિત ચાલુ રાખો.

પરમાત્માને જીવનના ડેન્ડ્ર સ્થાનમાં રાખો. પછી  
જુઓ કે કેવું દિવ્ય પરિણામ તમે મેળવી શકો છો.

(૧૨) વિદ્ધથી ઉરો નહિ, વિદ્ધનો પણ વિકાસ માટે  
અની જરૂરો. દિવ્ય સંકલ્પને પૂર્ણ કરવા માટે મળતી બધી  
તકેને જિન-કથિત માર્ગો ચાલોને સાર્થક કરો,

(૧૩) કોઈનું પડાવી લેવાના, કોઈનું જય તો તે  
મને મળો, ધીનને પાછળ પાડીને હું આગળ આવું. આવા  
કૂલિષ્ટ વિચારો તથા અમૈત્રી, કૌધ, ધૂણા, ઈંધો, અસૂયા.  
ધિક્કાર, સ્વાર્થભરેલી માયાવી વૃત્તિ, મલિન વાસનાઓ  
— આ બધાં કાર્ય સિદ્ધિના માર્ગમાં પડેલા આડા પથથરો  
છે. આવા મલિન ભાવથી હુર રહો.

(૧૪) જિનેશ્વરની આજા મુજબનું જીવન અનાવવા  
પ્રયત્નશીલ રહો.

(૧૫) આ પુસ્તક અધ્યાત્મ યોગી પૂ. પંન્યાસલુ  
મહારાજ શ્રી ભરતંકરવિજયલુ તરફથી મળેલ અણુમોદ  
રતોનામાં તમને સહભાગી અનાવવા લખવામાં આવ્યું છે.  
તે મુજબ સાધના કરો. આત્મ સમૃદ્ધિના અનંત અનનાના  
માલિક અનો. સૌનું શુલ અને કલ્યાણ થાઓ.

સહસાવન મધ્યે,

ગિરનારણ મહાતીર્થ,  
સં. ૨૦૪૩ ના ક્રાગણુ વહ ૧૨  
ગુરુવાર, તા. ૨૬ માર્ચ ૧૯૮૭


લિ.

સંતોની ચરણુરણ સમાન  
ભાણુલાઈ કરીલાવાના;  
વાંચ્યકોને ભાવસર્યો વંદન.

જવાંત સર્કાર ( Redient  
Success )ની ચાલી

- (૧) તમારે આ જનમાં અને  
આવતા જનમાં કેવા ઘનવું  
છે. તમારે શું જેઠાં છે તેનો  
નાંધ કરો. અને સંકલ્પ કરો.
- (૨) તમે નહીં કરેલ સંકલ્પમાં વાર-  
વાર દેરક્ષાર ન કરો.
- (૩) પરમાત્માના હિંય પ્રભાવે તમારો  
સંકલ્પ અવશ્ય પૂર્ણ થયો તેની  
દેખ અંદ્રા રાગો. મલ્લ ઉપરની  
અંદ્રા સંકલ્પમાં પ્રાણ પૂરે છે.
- (૪) તમારો સંકલ્પ મુજબનું દ્રશ્ય  
ધ્યાનમાં તમારી સમક્ષ ઉપ-  
સ્થિત કરો.
- (૫) તે દ્રશ્યમાં ધ્યાન સ્થીર કરો.
- (૬) તમારો સંકલ્પ વર્ત્તમાનકાળમાં  
સિદ્ધ થતો ધ્યાનમાં જુગ્યો.
- (૭) તમારો સંકલ્પ પૂર્ણ થયો હોય  
તેવા ભાવમાં જીવન જીવવું શરૂ  
કરો. તમે એક માહાન કલાકાર  
છો. તમારું જીવન તેજ તમારી  
કળા છો.

દી. બાણુભાઈ કડીવાળા



કૃંટો સૌંદર્ય પં. શ્રી પૂર્ણાંગ વિજયનુ મ.સા.

મહાવિદ્યે ક્ષોબમાં વીચરતા  
પતીછાયોં અતીશાયોથી પુકા  
શ્રી સિમંધર સ્વામી પરમાત્માનું દ્યાન